


# ગુણાર્થાન વિવેચન

(ધવલા સટિલ)



૧૪. અયોગકેવળી

૧૩. સયોગકેવળી

૧૨. ક્ષીણમોહ

૧૧. ઉપરાંતમોહ

૧૦. સ્ફુરમસાંપરાય

૯. અનિવૃત્તિકરણ

૮. અપૂર્વકરણ

૭. અપ્રમતાવિરત

૬. પ્રમતાવિરત

૫. દેશવિરત

૪. અવિસ્તસમ્યકૃત્વ

૩. સમ્યક્મિદ્યાત્મ (મિશ્ર)

૨. સાસાહનસમ્યકૃત્વ

૧. વિદ્યાત્

ॐ नमः सिद्धेश्वरोः

००८,६९ : (३५७) એકાંક્ષા લાંડ એરિયા +

००८,८ : (३५७) એકાંક્ષા કુલાં

००८,८ : (३५७) એકાંક્ષા લાંડ એરિયા, જાયપુર - ३०२०१५

## ગુણવિસ્તાર - વિવેચન

(ઘરલા સહિત)

લેખક

બ્ર. યશપાલજી જૈન,

M. A., જયપુર

: પઢીનિ પ્રેરણ કાર્ય

દક્ષાંત્ર કાર્ય

વિસ્તિરણ

: સંપાદક :

પંડિતજી રતનચંદ ભારિલલ

શાસ્ત્રી, ન્યાયિક, M. A., B. Ed.

પ્રાચાર્ય શ્રી ટોડરમલ ડિ. જૈન સિદ્ધાંત મહાવિદ્યાલય, જયપુર

: અનુવાદક :

હિનેજ્ઝ કુંપરજીભાઈ વોરા, B.com.

દહીસર, મુંબઈ

: પ્રકાશક :

નાનીશ્રદ્ધા પ્રકાશન

દહીસર, મુંબઈ - ૪૦૦૦૬૮

તથા

પંડિતજી ટોડરમલ સ્મારક ટ્રસ્ટ, જયપુર

એ - ૪, બાપુનગર, જયપુર (રાજસ્થાન) ૩૦૨૦૧૫

ફોન: (૦૧૪૧) ૨૭૦૫૫૮૧, ૨૭૦૭૪૫૮.

ફેક્સ: ૨૭૦૪૧૨૭. Email: ptstjaipur@yahoo.com

◆ પ્રથમ આઠ સંસ્કરણ (હીન્ડી) : ₹૩,૫૦૦  
 નવમું સંસ્કરણ (ગુજરાતી) : ₹૧,૦૦૦  
 (તા.૨૯-૪-૨૦૦૬, વેશાખ સુદ ૨, ગુરુવેદ જન્મયાતી) ₹૪,૫૦૦

પડતર કિંમત : રૂ. ૬૦/=  
 વેચાણ કિંમત : રૂ. ૨૫/=

લેજર ટાઇપ સેટિંગ :

પ્રેરક કોમ્પ્યુટર  
 બોરીવલી

પ્રાપ્તિસ્થાન :

૧) નમ્ર શાદ્યા પ્રકાશન (હિન્દી કે. વોરા)

૨૦૨, શારદા કો. ઓ. હા. સોસાયટી, ચુનાભાઈ,  
 એસ. એન. હુલે રોડ, દાહિસર (ઘસ્ટ), મુંબઈ - ૪૦૦ ૦૬૮.  
 ફોન - ૦૨૨ ૨૮૬૫ ૮૬૦૫ મો. ૨૪૨૦૮ ૪૫૧૫.

૨) પૂ. કાન્નશુસ્વામી સ્મારક ટ્રસ્ટ

કાન્નશુસ્વામી, લામ રોડ, દેવલાલી,  
 નાસિક, મહારાષ્ટ્ર - ૪૨૨ ૪૦૧.  
 ફોન : (૧૨૪૫) ૨૪૬૧૦૪૪

૩) પંડિત ટોડરમલ સ્મારક ટ્રસ્ટ

ઓ-૪, નાધૂનગાર, જયપુર (રાજ્યસાન) - ૩૦૨૦૧૫.  
 ફોન : (૦૧૪૧) ૨૭૦૫૪૮૧, ૨૭૦૭૫૪૮

મુખ્યક :

કે. ટી. પ્રિન્ટર્સ (નાનાનાન) સ્ટ્રીટ, ડાલોમાં, ત - ૩૪  
 ૩૪, જયલિંદ કોલોની,  
 એસ. વી. રોડ, બોરીવલી (પૂર્વ),  
 મુંબઈ - ૪૦૦ ૦૬૬.  
 ફોન - (૦૨૨) ૨૮૬૫ ૬૫૪૫ / ૨૮૬૪ ૮૩૧૦

## પ્રકાશકીય

(નવમું સંસ્કરણ)

ગુણસ્થાન પ્રવેશિકાનું આ સંશોધિત તથા સંવધિત ઇપ ગુણસ્થાન - વિવેચનના આઠ હીન્ડી સંસ્કરણ કર્યા પછી (ગુજરાતીનું આ પ્રથમ) સંસ્કરણ કરતા અમોને અત્યંત પ્રસન્નતાનો અનુભવ થઈ રહ્યો છે.

જ્યાપુરમાં આચ્યોજુત આદ્યાત્મિક શિક્ષણ શિબિરના અપસર પર કરણાનુયોગનું પ્રારંભિક જ્ઞાન કરાવવાના ઉદેશથી ગોમ્મટસારના ગુણસ્થાન પ્રકરણના વર્ગો બ્ર. યશપાલજી દ્વારા લેવાય છે. આ વર્ગોમાં બેસવાવાળા વિદ્યાર્થીઓને આ વિષય સમજવામાં ઘણી મુશ્કેલી પડતી હતી, તેને દ્વાનમાં રાખી બ્ર. યશપાલજીએ આ ફૂટિ તૈયાર કરી છે.

બ્ર. યશપાલજી ચારે અનુયોગોના સમતુલીત અધ્યેતા તથા પૈરાગ્ય રસથી ભીજાચેલા હૃદયવાળા આત્માર્થી વિદ્રોધન છે. શ્રી ટોડરમલ સ્મારક ભવનમાં સંચાલિત થવાવાળી પ્રત્યેક ગતિવિધિઓમાં આપનું સકીય યોગદાન રહે છે. ટ્રસ્ટના અનુરોધથી આપ પ્રવચનાર્થી અન્યત્ર પણ જાઓ છો અને પંડિત ટોડરમલજી દ્વારા લખેલ ટીકા સમ્યક્ઝજાન ચંદ્રિકાનું સંપાદન કાર્ય અત્યંત શ્રમ તથા એકાગ્રતાપૂર્વક કર્યું છે તથા સંપાદન કાર્યથી પ્રાણ અનુભવનો ભરપુર ઉપયોગ પ્રસ્તુત ફૂતિની રચનામાં કર્યો છે. કરણાનુયોગ ફૂતિને માટે ટ્રસ્ટ આપનો હૃદયથી આભારી છે.

ગુણસ્થાન - પ્રવેશિકાનું સંશોધન કરી જ્યારે વિસ્તૃત ઇપ પ્રદાન કરવામાં આવ્યું, ત્યારે તેના સંપાદનની જરૂરિયાત જગાઈ. તેને માટે પં. રતનચંદજી ભારિલ્લથી જિવેદન કર્યું, તેથી તેઓએ પોતાના લેખનાઈ કાર્યોની પ્રતિકુળતાઓમાં પણ સમય કાઢી તેને સંપાદિત કરી સુય્યવસ્તિથત કર્યું છે, તેથી ટ્રસ્ટ તેમનો હાઈક આભારી છે.

આ પુસ્તકની લેજર ટાઇપ સેટીંગ પ્રેરક કોમ્પ્યુટર દ્વારા તથા પ્રીટિંગ ડે. ટી. પ્રીન્ટસ, બોરીવલી દ્વારા કરવામાં આવેલ છે. તે માટે ટ્રસ્ટ આપનો હૃદયથી આભાર માને છે.

પ્રથમ ગુજરાતી અનુભાવીત આ સંસ્કરણ દ્વારા આપ સર્વે પોતાના પરિણામોને ઓળખી આત્મકલ્યાણ કરો એ જ મંગલ ભાવના.....

વિમળાબેન ડે. વોરા

અદ્યક્ષ

નામશ્રદ્ધા પ્રકાશન, દહીસર.

ડૉ હુકમચંદજી ભારીલ્લ

મહામંત્રી

શ્રી ટોડરમલ સ્મારક ટ્રસ્ટ, જ્યાપુર.

## સંપાદકીય

અદ્યાત્મગર્લિત આગમના અભ્યાસમાં જુથિ રાખવાવાળા શ્રીયુત બ્ર. ચશપાલજી જેણ ગત અનેક વર્ષોથી કરણાનુયોગનો વિષય ગુણસ્થાનનું સામાન્ય જ્ઞાન કરાવવા માટે શિક્ષિણ શિલ્પિરોમાં પ્રોફ્લ વર્ગો લેતા રહ્યા છે. જેમ - જેમ આપના આ વર્ગો લોકપ્રિય થતા ગયા, તેમ-તેમ આપનો ઉત્સાહ વધતો ગયો. ફળસ્વરૂપે આપે એક કરત્ત પાનાની પુસ્તક પણ ગુણસ્થાન પ્રવેશિકા નામથી લખીને પ્રકાશિત કરાવી.

આગમના અદ્યાપનથી વિષયનું પરિમાર્જન તો થયું જ રહ્યું. ગુણસ્થાનોની કક્ષા લેવાથી ગુણસ્થાનોથી સંબંધિત વિષય-વસ્તુ હજુ પણ વિસ્તૃત રૂપમાં સંકલિત થતી રહી. તેથી આપે ચાર વર્ષ પછી વળી આ નિર્ણય લીધો કે શા માટે આ ગુણસ્થાન પ્રવેશિકાને વિસ્તૃતરૂપ ન આપી શકાય ?

પોતાના છારા લેવાથેલ નિર્ણયને અનુસાર બ્રહ્મચારીજીએ સંકલન સામ્ભળીને વ્યવસ્થિત રૂપ આપવાનું કામ પ્રારંભ કરી દીદ્યું અને તેના સંપાદન માટે મને કહ્યું. એક વર્ષની અંદર જ આ લઘુ પુસ્તિકાની લગભગ ૨૫૦ પાનાની પાંડુલિપિ તૈયાર કરી મને વળી સંપાદન માટે આગ્રહ કર્યો.

મારા પોતાના લેખન, અદ્યાયન - અદ્યાપન આઈના કારણે મારી પાસે ઘણું કરી સમયાભાવ રહે છે છતાં પણ ધર્મ સ્નેહવશ તથા આ વિચાર કરીને કે “આ નિમિત્તથી પોતાના ગુણસ્થાન સંબંધી જ્ઞાનનું પરિમાર્જન થઈ જશે.” - મેં તેઓનો આગ્રહ સહજ સ્વીકાર કરી લીધો.

બ્રહ્મચારી ચશપાલજી જેણ મૂળ તો કળનકાબી છે અને આપની શિક્ષા મરાઈ ભાષામાં થઈ, તેથી કળનક તથા મરાઈ ભાષા ઉપર તો આપનો વિશેષ અધિકાર છે, પરંતુ હિન્દી ભાષા ઉપર તેવો અધિકાર નથી, જેવો હિન્દી લેખન માટે અપેક્ષિત હોય છે, આ કારણે ભાષા સંબંધી કમજોરી તો હતી જ.

વિસ્તારથી શિખવવાની આદત તથા અભ્યાસ હોવાથી પ્રશ્નો પણ મોટા અને તેના ઉત્તર પણ આડા-અવળા હતા, થોડું પુનરાવર્તન પણ હતું. વિષયવસ્તુ અત્યંત ઉપયોગી હોવા છતાં પણ તેનું પ્રસ્તુતીકરણ નબળ્યું હતું. મેં બ્રહ્મચારીજીની સંમતિથી જ તેના મૂળભાવને સંપૂર્ણરીતે સુરક્ષિત રાખીને વિષયવસ્તુ તથા ભાષામાં સંશોધન તથા પરિમાર્જન કરી સુગર્હિત તથા સુવ્યવસ્થિત રૂપરૂપ પ્રદાન કરવાનો પ્રયાસ કર્યો છે.

પ્રસન્નતાની વાત તો એ હતી કે મેં જે પણ સંશોધન કર્યું, સલાહ આપી, તેને બ્રહ્મચારીજીએ ઘણી સહજતાથી સ્વીકાર કર્યો અને પારંવાર હાઈક પ્રસન્નતા પ્રગટ કરી. મને આનો સૂક્ષ્મતાથી અદ્યાયન કરવાથી ઘણો લાભ થયો. બધું મળીને (એક રીતે કહીએતો) વસ્તુતઃ આ ગુણસ્થાન વિવેચન ઘણું જ જ્ઞાનવર્દ્ધક થઈ ગયું છે. આગમ તથા અદ્યાત્મમાં પ્રવેશ કરવાને માટે આ બૃહદાકાર પુસ્તક પ્રવેશફ્લાર સિદ્ધ થશે. કૃતિને વાંચવાથી જ્ઞાનાચ્છવિ છે કે લેખકે આ કૃતિને લખવામાં તથા વિષય-વસ્તુનું સંકલન કરવામાં અનેક ગ્રંથોનું ગહન અદ્યાયન કર્યું છે. એટલા માટે લેખકને જેટલા ધન્યવાદ આપવામાં આવે તેટલા ઓછા જ છે. હું કામના કરું છું કે લેખકનો શ્રમ સાર્થક થાય.

- સંપાદક : પં. રતનચંદ્ર ભારિદિ

## આત્મનિવેદન

વિઠેલા અનેક વર્ષોથી કરણાનુયોગના મહત્વપૂર્ણ વિષય ગુણસ્થાન સંબંધી વર્ગો લેવાનું સૌભાગ્ય મને વિભિન્ન શિક્ષણ શિબિરોના અવસરે મળતું રહ્યું છે. પ્રારંભમાં તો માત્ર શ્રી કુંદુંકુંડહાન દિગ્ંબર જૈન તીર્થસુરક્ષા દ્રસ્ટ, મુંબઈ દ્વારા જ્યાપુરમાં આયોજીત શિબિરોમાં જ આ વર્ગો ચાલતા હતા. પરંતુ શીખનારાઓની વધતી જતી જિજ્ઞાસાને જોતાં હવે પ્રત્યેક શિબિરોનો આ એક અનિવાર્ય વર્ગ થઈ ચૂક્યો છે. આ રીતે હું જ્યાં પણ પ્રવચનાર્થે જાઉ છું ત્યાં પણ ગુણસ્થાન પ્રકરણને સમજાવવાનો આગ્રહ થવા લાગે છે. સમાજની આ પ્રકારની વિશેષ જિજ્ઞાસાએ જ મને આ વિષય ઉપર અદ્યયન હેતુ પ્રેરિત કર્યો.

શ્રી ટોડરમલજી દિગ્ંબર જૈન સિદ્ધાંત મહાવિધાલયમાં શાસ્ત્રી પ્રથમ વર્ષના પાઠ્યકક્ષમના અંતર્ગત ગુણસ્થાન પ્રકરણના અદ્યાપનના નિમિત્તથી પણ મારા આ વિષયનું ચિંતન-મનન વધતું ગયું. તેનું ફળ આ “ગુણસ્થાન વિવેચન” છે.

ગુણસ્થાન વિવેચનના માદ્યમથી ગુણસ્થાનના વર્ગ લેવાની/સમજાવવાની મજા કંઈક અલગ જ છે. હવે હું વિધાર્થીઓને “આટલા પાના વાંચીને આવશો તો વિષય સરળતાથી સમજમાં આવશે” - એમ કહું છું. વિશેષ કરીને શ્રી ટોડરમલજી દિગ્ંબર જૈન સિદ્ધાંત મહાવિધાલયના વિધાર્થીઓને શીખવાડવામાં, તેઓને ગુણસ્થાન વિષયની તૈયારી કરવામાં વિશેષ અનુકૂળતા થઈ ગઈ છે. હવે વિધાર્થી ગુણસ્થાનની લૂભિકાઉપ પ્રશ્નોત્તર તો ચાદ કરે જ છે, સાથે સાથે ગુણસ્થાન વિવેચન અદ્યાયમાંના પ્રત્યેક ગુણસ્થાનનો સમજેલો વિષય પોતાના શબ્દોમાં આત્મવિશ્વાસપૂર્વક સંલગ્નાવે છે. આ રીતે ગુણસ્થાન વિવેચનના કારણે ગુણસ્થાન સંબંધી વિષય સમજવો તથા સમજાવવો હવે ઘણો જ સુગમ થઈ ગયો છે.

મેં આ ગુણસ્થાન વિવેચન કરણાનુયોગની વિશેષ જાણકારી રાખવાવાળામાંથી બ્ર. હીરાબેન (ઈંદોર), બ્ર. વિમણાબેન (જબલપુર), પં. રાજમલજી જૈન (ભોપાલ), પં. કિશાનચંદજી (અલવર), પં. પી. એલ. યૈધ (મલકાપુર), પં. મનોહરશાખ મારવડકર (નાગપુર) વગેરે વિક્રોનોને આનેહુલ બતાવ્યું અને તેઓના મહત્વપૂર્ણ સલાહ-સૂચન અનુસાર સંશોધન પણ કરી લીધું છે. તેથી હું તેઓ સર્વોનો આભારી છું. પં. રાજમલજીએ આખું પુસ્તક બે-બે વાર સૂક્ષ્મતાથી વાંચ્યું છે અને સલાહ પણ આપી છે.

આ પુસ્તકને ત્રણ અદ્યાયોમાં વિભાજીત કર્યું છે. (૧) પીઠિકા (૨) પ્રશ્નોત્તર તથા (૩) ગુણસ્થાન. સર્વપ્રથમ પીઠિકામાં આચાર્યકલ્પ પંડિત ટોડરમલજી વિરચિત સમ્યજ્ઞાન-ચંદ્રકાની પીઠિકાને ફરી સંપાદીત કરી પ્રશ્નોત્તરની સાથે આપેલ છે, જેનાથી વાંચકોને સમજવામાં વધુ સરળતા થશે.

પ્રશ્નોત્તર વિભાગમાં ગુણસ્થાન પ્રકરણને સમજવામાં સહયોગી એવા અત્યંત આવશ્યક પ્રશ્નોત્તર વિશેષ સંશોધનની સાથે વિશેષ જોડી દીધા છે. ચૌદ ગુણસ્થાનવાળા ત્રીજા અદ્યાયમાં જળમૂળથી પરિવર્તન કરીને ગુણસ્થાન-પ્રવેશિકામાં જેનો સંકિર્તનમાત્ર કર્યો હતો, તે બધા બિંદુઓને જે રીતે વર્ગમાં વિસ્તારથી શીખવાનું છું, તે રીતે સંપૂર્ણ વિષય

આપવાનો પચાસ કર્યો છે. તેનાથી વર્ગમાં ન બેસવાવાળા પણ જો સ્વયં પોતે તેને એકલા વાંચશે તો પણ તેઓ વિષય સહજ રીતે સમજુ શકશે.

ઉપરોક્ત ત્રણે અદ્યાચો પછી મોક્ષમાર્ગ હેતુ જે વિષયોને સમજું અનિવાર્ય છે, એવા વિષય - જેમ કે જીવ બળવાન છે, કર્મબંધનો નિયમ વગેરે પરિશિષ્ટમાં આપવામાં આવેલ છે.

આ આઠમા (હીનદી) સંસ્કરણમાં ઘવલાગત ગુણસ્થાનનો અંશ પણ જોડી દીધો છે, જેમાં ૫૦ શંકા-સમાધાન ગર્ભિત છે. આ શંકા-સમાધાનોને અંગ્રેજી (૧ થી ૫૦ સુધી) ક્રમાંક આપવામાં આવેલ છે. આ સંસ્કરણની ભાષાની શુદ્ધતાનું શ્રેય પં. શ્રી પ્રવીણજી શાસ્ત્રી, રાયપુરને જાય છે. અદ્યાત્મસંબંધી મતબેદ હોવા છતાં પણ આગ્રા નિવાસી કરણાનુયોગ રસિક પં. શ્રી રતનલાલજી લેનાડાનો સહયોગ અમો લૂલી નથી શકતા. આ બંને વિદ્ધાનોનો પણ અમો આભાર વ્યક્ત કરીએ છીએ.

બધા જિજાસુઓના માદ્યમથી પોતાના પરિણામોને ઓળખી આત્મકલ્યાણ કરે - એ જ મંગલકામના છે.

- ખ્ર. યશપાલ ઝૈન.

શ્રી ટોડરમલ સ્મારક ટ્રસ્ટ, એ - ૪, બાપુનગર, જ્યાપુર

જિનવાણીના પ્રચાર પ્રસાર અર્થે .....

પ્રસ્તુત સંસ્કરણના પ્રકાશન માટે.....

આર્થિક સહયોગ દેનારા દાનદાતા.....

શ્રી નેમજીભાઈ કરમસી પુનથી ગંગાર

શ્રી રતીલાલ કરમથી પુનથી ગંગાર

(મુંબઈ - દહીસર) (કરણ - કાંડાગારા)નો

અંત:કરણપૂર્વક આભાર .....

શુભેચ્છક :

મે. ગંગાર ટીમ્બર માર્ટ

મે. કુમુદ બીલ્ડર્સ

મે. ગંગાર (હાઇવેર/સીરામીક્સ)

મે. કુમુદ કુમુદ ડેવલપર્સ

: મે. કુમુદ એન્ટપ્રાઇઝ :

## અનુવાદકની કલમે.....

હું અત્યારે ક્યાં ઉભો છું અને મારી મંજિલ શું છે ? આ જાણવાની ઉત્કંઠાથી ગુણસ્થાન સમજવાની જિજાસા થઈ. આદરણીય બ્ર. યશપાલજીના “ગુણસ્થાન વિવેચન” પુસ્તકના હીન્દી સંસ્કરણો અભ્યાસ કર્યો. તેનાથી જીવનમાં દઢતા તથા પવિત્રતા આવી. આ પુસ્તક મારા માટે પુરુષાર્થીપ્રેરક બની રહ્યું. ત્યારે થયું ..... “સમયસાર” નો સાર સમજાવનાર પૂ. ગુરુદેવશ્રીના પ્રવચનો તથા સાહિત્ય પહેલા ગુજરાતીમાં પ્રાચ થતાં હોય છે, જ્યારે મારા જીવનની દીવાદાંડી સમાન ગુણસ્થાન વિવેચનનું પુસ્તક મારી માતુલાખામાં કેમ નહીં ? જો ગુજરાતીમાં આ પુસ્તકનું અનુવાદન થાય તો મારી જેમ મારા અન્ય ગુજરાતી સાધમણીઓ માટે પણ પુરુષાર્થીપ્રેરક તથા પ્રેરણાદાયક બની રહે..... અને આ ચિંતનના સારણે આજે આપના કરકમળોમાં પ્રસ્તુત થયેલ છે “ગુણસ્થાન વિવેચન” નું પ્રથમ ગુજરાતી સંસ્કરણ અનુષ્ઠાન કરી રહેલું !

ગુણસ્થાનની વાત કરતાં હોઇએ ત્યારે સ્વાભાવિક “ગુણસ્થાન આરોહણ કમ” એટલે કે શ્રીમદ્ રાજયંદ્રજીની અપૂર્વ રચના “અપૂર્વ અવસર એવો ક્યારે આવશે?” ને વિસ્મૃત કેમ કરી શકાય ? પૂ. ગુરુદેવના તેની ઉપર થયેલા પ્રવચનો પણ ખરેખર અપૂર્વ જ છે.

કરણાનુયોગનો વિષય થોડો કઠિન તથા સૂક્ષ્મ તો છે જ પરંતુ તેને પોતાની આગવી, સુગમ અને સરળ ભાષામાં બ્ર. પં. શ્રી યશપાલજી એ “ગુણસ્થાન વિવેચન” તૈયાર કરી દરેક મુમુક્ષુઓ ઉપર ઘણો ઉપકાર કર્યો છે. તેમજ તેનું સંપાદન પં. શ્રી રતનયંદુ ભારિલે સુવ્યવસ્થિત કરી સુંદરીતે ગોઠયેલ છે, જે માટે બંને અદ્યાત્મપ્રેમીઓનો જેટલો આભાર માનીએ તેટલો ઓછો છે.

ગુજરાતી અનુવાદ કરવા માટે મારા પ્રેરણામૂર્તિ સમાન આદરણીય અનનાજી (બ્ર. યશપાલજી)નો હું ખૂબ જ અણી છું તેમજ આ પ્રતાને ચોક્સાઈપૂર્વક ઝીણાવટથી તપાસવા માટે શ્રી અધ્યિનત્વાર્થ (મલાંડ-મુંબઈ)નો, આર્થિક સહાય કરનાર વડીલબંધુ શ્રી ગેમજુભાઈ ગંગર તથા શ્રી રતીલાલભાઈ ગંગર (કાચ્છ-કાંડાગરા) (દહીસર, મુંબઈ) બંધુલેલડીનો હું અંતઃકરણપૂર્વક આભારી છું

શક્તિ ઉપરાંત જીવનમાં પહેલી જ વાર નાના હાથે ધાણું મોઢું કામ હાથમાં લેવાથી જિનવાણીની જાણતા-અજાણતા કોઈ અશાતના થઈ ગઈ હોય તો ક્ષમા ચાચું છું અને કામમાં ક્ષતી રહી ગઈ હોય તો સુજાજનોએ સુધારીને વાંચવું તથા તે તરફ દ્યાન દોરવા વિનંતી.....

અનુવાદનું મૂળ પ્રયોજન સ્વયંનો સ્વાધ્યાય તેમજ આપણે સર્વે આપણી મંજિલને ઓળખીએ અને ચોટેચ ગુણસ્થાન પાર કરી ગુણસ્થાનાતીત પોતાના સ્વરૂપને સાધીએ એ જ મંગલ મનોભાવના.....

લી. હિતેજ્જ કુંવરજી વોરા (દહીસર)

## \* આનુક્રમણિકા \*

ક્રમ	વિષય	પાના નં.
૧.	પ્રકાશકીય આદિ	---
૨.	પ્રથમ અદ્યાય	૧-૨૦
	◆ સામાન્ય પ્રકરણ	૧-૫
	◆ પ્રથમાનુયોગનો પક્ષપાતી	૬-૭
	◆ ચરણાનુયોગનો પક્ષપાતી	૭-૧૧
	◆ ક્રયાનુયોગનો પક્ષપાતી	૧૧-૧૪
	◆ શબ્દશાસ્ત્ર, અર્થ, કામતોગ તથા અન્યમતનો પક્ષપાતી	૧૪-૧૮
	◆ શાસ્ત્રાત્યાસનો મહિમા	૧૮-૨૦
૩.	દ્વિતીય અદ્યાય	૨૧-૪૩
	◆ મહત્વપૂર્ણ પ્રશ્નોત્તર	૨૧-૪૩
૪.	તૃતીય અદ્યાય	૪૪-૨૬૪
	◆ ગુણસ્થાન-ભૂમિકા	૪૪-૪૭
	◆ ગુણસ્થાન-પરિભાષા	૪૮-૫૧
	◆ ગુણસ્થાન-વિભાજન	૫૧-૬૦
૫.	૧. મિથ્યાત્પ ૨. સાસાદનસમ્યકૃત્ય ૩. સમ્યક્ષમિથ્યાત્પ(મિશ્ર) ૪. અવિરતસમ્યકૃત્ય	૬૧-૭૫ ૭૭-૮૭ ૮૮-૯૫ ૯૬-૧૧૫
	૫. દેશવિરત ૬. પ્રમતવિરત ૭. અપ્રમતવિરત ૮. અપૂર્વકરણ ૯. અલિપૃત્તિકરણ	૧૧૭-૧૨૭ ૧૨૮-૧૪૮ ૧૪૮-૧૫૧ ૧૫૨-૧૭૫ ૧૭૫-૧૮૫
	૧૦. સૂક્ષ્મસાંપર્યાય ૧૧. ઉપશાંતમોહ ૧૨. ક્ષીણમોહ ૧૩. સયોગકેવળી	૧૮૯-૧૯૬ ૧૯૭-૨૦૭ ૨૦૮-૨૧૬ ૨૧૭-૨૨૭
	૧૪. અયોગકેવળી	૨૨૮-૨૩૮
૬.	◆ સિદ્ધભગવાન	૨૩૫-૨૪૨
૭.	◆ પરિશિષ્ટ-૧, ૨, ૩, ૪, ૫, ૬	૨૪૪-૨૫૪

નારી શરીરી સિકુ નારીમિ ઉચ્ચ મર્દ હિંડ હિંડ નિ પ્રાણી મર્દ  
 નારી એવી મર્દ ન રૂપ, કિંતુ એવી નારી નુંદિનું હોય  
 એવી જી હિંડ મર્દ તેથે નિ હોય હોય ના - એ મર્દ  
 નિની નારી નારી નુંદિનું હોય નિની નારી નારી નારી નિની મર્દ - એ મર્દ  
 નારી નારી નુંદિનું નિની નારી  
 નારી નારી નારી નારી નારી નારી નારી નારી નારી નારી નારી નારી નારી નારી નારી  
 નારી નારી નારી નારી નારી નારી નારી નારી નારી નારી નારી નારી નારી નારી નારી



## પ્રથમ અદ્યાય સમ્યગજ્ઞાન ચંદ્રિકા - પીઠિકા

(દોહા)

વન્દો જ્ઞાનાનનં - કૃ, નેમિચનં ગુણકં, વિનામિ ન નિ  
 માધ્યવ-વન્દિત વિમલ પદ, પુણ્ય પચોનિધિ નંદ ॥૧॥

દોષ દછન ગુન ગછન ધન, અરિ કરિ હરિ અરહંત,  
 સ્વાનુભૂતિ-રમની-રમન, જગ-નાયક - જયવંત ॥૨॥

સિદ્ધ શુદ્ધ સાધિત સહજ, સ્વરસ સુધારસ ધાર,  
 સમયસાર શિવ સર્વગત, નમત હોઉ સુખજાર ॥૩॥

જૈની બાની વિવિધ વિધિ, વરનત વિશ્વ પ્રમાન,  
 સ્યાત્પ્રદ મુદ્રિત અહિતહર, કરહુ સકલ કલ્યાન ॥૪॥

મૈન નમો નગન જૈન જન, જ્ઞાન-દ્યાન ધન લીન,  
 મૈન માન જિન દાન ધન, એન હીન તન છીન ॥૫॥

ઇહ વિધિ મંગલ કરન તૈં, સબ વિધિ મંગલ હોત,  
 હોત ઉંંગલ દૂરિ સબ, તમ જ્યો ભાનુ ઉધોત ॥૬॥

હવે મંગલાચરણ કરીને શ્રીમદ્ ગોમ્મટસાર, જેનું બીજું નામ પંચસંગ્રહ  
 ગ્રંથ, તેની દેશભાષામય ટીકા કરવાનો પુરુષાર્થ કરે છું. આ ગ્રંથ-સમુદ્ર  
 તો એવો છે, જેમાં સાતિશય બુદ્ધિ-બળ ચુક્ત જીવોનો પણ પ્રવેશ  
 થવો દુર્લભ છે અને હું મંદબુદ્ધિ (આ ગ્રંથનો) અર્થ પ્રકાશવારૂપ તેની  
 ટીકા કરવાનો વિચાર કરી રહ્યો છું.

આ વિચાર તો એવો થયો, જેમ કોઈ પોતાના મુજે જિનેન્દ્ર દેવના સર્વ ગુણોનું વર્ણન કરવા ઈચ્�ે, પરંતુ તે કેમ થઈ શકે?

પ્રશ્ન ૧:- ન થઈ શકે તો પુરુષાર્થ કેમ કરો છો ?

ઉત્તર :- જેમ જિનેન્દ્રદેવના સર્વ ગુણોનું વર્ણન કરવાની શક્તિ નથી છતાં પણ ભક્ત પુરુષ ભક્તિને વશ થઈ પોતાની બુદ્ધિ પ્રમાણ ગુણ-વર્ણન કરે છે, તેવી જ રીતે આ ગ્રંથનાં સંપૂર્ણ અર્થનું પ્રકાશન કરવાની શક્તિ ન હોવા છતાં અનુરાગને વશ હું મારી બુદ્ધિ અનુસાર (ગુણ) અર્થનું પ્રકાશન કરીશ.

પ્રશ્ન ૨:- જો અનુરાગ છે, તો પોતાની બુદ્ધિ અનુસાર ગ્રંથાત્યાસ કરો; પરંતુ મંદબુદ્ધિવાળાઓને તો ટીકા કરવાના અધિકારી થવું ઉચિત નથી.

ઉત્તર :- જેમ કોઈ પાઠશાળામાં બહુ બાળકો ભણે છે, તેમાં કોઈ બાળક વિશેષ જ્ઞાન રહિત છે, છતાં અન્ય બાળકોથી વધારે ભણ્યો છે, તો તે પોતાથી અલ્પ ભણેલા બાળકોને પોતાના જેવું જ્ઞાન થવા માટે કાંઈ લખી આપવા આદિ કાર્યનો હક્કદાર હોય છે. તે જ પ્રમાણે મને વિશેષ જ્ઞાન નથી, છતાં પણ કાળદોષથી મારાથી પણ મંદબુદ્ધિવાળા છે અને થશે પણ, તેઓને માટે મારા જેવું આ ગ્રંથનું જ્ઞાન થવા માટે ટીકા કરવાનો અધિકારી થયો છું.

પ્રશ્ન ૩:- આ કાર્ય કરવું છે - એવો તો આપે વિચાર કર્યો, પરંતુ જેમ નાનો માણસ મોટું કાર્ય કરવાનો વિચાર કરે, તો ત્યાં તે કાર્યમાં ભૂલ તો થાય જ છે અને ત્યાં તે હાંસીપાત્ર બને છે. તે જ પ્રમાણે આપ પણ મંદબુદ્ધિવાળા થઈને આ ગ્રંથની ટીકા કરવાનો વિચાર કરી રહ્યા છો, તો ભૂલ તો થશે જ અને ત્યાં હાસ્યને પાત્ર થઈ જશો.

ઉત્તર :- આ વાત સત્ય છે કે હું મંદબુદ્ધિ હોવા છતાં પણ આવા મહાન ગ્રંથની ટીકા કરવાનો વિચાર કરી રહ્યો છું. અહીં ભૂલ તો થઈ શકે છે, પરંતુ સજ્જન હાસ્ય નહીં કરે.

જેમ બીજા બાળકોથી વધારે ભણેલો બાળક જ્યાંક ભૂલ કરે, ત્યારે મોટેરા એવો વિચાર કરે છે કે બાળક છે તો ભૂલ તો થાય, પરંતુ બીજા બાળકોથી લલો છે. આ પ્રમાણે વિચારી હસશે નહીં.

તે પ્રમાણે હું અહીં કાંઈ ભૂલી જાઉ તો ત્યાં સજ્જન પુરુષ એવો

વિચાર કરુશે કે તે મંદબુદ્ધિ હતો, તેથી ભૂલ તો થાય; પરંતુ કેટલાંચાં  
અતિ મંદબુદ્ધિવાળાથી તો ભલો(સારો) જ છે, આવો વિચાર કરી  
હાસ્ય નહીં કરે.

**પ્રશ્ન ૪:-** સજ્જન તો હાસ્ય નહીં કરે, પરંતુ દુર્જન તો કરુશે જ ને ?

**ઉત્તર :-** દુર્જ તો એવા જ હોય છે, જેના હૃદયમાં જીજાનાં નિર્દોષ-  
સારા ગુણ પણ વિપરીત જ ભાસે છે, પરંતુ તેના ભયથી જેમાં આપણું  
હિત થાય - એવા કાર્યને કોણ ન કરે ?

**પ્રશ્ન ૫:-** પૂર્વ ગ્રંથ તો છે જ, તેનો અભ્યાસ કરી - કરાવીને જ હિત  
થાય છે, મંદબુદ્ધિથી ગ્રંથની ટીકા કરવાની મહંતતા (મોટાઈ / પંડિતાઈ)  
શા માટે પ્રગટ કરો છો ?

**ઉત્તર :-** ગ્રંથનો અભ્યાસ કરવાથી ગ્રંથની ટીકા રચના કરવામાં  
ઉપયોગ વિશેષ લાગે છે, અર્થ પણ વિશેષ સમજમાં આવે છે. અન્ય  
જીવને ગ્રંથાભ્યાસ કરાવવાનો સંયોગ થવો દુર્લભ છે અને સંયોગ થવા  
છતાં કોઈક જીવને જ અભ્યાસ થાય છે. ગ્રંથની ટીકા રચવાથી તો  
પરંપરાગત અનેક જીવને અર્થનું જ્ઞાન થશે. માટે પોતાનું તથા અન્ય  
જીવોનાં વિશેષ હિત કાજે ટીકા કરું છું, મહંતતાનું તો કોઈ પ્રયોજન  
જ નથી.

**પ્રશ્ન ૬:-** આ સત્ય છે કે આ કાર્યમાં વિશેષ હિત થાય છે, પરંતુ  
બુદ્ધિની મંદતાથી ક્યાંક ભૂલથી અન્યથા અર્થ લખાઈ જાય, તો ત્યાં  
મહાપાપની ઉત્પત્તિથી અહિત પણ થશે.

**ઉત્તર :-** યથાર્થ સર્વ પદાર્થના જ્ઞાતા તો કેવળી ભગવાન છે,  
જીજાને જ્ઞાનાપરણાના ક્ષયોપશમ અનુસાર જ્ઞાન છે, તેઓને કોઈ અર્થ  
અન્યથા પણ લાગે, પરંતુ જિનેન્દ્ર દેવનો એવો ઉપદેશ છે -

“કુદેવ, કુગુર, કુશાસ્ત્રોના વચનની પ્રતીતિથી તથા છઠથી તથા  
કોઇ, માન, માચા, લોભથી તથા હાસ્ય-ભયાદિકથી જે અન્યથા  
શ્રદ્ધા કરે તથા ઉપદેશ આપે, તો તે મહાપાપી છે.” તથા વિશેષ  
જ્ઞાનપાન ગુરુના નિમિત વગર તથા પોતાના વિશે ક્ષયોપશમ વિના  
કોઈ સૂક્ષ્મ અર્થ અન્યથા પ્રતિભાસિત થાય અને તે એવું જાહે કે  
જિનેન્દ્રદેવનો ઉપદેશ આવો જ છે - એમ જાહી કોઈ સૂક્ષ્મ અર્થની

શ્રદ્ધા કરે અને ઉપદેશ આપે તો તેને મહાપાપ નથી થતું. તે જ આ ગોમમટસાર જીવકાંડ ગ્રંથમાં પણ આચાર્યશ્રી નેમિચંદ્રજી એ કહ્યું છે -

સમ્માઇફ્ટી જીવો, ઉવિડું પવયણ તુ સદ્ગુર્દ્દિ ।

સદ્ગુર્દિ અસબ્ભાવં, અજાણમાળો ગુરુળિયોગ ॥૨૭॥

પ્રશ્ન ૭:- આપે વિશેષ જ્ઞાનીથી ગ્રંથના યથાર્થ સર્વ અર્થનો નિર્ણય કરી ટીકા કરવાનો પ્રારંભ કેમ ન કર્યો?

ઉત્તર :- કાળદોષથી ડેવળી-શુતકેવળીનો તો અતે અભાવ જ છે અને વિશેષ જ્ઞાની પણ જ્યલ્દે જ મળે છે. જે કોઈ છે તેઓ દૂર ક્ષેત્રમાં છે, તેમનો સંયોગ દુર્લભ છે અને આચુ, બુદ્ધિ, બળ, પરાક્રમ આદિ તુચ્છ રહી ગયા છે. માટે જેટલું થઈ શક્યું, તેટલા અર્થનો નિર્ણય કર્યો, બાકી શેષ જેમ છે, તેમ પ્રમાણ છે.

પ્રશ્ન ૮:- આપે કહ્યું તે સત્ય છે, પરંતુ આ ગ્રંથમાં જો ભૂલ થશે, તેને શુદ્ધ કરવાનો શું કોઈ ઉપાય પણ છે?

ઉત્તર :- એક ઉપાય આ કરીએ છીએ - જ્ઞાની પુરુષોનો પ્રત્યક્ષ તો સંયોગ નથી, માટે તેઓને પરોક્ષ જ એવી વિનંતી કરું છું કે - “હું મંદબુદ્ધિ છું, વિશેષ જ્ઞાન રહિત છું, અવિવેકી છું, શબ્દ, ન્યાય, ગણિત, ધાર્મિક આદિ ગ્રંથોનો વિશેષ અભ્યાસ મને નથી, તેથી હું શક્તિહીન છું, છતાં પણ ધર્મનુરૂપને વશ થઈને ટીકા કરવાનો વિચાર કર્યો છે, તેમાં જ્યાં જ્યાં ભૂલ થઈ જાય, અન્યથા અર્થ થઈ જાય, ત્યાં ત્યાં મારા ઉપર ક્ષમા કરી તે અન્યથા અર્થને દૂર કરી યથાર્થ અર્થ લખશો. આ પ્રકારે વિનંતી કરી જે ભૂલ થશે, તેને શુદ્ધ કરવાનો ઉપાય કર્યો છે.

પ્રશ્ન ૯:- આપે ટીકા કરવાનો વિચાર કર્યો, તે તો સાંચ કર્યું, પરંતુ આવા મહાન ગ્રંથની ટીકા સંસ્કૃતમાં જ જોઈએ. ભાષામાં તો તેની ગંભીરતા ભાસિત નહીં થાય.

ઉત્તર :- આ ગ્રંથની “જીવતત્વપ્રદીપિકા” નામની સંસ્કૃત ટીકા તો પૂર્વ થયેલ જ છે, પરંતુ ત્યાં સંસ્કૃત, ગણિત આમનાય આદિના જ્ઞાન રહિત જે મંદબુદ્ધિ છે, તેમનો પ્રવેશ થતો નથી. અહીં કાળ-દોષથી બુદ્ધિ આદિ તુચ્છ હોવાથી સંસ્કૃતાદિના જ્ઞાન રહિત જીવ ઘણા છે, તેઓને આ ગ્રંથના અર્થનું જ્ઞાન કરવા માટે ભાષા ટીકા કરું છું. તેથી જે

જીવ સંસ્કૃતાદિત સહિત વિશેષ જ્ઞાનવાળ છે, તેઓ મૂળ ગ્રંથ તથા સંસ્કૃત ટીકાથી અર્થ ધારણા કરે. જે જીવ સંસ્કૃતાદિત વિશેષ જ્ઞાનરહિત છે, તેઓ આ ભાષા ટીકાથી અર્થને ધારણા કરે અને જે જીવ સંસ્કૃતાદિત જ્ઞાન સહિત છે, પરંતુ ગણિત આમનાયાદિકના જ્ઞાનના અભાવથી મૂળ ગ્રંથ તથા સંસ્કૃત ટીકામાં પ્રવેશ નથી મેળવી શકતા, તેઓ આ ભાષા ટીકાથી અર્થને ધારણા કરીને મૂળ ગ્રંથ તથા સંસ્કૃત ટીકામાં પ્રવેશ કરે તથા જે ભાષાટીકાથી મૂળ ગ્રંથ તથા સંસ્કૃત ટીકાથી વિશેષ અર્થ થઈ શકે, તેને જાળવાનો અન્ય ઉપાય થાય તે કરે.

**પ્રશ્ન ૧૦ :-** સંસ્કૃત જાળવાવાળાને ભાષા અભ્યાસમાં અધિકાર નથી.

**ઉત્તર :-** સંસ્કૃત જાળવાળાને ભાષા વાંચવાથી તો કોઈ દોષ લાગતો નથી, આપણું પ્રયોજન જેમ સિદ્ધ થાય એમ જ કરવું. પૂર્વમાં અર્ધમાગદી આદિ ભાષામય મહાગ્રંથ હતાં. જ્યારે જીવોની બુદ્ધિધની મંદતા થઈ ત્યારે સંસ્કૃતાદિત ભાષામાં ગ્રંથ બન્યા. હવે જીવોની બુદ્ધિધની વિશેષ મંદતા થઈ, તેથી દેશભાષામય ગ્રંથ રચવાનો વિચાર આવ્યો. સંસ્કૃતાદિત ગ્રંથનો અર્થ પણ ભાષા દ્વારા જ જીવોને સમજાવે છે. અહીં ભાષા દ્વારા જ અર્થ લખવામાં આવે તો કોઈ દોષ નથી.

આ પ્રમાણે વિચાર કરી શ્રીમદ્ ગોમમટસાર બીજું નામ પંચસંગ્રહ ગ્રંથની જીવતત્પ્રદીપિકા નામની સંસ્કૃત ટીકા અનુસાર “સમ્યગ્જ્ઞાન ચંદ્રિકા” નામની આ દેશભાષામયી ટીકા કરવાનો નિશ્ચય કર્યો છે. શ્રી અરહંતદેવ, જીનવાણી, નિર્ણય ગુરુવર્યોના પ્રસાદથી તથા મૂળગ્રંથકર્તા શ્રી નેમિચંદ્ર આદિ આચાર્યોના પ્રસાદ થકી આ કાર્ય સિદ્ધ થાયો.

હવે આ શાસ્ત્રના અભ્યાસમાં જીવોને સંભુખ કરીએ છીએ.

હે ભવ્ય જીવ ! તું તારું હિત ઈચ્છિતો હોય તો તને જે પ્રકારે હિત થાય તે પ્રકારે જ આ શાસ્ત્રનો અભ્યાસ કરજે.

આત્માનું હિત મોક્ષ છે. મોક્ષ સિવાય અન્ય જે છે, તે પરસંયોગજગ્નિત છે, વિનાશક છે, દુઃખમય છે અને મોક્ષ જ નિજસ્વભાવ છે, અવિનાશી છે, અનંત સુખમય છે. માટે તારે મોક્ષપદની પ્રાસિનો ઉપાય કરવો જોઈએ.

મોક્ષનો ઉપાય સમ્યક્ષુદ્ધનિ, સમ્યક્જ્ઞાન, સમ્યક્યારિત છે. તેની પ્રાપ્તિ જીવાદિકનું સ્વરૂપ જાળવાથી જ થાય છે. તેને કહું છું -

જીવાદિં તત્ત્વોનું શ્રદ્ધાન સમ્યકૃદર્શન છે. જાણયા વગર શ્રદ્ધાન થવું આકાશના કુલ સમાન છે. પ્રથમ જાણો, ત્યાર પછી તેમ જ પ્રતીતિ કરવાથી શ્રદ્ધાનને પ્રાપ્ત થાય છે. માટે જીવાદિકનું જાણવું, શ્રદ્ધાન થવાથી પૂર્વે જ થાય છે. તે જ તેના શ્રદ્ધાનરૂપ સમ્યકૃદર્શનના કારણરૂપ જાણવું.

શ્રદ્ધાન થવાથી જે જીવાદિકનું જાણવું થાય છે, તેનું નામ સમ્યકૃજ્ઞાન છે.

શ્રદ્ધાનપૂર્વક જીવાદિને જાણતાં જ જીવ સ્વયંમેવ ઉદાસીન થઈ હેઠળો ત્યાગ, ઉપાદેયને બ્રહ્મણ કરે છે, ત્યારે સમ્યકૃચારિત્ર થાય છે. અજ્ઞાનપૂર્વક કિયાકાંક્ષાથી સમ્યકૃચારિત્ર થતું નથી.

આ પ્રકારે જીવાદિકને જાણવાથી જ સમ્યકૃદર્શન આદિ મોક્ષના ઉપાયની પ્રાપ્તિ થાય છે - એવો નિશ્ચય કરવો જોઈએ. આ શાસ્ત્રના અભ્યાસથી જીવાદિનું જાણવું ચથાર્થ થાય છે. જે સંસાર છે, તે જીવ અને કર્મના સંબંધરૂપ છે તથા વિશેષ જાણવાથી તેના સંબંધનો અભાવ થાય છે, તે જ મોક્ષ છે. માટે આ શાસ્ત્રમાં જીવ અને કર્મનું જ વિશેષ નિરૂપણ છે. અથવા જીવાદિક ખટક્ખાય, સાત તત્ત્વાદિકનું પણ આમાં ચથાર્થ નિરૂપણ છે, તેથી આ શાસ્ત્રનો અભ્યાસ અવશ્ય કરશો.

હવે અહીં અનેક જીવ આ શાસ્ત્રના અભ્યાસમાં અરુચિ હોવાને લીધે વિપરીત વિચાર પ્રગત કરે છે. તેમને સમજાવીએ છીએ :-

અનેક જીવ માત્ર પ્રથમાનુયોગ, ચરણાનુયોગ, ડ્રવ્યાનુયોગનો જ પક્ષ કરી આ કરણાનુયોગરૂપ શાસ્ત્રના અભ્યાસનો નિષેધ કરે છે.

પ્રશ્ન ૧૧:- તેમાંથી પ્રથમાનુયોગનો પક્ષપાતી કહે છે કે વર્તમાનમાં જીવની બુદ્ધિ બહુ જ મંદ છે, તેઓને આવા સૂક્ષ્મ વ્યાખ્યાનરૂપ શાસ્ત્રમાં કાંઈ જ સમજમાં આવતું નથી, માટે તીર્થકરાદિકની કથાનો ઉપદેશ અપાય તો સારી રીતે સમજુ લે અને સમજુને પાપથી કરીને ધર્માનુરોગી થાય. માટે પ્રથમાનુયોગનો ઉપદેશ કાર્યકારી છે.

ઉત્તર :- હમણાં બધા જીવો તો એક સરખા છે નહીં, હીનાધિક બુદ્ધિ દેખાય છે, તેથી જેવો જીવ હોય, તેવો ઉપદેશ દેવો. અથવા મંદબુદ્ધિ જીવ પણ શીખડાવવાથી, અભ્યાસ કરવાથી બુદ્ધિમાન થતાં જોવામાં આવે છે. માટે જે બુદ્ધિમાન છે, તેઓને તો આ ગ્રંથ કાર્યકારી છે જ અને

જે મંદબુદ્ધિ છે, તે વિશેષબુદ્ધિવાળાઓ દ્વારા સામાન્ય-વિશેષરૂપ ગુણાસ્થાનાટિકનું સ્વરૂપ શીખીને આ શાસ્ત્રના અભ્યાસમાં પ્રવર્તન કરે.

પ્રશ્ન ૧૨ - અહીં મંદબુદ્ધિવાળા કહે છે કે આ ગોમ્મટસાર શાસ્ત્ર તો ગણિત સમસ્યાનું વર્ણન કરવાવાળું અનેક અપૂર્વ કથન સહિત હોવાથી બહુ જ કઠિન છે, એવું સાંભળવામાં આવેલ છે. અમે તેમાં કેવી રીતે પ્રવેશ કરી શકીએ ?

ઉત્તર :- કરો નહીં ! આ ભાષા ટીકામાં ગણિત આદિનો અર્થ સુગમરૂપ બનાવી કહ્યો છે, તેથી પ્રવેશ મેળવવો કઠિન નથી. આ શાસ્ત્રમાં કથન ક્યાંક તો સામાન્ય છે, ક્યાંક વિશેષ છે, ક્યાંક સુગમ છે, ક્યાંક કઠિન છે. ત્યાં જો સર્વ અભ્યાસ થઈ શકે, તો સારું જ છે અને જો ન થઈ શકે તો પોતાની બુદ્ધિ અનુસાર જેટલો થઈ શકે, તેટલો જ અભ્યાસ કરો, પોતાના ઉપાયમાં આગસ ના કરશો.

તે કહ્યું - જીવ પ્રથમાનુયોગ સંબંધી કથાટિક સાંભળવાથી પાપથી ડરીને ઘર્માનુશાસ્ત્ર થાય છે.

ત્યાં બંને કાર્ય-પાપથી કરવું અને ઘર્માનુશાસ્ત્ર થવું શિથિલતારૂપ થાય છે. અહીં પુણ્ય-પાપના કારણ-કાર્યાટિક વિશેષ જાણવાથી તે બંને કાર્ય ફ્રઢતા સહિત થાય છે. તેથી આનો અભ્યાસ કરશો. આ પ્રમાણે પ્રથમાનુયોગના પક્ષપાતીને આ શાસ્ત્રના અભ્યાસમાં સન્મુખ ફર્યો.

પ્રશ્ન ૧૩ :- હવે ચરણાનુયોગનો પક્ષપાતી કહે છે કે જે આ શાસ્ત્રમાં કથિત જીવ - કર્મનું સ્વરૂપ છે, તે જેવું છે, તેવું જ છે. તે જાણવાથી શું સિદ્ધ થાય છે ? જો હિંસાટિકનો ત્યાગ કરીને પ્રતનું પાલન કરવામાં આવે, ઉપવાસાટ તપ કરવામાં આવે, અરિહંતાટિકની પૂજા, નામસ્મરણ આદિ ભક્તિ કરવામાં આવે, દાન આપવામાં આવે, વિષય-ક્ષાયાટિકથી ઉદાસીન થવું ઈત્યાટિક જો શુભ કાર્ય કરવામાં આવે તો આત્મહિત થાય, માટે તેનો પ્રત્યક્ષ ચરણાનુયોગનો ઉપદેશ કરવો જોઈએ.

ઉત્તર :- તેને કહીએ છીએ કે - હે સ્થૂળબુદ્ધિ ! તેં પ્રતાટિ શુભકાર્ય કહ્યા, તે કરવા યોગ્ય જ છે, પરંતુ તે સર્વે સમ્યકત્વ વગર એવા છે જેવા એકડાં વગરના મીડા અને જીવાટિકનું સ્વરૂપ જાણ્યા વગર સમ્યકૃત્વનું હોવું એવું છે જાણો વાંઝીયાને પુત્ર. તેથી જીવાટિકનું સ્વરૂપ જાણવા માટે આ શાસ્ત્રનો અભ્યાસ અવશ્ય કરવો જોઈએ.

તथા તે જે પ્રકારે પ્રતાંક શુભકાર્ય કહ્યા અને તેનાથી પુણ્યબંધ થાય છે, એમ કહ્યું તે તો હીક છે, તેવી જ રીતે જીવાંકનું સ્વરૂપ જાણવારૂપ જ્ઞાનાભ્યાસ છે, આ પણ સહૃદ્યી મોટું પ્રદાન શુલ્ફ કાર્ય છે. આનાથી સાતિશય પુણ્યનો બંધ થાય છે અને પેલા પ્રતાંકમાં પણ જ્ઞાનાભ્યાસની જ મુજબતા છે. તેને જ કહીએ છીએ:-

જે જીવ પ્રથમ, જીવ-સમાસાંક વિશેષ જાણી પશ્ચાત્ યથાર્થજ્ઞાન કરી હિંસાંકનો ત્વાગી થઈ પ્રત ધારણ કરે, તે જ પ્રતી છે. જીવાંકના વિશેષોને જાણ્યા વગર કાંઈક હિંસાંકના ત્વાગથી પોતાને પ્રતી માને તો તે પ્રતી નથી. માટે પ્રતના પાલનમાં પણ જ્ઞાનાભ્યાસ જ પ્રદાન છે.

તપ બે પ્રકારના છે. બહિરંગ તપ અને અંતરંગ તપ. જેનાથી શરીરનું દમન થાય, તે બહિરંગ તપ છે અને જેનાથી મનનું દમન થાય તે અંતરંગ તપ છે. આમાં બહિરંગ તપથી અંતરંગ તપ ઉત્કૃષ્ટ છે. ઉપવાસાંક તો બહિરંગ તપ છે, જ્ઞાનાભ્યાસ અંતરંગ તપ છે. સિદ્ધાંતમાં પણ ઇ પ્રકારના અંતરંગ તપોમાં ચોદ્યું સ્વાધ્યાય તપ કહ્યું છે, તેનાથી ઉત્કૃષ્ટ કાર્યોત્સર્જ અને દ્યાન જ છે, માટે તપ કરવામાં પણ જ્ઞાનાભ્યાસ જ પ્રદાન છે.

જીવાંકના વિશેષરૂપ ગુણસ્થાનાંકનું સ્વરૂપ જાણવાથી જ અરહંત આંકનું સ્વરૂપ યથાર્થ રીતે ઓળખી શકાય છે, તથા આપણી અવસ્થા ઓળખી શકાય છે, આવી ઓળખાણ થવાથી જે અંતરંગમાં તીવ્ર ભક્તિ પ્રગટ થાય છે, તે બહુ કાર્યકારી છે અને જે કુળ-ક્રમાંકથી ભક્તિ થાય છે, તે કિંચિત્માત્ર જ ફળ આપે છે. માટે ભક્તિમાં પણ જ્ઞાનાભ્યાસ જ પ્રદાન છે.

દાન ચાર પ્રકારના છે. જેમાં આહારદાન, ઔષધદાન, અભયદાન તો તત્કાલ ક્ષુદ્રાના દુઃખને કે રોગના દુઃખને અથવા મરણાંકન ભયના દુઃખને જ દૂર કરે છે, પરંતુ જે જ્ઞાનદાન છે, તે અનંત લવોથી ચાલ્યા આવતા દુઃખને દૂર કરવામાં કારણ છે. તીર્થકર, કેવળી, આચાર્યાંકની પણ જ્ઞાનદાનની પ્રવૃત્તિ મુજબ છે. તેથી જ્ઞાનદાન ઉત્કૃષ્ટ છે. માટે જેને જ્ઞાનાભ્યાસ હોય તો તે પોતાનું ભલું કરી લે છે અને અન્યજીવોને પણ જ્ઞાનદાન આપે છે.

જ્ઞાનાભ્યાસ વિના જ્ઞાનદાન દેવું કેવી રીતે થઈ શકે? માટે દાનમાં

પણ જ્ઞાનાભ્યાસ જ પ્રધાન છે.

જેમ જન્મથી જ કોઈ પુરુષ ઠગોના ઘરે પહોંચી જાય, ત્યાં તે ઠગોને પોતાના માને છે. કદાચિત્ કોઈ પુરુષ કોઈ નિમિત્તથી પોતાના કુળનું અને ઠગોનું ચથાર્થ જ્ઞાન કરવાથી ઠગોથી અંતરંગમાં ઉદાસીન થઈ જાય છે. તેઓને પર જાણી સંબંધ છોડવા દઈછે છે. બહારમાં જેવું નિમિત્ત છે એવું પ્રવર્તન કરે છે અને કોઈ પુરુષ તે ઠગોને પોતાના જ જાણે છે, કોઈ કારણથી કોઈ ઠગોથી અનુરાગ કરે છે અને કોઈ ઠગોથી લડીને ઉદાસીન થાય છે, આહારાદિકનો ત્યાગ કરી હે છે.

તેમ જ અનાદિથી બધા જીવ સંસારને પ્રાક્ત છે, ત્યાં કર્મોને પોતાના માને છે. તેમાંથી કોઈ જીવ કોઈ નિમિત્તથી જીવ અને કર્મનું ચથાર્થ જ્ઞાન કરીને કર્મોથી ઉદાસીન થઈ તેને પર માનવા લાગે, તેનાથી સંબંધ છોડવા દઈછે છે. બાહ્યમાં જેવું નિમિત્ત છે, તેવી પ્રવૃત્તિ કરે છે. આ પ્રકારે જે જ્ઞાનાભ્યાસ ફ્રારા જે ઉદાસીનતા થાય છે, તે જ કાર્યકારી છે. કોઈ જીવ તે કર્મોને પોતાના માને છે અને કોઈ કારણથી કોઈ શુભ કર્મોથી અનુરાગરૂપ પ્રવૃત્તિ કરે છે, કોઈ અશુભ કર્મને દુઃખનું કારણ જાણી ઉદાસીન થઈ વિષયાદિકનો ત્યાગી થાય છે.

આ પ્રકારે જ્ઞાન વિના જે ઉદાસીનતા થાય છે, તે પુણ્યફળની દાતા છે, મોક્ષકાર્યને સાધતી નથી. માટે ઉદાસીનતામાં પણ જ્ઞાનાભ્યાસ જ પ્રધાન છે. આ પ્રકારે અન્ય પણ શુભ કાર્યોમાં જ્ઞાનાભ્યાસને જ પ્રધાન જાણશો. જુઓ, મહામુનિઓના પણ દ્વારા અને અદ્યયન - બંને ચ કાર્ય મુખ્ય છે. માટે આ શાસ્ત્રના અદ્યયન ફ્રારા જીવ તથા કર્મનું સ્વરૂપ જાણી સ્વરૂપનું દ્વારા કરવું.

**પ્રશ્ન ૧૪:-** અહીં કોઈ તર્ક કરે કે - કોઈ જીવ શાસ્ત્ર અદ્યયન તો ધણું કરે છે અને વિષયાદિકનો ત્યાગી નથી થતો, તો તેને શાસ્ત્ર અદ્યયન કાર્યકારી છે કે નહીં? જો છે, તો મહિત પુરુષ શા માટે વિષયાદિક તજે? અને જો ન તજે, તો જ્ઞાનાભ્યાસની મહિમા ક્યાં રહી?

**ઉત્તર :-** શાસ્ત્રાભ્યાસી લે પ્રકારના છે. ૧. લોભાર્થી ૨. ધર્માર્થી. ત્યાં જે જીવ અંતરંગ અનુરાગ વગર જ્યાતિ-પૂજા-લાભાદિકના પ્રયોજનથી શાસ્ત્રાભ્યાસ કરે, તે લોભાર્થી છે. તે વિષયાદિકનો ત્યાગ નથી કરતો અથવા જ્યાતિ-પૂજા-લાભાદિકના અર્થે

વિષયાદિકનો ત્યાગ પણ કરે છે, છતાં પણ તેનો શાસ્ત્રાભ્યાસ કાર્યકારી નથી.

જે જીવ અંતરંગ અનુરાગથી આત્મહિતના અર્થે શાસ્ત્રાભ્યાસ કરે છે, તે ધર્મથી છે.

પ્રથમ તો જૈન શાસ્ત્રો જ એવા છે કે જે તેનું ધર્મથી થઈ અભ્યાસ કરે છે, તે વિષયાદિકનો ત્યાગ કરે જ કરે છે; તેનો તો જ્ઞાનાભ્યાસ કાર્યકારી છે જ.

કદાચિત્ત પૂર્વકર્મોદ્યની પ્રબળતાથી જ્યાયરૂપ વિષયાદિકનો ત્યાગ ન થઈ શકે, તો પણ તેના સમ્યક્ષર્ણન-જ્ઞાનના હોવાથી જ્ઞાનાભ્યાસ કાર્યકારી હોય છે, જે પ્રમાણે અસંયત ગુણસ્થાનમાં વિષયાદિકના ત્યાગ વિના પણ મોક્ષમાર્ગણું હોય છે.

પ્રશ્ન ૧૫ :- જે ધર્મથી થઈને જૈનશાસ્ત્રોનો અભ્યાસ કરે છે તેના વિષયાદિકનો ત્યાગ ન થઈ શકે એવું તો નથી થતું કેમ કે વિષયાદિકનું સેવન પરિણામોથી થાય છે અને પરિણામ સ્વાધીન હોય છે.

ઉત્તર :- પરિણામ બે પ્રકારના છે. ૧. બુદ્ધિપૂર્વક ૨. અબુદ્ધિપૂર્વક. ત્યાં જે પરિણામ પોતાના અભિપ્રાય અનુસાર થાય તે બુદ્ધિપૂર્વક અને જે પરિણામ દૈવ(કર્મ)ના નિમિત્તથી પોતાના અભિપ્રાયથી વિરુદ્ધય (અન્યથા) થાય તે અબુદ્ધિપૂર્વક.

જેમ સામાચિક કરતી વેળા ધર્મત્બાનો અભિપ્રાય તો એવો છે કે હું મારા પરિણામ શુભરૂપ રાખું. ત્યાં જે શુભ પરિણામ જ થાય તે તો બુદ્ધિપૂર્વક છે અને જો કર્મોદ્યથી સ્વચ્યમેવ અશુભ પરિણામ થાય, તે અબુદ્ધિપૂર્વક જાણવા.

તે જ પ્રમાણે ધર્મથી થઈને જે જૈનશાસ્ત્રોનો અભ્યાસ કરે છે તેનો અભિપ્રાય તો વિષયાદિકના ત્યાગરૂપ વીતરાગભાવની પ્રાસિનો જ હોય છે. ત્યાં વીતરાગભાવ હોય છે, તે બુદ્ધિપૂર્વક છે અને ચારિત્રમોહના ઉદ્દયથી (ઉદ્યને વશ થવાથી) સરાગ ભાવ થાય છે, તે અબુદ્ધિપૂર્વક છે. તેથી સ્વવશ વિના(પરવશ) જે સરાગ ભાવ થાય છે, તેનાથી તેની વિષયાદિકની પ્રવૃત્તિ દેખાઈ રહી છે, કારણ કે બાહ્ય-પ્રવૃત્તિનું કારણ પરિણામ છે.

પ્રશ્ન ૧૬ :- જો આ પ્રકારે છે, તો અમે પણ વિષયાદિકનું સેવન

કરીશું અને કહીશું - અમારે ઉદ્યાધીન કાર્ય થાય છે.

ઉત્તર :- રે મૂર્ખ! કહેવાથી તો કાંઈ થતું નથી. સિદ્ધિ તો અભિપ્રાય અનુસાર થાય છે. માટે જૈનશાસ્ત્રોના અભ્યાસ છ્ણારા પોતાના અભિપ્રાયને સમ્યકૃતપ કરવો. અંતરંગમાં વિષયાદિક સેવનનો અભિપ્રાયહો, તો ધર્માર્થી નામ નથી પામતો. આ પ્રકારે ચરણાનુયોગના પક્ષપાતીને આ શાસ્ત્રોના અભ્યાસમાં સન્મુખ કર્યો.

પ્રશ્ન ૧૭ :- હવે બ્રહ્મયાનુયોગનો પક્ષપાતી કહે છે કે આ શાસ્ત્રમાં જીવના ગુણસ્થાનાદિત્પ વિશેષ અને કર્મના વિશેષ લેદનું વર્ણન કર્યું છે, પરંતુ તેના જીવાયાથી તો અનેક વિકલ્પ-તરંગ ઉત્પન્ન થાય છે અને કાંઈ સિદ્ધિ થતું નથી. માટે પોતાના શુદ્ધ સ્વરૂપને અનુભવવો અથવા સ્વ-પરનું લેદવિજ્ઞાન કરવું, એટલું જ કાર્યકારી છે. અથવા તેના ઉપદેશક જે અદ્યાત્મ શાસ્ત્ર છે, તેનો જ અભ્યાસ કરવો ચોગ્ય છે.

ઉત્તર :- હે સૂક્ષ્માભાસ બુદ્ધિ ! તે કહ્યું તે સત્ય છે, પરંતુ પોતાની અવસ્થા જોવી. જે સ્વરૂપાનુભવમાં તથા લેદવિજ્ઞાનમાં ઉપયોગ નિરંતર રહે છે તો અન્ય વિકલ્પ શા માટે કરવા? ત્યાં જ સ્વરૂપાનંદ સુધારસનો સ્વાદી થઈ સંતુષ્ટ થવું, પરંતુ નીચલી ભૂમિકામાં ત્યાં નિરંતર ઉપયોગ કરતો જ નથી, ઉપયોગ અનેક અવલંબનોને દીખ્યે છે. તેથી જે સમયે ત્યાં ઉપયોગ ન લાગે ત્યારે ગુણસ્થાનાદિ વિશેષ જીવાયાનો અભ્યાસ કરવો.

તથા તે કહ્યું કે અદ્યાત્મ શાસ્ત્રોનો જ અભ્યાસ કરવો, જે ચોગ્ય જ છે, પરંતુ ત્યાં લેદ-વિજ્ઞાન કરવા માટે સ્વ-પરનું સામાન્યપણે સ્વરૂપ નિરૂપણ છે અને વિશેષ જ્ઞાન વિના સામાન્યનું જાણવું સ્પષ્ટ નથી થતું. માટે જીવ અને કર્મને વિશેષ સારી રીતે જીવાયાથી જ સ્વ-પરનું જાણવું સ્પષ્ટ થાય છે. તે વિશેષ જીવાયા માટે આ શાસ્ત્રોનો અભ્યાસ કરવો, કારણકે સામાન્ય શાસ્ત્રથી વિશેષ શાસ્ત્ર નિશ્ચયથી બળવાન હોય છે. ત્યાં કહ્યું છે, “સામાન્યશાસ્ત્રોનૂં વિશેષો બલવાન ભવેત्”

પ્રશ્ન ૧૮ :- અદ્યાત્મ શાસ્ત્રોમાં તો ગુણસ્થાનાદિ વિશેષોથી રહિત શુદ્ધ સ્વરૂપનો અનુભવ કરવો ઉપાદેય કહ્યું છે અને અહીં ગુણસ્થાનાદિ સહિત જીવનું વર્ણન છે, માટે અદ્યાત્મ શાસ્ત્ર અને આ શાસ્ત્રમાં તો વિરુદ્ધતા ભાસે છે, તે કેવી રીતે છે ?

ઉત્તર :- નય બે પ્રકારના છે. ૧. નિશ્ચયનય ૨. વ્યવહારનય.

નિશ્ચયનયથી જીવનું સ્વરૂપ ગુણસ્થાનાદિ વિશેષ રહિત, અલેદ્વસ્તુ માત્ર જ છે અને વ્યવહારનયથી ગુણસ્થાનાદિ વિશેષ સહિત અનેક પ્રકાર છે. ત્યાં જે જીવ સર્વોત્કૃષ્ટ, અલેદ, એક સ્વભાવને અનુભવે છે, તેઓને તો ત્યાં શુદ્ધ ઉપદેશરૂપ જે શુદ્ધ નિશ્ચયનય છે, તે જ કાર્યકારી છે. જે સ્વાનુભવદશાને પ્રાપ્ત નથી થયા, તથા જે સ્વાનુભવદશાથી છૂટીને સવિકલ્પદશાને પ્રાપ્ત થયા છે - એવા અનુતૃપ્ત જે અશુદ્ધસ્વભાવ, તેમાં સ્થિત જીવોને વ્યવહારનય પ્રયોજનવાન છે. તે જ અદ્યાત્મમશાસ્ત્ર સમયસાર ગાથા - ૧૨માં કહ્યું છે:-

**સુદ્ધો સુદ્ધાદેસો, ણાદબ્વો પરમભાવદરસીહિં ।  
વવહારદેસિદા પુણ, જે દુ અપરમે ટ્રિદા ભાવે ॥**

આ ગાથાની વ્યાખ્યાના અર્થને વિચારી જો જો. સાંભળો ! તમારા પરિણામ સ્વરૂપાનુભવ દશામાં તો વર્તતા નથી અને વિકલ્પ જાણી ગુણસ્થાનાદિ લેદોનો વિચાર નહીં કરો તો તમે ઇતોભ્રષ્ટ: તતોભ્રષ્ટ: થઈને અશુલોપયોગમાં જ પ્રવર્તન કરશો, ત્યાં તમારું ખરાબ જ થશે.

અને સાંભળો ! સામાન્યપણાથી તો વેદાંત આદિ શાસ્ત્રાભ્યાસોમાં પણ જીવનું સ્વરૂપ શુદ્ધ કહ્યું છે, ત્યાં વિશેષને જાણ્યા વિના યથાર્થ-અથથાર્થનો નિશ્ચય(નિર્ણય) ડેવી રીતે થશે ?

માટે ગુણસ્થાનાદિ વિશેષ જાણવાથી જીવની શુદ્ધ-અશુદ્ધ-મિશ્ર અપસ્થાનું જ્ઞાન થાય છે, ત્યારે નિર્ણય કરીને યથાર્થને અંગીકાર કરજો અને સાંભળો ! જીવનો ગુણ જ્ઞાન છે, તેથી વિશેષ જાણવાથી આત્મગુણ પ્રગટ થાય છે. આપણું શ્રદ્ધાન પણ ક્રઢ થાય છે. જેમ સમ્યકૃત્વ છે, તે કેવળજ્ઞાન પ્રાપ્ત થતા પરમાવગાઢ નામને પ્રાપ્ત થાય છે, માટે વિશેષોને જાણવું.

**પ્રશ્ન ૧૮ :- આપે કહ્યું તે સત્ય, પરંતુ કરણાનુયોગ ઝારા વિશેષ જાણવાથી પણ ક્રિયાલિંગી મુનિ અદ્યાત્મ શ્રદ્ધાન વિના સંસારી જ રહે છે અને અદ્યાત્મનું અનુસરણ કરવાવાળા તિર્યંચો આદિને અત્ય જ્ઞાન હોવા છતાં પણ યથાર્થ શ્રદ્ધાનથી સમ્યકૃત્વ પ્રાપ્ત થઈ જાય છે. તથા તુષ્માષભિન્નઃ એટલું જ શ્રદ્ધાન કરવા માત્રથી શિવભૂતિ મુનિરાજ મુક્ત થયા છે. તેથી અમારી જુદ્ધથી તો વિશેષ વિકલ્પોનું સાધન નથી થતું. પ્રયોજનમાત્ર અદ્યાત્મનો અભ્યાસ કરીશું.**

ઉત્તર :- બ્રહ્મલિંગી મુનિરાજ જે પ્રકારે કરણાનુયોગ છારા વિશેષને જાણે છે, તે જ પ્રકારે અદ્યાત્મ શાસ્ત્રોનું જ્ઞાન પણ તેને હોય છે. પરંતુ મિથ્યાત્પના ઉદ્દ્યથી (મિથ્યાત્પવશ) અયથાર્થ સાધન કરે છે, તો શાસ્ત્ર શું કરે?

શાસ્ત્રોમાં તો પરસ્પર વિરોધ છે નહીં, કેવી રીતે? તે કહીએ છીએ:- કરણાનુયોગના શાસ્ત્રોમાં તથા અદ્યાત્મ શાસ્ત્રોમાં પણ રાગાદિક ભાવ, આત્માને કર્મ નિમિત્તથી ઉત્પન્ન થતા કહે છે, બ્રહ્મલિંગી તેના સ્વયં કર્તા થઈને પ્રવર્તે છે અને શરીરશ્રિત સર્વ શુભાશુલ કિયા પુદ્ગલમથી કહી છે, પરંતુ બ્રહ્મલિંગી તેને પોતાની જાણીને તેમાં ગ્રહણ-ત્યાગની બુદ્ધિ કરે છે.

બધાં જ શુભાશુભભાવ, આશ્રવ-બંધના કારણ કહ્યા છે, પરંતુ બ્રહ્મલિંગી શુભભાવોને સંવર, નિર્જરા અને મોક્ષનું કારણ માને છે. શુદ્ધભાવને સંવર, નિર્જરા અને મોક્ષનું કારણ કહ્યું છે, પરંતુ બ્રહ્મલિંગી તેને ઓળખતો જ નથી અને પ્રગત શુદ્ધાત્મસ્વરૂપને મોક્ષ કહ્યો છે તેનું બ્રહ્મલિંગીને થથાર્થ જ્ઞાન જ નથી. આ પ્રકારે અન્યથા સાધન કરે, તો તેમાં શાસ્ત્રનો શું દોષ છે?

તે કહ્યું કે તિર્યચાદિને સામાન્ય શ્રદ્ધાનથી કાર્યસિદ્ધ થઈ જાય છે. તિર્યચાદિકને પણ પોતાના ક્ષ્યોપશમ અનુસાર વિશેષનું જાણવું થાય જ છે. અથવા પૂર્વ પયયોમાં (પૂર્વભવમાં) વિશેષનો અત્યાસ કર્યો હતો, તે સંસ્કારના બળથી (વિશેષનું જાણવું) સિદ્ધ થાય છે.

જે પ્રકારે કોઈએ ક્યાંચ દટાયેલું ઘન મેળવ્યું, તો તે પ્રકારે આપણે પણ મેળવશું, એવું માની બધાએ વ્યાપારાદિકનો ત્યાગ કરવો ચોગ્ય નથી. તે પ્રકારે કોઈને અલ્પ શ્રદ્ધાન છારા જ કાર્ય સિદ્ધ થયું છે. તો આપણે પણ આ પ્રકારે જ કાર્યની સિદ્ધિ કરીશું, એવું માની બધાએ વિશેષ અત્યાસનો ત્યાગ કરવો ઉચિત નથી, કારણ કે તે રાજમાર્ગ નથી. રાજમાર્ગ તો આ જ છે. વિવિધપ્રકારના વિશેષ (લેદ) જાણી તત્વોનો નિર્ણય થવાથી જ કાર્ય સિદ્ધ થાય છે.

તે જે કહ્યું કે મારી બુદ્ધિથી વિકલ્પ સાધન નથી થતાં, તો જેટલો થઈ શકે, તેટલો જ અત્યાસ કર. તું પાપકાર્યમાં તો પ્રવીણ છો અને આ અત્યાસમાં કહે છે ‘મારી બુદ્ધિ નથી,’ તે તો પાપીનું લક્ષણ

છે. આ પ્રકારે વ્યાખ્યાનુયોગના પક્ષપાતીને આ શાસ્ત્રના અભ્યાસમાં સંભુલ કર્યો.

હવે અન્ય વિપરીત વિચારવાળાને સમજાવીએ છીએ :-

પ્રશ્ન ૨૦ :- શબ્દશાસ્ત્રાદિકનો પક્ષપાતી કહે છે કે વ્યાકરણ, ન્યાય, કોશ, છંદ, અલંકાર, કાવ્યાદિક ગ્રંથોનો અભ્યાસ કરાય તો અનેક ગ્રંથોનું સ્વયંમેવ જ્ઞાન થાય છે તથા પંડિતપણું પ્રગટ થાય છે. આ શાસ્ત્રના અભ્યાસથી તો એક આનું જ જ્ઞાન થાય છે તથા પંડિતપણું વિશેષ પ્રગટ થતું નથી. તેથી શબ્દ-શાસ્ત્રાદિકનો અભ્યાસ કરવો.

ઉત્તર :- જો તમો, લોકમાં જ પંડિત કહેડાવવા માંગો છો, તો તમો તેનો જ અભ્યાસ કર્યા કરો અને જો પોતાના (હિતરૂપ) કાર્ય કરવાની દીક્ષા છે, તો આવા જૈન શાસ્ત્રો (ગ્રંથો)નો જ અભ્યાસ કરવા યોગ્ય છે. તથા જૈની તો જીવાદિક તત્વોના નિરૂપણ કરવાવાળા જે જૈન ગ્રંથ છે, તેનો જ અભ્યાસ હોય તો પંડિત માનશે.

પ્રશ્ન ૨૧ :- તો કહે છે કે હું જૈન ગ્રંથોનું વિશેષજ્ઞાન કરવા માટે જ વ્યાકરણાદિકનો અભ્યાસ કરું છું.

ઉત્તર :- એવું છે તો સારું જ છે, પરંતુ એટલું છે કે જે પ્રકારે ચતુર ખેડૂત પોતાની શક્તિ અનુસાર હળાદિક દ્વારા ખેતરને અલ્પ-બહુ સંભાળીને સમય પર બીજ વાવે, તો તેને ફળની પ્રાપ્તિ થાય છે.

તે જ પ્રમાણે તે પણ જો પોતાની શક્તિ અનુસાર વ્યાકરણાદિકના અભ્યાસથી બુદ્ધિને અલ્પ-બહુ સંભાળીને જેટલા સમય સુધી મનુષ્ય પચાય તથા દીનિક્યોની પ્રબળતા દીત્યાદિક છે, તેટલા સમયમાં તત્વજ્ઞાનને કારણ જે શાસ્ત્ર છે, તેનો અભ્યાસ કરીશ, તો તેને સમ્યકૃત્ય આદિની પ્રાપ્તિ થઈ જશે.

જેમ અજ્ઞાની ખેડૂત હળાદિકથી ખેતર ખેડતાં-ખેડતાં જ સમય ગુમાવે અને સમય પર બીજ ન વાવે તો તેને ફળ પ્રાપ્તિ થશે નહીં, વૃથા જ ખેડ-ભિન્ન થશે.

તેજ પ્રકારે તેં પણ જો વ્યાકરણાદિક દ્વારા બુદ્ધિને વધારવા - વધારવામાં જ સમય પિતાવશે, તો સમ્યકૃત્યાદિકની પ્રાપ્તિ થશે નહીં, વૃથા જ ખેડ-ભિન્ન થશે.

આ કાળમાં આચુ, બુદ્ધિ આદિ અલ્પ છે, માટે પ્રયોજન માત્ર

અભ્યાસ કરજે, શાસ્ત્રોનો તો પાર છે જ નહીં અને સાંભળ ! કોઈ જુવ વ્યાકરણાદિકના જ્ઞાન વિના પણ તત્વોપદેશરૂપ ભાષા શાસ્ત્રો છ્નારા તથા ઉપદેશ સાંભળી તથા શીખવાથી પણ તત્વજ્ઞાની થતાં જોવામાં આવે છે. કેટલાંક જુવ કેવળ વ્યાકરણાદિકના જ અભ્યાસમાં જન્મ ગુમાવે છે અને તત્વજ્ઞાની નથી થતાં - એવું પણ જોવામાં આવે છે.

અને સાંભળ ! વ્યાકરણાદિનો અભ્યાસ કરવાથી પુણ્ય ઉત્પન્ન નથી થતું, પરંતુ ધર્મધીંદ્રિય થઈને તેનો અભ્યાસ કરે તો કિંચિત્ પુણ્ય થાય છે. તત્વોપદેશક શાસ્ત્રોના અભ્યાસથી સાતિશય મહાન પુણ્યોપાર્જન થાય છે. માટે સારું તો એ છે કે આવા તત્વોપદેશક શાસ્ત્રોનો અભ્યાસ કરવો જોઈએ. આ રીતે શબ્દ - શાસ્ત્રાદિકના પક્ષપાતીને આ શાસ્ત્રની સંભુખ કર્યા.

**પ્રશ્ન રૂ :-** અર્થ/ધનનો પક્ષપાતી કહે છે કે આ શાસ્ત્રનો અભ્યાસ કરવાથી શું થશે ? સર્વ કાર્ય ધનથી થાય છે. ધનથી જ પ્રભાવના આદિ ધર્મ થાય છે. ધનવાન પાસે અનેક પંડિત આવીને રહે છે. અન્ય પણ સર્વ કાર્યોની સિદ્ધિ થાય છે. તેથી ધન ઉત્પન્ન કરવાનો પુરુષાર્થ કરવો.

**ઉત્તર :-** રે પાપી ! ધન કાંઈ આપણું ઉત્પન્ન કરેલું તો હોતું નથી, ભાગ્યથી થાય છે. આ ગ્રંથાભ્યાસ આદિ ધર્મ-સાધનથી જે પુણ્યની ઉત્પત્તિ થાય છે, તેનું જ નામ ભાગ્ય છે. જે ધન થવું છે તો શાસ્ત્રાભ્યાસ કરવાથી કેવીરીતે નહીં થાય ? અને નથી થવું તો શાસ્ત્રાભ્યાસ નહીં કરવાથી કેવીરીતે થશે ? ધનનું હોવા, ન હોવાપણું તો ઉદ્યાધીન છે. શાસ્ત્રાભ્યાસમાં શા માટે શિથિલ થાય છે ? અને સાંભળ ! ધન છે તે તો વિનાશક છે, ભય સહિત છે, પાપથી ઉત્પન્ન થાય છે, તથા નરકાદિનું કારણ છે.

જે આ શાસ્ત્રાભ્યાસરૂપ જ્ઞાનધન છે, તે અવિનાશી છે, ભય રહિત છે, ધર્મરૂપ છે, સ્વર્ગ-મોક્ષનું કારણ છે. તેથી મહંત પુરુષતો ધનાદિકને છોડીને શાસ્ત્રાભ્યાસમાં જ લાગે છે અને તું પાપી શાસ્ત્રાભ્યાસ છોડી ધન ઉત્પન્ન કરવામાં મોટાઈ સમજે છે, તો તું અનંત સંસારી છે.

તેંબું કે પ્રભાવના આદિ ધર્મ પણ ધનથી થાય છે, પરંતુ તે

પ્રભાવનાઈ ધર્મ તો કિંચિતું સાવધનિક્યા સંચુક્ત છે. માટે સમસ્ત સાવધ પાપ રહિત શાસ્ત્રાભ્યાસઙ્ગ ધર્મ છે, તે પ્રધાન છે. જો એમ ન હોય તો ગૃહસ્થ અવસ્થામાં પ્રભાવનાઈ ધર્મ સાધતા હતાં, તેને છોડી સંયમી થઈ શાસ્ત્રાભ્યાસમાં શા માટે લાગે છે ?

**શાસ્ત્રાભ્યાસ કરવાથી પ્રભાવનાઈ પણ વિશેષ થાય છે.**  
તેં કહ્યું કે ઘનવાનની નજીક પંડિત પણ આવીને રહે છે. તે તો લોભી પંડિત હોય અને અવિવેકી ઘનવાન હોય ત્યાં તો એવું જ થાય છે. શાસ્ત્રાભ્યાસવાળાની તો ઈંજ્ઞાઈક દેવો પણ સેવા કરે છે. અહીં પણ મોટા-મોટા મહંત પુરુષ દાસ થતા જોવામાં આવે છે, માટે શાસ્ત્રાભ્યાસવાળાથી ઘનવાળોને મહંત ના જાણો.

તેં કહ્યું કે ઘનથી સર્વ - કાર્યની સિદ્ધિ થાય છે(પરંતુ એમ નથી). એ ઘનથી તો આ લોક સંબંધી કાંઈક વિષયાઈક કાર્ય એ પ્રકારે સિદ્ધ થાય છે, જેનાથી ઘણા સમય સુધી નરકાઈકના દુઃખ સહેવા પડે છે અને શાસ્ત્રાભ્યાસથી એવા કાર્ય સિદ્ધ થાય છે કે જેનાથી આ લોક-પરલોકમાં અનેક સુખોની પરંપરા પ્રાપ્ત થાય છે.

માટે ઘન ઉત્પન્ન કરવાના વિકલ્પ છોડી શાસ્ત્રાભ્યાસ કરજે અને એવું સર્વથા ન બને તો સંતોષપૂર્વક ઘન ઉપાર્જન કરવાના સાધન કરી શાસ્ત્રાભ્યાસમાં તત્પર રહેજો. આ પ્રકારે ઘન ઉપાર્જન કરવાના પક્ષપાતીને શાસ્ત્રાભ્યાસ સન્મુખ કર્યો.

**પ્રશ્ન ૨૩ :- કામ-ભોગાઈકનો પક્ષપાતી કહે છે કે શાસ્ત્રાભ્યાસ કરવામાં સુખ નથી, મોટાઈ નથી. માટે જેના છારા અહીં જ સુખ થાય એવા જે સ્ત્રીસેવન, ખાવું-પહેરવું ઈત્યાઈક વિષય, તેનું સેવન કરવામાં આવે અથવા જેના છારા અહીં જ મોટાપણું થાય, એવા વિવાહાઈક કાર્ય કરવામાં આવે.**

**ઉત્તર :-** વિષયજનિત જે સુખ છે, તે દુઃખ જ છે, કારણ કે વિષય સુખ તો પર - નિમિત્તથી થાય છે. પહેલા, પછી અને તત્કાળ જ આકુળતા સહિત છે અને જેનો નાશ થવાના અનેક કારણ મળે જ છે. આગામી કાળમાં નરકાઈ દુર્ગતિને પ્રાપ્ત કરાવવાવાળા છે. આવું હોવા જ્તાં પણ તે તારી ઈચ્છાનુસાર મળતા જ નથી, પૂર્વ પુણ્યથી થાય છે, તે માટે વિષમ છે.

જેમ - ખંજવાળથી પીડિત પુરુષ પોતાના અંગને કઠોર વસ્તુથી ખંજવાળે છે, તેવી જ રીતે ઇન્જિન્યોથી પીડિત જીવ, તેની પીડા સહન ન થાય ત્યારે કિંચિત્ માત્ર જેમાં પીડાના પ્રતિકારુપ ભાસે, એવા જે વિષયસુખ, તેમાં વલોખા મારે છે, તે પરમાર્થરૂપ સુખ છે જ નહીં. શાસ્ત્રાભ્યાસ કરવાથી જે સમ્યગ્જ્ઞાન થયું, તેના થકી ઉત્પન્ન આનંદ, તે જ સાચું સુખ છે. તે સુખ સ્વાધીન છે, આકૃગતા રહિત છે, કોઈના છ્ણારા નાણ થતું નથી, મોકશનું કારણ છે, તેથી વિષમ નથી. જે પ્રકારે જે ખંજવાળની પીડા ન હોય તો સહજ જ સુખી થાય છે, તે જ પ્રકારે જ્યારે ત્યાં ઇન્જિન્યો પીડાવા માટે સમર્થ નથી હોતી, ત્યારે સહજ જ સુખ પ્રાપ્ત થાય છે. માટે વિષય સુખને છોડી શાસ્ત્રાભ્યાસ કરવો. જો સર્વથા વિષય ન છૂટે તો જેટલું થઈ શકે તેટલું છોડી, શાસ્ત્રાભ્યાસમાં તત્પર રહેયું.

તે વિવાહાદિક કાર્યમાં મોટાઈ થવાનું કહ્યું, તે મોટાઈ કેટલા દિવસ રહેશે ? જેના માટે મહાપાપારંબ કરી નરકાદિમાં ઘણા કાળ સુધી દુઃખ બોગવવું પડશે. તે કાર્યોમાં તારાથી પણ વધારે ઘન લગાવવાવાળા ઘણા છે, તેથી વિશેષ મોટાઈ પણ થવાવાળી નથી.

શાસ્ત્રાભ્યાસથી તો એવી મોટાઈ થાય છે કે જેની સર્વજ્ઞન મહિમા કરે છે, ઇન્જિન્યોદિક પણ પ્રશંસા કરે છે અને પરંપરાથી સ્વર્ગ-મુક્તિનું કારણ છે. માટે વિવાહાદિક કાર્યોનો વિકલ્પ છોડી શાસ્ત્રાભ્યાસનો પુરુષાર્થ કરવો. સર્વથા ન છૂટે તો બહુ વિકલ્પ ના કરશો. આ પ્રકારે કામ-બોગાદિકના પક્ષપાતીને શાસ્ત્રાભ્યાસમાં સન્મુખ કર્યો.

આ પ્રકારે અન્ય જીવ પણ જે વિપરીત વિચારથી આ ગ્રંથના અભ્યાસમાં અર્થચિ પ્રગટ કરે છે, તેઓને ચથાર્થ વિચાર કરી આ શાસ્ત્રના અભ્યાસમાં સન્મુખ થવા યોગ્ય છે.

**પ્રશ્ન ૨૪ :-** અહીં અન્યમતિ કહે છે કે તમોએ પોતાના જ શાસ્ત્રનો અભ્યાસ કરવાને ક્રઢ કર્યો. અમારા મતમાં વિવિધ યુક્તિ આદિ સહિત શાસ્ત્ર છે. તેનો પણ અભ્યાસ શા માટે ન કરાવાય ?

**ઉત્તર :-** તમારા મતના શાસ્ત્રોમાં આત્મહિતનો ઉપદેશ નથી. ક્યાંક શ્રુત્ગારનો, ક્યાંક ચુદ્ઘનો, ક્યાંક કામ-સેવન આદિનો, ક્યાંક હિંસાદિકનું કથન છે અને તે તો વિના ઉપદેશ જ સહજમાં જ થાય

છે. તેથી તેને ત્યજવાથી હિત થાય છે. અન્યમત તો ઉલ્ટું તેનું જ પોખણ કરે છે. માટે તેનાથી હિત કેમ થશે ?

**પ્રશ્ન ૨૫ :-** ત્યાં કહે છે કે ઈશ્વરે એવી લીલા કરી છે, તેને ભજે છે. તો તેનાથી ભલું થાય છે.

**ઉત્તર :-** ત્યાં કહે છે કે જો ઈશ્વરને સહજ સુખ નથી હોતું ત્યારે સંસારીની જેમ લીલાથી સુખી થયા. જો તે સહજ સુખી હોત તો શા માટે વિષયાઈ સેવન કે ચુદ્ધ આઈ કરે ? કારણ કે મંદબુદ્ધિ પણ વગર પ્રયોજન કિંચિત્ માત્ર પણ કાર્ય નથી કરતાં. એથી જણાય છે કે તે ઈશ્વર આપણા જેવા જ છે. તેનો યશ ગાવાથી શું સિદ્ધ થાશે ?

**પ્રશ્ન ૨૬ :-** તે ફરી કહે છે કે અમારા શાસ્ત્રોમાં ત્યાગ, પૈરાગ્ય, અહિસાઈકનો પણ તો ઉપદેશ છે.

**ઉત્તર :-** તે સર્વ ઉપદેશ પૂર્વિપર વિરોધ સહિત છે. ક્યાંક વિષય પોખાય છે, ક્યાંક નિષેધ કરે છે, ક્યાંક પહેલા પૈરાગ્ય બતાડી, પાછળથી હિસાઈક કરવી તે પુષ્ટ કરે છે. તે વાતુલવચનવત્ત (વાતુલ = જેની બુદ્ધિ ઠેકાણે ન હોય, ખોટી બુદ્ધિ રૂપ) વચન પ્રમાણ કેવી રીતે હોય?

**પ્રશ્ન ૨૭ :-** તે કહે છે કે વેદાંત આઈ શાસ્ત્રોમાં તો તત્પ્રવાનું નિરૂપણ છે.

**ઉત્તર :-** તેને કહીએ છીએ - ના, તે નિરૂપણ પ્રમાણથી બાધિત છે, અયથાર્થ છે, તેનું નિરાકરણ જૈનર્દ્શનના ન્યાયશાસ્ત્રોમાં કર્યું છે, ત્યાંથી જાણવું. માટે અન્યમતના શાસ્ત્રોનો અભ્યાસ ન કરવો. આ પ્રકારે જીવોને આ શાસ્ત્રના અદ્યયનમાં સન્મુખ કર્યા.

તેઓને કહીએ છીએ .....

“હે ભવ્યજનો ! શાસ્ત્રાભ્યાસના અનેક અંગ છે. શાબ્દ કે અર્થનું વાંચવું કે શીખવું, શીખવાડવું, ઉપદેશ દેવો, વિચારવું, સાંલળવું, પ્રશ્ન કરવા, સમાધાન જાળવા, વારંવાર ચર્ચા કરવી ઈત્યાઈ અનેક અંગ છે. ત્યાં જેમ બને તેમ અભ્યાસ કરવો. જો સર્વ શાસ્ત્રોનો અભ્યાસ ન થઈ શકે તો આ શાસ્ત્રમાં સુગમ તથા દુર્ગમ, અનેક અર્થોનું નિરૂપણ છે, ત્યાં જેટલો થાય તેટલો જ અભ્યાસ કરવો, પરંતુ અભ્યાસમાં આળસુ થયું નહીં.”

જુઓ ! શાસ્ત્રાભ્યાસનો મહિમા ! જેના થવાથી જીવ પરંપરાથી આત્માનુભવ દશાને પ્રાપ્ત થાય છે, જેનાથી મોક્ષરૂપ ફળની પ્રાપ્તિ

થાય છે. એ તો દૂર રહ્યું, શાસ્ત્રાભ્યાસથી તત્કાળ પણ કેટલા ગુણ પ્રગટ થાય છે:-

- (૧) કોઇપણ કષાયોની તો મંદિર થાય છે.
- (૨) પંચેન્દ્રિયોના વિષયોમાં થવાવાળી પ્રવૃત્તિ રોકાય છે.
- (૩) અતિ ચંચળ મન પણ એકાગ્ર થાય છે.
- (૪) હિંસાઈ પાંચ પાપ થતાં નથી.
- (૫) અલ્પજ્ઞાન હોવા છતાં ત્રિલોકના ત્રણે કાળ સંબંધી ચરાચર પદાર્થોનું જાણવું થાય છે.
- (૬) હેઠ-ઉપાદેયની ઓળખ થાય છે.
- (૭) આત્મજ્ઞાન સંન્મુખ થાય છે. (જ્ઞાન આત્મસંન્મુખ થાય છે.)
- (૮) વધારે - વધારે જ્ઞાન થવાથી આનંદ ઉત્પન્ન થાય છે.
- (૯) લોકમાં મહિમા/ચરણ વિશેષ થાય છે.

(૧૦) સાતિશાય પુણ્યનો બંધ થાય છે. આટલા ગુણો તો શાસ્ત્રાભ્યાસ કરવાથી તત્કાળ જ પ્રગટ થાય છે, માટે શાસ્ત્રાભ્યાસ અવશ્ય કરવો.

**પ્રશ્ન ૨૮ :-** હે ભવ્ય ! શાસ્ત્રાભ્યાસ કરવાના સમયની પ્રાસિ મહા દુર્લભ છે ! ડેવી રીતે ?

**ઉત્તર :-** એકેન્દ્રિયાઈ અસંજી સુધીના જીવોને તો મન છે જ નહીં. નારકી વેદનાથી પીડિત, તિર્યચ વિવેક રહિત, દેવ વિષયાસક્ત, માટે મનુષ્યોને અનેક સામગ્રી મળ્યા પછી જ શાસ્ત્રાભ્યાસ થાય છે. આ મનુષ્ય પર્યાયની પ્રાસિ જ ક્રબ્ય - ક્ષેત્ર - કાળ - ભાવથી મહાદુર્લભ છે.

ક્રબ્ય અપેક્ષાથી તો લોકમાં મનુષ્ય જીવ ઘણા ઓછા છે, તુરણ સંખ્યાત માત્ર જ છે અને અન્ય જીવોમાં નિગોદિયા અનંત છે, બીજા જીવ અસંખ્યાત છે.

ક્ષેત્ર અપેક્ષાથી મનુષ્યોનું ક્ષેત્ર બહુ જ થોડું અઢાઈદ્ધીપ માત્ર જ છે અને અન્ય જીવોમાં એકેન્દ્રિયોનું ક્ષેત્ર સર્વ લોક છે. અન્યોનું કેટલાંક રાજુ પ્રમાણ છે.

કાળ અપેક્ષાથી મનુષ્ય પર્યાયમાં ઉત્કૃષ્ટ રહેવાનો કાળ ઘણો ઓછો છે. કર્મભૂમિ અપેક્ષાએ પૃથક્તવ કોટી પૂર્વ માત્ર જ છે અને અન્ય પર્યાયમાં ઉત્કૃષ્ટ રહેવાનો કાળ - એકેન્દ્રિયોમાં તો અસંખ્યાત પુદ્ગાલ

પરાવર્તન માત્ર અને અન્યોમાં સંખ્યાત પત્ર્ય માત્ર છે.

ભાવ અપેક્ષાથી તીવ્ર શુભાશુભપણાથી રહિત એવી મનુષ્ય પર્યાયના કારણઙું પરિણામ થવા અતિ દુર્લભ છે. અન્ય પર્યાયને કારણ અશુભઙું કે શુભઙું પરિણામ થવા સુલભ છે. આ પ્રકારે શાસ્ત્રાભ્યાસનું કારણ જે પર્યાય કર્મભૂમિની મનુષ્ય પર્યાય, તેનું દુર્લભપણું જાણાં.

ત્યાં ઉત્તમ નિવાસ, ઉર્ચયકુળ, પૂર્ણ આચુ, ઈન્જિન્યોનું સામર્થ્ય, નિરોગીપણું, સત્તસંગતિ, ધર્મરૂપ અલિપ્રાય, બુદ્ધિની પ્રબળતા આઈની પ્રાપ્તિ થવી ઉત્તરોત્તર મહાદુર્લભ છે. આ પ્રત્યક્ષ દેખાય છે અને આટલી સામગ્રી મળ્યા વિના ગ્રંથાત્યાસ થતો નથી. હવે તે ભાગ્યથી આ અવસર મેળવ્યો છે, માટે તમોને હઠથી પણ તમારા હિત માટે પ્રેરણા કરીએ છીએ.

જેમ થઈ શકે તેમ આ શાસ્ત્રનો અભ્યાસ કરો, અન્ય જીવોને જેમ બને તેમ શાસ્ત્રાભ્યાસ કરાવો અને જે જીવ શાસ્ત્રાભ્યાસ કરે છે, તેની અનુમોદના કરો. પુસ્તક લખાવવા કે શીખવા - શીખવાંદવાવાળાની રિથરતા કરવી, ઇંચ્યાંદ શાસ્ત્રાભ્યાસના બાણ્યકારણ, તેના સાધન કરવા, કારણ કે તેના દ્વારા પણ પરંપરા કાર્ય સિદ્ધ થાય છે અને મહાન પુણ્ય ઉત્પન્ન થાય છે. આ પ્રકારે આ શાસ્ત્રના અભ્યાસાંદમાં જીવોને રૂચિવાન કર્યો.

-0-0-0-0-

નિર્ણયાદી ગ્રંથમાં કાર્યક્રમ અનુભૂતિ પ્રાપ્તિ કરીનું હોય શાળાનગરનાનિ  
એ કેવું હોય નિર્ણયાદીમાં જિલ્હે વિભાગું આપું નાનાની રીત  
૧૮ ઈંડ વિભાગ - : મ. ૧૪૫

નિર્ણયાદીમાં મદાનીપ ઉપરાંત વિધાન ક્રિય નિર્ણયાદી એવી : કાર્ય

## ક્ષેત્રીય અદ્યાય

### મહત્વપૂર્ણ પ્રશ્નોત્તર

પ્રશ્ન ૧ :- કર્મ કોને કહે છે ?

ઉત્તર :- જીવના મોહ - રાગ - છ્લેષરૂપ પરિણામોના નિમિત્તથી સ્વયં  
પરિણામિત કાર્મણાવર્ગાનારૂપ પુદ્ગલની વિશિષ્ટ અવસ્થાને કર્મ કહે છે.

પ્રશ્ન ૨ :- કાર્મણાવર્ગાના કોને કહે છે ?

ઉત્તર :- કર્મરૂપ પરિણામિત થવા યોગ્ય વર્ગણાઓને કાર્મણાવર્ગાના  
કહે છે.

પ્રશ્ન ૩ :- કર્મના મૂળ ભેદ કેટલા છે ?

ઉત્તર :- કર્મના મૂળ આઠ ભેદ છે. - જ્ઞાનાવરણ, દર્શનાવરણ,  
વેદનીય, મોહનીય, આચુ, નામ, ગોત્ર અને અંતરાય. આમાં જ્ઞાનાવરણ,  
દર્શનાવરણ, મોહનીય અને અંતરાય આ ચાર ધાતિકર્મ તથા વેદનીય,  
આચુ, નામ અને ગોત્ર આ ચાર અધાતિ કર્મ છે.

પ્રશ્ન ૪ :- મોહ કોને કહેવાય છે ?

ઉત્તર :- ♦ પરદ્રવ્યમાં જીવને અહંકાર - મમકારરૂપ પરિણામનું થવું તે  
મોહ છે.

♦ ક્રાંતિ, ગુણ, પર્યાય સંબંધી મૂઢ્યતારૂપ પરિણામ, તે મોહ છે.

♦ દેવ - ગુરુ - ધર્મ, આખ, આગમ અને પદાર્થોના સંબંધમાં અજ્ઞાનભાવ,  
તે મોહ છે.

♦ વિપરીત માન્યતા, તત્ત્વોનું અશ્રદ્ધાન, વિપરીત અભિપ્રાય, પર  
પદાર્થોમાં એકત્ર - મમત્વ - કર્તૃત્વ - ભોક્તૃત્વ અને સુખબુદ્ધિ અર્થાતું  
શરીરને પોતાનું સ્વરૂપ માનવું, પંચેન્દ્રિયોના વિષયોમાં સુખ માનવું.  
અનુકૂળ - પ્રતિકૂળ સંયોગોમાં ઈષ્ટ - અનિષ્ટ બુદ્ધિ રાખવી, સ્વયંને  
પરના અથવા પરને પોતાના કર્તા - ધર્તા - હર્તા માનવું ઈદ્યાદિ

મિથ્યાત્પલાવ દર્શન મોહનીય કર્મના ઉદ્યના સમયે અર્થાત् નિમિત્તથી થવાવાળા જીવના શ્રદ્ધાગુણના વિકારી પરિણામોને મોહ કરે છે.

**પ્રશ્ન ૫ :-** રાગ કોને કરે છે ?

**ઉત્તર :-** કોઈ પદાર્થને ઈજ જાણી તેમાં જીવનું પ્રીતિરૂપ પરિણામનું થયું, તે રાગ છે.

માયા, લોલ, હાસ્ય, રતિ, ત્રણ વેદરૂપ પરિણામ અને પરપદાર્થ પ્રતિ આકર્ષણા, સ્નેહ, પ્રેમ, મમત્વબુદ્ધિ, ભોકૃત્વબુદ્ધિ, આસક્તિ ઈત્યાદિ ચારિત્રમોહનીય કર્મોદ્યના સમયે અર્થાત् નિમિત્તથી થવાવાળા જીવના ચારિત્રગુણના કષાયરૂપ પરિણામન (પરિણામો)ને રાગ કરે છે.

**પ્રશ્ન ૬ :-** છ્રેષ્ઠ કોને કરે છે ?

**ઉત્તર :-** કોઈ પદાર્થને અનિષ્ટ જાણી તેમાં જીવનાં અપ્રીતિરૂપ પરિણામનું થયું, તે છ્રેષ્ઠ છે.

કોઇ, માન, અરતિ, શોક, ભય, જુગુપ્સા અને પરપદાર્થો પ્રતિ ધૃણા, ઈધા, છ્રેષ્ઠ, જલન, ક્રોહ, અસૂયા (નિંદા, અપમાન) ઈત્યાદિ ચારિત્રમોહનીય કર્મોદ્યના સમયે (નિમિત્તથી) થવાવાળા જીવના ચારિત્ર ગુણના કષાયરૂપ પરિણામન અર્થાત્ પરિણામોને છ્રેષ્ઠ કરે છે.

**પ્રશ્ન ૭ :-** કર્મોની કેટલી અવસ્થાઓ હોય છે ?

**ઉત્તર :-** કર્મોની દશ અવસ્થાઓ હોય છે. (૧) બંધ (૨) સત્તા (૩) ઉદ્ય (૪) ઉદીરણા (૫) ઉત્કર્ષણ (૬) અપકર્ષણ (૭) સંકમણા (૮) ઉપશાંત (૯) નિધારિત (૧૦) નિકાચિત.

**પ્રશ્ન ૮ :-** બંધ કોને કરે છે ?

**ઉત્તર :-** જીવના મોહ -રાગ - છ્રેષ્ઠરૂપ પરિણામોનું નિમિત્ત પામી કાર્મણા વર્ગણાઓના આત્મપ્રેરેશ સાથે થવાવાળા વિશિષ્ટ પરસ્પર એકશેત્રાવગાહરૂપ સંબંધને બંધ કરે છે.

**પ્રશ્ન ૯ :-** બંધના કેટલા ભેદ હોય છે ?

**ઉત્તર :-** બંધના ચાર ભેદ હોય છે. (૧) પ્રકૃતિબંધ (૨) પ્રદેશબંધ (૩) સ્થિતિબંધ (૪) અનુભાગબંધ

**પ્રશ્ન ૧૦ :-** પ્રકૃતિબંધ કોને કરે છે ?

**ઉત્તર :-** પ્રકૃતિ અર્થાત્ સ્વભાવ. જેમ - લીમડાનો સ્વભાવ કડવો, ગોળનો સ્વભાવ મીઠો હોય છે, તેવી રીતે કર્મોનાં પોત-પોતાના સ્વભાવને

પ્રકૃતિબંધ કહે છે.

♦ કર્મરૂપ પરિણામિત થવા યોગ્ય પુદ્ગલોનું જ્ઞાનાવરણાદિ મૂળ પ્રકૃતિરૂપ તથા ભેદ - ઉત્તરપ્રકૃતિરૂપ પરિણામન થવાનું નામ પ્રકૃતિબંધ છે.

પ્રશ્ન ૧૧ :- પ્રદેશબંધ કોને કહે છે ?

ઉત્તર :- જીવની સાથે પ્રતિસમય જેટલા પુદ્ગલ પરમાણુ કર્મરૂપ પરિણામન કરે છે, તે પ્રમાણ અર્થાત્ સંખ્યાને પ્રદેશબંધ કહે છે.

પ્રશ્ન ૧૨ :- સ્થિતિબંધ કોને કહે છે ?

ઉત્તર :- જ્ઞાનાવરણાદિ કર્મરૂપ પરિણામિત પુદ્ગલ સ્કંધોનું આત્માન સાથે એકલેત્રાવગાહ સ્થિતિરૂપ કાળાવધિના બંધનને સ્થિતિબંધ કહે છે.

પ્રશ્ન ૧૩ :- અનુભાગબંધ કોને કહે છે ?

ઉત્તર :- જ્ઞાનાવરણાદિ કર્મોના રસ વિશેષને અથવા ઇન પ્રદાન કરવાની શક્તિ વિશેષને અનુભાગબંધ કહે છે.

પ્રશ્ન ૧૪ :- સત્ત્વ અથવા સત્તા કોને કહેવાય છે ?

ઉત્તર :- અનેક સમયોમાં બંધાયેલા કર્મોનું વિવક્ષિત કાળ સુધી જીવના પ્રદેશો સાથે અસ્તિત્વ હોવું, તેને સત્ત્વ અથવા સત્તા કહેવાય છે.

પ્રશ્ન ૧૫ :- ઉદ્ય કોને કહે છે ?

ઉત્તર :- કર્મની સ્થિતિ પૂરી થતાં જ, કર્મના ઇન આપવાને ઉદ્ય કહેવાય છે.

પ્રશ્ન ૧૬ :- ઉદીરણા કોને કહે છે ?

ઉત્તર :- જીવના પરિણામોના નિમિત્તથી કર્મની સ્થિતિ પૂરી થયા પહેલા જ કર્મનું ઉદ્યમાં આવી ઇન આપવું, તેને ઉદીરણા કહે છે.

♦ જીવના પરિણામોના નિમિત્તથી કર્મના ઉદ્યાવલીની બાહ્રના નિષેકોનું ઉદ્યાવલીના નિષેકોમાં ભળી જવું ઉદીરણા છે.

♦ જે કર્મનો ઉદ્યકાળ નથી આવ્યો, તે કર્મનું ઉદ્યકાળમાં આવવું તેને ઉદીરણા કહે છે.

♦ અકાળપાક ને ઉદીરણા કહે છે.

પ્રશ્ન ૧૭ :- ઉત્કર્ષણા કોને કહેવાય છે ?

ઉત્તર :- જીવના પરિણામોનું નિમિત પામી કર્મની સ્થિતિ - અનુભાગનું વધવું, તેને ઉત્કર્ષણા કહે છે.

પ્રશ્ન ૧૮ :- અપકર્ષણ કોને કહેવાય છે ?

**ઉત્તર :-** જીવના પરિણામોનું નિભિત્ત પામી કર્મની સ્થિતિ - અનુભાગનું ઘટવું, તેને અપકર્ષણ કહે છે.

**પ્રશ્ન ૧૯ :-** સંક્રમણ કોને કહે છે ?

**ઉત્તર :-** વિવક્ષિત કર્મ પ્રકૃતિઓના પરમાણુઓનું સજીતીય અન્ય પ્રકૃતિરૂપ પરિણામન થવું, તેને સંક્રમણ કહે છે.

**જેમ કે -** વિશુદ્ધ પરિણામોના નિભિત્તથી પૂર્વબદ્ધ અસાતા વેદનીય પ્રકૃતિના પરમાણુઓનું સાતાવેદનીયરૂપ તથા સાતાવેદનીયનું અસાતા વેદનીયરૂપ પરિણામન થવું.

આમાં પણ એટલી વિશેષતા છે કે (૧) મૂળ પ્રકૃતિઓમાં પરસ્પર સંક્રમણ થતું નથી. (૨) ચારે આચુમાં આપસમાં સંક્રમણ નથી થતું (૩) મોહનીયના ઉત્તરભેદ - દર્શનમોહનીયનું ચારિત્રમોહનીયમાં સંક્રમણ નથી થતું. (૪) દર્શનમોહનીયના ભેદોમાં તથા ચારિત્રમોહનીયકર્મના ભેદોમાં પરસ્પર સંક્રમણ થાય છે.

**પ્રશ્ન ૨૦ :-** ઉપશાંત કોને કહે છે ?

**ઉત્તર :-** જે કર્મ ઉદ્યમાં ન આવી શકે, સત્તામાં રહે, તે ઉપશાંત કહેવાય છે.

◆ સત્તાવિષે તિષ્ઠતા અપની-અપની સ્થિતિ કો ધૈરે હૈને જ્ઞાનાવરણાદિક કર્મ કા દ્રવ્ય જા વિષે, જાકી જાવત् કાલ ઉદીરણા ન હોય તાવત् કાલ ઉપશાંત કરણ કહિએ ।

◆ ઉપશાંત કરણ આઠેય કર્મોમાં થાય છે.

◆ ઉપશાંત અવસ્થાને પ્રાપ્ત કર્મનું ઉત્કર્ષણ, અપકર્ષણ અને સંક્રમણ થઈ શકે છે, પરંતુ તેની ઉદીરણા થતી નથી.

◆ કર્મોની દસ અવસ્થાઓમાં ઉપશાંતકરણ છે.

**પ્રશ્ન ૨૧ :-** ઉપશમ કોને કહે છે ?

**ઉત્તર :-** આત્મામાં કર્મની નિજશક્તિનું કારણાવશ પ્રગટ ન થવું ઉપશમ છે. જેમ - કટકફળ(ફટકડી) આદિ દ્રવ્યના સંબંધથી પાણીમાં કીચકનું ઉપશમ થઈ જાય છે.

◆ પરિણામોની વિશુદ્ધતાથી કર્મોની શક્તિનું અનુદ્ભૂત રહેવું અર્થાત् પ્રગટ ન થવું ઉપશમ છે.

- ◆ ઉપશામ માત્ર દર્શનમોહનીય તથા ચારિત્રમોહનીયમાં થાય છે,
- અન્ય કોઈ પણ કર્મોમાં નહીં.
- ◆ કર્મોની દસ અવસ્થાઓમાં ઉપશમકરણ નથી.
- ◆ પ્રશાસ્ત - અપ્રશાસ્ત ભેદ ઉપશાંતના નથી.

પ્રશ્ન ૨૨ :- પ્રશાસ્ત ઉપશામ કોણે કહેવાય છે ?

ઉત્તર :- (અ) અધકરણાદિ ઝારા ઉપશામ વિદ્યાનથી (અનંતાનુબંધી ચતુર્ધ્ય વગર) મોહનીય કર્મની જે ઉપશમતા થાય છે, તેને પ્રશાસ્ત ઉપશામ અથવા અંતરકરણારૂપ ઉપશામ પણ કહેવાય છે.

(બ) આગામી કાળમાં ઉદ્યમાં આવવાયોગ્ય કર્મ પરમાણુઓને જીવજૂત પરિણામ વિશેષ ઝારા આગળ - પાછળ ઉદ્યમાં આવવાયોગ્ય થવાને અંતરકરણારૂપ ઉપશામ કહે છે. ઔપશમિક સમ્યકૃત્વમાં દર્શનમોહનીયનો પ્રશાસ્ત ઉપશામ જ થાય છે.

(ક) ઉદ્ય, ઉદીરણા, ઉત્કર્ષણ, અપકર્ષણ, પરપ્રકૃતિસંક્રમણ, સ્થિતિકાંડકઘાત, અનુભાગકાંડકઘાત વગર કર્મોની સત્તામાં રહેવાને પ્રશાસ્ત ઉપશામ કહે છે.

પ્રશ્ન ૨૩ :- અપ્રશાસ્ત ઉપશામ અથવા સદ્વસ્થારૂપ ઉપશામ કોણે કહે છે ?

ઉત્તર :- અપ્રશાસ્ત ઉપશમનું બીજું નામ સદ્વસ્થારૂપ ઉપશામ પણ છે.

◆ વર્તમાન સમયને છોડીને આગામી કાળમાં ઉદ્યમાં આવવાવાળા કર્મોનું સત્તામાં પડી રહેલું, તેને સદ્વસ્થારૂપ ઉપશામ અથવા અપ્રશાસ્ત ઉપશામ કહે છે.

◆ ઉદ્યનો અભાવ જ અપ્રશાસ્ત ઉપશામ છે.

◆ અનંતાનુબંધીનો અપ્રશાસ્ત ઉપશામ જ હોય છે. જેમ - સર્વધાતિ પ્રકૃતિઓનો ક્ષયોપશામ દશામાં થવાવાળો સદ્વસ્થારૂપ ઉપશામ.

◆ જે કર્મ ત્રણ કરણો વગર જ સત્તામાં સ્વયં દબાયેલા રહે, તેને અપ્રશાસ્ત ઉપશામ કહે છે.

◆ સમ્યકદર્શનના સમયે જે ત્રણ કરણ હોય છે, તે દર્શનમોહનીયકર્મના ઉપશમને લીધે થાય છે, અનંતાનુબંધી કખાયને દબાવવા માટે નહીં, પરંતુ અનંતાનુબંધીનો સદ્વસ્થારૂપ/અપ્રશાસ્ત ઉપશામ સ્વયં થાય છે.

પ્રશ્ન ૨૪ :- નિધત્તિ કોણે કહે છે ?

ઉત્તર :- સંક્રમણ અને ઉદીરણાને અયોગ્ય પ્રકૃતિઓને નિધત્તિ કહે છે.

**પ્રશ્ન ૨૫ :-** નિકાચિત કોને કહે છે ?

**ઉત્તર :-** સંકમણ, ઉદીરણા, ઉત્કર્ષણ તથા અપકર્ષણાને અયોગ્ય પ્રકૃતિઓને નિકાચિત કહે છે.

આ ત્રણો (ઉપશાંત ઝ્લવ્યકર્મ, નિધત્તિ તથા નિકાચિત કર્મ) પ્રકારના કરણ ઝ્લવ્ય અપૂર્વકરણગુણસ્થાન સુધીજ જોવામાં આવે છે, કારણોકે અનિવૃત્તિકરણ ગુણસ્થાનમાં પ્રવેશ કરવાના પ્રથમ સમયમાં જ બદ્ધાં કર્મોના ત્રણો કરણ ચુગપદ વ્યુચિત્ર અર્થાત् નષ્ટ થઈ જાય છે. (ક્રિકાંડ ગાથા: જ્યેણ તથા જ્યાધવલા પુસ્તક: ૧૩, પાનું ૨૩૧,૫૭૫)

**પ્રશ્ન ૨૬ :-** ઉદ્યાવલી કોને કહે છે ?

**ઉત્તર :-** વર્તમાન સમયથી લઈને એક આવલી સુધીના કાળમાં ઉદ્યમાં આવવા યોગ્ય નિષેકોને ઉદ્યાવલી કહે છે.

**પ્રશ્ન ૨૭ :-** નિષેક કોને કહે છે ?

**ઉત્તર :-** એક સમયમાં ઉદ્યમાં આવવાવાળા કર્મપરમાણુના સમૂહને નિષેક કહે છે.

**પ્રશ્ન ૨૮ :-** ક્ષય કોને કહે છે ?

**ઉત્તર :-** કર્મોનું આત્માથી સર્વથા દૂર થવું તેને ક્ષય કહે છે.

◆ કર્મોની કર્મરૂપથી નાશ થવાને અર્થાત् અકર્મદશા થવાને ક્ષય કહે છે.

**પ્રશ્ન ૨૯ :-** શ્રેણી ચઢવાને પાત્ર કોણ હોય છે ?

**ઉત્તર :-** સાતિશાય અપ્રમત્તવિરત નામના સાતમા ગુણસ્થાનવર્તી મુનિરાજ શ્રેણી ચઢવાના પાત્ર છે.

◆ ક્ષાયિક સમ્યક્ષક્રષ્ટિ અપ્રમત્ત મુનિરાજ, ઉપશમ અથવા ક્ષપકશ્રેણી ચઢી શકે છે, પરંતુ દ્ર્ઘીયોપશમ સમ્યક્ષક્રષ્ટિ માત્ર ઉપશમશ્રેણી ચઢી શકે છે.

**પ્રશ્ન ૩૦ :-** શ્રેણી કોને કહે છે ?

**ઉત્તર :-** ચારિત્રમોહનીયની અનંતાનુંબંધી ચતુર્ષય વિના શેષ ૨૧ પ્રકૃતિઓના ઉપશમ અથવા ક્ષયમાં નિમિત્ત થવાવાળા જીવના શુદ્ધભાવો અર્થાત્ વૃદ્ધિગત વીતરાગ પરિણામોને શ્રેણી કહે છે.

**પ્રશ્ન ૩૧ :-** શ્રેણીના કેટલા લેદ છે ?

**ઉત્તર :-** શ્રેણીના બે લેદ છે. ૧) ઉપશમ શ્રેણી અને ૨) ક્ષપકશ્રેણી

**પ્રશ્ન ૩૨ :-** શ્રેણી ચઢવાનો શું અતિપ્રાય છે ?

**ઉત્તર :-** સાતમા ગુણસ્થાનથી આગળ આ જીવ ક્રમથી શુદ્ધભાવોને અર્થાત્ વીતરાગતાને વધારતો જ જાય છે, તેને શ્રેણી ચઢવું કહે છે.

♦ સાતમા ગુણસ્થાનથી આગળ વૃદ્ધિગત વીતરાગ પરિણામોની બે શ્રેણીઓ છે. (૧) ઉપશમ શ્રેણી (૨) ક્ષપક શ્રેણી. પ્રત્યેક શ્રેણીમાં ચાર-ચાર ગુણસ્થાન છે.

**પ્રશ્ન ૩૩ :-** ઉપશમશ્રેણી કોને કહે છે ? તેના કયા-કયા ગુણસ્થાન છે?

**ઉત્તર :-** જેમાં ચારિત્ર મોહનીયની ૨૧ પ્રફૃતિઓની ઉપશમતા સાથે વીતરાગતા વધતી જાય છે, તેને ઉપશમશ્રેણી કહે છે. આઠ-નવ-દસ અને અગ્યાર આ ચાર ગુણસ્થાન ઉપશમ શ્રેણીના છે.

**પ્રશ્ન ૩૪ :-** ક્ષપકશ્રેણી કોને કહે છે ? તેના કયા-કયા ગુણસ્થાન છે?

**ઉત્તર :-** જેમાં ચારિત્ર મોહનીયની ૨૧ પ્રફૃતિઓના ક્ષયની સાથે વીતરાગતા વધતી જાય છે, તેને ક્ષપકશ્રેણી કહે છે. આઠ-નવ-દસ અને બારમું આ ચાર ગુણસ્થાન ક્ષપક શ્રેણીના છે.

**પ્રશ્ન ૩૫ :-** મોહનીય કર્મ કોને કહે છે ? તેના કેટલાં અને કયા-કયા ભેદ છે?

**ઉત્તર :-** જીવના મોહ - રાગ - ક્લેખ આદિ વિકારી પરિણામોના થવામાં નિમિત્ત થવાવાળા કર્મને મોહનીય કર્મ કહે છે. તેના બે ભેદ છે. (૧) દર્શનમોહનીય (૨) ચારિત્રમોહનીય.

**પ્રશ્ન ૩૬ :-** દર્શનમોહનીયના કેટલાં અને કયા-કયા લેદ છે?

**ઉત્તર :-** બંધની અપેક્ષાએ દર્શનમોહનીય કર્મ એક જ પ્રકારે છે. પરંતુ સત્ત્વ અર્થાત્ સત્તા અને ઉદ્યની અપેક્ષાએ ત્રણ લેદ છે.

(૧) મિથ્યાત્પ (૨) સમ્યક્મિથ્યાત્પ (૩) સમ્યક્પ્રફૃતિ.

જેમ - ચક્કીમાં દળોલા ક્ષાર યુક્ત ચોખાના ક્ષાર, ચોખા તથા કટકી આ પ્રમાણે ત્રણ લેદ છે, તે જ પ્રકારે પ્રથમોપશમ સમ્યક્ત્વરૂપી ચક્કીથી દળાયેલા દર્શનમોહનીયકર્મના ત્રણ લેદ છે.

**પ્રશ્ન ૩૭ :-** મિથ્યાત્પદર્શનમોહનીય કર્મ કોને કહે છે?

**ઉત્તર :-** સર્વજ્ઞ પ્રાણિત માર્ગથી વિમુખ થઈને તત્ત્વાર્થ શદ્ધાનમાં નિરૂત્સુક, હિતાહિત વિચાર કરવામાં અસર્મદ્ધ, મિથ્યાત્પ અર્થાત્ વિપરીત માન્યતારૂપ પરિણામોમાં નિમિત્ત થવાવાળા કર્મને મિથ્યાત્પ દર્શનમોહનીય કર્મ કહે છે.

પ્રશ્ન ૩૮ :- સમ્યકુભિદ્યાત્પ દર્શનમોહનીય કર્મ કોણે કહે છે?

ઉત્તર :- પ્રકાલિત ક્ષીણ-અક્ષીણ મંદ-શક્તિવાળા ક્ષાર(ચોખા)ના સમાન ભિશ શ્રેદ્ધાનમાં નિમિત્ત થવાવાળા કર્મને સમ્યકુભિદ્યાત્પ(ભિશ) દર્શનમોહનીય કર્મ કહે છે.

પ્રશ્ન ૩૯ :- સમ્યકુપ્રકૃતિ દર્શનમોહનીય કર્મ કોણે કહે છે?

ઉત્તર :- ક્ષાયોપશમિક સમ્યકૃત્પમાં ચલ, મલ, અગાઢ દોષોના ઉત્પન્ન થવામાં નિમિત્ત થવાવાળા કર્મને સમ્યકુપ્રકૃતિ દર્શનમોહનીય કર્મ કહે છે.

પ્રશ્ન ૪૦ :- ચારિત્રમોહનીય કર્મ કોણે કહે છે?

ઉત્તર :- સમ્યકુદર્શન-જ્ઞાનપૂર્વકરાગ-દ્રેષ્ણની નિવૃત્તિમય આત્મસ્થિરતા રૂપ ચારિત્રની અપ્રગટાનમાં નિમિત્ત થવાવાળા કર્મને ચારિત્રમોહનીય કર્મ કહે છે.

પ્રશ્ન ૪૧ :- ચારિત્ર મોહનીયકર્મના કેટલા લેદ - પ્રલેદ છે? કયા-કયા?

ઉત્તર :- ચારિત્ર મોહનીયકર્મના બે લેદ છે. (૧) કષાય (૨) નોકષાય.

♦ કષાયના સોળ લેદ છે - અનંતાનુંબંધી કોઘ - માન - માચા - લોભ, અપ્રત્યાખ્યાનાવરણીય કોઘ - માન - માચા - લોભ, પ્રત્યાખ્યાનાવરણીય કોઘ - માન - માચા - લોભ, સંજ્યલન કોઘ - માન - માચા - લોભ.

♦ નોકષાયના નવ લેદ છે - હાસ્ય, રતિ, અરતિ, શોક, ભય, જુગુપ્સા, સ્ત્રીવેદ, પુરુષવેદ, નપુંસક વેદ (આ નવ નોકષાય પણ અનંતાનુંબંધી આદિ ચાર લેદ રૂપ પણ હોય છે. અર્થાત્ તેનો ઉદ્ય તે કોઘાદ સાથે થથા સંલખ થાય છે. ખુલાસા માટે ભાવદીપિકા પાના નં. ૪૮ થી ૫૦ કષાયલાવ અંતરાધિકાર વાંચો.)

પ્રશ્ન ૪૨ :- કષાય કર્મ કોણે કહે છે?

ઉત્તર :- અમચ્યાદિત - વિસ્તૃત સંસારરૂપી કર્મક્ષેત્રને ખેડીને આત્મસ્વભાવથી વિપરીત લોકિક સુખ અને દુઃખ આદિ અનેક પ્રકારના ધાર્યના ઉત્પાદક જીવના વિકારી પરિણામોને કષાય કહે છે.

♦ આત્માને દુઃખી કરવાવાળા, આહુળ-દ્વાહુળ કરવાવાળા, કસવાવાળા પરિણામને કષાય કહે છે. આ જ પરિણામોના સમયે પૂર્વબદ્ધ કર્મનો જે ઉદ્ય નિમિત્ત થાય છે, તેને જ કષાય કર્મ કહે છે.

♦ આ કષાય પરિણામોના સમયે સ્વયં કર્મરૂપ પરિણામિત નવી

કર્મએવર્ગણાને કષાય કર્મ કહે છે.

પ્રશ્ન જ૩ :- નોકષાય કર્મ કોને કહે છે ?

ઉત્તર :- નો = કિંચિત्, માત્ર, અત્પ. કિંચિત् કષાય કર્મને નોકષાય કર્મ કહે છે.

પ્રશ્ન જ૴ :- અનંતાનુબંધી કષાય કર્મ કોને કહે છે ?

ઉત્તર :- અનંત + અનુબંધી = અનંતાનુબંધી.

અનંત = સંસાર અર્થાત् મિથ્યાત્પ પરિણામ.

અનુ = સાથે-સાથે.

બંધી = બંધાવવાવાળા.

♦ મિથ્યાત્પ પરિણામની સાથે - સાથે બંધાવવાવાળા કષાય ને અનંતાનુબંધી કષાય કર્મ કહે છે.

♦ જે કષાય અનંત ક્રદ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવોથી અનુબંધ કરે - સંબંધ જોડે, તેને અનંતાનુબંધી કષાય કર્મ કહે છે. જેમ કે - અન્યાય, અનીતિ તથા અવિદેશિક રાજ્યવિરુદ્ધ, લોકવિરુદ્ધ તથા ધર્મવિરુદ્ધ અમર્યાદિતરૂપથી થવાવાળા જીવના કષાય ભાવ.

♦ આ કષાય સમ્યકૃત્પ તથા ચારિત્ર બંનેના ઘાતમાં નિમિત્ત થાય છે.

પ્રશ્ન જ૫ :- અપ્રત્યાખ્યાનાવરણીય કષાય કર્મ કોને કહે છે ?

ઉત્તર :- અપ્રત્યાખ્યાનાવરણ = અપ્રત્યાખ્યાન + આવરણ.

અ = કિંચિત्, અત્પ. પ્રત્યાખ્યાન = ત્યાગ અર્થાત् કિંચિત् ત્યાગ અર્થાત્ દેશચારિત્ર, સંચમાસંચમ. ♦ ક્રદ્યપ્રત અર્થાત્ બુદ્ધિપૂર્વક શુલોપયોગરૂપ બાધ્ય પ્રતોનું વ્યાપ્ત થાયાણા. ♦ ભાવપ્રત/ચારિત્ર અર્થાત્ બે કષાય ચોકડીના અભાવથી વ્યક્ત થવાવાળી વીતરાગતા. જેમ કે - ન્યાય, નીતિ તથા વિદેશિક રાજ્યાદિથી અવિરુદ્ધ મર્યાદાપૂર્વક થવાવાળા જીવના અકષાય ભાવ.

♦ આવરણ = ઢાંકવાવાળું.

♦ જીવના દેશસંચમરૂપ ચારિત્ર પરિણામોને આવૃત્ત કરવામાં અર્થાત્ ઢાંકવામાં નિમિત્ત થવાવાળા કર્મને અપ્રત્યાખ્યાનાવરણીય કષાય કર્મ કહે છે.

પ્રશ્ન જ૬ :- પ્રત્યાખ્યાનાવરણીય કષાય કર્મ કોને કહે છે ?

ઉત્તર :- પ્રત્યાખ્યાનાવરણ = પ્રત્યાખ્યાન + આવરણ

પ્રત્યાખ્યાન = ત્યાગ, મહાપ્રત, સકલસંયમ, સકલચારિત્ર, સંયમ.

◆ ક્રિયાપ્રત અર્થાત् બુદ્ધિપૂર્વક શુભોપયોગરૂપ બાહ્ય મહાપ્રતોનું ગ્રહણા.

◆ ભાવપ્રત/ચારિત્ર અર્થાત् ત્રણ કષાય ચોકડીના અભાવથી વ્યક્ત થવાવાળી વીતરાગતા.

◆ જીવના સકલસંયમરૂપ ચારિત્ર પરિણામોને છાંકવામાં અર્થાત् આવૃત્ત કરવામાં નિમિત્ત થવાવાળા કર્મને પ્રત્યાખ્યાનાવરણીય કષાય કર્મ કહે છે.

પ્રશ્ન ર૭:- સંજ્યપલન કષાય કર્મ કોણે કહે છે ?

ઉત્તર :- સંજ્યપલન = સમ્ભૂ + જ્યપલન. સમ્ભૂ = સારી રીતે, જ્યપલન = પ્રકાશિત થયું. જીવના સકલસંયમ પરિણામોની સાથે જે સારી રીતે પ્રકાશિત થાય છે, રહી શકે છે. (નષ્ટ થાય છે, બણે છે)

◆ જે સકલસંયમ પરિણામોના ઘાતમાં નિમિત્ત નથી થતાં, પરંતુ સકલસંયમની સાથે રહે છે, તેને સંજ્યપલન કષાય કહે છે.

◆ જીવના ચથાખ્યાતચારિત્ર પરિણામો અર્થાત્ પૂર્ણ વીતરાગભાવના ઘાતમાં નિમિત્ત થવાવાળા કર્મને સંજ્યપલન કષાય કર્મ કહે છે.

પ્રશ્ન ર૮:- ક્ષયોપશમ કોણે કહે છે ?

ઉત્તર :- વર્તમાનકાળના સર્વધાતિ સ્પર્ધકોનો ઉદ્યાભાવી ક્ષય, ભવિષ્યકાળમાં ઉદ્યમાં આવવા યોગ્ય સર્વધાતિ સ્પર્ધકોનું સદયસ્થારૂપ ઉપશમ અને વર્તમાનકાલીન દેશધાતિ સ્પર્ધકોનો ઉદ્ય, આ ત્રણોરૂપ કર્મની અવસ્થાને ક્ષયોપશમ કહે છે.

પ્રશ્ન ર૯:- ઉદ્યાભાવીક્ષય કોણે કહે છે ?

ઉત્તર :- જ્યારે સર્વધાતિ સ્પર્ધકોનો ઉદ્ય હોય છે, ત્યારે આત્માના ગુણની થોડીપણ અભિવ્યક્તિ નથી થતી, માટે આ ઉદ્યના અભાવને ઉદ્યાભાવી ક્ષય કહે છે.

◆ આત્મગુણો (પર્યાયો)ની કિંચિત્ પણ અભિવ્યક્તિ ન થવામાં નિમિત્ત થવાવાળા સર્વધાતિ સ્પર્ધકોનો ઉદ્યના અભાવને ઉદ્યાભાવીક્ષય કહે છે.

◆ સર્વધાતિ સ્પર્ધક અનંતગણા હીન થઈ- થઈને અર્થાત્ ઉદ્યના એક સમય પહેલા દેશધાતિ સ્પર્ધકમાં પરિણામિત થઈને ઉદ્યમાં આવે છે. તે સર્વધાતિ સ્પર્ધકોનું અનંતગણું હીનત્વ જ ક્ષય કહેવાય છે. તેને જ સ્તિબુક સંકમણ કહે છે.

**પ્રશ્ન ૫૦ :- ધાતિકર્મ કોને કહે છે ?**

**ઉત્તર :-** જીવના જ્ઞાનાદિ અનુજીવી ગુણોના ધાતમાં અર્થાત् જ્ઞાનાદિગુણોની પર્યાયોના વ્યક્ત ન થવામાં નિમિત થવાવાળા કર્મને ધાતિકર્મ કહે છે.

◆ આઠ કર્મોમાં જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય અને અંતરાય આ ચારધાતિકર્મ છે. તેના બે લેણ છે. (૧) સર્વધાતિ (૨) દેશધાતિ.

**પ્રશ્ન ૫૧ :- સર્વધાતિ કર્મ કોને કહે છે ?**

**ઉત્તર :-** જીવના જ્ઞાનાદિ ગુણોની (પર્યાયોની) પૂર્ણપણે ધાત કર્વામાં નિમિત થવાવાળા કર્મને સર્વધાતિ કર્મ કહે છે.

**પ્રશ્ન ૫૨ :- સર્વધાતિ પ્રકૃતિઓ કેટલી અને કઈ - કઈ છે ?**

**ઉત્તર :-** (૧) કેવળજ્ઞાનાવરણ (૨) કેવળદર્શનાવરણ (૩) નિંદ્રા (૪) નિંદ્રા - નિંદ્રા (૫) પ્રચલા (૬) પ્રચલા - પ્રચલા (૭) સ્ત્ર્યાનગૃહિય (૮ - ૧૧) અનંતાનુંબંધી ચતુર્ષય (૧૨ - ૧૫) અપ્રત્યાખ્યાનાવરણ ચતુર્ષય (૧૬ - ૧૯) પ્રત્યાખ્યાનાવરણ ચતુર્ષય (૨૦) મિથ્યાત્પ દર્શન મોહનીય (૨૧) સમ્યક્મિથ્યાત્પ દર્શનમોહનીય. આ ૨૧ પ્રકૃતિઓ સર્વધાતિ છે.

**પ્રશ્ન ૫૩ :- દેશધાતિ કર્મ કોને કહે છે ?**

**ઉત્તર :-** જીવના જ્ઞાનાદિ ગુણોને એકદેશ (ાંશિક) ધાતમાં નિમિત થવાવાળા કર્મને દેશધાતિ કર્મ કહે છે.

**પ્રશ્ન ૫૪ :- દેશધાતિ પ્રકૃતિઓ કેટલી અને કઈ - કઈ છે ?**

**ઉત્તર :-** (૧) મતિજ્ઞાનાવરણ (૨) શ્રુતજ્ઞાનાવરણ (૩) અવધિજ્ઞાનાવરણ (૪) મન:પર્યાયજ્ઞાનાવરણ (૫) ચક્ષુદર્શનાવરણ (૬) અચ્છુક્ષુદર્શનાવરણ (૭) અવધિદર્શનાવરણ (૮) સમ્યક્ત્વ પ્રકૃતિ (૯ - ૧૨) સંજ્વલન ચતુર્ષય (૧૩ - ૨૧) હાસ્યાદિ નવ નોકખાય (૨૨) દાનાતંત્રાય (૨૩) લાભાતંત્રાય (૨૪) બોગાતંત્રાય (૨૫) ઉપબોગાતંત્રાય (૨૬) વીચાતંત્રાય - આ ૨૬ પ્રકૃતિઓ દેશધાતિ છે.

**પ્રશ્ન ૫૫ :- અવિભાગી - પ્રતિરછેદ કોને કહે છે ?**

**ઉત્તર :-** શક્તિના અવિભાગી અંશને અવિભાગી પ્રતિરછેદ કહે છે. અ = નહીં, વિભાગ = અંશ અર્થાત् જેનો બીજો અંશ (ભાગ) ન થઈ શકે, તે અવિભાગી છે. પ્રતિરછેદ = શક્તિનો અંશ

♦ ફ્રલ્યમાં સહૃદી નાનો પરમાણુ તથા કાલાણુ, ક્ષેત્રની અપેક્ષાએ આકાશનો એક પ્રદેશ, કાળની ફ્રલ્યિથી સહૃદી નાનો સમય અને ભાવની અર્થાત્ શક્તિની અપેક્ષાએ બધાથી નાનો અંશ અવિભાગી પ્રતિચ્છેદ છે.

**પ્રશ્ન પ૫ :-** વર્ગ કોને કહે છે ?

**ઉત્તર :-** સમાન (સરખા) અવિભાગી - પ્રતિચ્છેદોના સમૂહને વર્ગ કહે છે. જો કે પ્રત્યેક પરમાણુમાં અનંત અવિભાગી - પ્રતિચ્છેદ હોય છે. માટે પ્રત્યેક પરમાણુ એક વર્ગ છે.

**પ્રશ્ન પ૬ :-** વર્ગિણા કોને કહે છે ?

**ઉત્તર :-** સમાન(સરખા) અવિભાગી - પ્રતિચ્છેદોથી ચુક્ત વર્ગોના સમૂહને વર્ગિણા કહે છે.

**પ્રશ્ન પ૭ :-** સ્પર્ધક કોને કહે છે ?

**ઉત્તર :-** એક એક અવિભાગી - પ્રતિચ્છેદોથી અધિક વર્ગોના સમૂહઃપ્ર વર્ગિણાઓ જ્યાં સુધી ઉપલબ્ધ થાય, તે વર્ગિણાઓના સમૂહને સ્પર્ધક કહે છે.

♦ અનેક પ્રકારની અનુભાગશક્તિથી ચુક્ત કાર્મણવર્ગિણાઓને અર્થાત્ કર્મસમૂહને સ્પર્ધક કહે છે.

♦ સર્વધાતિ પ્રકૃતિમાં સંપૂર્ણ સ્પર્ધક સર્વધાતિ જ હોય છે, તેમાં દેશધાતિ સ્પર્ધક નિયમથી હોતા નથી. આ કારણથી સર્વધાતિ પ્રકૃતિમાં કર્મનો ક્ષયોપશમ ઘટિત થતો નથી.

જેમ કે - કેવળજ્ઞાનાવરણ કર્મ.

♦ દેશધાતિ પ્રકૃતિમાં સ્પર્ધક, સર્વધાતિ તથા દેશધાતિ બંને પ્રકારના હોય છે. આ કારણથી દેશધાતિ કર્મોના ઉદ્યકાળમાં કર્મનો ક્ષયોપશમ ઘટિત થાય છે અને જીવના જ્ઞાનાદિ અનુજીવી ગુણાની પથ્યિ પ્રગટ થાય છે. જેમ કે - મતિજ્ઞાનાવરણાદિ દેશધાતિકર્મ.

**પ્રશ્ન પ૮ :-** પૂર્વસ્પર્ધક કોને કહે છે ?

**ઉત્તર :-** અનિવૃત્તિકરણ નામના નવમાં ગુણસ્થાનની પૂર્વે જોવામાં આવતાં સ્પર્ધકોને પૂર્વસ્પર્ધક કહે છે.

**પ્રશ્ન પ૯ :-** અપૂર્વસ્પર્ધક કોને કહે છે ?

**ઉત્તર :-** અનિવૃત્તિકરણાગુણસ્થાનના પરિણામોના નિમિત્તથી અનુભાગ ક્ષીણ સ્પર્ધકોને અપૂર્વસ્પર્ધક કહે છે.

**પ્રશ્ન ૫૧ :- કૃષિ ( અનુકૃષિ ) કોને કહે છે ?**

ઉત્તર :- કર્માના અનુભાગને કમ ક્રમથી હીન થવાને કૃષિ અથવા અનુકૃષિ કહે છે. અર્થાત् અનુભાગનું કૃષ થવું - ઘટવું તે કૃષિ છે. આ અનિવૃત્તિકરણગુણસ્થાનના પરિણામોના નિમિત્તથી થાય છે.

**પ્રશ્ન ૫૨ :- બાદરકૃષિ કોને કહે છે ?**

ઉત્તર :- અપૂર્વસ્પર્ધકથી પણ વિશેષ અનુભાગ ક્ષીણ સ્પર્ધકોને બાદરકૃષિ કહે છે. અર્થાત् સંજવલન કોઘ, માન, માચા, લોભનો અનુભાગ ઘટાડવો - સ્થૂલ ખંડ કરવો, તે બાદરકૃષિ છે.

**પ્રશ્ન ૫૩ :- સૂક્ષ્મકૃષિ કોને કહે છે ?**

ઉત્તર :- બાદર કૃષિથી પણ વિશેષ અનુભાગ ક્ષીણ સ્પર્ધકોને સૂક્ષ્મ કૃષિ કહે છે.

**પ્રશ્ન ૫૪ :- અનુકૃષિતચના કોને કહે છે ?**

ઉત્તર :- ઉપર - નીચેના પરિણામોમાં અનુકર્ષણ (કમ-ક્રમથી ક્ષીણ થવું) ને બતાવવાવાળી રૂચના વિશેખને અનુકૃષિતચના કહે છે.

**પ્રશ્ન ૫૫ :- માર્ગણા કોને કહે છે અને તેના કેટલાં લેદ છે ?**

ઉત્તર :- કોઈક વિશિષ્ટ પર્યાયો અર્થાત् ભાવોના આધાર પર જીવોના અન્યેષણા (ખોજ, સંશોધન)ને માર્ગણા કહે છે. તેના ચૌદ લેદ છે - ગતિ, ઈન્જિન્ઝિયરિંગ, કાચ, યોગ, વેદ, કષાય, જ્ઞાન, સંયમ, દર્શન, લેશ્યા, ભવ્યત્વ, સમ્યકૃત્વ, સંજ્ઞા અને આહાર.

◆ માર્ગણા પ્રકારણમાં વિવક્ષિત ભાવનો સદ્ગ્રાવ - અસદ્ગ્રાવ બંને અપેક્ષિત હોય છે.

**પ્રશ્ન ૫૬ :- સમ્યકૃત્વમાર્ગણા કોને કહે છે ? તેના કેટલાં લેદ છે ?**

ઉત્તર :- સમ્યકૃત્વશર્ણિ / શ્રદ્ધાગુણની મુખ્યતાથી જીવોના અન્યેષણાને સમ્યકૃત્વમાર્ગણા કહે છે.

તેના છ લેદ છે. મિથ્યાત્વ, સાસાદન, મિશ્ર, ઔપશામિકસમ્યકૃત્વ, ક્ષાયોપશામિકસમ્યકૃત્વ અને ક્ષાયિકસમ્યકૃત્વ. (પ્રથમ ત્રણ લેદોનું સ્વરૂપ તત્ત્વસંબંધી ગુણસ્થાનરૂપ જ છે, તેથી ગુણસ્થાન અદ્યાયમાં જોવું)

“સમ્યકૃત્વના તો લેદ ત્રણ જ છે, તથા સમ્યકૃત્વના અભાવરૂપ મિથ્યાત્વ છે. બંનેના મિશ્રભાવ તે મિશ્ર છે. સમ્યકૃત્વનો ઘાતકભાવ તે સાસાદન છે. આ રીતે સમ્યકૃત્વમાર્ગણાથી જીવનો વિચાર કરવાથી છ

બેદ કહ્યા છે.” - (મોક્ષમાર્ગપ્રકાશક - પાના નં. ૩૩૭)

પ્રશ્ન ક૭ :- ઔપશમિકસમ્યકૃત્વ કોને કહે છે ?

ઉત્તર :- નિજ શુદ્ધાત્મ સન્મુખ પુરુષાર્થી જીવની પાંચ, છ કે સાત પ્રકૃતિઓ (દર્શનમોહનીયની ત્રણ અને અનંતાનુંબંધી ચતુર્ષટ્ય)ના ઉપશમના સમયે-તે કાળમાં - (નિમિત્તથી) થવાવાળા શ્રદ્ધાગુણના સમ્યક પરિણમનને ઔપશમિકસમ્યકૃત્વ કહે છે.

અનાદિ મિથ્યાબ્રહ્મિની પાંચ પ્રકૃતિઓનો તથા સાદિ મિથ્યાબ્રહ્મિની સાત, છ કે પાંચ પ્રકૃતિઓનો ઉપશમ થાય છે.

અનાદિ મિથ્યાબ્રહ્મિ જીવને સર્વપ્રથમ ઔપશમિક સમ્યકૃદર્શન જ પ્રગટ થાય છે.

પ્રશ્ન ક૮ :- ક્ષાયોપશમિકસમ્યકૃત્વ કોને કહે છે ?

ઉત્તર :- નિજ શુદ્ધાત્મ સન્મુખ પુરુષાર્થી જીવની પૂર્વોક્ત સાત પ્રકૃતિઓના ક્ષયોપશમ સમયે - તે કાળમાં (નિમિત્તથી) થવાવાળા શ્રદ્ધાગુણના સમ્યક પરિણમનને ક્ષાયોપશમિક સમ્યકૃત્વ કહે છે.

♦ ક્ષયોપશમ - અનંતાનુંબંધી ચતુર્ષટ્ય, મિથ્યાત્વ તથા સમ્યકમિથ્યાત્વ આ છ સર્વધાત્તુ પ્રકૃતિઓના ઉદ્યાભાવી ક્ષય અને સદવસ્થાંત્રપ ઉપશમ તથા દેશધાત્તુ સમ્યકૃપ્રકૃતિ દર્શનમોહનીયનો ઉદ્ય.

પ્રશ્ન ક૯ :- ક્ષાયિકસમ્યકૃત્વ કોને કહે છે ?

ઉત્તર :- નિજ શુદ્ધાત્મસન્મુખ પુરુષાર્થી જીવની પૂર્વોક્ત સાત પ્રકૃતિઓના સર્વથા ક્ષયના સમયે થવાવાળા તથા ભવિષ્યમાં અનંતકાળ સુધી રહેવાવાળા શ્રદ્ધાગુણના સમ્યક પરિણમનને ક્ષાયિકસમ્યકૃત્વ કહે છે.

ક્ષાયિક સમ્યકૃદર્શન હંમેશા ક્ષયોપશમિક સમ્યકૃત્વપૂર્વક જ થાયું છે અને ભવિષ્યકાળમાં અનંતકાળ સુધી ક્ષાયિકંત્રપ જ રહે છે.

પ્રશ્ન ક૧૦ :- ઔપશમિકસમ્યકૃત્વના કેટલા બેદ છે ?

ઉત્તર :- બે બેદ છે. પ્રથમોપશમ સમ્યકૃત્વ અને દ્વિતીયોપશમ સમ્યકૃત્વ.

પ્રશ્ન ક૧૧ :- પ્રથમોપશમ સમ્યકૃત્વ કોને કહે છે ?

ઉત્તર :- ‘પ્રથમ’ શબ્દનો અર્થ પહેલીવાર નથી. અનાદિ અથવા સાદિ મિથ્યાબ્રહ્મિ જીવને જ્યારે પણ ઔપશમિક સમ્યકૃદર્શન પ્રગટ થાય છે, તેને પ્રથમોપશમ સમ્યકૃત્વ કહે છે.

**પ્રશ્ન ૭૨ :-** દ્વિતીયોપશમસમ્યકૃત્વ કોને કહે છે ?

**ઉત્તર :-** ક્ષાયોપશમિકસમ્યકૃત્વના અનંતર શ્રેણી ચડવા માટે જે ઔપશમિક સમ્યકૃત્વ થાય છે, તેને દ્વિતીયોપશમ સમ્યકૃત્વ કહે છે.

♦ શ્રેણી ચડવાની સન્મુખ સાતિશય સાતમાં ગુણસ્થાનવતી ક્ષાયોપશમિક સમ્યકૃત્વ મુનિરાજના (અનંતાનુંબંધી ચતુષ્ટયના વિસંયોજન તથા) દર્શનમોહનીયત્રિકના ઉપશમના સમયે અર્થાત् નિમિત્તથી થવાવાળા શ્રદ્ધાગુણના સમ્યકૃત પરિણામનને દ્વિતીયોપશમ સમ્યકૃત્વ કહે છે.

**પ્રશ્ન ૭૩ :-** વિસંયોજન કોને કહે છે ?

**ઉત્તર :-** અનંતાનુંબંધી ચતુષ્ટયના અપ્રત્યાખ્યાનાવરણ આદિ બાર કષાય તથા હાસ્યાદિ નવ નોકષાય કર્મરૂપ પરિણામિત થવાને વિસંયોજન કહે છે.

આ વિસંયોજનનું કાર્ય ચોથાથી સાતમાં ગુણસ્થાન સુધીના કોઈપણ એક ગુણસ્થાનમાં થાય છે.

**પ્રશ્ન ૭૪ :-** જીવના અસાધારણ ભાવ કોને કહે છે ? તે કેટલા પ્રકારના છે ?

**ઉત્તર :-** જીવના અતિરિક્ત અન્ય ક્રિયોમાં ન હોય અર્થાત् માત્ર જીવમાં જ જોવામાં આવતા હોય તેવા ભાવોને જીવના અસાધારણભાવ કહે છે. તે પાંચ પ્રકારના છે.

(૧) ઔપશમિકભાવ (૨) ક્ષાયિકભાવ (૩) ક્ષાયોપશમિકભાવ (૪) ઔદયિકભાવ (૫) પારિણામિકભાવ

(૧) ઔપશમિકભાવ : નિજશુદ્ધાત્મ સન્મુખ પુરુષાર્થી જીવના મોહનીય કર્મના અંતરકરણરૂપ ઉપશમના સમયે અર્થાત् નિમિત્તથી થવાવાળા શુદ્ધભાવોને ઔપશમિકભાવ કહે છે.

(૨) ક્ષાયિકભાવ : નિજશુદ્ધાત્મ સન્મુખ પુરુષાર્થી જીવના કર્મના ક્ષયના સમયે થવાવાળા તથા ભવિષ્યમાં અનંતકાળ સુધી રહેવાવાળા શુદ્ધભાવોને ક્ષાયિકભાવ કહે છે.

(૩) ક્ષાયોપશમિકભાવ : કર્મના ક્ષયોપશમના સમયે અર્થાત् નિમિત્તથી થવાવાળા જીવના ભાવોને ક્ષાયોપશમિકભાવ કહે છે.

(૪) ઔદયિકભાવ : કર્મોદચના સમયે અર્થાત् નિમિત્તથી થવાવાળા

જીવના ભાવને ઔદ્યિકભાવ કહે છે.

(પ) પારિણામિક ભાવ : પૂર્ણપણે કર્મનિરપેક્ષ અર્થાત્ કર્મના ઉપશમ, ક્ષય, ક્ષયોપશમ અને ઉદ્યથી નિરપેક્ષ જીવના પરિણામને પારિણામિક ભાવ કહે છે.

પ્રશ્ન ૭૫ :- નિમિત્તકારણ કોણે કહે છે ?

ઉત્તર :- જે પદાર્થ પોતે વિવક્ષિત કાર્યરૂપ તો ન પરિણામે, પરંતુ કાર્યની ઉત્પત્તિમાં અનુકૂળ થવાનો જેણા પર આરોપ આવી શકે, તે પદાર્થને નિમિત્ત કારણ કહે છે.

જેમ કે - ઘડાની ઉત્પત્તિમાં કુંભાર, ચક, દંડ આદિ.

પ્રશ્ન ૭૬ :- નિમિત્ત - નૈમિત્તિક સંબંધ કોણે કહે છે ?

ઉત્તર :- જ્યારે ઉપાદાન પોતે કાર્યરૂપ પરિણામે છે, ત્યારે ભાવરૂપ કે અભાવરૂપ કયા અનુકૂળ નિમિત્ત કારણનો તેની સાથે સંબંધ છે - તે બતાવવા મોટે તે કાર્યને નૈમિત્તિક કહે છે. આ પ્રકારે બિજન પદાર્થના આ સ્વતંત્ર સંબંધને નિમિત્ત - નૈમિત્તિક સંબંધ કહે છે.

નિમિત્ત - નૈમિત્તિક સંબંધ પરતંત્રતાનું સૂચક નથી, પરંતુ નૈમિત્તિકની સાથે કયો નિમિત્તરૂપ પદાર્થ છે, તેનું જ્ઞાન કરાવે છે. જે કાર્યને નિમિત્તની અપેક્ષા નૈમિત્તિક કર્યું છે, તેને જ ઉપાદાનની અપેક્ષાએ ઉપાદ્ય પણ કહે છે.

પ્રશ્ન ૭૭ :- આવલી કોણે કહે છે ?

ઉત્તર :- જધન્ય યુક્ત અસંખ્યાત સમય-સમૂહને આવલી કહે છે.

પ્રશ્ન ૭૮ :- સમય કોણે કહે છે ?

ઉત્તર :- એક આકાશપ્રદેશથી નિકટવર્તી અન્ય આકાશપ્રદેશ સુધી મંદગતિથી ગમન કરતા પરમાણુના ગમન-કાળને સમય કહે છે. આ વ્યવહારકાળનો સૌથી નાનો અંશ છે.

પ્રશ્ન ૭૯ :- પ્રદેશ કોણે કહે છે ?

ઉત્તર :- એક પરમાણુથી વ્યાખ આકાશક્ષેત્રને પ્રદેશ કહે છે.

એક પ્રદેશમાં અનંત પરમાણુઓને અવગાહના (જ્યા) દેવાની શક્તિ છે.

પ્રશ્ન ૮૦ :- અંતર્મુહૂર્ત કોણે કહે છે ?

ઉત્તર :- મુહૂર્તમાંથી એક સમય ઓછો - બાકીના શેષ કાળ પ્રમાણને બિજન મુહૂર્ત કહે છે. તેં બિજન મુહૂર્તમાંથી પણ એક સમય ઓછા શેષ

કાળ પ્રમાણને અંતર્મુહૂર્ત કહે છે. આ ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત છે.

(૧) જે મુહૂર્તની બાજુમાં હોય, તેને અંતર્મુહૂર્ત કહે છે.

(૨) આવલીથી વધારે અને મુહૂર્તથી ઓછા કાળને અંતર્મુહૂર્ત કહે છે.

(૩) એક મુહૂર્તમાં ઉછુર શ્વાસોચ્છવાસ હોય છે. એક આવલી + એક સમય આ જધન્ય અંતર્મુહૂર્ત છે.

ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્તમાં એક સમય ઓછો અને જધન્યથી એક સમય વધારે એવા મદ્યમ અંતર્મુહૂર્ત અસંખ્યાત હોય છે.

**પ્રશ્ન ૮૧ :- મુહૂર્ત કોને કહે છે ?**

ઉત્તર :- (બે ઘડી) ૪૮ મિનિટને મુહૂર્ત કહે છે.

**પ્રશ્ન ૮૨ :- પૂર્વ કોને કહે છે ?**

ઉત્તર :- ૭૦ લાખ, ૫૮ હજાર કરોડ વર્ષ કાળને પૂર્વ કહે છે.

**પ્રશ્ન ૮૩ :- સાગર કોને કહે છે ?**

ઉત્તર :- દસ કોડાકોડી અદ્ધીપત્યોપમ કાળને સાગર કહે છે.

**પ્રશ્ન ૮૪ :- અસંખ્યાત કોને કહે છે ?**

ઉત્તર :- સંખ્યાતીત કલિપત રાશિમાંથી એક-એક સંખ્યા ઘટાડતાં જતાં જે સમાસ થઈ જવાવાળી રાશિને અસંખ્યાત કહે છે.

♦ જે સંખ્યા પાંચેય ઇન્ડ્રિયોનો અર્થાત् મતિ-શુત જ્ઞાનનો વિષય છે, તેને સંખ્યાત કહે છે.

♦ અવધિજ્ઞાનગમ્ય અને મનઃપર્યાયજ્ઞાનગમ્ય સંખ્યાને અસંખ્યાત કહે છે.

♦ જેની ગણતરી ન થઈ શકે, તેને અસંખ્યાત કહે છે.

♦ સંખ્યાતીત રાશિને અસંખ્યાત કહે છે.

**પ્રશ્ન ૮૫ :- અનંત કોને કહે છે ?**

ઉત્તર :- અસંખ્યાતથી ઉપર કેવળજ્ઞાનગમ્ય સંખ્યાને અનંત કહે છે.

♦ નવી વૃદ્ધિ ન થવા છતાં પણ અસંખ્યાત કે સંખ્યાતરૂપથી કેટલું પણ ઘટાડવાં છતાં જે સંખ્યાનો અંત ન આવે, તેને અક્ષય અનંત કહે છે.

♦ જે સંખ્યાનો અંત આવી જાય, તેને સક્ષય અનંત કહે છે.

**પ્રશ્ન ૮૬ :- સમુદ્રધાત કોને કહે છે ?**

ઉત્તર :- મૂળ શરીરને છોડ્યા વિના તેજસ - કાર્મણાર્થ ઉત્તર દેહની

સાથે જીવ પ્રદેશોનું શરીરથી બહાર નીકળવું, તેને સમુદ્ધાત કહે છે.

પ્રશ્ન ૮૭ :- સમુદ્ધાત કેટલા છે ? ક્યા ક્યા ?

ઉત્તર :- સમુદ્ધાત સાત પ્રકારના છે. વેદના, કષાય, વિજિયા, મરણાંતિક, તેજસ, આહારક અને કેવળી સમુદ્ધાત.

પ્રશ્ન ૮૮ :- કેવળી સમુદ્ધાત કોને કહે છે ?

ઉત્તર :- પોતાના મૂળ પરમ-ઓદારિક શરીરને છોડયા વિના આત્મપ્રદેશોને દંડાદિપ થઈ શરીરની બહાર પૂર્ણ લોકાકાશમાં ફેલાવવાની કિયાને કેવળી સમુદ્ધાત કહે છે.

પ્રશ્ન ૮૯ :- કેવળી ભગવાનને સમુદ્ધાત શા માટે હોય છે ?

ઉત્તર :- આચુકર્મની સ્થિતિ થોડી હોય અને બાકીના ત્રણ અધાતિયા કર્મોની સ્થિતિ આચુની અપેક્ષાએ વધારે હોવાથી, અન્ય ત્રણ કર્મોની સ્થિતિ આચુકર્મ સમાન અંતર્મુહૂર્ત કરવા માટે કેવળી ભગવાનને સમુદ્ધાત હોય છે.

પ્રશ્ન ૯૦ :- મરણાંતિક સમુદ્ધાત કોને કહે છે ?

ઉત્તર :- મરણાના અંતર્મુહૂર્ત પૂર્વે નવી પર્યાય ધારણ કરવાના ક્ષેત્રને સ્પર્શ કરવા માટે આત્મપ્રદેશોના બહાર નીકળવાને મરણાંતિક સમુદ્ધાત કહે છે. જેઓએ પરલેવનું આચુ બાંધી લીધું છે, તેવા જ જીવોને મરણાંતિક સમુદ્ધાત હોય છે.

પ્રશ્ન ૯૧ :- અનાદિ મિથ્યાક્રષિ જીવ કોને કહે છે ?

ઉત્તર :- અનાદિકાળથી આજ સુધી જે જીવે મિથ્યાત્પનો નાશ નથી કર્યો અર્થાત્ સમ્યકૃત્પની પ્રાપ્તિ નથી કરી તેવા જીવને અનાદિ મિથ્યાક્રષિ જીવ કહે છે.

પ્રશ્ન ૯૨ :- સાદિ મિથ્યાક્રષિ જીવ કોને કહે છે ?

ઉત્તર :- એકવાર સમ્યકૃત્પન પ્રગટ થઈ ગયા પછી ફરી પુરુષાર્થની હીનતાથી મિથ્યાત્વી થઈ જવાવાળા જીવને સાદિ મિથ્યાક્રષિ જીવ કહે છે.

પ્રશ્ન ૯૩ :- યોગ કોને કહે છે ?

ઉત્તર :- કર્મોના ગ્રહણમાં નિમિત્તપ્ર જીવના પ્રદેશોની પરિસ્પંદનપ્ર પર્યાયને યોગ કહે છે.

પ્રશ્ન ૯૪ :- યોગના કેટલા લેણ છે ? ક્યા ક્યા ?

**ઉત્તર :-** યોગના બે લેદ છે. (૧) ભાવયોગ (૨) ફ્રલ્યયોગ.

**પ્રશ્ન ૮૫ :-** ભાવયોગ કોણે કહે છે ?

**ઉત્તર :-** કર્મ - નોકર્મને યોગ્ય પુદ્ગલમય કાર્મણાવર્ગણાઓને ગ્રહણ કરવામાં નિમિત્તઃપ આત્માની શક્તિવિશેષને ભાવયોગ કહે છે.

**પ્રશ્ન ૮૬ :-** ફ્રલ્યયોગ કોણે કહે છે ?

**ઉત્તર :-** ભાવયોગને કારણ આત્માના પ્રદેશોનું કંપન થવું, તે ફ્રલ્યયોગ છે.

**પ્રશ્ન ૮૭ :-** અન્ય અપેક્ષાએ યોગના કેટલાં બેદ છે ? ક્યા ક્યા ?

**ઉત્તર :-** અન્ય અપેક્ષાએ યોગના બે બેદ છે.

(૧) કષાયયોગ (૨) અકષાયયોગ.

◆ આલંબનની અપેક્ષાએ મનયોગ, વચનયોગ અને કાયયોગ એમ ત્રણ બેદ છે.

◆ મનયોગના ૪, વચનયોગના ૪ અને કાયયોગના ૭ એમ નિમિત્તની અપેક્ષાએ ૧૫ બેદ પણ થાય છે.

◆ વાસ્તવિકર્ષપથી જોવા જઈએ તો યોગ એક જ પ્રકારનો છે.

**પ્રશ્ન ૮૮ :-** ગમનાગમનનો શું અર્થ છે ?

**ઉત્તર :-** ગમનનો અર્થ જવું, આગમનનો અર્થ આવવું. જીવના એક ગુણસ્થાનથી બીજા ગુણસ્થાનમાં આવવા-જવાના અર્થમાં ગમનાગમન શર્દનો પ્રયોગ કરવામાં આવે છે.

(ગો.ક.કાં. ગાથા - ૫૫૫, ૫૫૬)

**પ્રશ્ન ૮૯ :-** શુભોપયોગ કોણે કહે છે ?

**ઉત્તર :-** “જે ઉપયોગ અર્થાત્ જ્ઞાન-દર્શન પરમભૂતારક દેવાધિદૈવ પરમેક્ષર એવા અરહંત, સિદ્ધ તથા સાધુની શ્રેદ્ધા કરવામાં તથા સમસ્ત જીવ સમૂહની અનુકૂળાનું આચરણ કરવામાં પ્રવૃત્ત છે, તે શુભોપયોગ છે.”

(પ્રવચનસાર ગાથા - ૧૫૭ ની ટીકા)

**પ્રશ્ન ૧૦૦ :-** અશુભોપયોગ કોણે કહે છે ?

**ઉત્તર :-** “જે ઉપયોગ અર્થાત્ જ્ઞાન-દર્શન પરમભૂતારક દેવાધિદૈવ પરમેક્ષર એવા અરહંત, સિદ્ધ તથા સાધુની અતિરિક્ત અન્ય ઉનમાર્ગની શ્રેદ્ધા કરવામાં તથા વિષય, કષાય, કુશવણા, કુવિચાર, કુસંગ અને

ઉત્ત્રતાનું આચરણ કરવામાં પ્રવૃત્ત છે, તે અશુલોપયોગ છે.”

(પ્રવચનસાર ગાથા - ૧૫૮ની ટીકા)

પ્રશ્ન ૧૦૧ :- શુદ્ધોપયોગ કોને કહે છે ?

ઉત્તર :- (૧) “જે ઉપયોગ અર્થાત् જ્ઞાન-દર્શન પરદ્રવ્યમાં મદ્યસ્થ થતો થકો પરદ્રવ્યાનુસાર પરિણાતિને આધીન ન થવાથી શુલ્ભ તથા અશુલ્ભરૂપ અશુદ્ધોપયોગથી મુક્ત થઈ માત્ર સ્વદ્રવ્યાનુસાર પરિણાતિને ગ્રહણ કરે છે, તે શુદ્ધોપયોગ છે.”

(પ્રવચનસાર ગાથા - ૧૫૮ની ટીકા)

(૨) “ઇષ્ટ - અનિષ્ટ બુદ્ધિના અભાવથી જ્ઞાનમાં જ ઉપયોગ લાગે, તેને શુદ્ધોપયોગ કહીએ - તે જ ચારિત્ર છે.” (૩) (જ યચંદજી જાબડા, મોક્ષપાહૃત ગાથા - ૭૨)

(૩) ચિત્તનિરોધ, શુદ્ધોપયોગ, સામ્ય, સ્વાસ્થ્ય, સમાધિ અને યોગ આ સર્વે શબ્દ એક જ અર્થના વાચક છે.

(પદ્ધનંદી પંચવિંશતિકા, ગાથા - ૯૪.)

(૪) ઉપયોગરૂપ અર્થાત् જ્ઞાન-દર્શન વીતરાગતાને શુદ્ધોપયોગ કહે છે.

શુદ્ધોપયોગ સંબંધી અત્યંત સંતુલિત અને સ્પષ્ટ ભાવ પં. ટોડરમલજીએ મોક્ષમાર્ગ પ્રકાશક શાસ્ત્રના પાનાનં. ૨૮૯ પર આ પ્રમાણે આપેલ છે.

“ક્રણાનુયોગમાં તો રાગાદિ રહિત શુદ્ધોપયોગ યથાખ્યાત ચારિત્ર થવાથી થાય છે, તે મોહના નાશથી સ્વયંમેવ થશે. નીચલી અવસ્થાવાળો (બારમાં ક્ષીણમોહ અને અગ્યારમાં ઉપશાંતમોહ ગુણસ્થાનથી નીચેના ગુણસ્થાનવાળાના) શુદ્ધોપયોગનું સાધન શી રીતે કરે? તથા દ્રવ્યાનુયોગમાં શુદ્ધોપયોગ કરવાનો જ મુખ્ય ઉપદેશ છે.

માટે ત્યાં છબ્બસ્થ જે કાળમાં બુદ્ધિગોચર ભક્તિ આદિ તથા હિંસા આદિ કાર્યરૂપ પરિણામોને છોડી (શ્રાવક - ચોથા/પાંચમા ગુણસ્થાનવર્તી સાધક) આત્મઅનુભવ આદિ કાર્યોમાં પ્રવર્તે, તે કાળમાં તેને શુદ્ધોપયોગી કહે છે. છતાં અહીં કેવળજ્ઞાનગોચર સૂક્ષ્મ રાગાદિક છે, છતાં તેની વિવક્ષા અત્રે નથી કરી. પોતાના બુદ્ધિગોચર રાગાદિક છોડે છે, એ અપેક્ષાએ તેને ચોથા - પાંચમા ગુણસ્થાનોમાં શુદ્ધોપયોગી કહ્યું છે.”

મોક્ષમાર્ગ પ્રકાશક પાના નં. ૨૮૫ પર કહ્યું છે .... “ધર્માનુરાગરૂપ પરિણામ તે શુલોપયોગ, પાપાનુરાગરૂપ તથા દ્રેષ્ટરૂપ પરિણામ તે

અશુભો પયોગ અને રાગ-ક્લેખ રહિત પરિણામ તે શુદ્ધોપયોગ.”

પ્રશ્ન ૧૦૨ :- શુદ્ધ પરિણાતિ કોને કહે છે ?

ઉત્તર :- શુદ્ધ શબ્દનો અર્થ મોહ-રાગ-ક્લેખાદિ વિકારી ભાવોથી રહિત એવા વીતરાગ પરિણામ.

♦ આત્માના ચારિત્રગુણની શુદ્ધપયચિને શુદ્ધ પરિણાતિ કહે છે.

♦ બુદ્ધિપૂર્વક શુલાશુલ ઉપયોગના કાળમાં ઉપયોગ રહિત ચારિત્ર ગુણની વીતરાગ અવસ્થાને શુદ્ધ પરિણાતિ કહે છે.

પ્રશ્ન ૧૦૩ :- અધઃકરણાદિ ત્રણ કરણ કેટલા સ્થાન પર હોય છે ?

ઉત્તર :- ઔપશમિક તથા ક્ષાયિક સમ્યકૃત્વ માટે અનંતાનુબંધી કષાય ચતુર્ષયની વિસંયોજન માટે અને ચારિત્રમોહનીયની ૨૧ પ્રકૃતિઓની ઉપશમતા તથા ક્ષપણા કરવા માટે અધઃકરણ આદિ ત્રણ કરણ હોય છે.

(વિશેષ ખુલાસો મિથ્યાત્ત્વ ગુણસ્થાનના વિલાગના અંતમાં જુઓ.)

પ્રશ્ન ૧૦૪ :- શું કર્મોના ઉપશમ, ક્ષય, ક્ષયોપશમના નિમિત્તથી શુદ્ધભાવ થાય છે અથવા આત્માના શુદ્ધભાવોથી કર્મોનો ક્ષયાદિ થાય છે ?

ઉત્તર :- બંને કથન પોત-પોતાની અપેક્ષાથી બરાબર છે. પહેલું કથન કર્મની અપેક્ષાથી કર્યું છે તથા બીજું કથન જીવના ભાવોની અપેક્ષાથી કર્યું છે.

♦ કર્મના ઉપશમાદિ કાર્ય અને જીવના ઔપશમિકાદિભાવ એક જ સમયમાં થાય છે માટે બંને વાક્યોનો ભાવ એક જ છે.

♦ ખરેખર જોવા જઈએ તો પુદ્ગલ કર્મોમાં ઉત્પાદ, વ્યય પુદ્ગલના ઉપાદાનથી થાય છે અને આત્મ પરિણામોમાં ઉત્પાદ-વ્યય આત્મરૂપ ઉપાદાનથી થાય છે. બંને કથન પોત-પોતાની અપેક્ષાએ સાચા છે.

માત્ર અપરાધ જીવનો છે, પુદ્ગલ અર્થાત્ કર્મનો નહીં. અપરાધનો અલાવ પણ જીવ જ કરે છે. માટે જીવને જ ઉપદેશ આપવામાં આવે છે.

પ્રશ્ન ૧૦૫ :- વિશ્રહગતિમાં આત્મા કયા કયા ગુણસ્થાનોમાં હોય છે? કયાં ગુણસ્થાનોના પરિણામની સાથે જીવ પરલખમાં જાય છે ?

ઉત્તર :- પહેલા, બીજા તથા ચોથા ગુણસ્થાનના પરિણામો સાથે જીવ પરલખમાં જાય છે. અર્થાત્ વિશ્રહગતિમાં આ ત્રણ જ ગુણસ્થાન હોય છે.

પ્રશ્ન ૧૦૬ :- ક્યા ગુણસ્થાનમાં જીવનું મૃત્યુ થતું નથી ?

ઉત્તર :- ત્રીજા, બારમા તથા તેરમાં ગુણસ્થાનમાં જીવનું મૃત્યુ થતું નથી. કહ્યું પણ છે - “મિશ્ર, ક્ષીણ, સજોગ તીનમે મરન ન પાયે.”

◆ ક્ષપકશ્રેણીના કોઈપણ ગુણસ્થાનમાં મરણ નથી થતું.

◆ ઉપશમશ્રેણીના આઠમા ગુણસ્થાનના પ્રથમભાગમાં પણ મરણ નથી થતું.

◆ પાંચમાં ગુણસ્થાનથી અગ્યારમાં ગુણસ્થાન સુધીના બદાં ગુણસ્થાનોમાં જીવનું મરણ તો થઈ શકે છે. પરંતુ પાંચમાંથી અગ્યારમાં ગુણસ્થાન સુધીના ગુણસ્થાનોના પરિણામોને સાથે લઈ વિગ્રહ ગતિમાં નથી જતો. મૃત્યુ થતાં જ વિગ્રહગતિના પ્રથમ સમયમાં ચોથું ગુણસ્થાન થઈ જાય છે.

પ્રશ્ન ૧૦૭ :- સંસારમાં ક્યા ક્યા ગુણસ્થાનનો વિરહ નથી થતો?

ઉત્તર :- પહેલા, ચોથા, પાંચમાં, છઢા, સાતમા અને તેરમાં આ ગુણસ્થાનોનો સંસારમાં કયારેય પણ વિરહ નથી થતો અર્થાત् આ ગુણસ્થાનોમાં જીવો સદા વિધમાન રહે જ છે.

પ્રશ્ન ૧૦૮ :- અપ્રતિપાતી ગુણસ્થાન ક્યા ક્યા છે ?

ઉત્તર :- બારમું, તેરમું, ચૌદમું તથા ક્ષપકશ્રેણીનું આઠમું, નવમું તથા દશમું - આ ગુણસ્થાન અપ્રતિપાતી છે. અર્થાત् આ ગુણસ્થાનોથી જીવ નીચે ન આવતા ઉપર ને ઉપર ચઢે છે. પડવાનું નામ પ્રતિપાત અને નહીં પડવાનું નામ અપ્રતિપાત કહેવાય છે.

પ્રશ્ન ૧૦૯ :- ગુણસ્થાનના જ્ઞાનથી શું લાભ છે ?

ઉત્તર :- ૧) તેરમા તથા ચૌદમા ગુણસ્થાનવર્તી જ અરહંત ભગવાન હોય છે. ગુણસ્થાનાતીત શુદ્ધ આત્મા જ સિદ્ધ પરમાત્મા કહેવાય છે. આ રીતે ગુણસ્થાનના જ્ઞાનથી જ સાચા અર્થાત् વીતરાગ તથા સર્વજ્ઞ ભગવાનનો પાકો નિર્ણય થાય છે.

૨) તેરમા ગુણસ્થાનવર્તી અરહંત ભગવાનના પરમ ઔદારિક શરીરના સર્વાંગથી દિવ્યદ્વયનિ ખરે છે. દિવ્યદ્વયનિથી જ ચથાર્થી તત્ત્વ સ્પષ્ટ થાય છે. દિવ્યદ્વયનિનો વિષય જ સાચા શાસ્ત્રમાં લિપિબદ્ધ રહે છે. તેથી ગુણસ્થાનના જ્ઞાનથી જ સાચા શાસ્ત્ર/તત્ત્વની જાણકારી પ્રાપ્ત થાય છે.

૩) ત્રીજા કષાય ચોકડીના અભાવપૂર્વક વ્યક્ત વીતરાગતા પ્રગટ કરીને પ્રચુર સ્વસંવેદનના આનંદના ભોગી જ સાચા ગુરુ હોય છે. એવા

ગુરુ છઠા - સાતમા ગુણસ્થાનવર્તી હોય છે અથવા તો તે મહાપુરુષ આઠમા ગુણસ્થાનથી ઉપરના ગુણસ્થાનમાં બિરાજે છે, માટે ગુણસ્થાનના જ્ઞાનથી જ સાચા સાધુનું સ્પષ્ટ જ્ઞાન થાય છે.

પ્રશ્ન ૧૧૦ :- ગુણસ્થાનના જ્ઞાનથી શું માત્ર દેવ - શાસ્ત્ર - ગુરુનો જ યથાર્થ નિર્ણય થાય છે કે આપણાને વ્યક્તિગત પણ કાંઈ લાભ થાય છે?

ઉત્તર :- શા માટે નહીં ? દેવ - શાસ્ત્ર - ગુરુના સંબંધમાં પણ જે સાચો નિઃશંક નિર્ણય તથા યથાર્થ પ્રતીતિ થાય છે, તે પણ તો આપણાને જ વ્યક્તિગત લાભ થાય છે, દેવ - શાસ્ત્ર - ગુરુને નહીં.

દેવ તથા ગુરુના ગુણસ્થાનની જાણકારીની સાથે આપણાને આપણું પોતાનું ગુણસ્થાન કર્યું છે ? વિરાધક ગુણસ્થાનથી સાધક ગુણસ્થાનોની પ્રાપ્તિ અર્થાત્ મોક્ષમાર્ગની પ્રાપ્તિ કેમ થશે ? તથા આપણે શું કરવું આપશ્યક છે ? - આ બધાનું જ્ઞાન થાય છે.

- ૦-૦-૦-૦-૦-

તृतीय અધ્યાય

નિ પ્રમાણે કાંઈ ગુણસ્થાન વિવેચન કરીબિ રાખી શકાય

## ગુણસ્થાન : ભૂમિકા

અનાદિકાળથી લઈને આજ સુધી અક્ષય અનંત સર્વજ્ઞ ભગવાન થઈ ગયા છે. હમણાં વર્તમાનકાળમાં પણ વિદેહક્ષેત્રમાં લાખો સર્વજ્ઞ ભગવાન વિદ્યમાન છે અને ભવિષ્યમાં પણ અનંત સર્વજ્ઞ ભગવાન થશે. તે સર્વ અનંતાનંત સર્વજ્ઞ ભગવંતોની અલૌકિક દિવ્યદ્વારનિમાં જે વસ્તુ સ્વભાવનું વાર્ણન આવ્યું છે, તેને ગણધર હેવે ચાર અનુયોગમાં વિભક્ત(વિભાજન) કર્યું છે. જે આ પ્રકારે છે -

૧) પ્રથમાનુયોગ ૨) કરણાનુયોગ ૩) ચરણાનુયોગ ૪) ફ્રવ્યાનુયોગ. આને સરળ ભાષામાં કહીએ તો જે ભવ્ય જીવોએ ફ્રવ્યાનુયોગને અનુસાર નિજ જ્ઞાયક આત્માનો આશ્રય લીધો છે, તેના જ કરણાનુયોગઅનુસાર કર્માના ઉપશમાઈ હોય છે. તેમનું જ બાધ્ય જીવન ચરણાનુયોગને અનુસાર સદાચારમય થઈ જાય છે અને તે જ પ્રથમાનુયોગને અનુસાર મહાપુરુષ કહેવાય છે.

આ રીતે ભ્રવ્યાનુયોગ દીપક છે જે સમ્વયજ્ઞાનને આલોકિત કરી અન્ય ત્રણો અનુયોગોને પ્રકાશિત કરવામાં મુખ્ય લૂભિકા ભજવે છે.

## (રણકર્ણ શ્રાવકાચાર, અદ્યાય બીજો)

## અનુયોગોની ઉપયોગીતા -

- (૧) પોતાને વીતરાગી બનવું હોય તો મહાપુરુષોને આદર્શ બનાવો.  
 (૨) ચિત્તમાં જ્ઞાનની સૌરભ મહેંકાવવી હોય તો કર્મસિદ્ધાંત ને  
 અપલોકો.  
 (૩) પોતાના જીવનને પવિત્ર બનાવવું હોય તો મહાપુરુષોના આચરણને  
 અપનાવો.

(૪) શ્રેદ્ધામાં નિઃશંકતા લાવવી હોય તો વસ્તુવ્યવસ્થાને જાણો. અહીં પ્રસ્તુત વિષય કરણાનુયોગ છે અને વિવક્ષિત વિષય ગુણસ્થાન સંબંધી ચર્ચા છે.

#### કરણાનુયોગથી લાભ –

(૧) સૂક્ષ્મ પરમાણુ આઈ, અંતરિત રામ-રાવણાઈ, દૂરવર્તી સુભેરુપર્વતાઈ પદાર્થનો જ્ઞાતા કોઈ અવશ્ય હોવો જોઈએ, કારણ કે તે પદાર્થ અનુમાન જ્ઞાનનો વિષય છે. તેથી જગતમાં કોઈ ને કોઈ સર્વજ્ઞ અવશ્ય છે - તેવો નિર્ણય થાય છે.

(૨) સર્વજ્ઞ ભગવાન ક્રારા પ્રરૂપેલ સૂક્ષ્મ છતાંથી બુદ્ધિગમ્ય પદાર્થનું જ્ઞાન થાય છે તથા ક્રમબદ્ધપર્યાય/ક્રમનિયમિતપર્યાયનો નિર્ણય થાય છે.

(૩) કરણાનુયોગના અલ્યાસથી કૃષાયની મંદટા થાય છે તથા જ્ઞાનમાં નિર્મળતા આવે છે.

(૪) જીવ પરિણામોના અને કર્મબંધનાઈના નિમિત્ત - નૈમિત્તિક સંબંધનું ચથાર્થ જ્ઞાન થાય છે અને કર્તા-કર્મ સંબંધી ખાંતિનો નાશ થઈ થાય છે.

(૫) ભૂમિકા અનુસાર થવાવાળા પરિણામોનું અને તદઅનુસાર શુભાશુભ આચરણનો વિવેક જાગૃત થાય છે.

(૬) ચથાપદવી (યોગ્ય પદવી) નિમિત્તરૂપ થવાવાળા કર્મોના ઉપશમાઈનો સત્ય નિર્ણય થઈ જાય છે. કર્મોના બંધ, સત્તા, ઉદ્ય આઈ દસ અવસ્થાઓનું જ્ઞાન થાય છે.

(૭) ભવિષ્યમાં થવાવાળી અશુદ્ધતા તથા અનિષ્ટ પર્યાયોથી બચવાની પ્રેરણા મળે છે.

(૮) કેવળજ્ઞાનગમ્ય સૂક્ષ્મ તથા આશ્રેર્વકારક વિષયોનું જ્ઞાન થવાથી સર્વજ્ઞ ભગવાન અને સર્વજ્ઞ સ્વભાવી પોતાના આત્માનો મહિમા આવે છે.

(૯) કરણાનુયોગમાં વર્ણવિલ ચૌદુરુણસ્થાનો, ચૌદ માર્ગિણા, ચૌદ સત્તાપન, અષ્ટાણું અને ચારસો છ જીવસમાસો, કરોડો કુણ, ૮૪ લાખ ચોનિ આઈનું જ્ઞાન થવાથી જીવદ્યાના ભાવ ઉત્પન્ન થાય છે. ચોસઠ અવગાહના સ્થાન આઈ અનેકાનેક અનુપમ વિષયોના વિશેષ

જ્ઞાનથી આનંદ થાય છે. ( ગોમ્મટસાર જીવકાંડ - ગાથા નં. ૭૭)

(૧૦) આત્મસ્પર્શને ભૂતી મિથ્યાત્વ, અજ્ઞાન તથા કષાયોને આધીન થવાથી ફ્રલ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ તથા ભવર્ષ સંસારમાં જીવ દુઃખ ભોગવી રહ્યો છે, આ જાણી પોતાના લૂતકાલીન બ્રમનું જ્ઞાન થવાથી સંસારથી ભય ઉત્પણ્ણ થાય છે. ભોગોની આસક્તિ ઓછી થઈ જાય છે અને પૈરાગ્યભાવ પુષ્ટ થાય છે.

(૧૧) નરક - નિગોદાદિની દુઃખોની જાણકારીથી પણ સંસાર, શરીર તથા ભોગોથી વિરક્તતારૂપ મોક્ષમાર્ગ પ્રાપ્ત કરવાનો મંગળ બોધપાઠ મળે છે અને જ્ઞાયક આત્માના આશ્રયની ભાવના ઉત્પણ્ણ થાય છે.

કરણાનુયોગના શાસ્ત્રમાં કેવળજ્ઞાનગમ્ય સૂક્ષ્મ કથન હોવાથી તેને અહેતુવાદ આગમ પણ કહે છે, કારણ કે આમાં પ્રફેલ પ્રત્યેક વિષયના સંબંધમાં હેતુ બતાવવો સંભવ નથી. જેમ કે - ગુણસ્થાન ચૌદ છે. આપ પૂછ્યશો :- ગુણસ્થાન ચૌદ જ કેમ છે ? તેર કે પંદર કેમ નહીં ? તેનો ઉત્તર એટલો જ છે કે અનંત સર્વજ્ઞ ભગવંતોની દિવ્યદ્વારનિમાં ચૌદ ગુણસ્થાનનું જ વર્ણન આવ્યું છે. માટે ગુણસ્થાન ચૌદ જ છે. આગમગર્ભિત ચુક્તિ તો બતાવી શકાય છે, પરંતુ જેમ ફ્રલ્યાનુયોગમાં બુદ્ધિગમ્ય હેતુ કે તર્ક આપી શકીએ છીએ, તેવું કરણાનુયોગમાં હેતુ કે તર્ક આપવું શક્ય નથી.

“જેનિદર્મ પરીક્ષા પ્રધાની છે ” આ કથન માત્ર ફ્રલ્યાનુયોગની અપેક્ષાથી છે. અન્ય ત્રણે અનુયોગમાં કેવળી ભગવાનની આજ્ઞાની જ મુખ્યતા છે.

પ્રથમાનુયોગના પુરાણોમાં વર્ણિત શલાકા પુરુષ ત્રેસઠ હોય છે. ભરત-ઐરાવત ક્ષેત્રના અવસર્પિણીના ચોથા અને ઉત્સર્પિણીના ત્રીજા આરામાં તીર્થીકર ચોવીસ જ થાય છે. વિદેહક્ષેત્રમાં હંમેશા ભરતક્ષેત્રના અવસર્પિણીના ચોથા આરાની આદિ જેવો કાળ જ વર્તે છે. ત્યાં જધન્ય વીસ તીર્થીકર સદાકાળ વિધમાન રહે છે. ચક્કવર્તી બાર હોય છે. ઇત્યાદિ કથનોની પરીક્ષા ન થઈ શકે. જેમ ભગવાનની આજ્ઞા શાસ્ત્રમાં લિપિબદ્ધ છે, તેમ જ માનવું અનિવાર્ય છે.

કરણાનુયોગના ગ્રંથો અનુસાર ચૌદ માર્ગણાઓ, ચૌદ જીવસમાસ, મેરુપર્વત, અસંખ્યાદિ ઝીપ-સમુદ્ર, નરક-સ્વર્ગ સંબંધી વર્ણિત દુઃખ તથા સુખનું સ્વર્ણ - આ બધાનું આજ્ઞાનુસાર જ શ્રદ્ધાન કરવું અનિવાર્ય છે.

ચરણાનુયોગના શાસ્ત્રો અનુસાર કાંદા, બટાટા, સકરકંદ, મૂળા, લસાણ આદિ કંદમૂળના રાઈ જેટલા ટુકડામાં અનંત બાદર નિગોડિયા જીવ છે, તેથી તે અભક્ષય છે. જીવોની અનંતતાની પરીક્ષા કેવી રીતે શક્ય છે? અહીં પણ આજ્ઞા જ શિરોધાર્ય છે. આજ્ઞાનુસાર જ આ પદાર્થોનો ત્યાગ કરવો તે જ આપણું કર્તવ્ય છે.

ફ્રલ્યાનુયોગના શાસ્ત્રો અનુસાર પંચાસ્તિકાય, જ ફ્રલ્ય, સાત તત્પ્ર, નવ પદાર્થો, હિતકારી-અહિતકારી ભાવો, બંધમાર્ગ, મોક્ષમાર્ગ સંબંધી સત્યાસત્યનો નિર્ણય પોતાની બુદ્ધિ અનુસાર ચુક્તિ-પરીક્ષા છારા કરી શકીએ છીએ.

ગુણસ્થાનની પરિભાષા (વ્યાખ્યા) જાળવાની પહેલા જ આપણા મનમાં એક પ્રશ્ન થાય છે, જે આ પ્રકારે છે.

**પ્રશ્ન ૧:- આપણે ગુણસ્થાનમાં પ્રવેશ કરવો છે કે ગુણસ્થાનના જ્ઞાનમાં?**

ઉત્તર :- બધા સંસારી જીવોનો ગુણસ્થાનમાં પ્રવેશ તો અનાદિકાળથી છે જે, કારણ કે સંસારી જીવ ગુણસ્થાનથી રહિત હોતો જ નથી. સંસારી જીવ કોઈને કોઈ ગુણસ્થાનમાં નિયમથી રહે જ છે. ભલે પછી તે જ્ઞાની હોય કે અજ્ઞાની. માત્ર સિદ્ધય જીવ જ ગુણસ્થાન રહિત હોય છે, કારણકે તેઓ સ્વલ્ભાવ સાધનાથી ગુણસ્થાનાતીત થઈ ગયા છે. આનો અર્થ એ થયો કે સિદ્ધય જીવ વર્તમાનકાળમાં ગુણસ્થાનાતીત થઈ ગયા છે, પરંતુ તેઓ પણ પૂર્વે સંસાર અવસ્થામાં ગુણસ્થાન સહિત જ હતાં.

પ્રત્યેક સંસારી જીવ પણ આત્મસ્વભાવની અપેક્ષાથી તો ગુણસ્થાનાતીત, ત્રિકાળી, શુદ્ધધ, સહજાનંદમય ભગવાન આત્મા જ છે, પરંતુ તે અદ્યાત્મનો વિષય છે, જે અહીં ગુણસ્થાનના કથન સમ્બેદ્ધી ગૌણ છે. ત્રિકાળી આત્મસ્વભાવની અહીં અત્યારે વિવક્ષા નથી. જ્યાં જેની વિવક્ષા હોય છે, તેની જ ચર્ચા કરવી વિવક્ષિત વિષય સમજવાને માટે ઉપયોગી હોય છે.

તાત્પર્ય એ છે કે સર્વ સંસારી જીવ ગુણસ્થાન સહિત જ હોય છે. માટે અમને - તમને ગુણસ્થાનમાં પ્રવેશ નથી કરવાનો, પરંતુ ગુણસ્થાન વિષેના જ્ઞાનમાં પ્રવેશ કરવાનો છે.

**ગુણસ્થાન :** પરિભાષા -

આચાર્યશ્રી નેમિયંડ્રેવે ગોમતસાર ગાથા ઉત્તા ટમાં ગુણસ્થાનની પરિભાષા આ પ્રકારે આપી છે.

સંખોઓ ઓઘોત્તિ ય, ગુણસણા સા ચ મોહજોગભવા ।

જેહિ દુ લખિબજન્તે, ઉદ્યાદિસુ સંભવેહિં ભાવેહિં ॥

જીવા તે ગુણસણા, ણિદ્રિંદ્રા સવ્વદરસીહિં ॥

મોહ અને યોગના નિમિત્તથી જીવની શ્રદ્ધા તથા ચારિત્ર ગુણની થવાવાળી તારતમ્યઝપ અર્થાત્ હીનાધિક અવસ્થાઓને ગુણસ્થાન કહે છે.

અનાદિકાળથી અનંત સર્વજ્ઞ ભગવંતોએ અનંત જીવોના કલ્યાણ માટે અનંતવાર દિવ્યદ્વારનિથી પરમ સત્ય/પરમાર્થ વસ્તુવ્યવસ્થાનું કથન કર્યું છે. તેનું જ વિવેચન આચાર્યોએ શાસ્માં લિપિબદ્ધ કર્યું છે. તે વસ્તુવ્યવસ્થા અનુસાર પ્રત્યેક વસ્તુ, દ્રવ્ય-ગુણ-પર્યાયમય છે. આ દ્રવ્ય-ગુણ-પર્યાયોને છોડી આ વિશ્વમાં અન્ય કાંઈ પણ છે જ નહીં.

**પ્રશ્ન ૨ :-** વસ્તુવ્યવસ્થામાં ગુણસ્થાન દ્રવ્ય છે, ગુણ છે કે પર્યાય ?

**ઉત્તર :-** જૈન તત્ત્વજ્ઞાનની સામાન્ય જાણકારી રાખવાવાઓ મનુષ્ય પણ આ જાણો છે કે દ્રવ્ય તો જાતિ અપેક્ષા જીવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ, આકાશ અને કાળ - આ છ જ છે. તેમાં ગુણસ્થાન નામનું કોઈ દ્રવ્ય નથી. દ્રવ્યની વ્યાખ્યા અનુસાર પણ ગુણસ્થાન દ્રવ્ય નથી થઈ શકતા, કારણ કે “ગુણોના સમૂહને દ્રવ્ય કહે છે.” આ દ્રવ્યની વ્યાખ્યા સર્વ વિદ્યિત છે. ગુણસ્થાન, ગુણોનો સમૂહ નથી. તેથી આ સ્પષ્ટ થઈ ગયું કે ગુણસ્થાન દ્રવ્ય નથી.

ગુણસ્થાન ગુણ પણ નથી, કારણ કે જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય આદિ જીવ દ્રવ્યના ગુણ છે. સ્પર્શ, રસ, ગંધ, વર્ણ આ પુદ્ગલ દ્રવ્યના ગુણ છે. ધર્માદિ દ્રવ્યોના પણ ગતિહેતુત્વ આદિ ગુણ છે. તે ગુણોમાં પણ ગુણસ્થાન નામનો કોઈ ગુણ આગમમાં કહેવાયો નથી. ગુણની વ્યાખ્યા અનુસાર પણ ગુણસ્થાન ગુણ ન થઈ શકે કારણ કે, “જે દ્રવ્યના સંપૂર્ણ ભાગોમાં અને તેની દરેક અવસ્થામાં રહે છે, તેને ગુણ કહે છે.” ગુણસ્થાન કોઈપણ દ્રવ્યના સંપૂર્ણ ભાગોમાં અને તેની બધી અવસ્થાઓમાં નથી રહેતા. માટે આગમ - પ્રમાણ તથા તર્કથી પણ આ નિર્ણય થઈ જ ગયો કે ગુણસ્થાન કોઈપણ દ્રવ્યના કોઈ ગુણ નથી.

આ પ્રકારે આ સ્વયમેવ સિદ્ધ થઈ ગયું કે ગુણસ્થાન માત્ર પર્યાય જ છે. પર્યાય શબ્દનો અર્થ પરિણામન કે અવસ્થા છે. ઉપરની પરિભાષામાં અવસ્થાને ગુણસ્થાન કહે છે - એમ આવ્યું જ છે.

તાત્પર્ય એ નીકળ્યું કે ગુણસ્થાન સંસારી જીવ ક્રિયની જ પર્યાય છે, સિદ્ધ જીવ ક્રિયની નરી તથા પુરુષ, ઘર્માદિ પાંચે અજીવ ક્રિયની પણ નથી.

ગુણસ્થાન સંસારી જીવ ક્રિયની પર્યાય નિશ્ચિત હોવા છતાં પણ લેદ વિવક્ષાથી ગુણસ્થાન જીવ ક્રિયના કયા-કયા ગુણોની પર્યાય છે, તેની વિશેષ ચર્ચા ક્રમથી થશે જ.

ગ્રંથાધિરાજ સમયસાર શાસ્ત્રમાં તો ગુણ અને પર્યાયોના લેણે ગૌણ કરી સામાન્ય જીવ ક્રિયની મુખ્યતાથી ચર્ચા કરી છે અને ગોમટસાર ગ્રંથમાં ક્રિય અને ગુણોને ગૌણ કરીને જીવ ક્રિયની વિકારી/અવિકારી પર્યાયોની મુખ્યતાથી વર્ણિન કર્યું છે. બીજા શબ્દોમાં કહીએ તો સમયસારને ત્રિકાળી, એક, અખંડ ભગવાન આત્માની ચર્ચા ક્રિદ્ધિની અપેક્ષાથી અપેક્ષિત છે અને ગોમટસારને કર્મ સાપેક્ષ પર્યાયની ચર્ચા અપેક્ષિત છે.

ક્રિય ક્યારેય પર્યાયને છોડી અલગ ન થઈ શકે અને પર્યાય ક્યારેય ક્રિયને છોડી અલગ ન થઈ શકે. આ વાસ્તવિક વસ્તુવ્યવસ્થા છે. ક્રિય -પર્યાય આ બંનેમાંથી માત્ર એકનો સ્વીકાર કરીએ તો એકાંત મિથ્યાત્પ છે. તેથી ક્રિય-પર્યાયમય વસ્તુનું યથાર્થ જ્ઞાન કરવું પ્રત્યેક જિજાસુ મુમુક્ષુનું કર્તવ્ય છે. અહીં મુખ્યપણે ગુણસ્થાનરૂપ પર્યાયની ચર્ચા જ દીઢ છે.

પરિલાખામાં આવેલ, “અવસ્થાઓને” શબ્દ આપણાને સ્પષ્ટ જણાવે છે કે ગુણસ્થાન પર્યાય જ છે. “અવસ્થાઓને” આ શબ્દની પહેલાં “તારતમ્યરૂપ” શબ્દ છે. આનો અર્થ થાય છે હીન-અધિકતા. જેમ “સારું” આ શબ્દ માટે અંગ્રેજીમાં “ગુડ”(good) કહે છે. તેથી વિશેષ સારા માટે “બેટ્ટર” (Better) અને સર્વોત્તમ માટે “બેસ્ટ” (Best) શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે. તેમ જ સંસ્કૃત ભાષામાં “તર” તથા “તમ” શબ્દોનો યથાસ્થાન ઉપયોગ કરવામાં આવે છે. અહીં તર અને તમ શબ્દનો સંબંધ શ્રદ્ધા અને ચારિત્ર ગુણની પર્યાયથી છે. આ

બંને ગુણોની થવાવાળી મિશ્યા, મિશ્ર કે સમ્યક એમ વિવિધ તારતમ્ય અવસ્થાઓ/પર્યાયોને ગુણસ્થાન કહે છે.

ઉપર્યુક્ત કથનથી આ તાત્પર્ય સમજવું જોઈએ કે ન જીવ ક્રવ્યને ગુણસ્થાન કહે છે અને ન શ્રદ્ધા તથા ચારિત્રગુણને. ગુણસ્થાન તો શ્રદ્ધા અને ચારિત્ર ગુણની શુદ્ધાશુદ્ધ પર્યાયોને કહે છે. આમાં આપણાને આ પણ સ્પષ્ટ થાય છે કે જીવ ક્રવ્યને છોડીને પુદ્ગલાદિં અન્ય ક્રવ્યોથી ગુણસ્થાનનો કાંઈ જ સંબંધ નથી. જીવ ક્રવ્યનો પણ ફક્ત શ્રદ્ધા અને ચારિત્ર ગુણોથી જ ગુણસ્થાનનો સાક્ષાત સંબંધ છે. એટલું જ નહીં, શ્રદ્ધા અને ચારિત્ર ગુણોથી પણ સીધો સંબંધ ગુણસ્થાનનો નથી. ગુણસ્થાનનો સંબંધ શ્રદ્ધા અને ચારિત્ર ગુણની અવસ્થાઓ (પર્યાયો/પરિણામો) થી છે.

અત્યારસુધી ગુણસ્થાન સંબંધી વિચાર કરતાં સમયે આપણે સંસારી જીવ ક્રવ્ય, તેના શ્રદ્ધા અને ચારિત્ર ગુણ તથા તેની થવાવાળી પર્યાયોનો જ વિચાર કર્યો. સંક્ષેપમાં હજુ કારણનું જ ચિંતન કર્યું. આમાં નિમિત્તના સંબંધમાં હજુ કાંઈ જ બતાવ્યું નથી, પરંતુ નિમિત્તના સંબંધમાં વિચાર કરવો પણ આવશ્યક છે, કારણ કે કોઈ પણ કાર્ય નિમિત્ત-ઉપાદાન બંનેના યોગથી થાય છે. તેથી હવે નિમિત્તનો વિચાર કરીએ છીએ.

પરિભાષાના પ્રારંભમાં જ, “મોહ અને યોગના નિમિત્તથી” એમ જે ને કારણોનો ઉલ્લેખ કર્યો છે, તે બંને નિમિત્ત કારણ જ છે અને “ગુણસ્થાન” એ કાર્ય છે. જીવક્રવ્યના શ્રદ્ધા તથા ચારિત્ર ગુણનું જે પરિણામન થાય છે (તે તો ઉપાદાન કારણ છે) અને તે પરિણામનમાં મોહનીય કર્મનો ઉદ્દય, ઉપશમ, ક્ષયોપશમ, ક્ષયાદિ તથા યોગ (મન-વચન - કાચા) આ બંને નિમિત્ત કારણ છે.

આચાર્યશ્રી નેમિયંક્રસ્પામીએ ગોમ્મટસાર જીવકાંડની ત્રીજી ગાથામાં ગુણસ્થાનની પરિભાષા કહેતા લખ્યું છે “મોહજોગભવા” અર્થાત् મોહ અને યોગથી ઉત્પન્ન થવાવાળાને ગુણસ્થાન કહે છે. અહીં આચાર્યિદે માત્ર નિમિત્તભૂત કારણનો જ ઉલ્લેખ કર્યો છે, ઉપાદાન કારણને ગૌણ રાખ્યો છે.

ગુણસ્થાનને જ સંક્ષેપ, ઓઘ અને જીવસમાસ કહે છે, જે મોહ અને

યોગથી ઉત્પન્ન થાય છે. નિમિત્ત - પ્રધાન કથન પદ્ધતિથી આપણે એ પણ સમજી લેવું જોઈએ કે વક્તાની વિવક્ષા હમણાં નિમિત્તની મુખ્યતાથી કથન કરવાની છે. ઉપાદાન કારણને ગૌણ કર્યું છે, તેથી હવે નિમિત્તમૂલક કથનની અપેક્ષાથી મોહ્નોગભવા આ પરિભાષા સત્ય જ છે. માત્ર અહીં અવિવક્ષિત વિષયોને ગૌણ જ રાખવામાં આવ્યા છે.

ગુણસ્થાનના લેણ - ગુણસ્થાનના ચૌદ લેણ છે.

- ૧) મિથ્યાત્ય ૨) સાસાદનસમ્યકૃત્વ ૩) સમ્યક્મિથ્યાત્ય / મિશ્ર
- ૪) અવિરત સમ્યકૃત્વ ૫) દેશવિરત ૬) પ્રમત્તવિરત ૭) અપ્રમત્તવિરત
- ૮) અપૂર્વકરણ ૯) અનિવૃત્તિકરણ ૧૦) સૂક્ષ્મસાંપરાય ૧૧) ઉપશાંતમોહ
- ૧૨) ક્ષીણમોહ ૧૩) સથોગકેવળી ૧૪) અયોગકેવળી.

ચૌદ ગુણસ્થાનોના નામ છમાનુસાર સિદ્ધાંત-ચક્વતી આચાર્યશ્રી નેમિયંક્ર રચિત ગોમ્મટસાર જીવકાંડની નિમનાંકિત નવ તથા દસ નંબરની ગાથાઓમાં છે:-

**મિચ્છો સાસણ મિસ્સો, અવિરદ્દસપ્પો ય દેસવિરદો ય।**

**વિરદા પમત્ત ઇદરો, અપુબ્વ અણિયદ્વિ સુહમો ય ॥**

**ઉવસંત ખીણમોહો સજોગકેવળિજિણો અજોગી ય।**

**ચાતુર્દસ જીવ સમાસા કમેણ સિદ્ધા ય ણાદવ્વા ॥**

ગુણસ્થાન : વિભાજન

મોહ અને યોગની મુખ્યતાથી ગુણસ્થાનોનું વિભાજન -

(૧) પહેલા ગુણસ્થાનથી ચોથા ગુણસ્થાન સુધીના ચાર ગુણસ્થાન દર્શનમોહનીય કર્મના ઉદ્ય-અનુદ્યની મુખ્યતાથી છે.

(૨) પાંચમાંથી બારમા ગુણસ્થાન સુધીના આઠ ગુણસ્થાન ચારિત્ર મોહનીયકર્મના ઉદ્ય-અનુદ્યની મુખ્યતાથી છે.

(૩) તેરમું ગુણસ્થાન કેવળજ્ઞાન તથા યોગના સદ્ભાવની મુખ્યતાથી છે.

(૪) ચૌદમું ગુણસ્થાન કેવળજ્ઞાનનો સદ્ભાવ તથા યોગના અસદ્ભાવની મુખ્યતાથી છે.

જુદી - જુદી અપેક્ષાઓથી ગુણસ્થાનોનું વિભાજન -

(૫) અવિરત અને વિરતની અપેક્ષા : પ્રથમ મિથ્યાત્ય ગુણસ્થાનથી લઈને ચોથા અવિરત સમ્યકૃત્વ ગુણસ્થાન સુધીના જે સર્વ જીવ અવિરત

જ છે. પાંચમું ગુણસ્થાન વિરતાવિરતનું છે. છઢા પ્રમત્તવિરતથી લઈને અપ્રમત્તાદિ ઉપરના સર્વે ગુણસ્થાનવત્તી જીવ વિરત જ છે.

(૬) અજ્ઞાની (મિથ્યાત્વી) અને જ્ઞાનીની અપેક્ષા – પ્રથમ મિથ્યાત્વ ગુણસ્થાનથી લઈને બીજા સાસાદન ગુણસ્થાન સુધી સર્વ જીવ મિથ્યા શ્રદ્ધાનના ધારક હોવાથી અજ્ઞાની છે, કારણ કે તેઓને સમ્યક્ષર્થન નથી. વિશેષ એટલું છે કે ત્રીજા ગુણસ્થાનવત્તીને મિશ્ર શ્રદ્ધાની અથવા મિશ્ર જ્ઞાની પણ કહેવાય છે. બીજા - ત્રીજા ગુણસ્થાનવત્તી જીવ ભવ્ય હોવાથી તેમનો મોક્ષ પણ નિશ્ચિત જ છે.

અવિરતસમ્યક્ષત્વ નામનાં ચોથા ગુણસ્થાનથી અયોગકેવળી ગુણસ્થાન સુધી બધા જીવ નિયમથી જ્ઞાની અર્થાત્ સમ્યક્ષજ્ઞાની/ચથાર્થી જ્ઞાની છે કારણ કે તેઓ વસ્તુસ્વરૂપને ચથાર્થી જાણે છે. તેમને નિજ આત્માનું પણ જ્ઞાન તથા અનુભવ છે. જે સર્વજ્ઞ થઈ ગયા છે / અરહંત ભગવાન થઈ ગયા છે, તેમના જ્ઞાનનું સમ્યક્ષપણું તથા ચોથા અવિરતસમ્યક્ષત્વ ગુણસ્થાનવત્તી અગ્રતી શ્રાવકના જ્ઞાનનું સમ્યક્ષપણું સમાન છે - આ બંનેના જ્ઞાનના સમ્યક્ષપણામાં કિંચિત્ પણ અંતર નથી. આથી સમ્યગ્બ્રહ્મિ પણ શાસ્ત્રનો ચથાર્થી વક્તા છે. તેનો ઉપદેશ પણ સમ્યક્ષત્વની ઉત્પત્તિમાં નિમિત્ત કહેવાય છે.

અહીં સર્વજ્ઞ ભગવાન કેવળજ્ઞાની અર્થાત્ પૂર્ણ જ્ઞાની છે અને ચોથા ગુણસ્થાનવત્તી જીવ સમ્યક્ષજ્ઞાની હોવા છતાં પણ અલ્પજ્ઞ છે, આ જે અંતર છે, તેને માનવું જરૂરી જ છે.

(૭) છઙ્ગસ્થ અને સર્વજ્ઞાની અપેક્ષા – પ્રથમ ગુણસ્થાનથી લઈને બારમાં ક્ષીણમોહ ગુણસ્થાન સુધીના બાર ગુણસ્થાનવત્તી સર્વ જીવ નિયમથી છઙ્ગસ્થ જ છે. મતિ, શ્રુત, અવધિ અને મન:પર્યાય જ્ઞાનના ધારક મુનિરાજ પણ નિયમથી છઙ્ગસ્થ અર્થાત્ અલ્પજ્ઞ જ છે.

તેરમાં તથા ચૌદમા ગુણસ્થાનવત્તી પરમગુરુ અર્થાત્ અરહંત પરમાત્મા કેવળજ્ઞાનના ધારક હોય છે, તેથી તે સર્વ સર્વજ્ઞ જ છે. સર્વજ્ઞ જીવ પૂર્ણ જ્ઞાની હોય છે. ક્ષાયોપશમિક જ્ઞાન ક્યારેય પૂર્ણ હોતું નથી અને કેવળજ્ઞાન ક્યારેય અપૂર્ણ નથી હોતું, એવો નિયમ છે.

(૮) શ્રાવકની અપેક્ષા – એકદેશ ધર્મધારક સાધક જીવ, અવિરત સમ્યક્ષત્વી અને દેશવિરત ગુણસ્થાનવત્તી જીવોને શ્રાવક કહે છે. ચોથા

ગુણસ્થાનવર્તી અસંયમી છે અને પંચમ ગુણસ્થાનવર્તી સંયમાસંયમી છે.

(૬) ગુરુપદની અપેક્ષા - ત્રણ પ્રકારે આનું વિભાજન થઈ શકે.

(અ) પ્રમત્તાપ્રમત્ત ગુરુ : છઢા પ્રમત્ત તથા સાતમા સ્વસ્થાન અપ્રમત્ત ગુણસ્થાનમાં સતત જૂલવાવાળા ભાવલિંગી સંત પ્રમત્તાપ્રમત્ત ગુરુ છે.

(બ) અપ્રમત્તગુરુ : સાતમું સાતિશાય અપ્રમત્તસંયત અને અપૂર્વકરણ ગુણસ્થાનથી લઇને બારમા ક્ષીણમોહનીય ગુણસ્થાન સુધી શ્રેણીમાં મોહની ઉપશાંતતા અથવા ક્ષપણા કરવાવાળા દ્યાનારૂઢ મહામુનિરાજ અપ્રમત્ત ગુરુ છે.

(ક) પરમગુરુ : તેરમાં અને ચૌદમાં ગુણસ્થાનોમાં કેવળજ્ઞાનાંદી ક્ષાયિક પદ્યથોથી તથા પરમ ઔદારિક શરીર સહિત શોભાયમાન પરમ પવિત્ર આત્મા, જેને અરહંત પરમાત્મા પણ કહે છે, તે પરમગુરુ છે.

(૧૦) શ્રેણીની અપેક્ષા : શ્રેણી બે પ્રકારની છે. ઉપશામ શ્રેણી અને ક્ષપક શ્રેણી.

ઉપશામ શ્રેણીના (૧) અપૂર્વકરણ (૨) અનિવૃત્તિકરણ (૩) સૂક્ષ્મ સાંપરાય (૪) ઉપશાંતમોહ આ ચાર ગુણસ્થાન છે. ઉપશામક મુનિરાજ ચારિત્રમોહનીયનો ઉપશામ કરે છે અને ઉપશાંતમોહ ગુણસ્થાનથી નિયમથી નીચે પડે છે.

ક્ષપક શ્રેણીના (૧) અપૂર્વકરણ (૨) અનિવૃત્તિકરણ (૩) સૂક્ષ્મ સાંપરાય (૪) ક્ષીણમોહ આ ચાર ગુણસ્થાન છે. ક્ષપક મુનિરાજ ચારિત્રમોહનીયનો નિયમથી ક્ષય કરીને કેવળી ભગવાન થઈ સિદ્ધ થઈ જાય છે.

(૧૧) પ્રમત્ત તથા અપ્રમત્તભાવની અપેક્ષા : મિદ્યાત્વ ગુણસ્થાનથી લઇને પ્રમત્તસંયત ગુણસ્થાન સુધીના છ ગુણસ્થાનવર્તી સર્વ જીવ નિયમથી પ્રમત્તભાવ સહિત છે. અપ્રમત્ત ગુણસ્થાનથી લઇને ચૌદમાં અયોગકેવળી ગુણસ્થાન સુધીના સર્વે આઠ ગુણસ્થાનવર્તી મુનિરાજ અપ્રમત્તભાવ સહિત છે.

(૧૨) યોગ અને અયોગની અપેક્ષા - પ્રથમ મિદ્યાત્વ ગુણસ્થાનથી લઇને તેરમાં સયોગકેવળી ગુણસ્થાન સુધીના તેર ગુણસ્થાનવર્તી સર્વ જીવ સયોગી છે અને માત્ર ચૌદમાં અયોગકેવળી ગુણસ્થાનવર્તી અરહંત પરમાત્મા જ અયોગી છે.

(૧૩) રાગી અને વીતરાગીની અપેક્ષાથી આના ત્રણ ભેદ થાય છે.

(અ) મિથ્યાત્વ, સાસાદન અને મિશ્ર સુધીના ત્રણો ગુણસ્થાનવર્તી જીવ, વીતરાગભાવથી રહિત માત્ર રાગાદિ પરિણામવાળા છે, મોક્ષમાર્ગના વિરાઘક છે.

(બ) ચોથા અવિરતસમ્યજ્ઞત્વ ગુણસ્થાનથી લઈને દસમાં સૂક્ષ્મ સાંપરાય ગુણસ્થાન સુધીના સાતેય ગુણસ્થાનવર્તી જીવ રાગ તથા વીતરાગરૂપ મિશ્ર પરિણામોના ધારક સાધકજીવ છે.

(ક) અગ્યારમાં ઉપશાંતમોહ ગુણસ્થાનથી લઈને ચૌદમા અયોગ્યકેવળી ગુણસ્થાન સુધીના ચારેય ગુણસ્થાનવર્તી સર્વ મહાપુરુષ નિયમથી પૂર્ણ વીતરાગ પરિણામના ધારક જ હોય છે.

(૧૪) દુઃખ અને સુખની અપેક્ષાથી ચાર પ્રકારના વિભાજન -

(અ) મિથ્યાત્વથી મિશ્ર ગુણસ્થાન સુધીના સર્વ જીવ નિયમથી દુઃખી જ છે, કારણ કે મિથ્યાદર્શન, અજ્ઞાન અને અસંયમથી જીવને દુઃખ જ ભોગવલું પડે છે. યથાર્થ વસ્તુસ્વરૂપના જ્ઞાનથી જ સુખની પ્રાપ્તિ થાય છે.

(બ) ચોથા અવિરતસમ્યજ્ઞત્વ ગુણસ્થાનથી દસમાં સૂક્ષ્મસાંપરાય ગુણસ્થાન સુધીના સાત ગુણસ્થાનવર્તી સાધક જીવ કથંચિત્ દુઃખી પણ છે અને કથંચિત્ સુખી પણ છે. કષાયના સદ્ભાવને કારણ યથાસંભવ દુઃખ છે અને યથાયોગ્ય કષાયના અભાવથી ઉત્પન્ન વીતરાગતાથી યથાસંભવ સુખ પણ છે.

(ક) સત્તામાં હોવા છિતાં પણ કષાયનો સર્વથા ઉદ્યનો અભાવ, અગ્યારમાં ઉપશાંતમોહ ગુણસ્થાનમાં તથા સત્તા અને ઉદ્યની અપેક્ષાથી પણ સર્વથા અભાવ બારમાં ક્ષીણામોહ ગુણસ્થાનમાં થાય છે. તેથી તે વીતરાગી મુનીશ્વર પૂર્ણ અતીનિક્રય સુખી છે.

(લ) તેરમાં તથા ચૌદમા ગુણસ્થાનોમાં પૂર્ણ વીતરાગતાની સાથે કેવળજ્ઞાન પણ રહેલું છે. માટે આ બંને ગુણસ્થાનોમાં સુખ અનંતરૂપથી પરિણામિત થાય છે, તેથી અરહંત ભગવાન અનંતસુખી છે.

(૧૫) બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્માની અપેક્ષા આના ત્રણ ભેદ છે.

(અ) મિથ્યાત્વથી ત્રીજા મિશ્ર ગુણસ્થાન સુધીના ત્રણો ગુણસ્થાનવર્તી સર્વ જીવ બહિરાત્મા જ છે. તેને દુઃખી, અજ્ઞાની, વિરાઘક અને સંસારમાર્ગી

જ જાણવા જોઈએ.

(બ) ચોથા અવિરતસમ્યકૃત્વ ગુણસ્થાનથી લઇને બારમાં ક્ષીણમોહ ગુણસ્થાન સુધીના નવ ગુણસ્થાનવર્તી સર્વ જીવ અંતરાત્મા છે. તે સર્વ સમ્યકૃત્ત્વાની, સાધક, મોક્ષમાર્ગ અને ચથાપદવી સુખી છે.

(ક) તેરમાં - ચૌદમાં ગુણસ્થાનવર્તી સચોગ-અચોગ કેવળી જીનેન્નોને પરમાત્મા કહે છે. આ કેવળજ્ઞાની અનંત સુખી તો છે જ અને શીદ્ધ જ સિદ્ધ પરમાત્મા થઈ અવ્યાબાધ અનંતસુખને પ્રાપ્ત કરવાવાળા છે.

(૧૬) અશુલોપયોગી, શુલોપયોગી, શુદ્ધ્યોપયોગીની અપેક્ષા - મિથ્યાત્વથી ત્રીજા મિશ્ર ગુણસ્થાન સુધીના ત્રણે ગુણસ્થાનવર્તી જીવ મુખ્યપણે અશુલોપયોગી છે. ચોથાથી લઇને છઢા ગુણસ્થાન સુધીના ત્રણે ગુણસ્થાનવર્તી જીવ મુખ્યપણે શુલોપયોગી અને ચોથા-પાંચમાં ગુણસ્થાનવર્તી ગૌણઝ્પે શુદ્ધ્યોપયોગી પણ છે.

સાતમાથી બારમા ગુણસ્થાન સુધીના સર્વ જીવ વધતા થકા શુદ્ધ્યોપયોગી જ છે. તથા તેરમાં અને ચૌદમાં ગુણસ્થાનમાં શુદ્ધ્યોપયોગનું ફળ છે. એક અપેક્ષાથી ચોથા ગુણસ્થાનથી લઇને ચૌદમાં ગુણસ્થાન સુધીના અગ્યાર ગુણસ્થાનવર્તી બધા જીવ ધર્મત્વમાં જ કહેવાય છે.

(૧૭) ધાર્મિક - અધાર્મિકની અપેક્ષા - મિથ્યાત્વથી લઇને ત્રીજા મિશ્ર ગુણસ્થાન સુધીના ત્રણે ગુણસ્થાનવર્તી બધા જીવ અધાર્મિક જ છે, કારણ કે તેઓની પાસે નિશ્ચય સમ્યકૃત્ત્વનિ, જ્ઞાન, ચારિત્રસ્વરૂપ રત્નત્રય ધર્મ નથી હોતો. ચોથા અવિરતસમ્યકૃત્વથી લઇને ચૌદમાં અચોગકેવળી ગુણસ્થાન સુધીના અગ્યાર ગુણસ્થાનવર્તી સર્વ જીવ ધાર્મિક જ છે, કારણ કે તેમના જીવનમાં રત્નત્રયરૂપ ધર્મ હોય છે. તેઓને કમથી અયથાર્થ પુરુષાર્થી અને ચથાર્થ પુરુષાર્થી પણ કહી શકાય છે.

(૧૮) મિથ્યા-સમ્યકૃત્ત્વચારિત્રની અપેક્ષા - મિથ્યાત્વ, સાસાદન અને મિશ્ર આ ત્રણે ગુણસ્થાનવર્તી જીવ મિથ્યા ચારિત્રવાન છે, કારણ કે આ જીવ સમ્યકૃત્ત્વનથી નથી હોતા. ચોથા અવિરતસમ્યકૃત્વ ગુણસ્થાનથી લઇ ચૌદમાં અચોગ કેવળી ગુણસ્થાન સુધીના અગ્યાર ગુણસ્થાનવર્તી જીવ સમ્યકૃત્ત્વ ચારિત્રવાન હોય છે, કારણ કે આ સર્વ જીવ સમ્યકૃત્ત્વનિ છે. જ્યાં શ્રદ્ધા સમ્યકૃત્ત્વ થઈ ત્યાં જ્ઞાન તથા ચારિત્ર નિયમથી સમ્યકૃત્ત્વ અર્થાત્ ચથાર્થ થાય જ છે.

આ પ્રકારે મોહ તથા યોગના સદ્બાવ-અસદ્બાવની અપેક્ષાથી લઈને મિથ્યા તથા સમ્યક્ ચારિત્રની અપેક્ષા સુધીની અઢાર અપેક્ષાઓથી ગુણસ્થાનોનું વિલાજન થઈ શકે છે.

પ્રશ્ન ૩ :- આપણે હમણાં વર્તમાનમાં કયા ગુણસ્થાને છીએ, તે જો જાણવું હોય તો કઈ રીતે જાણી શકાય ?

ઉત્તર :- “અમૂર્તિક પ્રદેશોનો પુંજ, પ્રસિદ્ધ જ્ઞાનાદિ ગુણોનો ધારી, અનાદિનિધન વસ્તુ સ્વ છે અને મૂર્તિક પુદ્ગલ દ્રવ્યોનો પિંડ પ્રસિદ્ધ જ્ઞાનાદિકોથી રહિત જેનો નવો સંયોગ થયો એવા શરીરાદિક પુદ્ગલ પર છે, તેના સંયોગરૂપ નાના પ્રકારની મનુષ્ય તિર્યાદિક પથચિંહ થાય છે. તે પથચિંહમાં અહંબુદ્ધિ ધારણ કરે છે, સ્વ-પરનું લેદ નથી કરી શકતો, જે પથચિંહ પ્રાપ્ત કરે તેને જ પોતારૂપ (સ્વરૂપ) માને છે.

તથા તે પથચિંહમાં જ્ઞાનાદિક છે તે તો પોતાના ગુણ છે અને રાગાદિક છે, તે આપણને કર્મનિમિત્તથી ઔપાધિકભાવ થયા છે તથા વણાદિક છે, તે શરીરાદિક પુદ્ગલના ગુણ છે અને શરીરાદિકમાં વણાદિકોનું તથા પરમાણુઓનું નાના પ્રકારે પલટવું થાય છે, તે પુદ્ગલની અવસ્થા છે, તેથી આ બધાને જ પોતાનું સ્વરૂપ જાણે છે, સ્વલાબ-પરલાબનો વિવેક નથી થઈ શકતો.

તથા મનુષ્યાદિક પથચિંહમાં કુદુંબ - ધનાદિકનો સંબંધ હોય છે, તે પ્રત્યક્ષ પોતાથી ભિન્ન છે તથા તે પોતાને આધીન નથી પરિણામિત થતાં, છતાંચ તેનામાં મમકાર કરે છે કે આ મારા છે. તે કોઈ પણ રીતે પોતાના થતાં નથી. પોતે જ પોતાની માન્યતાથી જ પોતાના માને છે તથા મનુષ્યાદિ પથચિંહમાં કદાચિત દેવાદિકનું અથવા તત્વોનું અન્યથા સ્વરૂપ જે કલ્પિત કર્યું તેની તો પ્રતીતિ કરે છે, પરંતુ ચર્થાર્થ સ્વરૂપ જેવું છે તેવું પ્રતીત નથી કરતો.”

આ પ્રકારે પંડિત પ્રવરશ્રી ટોડરમલજીએ દર્શનમોહના ઉદ્યથી થવાવાળા જીવના પરિણામોનું વર્ણન મોક્ષમાર્ગપ્રકાશક પાના નં. ૩૮ પર કર્યું છે. તેના આધારથી પાત્ર જીવ પોતાના સ્થાનનો નિર્ણય લેવાનો આ પ્રમાણે પ્રયાસ કરી શકે છે :-

સૌ પ્રથમ આપણે સ્વ-આત્મા અને પર દેહાદિના લક્ષણાલેદથી ચથાર્થ

નિર્ણય કરી પોતાના શુભ - અશુભ તથા શુદ્ધ પરિણામોને જાણવા જોઈએ. તે માટે આગમનો અભ્યાસ, ચુક્તિનું અવલંબન અને પરંપરા ગુરુઓના ઉપદેશનો આધાર લઈ નિર્ણય કરવો જોઈએ.

(૧) આપણે તેરમાં - ચૌદમાં ગુણસ્થાનવર્તી પ્રગટ પરમાત્મા છીએ, એવો બમ હોવાનો તો કોઈને અવકાશ જ નથી, કારણ કે આપણામાંથી કોઈ ન તો વીતરાગી છે, ન સર્વજ્ઞ છે અને ન અનંત સુખી પણ.

(૨) જે વસ્ત્રોનો ત્યાગ ન કરી શક્યા હોય અર્થાત् દિગ્ંબર સાધુ અવસ્થાનો સ્વીકાર ન કર્યો હોય, તે છઢા ગુણસ્થાનથી લઈ બારમા ગુણસ્થાનવર્તી મુનિરાજ તો છે જ નહીં, આ પણ સ્પષ્ટ નિર્ણય છે.

(૩) હવે કેવળ પ્રથમ ગુણસ્થાનથી લઈને પાંચમા વિરતાવિરત ગુણસ્થાન સુધીના પાંચ ગુણસ્થાનોમાં આપણું ગુણસ્થાન શોધવાની વાત બાકી રહે છે.

જો જીવનમાં અહિંસા આદિ પાંચ અણુષ્ટત, ત્રણ ગુણબ્રત અને ચાર શિક્ષાબ્રત - આ બાર પ્રકારના શ્રાવકોચિત બ્રત આદિનો બુદ્ધિપૂર્વક સ્વીકાર જ ન હોય તો પાંચમું વિરતાવિરત ગુણસ્થાન પણ નથી. આ વિષય પણ પોતાની સમજમાં આવી જ જાય છે.

જો કદાચ કોઈએ બાહ્યમાં અણુષ્ટત આદિનો પણ સ્વીકાર કર્યો હોય અને આત્માનુભૂતિ/સમ્યક્ષદર્શનપૂર્વક અનંતાનુભંધી અને અપ્રત્યાખ્યાના-પરણ બે કષાય ચોકડીના અભાવપૂર્વક વીતરાગતારૂપ આનંદ (સુખ, ધર્મ, સંવર, નિર્જરા, મોક્ષમાર્ગ)નો અનુભવ કોઈને થતો હોય તો પાંચમું સંયમાસંયમ ગુણસ્થાન છે, એવું નિઃસંકોચપણે સમજવું.

(૪) જો માત્ર સાચા દેવ-શાસ્ત્ર-ગુરુની જ નિઃશંક શ્રદ્ધા હોય, જીવનમાં સાતે વ્યસનમાંથી કોઈ વ્યસન ન હોય, અન્યાય, અનીતિ, અભક્ષયનો ત્યાગ હોય, જીવનમાં આગમ કથિત આઠમૂળગુણોનું સહજરૂપથી પાલન થતું હોય અને મિથ્યાત્વ તથા અનંતાનુભંધી કષાય પરિણામના અભાવપૂર્વક આત્માનુભૂતિરૂપ અતિનિષ્ઠ્ય આનંદનો સ્વાદ પોતાના જીવનમાં આવતો હોય તો આપણને ચોથું ગુણસ્થાન અવિરત સમ્યક્ષક્રિય છે, એમ જાણવું.

જો દેવ-શાસ્ત્ર-ગુરુનો પણ આગમાનુસાર લક્ષણ ક્રિષ્ટિથી ચથાથી અને હાર્દિક નિર્ણય ન હોય તો તેને સમ્યક્તવ્ય પ્રગટ કરવાની પાત્રતા જ

નથી, તો પછી સમ્યકૃત્વ હોવાનો પ્રશ્ન જ ઉપસ્થિત નથી થતો, તે તો ગૃહીત મિથ્યાદ્રાગ્દિ છે. તેને આગમમાં તીવ્ર પાપી, અજ્ઞાની અને મૂઢ અર્થાતું મૂર્ખ કહ્યો છે.

પ્રશ્ન રણ:- આ વિવેચનની આપણે મિથ્યાત્વ ગુણસ્થાનવત્તી છીએ, એમ લાગે છે, આ સ્થિતિમાં અમારે સમ્યકૃત્વ પ્રાપ્ત કરવા શું કરવું જોઈએ?

ઉત્તર :- મિથ્યાત્વ ગુણસ્થાન નથી દીછિતા તો મિથ્યાત્વનો અભાવ કરી સમ્યકૃત્વની થવા માટે સાતતવોને હેચ, જોય તથા ઉપાદેચ બુદ્ધિથી ચથાર્થ નિર્ણય કરવાનો પુરુષાર્થ કરવો જોઈએ. આ પણ એક અપેક્ષા સમજુ લેવી જોઈએ કે ચિંતા કરવાની કોઈ આવશ્યકતા નથી, કારણ કે જીવનમાં સાચો નિર્ણય કરવો તે પણ બહુ જ મહત્વપૂર્ણ ઉપલબ્ધિ છે.

આ વિષયના વિશેષ સ્પષ્ટીકરણ માટે મોક્ષમાર્ગપ્રકાશક ત્રણના પાના નં. ૩૧૨નો આ અંશ જુઓ - “તથા આ અવસરમાં જે જીવ પુરુષાર્થથી તત્ત્વનિર્ણય કરવામાં ઉપયોગ લગાવવાનો અભ્યાસ કરે, તેની વિશુદ્ધતા વધશે, તેના કર્મની શક્તિ હીએ થશે, થોડા સમયમાં પોતાની મેળે દર્શનમોહનો ઉપશમ થશે, ત્યારે તત્ત્વોની ચથાવતું પ્રતીતિ આવશે. તેથી તેનું તો કર્તવ્ય તત્ત્વનિર્ણયનો અભ્યાસ જ છે, તેનાથી દર્શનમોહનો ઉપશમ તો સ્વયમેવ થાય છે. તેમાં જીવનું કાંઈ કર્તવ્ય નથી.

તથા તેના થવા પર જીવને સ્વયમેવ સમ્યકૃદર્શન થાય છે અને સમ્યકૃદર્શન થવાથી શ્રદ્ધાન તો એ થયું કે, “હુ આત્મા છું, મારે રાગાદિક ન કરવો,” પરંતુ ચારિત્રમોહના ઉદ્દ્યથી રાગાદિક થાય છે. ત્યાં તીવ્ર ઉદ્દ્ય હોય તો વિષયાદિમાં પ્રવર્તે છે અને મંદ ઉદ્દ્ય હોય ત્યારે પોતાના પુરુષાર્થથી ધર્મકાર્યોમાં તથા પૈરાગ્યાદિ ભાવનામાં ઉપયોગને લગાવે છે. તેના નિમિત્તથી ચારિત્રમોહ મંદ થઈ જાય છે, - એવું થવાથી દેશચારિત્ર તથા સકલચારિત્ર અંગીકાર કરવાનો પુરુષાર્થ પ્રગટ થાય છે.

તથા ચારિત્રને ધારણ કરીને પોતાના પુરુષાર્થથી ધર્મમાં પરિણાતિને વધારે ત્યાં વિશુદ્ધતાથી કર્મની શક્તિહીન થઈ જાય છે. તેનાથી વિશુદ્ધતા વધે છે અને તે કર્મની શક્તિ વધારે હીન થાય છે.

આ રીતે કમથી મોહનો નાશ કરે ત્યારે સર્વથા પરિણામ વિશુદ્ધ થાય છે. તેના છારા જ્ઞાનાવરણાદિકનો નાશ થાય ત્યારે કેવળજ્ઞાન પ્રગટ થાય છે. પછી ત્યાં વગર ઉપાયે અધાતિકર્મનો નાશ કરી શુદ્ધ

સિદ્ધપદને પ્રાખ કરે છે.”

જો કોઈ જીવ મિથ્યાત્પ ગુણસ્થાનવર્તી હોય અને બમથી પોતાને સમ્યક્ષક્રાંતિ અથવા પંચમાદિ ગુણસ્થાનવર્તી માનતો હોય તો તે મોક્ષમાર્ગનો પુરુષાર્થ પણ નથી કરી શકતો. દુર્લભ મળુષ્ય જીવન બમમાં જ વ્યર્થ ગુમાવી હે છે.

જો યથાર્થ નિર્ણય થતો હોય તો તો સારું જ છે. તેનાથી કરવાની વાત જ શું છે ? સાચા ઉપાયનું અવલંબન લેવું શ્રેષ્ઠ તથા શ્રેયસ્કર છે.

પ્રશ્ન ૫ :- મિથ્યાત્પ ગુણસ્થાનના અભાવ કરવાનો સાચો ઉપાય શું છે ?

ઉત્તર :- જિનેન્દ્ર કથિત તત્ત્વાનુસાર સદાચારી જીવન જીવતા પ્રથમ સાચા દેવ-શાસ્ત્ર-ગુરુનું યથાર્થ જ્ઞાન કરો. પછી અદ્યાત્મ શાસ્ત્રના અદ્યયનથી આત્મસ્વભાવનો નિર્ણય કરવો. જેને એકવાર નિજ શુદ્ધાત્માનો નિર્ણય થઈ જાય છે, તે વ્યક્તિ સ્વયમેવ સમ્યક્ષર્ણન આદિ ધર્મ પ્રગટ કરવાની કળા પણ સમજુ લે છે. નિજ શુદ્ધાત્મ સ્વભાવનો સ્વીકાર કરવો જ સમ્યક્ષર્ણ-જ્ઞાન-ચારિત્ર પ્રગટ કરવાનો સાચો, સરળ તથા સુગમ અને એકમાત્ર ઉપાય છે.

પ્રશ્ન ૬ :- મિથ્યાત્પ અને અનંતાનુંબંધી કષાય ચોકડીનો નાશ પણ તો કરવો જોઈએ ને ?

ઉત્તર :- આપનું આ કહેવું વ્યવહારનથની અપેક્ષાએ સત્ય જ છે પરંતુ વાસ્તવમાં (ખરોખર) ત્રિકાળી નિજ શુદ્ધાત્માનો આશ્રય લેવાથી મિથ્યાત્પાદિ કર્મોનો નાશ તો સ્વયમેવ થઈ જ જાય છે. તેમાં જીવને કાંઈ કરવું નથી પડતું. જ્ઞાનાવરણાદિ કર્મ તો પુદ્ગલની પર્યાય છે. તેમાં તો જીવ કાંઈ કરી જ નથી શકતો.

તત્ત્વનિર્ણય કરવો, પોતાની શ્રદ્ધાને યથાર્થ રીતે સમ્યક્ષર્પ પરિણમિત કરવી અને નિજ શુદ્ધાત્મામાં રમણતારૂપ ચારિત્ર પ્રગટ કરવું - આ તો જીવ ક્રિયાની અવસ્થા છે, તેને જીવ કરી શકે છે, કારણ કે આ કાર્ય જીવની સીમામાં આવે છે. અન્ય જીવોની અવસ્થાઓ અને પુદ્ગલાદિ ક્રિયાની અવસ્થાઓ જીવની સીમામાં આવતી નથી. તેથી તેમાં જીવ કાંઈ પણ નથી કરી શકતો.

પ્રશ્ન ૭ :- જ્યારે અહીં ગુણસ્થાનની ચર્ચા પ્રારંભ કરી છે તો વર્ચ્યે-વર્ચ્યે આ આત્મા ક્યાંથી/ કેમ આવી જાય છે ? સીધી કરણાનુયોગ

સાપેક્ષ વાત કરોને ?

ઉત્તર :- ભાઈ ! આપ પણ થોડા શાંત થઈ વિચારો ને ! તને આત્માની ચર્ચાથી આટલી અરુંધિ કેમ છે ? એરે ! ગુણસ્થાન પણ તો આત્માના જ હોય છે. અમે તો સમજુ - વિચારીને જ કહી રહ્યા છીએ. અનુયોગ અનુસાર કથન તો થશે જ. એમાં અમારું આપથી અથવા અન્ય કોઈથી કાંઈ પણ મતભેદ નથી. કથન પદ્ધતિને કારણે કેવળજ્ઞાન પ્રણીત શાસ્ત્ર ચાર અનુયોગોમાં વિભક્ત છે. ચારેય અનુયોગનું તાત્પર્ય એક વીતરાગતા જ છે. (પંચાસ્તિકાય ગાથા નં. ૧૭૨) સમ્યકૃદ્દર્શન પ્રગટ કરવાનો પુરુષાર્થ તો મુખ્યતાથી એક દ્રવ્યાનુયોગમાં કથિત નિજ શુદ્ધ જ્ઞાયક ભગવાન આત્માના આશ્રયથી જ થાય છે.

વિવિધ અનુયોગને અનુસાર ધર્મ પ્રગટ કરવાના પુરુષાર્થરૂપ ઉપાય જુદા-જુદા નથી, એક જ છે અને તે છે ત્રિકાળી નિજ શુદ્ધાત્માનો આશ્રય કરવો..... “કરણાનુયોગના અનુસાર આપ ઉધમ કરો તો ના થઈ શકે. કરણાનુયોગમાં તો યથાર્થ પદાર્થ બતાવવાનું મુખ્ય પ્રયોજન છે.... આપ કર્મોના ઉપશમાદિ કરવા દીછો તો કેમ થશે ? આપ તો તત્ત્વાદિનો નિશ્ચય કરવાનો પુરુષાર્થ કરો. તેનાથી સ્વયમેવ જ ઉપશમાદિ સમ્યકૃત્વ થાય છે..” (મોક્ષમાર્ગ પ્રકાશક, પાના નં. ૨૭૭)

પ્રશ્ન ૮ :- સમ્યકૃદ્રશનની પૂર્વે કરણાલબ્ધિ તો જોઈએ ને ? આપ તો તેની વાત જ નથી કરતાં ?

ઉત્તર :- હા ! કરણાલબ્ધિ જોઈએ; આ આપનું કહેવું સત્ય છે.

સમ્યકૃદ્રશનની પૂર્વે ક્ષયોપશમ, વિશુદ્ધિ, દેશના, પ્રાયોગ્ય અને કરણ - આ પાંચ લબ્ધિઓ અવશ્ય હોય છે. આમાં કરણાલબ્ધિ સાધકતમ હોય છે. અર્થાત્ કરણાલબ્ધિ પ્રાપ્ત થવાથી સમ્યકૃદ્રશન નિયમથી પ્રગટ થાય જ છે. એવો નિયમ અન્ય ચારે લબ્ધિઓ સાથે નથી. આ કરણાલબ્ધિની પ્રાપ્તિનો ઉપાય પણ એક ત્રિકાળી નિજ શુદ્ધાત્માનો આશ્રય લેવાનો જ છે, અન્ય નહીં.

આ ઉપાય મોક્ષમાર્ગ/રત્નત્રયની પ્રાપ્તિનો છે. જેમ બિલાડીને કોઈ ગમે તે રીતે જમીન પર ફેંકે, તે નિયમથી પોતાના ચારે પગ ઉપર જ ઉલ્લી થઈ જાય છે, તેમ જ ચારેય અનુયોગોમાંથી કોઈપણ અનુયોગને વાંચો, બધામાં સમ્યકૃદ્રશનની પ્રાપ્તિનો ઉપાય માત્ર નિજ ભગવાન આત્માનો આશ્રય કરવો એ જ બતાવેલ છે.

ગિરાતનાં રહિતપરી હશ્મિનું રાહ હતું ગિરાતેનું જાહેર હશ્મિનું રહિતીનું  
છે. કંઈ કાંઈની રહિતું હશ્મિનું હશ્મિનું હશ્મિનું (૬)

મિથ્યાત્વ નાની રહિતું હશ્મિનું હશ્મિનું હશ્મિનું હશ્મિનું હશ્મિનું  
મિથ્યાત્વ નાની રહિતું હશ્મિનું હશ્મિનું હશ્મિનું હશ્મિનું હશ્મિનું (૭)

### મિથ્યાત્વ ગુણસ્થાન

પહેલા ગુણસ્થાનનું નામ મિથ્યાત્વ છે.

આ મિથ્યાત્વ ગુણસ્થાન પ્રત્યેક જીવને અનાદિકાળથી સ્વચ્છસિદ્ધ છે. વર્તમાનમાં સિદ્ધાલયમાં બિરાજમાન જેટલા પણ પરમપૂજ્ય સિદ્ધ ભગવાન છે, તે સર્વ ભૂતકાળમાં આ મિથ્યાત્વ ગુણસ્થાનમાં જ હતાં. આ મિથ્યાત્વનો નાશ કરીને જ રત્નત્રયની સાધનાના બળથી તેઓ સર્વ સિદ્ધાલય પહોંચ્યા છે.

નવા અપરાધની વગર જ જીવ અનાદિકાળથી જ વિપરીત શ્રદ્ધાની છે. પરંતુ આ જીવ ઈછે તો, વર્તમાનમાં પોતાના પુરુષાર્થી વિપરીત શ્રદ્ધાટિનો પરિહાર (ત્વાગ) કરી શકે છે. ઉદ્ધી માન્યતાનો ત્વાગ કરવો, તે મનુષ્યના હાથમાં છે. વિપરીત માન્યતા, વિપરીત શ્રદ્ધા, મિથ્યાત્વ, સંસારમાર્ગ, દુઃખમાર્ગ - આ બધાનો એક જ અર્થ છે.

**પ્રશ્ન ૬ :-** મિથ્યાત્વ અવસ્થામાં જીવના કેવા ભાવો હોય છે ? તે સ્પષ્ટ કરશો જેનાથી મિથ્યાત્વનું સાચું સ્વરૂપ અમે સમજુ શકીએ અને તેનો ત્વાગ કરી શકીએ.

**ઉત્તર :-** અજ્ઞાની જીવ અનાદિકાળથી જ વિપરીત માન્યતાને સાચી માની મિથ્યાત્વને જ સતત પુષ્ટ કરી રહ્યો છે તથા સત્સમાગમ તથા સત્તશાસ્ત્રનું અદ્યયન ન કરવાથી પોતાની ભૂલોનું પણ ચથાર્થ જ્ઞાન નથી. તેથી મિથ્યાત્વ છોડવા તથા છોડાવવાનાં અલિપ્રાયથી અહીં તે સુબોધ શબ્દોમાં મિથ્યાત્વ પરિણામ સ્પષ્ટ કરીએ છીએ.

(૧) વીતરાગી, સર્વજ્ઞ, હિતોપેદેશી સાચા દેવને છોડી અન્ય મોહી-રાગી-ક્લેધી દેવ-દેવીઓને સાચા દેવ માનવા, સર્વજ્ઞકથિત સત્તશાસ્ત્રથી વિપરીત શાસ્ત્રને ચથાર્થ શાસ્ત્ર માનવું, છઢા-સાતમા ગુણસ્થાનમાં જૂલવાવાળા લાવલિંગી દિગંબર મુનિરાજને છોડી અન્ય વેશધારીને ગુરુ તરીકે સ્વીકારવા, આ બધું ગૃહીત મિથ્યાત્વ છે.

(૨) આપણાથી સર્વથા લિન્ન, ધન-ધાન્ય-દુકાન-મકાન-પુત્ર-મિત્ર-

વસ્ત્રાદિમાં એકત્વબુદ્ધિને તથા સાત તત્વોમાં વિપરીત માન્યતાને અગૃહીત મિથ્યાત્વ કહે છે.

(૩) આપણે જીવ છીએ, છતાંચ જીવથી સર્વથા ભિજન જડસ્વભાવી શરીરને પોતાનું માનવાવાળો બહિરાત્મા મિથ્યાફ્રષ્ટ છે.

(૪) જીવ જ્ઞાનાનંદસ્વભાવી હોવા છતાં તેને કોધાદિ સ્વભાવવાળો જાણવો (માનવો) તે પણ મિથ્યાત્વ છે.

(૫) જીવ અનાદિથી જ અમૂર્તિક તથા જ્ઞાનાનંદ સ્વભાવી હોવા છતાં પણ તેને મૂર્તિક, અચેતન, મનુષ્યાદિરૂપ માનવું મિથ્યાત્વ છે. પોતાને ખૂલી શરીરાદિ પરપદાર્થોમાં અહંકાર, મમકાર, કર્તૃત્વ, ભોક્તૃત્વ આદિ બખમભાવ રાખવો - તે બધાં મિથ્યાત્વના ચિનહ છે.

(૬) (i) : પુણ્ય પાપભાવને ધર્મ માનવો.

(ii) : હું બીજા જીવોને મારી શકું છું અથવા બચાવી શકું છું.

(iii) : બીજા જીવ મને મારી શકે છે અથવા બચાવી શકે છે.

(iv) : હું અન્ય જીવોને સુખી - દુઃખી કરી શકું છું અથવા અન્ય જીવ મને સુખી - દુઃખી કરી શકે છે અથવા મારું અકલ્યાણ કરી શકે છે.

(v) : દેવ તથા ગુરુ મારું કલ્યાણ તથા અકલ્યાણ પણ કરી શકે છે.

(vi) : વિશ્વના કોઈક પદાર્થ સારા છે અને કોઈક પદાર્થ ખરાબ છે.

આવી રીતે સર્વ અજ્ઞાનજગિત વિચાર નિયમથી તીવ્ર મિથ્યાત્વરૂપ જ છે, કારણ કે આ બધા વસ્તુસ્વરૂપથી વિરુદ્ધ છે.

આચાર્યશ્રી નેમિચંક્રસ્વામીએ ગોમ્મટસાર જીવકાંડ ગાથા - ૧૫માં મિથ્યાત્વ ગુણસ્થાનની પરિભાષા આ પ્રમાણે આપી છે -

**મિચ્છોદયેણ મિચ્છત્તમસદ્ધહણં તુ તત્ત્વ - અત્થાણં ।**

**એયંતં વિવરીયં, વિણયં સંસયિદમણાણં ॥**

દર્શનમોહનીય મિથ્યાત્વ કર્મના ઉદ્યના સમયમાં અર્થાત્ નિમિત્તથી થવાવાળા જીવના અતત્પત્રશ્રદ્ધાનરૂપભાવને મિથ્યાત્વ ગુણસ્થાન કહે છે.

જીવના મિથ્યાત્વ પરિણામમાં દર્શનમોહનીય કર્મના ત્રણ અર્થાત્ મિથ્યાત્વ, સમ્યક્મિથ્યાત્વ તથા સમ્યક્પ્રહૃતિરૂપ ભેદોમાંથી મિથ્યાત્વ દર્શનમોહનીય નામના ફ્રવ્યકર્મનો ઉદ્ય નિયમથી નિમિત્તરૂપ રહે છે અર્થાત્ જ્યારે જીવ મિથ્યાત્વ પરિણામથી પરિણામિત થાય છે, ત્યારે

મિથ્યાત્પ કર્મનો ઉદ્ય નિમિત્તઃપ હોય જ છે. માટે મિથ્યાત્પભાવને ઔદ્યિકભાવ પણ કહે છે. પરંતુ મિથ્યાત્પ કર્મ જીવને મિથ્યાક્રષિ બનાવે છે/કરે છે - એવું નથી. કર્મનો ઉદ્ય તો નિમિત માત્ર જ છે. અપરાધિઓ સ્વયં જીવનો જ છે.

આચાર્યશ્રી કુંદકુંદેવે “સમયસાર શાસ્ત્રની” ગાથા ૧૩૨માં જીવના અપરાધિનો બોધ કરાવતાં સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે –

“જીવનું જે તત્ત્વનું અજ્ઞાન છે (વસ્તુરૂપઃપથી અચથાર્થ / વિપરીત જ્ઞાન) તે અજ્ઞાનનો ઉદ્ય છે અને જીવનું જે તત્ત્વનું અશ્રદ્ધાન છે, તે મિથ્યાત્પનો ઉદ્ય છે.”

જ્યારે જીવ પોતાનો અપરાધ જોશે - જાણશે તો પોતાના અપરાધને દૂર કરવાનો પ્રયાસ કરશે. તેથી જે આત્મા પોતાનો દોષ સ્વીકાર કરે છે, તે જ પુરુષાર્થ કરી શકે છે/કરે છે. જે કર્મનો જ દોષ જાણતો - માનતો રહેશે, તે આત્મા સ્વાવલંબનઃપ સમ્યક્પુરુષાર્થ ક્યારેય કરી નહીં શકે.

જે જીવ આત્મામાં થવાવાળા મોહ-રાગ-ક્રેષાદિ વિકારીભાવોની ઉત્પત્તિમાં કર્મોના ઉદ્યને નિમિત્તઃપથી પણ નથી માનતો, તેની માન્યતા અનુસાર વિલાવ જ જીવનો સ્વભાવ થઈ જશે અને જે આ માની લે છે કે કર્મ જ વિકારનો કર્તા છે, આત્મા નહીં તે પણ કર્મોને જ આધીન થઈ ગયા. આવા જીવ સર્વજ્ઞ ભગવાનના ઉપદેશનું ચથાર્થ સ્વરૂપ ન જાણવાને કારણે જ્ઞાની નથી.

તેથી જીવ સ્વયં મિથ્યાત્પ તથા કોઇધાદિ વિલાવ ભાવોને કરવાવાળો અપરાધી છે. હા, જ્યારે જીવ અપરાધ કરે છે, ત્યારે કર્મનો ઉદ્ય તેમાં નિમિત અવશ્ય હોય છે. આ જ સાચી માન્યતા છે, આ જ ઉપાદાનમૂળક કથન છે.

શાસ્ત્રોમાં જ્યાં નિમિત્તની મુખ્યતા હોય છે, ત્યાં મિથ્યાત્પ કર્મના ઉદ્યથી મિથ્યાત્પભાવ થાય છે, એવું કથન જિનવાણીમાં મળે છે. પ્રથમાનુયોગ આદિ ત્રણે અનુયોગોમાં ઉપાદાનની મુખ્યતાથી કરેલા કથન ઘણાં ઓછા છે અને નિમિત્તની મુખ્યતાથી કરેલા કથન ઘણાં જ છે. માટે અજ્ઞાનીને એવો ભમ થઈ જાય છે કે નિમિત અર્થાત્ કર્મ જ જીવને બળજબરીથી વિકાર કરાવે છે.

જીવ પોતાના વિકારી અથવા અવિકારી પરિણામો કરવામાં પૂર્ણ સ્વતંત્ર છે, સ્વાધીન છે. આત્મા જ બળવાન છે, કર્મ બળવાન નથી. આ મહત્વપૂર્ણ વિષયને અહીં પ્રથમ ગુણસ્થાનના પ્રકરણામાં જ વિસ્તારપૂર્વક સ્પષ્ટ કરીએ છીએ, જેથી આગળના બધાં ગુણસ્થાનોમાં ચથાસ્થાન ચથાયોગ્ય સમજુ લેવું સુગમ થઈ જશે.

કરણાનુયોગની પદ્ધતિ નિમિત્તની મુખ્યતાથી કથન કરવાની હોય છે. તેથી તેની ભાષા જ એવી હોય છે કે, “મિથ્યાત્વ કર્મના ઉદ્દયથી/ નિમિત્તની બળવત્તાથી જ મિથ્યાત્વ ગુણસ્થાન થાય છે.” દ્યાન રહે, નિમિત્ત-નૈમિત્તિક સંબંધની અપેક્ષાથી કથન તો થાય છે, પરંતુ કાર્ય નહીં. કોઈપણ કર્મ કોઈપણ જીવને જબરદસ્તીથી કોધાઈ વિકારભાવ નથી કરાવતું. સદા વિકારરૂપ અધર્મ અને અવિકારરૂપ ધર્મ કરવામાં જીવ સંપૂર્ણ સ્વાધીન છે, સ્વતંત્ર છે, કર્મધીન નથી.

જ્યારે કર્મના ઉદ્દયથી જીવ, નીચેના ગયો ગયો કે વિકારી થઈ ગયો, એવું કથન વાંચવામાં કે સાંભળવામાં આવે તો સમજુ લેવું જોઈએ કે જીવ પોતાનાં અનાદિકાળના કુસંસ્કારોને કારણ પુરુષાર્થ હીનતાથી જ પતિત થયો છે, કર્મોએ કાંઈ નથી કર્યું. માત્ર તે કાળમાં કર્મનો ઉદ્ય હાજર હતો એટલું જ.

જ્યારે કર્મના અભાવથી વીતરાગતા વધી ગઈ, જીવને ઉપરના ગુણસ્થાનોની પ્રાપ્તિ થઈ, એવું કથન મળે તો ત્યાં એ સમજયું કે જીવને સ્વભાવના આશ્રયરૂપ વિશિષ્ટ પુરુષાર્થથી નવો વિશેષ ધર્મ પ્રગટ થયો છે.

લેદ - મિથ્યાત્વના પાંચ લેદ આ પ્રમાણે છે.

એકાંત, વિપરીત, વિનય, સંશય અને અજ્ઞાન તેની પરિભાષા :-

૧) જાતિની અપેક્ષાથી જીવાઈ છ ક્રિય અથવા સંખ્યાની અપેક્ષાથી અનંતાનંત ક્રિયોમાંથી પ્રત્યેક ક્રિય અનંતધર્મત્વમક હોવાથી અથવા પરસ્પર વિરોધી બે ધર્મત્વમક હોવા છતાંપણ તેને માત્ર એક ધર્મત્વમક માનવું તે એકાંત મિથ્યાત્વ છે. જેમ - ક્રિય નિત્ય જ છે અથવા અનિત્ય જ છે.

૨) પુણ્ય તથા શરીરાદિની કિયાઓથી જ મોક્ષ થઈ શકે છે એવું માનવું વિપરીત મિથ્યાત્વ છે.

૩) બધા ચથાર્થી તથા અચથાર્થી દેવ-શાસ્ત્ર-ગુરુ આપણા માટે વંદનીય

છે. તેની પૂજા, ભક્તિ, વિનય કરવો જોઈએ એવું માનવું તે વિનય મિથ્યાત્પ છે.

૪) વીતરાગતા ધર્મ છે કે પુણ્ય ધર્મ છે. એમ બંને પ્રકારના કથનોમાંથી કોઈપણ એક પક્ષનો નિશ્ચય ન હોવો તે સંશચ મિથ્યાત્પ છે.

૫) ન સ્વર્ગ છે, ન નરક છે, ન પાપ છે, ન પુણ્ય છે. માટે જાઓ-પીઓ અને મોજ કરો, એવી માન્યતાનું નામ અજ્ઞાન મિથ્યાત્પ છે.

૨. બીજુ અપેક્ષાએ મિથ્યાત્પના બે લેદ છે. અગૃહીત મિથ્યાત્પ અને ગૃહીત મિથ્યાત્પ. મિથ્યાત્પ કર્મના ઉદ્યના નિમિત્તથી સાત તત્પના વિષયમાં અનાદિકાળથી વિપરીત માન્યતાને અગૃહીત મિથ્યાત્પ કહે છે. જેમ કે અનાદિકાળથી દેહમાં આત્મબુદ્ધિ અને પુણ્યમાં ધર્મબુદ્ધિ.

(૧) અગૃહીત મિથ્યાત્પનો નાશ કરવા માટે જરૂરી-ચેતન અને સ્વભાવ-વિભાગના બેદજ્ઞાનપૂર્વક નિજ શુદ્ધાત્મ સ્વભાવનું જ્ઞાન તથા ભાન હોવું અત્યંત આવશ્યક છે. વાસ્તવમાં તો નિર્ધિકલ્પ રીતિથી નિજ શુદ્ધતમાનો સ્વીકાર થવો એ જ સમ્યકૃત્વની પ્રાસિનો અર્થાત् મિથ્યાત્પના ત્યાગનો એકમાત્ર યથાર્થ ઉપાય છે.

(૨) અનાદિકાળના અગૃહીત મિથ્યાત્પના પોષક કુટેય, કુગુર અને કુદ્ધર્મનું સેવન ગૃહીત મિથ્યાત્પ છે. જેમ કે - પોતાની મતિકલ્પનાથી રાગી-દ્રેષ્ણી દેવી-દેવતાઓને કલ્યાણકારક માની લેવા.

આ બંનેમાંથી પ્રથમ ગૃહીત મિથ્યાત્પનો ત્યાગ કરવો જરૂરી છે, કારણકે નવા અર્જિત સ્થૂળ(ગૃહીત) મિથ્યાત્પના ત્યાગ વગર અગૃહીત મિથ્યાત્પ પણ નથી છૂટતું. તથા અનાદિ સૂક્ષ્મ અગૃહીત મિથ્યાત્પના ત્યાગ વિના સમ્યકૃત્વની પ્રાસિ પણ નથી થઈ શકતી. સમ્યકૃત્વથી જ ધર્મનો પ્રારંભ થાય છે. .

ગૃહીત મિથ્યાત્પનો ત્યાગ કરવો મનુષ્યને પોતાને આધીન છે કારણ કે તેને પોતાના અજ્ઞાનભાવથી જ તેનો સ્વીકાર કર્યો છે. તેથી પોતાના જ્ઞાનભાવથી તે તેને છોડી પણ શકે છે.

રાગી-દ્રેષ્ણી દેવી-દેવતાઓને પોતાના હિતકર્તા કે અહિતકર્તા માની લેવું, પોતાની જ અજ્ઞાનતાનું પ્રદર્શન છે. તર્કશીલ વ્યક્તિ ગૃહીત મિથ્યાત્પને સહજ જ છોડી શકે છે.

૩. કિયાવાઈ, અકિયાવાઈ, અજ્ઞાનવાઈ અને પૈનયિકના ભેદથી પણ મિથ્યાત્પના ચાર લેંડ છે અને તેના પ્રલેંડ ૩૬૩ છે.

**મિથ્યાત્પનો શબ્દાર્થ :** મિથ્યાત્પન શબ્દનો અર્થ છે વિપરીતતા, અસત્યપણું. શ્રદ્ધા - જ્ઞાન તથા ચારિત્રગુણના વિપરીત પરિણામનને જ અહીં મિથ્યાત્પન કહ્યું છે. વિપરીત શબ્દનો અર્થ ઊંઘું, પસ્તુસ્પર્ષપથી વિરુદ્ધ છે. પ્રત્યેક આત્મામાં અનંત ગુણ છે. તેમાંથી મોક્ષમાર્ગમાં શ્રદ્ધા, જ્ઞાન તથા ચારિત્ર આ ત્રણ ગુણ જ મુજબ માનવામાં આપે છે, કારણ કે આમાં જ સમ્યક્ષપણું થવાથી મોક્ષમાર્ગ પ્રગટ થાય છે અને આના જ વિપરીત પરિણામનથી અજ્ઞાનીને અનાદિકાળથી સંસારમાર્ગ વર્તી રહ્યો છે.

જ્યાં એક જ અર્થાત્ શ્રદ્ધાગુણનું સમ્યક્ પરિણામન થયું, ત્યાં જ અન્ય બંને જ્ઞાન-ચારિત્ર ગુણોનું તથા અનંતગુણોનું પણ નિયમથી સમ્યક્ જ પરિણામન થઈ જાય છે. આ ભાવને મોક્ષમાર્ગ પ્રકાશક ગ્રંથના સાતમાં અદ્યાયના મંગલાચરણમાં સ્પષ્ટ કર્યું છે, જે આ પ્રકારે છે :-

ઇસ ભવતતૃ કા મૂલ ઈક, જાનહુ મિથ્યાભાવ,

તાકો કરિ નિર્મૂલ અબ, કરિએ મોક્ષ ઉપાવ ॥૧॥.

આ દોહામાં પ્રયુક્ત મિથ્યાભાવ શબ્દ મિથ્યાત્પના જ અર્થમાં આવ્યો છે, જે શ્રદ્ધા-જ્ઞાન-ચારિત્ર ત્રણે ગુણોની વિપરીતતાને પ્રકાશિત કરે છે. આ પ્રકારે સમ્યક્ષત્વ શબ્દ પણ શ્રદ્ધા-જ્ઞાન-ચારિત્ર ત્રણે ગુણોના સમ્યક્ પરિણામનના અર્થમાં જ પ્રયુક્ત થયો છે.

**ચારિત્ર અપેક્ષા વિચાર :** આ પ્રથમ મિથ્યાત્પન ગુણસ્થાનમાં ચારિત્ર ગુણનું પરિણામન નિયમથી વિપરીત જ થાય છે. તેથી અહીં મિથ્યા ચારિત્ર જ છે. શ્રદ્ધાગુણના વિપરીત પરિણામનને લીધે જ ચારિત્રગુણનું વિપરીત પરિણામન થાય છે. આનો અર્થ શ્રદ્ધાગુણનું વિપરીત પરિણામન નિમિત્ત અને ચારિત્રગુણનું વિપરીત પરિણામન નૈમિત્તિક. આ અપેક્ષાથી આ કથન સત્ય હોવા છતાં પણ માત્ર મિથ્યા શ્રદ્ધાએ જ ચારિત્રને મિથ્યા નથી બનાવ્યો.

મિથ્યાચારિત્રના પરિણામનમાં ઉપાદાનકારણ ચારિત્ર ગુણની આપણી પોતાની તત્ત્વમયની યોગ્યતા પણ તેવી જ હોય છે.

જેમ કે - ચારિત્ર ગુણના સંબંધમાં કહ્યું છે, તેમ જ જ્ઞાનાદિ સર્વેગુણોના

પરિણામનમાં પણ સમજુ લેવું જોઈએ.

**કાળ અપેક્ષા વિચાર:** મિથ્યાત્પનો કાળ આનો અર્થ છે, જેટલા સમય સુધી જીવ મિથ્યાક્રષિ થતો થકો રહે છે, તે મિથ્યાત્પનો કાળ છે.

(૧) જઘન્ય કાળ: મિથ્યાત્પનો જઘન્યકાળ અંતર્મુહૂર્ત ત્યારે થઈ શકે છે, જ્યારે કોઈ સમ્યક્ક્રષિ સમ્યક્કૃત્વથી ચ્યુત થઈને મિથ્યાત્પી થઈ જાય છે અને અંતર્મુહૂર્તના કાળ સુધી મિથ્યાત્પ પરિણામની સાથે જીવન પિતાવી ફરીથી સમ્યક્ક્રષિ થઈ જાય છે. આ અંતર્મુહૂર્ત કાળને મિથ્યાત્પ ગુણસ્થાનનો જઘન્ય કાળ કહે છે.

આ ગુણસ્થાનમાં કોઈ જીવ એક, બે આદિ સમયથી લઇને સંખ્યાત અસંખ્યાત સમય સુધી રહેતો જ નથી. જો મિથ્યાત્પમાં આવ્યો છે તો તેને ઓછામાં ઓછા એક અંતર્મુહૂર્ત કાળ સુધી રહેવું અનિવાર્ય છે, કારણ કે મિથ્યાત્પથી છૂટીને ફરીથી સમ્યક્કૃત્વ પ્રાપ્ત કરવામાં ઓછામાં ઓછો એક અંતર્મુહૂર્ત કાળનો પુરુષાર્થ આવશ્યક છે.

(૨) ઉત્કૃષ્ટ કાળ: સાદિ મિથ્યાક્રષિની અપેક્ષા એ જો મિથ્યાત્પ ગુણસ્થાનના ઉત્કૃષ્ટકાળનો વિચાર કરીએ તો મિથ્યાત્પ ગુણસ્થાનનો ઉત્કૃષ્ટકાળ કિંચિતન્યૂન અર્દ્ધપુરુષ પરાવર્તન માત્ર છે.

જ્યારે કિંચિતન્યૂન અર્દ્ધપુરુષ પરાવર્તનકાળમાંથી માત્ર અંતર્મુહૂર્ત કાળ શેષ રહી જાય છે, ત્યારે આ જીવ ફરી પુરુષાર્થ કરી સમ્યક્કૃત્વ અને સંયમને ચુગપદ ધારણ કરી શૈણી માંડી કેવળજ્ઞાન પ્રાપ્ત કરી સિદ્ધ ભગવાન થઈ જાય છે, એવો નિયમ છે.

(૩) મદ્યમ કાળ: મિથ્યાત્પ ગુણસ્થાનનો યથાચોર્ય જઘન્યકાળ અંતર્મુહૂર્તમાં એક સમય, બે, ત્રણ, ચાર આદિ સમય મળીને અનેક લેદ થઈ શકે છે. પછી બે, ત્રણ, ચાર અંતર્મુહૂર્ત અને તેમાં પણ એક-બે આદિ સમય મળીને મદ્યમકાળના અનેક પ્રકાર થઈ શકે છે. આ રીતે કિંચિત ન્યૂન અર્દ્ધપુરુષ પરાવર્તનકાળ સુધી જેટલા પણ કાળના લેદ થઈ શકે છે, તે સર્વ મિથ્યાત્પ ગુણસ્થાનનાં મદ્યમકાળના લેદ સમજવા જોઈએ.

(૪) અનાદિ અનંતકાળ: અભવ્ય જીવના મિથ્યાત્પલાવનો કયારેય નાશ જ નથી થઈ શકતો, માટે અભવ્યોની અપેક્ષાથી મિથ્યાત્પ ગુણસ્થાનનો કાળ અનાદિ અનંત છે.

અનેક ભવ્યજીવોની અપેક્ષાથી પણ મિથ્યાત્વ ગુણસ્થાનનો કાળ અનાદિ - અનંત છે. અનાદિકાળથી પણ ભવ્યજીવોને પણ મિથ્યાત્વ ગુણસ્થાન છે અને ભવ્યોથી પણ ક્યારેય સંસાર ખાતી નહીં થાય. આ અપેક્ષાથી મિથ્યાત્વનો કાળ અનંત કહેવો આગમ સંમત છે.

**પ્રશ્ન ૧૦ :-** ભવ્યજીવોના મિથ્યાત્વનો કાળ અનંત કેવી રીતે ?

**ઉત્તર :-** આગમ અનુસાર આ સંસાર ક્યારેય ભવ્યજીવોથી રહિત નથી થતો. તેથી અનેક ભવ્ય જીવોની અપેક્ષાએ મિથ્યાત્વનો કાળ અનાદિ-અનંત સિદ્ધ થાય છે.

બીજુ એક અપેક્ષા આ પણ છે કે દૂરાનુદૂર ભવ્ય, અભવ્યની સમાન જ હોય છે. તેઓને ક્યારેય મોક્ષ કે મોક્ષમાર્ગ પ્રાપ્ત થતો જ નથી. માટે પણ મિથ્યાત્વ ગુણસ્થાનનો કાળ અનાદિ-અનંત સિદ્ધ થાય છે.

**(૫) અનાદિ સાંત કાળ :** એક ભવ્ય જીવની અપેક્ષાએ કાળ અનાદિ સાંત છે. આનો અર્થ -કોઈ ભવ્ય જીવ અનાદિથી મિથ્યાત્વ ગુણસ્થાનમાં રહે છે. આ અપેક્ષાથી ભવ્ય જીવના મિથ્યાત્વનો કાળ અનાદિ થઈ ગયો. હવે તે ભવ્ય જીવ જ્યારે પોતાના નિજ શુદ્ધાત્માનો આશ્રય કરી સમ્યકૃત્વી થાય છે, ત્યારે તેના મિથ્યાત્વનો નિશ્ચિત જ નાશ થઈ જાય છે. આ અપેક્ષાથી ભવ્ય જીવના મિથ્યાત્વનો કાળ સાંત થઈ ગયો. આ રીતે એક ભવ્ય જીવનો મિથ્યાત્વનો કાળ અનાદિસાંત સિદ્ધ થઈ ગયો.

**(૬) સાદિ- સાંત કાળ :** સૂક્ષ્મતાથી વિચાર કરીએ તો પ્રત્યેક પર્યાયનો કાળ એક સમયનો જ હોય છે. આ અપેક્ષાથી મિથ્યાત્વ પરિણામ સમ્યે-સમ્યે બદલતા જ રહે છે. આ ક્રષ્ણિથી પર્યાય અપેક્ષા અર્થાત્ સૂક્ષ્મ અજુઝુત્ત્રનયની અપેક્ષાએ મિથ્યાત્વ પરિણામનો કાળ એક સમય જ છે. માટે મિથ્યાત્વ પરિણામ સાદિ સાંત પણ છે.

**ગમનાગમન અપેક્ષા વિચાર :** ગમન શબ્દનો અર્થ છે જધું અને આગમન શબ્દનો અર્થ છે આવધું. જીવના એક ગુણસ્થાનથી બીજા ગુણસ્થાનમાં જવાં-આવવાનાં અર્થમાં ગમનાગમન શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે. સર્વ ગુણસ્થાનોમાં ગમનાગમન શબ્દનો અર્થ આમ જ સમજવો જોઈએ.

**ગમન :** (૧) મિથ્યાત્વ ગુણસ્થાનવર્તી ક્રવ્યલિંગી મુનિરાજ જો વધારેમાં વધારે પુરુષાર્થ કરી સીધા ઉપરના ગુણસ્થાનમાં જશે તો તે સાતમાં અપ્રમતસંયત ગુણસ્થાનમાં જઈ શકે છે. અર્થાત્ પહેલી જ વારમાં તે

અકદા ગુણસ્થાનોને પાર કરી જાય છે, કારણ કે કુલ મળીને ગુણસ્થાન ચૌં જ છે અને તેઓએ તો પ્રથમ વારમાં જ સાતમું અપ્રમત્તવિરત ગુણસ્થાન પ્રાસ કરી લીધું છે.

સાઈ કે અનાઈ મિથ્યાક્રષ્ટિ હોવા છતાં પણ જે મિથ્યાક્રષ્ટિ દ્રવ્યલિંગી મુનિરાજ હોય, તે પોતાના નિજ શુદ્ધાત્માના આશ્રય કરવાનો વિશિષ્ટ પુરુષાર્થ કરવાથી તથા બાધક કર્મોના ઉદ્યનો અભાવ થવાથી અપ્રમત્તસંયત ગુણસ્થાનમાં પ્રવેશ કરે છે. તે સાતિશાય પુરુષાર્થી મુનિરાજ પ્રથમ સમયમાં તો મિથ્યાક્રષ્ટિ હતાં અને બીજા જ સમયમાં મિથ્યાત્વ કર્મ તથા મિથ્યાત્વ પરિણામનો નાશ થવાથી તે જ સમય તે અનંતાનુંબંધી ચતુર્ષય, અપ્રત્યાખ્યાનાવરણ ચતુર્ષય અને પ્રત્યાખ્યાનાવરણ ચતુર્ષય કર્મોના ઉદ્યાભાવી ક્ષય થવાથી અર્થાત્ વીતરાગતા પ્રગટ થવાને લીધે ભાવલિંગી મુનિરાજ થઈ જાય છે. હવે તો માત્ર ચારિત્રમોહનીયમાંથી સંજ્વલન કષાય ચોકડી અને નવ નોકષાય કર્મનો ઉદ્ય તથા તજ્જન્ય પરિણામ જ શેષ રહી ગયા છે.

(૨) કોઈ પ્રથમ ગુણસ્થાનવતી દ્રવ્યલિંગી મુનિરાજ મિથ્યાત્વ તથા ત્રણ કષાય ચોકડીનો અભાવ ન હોવા છતાં પણ નિજ શુદ્ધાત્માના દ્વારાનરૂપ પુરુષાર્થી આ મિથ્યાત્વ ગુણસ્થાનથી સીધા પાંચમા વિરત-અવિરત ગુણસ્થાનમાં પણ ગમન કરી શકે છે.

(૩) અથવા કોઈ દ્રવ્યલિંગી શ્રાવક પ્રથમ ગુણસ્થાનથી શુદ્ધ આત્માના અવલંબનના બળથી સીધા પાંચમા વિરતાવિરત ગુણસ્થાનવતી થઈ જાય છે.

(૪) કોઈ દ્રવ્યલિંગી મુનિરાજ, દ્રવ્યલિંગી શ્રાવક અથવા અપ્રતી ભક્ત મિથ્યાક્રષ્ટિ જીવ મિથ્યાત્વ ગુણસ્થાનથી અવિરતસમ્યકૃત્વ ગુણસ્થાનમાં જઈ શકે છે.

(૫) કોઈ સાઈ મિથ્યાક્રષ્ટિ દ્રવ્યલિંગી મુનિરાજ, દ્રવ્યલિંગી શ્રાવક અથવા ભક્ત મિથ્યાક્રષ્ટિ હોય તો તે મિથ્યાત્વ ગુણસ્થાનથી ત્રીજા મિશ્ર ગુણસ્થાનમાં પ્રવેશ કરી શકે છે.

પ્રશ્ન ૧૧ :- આપે ત્રીજા ગુણસ્થાનમાં પ્રવેશ કરવાના માટે સાઈ મિથ્યાક્રષ્ટિ, આ વિશેષણ શા માટે લગાડ્યું ? શું કોઈ અનાઈ મિથ્યાક્રષ્ટિ ત્રીજા ગુણસ્થાન માં પ્રવેશ નહીં કરે ?

**ઉત્તર :-** અનાઈ મિથ્યાક્રષિ પાસે સમ્યક્મિથ્યાત્વ દર્શનમોહ કર્મની સત્તા જ નથી. તેથી તે ત્રીજા ગુણસ્થાનમાં પ્રવેશ નથી કરી શકતો. સમ્યક્ષુટ્વની ઉત્પત્તિથી પ્રથમ સમયમાં મિથ્યાત્વના ત્રણ ટુકડા થવાનો નિયમ છે.

**પ્રશ્ન ૧૨ :-** મિથ્યાત્વ ગુણસ્થાનની કોઈ જીવ સાતમાંમાં, કોઈ પાંચમાંમાં, કોઈ ચોથામાં અથવા કોઈ ત્રીજા ગુણસ્થાનમાં ગમન કરે છે, એવો લેદ કેમ/કેવી રીતે થાય છે ?

**ઉત્તર :-** પ્રત્યેક જીવની પોત-પોતાની પાત્રતા બિજ્ઞ-બિજ્ઞ હોય છે. ત્રિકાળી શુદ્ધધાત્માનો આશ્રય કરવારૂપ પુરુષાર્થ પણ વધ-ઘટ (વત્તો ઓછો) હોય છે. ઉદ્યમાં આવવાવાળા કર્મ પણ બિજ્ઞ-બિજ્ઞ જ હોય છે. ભવિતવ્ય પણ સ્વતંત્ર હોય છે. કોઈ જીવ કોઈ બીજા જીવના, પુદ્ગલાદિના અથવા ભગવાનને પણ આધીન નથી. માટે તેના ગુણસ્થાનમાં ગમનરૂપ કાર્ય પણ સ્વતંત્ર રીતે પર્યાયિત થોરયતા અનુસાર થતું રહે છે.

એક જ સમવશરણા (ધર્મસભા)માં દેવ-મનુષ્ય-તિર્યંચ ત્રણે ગતિના જીવ એક જ તીર્થકર ભગવાનનો ઉપદેશ શ્રવણ કરે છે, છતાંચ તે શ્રોતાઓમાં પણ તેમની પોત-પોતાની પાત્રતા અનુસાર જ તે મહાગ્રંથ કે અણુપતને ગ્રહણ કરે છે, સમ્યક્ષર્ણનાની પ્રાસિ કરે છે અથવા ત્રીજા ગુણસ્થાનને પાત્ર બને છે કે અંતરંગમાં તત્ત્વનો વિરોધ કરે છે. આથી પ્રત્યેક ક્રાંતિ, ગુણ અને પર્યાયની સ્વતંત્રતા સિદ્ધ થાય છે.

**પ્રશ્ન ૧૩ :-** ક્રાંતિલિંગી મુનિરાજના કેટલા લેદ છે ?

**ઉત્તર :-** ક્રાંતિલિંગી મુનિરાજને મુખ્યપણે ત્રણ લેદ છે.  
(૧) મિથ્યાત્વ ગુણસ્થાનવર્તી ક્રાંતિલિંગી, (૨) ચતુર્થ ગુણસ્થાનવર્તી ક્રાંતિલિંગી તથા (૩) પંચમ ગુણસ્થાનવર્તી ક્રાંતિલિંગી.

પહેલા, ચોથા તથા પાંચમાં ગુણસ્થાનવર્તીની ક્રાંતિલિંગી કહે છે. તેને માટે ધવલા પુસ્તક - ૪ પાના નં. ૨૦૮ પર સ્પષ્ટ ખુલાસો આવ્યો છે, તેનું અપલોકન કરો. તેનું સંક્ષેપમાં કથન આ પ્રમાણે છે - “સમાધાન - આ કોઈ દોષ નથી, કારણ કે છતાંચ નવત્રૈવેચકોમાં ક્રાંતિલિંગી મિથ્યાક્રષિ, અસંયતસમ્યક્ષર્ણિ અને સંયતાસંયત જીવ ઉત્પણ થાય છે.”

આ વિષય ત્રિલોકસાર ગાથા પરિપમાં પણ આવેલ છે. ત્યાં ક્રાંતિલિંગીને

નિર્ગ્રીથ શબ્દ છારા સંબોધેલ છે.

ભાવપાહુક ગાથા રેમાં ૧૦૫ કૃષ્ણલલક્ષ્મી સહજાનંદજી વણીએ પ્રવચનોમાં પ્રથમ ગુણસ્થાનથી પાંચમાં ગુણસ્થાન સુધીના પાંચેચ ગુણસ્થાનોમાં દ્રવ્યલિંગી મુનિપણાનો સ્વીકાર કરેલ છે. (પાના નં. ૩૦૩)

સાસાદન અને ભિશ ગુણસ્થાનવતીને પણ દ્રવ્યલિંગી મુનિરાજ કહી શકીએ છીએ, પરંતુ આ બંને ગુણસ્થાનોનો કાળ ધણો થોડો હોવાને લીધે દ્રવ્યલિંગીઓમાં તેઓને મુખ્યતાથી લેવામાં નથી આવ્યા.

ઇઝા ગુણસ્થાનવતીને જે દ્રવ્યલિંગ હોય છે, તે દ્રવ્યલિંગ ભાવલિંગની સંગાથે હોય છે. તેથી તેમને શાસ્ત્રમાં દ્રવ્યલિંગીની સંજ્ઞા નથી અપાઈ, કારણે તે દ્રવ્યલિંગ ભાવલિંગની સાથે સુમેળવાનું છે. વાસ્તવિક રીતે વિચારીએ તો ચૌદમાં ગુણસ્થાનના અંતિમ સમય સુધી દ્રવ્યલિંગ રહે છે.

પ્રશ્ન ૧૪ :- પરિણામોથી જે જીવ ચોથા અને પાંચમાં ગુણસ્થાનવતી છે, તે જીવ સમ્યક્ફક્ષણી તો છે જ અને બાહ્યમાં ર૮ મૂળગુણોનું નિરતિચાર પાલન પણ કરે છે, છતાં પણ આપે તેમને દ્રવ્યલિંગી શા માટે કહ્યા ?

ઉત્તર :- અંતરંગમાં અર્થાત્ પરિણામોથી ચતુર્થ ગુણસ્થાનવતી અવિરત સમ્યક્ફક્ષણી તથા પંચમ ગુણસ્થાનવતી અને બાહ્યમાં ર૮ મૂળગુણોનાં પાલન કરવાવાળા ભાવલિંગી નથી હોતાં, કારણ કે તેઓને આત્માનુભૂતિરૂપ સમ્યક્ફક્ષણની સાથે ત્રણ કષાય ચોકડીના અનુદ્યપૂર્વક ઉત્પન્ન વીતરાગતારૂપ શુદ્ધતા નથી હોતી. માટે તેઓને દ્રવ્યલિંગી કહ્યા છે. દ્રવ્યલિંગીનો અર્થ સર્વત્ર મિદ્યાદ્રષ્ટિ નથી થતો.

પ્રશ્ન ૧૫ :- આવા દ્રવ્યલિંગી મુનિરાજ સાથે સાચા શ્રાવકે કેવો વ્યવહાર રાખવો જાઈએ ?

ઉત્તર :- જો ર૮ મૂળગુણોનું આચરण આગમાનુસાર હોય તો દ્રવ્યલિંગી મુનિરાજની સાથે પણ ક્ષાયિક સમ્યક્ફક્ષણી તથા પંચમ ગુણસ્થાનવતી શ્રાવકે નમસ્કારાદિ વિનય વ્યવહાર તથા આહારદાન આદિ ક્રિયાઓ હાઈક પરિણામોથી કરવી જોઈએ, કારણ કે નમસ્કારાદિ વ્યવહાર છે અને મુનિરાજના પ્રતાંતું પાલન પણ વ્યવહાર છે. સૂક્ષ્મ અંતરંગ પરિણામોનો ખ્યાલ પણ નથી આવી શકતો, કારણ કે તે તો કેવળજ્ઞાનગમ્ય જ હોય છે. વ્યવહારી જનોને માટે દ્રવ્યલિંગી પણ પૂજ્ય છે.

(યોગસાર પ્રાભૂત અ. પ, શ્લોક - ૨૪૫, મોક્ષમાર્ગ પ્રકાશક પાના નં ૨૮૩-૨૮૪)

આગમન : (૧) પ્રમત્સંયત ગુણસ્થાનવર્તી ભાવલિંગી સંત પણ અનારોકાળના કુસંસ્કારોના ફરીથી પ્રગટ થવાથી વિપરીત પુરુષાર્થી નિજ શુદ્ધાત્માનું અવલંબન છુટવાથી તથા નિમિત્તઝપમાં ચથાયોગ્ય કર્મોનો ઉદ્ય આવવાથી સીધા મિથ્યાત્વ ગુણસ્થાનમાં આવી શકે છે.

(૨) પંચમ ગુણસ્થાનવર્તી વિરતાવિરત શાબક તથા પંચમ ગુણસ્થાનવર્તી ફ્રવ્યલિંગી મુનિરાજ પણ પોતાના હીએ પુરુષાર્થીઝપ અપરાધથી તથા તે જ સમય નિમિત્તઝપમાં ચથાયોગ્ય કર્મોના ઉદ્યથી સીધા મિથ્યાત્વ ગુણસ્થાનમાં આવી શકે છે.

(૩) ક્ષાયિક સમ્યક્ષ્રાણિને છોડી અન્ય બંને ઔપશમિક તથા ક્ષાયોપશમિક અવિરત સમ્યક્ષ્રાણિ જીવની જ્યારે શુદ્ધાત્માન વિપરીતતા આવે છે, તેમજ તે જ સમયે મિથ્યાત્વનો ઉદ્ય આવવાથી તે જીવ સીધો મિથ્યાત્વ ગુણસ્થાનમાં આવી શકે છે.

(૪) મિશ્ર ગુણસ્થાનવર્તી પણ મિથ્યાત્વમાં આવી શકે છે.

(૫) સાસાદન સમ્યક્ષ્રાણિ તો મિથ્યાત્વ ગુણસ્થાનમાં આવે જ છે.

પ્રશ્ન ૧૬ :- મિથ્યાત્વ ગુણસ્થાનવર્તી જીવ કઈ સાધના ફ્રારા અવિરત સમ્યકૃત્વ આદિ ઉપરના ગુણસ્થાનોને પ્રાપ્ત કરે છે ?

ઉત્તર :- મિથ્યાફ્રાણિ જીવ સ્વ-પર બેદજાનપૂર્વક પોતાના ત્રિકાળી નિજ શુદ્ધાત્માના આશ્રયઝપ મહાન અપૂર્વ પુરુષાર્થી દર્શનમોહારિ કર્મોનો પણ અભાવ થવાથી સમ્યક્ષર્ણનાદિ પ્રાપ્ત કરી લે છે. આ પ્રકારે મિથ્યાત્વ ગુણસ્થાનવર્તી સાધક ઉપરના ગુણસ્થાનોને પ્રાપ્ત કરે છે.

પ્રશ્ન ૧૭ :- મુનિરાજ પ્રમત્સંયત ગુણસ્થાનથી મિથ્યાત્વ ગુણસ્થાનમાં આવતાં જ શું કપડાં પહેરી લે છે ? શું પોતાના ઘરમાં ચાત્યા જાય છે ? અથવા સરાગી દેવની શુદ્ધા કરવા લાગે છે ?

ઉત્તર :- ભાઈ સાહેબ ! ગુણસ્થાનની પરિભાષાનું આપ ફરી અવલોકન કરશો તો સમજશે કે મોહ અને યોગના નિમિત્તથી શુદ્ધા અને ચારિત્રગુણની અવસ્થાઓ/પર્યાયોને ગુણસ્થાન કરે છે. ત્યાં કપડાં આદિ બાધ્ય પરિણામે ગ્રહણ કરવાની વાત જ ક્યાંથી આવી ?

અંદરને અંદર અર્થાત્ મોહોદ્યથી અબુદ્ધિપૂર્વક શુદ્ધા તથા ચારિત્ર ગુણોના પરિણમનમાં વિપરીતતા આવી ગઈ છે. પરિણામોની શિથિલતાથી ગુણસ્થાન ઉત્તરી ગયું છે. તત્કાલ તે પોતાને બુદ્ધિપૂર્વક સંભાળવાનો

પ્રયાસ ક્રે છે. બીજાને કિંચિત્માત્ર ખબર પણ ન પડે, એટલામાં તો તે ફીથી સાતમાં ગુણસ્થાનમાં પણ પ્રવિષ્ટ થઈ પૂર્વ અનુભૂત અપૂર્વ આત્માનંદનો રસાસ્વાદન પણ કરવા લાગે છે.

તેઓ મહાપુરુષ છે, અલૌકિક મહામાનવ છે. એવી અવસ્થામાં તેઓને કપડાં પહેરવાનો તથા ઘરે જવાનો તથા ખોટા દેવોની આરાધનામાં જોડાવાનો ભાવ પણ આવતો નથી.

કોઈ સાધારણ સાઈકલ સવાર જ્યારે સાઈકલ ચલાવતાં પડી જાય છે તો તરત ઉઠવાની કોશિશ કરે છે કે ત્યાં જ ગાદલો લઈને સૂઈ જાય છે?

**પ્રશ્ન ૧૮ :-** અપ્રમતાએ ઉપરીમ ગુણસ્થાનોથી સીધા જ મિથ્યાત્વ ગુણસ્થાનમાં પ્રવેશ કેમ નથી થતો ?

**ઉત્તર :** - શુદ્ધોપયોગરૂપ અપ્રમત ગુણસ્થાનોથી પ્રમતસંયત ગુણસ્થાનમાં જ મુનિરાજનું આગમન થાય છે. ત્યારપછી જ અનેક માર્ગથી નિયલા ગુણસ્થાનમાં ગમન/પતન થાય છે. શુદ્ધોપયોગપૂર્વક શુભોપયોગરૂપ છઢા ગુણસ્થાનની પ્રાસિનો એવો જ નિયમ છે.

પ્રમતસંયતથી સીધા મિથ્યાત્વ ગુણસ્થાનમાં દરેક મુનિરાજનું આવવું આવશ્યક નથી. છઢાથી પાંચમામાં, ચોથામાં, ત્રીજામાં અને ઔપશમિક સમ્યક્ષક્રિય પ્રમતસંયત હોય તો બીજમાં તથા ક્ષાયિકસમ્યકૃત્વી ન હોય તો પહેલા ગુણસ્થાનમાં પણ આવી શકે છે. ક્ષાયિક સમ્યક્ષક્રિય મુનિરાજ ચોથા ગુણસ્થાન સુધી જ આવી શકે છે, તેનાથી નીચે નહીં. વિશેષ અપેક્ષા વિચાર : (૧) એકેન્દ્રિયથી અસંજી પંચેન્દ્રિય સુધી તથા લબ્ધપર્યાસ સંમૂહીએ મળુષ્ય જીવ મિથ્યાક્રિય જ હોય છે અને તે સમ્યક્ષદર્શનની પ્રાસિ પણ પોતાના આ જીવનમાં કરી શકતા નથી.

**પ્રશ્ન ૧૯ :-** સંજી જીવ જ સમ્યકૃત્વને પામી શકે છે, એવો નિયમ શા માટે ? તેનું સ્પષ્ટીકરણ કરો.

**ઉત્તર :-** સંજી જીવ મન સહિત હોય છે. મનના માદ્યમથી જ જીવ હિતાહિતનો વિચાર કરી શકે છે. તત્ત્વના સૂક્ષ્મ વિચારથી પ્રગટ થવાવાળો સમ્યકૃત્વરૂપ મોક્ષમાર્ગ મન વગર નથી થઈ શકતો.

આ વિષયનું સ્પષ્ટીકરણ કાતિક્યાનુપ્રેક્ષા ગાથા-૩૦૭માં નિમ્ન રીતે આવેલ છે. મૂળ ગાથા તથા પં. જ્યથયંદજુ છાબડાકૃત અર્થ આ પ્રમાણે છે -

## ચદુગદિભવ્વોસણી, સુવિસુદ્ધો જગમાળાપજતો । સંસારતડે ણિયડો, ણાણી પાવેડ સમ્મતં ॥

“પહેલા તો ભવ્ય જીવ હોય, કારણ કે અલબ્યને સમ્યકૃત્વ થઈ શકતું નથી. ચારેય ગતિઓમાં સમ્યકૃત્વ ઉત્પન્ન થાય છે. પરંતુ મન સહિત(સંઝી) ને જ ઉત્પન્ન થાય છે. અસંઝીને ઉત્પન્ન નથી થઈ શકતું. તેમાં પણ વિશુદ્ધ પરિણામી હોય, શુભલેશ્યા<sup>૧</sup> સહિત હોય, અશુભલેશ્યાઓ<sup>૨</sup>માં પણ શુભલેશ્યાઓની જેમ કષાયોના સ્થાન હોય છે, તેને ઉપચારથી વિશુદ્ધ કહે છે. સંકલેશ પરિણામોમાં સમ્યકૃત્વ ઉત્પન્ન નથી થતું. જાગૃત અવસ્થામાં થાય છે, સૂતેલાને નથી થતું. પર્યાસ ને થાય છે, અપર્યાસ અવસ્થામાં નથી થતું. સંસાર નો ડિનારો જેણી નજીદીક આવી ગયો છે, જે નિકટભવી છે, જેણું અર્ધપુદ્ગાલ પરાવર્તનકાળથી વધારે સંસાર ભમણ બાકી હોય, તેને સમ્યકૃત્વ ઉત્પન્ન નથી થતું. જાણી હોય અર્થાત् સાકાર ઉપયોગવાન હોય, નિરાકાર દર્શન ઉપયોગીને સમ્યકૃત્વ ઉત્પત્ત નથી થતું. એવા જીવોને સમ્યકૃત્વની ઉત્પત્તિ થાય છે.”

(૨) મિથ્યાત્વ ગુણસ્થાનવર્તી બધા જીવ બહિરાત્મા જ છે. આત્માને આત્મા ન માની શરીરાદિ પરવસ્તુઓમાં જે મમત્વાદિ કરે છે, તેને બહિરાત્મા કહે છે. પ્રથમ ત્રણ ગુણસ્થાનવર્તી બધા બહિરાત્મા જ છે. બહિરાત્મા નિયમથી દુઃખી તો છે જ, તેઓને પાપી પણ કહે છે.

(૩) કુદેવ-કુગુરુ-કુશાસ્ત્રના ઉપાસક બધા ગૃહીત મિથ્યાક્રષિ જ હોય છે. રાગી -ક્લેધી દેવી-દેવતાઓના કોઈ લક્તનો વિશેષ પુણ્યોદય હોય અને વચનાદિ ચતુરાઇથી બાહ્રમાં કુવેશ ધારણ કરીને અનેક લોકોનો ગુરુ બની ગયો હોય, હજારો અને લાખો મોટા ધનવાન, રાજાદિક પણ તેના અનુયાયી થઈ ગયા હોય, તો પણ સર્વજ્ઞ ભગવાનની આજ્ઞા અનુસાર તે મિથ્યાક્રષિ, પાપી, બહિરાત્મા, સંસારમાર્ગ જ છે. એવા ગુરુ નામદારી લોકોના પ્રભાવમાં આવવું મિથ્યાત્વભાવનું સ્પષ્ટ પોષણ કરવું જ છે.

દયા, સજ્જનતા, પરોપકાર, દેશસેવા તથા સામાજિક કાર્ય ઈત્યાદિ લૌકિક કારણોથી સમાજમાં શ્રેષ્ઠ થઈ જવું, યશ પ્રાપ્ત કરી લેવો અલગ

<sup>૧-૨</sup> શુભ લેશ્યા હોય તો વર્ધીમાન અને અશુભ લેશ્યા હોય તો હીંયમાન હોયો જોઈએ.

વાત છે અને તત્ત્વજ્ઞ થઈ મોક્ષમાર્ગી થઈ જવું અલગ વાત છે. આત્માથી, ધર્મમાર્ગને લૌકિક ચશ-પ્રતિષ્ઠા આદિથી કાંઈ પણ સંબંધ નથી.

લૌકિકમાં અતિશય મહાન વ્યક્તિ મિથ્યાબ્રહ્મિ હોઈ શકે છે અને સમજામાં જેને કોઈ ઓળખતું પણ નથી, એકદમ ઉપેક્ષિત હોય, તે પણ મોક્ષમાર્ગી હોઈ શકે છે. સંક્ષેપમાં એટલું સમજુ લેવું જોઈએ કે પૂર્વબદ્ધ પુણ્યોદયના કારણમાત્રથી કોઈ ઘાર્મિક નથી થઈ શકતો.

(૪) મિથ્યાબ્રહ્મિ મજુષ્ય ગર્ભકાળ સહિત આઠ વર્ષ સુધી મિથ્યાત્વ નષ્ટ કરવામાં અસમર્થ રહે છે. સંઝી, પંચેન્દ્રિય, પર્યાપ્ત તથા સંમૂહીર્ભ તર્યારી અંતર્મુહૂર્ત સુધી મિથ્યાત્વ નષ્ટ કરવામાં અસમર્થ રહે છે. દેવ નારકી પણ અંતર્મુહૂર્ત સુધી મિથ્યાત્વ નષ્ટ કરવામાં અસમર્થ રહે છે. વિશિષ્ટ કાળ વ્યતીત થતાં વિશિષ્ટ પાત્રતા પછી પુરુષાર્થીપૂર્વક સમ્યક્ષર્ણનાની પ્રાપ્તિ કરી શકે છે.

-૦૦૦૦-

### ઘવલા પુસ્તક ૧નો અંશ (પાના નં. ૧૯૨-૧૯૩)

સામાન્યથી ગુણસ્થાનની અપેક્ષા મિથ્યાબ્રહ્મિ જીવ છે. ॥૬॥

જિનેન્દ્રાદૈવ સર્વે પ્રાણીઓનો અનુગ્રહ કરવાવાળો હોય છે કારણ કે તેઓ વીતરાગી છે.

“મિથ્યાબ્રહ્મિ જીવ છે.” અહીંથા મિથ્યા, વિતથ, વ્યલીક (જૂઠ) અને અસત્ય આ એકાર્થ વાચી નામ છે. દાખિ શબ્દનો અર્થ દર્શન અથવા શ્રદ્ધાન છે. આનાથી એ તાત્પર્ય નિકળ્યું કે જે જીવની વિપરીત, એકાંત, વિનય, સંશય અને અજ્ઞાનનુંપ મિથ્યાત્વ કર્મના ઉદ્યથી ઉત્પન્ન થયેલી મિથ્યાઙ્પ દાખિ હોય છે. તેને મિથ્યા બ્રહ્મિ જીવ કહે છે.

જેટલા પણ વચન-માર્ગ છે તેટલા જ નય-વાદ અર્થાત્ નયના લેદ હોય છે અને જેટલા નયવાદ છે તેટલા જ પર-સમય (અનેકાંત-બાધ્ય-મત) હોય છે.

આ વચન અનુસાર મિથ્યાત્વના પાંચ જ લેદ છે, એવો કોઈ નિયમ ન સમજવો જોઈએ, પરંતુ મિથ્યાત્વ પાંચ પ્રકારના છે, એ કહેલું ઉપલક્ષણમાત્ર છે અથવા મિથ્યા શબ્દનો અર્થ જોટું અને બ્રહ્મિ શબ્દનો અર્થ ઇચ્છિ, શ્રદ્ધા કે પ્રત્યય છે. માટે જે જીવની ઇચ્છિ અસત્યમાં હોય છે તેને મિથ્યાબ્રહ્મિ કહે છે.

મિથ્યાત્વ પ્રકૃતિના ઉદ્યથી ઉત્પન્ન થવાવાળો મિથ્યાત્વલાવનો અનુભવ કરવાવાળો જીવ વિપરીત-શ્રદ્ધાવાળો હોય છે. જે શીતે પિતજીવરથી ચુક્ત જીવને મધુરરસ સારો નથી લાગતો તેજ શીતે તેને થથાર્થ ધર્મ સારો નથી લાગતો.

જે મિથ્યાત્વ કર્મના ઉદ્યથી તત્ત્વાર્થના વિષયમાં અશ્રદ્ધાન ઉત્પન્ન થાય છે અથવા વિપરીત શ્રદ્ધાન થાય છે, તેને મિથ્યાત્વ કહે છે. તેના સંશચિત, અભિગૃહીત અને અનભિગૃહીત ત્રણ લેદ છે.

## અધ્યક્રમાંદિના કાર્ય

- ૧) અનંતાનુભંગી કખાય ચતુર્ષયની વિસંયોજનાના સમયે અધ્યક્રમાંદિના, અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ આ ત્રણે કરણ નિયમથી હોય છે.
- ૨) ક્ષાયિક સમ્યકૃત્વ માટે અધ્યક્રમાંદિ ત્રણે કરણ હોય જ છે.
- ૩) ઉપશમશ્રેણીના આરોહણ માટે અર્થાત ચારિત્ર મોહનીય કર્મોની ઉપશમતા માટે અધ્યક્રમાંદિ ત્રણે કરણ હોય જ છે. સાતમાં સાતિશય અપ્રમત્તવિરત ગુણસ્થાનમાં અધ્યક્રમાંદિ હોય છે. તથા આઠમાં અને નવમાં ગુણસ્થાનના નામ જ શેષ બંને કરણોને અનુસાર છે.
- ૪) ક્ષપક શ્રેણીના આરોહણ માટે અર્થાત ચારિત્રમોહનીય કર્મોની ક્ષપણા / ક્ષય કરવા માટે અધ્યક્રમાંદિ ત્રણે કરણ હોય છે.
- ૫) જો પ્રશામોપશમ સમ્યકૃત્વથી મિથ્યાત્પ ગુણસ્થાનમાં આવેલા જીવને ક્ષાયોપશમિક સમ્યકૃત્વ શીધ પ્રાપ્ત કરવું હોય તો, તેને અધ્યક્રમાંદિ અને અપૂર્વકરણ આ બંનેય કરણ હોય છે.
- ૬) દેશચારિત્ર અર્થાત દેશવિરત ગુણસ્થાનની પ્રાપ્તિ માટે અધ્યક્રમાંદિ અને અપૂર્વકરણ આ બંનેય કરણ આવશ્યક છે. મિથ્યાત્પ ગુણસ્થાનથી સીધા પાંચમાં દેશવિરત ગુણસ્થાનમાં ગમન કરવાવાળાને ત્રણે કરણ હોય છે.
- ૭) સકલચારિત્રની પ્રાપ્તિ અર્થે પણ પહેલું તથા બીજું બંનેય કરણ હોય છે. મિથ્યાત્પથી સીધા ઔપશમિક સમ્યકૃત્વની સાથે અપ્રમત્તવિરત ગુણસ્થાનમાં પ્રવેશ કરવાવાળાને અધ્યક્રમાંદિ ત્રણે કરણ હોય છે.

શ્રેણીના ગુણસ્થાનોની પહેલાં ચારિત્ર માટે અલગ અધ્યક્રમાંદિ કરણ નથી હોતાં. સમ્યકૃત્વ માટે જે અધ્યક્રમાંદિ કરણ હોય છે, તે જ સમય યથાસંલબ્ધ અવિરત સમ્યકૃત્વ, દેશચારિત્ર કે સકલચારિત્ર હોય છે. ઔપશમિક ચારિત્ર તથા ક્ષાયિક ચારિત્ર માટે જ શ્રેણીના આરોહણકાળમાં અધ્યક્રમાંદિ ત્રણે કરણ હોય છે. આ રીતે ઉપર્યુક્ત પાંચ સ્થાનો પર જ અધ્યક્રમાંદિ ત્રણે કરણ હોય છે.

(આધાર - લભિધસાર તથા જ્યઘવલા પ્રથમ પુસ્તક)

૬ લેપ્ટોના રીલમાં જરૂરી ૮.૮ ઓફ  
લિપ્સિક્સાન્ડ ક્રીમિનાર્સિન વાણિજ્યાન  
નું હિસ્થ મર્ટ લિપ્સિક્સાન્ડ ક્રીમિનાર્સિન વાણિજ્યાન  
મર્ટ અનુભૂતિ પારક લિપ્સિક્સાન્ડ લિપ્સિક્સાન્ડ એન્ટ્રીન્યુનાન્ડ એન્ટ્રીન્યુનાન્ડ



૬ નિયંત્રણ વાણિજ્યાન નિયંત્રણ એન્ટ્રીન્યુનાન્ડ એન્ટ્રીન્યુનાન્ડ

## સાસાદનસમ્યકૃત્વ ગુણસ્થાન

બીજા ગુણસ્થાનનું નામ સાસાદનસમ્યકૃત્વ છે.

આ ગુણસ્થાન ઔપશમિક સમ્યકૃત્વની સાથે ઉપલા ગુણસ્થાનોથી  
નીચે પડવાના સમયે પતનકાળમાં પ્રાપ્ત થાય છે.

પ્રશ્ન ૨૦:- જો બીજું સાસાદન ગુણસ્થાન મિથ્યાત્વ ગુણસ્થાન પછી  
સીધું પ્રાપ્ત નથી થતું તો સાસાદન સમ્યકૃત્વ ગુણસ્થાનને બીજા નંબર  
પર કેમ કહ્યું છે ?

ઉત્તર :- સાસાદન સમ્યકૃત્વ ગુણસ્થાનને બીજા નંબર પર હોવાના  
કારણો નીચે પ્રમાણે છે :

૧. સાસાદન પરિણામ મિથ્યાત્વની નજીકના પરિણામ છે.
૨. સાસાદન ગુણસ્થાનથી જીવ નિયમથી મિથ્યાત્વમાં જ પ્રવેશ કરે છે.
૩. સાસાદન સમ્યકૃત્વ પરિણામ ન સમ્યકૃત્વ છે અને ન સમ્યકૃ  
મિથ્યાત્વરૂપ છે. માટે તેને ઉપરના ચોથા કે ત્રીજા ગુણસ્થાનમાં ન રાખી  
શકીએ.

૪. આ પરિણામ વ્યક્ત મિથ્યાત્વરૂપ પણ નથી. તેથી પહેલા  
મિથ્યાત્વ ગુણસ્થાનમાં પણ ન રાખી શકાય. આ બધાં કારણોથી  
સાસાદનસમ્યકૃત્વને બીજા નંબરમાં જ રાખવામાં આવેલ છે.

સાસાદન ગુણસ્થાન તો ઉપરના ગુણસ્થાનથી નીચે પડવાથી પતનના  
કાળમાં જ થાય છે. સમ્યકૃત્વરૂપી પર્વતશિખરથી પતિત અને  
મિથ્યાત્વરૂપી ભૂમિની તરફ નીચે પડવાવાળા જીવ ઔપશમિક  
સમ્યકૃત્વએ જ હોય છે.

ઔપશમિક સમ્યકૃત્વરૂપ શુદ્ધ પર્યાયને છોડવારૂપ જીવના અપરાધથી  
તથા અનંતાનુબંધી કષાયોમાંથી કોઈ એક કષાયના ઉદય ના નિમિત્તથી  
જીવને સાસાદનસમ્યકૃત્વ ગુણસ્થાનની પ્રાપ્તિ થાય છે. અહીં મિથ્યાત્વ  
રૂપનોહનીય કર્મનો ઉદય ન હોવા છતાં જીવ સમ્યકૃત્વથી રહિત થઈ

ગયો છે, એ વિષય સમજવો મહત્વપૂર્ણ છે.

પ્રશ્ન ૨૧ :- સાસાદનસમ્યકૃત્વ ગુણસ્થાન ઓપશમિક સમ્યકૃત્વીને જ કેમ થાય છે? ક્ષાચિક કે ક્ષાયોપશમિક સમ્યકૃત્વીને કેમ નથી થતું?

ઉત્તર :- જે સમ્યકૃત્વિની પાસે અનંતાનુબંધી કખાયની સત્તા હોય અને તેનો ઉદ્ય પણ હોય તો જ તેને બીજું સાસાદન ગુણસ્થાન બને છે.

ક્ષાચિક સમ્યકૃત્વિના તો અનંતાનુબંધી કખાયોનો નાશ જ થઈ ગયો છે. અર્થાત् તેને અનંતાનુબંધી કખાયની સત્તા જ નથી તો તેને અનંતાનુબંધી નો ઉદ્ય કેવી રીતે થશે? તેથી ક્ષાચિક સમ્યકૃત્વિને બીજું ગુણસ્થાન નથી હોતું.

ક્ષાયોપશમિક સમ્યકૃત્વિને અનંતાનુબંધી કખાયોની સત્તા તો છે, પરંતુ તેની અપ્રશાસ્ત ઉપશમ કે વિસંચોજના થઈ છે, તેથી અનંતાનુબંધીનો ઉદ્ય ન હોવાથી ક્ષાયોપશમિક સમ્યકૃત્વિને પણ બીજું ગુણસ્થાન નથી હોતું.

ઓપશમિક સમ્યકૃત્વિને મિથ્યાત્પના અંતરકરણારૂપ ઉપશમ થયેલ છે. આ કારણે ઉપશમ કાળ સુધી તો કદાચ જીવ ઓપશમિક સમ્યકૃત્વિ રહે છે અને ઉપશમ કાળમાંથી એક સમય કે છ આવલી કાળ શેષ રહેવા પર કદાચિત્ અનંતાનુબંધીનો ઉદ્ય/ઉદીરણ થવાથી સમ્યકૃત્વની વિરાધના થઈ જવાથી તેને સાસાદન ગુણસ્થાન થઈ જાય છે.

આ સાસાદન સમ્યકૃત્વિ જીવને અનંતાનુબંધી કખાય કર્મના ઉદ્યના નિભિતથી અનંતાનુબંધી કખાય ભાવ ઉત્પન્ન થવાથી તેના સમ્યકૃત્વની વિરાધનાં કહેલ છે, પરંતુ તે હમણાં મિથ્યાત્પ પરિણામને પ્રાખ નથી થયો, તેથી તેને સાસાદનસમ્યકૃત્વી કહે છે. સ + આસાદન = સાસાદન.

સ = સહિત, આસાદન = વિરાધના, નાશ. આ પ્રકારે સાસાદન શબ્દનો અર્થ સમ્યકૃત્વનો નાશ કરવાવાનું થાય છે.

પ્રશ્ન ૨૨ :- સમ્યકૃત્વનો નાશ થયો છે, પરંતુ મિથ્યાત્પ પરિણામને પ્રાખ નથી થયો, તે કેવી રીતે શક્ય છે? તે જીવ વચ્ચમાં ક્યાં અટકી જાય છે?

ઉત્તર :- સામાન્યરૂપથી જોઈએ તો જીવ કાં તો મિથ્યાકૃત્વિ હોય છે અથવા સમ્યકૃત્વિ. પરંતુ કરણાનુયોગ શ્રદ્ધાગુણની છ પર્યાયોને સ્વીકાર કરે છે. જેમ કે - (૧) મિથ્યાત્પ (૨) સાસાદનસમ્યકૃત્વ (૩)

સમ્યક્રમિયાત્પ (૪) ઔપશમિક સમ્યકૃતવ (૫) ક્ષાયોપશમિકસમ્યકૃતવ અને (૬) ક્ષાયિકસમ્યકૃતવ. આ કારણ થી સાસાદનસમ્યકૃતવ અને સમ્યક્રમિયાત્પ ગુણસ્થાનોની સિદ્ધિ થઈ જાય છે.

આચાર્યશ્રી નેમિયંડ્ર દેવે ગોમ્મતસાર જીવકાંડ ગાથા ૧૮માં સાસાદન સમ્યકૃતવ ગુણસ્થાનની પરિભાષા આ પ્રમાણે કહેલ છે -

આદિમસમ્મત્તદ્વા સમયાદો છાવલિ ત્તિ વા સેસે ।

અણઅળણદસ્બ્દયાદો ણાસિયસમ્મો ત્તિ સાસણકખો સો ॥

“પ્રથમોપશમ સમ્યકૃતવના અંતમાંથી જ્યારે જઘન્ય એક સમય અથવા ઉત્કૃષ્ટ છ આવલી પ્રમાણ કાળ બાકી રહે, તેટલા કાળમાં અનંતાનુંબંધી કોઇ, માન, માયા, લોભમાંથી કોઈ એક કષાયના ઉદ્યમાં આવવાથી સમ્યકૃતવની વિરાધના થવાથી શ્રદ્ધાની જે અવ્યક્ત અતત્પશ્રદ્ધાનરૂપ પરિણાતિ થાય છે, તેને સાસન અથવા સાસાદન ગુણસ્થાન કહે છે.”

શ્રી ગુણધરાચાર્ય અને શ્રી ચિત્પુરખલાચાર્યના મતાનુસાર દ્ર્ષ્ટિયોપશમ સમ્યકૃતી પણ બીજાં ગુણસ્થાનમાં આવે છે.

અહીં પરિભાષામાં જે શ્રદ્ધાની અવ્યક્ત અતત્પશ્રદ્ધાનરૂપ પરિણાતિની વાત કહી છે, તેને દર્શનમોહજનિત મિથ્યાત્પરૂપ પરિણાતિ ન કહી શકાય, કારણ કે શ્રદ્ધાની વિપરીત પરિણાતિ અવ્યક્ત છે. અતત્પશ્રદ્ધાનની પરિણાતિ વ્યક્ત થતાં જ મિથ્યાત્વી થઈ જાય છે. ઔપશમિક સમ્યકૃતવની વિરાધના થવાથી સાસાદન ગુણસ્થાન ઉત્પન્ન થયું છે.

**પ્રશ્ન ૨૩ :-** ઔપશમિક સમ્યકૃતવની વિરાધનામાં કોઈ કર્મનો ઉદ્ય નિમિત્ત છે કે નથી ?

**ઉત્તર :-** અનંતાનુંબંધી કોઇ-માન-માયા-લોભમાંથી કોઈ એક કષાય કર્મના ઉદ્યના નિમિત્તથી ઔપશમિક સમ્યકૃતવની વિરાધના થઈ જાય છે.

**પ્રશ્ન ૨૪ :-** સમ્યકૃતવની વિરાધના(નાશ) તો મિથ્યાત્પ કર્મના ઉદ્યથી થાય છે. આપ અનંતાનુંબંધી કષાયના ઉદ્યથી ઔપશમિક સમ્યકૃતવની વિરાધના થાય છે, એમ શા માટે કહો છો ?

**ઉત્તર :-** સમ્યકૃતવની વિરાધના મિથ્યાત્પથી થાય છે. - આ સામાન્ય

કથન છે. અહીં કરણાનુયોગની વિવક્ષાથી વિશેષ કથન કર્યું છે. કરણાનુયોગ અનુસાર અનંતાનુંબંધી કખાયનો ઉદ્ય પણ સમ્યકૃત્પના નાશમાં નિમિત છે.

આચાર્યશ્રી વીરસેનસ્વામીએ ઘવલા પુસ્તક એક - પાના નં. ૧૭૨ પર અનંતાનુંબંધી કખાયને છ્રિસ્તવભાવી કહેલ છે. અર્થાત્ અનંતાનુંબંધી કખાય સમ્યકૃત્પ અને સમ્યકૃત્પાચરણ ચારિત્ર- બંનેનો ઘાત કરવામાં નિમિત છે. આ કારણથી ઉપર અનંતાનુંબંધીના પણ ઉદ્યથી ઔપશમિક સમ્યકૃત્પની વિરાધના થાય છે. - એમ કહેવામાં આવ્યું છે. આ વિષયમાં ઘવલાજીનું મૂળ કથન આ પ્રમાણે છે-

### દંસણ - ચરણ ગુણધાર્દ ચત્તારિ અણંતાણુંબંધિ પયડીઓ

અપ્રત્યાખ્યાનાવરણાદિ કખાયના ઉદ્ય પ્રવાહને અનંત કરવાટું કાર્ય અનંતાનુંબંધી કખાય કરે છે. (ઘવલા પુસ્તક - ૫ પાનું -૪૩)

અનંતાનુંબંધી કખાયનો ઉદ્ય ક્યારે થાય છે? આ રીતે કાળની અપેક્ષાથી પ્રશ્ન પુછવામાં આવે તો આ પરિભાષામાં જ તેનો સ્પષ્ટ જવાબ આપવામાં આવ્યો છે. જ્યારે ઔપશમિક સમ્યકૃત્પના અંતર્મુહૂર્ત કાળમાંથી જધન્ય એક સમય, બે, ત્રણ, ચાર, પાંચ સમય અથવા છ આવલી કાળ શેષ રહે અને અનંતાનુંબંધી કખાયનો ઉદ્ય આવે તો સાસાદન ગુણસ્થાન થાય છે.

સાસાદન ગુણસ્થાનને સાસન સમ્યકૃત્પ પણ કહે છે. સાસનનો શબ્દાર્થ આ પ્રકારે છે. સ = સહિત, અસન = સમ્યકૃત્પની વિરાધના. સ+અસન = સાસન. સાસન સમ્યકૃત્પ = સમ્યકૃત્પવિરાધક પરિણામ.

સમયસાર નાટક ચતુર્દશ ગુણસ્થાનાધિકારમાં સાસાદન ગુણસ્થાનનું કથન ૨૦માં છંદમાં કર્યું છે. તેનો અભિપ્રાય એમ છે કે - “જેવી રીતે કોઈ ભૂખ્યો મનુષ્ય સાકર મેળવેલી ખીર ખાય અને ઉલ્ટી થયા પછી તેનો કિંચિત્ માત્ર સ્વાદ લેતો રહે.

તેવી રીતે ચોથા, પાંચમા, છઢા ગુણસ્થાન સુધી ચડેલા કોઈ ઉપશમી સમ્યકૃત્પીને અનંતાનુંબંધી કખાયનો ઉદ્ય થાય છે તો તે જ સમયે ત્યાંથી તે મિથ્યાત્પમાં પડે છે. તે પડવાની અવસ્થામાં જધન્ય એક સમય અને વધારેમાં વધારે છ આવલી સુધીમાં જે દૂષિત થયેલા સમ્યકૃત્પનો કિંચિત્ સ્વાદ મળે છે તે સાસાદન ગુણસ્થાન છે.”

સાસાદનની સંક્ષિપ્ત પરિભાષા કરીએ તો સમ્યકૃતવ વિરાધક પરિણામ જ સાસન ગુણસ્થાન છે. સમ્યકૃતવ વિરાધક જીવની સમ્યકૃતવરૂપી રત્નપર્વતશિખરથી પતિત મિથ્યાત્પરૂપી ભૂમિની સન્મુખ દશાને સાસન અથવા સાસાદનગુણસ્થાન કહે છે.

આ ગુણસ્થાનની પરિભાષામાં જે સમ્યકૃતવને રત્નપર્વતની ઉપમા આપી છે, તેનો અભિપ્રાય એ છે કે જેવીરીતે રત્નપર્વત અનેક રત્નોને ઉત્પત્ત કરવાવાળો અને ઉત્ત્રત સ્થાન પર પહોંચાડવાવાળો છે, તેવી જરીતે સમ્યકૃતવ પણ કેવળજ્ઞાનાદિ અનેક ગુણરત્નોને ઉત્પત્ત કરવાવાળો અને બધાંથી ઉત્ત્રત મોક્ષસ્થાન પર પહોંચાડવાવાળો છે.

**પ્રશ્ન રૂપ :-** સાસાદનગુણસ્થાનવર્તી જીવ વિપરીત અભિપ્રાયથી દૂષિત છે, માટે તેને સાસાદનસમ્યકૃતવ ન કહેવું જોઈએ.

**ઉત્તર :-** અહીં સમ્યકૃતવ કહેવાનું કારણ માત્ર એ છે કે તે પહેલાં સમ્યકૃતી હતો. માટે ભૂતનૈગમનયની અપેક્ષાએ તેને સમ્યકૃતવની સંજ્ઞા બની જાય છે. તે કાળ પણ હજુ સમ્યકૃતવનો ચાલી રહ્યો છે તથા દર્શનમોહનીયનો અહીં ઉપશમ જ છે. જેમ પરીક્ષાથીને પેપર લખવાનો સમય ત્રણ કલાકનો છે અને કોઈ વિધાર્થી ને કલાકમાં પેપર લખી ચાલ્યો જાય તો પણ શેખ એક કલાકનો કાળ પેપરનો કાળ જ કહેવામાં આવશે. ચારિત્ર અપેક્ષાએ વિચાર:

આ સાસાદનગુણસ્થાનમાં શ્રદ્ધા યથાર્થ ન હોવાથી જ્ઞાન, ચારિત્ર આદિ સર્વગુણોનું પરિણામન મિથ્યાત્પરૂપ જ થાય છે.

ચારિત્ર આદિ સર્વગુણ તથા જીવાદિ દ્રવ્ય તો સ્વભાવથી અનાદિ અનેંત શુદ્ધ જ છે. ગુણોમાં તથા દ્રવ્યમાં મિથ્યા અથવા સમ્યકૃતપણાંનો કોઈ પ્રશ્ન જ નથી. મિથ્યા કે સમ્યકૃતપણું અથવા શુદ્ધતા કે અશુદ્ધતા તો પર્યાયમાં જ આવે છે, તે પર્યાય દર્મ છે.

જો દ્રવ્યો અથવા ગુણોમાં મિથ્યાત્પરણું કે અશુદ્ધતા આવી જાય અથવા સ્વભાવથી દ્રવ્ય કે ગુણ અશુદ્ધ થઈ જાય તો તે તેનો સ્વભાવ થઈ જશે. ત્યારે ફરી તેને શુદ્ધ થવાનો કોઈ ઉપાય જ ન થઈ શકે. તેથી અનાદિથી સર્વ દ્રવ્ય અથવા પ્રત્યેક ગુણ સ્વભાવથી શુદ્ધ જ છે, એવું સ્વીકાર કરવું જોઈએ. સર્વજ્ઞ ભગવંતોની દિવ્યદવનિમાં દ્રવ્ય અને ગુણોને સદાય શુદ્ધ જ

કહેવામાં આવ્યા છે.

**કાળ અપેક્ષા વિચાર :**

**જધન્ય કાળ :** આ ગુણસ્થાનનો જધન્ય કાળ માત્ર એક સમય છે. અર્થાત્ કોઈ જીવ છુટા આદિ ગુણસ્થાનમાંથી ઔપશમિક સમ્યકૃત્વની સાથે પડીને આ સાસાદન ગુણસ્થાનમાં આવી જાય તો તે ઓછા માં ઓછા આ ગુણસ્થાનમાં માત્ર એક સમય રહી શકે છે. ત્યારબાદ તે નિયમથી મિથ્યાત્વ ગુણસ્થાનમાં ગમન કરે છે.

**ઉતૃષ્ટ કાળ :** જો કોઈ જીવ આ સાસાદન ગુણસ્થાનમાં વધારેમાં વધારે કાળ સુધી રહે તો માત્ર છ આવલી સુધી જ રહી શકે છે. ત્યારબાદ નિયમથી મિથ્યાત્વ ગુણસ્થાનમાં જ ગમન કરે છે. તેથી તેનો ઉતૃષ્ટકાળ છ આવલી છે.

**મદ્યમ કાળ :** બે, ત્રણ, ચાર, પાંચ સમયથી લઇને એક આવલી બે-ત્રણ - ચાર - પાંચ આવલીથી વધારે એક સમય, બે સમયથી લઈ ત્રણ - ચાર - પાંચ અને છેવટનો એક સમય ઓછો છ આવલી સુધીના સર્વ લેણ સાસાદનસમ્યકૃત્વના મદ્યકાળના લેણ હોઈ શકે છે.

**ગમનાગમન અપેક્ષા વિચાર :**

**ગમન :** સાસાદન સમ્યકૃત્વિ જીવ નિયમથી નીચે મિથ્યાત્વ ગુણસ્થાનમાં જ ગમન કરે છે. મિશ્ર, અવિરતસમ્યકૃત્વ આદિ ઉપરના ગુણસ્થાનોમાં સાસાદન સમ્યકૃત્વિનું ગમન નથી થતું, કારણ કે તેનું મુખ જ મિથ્યાત્વની તરફ થઈ ગયું હોય છે. આ કારણે તેની પર્યાયિગત પાત્રતા જ માત્ર મિથ્યાત્વ ગુણસ્થાનમાં જ પ્રવેશ કરવાની છે.

જેમ વૃક્ષ પરથી ફળ નીચે પડી રહ્યું હોય તો તે નીચે નિયમથી જમીન પર પડશે જ. વચ્ચેના અંતરાલ કાળથી તે પાછો વૃક્ષ પર ન જઈ શકે.

**તેમજ સાસાદનસમ્યકૃત્વી જીવ સમ્યકૃત્વથી છૂટી ગયો છે.** મિથ્યાત્વ સન્મુખ થઈ ગયો છે. હવે સાસાદનથી જ ઉપરના ગુણસ્થાનમાં જવાનો તેને અપસર નથી. હવે તો મિથ્યાકૃત્વિ થવું જ અનિવાર્ય છે. પછી મિથ્યાત્વ ગુણસ્થાનથી ચથાસંભવ ઉપરના ગુણસ્થાનમાં ફરીથી પુરુષાર્થ કરવાથી ગમન કરવો સંભવ છે.

**આગમન :** (૧) ઔપશમિક સમ્યકૃત્વિ પ્રમત્તસંચત ગુણસ્થાનવર્તી ભાવલિંગી મહાપુરુષ સીધા સાસાદનસમ્યકૃત્વ ગુણસ્થાનમાં આવી શકે છે.

(૨) ઔપશમિક સમ્યકૃત્વિના દેશવિરત ગુણસ્થાનથી અર્થાત् પ્રતી શ્રાવક અપસ્થાથી સીધા સાસાદન સમ્યકૃત્વ ગુણસ્થાનમાં આવવું થઈ શકે છે.

(૩) ઔપશમિક સમ્યકૃત્વિના અવિરતસમ્યકૃત્વ નામના ચોથા ગુણસ્થાનથી પણ સાસાદનસમ્યકૃત્વ ગુણસ્થાનમાં આવવું સંભવ છે, કારણ કે ઔપશમિક સમ્યકૃત્વિ જ સાસાદનસમ્યકૃત્વી થઈ શકે છે, અન્ય સમ્યકૃત્વિ નહીં, આ અફર નિયમ છે.

**વિશેષ અપેક્ષા વિચાર:** (૧) જો સાસાદનસમ્યકૃત્વ ગુણસ્થાનમાં રહેતા થક જીવનું મરણ થાય છે, તો તે જીવ મરણોપરાંત નરકગતિમાં જતો નથી, કારણ કે સાસાદન સમ્યકૃત્વનો કાળ ઔપશમિક સમ્યકૃત્વનો કાળ છે અને સમ્યકૃત્વિ જીવ (પૂર્વમાં આયુનો બંધ ન થયો હોય તો) નરકમાં જતો જ નથી - આ નિયમ છે.

(૨) તીર્થીકર અને આહારકદ્રિકની સત્તા સહિત જીવ સાસાદનસમ્યકૃત્વ ગુણસ્થાનમાં જતો જ નથી.

આહારક શરીર અને આહારક અંગોપાંગ નામકર્મ - બંનેને આહારકદ્રિક કહે છે. આહારક અધિધારી છઢા ગુણસ્થાનવર્તી મુનિરાજને જિનવાણી ના અધ્યયનમાં કોઈ પ્રકારની શંકા ઉત્પન્ન થવાથી અથવા જિનાલયની વંદના કરવા માટે તેના મસ્તકમાંથી એક હાથ પ્રમાણ સ્વચ્છ, શૈત, સપ્તાધાતુરહિત પુરુષાકાર પુતળું નીકળે છે, તેને આહારક શરીર કહે છે.

છઢા ગુણસ્થાનવર્તી મુનિરાજ ને પ્રયોજનભૂત સાત તત્ત્વ અને ક્રવ્ય - ગુણ - પર્યાય સંબંધી શંકા નથી હોતી, કારણ કે આ વિષયોનો ચથાર્થ નિર્ણય તો સમ્યકૃત્દર્શનની પ્રાસિના પૂર્વે જ થઈ જાય છે. જિનવાણી અગાધ છે અને મુનિરાજેનું ક્ષાયોપશમિક જ્ઞાન તો સીમિત જ હોય છે. તેથી અપ્રયોજનભૂત અનેક વિષયોના સંબંધમાં પ્રશ્ન તો થઈ જ શકે છે, તેના સહજ સમાધાન માટે આ પ્રક્રિયા સંપન્ન થાય છે.

આહારકદ્રિકની સત્તાવાળા મુનિરાજ વિશિષ્ટ પરિણામના ધારક હોય છે. તેથી તે આ સાસાદન સમ્યકૃત્વ ગુણસ્થાનમાં નથી આવતાં, એમ સમજયું જોઈએ.

(૩) દ્વિતીય ગુણસ્થાનવર્તી જીવના સાસાદન સમ્યકૃત્વરૂપ ભાવ/પરિણામને પારિણામિકભાવ પણ કહે છે, કારણ કે જીવના જે પરિણામ કર્મના ઉદ્ય,

ઉપશમ, ક્ષય અને ક્ષ્યોપશમની અપેક્ષાથી રહિત હોય છે, તેને પારિણામિક ભાવ કહે છે. આ પરિભાષા અનુસાર સાસાદન સમ્યકૃત્વરૂપ પરિણામ દર્શનમોહનીય કર્મના ઉદ્ય, ઉપશમ, ક્ષય અને ક્ષ્યોપશમની અપેક્ષા વગર જ થાય છે. તેથી દર્શનમોહનીય કર્મની અપેક્ષાએ આ બીજા ગુણસ્થાનના ભાવને પારિણામિક ભાવ પણ કહે છે.

મિથ્યાત્પ ગુણસ્થાનથી લઈને ચોથા ગુણસ્થાન સુધીના ચાર ગુણસ્થાન દર્શનમોહનીય કર્મની અપેક્ષાથી છે. બીજા ગુણસ્થાનમાં દર્શનમોહનીયના ઉદ્યાદિની અપેક્ષા નથી, તેથી દર્શનમોહનીય કર્મની અપેક્ષાથી અહીં પારિણામિકપણું ઘટિત થાય છે. જ્યાં જે અપેક્ષાએ કથન કરેલ હોય, ત્યાં તે અપેક્ષાથી સમજી લેવું જોઈએ.

◆સાસાદન ગુણસ્થાનનો કાળ ઔપશમિક સમ્યકૃત્વનો જ કાળ છે.

◆મિથ્યાત્પદર્શનમોહનીય પરિણામના નિમિત્તથી પ્રથમ ગુણસ્થાનમાં બંધાવવાવાળી ૧૬ કર્મ પ્રકૃતિઓનો અહીં બંધ નથી થતો.

◆અનંતાનુબંધી કખાયરૂપ ઔદયિક પરિણામોથી બંધાવા યોગ્ય રૂપ પ્રકૃતિઓનો અહીં બંધ થાય છે.

પંડિતપ્રવર ઠોડરમલજીના સાસાદન ગુણસ્થાન સંબંધી સૂક્ષ્મ ચિંતન પણ વિશેષ મહત્વનું છે. તેથી તેમના જ શાબ્દો અહીં આલંકિત કરીએ છીએ. (પૃષ્ઠ ૩૩૫)

“અહીં પ્રશ્ન છે કે અનંતાનુબંધી તો ચાન્ત્રિમોહની પ્રકૃતિ છે. તેથી ચાન્ત્રિનો ઘાત કરે, તેનાથી સમ્યકૃત્વનો ઘાત કઈ રીતે સંભવ છે ?

**સમાધાન :** અનંતાનુબંધીના ઉદ્યથી કોધાદિરૂપ પરિણામ થાય છે, કાંઈ અતત્પત્રશ્રેદ્ધાન નથી થતું, માટે અનંતાનુબંધી ચાન્ત્રિનો જ ઘાત કરે છે, સમ્યકૃત્વનો ઘાત નથી કરતા. તેથી પરમાર્થથી તો આમ જ છે, પરંતુ અનંતાનુબંધીના ઉદ્યથી જેવા કોધાદિક થાય છે, તેવા કોધાદિક સમ્યકૃત્વ થવાથી નથી થતાં - એવું નિમિત - નૈમિત્તિકપણું જોવામાં આવે છે. જેમ કે - ત્રસપણાની ઘાતક તો સ્થાપર પ્રકૃતિ જ છે, પરંતુ ત્રસપણું થતાં એકેન્દ્રીય જાતિપ્રકૃતિનો પણ ઉદ્ય થતો નથી. માટે ઉપચારથી એકેન્દ્રીય પ્રકૃતિને પણ ત્રસપણાનું ઘાતકપણું કહેવામાં આવે તો દોષ નથી. તે જ પ્રકારે સમ્યકૃત્વનો ઘાતક તો દર્શનમોહ છે, પરંતુ સમ્યકૃત્વ થવાથી અનંતાનુબંધી કખાયોનો પણ ઉદ્ય નથી થતો, માટે ઉપચારથી

અનંતાનુબંધીને પણ સમ્યકૃતવનું ઘાતકપણું કહેવામાં આવે તો દોષ નથી.

અહીં ફરી પ્રશ્ન છે કે અનંતાનુબંધી સમ્યકૃતવનો ઘાત નથી કરતા તો તેનો ઉદ્ય થવાથી સમ્યકૃતવથી બદ્ધ થઈ સાસાદન ગુણસ્થાનને ડેવી રીતે પ્રાપ્ત કરે છે ? (પાનું ૩૩૭)

**સમાધાન :** જેમ કોઈ મનુષ્યના મનુષ્યપર્યાયના નાશનું કારણ તીવ્ર રોગ પ્રગટ થયો હોય, તેને મનુષ્યપર્યાયને છોડવાવાળો કહીએ છીએ. તથા મનુષ્યપર્યાય દૂર થઈ દેવાટિપર્યાય થઈ, તે તો રોગ અવસ્થામાં નથી થઈ. અહીં મનુષ્યનું જ આચુ છે. તે જ રીતે સમ્યકૃતીના સમ્યકૃતવના નાશનું કારણ અનંતાનુબંધીનો ઉદ્ય પ્રગટ થયો, તેને સમ્યકૃતવનો વિરોધક સાસાદન કહ્યું. તથા સમ્યકૃતવનો અભાવ થવાથી મિદ્યાત્પ થાય છે, તે તો સાસાદનમાં નથી થયું. અહીં ઉપશમસમ્યકૃતવનો જ કાળ છે - એમ જાણવું.

આ રીતે અનંતાનુબંધી ચતુર્ભ્યની સમ્યકૃત થવાથી અવસ્થા થતી નથી. માટે સાત પ્રકૃતિઓના ઉપશમાદિકથી પણ સમ્યકૃતવની પ્રાપ્તિ કહેવામાં આવે છે.”

ઘવલા પુસ્તક ૧ નો અંશ (પાનાનં ૧૬૪)

સામાન્યથી સાસાદન સમ્યકૃતિ જીવ છે ॥૧૦॥

સમ્યકૃતવની વિરાધનાને આસાદન કરે છે. જે આ આસાદન થી ચુક્ત છે, તેને સાસાદન કરે છે. કોઈ એક અનંતાનુબંધી કખાયના ઉદ્ય થી જેનું સમ્યકૃતિન નષ્ટ થઈ ગયું છે. પરંતુ જે મિદ્યાત્પ કર્મના ઉદ્યથી ઉત્પન્ન થયેલ મિદ્યાત્પરૂપ પરિણામોને પ્રાપ્ત નથી થયો છતાં પણ મિદ્યાત્પ ગુણસ્થાનની સન્મુખ છે, તેને સાસાદન કરે છે. શંકા ૧ : સાસાદન ગુણસ્થાનવાળો જીવ મિદ્યાત્પ કર્મનો ઉદ્ય ન હોવાથી મિદ્યાકૃતિ નથી, સમીચીન (યથાથી) રૂચિનો અભાવ થવાથી સમ્યકૃતિ પણ નથી. આના સિવાય અન્ય કોઈ ચોથી કૃતિ છે નહીં, કારણ કે સમીચીન, અસમીચીન અને ઉલ્લયરૂપ કૃતિના અવલંબનભૂત વસ્તુની

સિવાય બીજુ કોઈ વસ્તુ જોવામાં આવતી નથી. માટે સાસાદન ગુણસ્થાન અસત્પ્રાપ જ છે. અર્થાત् સાસાદન નામનું કોઈ સ્વતંત્ર ગુણસ્થાન ન માનવું જોઈએ?

**સમાધાન -** એવું નથી, કારણ કે સાસાદન ગુણસ્થાનમાં વિપરીત અભિપ્રાય હોય છે. માટે તેને અસત્ક્રષ્ટિ જ સમજવું જોઈએ.

**શંકા ૨ :** જો એવું છે તો તેને મિથ્યાક્રષ્ટિ જ કહેવું જોઈએ, સાસાદન સંજ્ઞા આપવી ઉચિત નથી.

**સમાધાન -** ના, કારણ કે સમ્યક્કુર્દશન અને સ્વરૂપાચરણ ચારિત્રનો પ્રતિબંધ કરવાવાળા અનંતાનુંબંધી કખાયના ઉદ્યથી ઉત્પન્ન થયેલ વિપરીતાલિનિવેશ બીજા ગુણસ્થાનમાં જોવામાં આવે છે, માટે બીજા ગુણસ્થાનવર્તી જીવ મિથ્યાક્રષ્ટિ છે. પરંતુ મિથ્યાત્વકર્મના ઉદ્યથી ઉત્પન્ન થયેલ વિપરીતાલિનિવેશ ત્વાં જોવામાં નથી આવતો. માટે તેને મિથ્યાક્રષ્ટિ નથી કહેતાં, પરંતુ સાસાદન સમ્યક્કુર્દશિ કહે છે.

**શંકા ૩ :** પૂર્વના કથનાનુસાર જ્યારે તે મિથ્યાક્રષ્ટિ જ છે તો પછી તેને મિથ્યાક્રષ્ટિ સંજ્ઞા કેમ આપવામાં નથી આવી ?

**સમાધાન :-** - એવું નથી, કારણ કે સાસાદન ગુણસ્થાનને સ્વતંત્ર કહેવાથી અનંતાનુંબંધી પ્રકૃતિઓની દ્વિસ્વલભાવતાનું કથન સિદ્ધ થઈ જાય છે.

**વિશેષાર્થ :-** - સાસાદન ગુણસ્થાનને સ્વતંત્ર માનવાનું ફળ જે અનંતાનુંબંધીની દ્વિસ્વલભાવતા બતાવવામાં આવી છે, તે દ્વિસ્વલભાવતા બે પ્રકારથી થઈ શકે છે. એક તો અનંતાનુંબંધી કખાય સમ્યક્કૃત્વ અને ચારિત્ર આ બંનેની પ્રતિબંધક માનવા આવે છે અને એજ તેની દ્વિસ્વલભાવતા છે. આ કથનની પુષ્ટી અહીંયા સાસાદન ગુણસ્થાનને સ્વતંત્ર માનીને કરવામાં આવી છે. બીજું, અનંતાનુંબંધી જે રીતે સમ્યક્ષ્ટવના ધાત (નાશ) કરવામાં મિથ્યાત્વ પ્રકૃતિનું કામ કરે છે, તે જ રીતે તે મિથ્યાત્વવના ઉત્પાદનમાં મિથ્યાત્વપ્રકૃતિનું કામ નથી કરતી. આ રીતની દ્વિસ્વલભાવતાને સિદ્ધ કરવા માટે સાસાદન ગુણસ્થાનને સ્વતંત્ર માનેલ છે.

દર્શનમોહનીય ના ઉદ્ય, ઉપશમ, ક્ષય અને ક્ષ્યોપશમ થી જીવોના સાસાદનરૂપ પરિણામ તો ઉત્પન્ન થતાં નથી, જેનાથી કે સાસાદન ગુણસ્થાનને મિથ્યાક્રષ્ટિ, સમ્યક્કુર્દશિ અથવા સમ્યક્કૃત મિથ્યાક્રષ્ટિ કહેવામાં આવે. તથા જે અનંતાનુંબંધીના ઉદ્યથી બીજા ગુણસ્થાનમાં

વિપરીતાભિનિવેશ હોય છે, તે અનંતાનુંબંધી દર્શનમોહનીયનો બેદ ન હોઈને ચારિત્ર ને આપરણ કરવાવાળો હોવાથી ચારિત્રમોહનીયનો બેદ છે. માટે બીજા ગુણસ્થાનને મિથ્યાક્રષિત ન કહીને સાસાદન સમ્યક્ક્રષિત કર્યું છે. શંકા 4 : અનંતાનુંબંધી સમ્યક્ષત્વ અને ચારિત્ર આ બંને નો પ્રતિબંધક હોવાથી તેને ઉભયરૂપ (સમ્યક્ષત્વચારિત્રમોહનીય) સંજા આપવી જ્યાયસંગત છે?

સમાધાન : આ આરોપ બરાબર નથી, કારણ કે આ તો આપણાને ઈજ્જત જ છે. અર્થાત અનંતાનુંદી ને સમ્વયકૃત્ય અને ચારિત્ર આ બંનેના પ્રતિબંધક માળેલા જ છે. છતાં પણ પરમાગમમાં મુખ્યનયની અપેક્ષાએ આ પ્રકારનો ઉપદેશ નથી આપવામાં આવ્યો.

સાસાદન ગુણસ્થાન વિવક્ષિત કર્મના અર્થાત દર્શનમોહનીયના ઉદ્ય, ઉપશમ, ક્ષય અને ક્ષ્યોપશમ વગર ઉત્પન્ન થાય છે, માટે એ પારિણામિક છે. સાસાદન જે સમ્યકુદ્ધારિ, તે સાસાદનસમ્યકુદ્ધારિ છે. શંકા 5: સાસાદન ગુણસ્થાન વિપરીત અભિપ્રાયથી દૂષિત છે, માટે તેને સમ્યકુદ્ધારિપણું કઈ રીતે હોઇ શકે?

સમાધાન : ના, કારણ કે પ્રથમ તે સમ્યકુદ્ધિ હતો, માટે ભૂતપૂર્વ ન્યાયની અપેક્ષાએ તેની સમ્યકુદ્ધિ સંજ્ઞા થઈ જાય છે. કહ્યું પણ છે:- સમ્યકુદ્ધશનરૂપી રટનગિરિના શિખર પરથી પડીને જે જીવ મિથ્યાત્પરૂપી ભૂમિની અભિમુખ (સન્મુખ) છે, તથા જેનું સમ્યકુદ્ધશન નાચ થઈ ગયું છે, પરંતુ મિથ્યાર્થની પ્રાપ્તિ નથી થઈ, તેને સાસન અર્થાત્ સાસાદનગુણસ્થાનવર્તી સમજવો જોઈએ.

-9-9-9-9-

૫. અર્થ. નિષ્ઠાનીઓનીકોઈ વિભાગનાં નિ. ૬ કરી છેનિબાળિએની  
નિ. ૭ હેઠળ નિષ્ઠાનીઓની વિભાગ વિભાગ છાપણ નિ. ૮ કરી છેનિ  
નિ. ૯ હેઠળ નિષ્ઠાની વિભાગ વિભાગ નિષ્ઠાની નિષ્ઠાની નિ. ૧૦ કરી  
નિ. ૧૧ નિષ્ઠાની વિભાગ વિભાગ નિષ્ઠાની નિ. ૧૨ કરી  
નિ. ૧૩ નિષ્ઠાની વિભાગ વિભાગ નિ. ૧૪ કરી  
નિ. ૧૫ નિષ્ઠાની વિભાગ (નિષ્ઠાની વિભાગ) નિ. ૧૬ નિષ્ઠાની  
નિ. ૧૭ નિષ્ઠાની વિભાગ (નિષ્ઠાની વિભાગ) નિ. ૧૮ નિષ્ઠાની  
નિ. ૧૯ નિષ્ઠાની વિભાગ (નિષ્ઠાની વિભાગ) નિ. ૨૦ નિષ્ઠાની

(૩)

### સમ્યકુભિદ્ધાત્પ (મિશ્ર) ગુણસ્થાન

ત્રીજા ગુણસ્થાનનું નામ સમ્યકુભિદ્ધાત્પ અથવા મિશ્રગુણસ્થાન છે.  
આ ગુણસ્થાનના નામથી જ આપણા મનમાં એક પ્રશ્ન ઉત્પણ્ણ થાય છે.

પ્રશ્ન ૨૬ :- જે લોકો સાચા અને જૂઠા બંને પ્રકારના દેવ, શાસ્ત્ર અને  
ગુરુને સમાન માને છે, તે જ સમ્યકુભિદ્ધાત્પ છે અથવા અન્ય છે ?

ઉત્તર :- જે લોકો સાચા અને જૂઠા દેવ, શાસ્ત્ર અને ગુરુને સમાન  
પૂજનીય તથા કલ્યાણકારી માને છે, તે તો સાક્ષાત ગૃહીત મિદ્ધાત્પ જ  
છે. તેમનું તો મિદ્ધાત્પ ગુણસ્થાન જ છે. તેમને તો સાચા દેવ, શાસ્ત્ર,  
ગુરુનો પણ નિર્ણય નથી. તેઓ સાચા-ખોટાનો નિર્ણય કરવા માટે વિચાર  
પણ નથી કરી રહ્યા. તેઓને ત્રીજું ગુણસ્થાન ન હોઈ શકે. ત્રીજું ગુણસ્થાન  
તો તેને હોય છે, જે એકવાર સમ્યકુભિદ્ધાત્પ થઈ ગયા હોય.

જે જીવે એકવાર સમ્યકુભિદ્ધાત્પ પ્રાપ્ત કર્યું હોય અને ઇહી મિદ્ધાત્પ થઈ  
ગયો હોય, તેને સાદી મિદ્ધાત્પ કરે છે.

જ્યારે અનાંદ મિદ્ધાત્પ જીવ ઔપશામિક સમ્યકુભિદ્ધાત્પની પ્રાપ્તિ કરે છે  
ત્યારે તે જીવના મિદ્ધાત્પ કર્મના ત્રણ ટુકડા થવાને કારણ દર્શનમોહનીય  
કર્મ ત્રણ પ્રકારના થઈ જાય છે. (૧) મિદ્ધાત્પ (૨) સમ્યકુભિદ્ધાત્પ  
(૩) સમ્યકુભિદ્ધતિ. તેથી જેની પાસે સમ્યકુભિદ્ધાત્પ દર્શનમોહનીય કર્મની  
સત્તા હોય અને તેનો ઉદ્દ્ય આવી જાય તો જ તેને ત્રીજું ગુણસ્થાન હોય છે.

પ્રશ્ન ૨૭ :- જે જીવને સમ્યકુભિદ્ધાત્પ કર્મની સત્તા અર્થાત્ અસ્તિત્વ  
તથા ઉદ્દ્ય ન હોય તો શું તે જીવને ત્રીજું ગુણસ્થાન ન હોઈ શકે ?

ઉત્તર :- જે જીવને સમ્યકુભિદ્ધાત્પ કર્મની સત્તા અર્થાત્ અસ્તિત્વ  
છે, તે જીવને સમ્યકુભિદ્ધાત્પ ગુણસ્થાન નિયમથી હોય જ છે - એવો  
કારણ - કાર્ય સંબંધ તો છે જ નહીં. નિયમ એવો જરૂર છે કે જે-જે જીવની  
શ્રદ્ધામાં સમ્યકુભિદ્ધાત્પ આવે છે, તેને સમ્યકુભિદ્ધાત્પ દર્શન

મોહનીય કર્મનો ઉદ્ય હોય છે.

જીવના પરિણામમાં કર્મનો ઉદ્ય નિમિત માત્ર છે. કર્મ જીવના પરિણામને કરતો - કરાવતો નથી - એવું બિલ્કુલ નથી. જો કર્મ જીવના પરિણામને કરાવતો હોય તો તેને બળવાન કહેવું સંભવ હોત, પરંતુ કર્મમાં એવી કાંઈ શક્તિ જ નથી. તેથી કર્મ બળવાન નથી, જીવ જ પોતાના સારા-ખરાબ પરિણામોનો કર્તા છે.

**પ્રશ્ન ૨૮ :-** એક જીવમાં એક સાથે સમ્યકુમિદ્યાત્પ ક્રષ્ણ સંભવ નથી, કારણ કે આ બંને ક્રષ્ણાઓનો એક જીવમાં એક સાથે રહેવામાં વિરોધ આવે છે. આ બંને ક્રષ્ણાઓ એક જીવમાં કુમશ રહે છે, તેથી તેનું સમ્યકુત્પ અને મિદ્યાક્રષ્ણિ નામના ગુણસ્થાન માં અંતર્ભવ થઈ જશે. માટે સમ્યકુમિદ્યાક્રષ્ણિ નામનું ત્રીજું ગુણસ્થાન થતું નથી.

**ઉત્તર :-** ના, એવું નથી. સમીચીન અને અસમીચીનરૂપ (સમાન / સત્ય, અસમાન/અસત્ય) અને મિશ્ર શ્રદ્ધા એક સાથે રહી શકે છે - એવી મિશ્ર શ્રદ્ધાવાળો જીવ સમ્યકુમિદ્યાત્પી છે. આત્મા અનેક ધર્માત્મક છે. માટે આત્મામાં અનેક ધર્મોનો સહાનવસ્થાન લક્ષણરૂપ વિરોધ અસિદ્ધ છે, અર્થાત્ એક સાથે અનેક ધર્મોના રહેવામાં કોઈ બાધા નથી આવતી. જો કહેવામાં આવે કે આત્મા અનેક ધર્માત્મક છે, આ વાત પણ અસિદ્ધ છે, તેથી એ પણ કહેવું ઠીક નથી, કારણ કે અનેકાંત વગર તેનું અર્થક્રિયાકારીપણું નથી થઈ શકતું.

**પ્રશ્ન ૨૯ :-** જે ધર્મોનો એક આત્મામાં એક સાથે રહેવામાં વિરોધ નથી, તે રહે, પરંતુ સંપૂર્ણ ધર્મ તો એક સાથે આત્મામાં નહી રહી શકે?

**ઉત્તર :-** એવું કોણ કહે છે કે પરસ્પર વિરોધી અને અવિરોધી સમસ્ત ધર્મોનું એકીસાથે એક આત્મામાં રહેવું સંભવ છે? જો સંપૂર્ણ ધર્મોનું એકસાથે રહેવું માની લેવામાં આવે તો પરસ્પર વિરુદ્ધ ચૈતન્ય-અચૈતન્ય, ભવ્યત્વ-અભવ્યત્વ આઈ ધર્મોનું એકસાથે એક આત્મામાં રહેવાનો પ્રસંગ આવી જશે.

અનેકાંતનો અર્થ એ છે કે જે ધર્મોનો જે આત્મામાં અત્યંતાભાવ નથી, તે ધર્મ તે આત્મામાં કોઈ કાળે અને કોઈ ક્ષેત્રની અપેક્ષાએ ચુગપદ મળી શકે છે, આ પ્રકારે સમીચીન અને અસમીચીનરૂપ આ બંને શ્રદ્ધાઓનું કુમશ: એક આત્મામાં રહેવું સંભવ છે તો કદાચિત્ કોઈ આત્મામાં

એકસાથે પણ તે બંનેનું રહેવું થઈ શકે છે. આ બધા કથન કાલ્પનિક નથી, કારણ કે મિત્રામિત્ર જ્યાયથી એકકાળમાં અને એક જ આત્મામાં મિશ્રઝ્ઞપ પરિણામ થઈ શકે છે.

જેવી રીતે દેવદટ નામના કોઈ મનુષ્યમાં ચણાદતાની અપેક્ષાએ મિશ્રપણું અને ચૈત્રની અપેક્ષાએ અમિત્રપણું આ બંને ધર્મ એક જ કાળમાં રહે છે, તેમાં કોઈ વિરોધ નથી. આ પ્રકારે સમ્યકૃત્વ તથા મિથ્યાત્ત્વના મિશ્રભાવ પણ આત્મામાં રહે છે.

પ્રશ્ન ૩૦ :- પાંચ પ્રકારના ભાવોમાંથી ત્રીજા ગુણસ્થાનમાં ક્યો ભાવ છે?

ઉત્તર :- ત્રીજા ગુણસ્થાનમાં ક્ષાયોપશમિક ભાવ છે.

પ્રશ્ન ૩૧ :- મિથ્યાબ્રહ્મિ ગુણસ્થાનની સમ્યકૃમિથ્યાત્ત્વ ગુણસ્થાનને પ્રાંત થવાવાળા જીવના ક્ષાયોપશમિકભાવ કેવી રીતે સંભવ છે?

ઉત્તર :- સંભવ છે, કારણ કે વર્તમાન સમયમાં મિથ્યાત્ત્વ કર્મના સર્વ ધાતિ સ્પર્ધકોનો ઉદ્યાભાવી ક્ષય થવાથી અને સમ્યકૃમિથ્યાત્ત્વ કર્મના સર્વધાતિ સ્પર્ધકોનો ઉદ્ય થવાથી સમ્યકૃમિથ્યાત્ત્વ ગુણસ્થાન ઉત્પન્ન થાય છે. માટે તે ભાવ ક્ષાયોપશમિક જ છે. (સમ્યકૃજ્ઞાનંત્રિકા, પાનું ૮૮)

પ્રશ્ન ૩૨ :- ત્રીજા ગુણસ્થાનમાં સમ્યકૃમિથ્યાત્ત્વ પ્રકૃતિનો ઉદ્ય પણ છે, પછી ત્યાં ઔદ્ઘિકભાવ શા માટે નથી કહ્યો?

ઉત્તર :- ના, કારણ કે મિથ્યાત્ત્વ પ્રકૃતિના ઉદ્યથી જે પ્રકારે સમ્યકૃત્વનો સંપૂર્ણ નાશ થઈ જાય છે, તે જ રીતે સમ્યકૃમિથ્યાત્ત્વ પ્રકૃતિના ઉદ્યથી સમ્યકૃત્વનો સંપૂર્ણ નાશ નથી જોવામાં આવતો. માટે ત્રીજા ગુણસ્થાનમાં ઔદ્ઘિકભાવ ન કહી ક્ષાયોપશમિક ભાવ કહ્યો છે.

પ્રશ્ન ૩૩ :- સમ્યકૃમિથ્યાત્ત્વનો ઉદ્ય સમ્યકૃદર્શનનો પૂર્ણ વિનાશ તો કરતો નથી, તો પછી તેને સર્વધાતિ શા માટે કહ્યો?

ઉત્તર :- એવી શંકા યોગ્ય નથી, કારણ કે તે સમ્યકૃદર્શનની પૂર્ણતાનો પ્રતિબંધક છે. આ અપેક્ષાથી સમ્યકૃમિથ્યાત્ત્વને સર્વધાતિ કહ્યો છે. (વિશેષ સ્પષ્ટીકરણ માટે સત્પ્રશ્પણા સૂત્ર પાના નં ૧૩-૧૪ જુઓ.)

આચાર્યશ્રી નેમિયંગ્રસ્વામીજીએ ગોમટસાર જીવકાંડ ગાથા ૨૧માં સમ્યકૃમિથ્યાત્ત્વ ગુણસ્થાનની પરિભાષા આ પ્રમાણે આપેલ છે :-

સમ્મામિચ્છુદ્યેણ ય, જત્તતરસવ્વઘાદિકજ્જેણ ।

ણ ય સમ્મંમિચ્છંપિ ય, સમ્મિસ્સો હેદિ પરિણામો ॥

સમ્યક્ષમિદ્યાત્પ નામના દર્શનમોહનીય કર્મના ઉદ્યકાળમાં અર્થાતું નિમિત્તથી ગોળ મિશ્રિત દઈના જેવો સ્વાદ થવાવાળા જત્યંતર પરિણામોને સમ્યક્ષમિદ્યાત્પ ગુણસ્થાન કહે છે.

ગોળ મિશ્રિત દઈના જેવો સ્વાદ, તેનો અર્થ - ગોળનો સ્વાદ મીઠો અને દઈનો સ્વાદ ખાટો હોય છે. બંનેના મિશ્રણથી ખાટો-મીઠો મળેલો સ્વાદ થાય છે.

તેવી જ રીતે જીવની શ્રદ્ધાગુણની પર્યાય જ્યારે સમ્યક્ષ તથા મિદ્યા બંને રૂપ હોય છે, ત્યારે તેને ન સમ્યક્ષ કરી શકીએ છીએ, ન મિદ્યા. માટે શ્રદ્ધા ગુણની જે મિશ્રરૂપ પર્યાય થાય છે, તેને સમ્યક્ષમિદ્યાત્પ કહે છે. જ્યારે જીવની શ્રદ્ધાગુણની મિશ્રરૂપ અવસ્થા હોય છે, ત્યારે સહજ જ સમ્યક્ષમિદ્યાત્પ નામના દર્શનમોહનીય કર્મનો ઉદ્ય પણ રહે છે.

જત્યંતર શબ્દનો અર્થ અલગ જ જાતિનો અર્થાતું ન સમ્યક્ષશ્રદ્ધા અને ન વિપરીત શ્રદ્ધા છે, માટે જત્યંતર શબ્દનો પ્રયોગ કર્યો છે.

#### ચારિત્ર અપેક્ષા વિચાર:

સમ્યક્ષમિદ્યાત્પ ગુણસ્થાનમાં જીવનું ચારિત્ર મિદ્યા જ હોય છે. ચારિત્રગુણની પર્યાય શ્રદ્ધાગુણની પર્યાયનું અનુસરણ કરે છે. જો શ્રદ્ધા ચથાર્થ નથી તો ચારિત્ર ચથાર્થ ન હોઈ શકે, એવો નિયમ છે. ત્રીજા ગુણસ્થાનમાં શ્રદ્ધા ચથાર્થ નથી, માટે ચારિત્ર પણ મિદ્યા જ છે.

સૂક્ષ્મતાથી અને વાસ્તવિક રીતે જોઈએ તો સમ્યક્ષમિદ્યાત્પ ગુણસ્થાનમાં ચારિત્ર અને જ્ઞાન - બંને શ્રદ્ધાની જેમ મિશ્ર અર્થાતું સમ્યક્ષ-મિદ્યારૂપ જ હોય છે.

**કાળ અપેક્ષા વિચાર :** કોઈ જીવ આ સમ્યક્ષમિદ્યાત્પ નામનાં ત્રીજા ગુણસ્થાનમાં આવશે તો તે અંતર્મુહૂર્ત કાળ સુધી રહેશે જ.

**જધન્ય કાળ :** સર્વ લઘુ અંતર્મુહૂર્ત કાળ છે.

**ઉતૃષ્ટ કાળ :** સર્વોતૃષ્ટ અંતર્મુહૂર્ત કાળ અર્થાતું આ ગુણસ્થાનના જધન્યકાળથી આ ઉતૃષ્ટ કાળ સંખ્યાત ગુણા છે. (ધવલા. પુ. જ. પાનું ૩૪૪-૩૪૫)

#### ગમનાગમન અપેક્ષા વિચાર :

**ગમન :** (૧) સમ્યક્ષમિદ્યાત્પ ગુણસ્થાનવર્તી જીવ ઉપરના માત્ર અવિરત સમ્યક્ષત્વ ગુણસ્થાનમાં જ ગમન કરે છે, અન્ય કોઈપણ ઉપરના

ગુણસ્થાનોમાં નહીં.

(૨) જો સમ્યકુભિદ્યાત્પ ગુણસ્થાનવર્તી જીવ નીચલા ગુણસ્થાનમાં ગમન કરે છે તો તે એક માત્ર ભિદ્યાત્પ ગુણસ્થાનમાં જ ગમન કરે છે. સાસાદન ગુણસ્થાનમાં નહીં.

આગમન : મિશ્રગુણસ્થાનમાં સીધા આગમનના ચાર માર્ગ છે.

(૧) પ્રમતસંયત ગુણસ્થાનવર્તી ભાવલિંગી સંત સીધા સમ્યકુભિદ્યાત્પ ગુણસ્થાનમાં આવી શકે છે.

(૨) પંચમ ગુણસ્થાનવર્તી પ્રતી શ્રાવકનું સીધા ત્રીજા ગુણસ્થાનમાં આગમન થઈ શકે છે.

(૩) ચોથા અવિરતસમ્યકુટ્પથી પણ મિશ્ર ગુણસ્થાનમાં આવવું સંભવ છે.

આ ત્રણે ત્રીજા ગુણસ્થાનમાં આવવાવાળા ઔપશમિક અથવા ક્ષાયોપશમિક સમ્યકુફ્રાષ્ટ જ હોવા જોઈએ, કારણ કે ક્ષાયિક સમ્યકુફ્રાષ્ટ ત્રીજા ગુણસ્થાનમાં નથી આવતા, કારણ કે તેમની પાસે સમ્યકુભિદ્યાત્પ દર્શનમોહનીય કર્મની સત્તા જ નથી.

(૪) સાંદ્ર ભિદ્યાફ્રાષ્ટ, જેની સમ્યકુભિદ્યાત્પની સત્તા (અસ્તિત્વ) હોય અને કદાચ ઉદ્ય પણ આવે તો તે આ ત્રીજા ગુણસ્થાનમાં આવે છે.

**વિશેષ અપેક્ષા વિચાર :**

(૧) સમ્યકુભિદ્યાત્પ ગુણસ્થાનમાં જીવનું મરણ થતું નથી. આ મિશ્રઝપ શ્રદ્ધાનું પરિણામ જ ખોટું છે. સમ્યકુદર્શન સહિત મરણ થાય છે. ભિદ્યાત્પ પરિણામની સાથે તો જીવ અનાદિકાળથી મરતો જ આવ્યો છે, પરંતુ શ્રદ્ધાની મિશ્ર અવસ્થામાં મરણ નથી થતું અર્થાત્ તે મિશ્ર પરિણામ મરણને માટે પણ થોડ્ય નથી.

(૨) મિશ્ર ગુણસ્થાનમાં મારણાંતિક સમુદ્ધાત પણ થતો નથી.

મૃત્યુના અંતર્મુહૂર્ત પૂર્વે નવીન પર્યાય ધારણ કરવાના ક્ષેત્ર સુધી આત્મપ્રેરેશોના તેજશ - કાર્મણાશુપ ઉત્તર શરીરની સાથે બહાર નીકળવાની કિયાને મારણાંતિક સમુદ્ધાત કહે છે. મારણાંતિક સમુદ્ધાત કરવાવાળો જીવ નવીન ભવના ક્ષેત્ર/સ્થાનને સ્પર્શ કરી પાછો મૂળ શરીરમાં આવી જાય છે.

જેમણે પરલબના આચુષ્યનો બંધ કરી લીધો હોય, એવા જીવને જ મારણાંતિક સમુદ્ધાત થઈ શકે છે. જેમણે પરલબની આચુષ્યનો બંધ નથી

કર્યો, તેને મારણાંતિક સમુદ્ધાત નથી થતો. જેના આગલા જગતના ક્ષેત્ર/સ્થાન જ નિશ્ચિત ન હોય તેને મારણાંતિક સમુદ્ધાત કેમ થાય?

એકેન્ડ્રિયાંડિક કોઈ પણ બજ્જાયુષ (આચુ બાંધેલા) જીવને મારણાંતિક સમુદ્ધાત થઈ શકે છે, તેના માટે કોઈ ખાસ વિશેષતાઓની આવશ્યકતા નથી.

(૩) મિશ્ર શ્રદ્ધાવાળા સમ્યક્ મિથ્યાંક્રષ્ટિ જીવ જ્યાંસુધી આ ત્રીજા ગુણસ્થાનમાં છે, ત્યાં સુધી તેને આગળના ભવનો આચુકર્મનો બંધ નથી થતો, કારણ કે મિશ્ર અવસ્થાઓપ વિપરીતભાવ નવા આચુકર્મના બંધને માટે અયોગ્ય છે.

(૪) જે ત્રીજા ગુણસ્થાનમાં આવવાની પહેલા જીવને મિથ્યાત્વ પરિણામની સાથે આચુબંધ કર્યો હોય તો મિથ્યાત્વમાં જઈને મરણ કરે છે અને જે ત્રીજા ગુણસ્થાનમાં આવવાની પહેલા જીવને સમ્યક્ષૃત્વ પરિણામની સાથે આચુબંધ કર્યો હોય તો તે જીવ સમ્યક્ષૃત્વમાં જઈને મૃત્યુ પામે છે. (વિશેષ માટે જુઓ જીવકાં ગાથા. ૨૪, સમ્યગ્જ્ઞાન ચંદ્રિકા)

(૫) અસ્થિર શ્રદ્ધાવાળ સમ્યક્ મિથ્યાંક્રષ્ટિ જીવ મુનિજીવનને યોગ્ય સંયમને અથવા પ્રતી શ્રાવકને યોગ્ય સંયમાસંયમ પરિણામને પ્રાપ્ત નથી કરી શકતો.

(૬) તીર્થીકર નામકર્મની સત્તા જે જીવને છે, તે જીવ આ ત્રીજા ગુણસ્થાનમાં નથી આવતો. તીર્થીકર પ્રફૂતિની સત્તાવાળો જીવ એક અંતર્મૂહૂર્ત માત્ર માટે મિથ્યાત્વ ગુણસ્થાનમાં તો જઈ શકે છે, પરંતુ ત્રીજા મિશ્ર - સમ્યક્ મિથ્યાત્વ ગુણસ્થાનમાં નથી જતો.

ઘંસલા પુસ્તક ૧ નો અંશ (પાના નં. ૧૫૭ થી ૧૭૧)

સામાન્યથી સમ્યક્ મિથ્યાંક્રષ્ટિ જીવ છે. ॥૧૧॥

ક્રષ્ટિ, શ્રદ્ધા, રૂચિ અને પ્રત્યાય આ પર્યાયવારી (સમાનાથી) નામ છે. જે જીવની સમીચીન અને મિથ્યા બંને પ્રકારની ક્રષ્ટિ હોય છે, તેને સમ્યક્ મિથ્યાંક્રષ્ટિ કહે છે.

શંકા ૬: જે રીતે મિથ્યાત્વના ક્ષયોપશમથી સમ્યક્ મિથ્યાત્વ ગુણસ્થાનની ઉત્પત્તિ બતાવેલ છે, તે જ રીતે આ અનંતાનુંબંધી કર્મના સર્વધાતિ સ્પર્ધકોના ક્ષયોપશમથી થાય છે - એમ શા માટે નથી કહ્યું?

સમાધાન : ના, કારણ કે અનંતાનુંબંધી કષાય ચારિત્રનો પ્રતિબંધક છે,

માટે અહીં તેના ક્ષયોપશમથી ત્રીજું ગુણસ્થાન નથી કહેવામાં આવ્યું.

જે અનંતાનુંબંધી કર્મના ક્ષયોપશમથી ત્રીજા ગુણસ્થાનની ઉત્પત્તિ માને છે, તેના મતથી સાસાદન ગુણસ્થાનને ઓદયિક માનવું પડશે. પરંતુ એવું નથી, કારણે કે ત્રીજા ગુણસ્થાન ને ઓદયિક નથી માનવામાં આવ્યું.

અથવા, સમ્યકુપ્રહૃતિ કર્મના દેશધાતિ સ્પર્ધકોના ઉદ્યક્ષય થવાથી સત્તામાં સ્થિત તે જ દેશધાતિ સ્પર્ધકોનો ઉદ્યભાવ લક્ષણ ઉપશમ થવાથી અને સમ્યકુમિથ્યાત્વ કર્મના સર્વધાતિ સ્પર્ધકોનો ઉદ્ય થવાથી સમ્યકુમિથ્યાત્વ ગુણસ્થાન ઉત્પન્ન થાય છે. માટે તે ક્ષયોપશમિક છે. અહીં આ રીતે જે સમ્યકુમિથ્યાત્વ ગુણસ્થાનને ક્ષયોપશમિક કહ્યું છે, તે કેવળ સિદ્ધાંતના પાઠોને પ્રારંભ કરવાવાળાઓને પરિજ્ઞાન કરાવવા માટે કહેવામાં આવેલ છે.

વાસ્તવમાં તો સમ્યકુમિથ્યાત્વ કર્મ નિરન્વયરૂપથી આપ્ત, આગમ અને પદાર્થ - વિષયક શદ્ધાનો નાશ કરવા પ્રતિ અસમર્થ છે, પરંતુ તેના ઉદ્યથી સત્ત સમીચીન અને અસત્ત અસમીચીન પદાર્થને યુગપદ વિષય કરવાવાળી શદ્ધા ઉત્પન્ન થાય છે, માટે સમ્યકુમિથ્યાત્વ ગુણસ્થાન ક્ષયોપશમિક કહેવામાં આવે છે.

જે આ ગુણસ્થાનમાં સમ્યકુમિથ્યાત્વ પ્રકૃતિના ઉદ્યથી સત્ત અને અસત્ત પદાર્થને વિષય કરવાવાળી મિશ્ર ઇચ્છિકપ ક્ષયોપશમતા ન માનવામાં આવે તો ઉપશમ સમ્યકુફ્રષ્ટિના સમ્યકુમિથ્યાત્વ ગુણસ્થાનની પ્રાપ્તિ થવા પર તે સમ્યકુમિથ્યાત્વ ગુણસ્થાનમાં ક્ષયોપશમપણું નથી થઈ શકતું, કારણ કે ઉપશમ સમ્યકૃત્વથી તૃતીય ગુણસ્થાનમાં આવેલ જીવની આવી અવસ્થામાં સમ્યકુપ્રહૃતિ, મિથ્યાત્વ અને અનંતાનુંબંધી આ ત્રણોનો ઉદ્યાભાવી ક્ષય જોવામાં નથી આવતો.

**શંકા 7 :** ઉપશમ સમ્યકૃત્વથી આવેલા જીવના તૃતીય ગુણસ્થાનમાં સમ્યકુપ્રહૃતિ મિથ્યાત્વ અને અનંતાનુંબંધી આ ત્રણોનો ઉદ્યાભાવરૂપ ઉપશમ તો જોવામાં આવે છે?

**સમાધાન :** ના, કારણ કે આ રીતે તો ત્રીજા ગુણસ્થાનમાં ઔપશમિકભાવ માનવો પડશે.

**શંકા 8 :** તો ત્રીજા ગુણસ્થાનમાં ઔપશમિકભાવ જ રહ્યો આવે ?

**સમાધાન :** ના, કારણે ત્રીજા ગુણસ્થાનમાં ઔપશમિકભાવનું પ્રતિપાદન

કરવાવાળું કોઈ આર્ધવાક્ય નથી. અર્થાતું આગમમાં ત્રીજા ગુણસ્થાનમાં ઔપશમિકલાવ નથી બતાવ્યો.

બીજું, જો ત્રીજા ગુણસ્થાનમાં મિદ્યાત્વ આદિ કર્મોના ક્ષયોપશમથી ક્ષયોપશમભાવની ઉત્પત્તિ માની લઈએ તો મિદ્યાત્વ ગુણસ્થાનને પણ ક્ષયોપશમિક માનવું પડશે, કારણે સાચિ મિદ્યાક્રષ્ટિની અપેક્ષા મિદ્યાત્વ ગુણસ્થાનમાં પણ સમ્યક્પ્રહૃતિ અને સમ્યક્મિદ્યાત્વ કર્મના ઉદ્દ્ય અવસ્થાને પ્રાપ્ત થયેલ સ્પર્ધકોનો ક્ષય થવાથી, સત્તામાં સ્થિત તેમનો જ ઉદ્દ્યાભાવ લક્ષણ ઉપશમ થવાથી તથા મિદ્યાત્વકર્મના સર્વધાતિ સ્પર્ધકોનો ઉદ્દ્ય થવાથી મિદ્યાત્વ ગુણસ્થાનની ઉત્પત્તિ જોવામાં આવે છે. આટલા કથન (વિદ્યાન)થી આ તાત્પર્ય સમજવું જોઈએ કે ત્રીજા ગુણસ્થાનમાં મિદ્યાત્વ, સમ્યક્પ્રહૃતિ, અને અનંતાનુભંધીના ક્ષયોપશમથી ક્ષયોપશમિક ભાવ ન થઈ ને માત્ર મિશ્ર પ્રહૃતિના ઉદ્દ્યથી મિશ્રભાવ હોય છે.

### ગુરુભક્તિનું અન્યથા રૂપ

કેટલાંચે જીવ આજાનુસારી છે. તે તો - આ જૈનના સાધ્ય છે, અમારા ગુરુ છે, માટે તેઓની ભક્તિ કરવી જોઈએ - એવો વિચાર કરી તેઓની ભક્તિ કરે છે અને કેટલાંચે જીવ પરીક્ષા પણ કરે છે. ત્યાં આ મુનિ દયા પાળે છે, શીલ પાળે છે, ધનાદિ રાખતા નથી, ઉપવાસાદિ તપ જ્ઞ છે, ક્ષુદ્રાદિ પરિષ્હ સહે છે, કોઈના પર છોધાદિ નથી કરતા, ઉપરોક્ત આપી અન્યને ધર્મમાં લગાડે છે - ઈત્યાદિ ગુણોનો વિચાર કરી તેમાં ભક્તિભાવ કરે છે. પરંતુ એવા ગુણ તો પરમહંસાદિક અન્યમતિઓમાં તથા જૈની મિદ્યાક્રષ્ટિઓમાં પણ જોવામાં આવે છે, માટે એમાં અતિવ્યાખ્યપણું છે, તેના દ્વારા સાચી પરીક્ષા નથી થતી.

તથા જે ગુણોનો વિચાર કરે છે, તેમાં કેટલાંચે જીવાશ્રિત છે, કેટલાંચે પુદ્ગલાશ્રિત છે, તેઓને વિશેષ ન જાણતાં થકા અસમાનજાતીય મુનિપર્યાયમાં એકત્રારૂપ થી મિદ્યાક્રષ્ટિ જ રહે છે. તથા સમ્યક્દર્શન જ્ઞાન ચારિત્રની એકત્રારૂપ મોક્ષમાર્ગ તે જ મુનિઓનું સાચું લક્ષણ છે, તેને નથી ઓળખતા, કારણ કે આ ઓળખાણ થઈ જાય તો મિદ્યાક્રષ્ટિ રહે નહીં. આ રીતે જો મુનિઓનું સાચું સ્વરૂપ જ નહીં જાણે તો સાચી ભક્તિ કેવીરીતે થશે? પુણ્યબંધના કારણભૂત શુલક્ષયારૂપ ગુણોને ઓળખી તેઓની સેવાથી પોતાનું ભલું જાણી તેમાં અનુરાગી થઈ ભક્તિ કરે છે.

૪

### અવિરતસમ્યકૃત્પ ગુણસ્થાન

ચોથા ગુણસ્થાનનું નામ અવિરતસમ્યકૃત્પ છે. આ ગુણસ્થાનની વિસ્તારપૂર્વક ચર્ચા કરતાં પહેલા ચોથા ગુણસ્થાનમાં દર્શનમોહનીય કર્મનું શું નિમિત્તપણું છે, તેનું સ્પષ્ટીકરણ કરીએ છીએ :-

(૧) જો જીવ ઔપશમિક સમ્યકૃત્પણી હોય તો દર્શનમોહનીયની ત્રણા, બે કે એક કર્મ પ્રકૃતિનું અને ચારિત્ર મોહનીયની અનંતાનુંબંધી કષાય ચતુષ્ટય કર્મપ્રકૃતિનું - એ રીતે સાત, છ અથવા પાંચ પ્રકૃતિઓનો ઉપશમ હોય છે.

(૨) જો જીવ ક્ષાયોપશમિક સમ્યકૃત્પણી હોય તો ભિદ્યાત્પ, સમ્યકૃમિદ્યાત્પ તથા અનંતાનુંબંધી કષાય ચતુષ્ટય આ પ્રકારે છ કર્મ પ્રકૃતિઓના ક્ષાયોપશમ અર્થાત્ સર્વધાતિ સ્પર્ધકોનો ઉદ્યાભાવી ક્ષય અને સદઅપસ્થાનુપ ઉપશમ રહે છે અને દેશધાતિ સમ્યકૃપ્રકૃતિ દર્શન મોહનીય કર્મનો ઉદ્ય રહે છે.

એટલું વિશેષ છે કે અનંતાનુંબંધી કષાય ચતુષ્ટય, ભિદ્યાત્પ તથા સમ્યકૃમિદ્યાત્પ આ છ એ પ્રકૃતિઓ ઉદ્યાવલીમાં તો રહે છે, પરંતુ ઉદ્યથી એક સમય પૂર્વ સ્તિબુક સંક્રમણ દ્વારા ચથાયોગ્ય અન્ય પ્રકૃતિઓમાં સંક્રમિત થઈને ઉદ્યમાં આવે છે.

(૩) જો જીવ ક્ષાયિક સમ્યકૃત્પણી હોય તો ભિદ્યાત્પાદ ત્રણ દર્શનમોહનીય અને અનંતાનુંબંધી કષાય ચતુષ્ટયનો ક્ષય રહે છે.

આચાર્યશ્રી નેમિયંબ્રેદે ગોમ્મટસાર જીવકાંડ ગાથા રદમાં અવિરત સમ્યકૃત્પ ગુણસ્થાનની પરિભાષા આ પ્રમાણે આપેલ છે : -

**ણો ઝંદિયેસુ વિરદો, ણો જીવે થાવરે તસે વાપિ ।**

**જો સદ્વદિ જિણુત્તાં, સમ્માઝ્ઞી અવિરદો સો ॥**

જે પરિણામ સમ્યકુદર્શનથી સહિત હોય, પરંતુ ઈન્દ્ર્ય વિષયોથી અને ત્રસ -સ્થાવરની હિસાથી અવિરત હોય અર્થાત્ એકદેશ કે

સર્વદિશ કોઈ પણ પ્રકારના સંયમથી રહિત હોય, તે પરિણામને અવિરત સમ્યકૃત્વ ગુણસ્થાન કહે છે.

અહીં ચોથા ગુણસ્થાનમાં સમ્યકૃત્વના ઘાતક કર્મોનો ઉપશામ, ક્ષય અથવા ક્ષયોપશામ થઈ ગયો છે. તેથી વ્યવહાર અને નિશ્ચય બંને સમ્યકૃત્વના પ્રગટ થઈ ગયા છે. મોક્ષમાર્ગનો પ્રારંભ, આંશિક વીતરાગતા, સંવર-નિર્જરા, સાચું સુખ, સમ્યકૃત્વના - આ બધું અહીં અવિરત સમ્યકૃત્વ ગુણસ્થાનમાં એકસાથે જ વ્યક્ત થાય છે.

નિશ્ચિત સમ્યકૃત્વના સાથે જ્યાં શુભરાગના અર્થાત્ પુણ્ય પરિણામનો વિષય સાચા દેવ-શાસ્ત્ર-ગુરુ હોય છે, તેને જ વ્યવહાર સમ્યકૃત્વના કહે છે. તેથી બંને સમ્યકૃત્વના એક સાથે જ ઉત્પન્ન થાય છે.

ચોથા ગુણસ્થાનથી જ તીર્થકર નામકર્મનો બંધ પ્રારંભ થાય છે. તીર્થકર નામકર્મના બંધનું કાર્ય કોઈ જીવ નિશ્ચય સમ્યકૃત્વના અભાવમાં કેવી રીતે કરી શકે ?

સાધકના જીવનમાં વ્યવહાર (વ્યવહારાલાસ)ની સાથે નિશ્ચય હોય પણ શકે અને ન પણ હોય એવું પણ સંભવ છે, પરંતુ નિશ્ચયની સાથે સાધકને વ્યવહાર અર્થાત્ ચથાર્થ વ્યવહાર તો નિયમથી હોય જ છે. એવું જ વસ્તુસ્પર્શ સર્વજ્ઞ ભગવાને પ્રરૂપેલ આગમમાં વર્ણિયેલું છે. રહસ્યપૂર્ણ ચિહ્નીમાં - મોક્ષમાર્ગ પ્રકાશક પાનાનં.૩૪૪ પર લખ્યું છે, “ચોથા ગુણસ્થાનમાં સિદ્ધસમાન ક્ષાચિક સમ્યકૃત્વના થઈ જાય છે.” તેથી આગમાનુસાર સર્વ કથન ચથાર્થ જાળાવું જોઈએ.

ચોથા ગુણસ્થાનમાં માત્ર એક કષાય ચોકડીનો જ અભાવ છે. તે કારણે આંશિક વીતરાગતા પણ છે, પરંતુ ન તો બે કષાય ચોકડીનો અભાવ છે અને ન અણુદ્રતોના ગ્રહણરૂપ રાગભાવ અર્થાત્ પુણ્ય પરિણામ છે. તેથી ચતુર્થ ગુણસ્થાનવર્તી જીવને અવિરતિ છે.

**અવિરતિનું સ્પષ્ટીકરણ :** પંચેનિક્રય અને મનના વિષયોમાં પ્રવૃત્તિ અને બદ્ધકાય જીવોની હિંસાથી અવિરતિ - આ અવિરતીના ૧૨ ભેદ છે. ઉપર્યુક્ત અવિરતિનો કિંચિત્ પણ ત્વાગ આ જીવોને નથી હોતો, પરંતુ અવિરતિમાં પ્રવૃત્તિ હેયબુદ્ધિથી રહે છે તથા આગમ અનુસાર સદાચાર તો અવશ્ય હોય જ છે. સ્પર્શનાંદી પાંચ ઈનિક્રયોના વિષય - સ્પર્શ, રસ, ગંધ, વર્ણ અને

શબ્દોમાં પ્રવૃત્ત થવું તથા યશ, પ્રસિદ્ધિ આદિ પાપરૂપ વિકલ્પોમાં મનથી પ્રવૃત્તિ કરવી આને ઈજીઝ્યો અને મનના વિષયોમાં પ્રવૃત્તિ કહે છે. આ પાંચ પ્રકારની ઈજીઝ્યો અને મનથી સંબંધિત છ લેદરૂપ અવિરતી થઈ ગઈ. અવિરત સમ્યકુષ્ટભિના જીવનમાં આ પ્રકારે છ પ્રકારની અવિરતિ તો પૂર્વ સંસ્કારવશ હેચુદુદ્યથી રહે જ છે.

પૃથ્વીકાચિક, જલકાચિક, અત્રિકાચિક, વાયુકાચિક અને વનસ્પતિકાચિક જીવોને પાંચ સ્થાવરકાય કહે છે અર્થાત્ એકેજીઝ્ય જીવોને સ્થાવર કહે છે. બે ઈજીઝ્યાદિથી લઇને સંજી પંચેજીઝ્ય સુધીના સર્વ જીવોને ત્રસ કહે છે.

પાંચ સ્થાવરકાય અને એક ત્રસકાય - આ પ્રકારે છકાય જીવ છે. સમ્યકુષ્ટભિ જીવ આ છકાય જીવોની હિંસા ન દર્શાતી પણ તેમની હિંસાથી પૂર્વ સંસ્કારવશ તથા પોતાની કમજોરીને કારણ વિરત નથી. આ રીતે સમ્યકુષ્ટભિ જીવ ઈજીઝ્ય અસંયમ અને પ્રાણી અસંયમને કારણ અવિરત છે. આ અવિરતિમાં અપ્રત્યાખ્યાનાવરણકષાય કર્મનો ઉદ્ય પણ નિમિત્તરૂપ રહે છે.

જુઓ પરિણામોની વિચિત્રતા ! સમ્યકુદર્શન થઈ ગયું છે, વચ્ચે - વચ્ચે ચથાચોગ્ય કાલાવધિ વ્યતીત થવા પર આત્માનુભવ પણ થાય છે. ગૃહીત તથા અગૃહીત મિથ્યાત્વનો અભાવ તો થઈ જ ગયો છે. અનંતાનુંબંધી કષાય ચોકડીના અનુદ્યપૂર્વક આંશિક વીતરાગતા પ્રગત થઈ ગઈ છે. જીવન અન્યાય, અનીત અને અભક્ષયથી રહિત છે. અનંત સંસારને સાંત/સીમિત કરેલ છે, છતાં પણ બાર પ્રકારની અવિરત હોવા છતાં પણ, મોક્ષની સાધના કરવાવાળા સાધકના પુરુષાર્થીના હીણપણાથી આ જીવ ઈજીઝ્યસંયમ અને પ્રાણીસંયમના અભાવને કારણે અવિરત જ છે.

આચાર્યશ્રી નેમિચંદ્રદેવે ગોમ્મટસાર જીવકાંડ ગાથા રકમાં અવિરત સમ્યકુષ્ટ ગુણસ્થાનની પરિભાષા આ પ્રમાણે આપેલ છે -

**સત્તણહં ઉવસમદો, ઉવસમસમ્મો ખયાદુ ખડ્યો ય ।**

**બિદિયકસાયુદ્યાદો, અસંજદો હોદિ સમ્મો ય ॥**

અપ્રત્યાખ્યાનાવરણ કષાય કર્મના ઉદ્યથી અસંયત હોવા છતાં પાંચ, છ કે સાત (અનંતાનુંબંધીની ચાર અને દર્શનમોહનીયની ત્રણ) પ્રકૃતિઓના ઉપશમ, ક્ષય, ક્ષયોપશમની દશામાં થવાવાળા જીવના

ઔપશમિક, ક્ષાચિક તથા ક્ષાયોપશમિક ભાવોને અવિરતસમ્યકૃત્વ ગુણસ્થાન કહે છે.

પ્રથમ “અપ્રત્યાખ્યાન” શબ્દનો અર્થ કરીશું. “અ” શબ્દનો અર્થ કિંચિત્ છે. “પ્રત્યાખ્યાન” શબ્દનો અર્થ ત્યાગ છે. જે કષાય કર્મ કિંચિત્ પણ ત્યાગ ન થવામાં નિમિત્ત છે, તેને અપ્રત્યાખ્યાનાવરણ કષાય કર્મ કહે છે.

જેવી રીતે - જીવ જ્યારે પોતાના પુરુષાર્થીની હીનતાથી કિંચિત્ પણ અર્થાત્ અણુપ્રતઃપ પણ સંયમાસંયમ ભાવ પ્રગટ નથી કરતો અથવા મહાપ્રતઃપ સંયમભાવ પણ પ્રગટ નથી કરતો, ત્યારે અપ્રત્યાખ્યાનાવરણાદિ કષાય કર્મોના નિમિત્તઃપથી ઉદ્ય રહે જ છે. એવા સમ્યકૃત્વાદિ જીવને અવિરતસમ્યકૃત્વાદિ કહે છે.

### સમ્યકૃત્વ અપેક્ષા વિચાર:

ચોથા અવિરતસમ્યકૃત્વ ગુણસ્થાનમાં વિવિધ જીવોની અપેક્ષાથી ઔપશમિક, ક્ષાયોપશમિક અને ક્ષાચિક - આ ત્રણે સમ્યકૃત્વ રહી શકે છે. એક જીવને એક સમયમાં એક જ સમ્યકૃત્વ રહે છે. ત્રણે સમ્યકૃત્વોમાં થથાર્થ શ્રદ્ધારૂપ ધર્મની અપેક્ષાથી સમાનતા હોવા છતાં પણ અન્ય અપેક્ષાઓથી અસમાનતા પણ છે. પ્રથમ સમાનતા કહીએ છીએ :-

(૧) ત્રણેચ સમ્યકૃત્વીના નવા કર્મોના બંધની અપેક્ષાએ સમાનતા છે. ત્રણે સમ્યકૃત્વોમાં ૪૧ પ્રકૃતિઓનો બંધ નથી થતો.

(૨) ત્રણેચ સમ્યકૃત્વી ચોથા ગુણસ્થાનવર્તી જ છે.  
હવે અસમાનતા કહીએ છીએ - પ્રથમ ક્ષાચિક સમ્યકૃત્વીની વિરોધતાને બતાવીએ છીએ -

(૧) ક્ષાચિક સમ્યકૃત્વની પહેલા બે વાર ત્રિકરણ પરિણામ થાય છે. પ્રથમ ત્રિકરણ પરિણામ દ્વારા અનંતાનુંબંધી ચતુર્ષયનું વિસંયોજન થાય છે, પછી દર્શનમોહનીયના નાશ માટે ત્રિકરણ પરિણામ થાય છે. જ્યારે ઔપશમિક સમ્યકૃત્વ માટે એકવાર જ ત્રિકરણ પરિણામ આવશ્યક રહે છે.

(૨) ઔપશમિક સમ્યકૃત્વીના સમ્યકૃત્વ વિરોધી સાતે પ્રકૃતિઓની સત્તા બની રહે છે. તથા કાળ પણ અંતર્મુહૂર્ત માત્ર છે. જ્યારે ક્ષાચિક સમ્યકૃત્વીના સમ્યકૃત્વ વિરોધી જ પ્રકૃતિની સત્તા નથી અને કાળ

સાઈ અનંત છે, તેથી નિત્ય છે.

(૩) ક્ષાયોપશમિક સમયે - સમયે ગુણ શ્રેણી નિર્જરા કરે છે.

(૪) પૂર્વમાં મનુષ્ય કે તિર્યાચાયુનો બંધ ન હોવાની દશામાં તે જ ભવમાં અથવા ત્રીજા જ ભવમાં મોક્ષ પ્રાપ્ત કરે છે.

હવે ક્ષાયોપશમિક સમયકૃત્વની અપેક્ષાએ અસમાનતાને કહે છે.

(૧) આ સમયકૃત્વમાં સમયકૃત્વમોહનીયનો ઉદ્ય હોવાથી ચલ-મલ અગાઢ દોષ હોય છે.

(૨) આનો નાશ થવામાં વાર નથી લાગતી.

(૩) આ સમયકૃત્વ પલ્યના અસંખ્યાતમાં ભાગ વાર છૂટી શકે છે.

(૪) આને માટે ત્રિકરણ પરિણામ આવશ્યક નથી.

(૫) ક્ષાયોપશમિક સમયકૃત્વમાં ગુણશ્રેણી નિર્જરા નથી થતી, આ કારણથી આ સમયકૃત્વની સાથે શ્રેણી ચડવાનો અપૂર્વ પુરુષાર્થ નથી થઈ શકતો. જે, જેટલા અને જેવા ભેદ છે તેને પણ સ્વીકાર કરવો જોઈએ. (ઉપશમાદિની પરિલાખાઓ પ્રશ્નોત્તર વિલાગમાં છે, ત્યાંથી જાણી લેવી.)

**સમયકૃત્વનો કાળ :** ઔપશમિક સમયકૃત્વનો જધન્ય કાળ તથા ઉત્કૃષ્ટકાળ પણ અંતર્મુહૂર્ત જ છે. છતાં જધન્યકાળથી ઉત્કૃષ્ટકાળ સંખ્યાત ગણો વધારે છે. અંતર્મુહૂર્ત કાળના અસંખ્યાત ભેદ છે, માટે તેના નાનું અંતર્મુહૂર્ત, મોટું અંતર્મુહૂર્ત, મદ્યમ અંતર્મુહૂર્ત એવા અનેક ભેદ છે.

ક્ષાયોપશમિક સમયકૃત્વનો જધન્યકાળ માત્ર અંતર્મુહૂર્ત છે અને ઉત્કૃષ્ટકાળ કક સાગર છે. અથવા એક અંતર્મુહૂર્ત ઓછા એક કક સાગર પછી એક અંતર્મુહૂર્ત માટે મિશ્ર ગુણસ્થાનમાં આવીને ફરીથી ક્ષાયોપશમિક સમયકૃત્વની સાથે કક સાગર સુધી રહી શકે છે. ચથાયોગ્ય અંતર્મુહૂર્ત અધિક એક સમય, બે સમય આદિથી લઇને અંતર્મુહૂર્ત ઓછા કક સાગર સુધી વચ્ચે થવાવાળા કાળના સર્વ ભેદ ક્ષાયોપશમિક સમયકૃત્વના મદ્યમકાળના પ્રકાર થઈ શકે છે.

**પ્રશ્ન ૩૪ :** પ્રથમવાર ઔપશમિક સમયકૃત્વ થયા પછી એકવાર મિથ્યાત્વમાં જવું અનિવાર્ય છે શું?

**ઉત્તર :** ના, પ્રથમવાર ઔપશમિક સમયકૃત્વ થયા પછી કોઈક જીવ મિથ્યાત્વમાં જઈ શકે છે. પરંતુ મિથ્યાત્વમાં જવું અનિવાર્ય નથી, કારણ

કે ઔપશમિક સમ્યકૃત્વનો કાળ પૂરો થયાબાદ જીવ ક્ષાયોપશમિક સમ્યકૃત્વિ, સમ્યક્તિયાક્રષિ, સાસાદન સમ્યકૃત્વિ પણ થઈ શકે છે. આ વિષયના વિશેષ સ્પષ્ટ ખુલાસા માટે ઘયદલા પુસ્તક -૫. પાનું. રેઝર (૧, ૮, ૮૮) ગાથા ૧૨ તથા જ્યઘયદલા પુસ્તક ૧૨ ગાથા ૧૦૩ અને ૧૦૫ ને ટીકા સાથે જુઓ.

અહીં ગાથા કમાંક ૧૦૫નો અર્થ તથા ટીકાનું અનુવાદ આપીએ છીએ. સમ્યકૃત્વના પ્રથમ લાભના અનંતરપૂર્વ પાછલા સમયમાં મિથ્યાત્વ જ હોય છે. અપ્રથમ લાભના અનંતરપૂર્વ પાછલા સમયમાં મિથ્યાત્વ ભજનીય છે ॥ ૧૧-૧૦૫॥

અહીં ગાથા સમ્યકૃત્વને ગ્રહણ કરવાવાળા જીવના અનંતરપૂર્વ પાછલા સમયમાં શું મિથ્યાત્વનો ઉદ્દય છે અથવા નથી એવી પુછા થવાથી તેનો નિર્ણય કરવા માટે આવી છે. હવે એનો અર્થ કહે છે. જેમ કે - અનાદિ મિથ્યાક્રષિ જીવના સમ્યકૃત્વનો જે પ્રથમ લાલ થાય છે. તેના ‘અણાંતરં પચ્છદો’ અર્થાત્ અનંતરપૂર્વ પાછલી અવસ્થામાં મિથ્યાત્વ જ હોય છે, કારણ કે તેની પ્રથમ સ્થિતિનો અંતિમ સમય પ્રાપ્ત થવા સુધી મિથ્યાત્વના ઉદ્દયને છોડી પ્રકારાંતર સંભવ નથી.

‘લંભસ્સ અપદમસ્સ દુ’ અર્થાત્ જે નિયમથી અપ્રથમ અર્થાત્ દ્વિતીયાદિ વાર સમ્યકૃત્વનો લાભ છે તેના અનંતરપૂર્વ પાછલી અવસ્થામાં મિથ્યાત્વનો ઉદ્દય ભજનીય છે. કદાચિત્ મિથ્યાક્રષિ થઇને વેદક સમ્યકૃત્વ કે ઉપશમ સમ્યકૃત્વને પ્રાપ્ત કરે છે અને કદાચિત્ સમ્યક્તિ થઇને વેદક સમ્યકૃત્વને પ્રાપ્ત કરે છે આ ઉપરની ગાથા-સૂત્રનો ભાવાર્થ છે.

(જ્યઘયદલા પુસ્તક - ૧૨, પાનુ. ૩૭)

પ્રશ્ન ૩૫: જેણે આજે જ સમ્યકૃત્વની પ્રાપ્તિ કરી છે અને જેણે અનેક વર્ષો પહેલા સમ્યકૃત્વની પ્રાપ્તિ કરી છે - આ બંને જીવોની શ્રદ્ધાળી તથા ચારિત્રની શુદ્ધિમાં કાંઈ અંતર હશે કે નહીં ?

ઉત્તર: સામાન્ય કથનની અપેક્ષાથી બંનેને મિથ્યાત્વ અને અનંતાનુંબંધી એક જ કથાય ચોકડીના અનુદ્દયપૂર્વક વ્યક્ત વીતરાગતા સમાન રહે છે, છતાંચ શેષ ત્રણ કથાય ચોકડીની મંદ, મંદતર, મંદતમ ઉદ્યાનુસાર તથા વ્યક્તિગત પુરુષાર્થ અનુસાર અંતર પણ રહે છે.

ચારિત્ર અપેક્ષા વિચાર:

સમ્યકુદર્શન એકલું નથી હોતું. તેની સાથે જ્ઞાન અને ચારિત્ર પણ સમ્યક થાય જ છે, એટલું જ નહીં આત્માના અન્ય અનંતગુણોમાં પણ આંશિક શુદ્ધતા પ્રગટ થાય છે. ‘સર્વ ગુણાંશ તે સમ્યકૃત્વ’ એવો ઉલ્લેખ પણ આગમમાં મળે છે. આનો ભાવ એ છે કે સમ્યકૃત્વ થવા પર આત્માના ચારિત્ર આદિ અનંત ગુણોમાં સમ્યકૃપણું નિયમથી થઈ જાય છે. પ્રતૃપ સંયમ ન હોવાથી ચોથા ગુણસ્થાનવર્તી જીવને અવિરત કહ્યો છે. છતાં પણ સમ્યકુદર્શનનો અવિનાભાવી અનંતાનુંબંધીના અભાવપૂર્વક થવાવાળું સમ્યકૃત્વાચરણ/સ્વતૃપાચરણ ચારિત્ર તો હોય જ છે.

અણુવ્રતો કે મહાપ્રતોનું પાલન ન હોવાથી ચતુર્થ ગુણસ્થાનવર્તીને ચરણાનુયોગ અસંયમી કહે છે. ગુણસ્થાન આ વિષય કરણાનુયોગનો છે અને કરણાનુયોગ આ સમ્યકુક્રિયાને અવિરત જ કહે છે.

હવે કરણાનુયોગની જ અન્ય અપેક્ષાઓથી થોડો વિચાર કરીએ. ચારિત્રમોહનીય કર્મની અનંતાનુંબંધી કષાય ચોકડી આ ચોથા ગુણસ્થાનમાં નિયમથી નથી. આ કષાય ચોકડીના અભાવથી ચારિત્રગુણમાં આંશિક નિર્મળતા અથવા અલ્પ વીતરાગતા અહીં ચોથા ગણું છે. સૂક્ષ્મ વિષયોના કથન કરવાવાળા કરણાનુયોગ શાસ્ત્રની ફ્રાણિથી સતર્ક સિદ્ધ થવાથી અહીં ચારિત્ર પ્રમાણિત જ છે. તથા તેના બાધક કારણનો પણ અભાવ છે.

ક્રિયાનુયોગની અપેક્ષાએ પણ ચતુર્થ ગુણસ્થાનમાં સ્વતૃપાચરણ ચારિત્ર છે જ. વસ્તુતઃ તો સ્વતૃપમાં આચરણ કરવું જ ચારિત્ર છે. આ વિષયને આચાર્યશ્રી અમૃતચંદ્રદેવે પ્રવચનસાર ગ્રંથની ગાથા નં. ૭ની ટીકામાં સ્પષ્ટ કહ્યું છે - “સ્વતૃપમાં ચરણ કરવું (રમવું) તે ચારિત્ર છે. સ્વસમયમાં પ્રવૃત્તિ કરવી એવો આનો અર્થ છે.” આચાર્યશ્રી જયસેનદેવે પણ કહ્યું છે. - “શુદ્ધ ચૈતન્ય સ્વતૃપમાં આચરણ- પ્રવૃત્તિ-લીનતા ચારિત્ર છે.”

આચાર્ય કુંદુંદેવે આને જ “સમ્યકૃત્વાચરણ ચારિત્ર” નામ આપ્યું છે. ચોથા ગુણસ્થાનમાં જો આંશિક વીતરાગતા પ્રગટ થઈ ગઈ છે તો ચારિત્ર તો છે જ.

સમ્યકૃદર્શનનો અવિનાભાવી કે સહ્યારી હોવાથી સ્વરૂપાચરણ ચારિત્રને જ સમ્યકૃત્વાચરણ ચારિત્ર નામ આપવામાં આવ્યું છે. સિદ્ધોને અનંત અતિનિંદ્રિય સુખ પ્રગટ થઈ જાય છે. તેમના અનંતસુખના અનંતમાં ભાગરૂપ સાચું સુખ સમ્યકૃક્રિયને પણ પ્રગટ થઈ ગયું છે, કારણ કે તેણે અનંતસંસારને આત્મસ્વભાવના થથાર્થ શ્રદ્ધાનથી સીમિત કરી દીધો છે.

કરણાનુયોગની અપેક્ષાથી પણ અનંતાનુંબંધી ચારિત્રમોહનીય કર્મના અનુદ્યરૂપ અભાવ થવાથી અર્થાત્ પ્રતિબંધક કારણનો અભાવ થવાથી વીતરાગતાની અભિવ્યક્તિરૂપ ચારિત્ર સિદ્ધ થાય જ છે.

૫૮ સમ્યકૃત્વાચરણ ચારિત્ર શબ્દનો પ્રયોગ આચાર્યશ્રી કુંદકુંદદેવે અષ્ટપાહુડ ગ્રંથના ચારિત્ર પાહુડની ગાથા આઠ તથા નવમાં કર્યો છે. સ્વરૂપાચરણ ચારિત્ર શબ્દનો પ્રયોગ-ધ્વલા પુસ્તક -૧, પાનાનં. ૧૫૮માં અને પં. સદાસુખદાસજી હૃત રત્નકર્ણકાચારમાં અનેક જગ્યાએ આવ્યો છે.

ગુરુ ગોપાલદાસજી બોરેયાએ જેણ સિદ્ધાંત પ્રવેશિકાના પ્રશ્ન નં. ૨૨૨ના ઉત્તરમાં સ્વરૂપાચરણ ચારિત્ર આપેલ છે તથા પ્રશ્ન ૨૨૩ના ઉત્તરમાં તેની પરિભાષા બતાવી છે.

### કાળ અપેક્ષાએ વિચાર :

ચોથા ગુણસ્થાનના આ પ્રકરણમાં જ પહેલા સમ્યકૃત્વના કાળનું વર્ણિન કર્યું છે અને અહીં હવે અવિરત સમ્યકૃત્વ નામના ચોથા ગુણસ્થાનના કાળ સંબંધી સ્પર્ધીકરણ કરવામાં આવે છે.

**જધન્ય કાળ :** ચોથા ગુણસ્થાનનો જધન્યકાળ અંતર્મુહૂર્ત છે. ચારેય ગતિમાં જીવ સમ્યકૃત્વની પ્રાસિ કરી શકે છે. એક લયથી અન્ય લયમાં સમ્યકૃત્વ લઈને જઈ પણ શકે છે.

જો કોઈ જીવ એકેદેશ સંયમ અથવા સવદિશ સંયમ વગર અર્થાતું પાંચમાં કે છઢા-સાતમાં ગુણસ્થાન વગર માત્ર સમ્યકૃદર્શન સહિત ચોથા અવિરત સમ્યકૃત્વ ગુણસ્થાનમાં ઓછામાં ઓછો કાળ રહે તો તે માત્ર એક અંતર્મુહૂર્ત જ રહી શકે છે.

એક અંતર્મુહૂર્તથી ઓછું એટલે કે એક સમય, બે, ત્રણ, ચાર સમય આદિ અથવા એક આવલી કાળ સુધી નથી રહી શકતો. આ અવિરત સમ્યકૃત્વ ચતુર્થ ગુણસ્થાનવર્તી જીવના જધન્યકાળનું કથન થયું.

**ઉત્કૃષ્ટ કાળ :** સાધિક ૩૩ સાગર છે. અનુતરવાસી દેવોમાં એક સમય ઓછો ૩૩ સાગર સુધી અવિરતસમ્યકૃત્વ અર્થાત् ચોથું ગુણસ્થાન રહે છે. અનુતરવાસી દેવ સ્વર્ગથી ચ્યુત થઈને પૂર્વકોટી વર્ષની આચુવાળા મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે. ત્યાં તે અંતર્મુહૂર્ત પ્રમાણ આચુ બાકી રહેવા સુધી અવિરત સમ્યકૃત્વિ થઈને રહે તો એક સમય ઓછો ૩૩ સાગર અને અંતર્મુહૂર્ત ઓછો કોટિપૂર્વ કાળ સુધી ચોથા ગુણસ્થાનનો ઉત્કૃષ્ટ કાળ હોય છે. (ઘવલા પુ. જ. પાનું. ૩૪૭ - ૩૪૮)

આ અપેક્ષાએ અવિરતસમ્યકૃત્વનો ઉત્કૃષ્ટકાળ સાધિક ૩૩ સાગર હોય છે.

સાતમી નરકમાં નારકીઓની અપેક્ષાએ છ અંતર્મુહૂર્ત ઓછા ૩૩ સાગરકાળ અવિરતસમ્યકૃત્વ ચોથા ગુણસ્થાનનું છે.

ઘવલામાં આનું ટપણીકરણ આ પ્રકારે છે - મોહકર્મની અઙ્ગાવીસ પ્રકૃતિઓની સત્તા રાખવાવાળો એક તીર્યચ અથવા મનુષ્ય મિથ્યાકૃત્વ જીવ સાતમી પૃથ્વીમાં ઉત્પન્ન થયો. તે છ યે પર્યાપ્તિઓથી પર્યાપ્ત થઈ (૧) વિશ્રામલેતો થકો (૨) વિશુદ્ધ થઈ (૩) વેદક સમ્યકૃત્વને પ્રાપ્ત થયો. અંતર્મુહૂર્ત કાળ પ્રમાણ આચુકર્મની સ્થિતિના અવશેષ રહેવા પર ફરી મિથ્યાત્વને પ્રાપ્ત થયો. (૪) ત્યાં આગામી લવની આચુને બાંધી (૫) અંતર્મુહૂર્ત કાળ વિશ્રામ લઈ (૬) નીકલ્યો, આ પ્રકારે છ અંતર્મુહૂર્ત ઓછા ૩૩ સાગરકાળ સુધી નરકગતિમાં અવિરત સમ્યકૃત્વ ગુણસ્થાન રહે છે. (ઘવલા પુ. જ. પાનું. ૩૫૬)

મનુષ્ય તથા તિર્યચ ગતિની અપેક્ષા અવિરત સમ્યકૃત્વ ગુણસ્થાનનો કાળ અનુક્રમથી સાધિક ત્રણ પલ્ય તથા ત્રણ પલ્ય છે.

(સર્વાર્થિસિદ્ધિ. પાનું. ૪૧-૪૨)

### મદ્યમકાળ :

એક અંતર્મુહૂર્તથી લઇને સાધિક ૩૩ સાગરકાળની વર્ચે જેટલા પણ લેદ થઈ શકે છે, તે સર્વ અવિરત સમ્યકૃત્વના ચોથા ગુણસ્થાનના મદ્યમકાળના પ્રકારે સમજવા જોઈએ.

### ગમનાગમન અપેક્ષા વિચાર :

ગમન : કોઈ અવિરતસમ્યકૃત્વ ગુણસ્થાનવતી ક્રવ્યલિંગી મુનીરાજ હોય, જો તે પોતાના ત્રિકાળી નિજ શુદ્ધાત્મના વિશિષ્ટ પુરુષાર્થપૂર્વક દ્યાન

કરે છે તો તે તુરેંત આગળના સમયે સાતમાં અપ્રમત્તસંયત ગુણસ્થાનમાં ગમન કરે છે અર્થાત્ ભાવલિંગી મુનિરાજ બની જાય છે.

ચતુર્થ ગુણસ્થાનમાં તો એક કષાય ચોકડીના અભાવથી ઉત્પન્ન વીતરાગ પરિણાત સહિત હતાં અને સાતમામાં જતાં જ ત્રણ કષાય ચોકડીના અભાવપૂર્વક વ્યક્ત મહાન વીતરાગતાના અપૂર્વ આનંદનો રસાસ્વાદન કરવા લાગે છે.

પ્રશ્ન ૩૬ : શું ચોથાથી સાતમાં ગુણસ્થાનમાં જવાવાળા મુનિરાજને આ અપૂર્વ પરિવર્તન સમજમાં આવે છે ?

ઉત્તરઃ શા માટે નહીં ? અવશ્ય સમજમાં આવે છે. જે આત્મા કોદ્ધાઈ વિભાવભાવોનો અનુભવ કરી શકે છે તો તે આત્મા ચારિત્ર ગુણના વ્યક્ત સુખદ સ્વભાવ પરિણામનો અનુભવ શા માટે ન કરી શકે ? યથા પદ્ધતિ વ્યક્ત વીતરાગતાથી ઉત્પન્ન આનંદનો અનુભવ મુનિરાજ અવશ્ય કરે જ છે. તેમને ગુણસ્થાનને જાણવાનો વિકલ્પ નથી થતો. તેથી ગુણસ્થાનનું જ્ઞાન નથી થતું.

૨. ચતુર્થ ગુણસ્થાનવર્તી ક્રબ્યલિંગી મુનિરાજ અથવા ચતુર્થ ગુણસ્થાનવર્તી પ્રતી ક્રબ્યલિંગી શ્રાવક ચોથા ગુણસ્થાનથી દેશવિરત નામના પાંચમાં ગુણસ્થાનમાં પણ પ્રવેશ/ગમન કરી શકે છે.

પહેલાંથી ચોથા ગુણસ્થાનમાં પ્રવેશ કરવો હોય અથવા ચોથાથી ઉપરનાં કોઈ પણ ગુણસ્થાનમાં પ્રવેશ કરવો હોય તો નિજ શુદ્ધાત્માનું જ્ઞાન તથા દ્યાન અનિવાર્ય છે. શુદ્ધોપચોગપૂર્વક જ ચતુર્થ ગુણસ્થાનમાં તથા આનાથી ઉપરના ગુણસ્થાનોમાં જવું સંભવ છે. એવું થવા પર જ્યાં જેટલા કર્મોનું ઉપશમ, ક્ષયોપશમ, ક્ષય થવું હોય છે, તે સર્વ કાર્ય પણ એકસાથે પોતાની મેળે થઈ જ જાય છે.

પ્રશ્ન ૩૭ : મિથ્યાત્વ ગુણસ્થાનથી સાતમાં અપ્રમત્તસંયત ગુણસ્થાનમાં અને ચોથા અવિરતસમ્યકૃત્વ ગુણસ્થાનથી સાતમાં અપ્રમત્તસંયત ગુણસ્થાનમાં ક્રબ્યલિંગી મુનિરાજ જ ગમન કરે છે. એવું શા માટે કહ્યું ? કોઈપણ પ્રતી કે અપ્રતી સમ્યક્રબ્ધિ શ્રાવક સાતમામાં ગમન કરી છન્હા ગુણસ્થાનમાં આવી બહારમાં દિગંબર મુનિદીક્ષા ધારણ શા માટે નથી કરી શકતાં ?

ઉત્તરઃ જ્યારે ત્રણ કષાય ચોકડીના અનુદ્યુક્ત અભાવપૂર્વક વીતરાગતા

વ્યક્ત થાય છે, ત્યારે કપડાં પહેરવાનો રાગ પરિણામ જ નથી રહેતો અને રાગલાવ ન રહેવાથી કપડાં આઈ બાબુ પરિશ્રહ પણ નથી રહેતો-આ જ સુમેળ છે. રાગ પરિણામ કપડાં પહેરવાનું કામ કરાવે છે, જ્યારે રાગ જ નષ્ટ થઈ ગયો તો કપડાં પહેરશે કોણ ? બાબુ પરિશ્રહના અભાવપૂર્વક જ અપ્રમત્તપણાનો સુમેળ છે. એવો જ બંનેમા સહજ નિમિત્ત - નૈમિત્તિક સંબંધ છે. માટે સાતમાં અપ્રમત્તસંયત ગુણસ્થાનની પ્રાસિની પહેલાં જ કપડાં આઈ સર્વ બાબુ પરિશ્રહનો બુદ્ધિપૂર્વક ત્યાગ પહેલાં, ચોથા અથવા પાંચમાં ગુણસ્થાનમાં કષાયની મંદ, મંદતર તથા મંદતમ ઉદ્યમાં થઈ જ જાય છે. તેથી ફ્રાન્ઝલિંગી મુનિરાજ જ સાતમાં ગુણસ્થાનમાં ગમન કરે છે.

**પ્રશ્ન ૩૮ :** આપના આ કથનથી એ સ્પષ્ટ થાય છે કે ફ્રાન્ઝલિંગ પ્રથમ થાય છે અને ભાવલિંગની પ્રાસિ પાછળથી થાય છે. શું આપ એમ કહેવા માંગો છો?

**ઉત્તર :** હા, ફ્રાન્ઝલિંગપૂર્વક જ ભાવલિંગ હોય છે, એવું જ વસ્તુનું સ્વરૂપ છે.

**પ્રશ્ન ૩૯ :** સામાન્ય વ્યક્તિઓ માટે તો ફ્રાન્ઝલિંગપૂર્વક ભાવલિંગ થવાનો નિયમ ઠીક છે, પરંતુ તીર્થીકર આઈ મહાપુરુષોને તો પહેલા ભાવલિંગ થઈ જતું હશે?

**ઉત્તર :** ના, “એક હોય ત્રણ કાળમાં, પરમારથનો પંથ.”

જિનિધર્મમાં તો કોઈ વિશીષ્ટ વ્યક્તિને માટે પણ મોક્ષમાર્ગ કે મોક્ષપ્રાસિના ઉપાયમાં કાંઈ છૂટછાટ નથી. વસ્તુસ્વરૂપ તો બધાંને માટે સમાન જ હોય છે. જેમ કે - પૈરાગ્ય ઉત્પન્ન થવાથી તીર્થીકર થવાવાળા ચુવા મહાવીરે પણ વનમાં જઈ અલંકાર, મુકૃટ આઈ આખૂષણો અને વસ્ત્રોનો બુદ્ધિપૂર્વક ત્યાગ કર્યો. કેશલોચ કરીને ઇંગંબર મુની થયા.

આ રીતે ફ્રાન્ઝલિંગને ઘારણ કરી મુનિ થઈ તે દ્વારાનું નેસી ગયા અને શુદ્ધોપચ્યોગમાં પોતાના નિજ શુદ્ધાત્માનું દ્વારા કરી લીધું, ત્યારે જ ત્રણ કષાય ચોક્કીના અભાવપૂર્વક અપ્રમત્તસંયત ગુણસ્થાનને પ્રાપ્ત થયા હતાં અને ભાવલિંગી મુનિરાજ બન્યા હતા.

આ પ્રકારે તીર્થીકર થવાવાળા ચુવક મહાવીરને પણ ફ્રાન્ઝલિંગપૂર્વક જ ભાવલિંગ થયું છે. આ રીતે ફ્રાન્ઝલિંગ અને ભાવલિંગનો પરસ્પર સુમેળ બધાં જીવો માટે અનાઈથી છે અને આગળ પણ અનંતકાળ સુધી રહેશે,

એવું સમજવું જોઈએ.

પ્રશ્ન ૪૦ : તીર્થીકર તો પોતાની આઠ વર્ષની ઉમરમાં જ પંચમ ગુણસ્થાનવર્તી ગ્રતી શ્રાવક થઈ જાય છે, એવું અમે પાર્શ્વપુરાણ શાસ્ત્રમાં વાંચ્યું છે. તેનું શું તાત્પર્ય છે ?

ઉત્તર : પાર્શ્વપુરાણ પ્રથમાનુયોગનું શાસ્ત્ર છે. ત્યાં સ્થૂળરૂપથી સામાન્ય કથન કર્યું છે. ત્યાં તીર્થીકર થવાવાળા આઠ વર્ષના બાળકનું બાધ્ય આચરણ પંચમ ગુણસ્થાનવર્તી ગ્રતી શ્રાવક સમાન હોય છે, આ સમજાવવાનો ભાવ છે. આચાર્યોએ બાળ તીર્થીકરના આદર્શ જીવનને પ્રસ્તુત કરી સાધક જીવોને તેમના જેવું જીવન જનાવવાની પ્રેરણા આપી છે.

વસ્તુતઃ વાત એ છે કે તીર્થીકર, ચક્કવર્તી વગેરે વિશિષ્ટ પદવીધારક મહાપુરુષોનો અણુપ્રતરૂપ અલ્પ પુરુષાર્થ નથી હોતો. તે તો સીધા મહાપ્રતોને જ અંગીકાર કરે છે, કારણ કે તેઓનો પુરુષાર્થ મહાન જ હોય છે.

પ્રશ્ન ૪૧ : આચાર્યશ્રી કુંદકુંદદેવે અષ્ટપાહુક-ભાવપાહુકની ગાથા છતમાં તો પ્રથમ ભાવલિંગ પ્રગટ કરો, ત્યારબાદ ફ્રલ્યલિંગને સ્વીકાર કરવાની પ્રેરણા આપી છે. તેનો શું અભિપ્રાય છે ?

ઉત્તર : આચાર્યશ્રીએ એ ગાથામાં સમ્યક્ષુર્દ્ધનને ભાવલિંગ કર્યું છે. મિચ્છત્તાર્દી ય દોસ ચઢીકણનો અર્થ છે મિથ્યાત્પાદિ દોષોને છોડીને. આચાર્યશ્રીને ત્યાં સમ્યક્ષુર્દ્ધન અર્થ અભિપ્રેત છે. સમ્યક્ષુર્દ્ધન વગર મુનિપણાનો યથાર્થી પુરુષાર્થ પ્રગટ જ નથી થતો. તેથી અનાદિનિધન માર્ગ તો એ જ છે કે પહેલા સમ્યક્ષુર્દ્ધન પ્રગટ કરવું અને તત્પક્ષ્યાત સંયમ ધારણ કરવું. મિથ્યાત્પની ગ્રંથી તોડવી તે જ પ્રથમ ફ્રલ્યિ અપેક્ષાએ નિર્ણયિતા છે.

આચાર્યશ્રી કુંદકુંદદેવે ણગો હી મોક્ખમગો નગનતા જ મોક્ષમાર્ગ છે, અમ સ્પષ્ટ કર્યું છે.

પ્રશ્ન ૪૨ : તો પછી આચાર્યશ્રી કુંદકુંદદેવના વચનાનુસાર બાધ્ય નગનતાને જ મોક્ષમાર્ગ અને મુનિપણું કેમ ન માનવું ? ત્રણ કષાય ચોકડીના અનુદ્યરૂપ વીતરાગતાની શું જરૂર છે ?

ઉત્તર : ણગો હી મોક્ખમગો આ કથન વ્યવહારનયનું છે. જે

બાહ્યનિમિત્તની અપેક્ષાથી સાચું હોવા છતાં પણ નિશ્ચયની અપેક્ષા રાખે છે. એક જ નયના વિષયને સ્વીકાર કરવાથી મિથ્યાત્પનો પ્રસંગ આવે છે. તેથી શરીરની નગનતા આદિ રે મૂળગુણમય દ્રવ્યલિંગનું પાલન કરવારૂપ રાગભાવ અર્થાત્ પુણ્યમય પરિણામ અને ત્રણ કષાય ચોકડીના અનુદ્યથી વ્યક્ત વીતરાગભાવ - આ બંનેના સદ્ભાવથી જ છઢા - સાતમાં ગુણસ્થાનની લૂભિકા બને છે.

હવે ચોથા ગુણસ્થાનથી નીચેના ગુણસ્થાનોમાં ગમન કરવા વિષે વિચાર કરીએ છીએ.

૩. ચતુર્થ ગુણસ્થાનવર્તી અવિરત સમ્યક્ષ્રાણિના સમ્યક્ષ્રમિથ્યાત્પ નામના દર્શનમોહનીય કર્મની સત્તા હોય અને તેની નિર્મિત શ્રદ્ધા પોતાના જ અપરાધથી કે પૂર્વ કુસંસ્કારવશ મિશ્રભાવરૂપ થઈ જાય તો તે સમયે મિશ્ર કર્મનો ઉદ્ય આવવાથી તે ત્રીજા મિશ્ર ગુણસ્થાનમાં પ્રવેશ કરે છે.

૪. આ ચોથા ગુણસ્થાનવર્તી જો ઔપશમિક સમ્યક્ષ્રાણિ હોય અને સ્વયમેવ જ વિપરીત પુરુષાર્થથી તેને અનંતાનુંબંધી કષાય પરિણામ થઈ જાય તો તે જ સમયે અનંતાનુંબંધી કષાયકર્મનો ઉદ્ય પણ સ્વયમેવ આવે છે અને આ જીવ સાસાદનસમ્યકૃત્વ નામના બીજા ગુણસ્થાનમાં ગમન કરે છે.

૫. જો (ક્ષાચિક સમ્યક્ષ્રાણિને છોડીને) કોઈ અવિરત સમ્યક્ષ્રાણિની પરિણાતિ મિથ્યાત્પભાવરૂપ થઈ જાય અને તે જ સમયે મિથ્યાત્પ કર્મનો ઉદ્ય પણ આવી જાય તો તે મિથ્યાત્પ ગુણસ્થાનમાં પ્રવેશ કરે છે. આગમન : ૧) સાદિ કે અનાદિ મિથ્યાક્રાણિ જીવ શુદ્ધાત્માના આશ્રયથી મિથ્યાત્પ ગુણસ્થાનથી સીધો અવિરત સમ્યકૃત્વ ગુણસ્થાનમાં આવી શકે છે.

૨) સમ્યક્ષ્રમિથ્યાત્પ ગુણસ્થાનવર્તી જીવોનો પણ શુદ્ધાત્માના આશ્રયથી અવિરત સમ્યકૃત્વ ગુણસ્થાનમાં આગમન થઈ શકે છે.

૩) દેશવિરત ગુણસ્થાનવર્તી જીવોનો પોતાના પુરુષાર્થ - હીનતાથી અવિરત સમ્યકૃત્વ ગુણસ્થાનમાં આવવું સંભવ છે.

૪) છઢા ગુણસ્થાનવર્તી મુનિરાજ પણ પોતાના હીણા પુરુષાર્થથી સીધા ચોથા ગુણસ્થાનમાં આવી શકે છે.

ઉપરનાં ગુણસ્થાનોથી નીચેલા ગુણસ્થાનોમાં આવેલા મુનિરાજ તો તત્કાળ જ આત્માશ્રિત દ્યાન-મગનતાનો વિશેષ પુરુષાર્થ કરીને સાતમાં

અપ્રમત્તસંયત ગુણસ્થાનમાં પહોંચી પ્રચુર સ્વસંવેદનરૂપ વિશિષ્ટ અનુપમ આનંદનો અનુભવ કરે છે.

પ્રથત્ન કરવા છતાં પણ મુનિ-દશાને યોગ્ય છઢા-સાતમાં ગુણસ્થાનરૂપ ભાવલિંગની પ્રાપ્તિ નથી થતી, તો સ્વયં જ મુનિવેષ/ ફ્રવ્યલિંગનો ત્યાગ કરવો, તે ઉપાય નથી. પ્રત્યેક અંતર્મુહૂર્તમાં જ નહીં ચથાર્થ મુનિપણું પ્રાપ્ત કરવા માટે બુદ્ધિપૂર્વક સતત પ્રયાસ કરતા રહેવું ધારું આવશ્યક છે. જેમ - આચાર્ય વારિષેણાના શિષ્ય પુષ્પડાલે પ્રથત્ન કર્યો છે. આચાર્યએ પણ પોતાના શિષ્યને મુનિ-પદમાં સ્થિર કરવાના જ અનેક ઉપાય કર્યા છે.

આગમના અદ્યયનથી આ વાત પણ સ્પષ્ટ થઈ જાય છે કે અનેક દિગંબર મુનિરાજ પોતાના મુનિજીવન અર્થાત્ મનુષ્ય જીવનના અંતિમ સમય સુધી ફ્રવ્યલિંગી મુનિરાજ જ બની રહે છે અને આગળના ભવમાં નવ ગ્રૈવેયકમાં પણ જન્મ લઈ શકે છે. નવ ગ્રૈવેયકમાં ફ્રવ્યલિંગી મુનિરાજ જન્મ લે છે, આ કથન આગમમાં સર્વત્ર મળે છે. આનાથી આપણાને આ નિર્ણય આગમાનુસાર ઉચિત પ્રતીત થાય છે કે ગૃહીત પ્રતોનો ત્યાગ કરવો તે ઉપાય નથી, પ્રતોને અનુસાર આંતરિક જીવન ધર્મસ્ય બનાવવું કર્તવ્ય છે.

**પ્રશ્ન ૪૩ :** રતનકરંકશાપકાચારના રચયિતા આચાર્ય સમંતલફ્રદેવે પોતાના પૂર્વ જીવનમાં ભસ્મક રોગ થવાને લીધે તથા આચાર્ય આર્થનંદીએ (ક્ષત્રચૂડામણિમાં ઉલ્લેખિત) પણ મુનિપદનો ત્યાગ કર્યો હતો. આ વિષય શાસ્ત્રમાં આપેલો છે. તેથી આપ તેને સ્પષ્ટ સમજાવો.

**ઉત્તર :** તેમના જીવનનું ઉદાહરણ લેવું હોય તો આચાર્ય સમંતલફ્રના પ્રભાવના કાર્યનું તથા આચાર્ય આર્થનંદીના મુક્તિ-પ્રાપ્ત કરવારૂપ આદર્શ પુરુષાર્થનો લેવો જોઈએ. મુનિપદનો ત્યાગ તો અપરિહાર્ય કારણથી તથા ગુરુના ઉપદેશથી થયો છે.

જે જીવન સર્વોત્તમ ન હોય તેના અનુસરણનો વિચાર પોતાની મનોભૂમિકાની મલીનતાને જ સ્પષ્ટ કરે છે. તેથી ગૃહીત પ્રતોના ત્યાગનો વિચાર કરવો સાચો માર્ગ નથી. વાસ્તવિક રીતે જોઈએ તો ગૃહીત પ્રતોના નિર્દોષ પાલનની સાથે નિજ શુદ્ધાત્માના દ્યાનથી ભાવલિંગ પ્રગત કરવાનો અવિરત પ્રયાસ જ શ્રેષ્ઠ ઉપાય છે.

પ. ઉપશમ શ્રેણીની અપેક્ષાએ ઉપશમ શ્રેણીના ચારે ગુણસ્થાનોમાં મરણ થઈ જાય તો સીધા ચોથા ગુણસ્થાનમાં આવે છે. અર્થાત् મરણના અંતસમય સુધી તો શ્રેણીનું તે જ ગુણસ્થાન રહે છે, પરંતુ વિગ્રહગતિમાં પ્રથમ સમયથી જ ચોથું ગુણસ્થાન થઈ જાય છે.

**પ્રશ્ન જ્ઞા:** સાહિ કે અનાહિ કોઈપણ મિથ્યાક્રષિ મનુષ્ય શું મિથ્યાત્પદી અવિરતસમ્યકૃત્વ ગુણસ્થાનની પ્રાપ્તિ કરી શકે છે કે તેની પણ કાંઈ વિશિષ્ટ પાત્રતા આવશ્યક છે ?

**ઉત્તર :** બંને મિથ્યાક્રષિઓને સમ્યકૃત્વ માટે પુરુષાર્થી તથા પાત્રતા સ્વામાન જ હોય છે. હા, એટલું અવશ્ય છે કે જેની પાત્રતા વિશેષ હોય છે તે શીધ જ સમ્યકૃત્વરૂપી રૂનને પ્રાપ્ત કરી શકે છે. વિશિષ્ટ કારણોથી પાત્રતાને પ્રાપ્ત મિથ્યાક્રષિ જ અવિરત સમ્યકૃત્વ ગુણસ્થાનની પ્રાપ્તિ કરી શકે છે, સર્વ અથવા કોઈ પણ મિથ્યાક્રષિ નહીં.

**પ્રશ્ન જ્ઞપ :** અવિરત સમ્યકૃત્વ ગુણસ્થાનની પ્રાપ્તિ માટે પાત્રતાનું સ્વરૂપ શું છે ?

**ઉત્તર :** ગૃહીત મિથ્યાત્પવનો પૂર્ણ ત્વાગ આવશ્યક છે. રાગી-ફેખી દેવી-દેવતાઓને માનવા-પૂજયાવાળા મિથ્યાક્રષિ જીવને ચોથું અવિરત સમ્યકૃત્વ ગુણસ્થાન પ્રાપ્ત નથી થઈ શકતું. વીતરાગી, સર્વજ્ઞ અને હિતોપદેશી દેવ જ સાચા દેવ છે. વીતરાગતાની પોષક વાણી જ સાચા શાસ્ત્ર છે. છઙ્ગા-સાતમાં ગુણસ્થાનમાં જૂલયાવાળા ભાવલિંગી દિગ્ંબર સાધુ જ ગુરુ છે. એવો ક્રષ્ણ શ્રદ્ધાવાળ મિથ્યાક્રષિ જ સમ્યકૃત્વ થવાને પાત્ર છે.

સાચા દેવ-શાસ્ત્ર-ગુરુની અંતર્ંગ-બહિર્ંગ લક્ષણ ક્રષિથી નિર્ણયાત્મક જ્ઞાન શ્રદ્ધા વગર કોઈ કેટલો પણ પ્રયાસ કરે, તે જીવ અવિરત સમ્યકૃત્વ નામના ચોથા ગુણસ્થાનને પ્રાપ્ત નથી કરી શકતો. દેવ-શાસ્ત્ર-ગુરુ આ ત્રણોમાંથી કોઈ એકની પણ યથાર્થ શ્રદ્ધાન ન હોય તો ત્રણોની સાચી શ્રદ્ધા નથી.

અન્યાય, અનીતિ અને અભક્ષણા બાબુ ત્વાગરૂપ સદાચારી જીવન વગર ધર્મ સમજમાં આવવો પણ કરુણા છે. જૈન કુળાચાર પાલન કરવાવાળાને અર્થાત് આઠ મૂળગુણો (મધ્ય, માંસ, મરિચ આ ત્રણ મકાર અને પાંચ ઉંડબર ફળોના ત્વાગરૂપ અષ્ટ મૂળગુણો)ને ધારણ

કર્યા વિના સમ્યકૃત્વની પ્રાસિની પાત્રતા પણ નથી આવી શકતી.

**અન્યાય :** જે કામને સરકાર પણ અચોગ્ય માને છે, દંડ ચોગ્ય સમજે છે, મનુષ્યને જેલમાં નાખે છે, દેશનિકાલ કરે છે, ફાંસી આદિની સજા આપે છે, એવું કોઈ પણ કામ કરવાવાળો મનુષ્ય અન્યાયી છે અને તે સમ્યકૃત્વની પ્રાસિ માટે અપાત્ર છે.

**અનીતિ :** જે કામને લીધે જૈન સમાજ અથવા જૈનેતર સમાજ પણ મનુષ્યની નિંદા કરે, એવું કાર્ય અનીતિની કોટીમાં આવે છે. જેમ - પૃદ્ધ માતા - પિતાની સેવા ન કરવી, બીજાની નિંદા કરતા રહેવું, લોકિક નીતિથી વિરુદ્ધ આચરણ રાખવું આદિ. (વિશેષ જાણકારી માટે ભાવદીપિકા શાસ્ત્રનો ઔદ્ઘિક ભાવાધિકાર જુઓ)

**અભક્ષય :** જે ખાવા-પીવાની જૈન શાસ્ત્રોમાં સહમતિ નથી એવી વસ્તુઓના ભક્ષણને અભક્ષય કરે છે. જેમ કે - અનંતકાય જીવ જેમાં છે એવા પદાર્થ - કાંદા, લસણ, મૂળા, બટાટા, શકરકંદ, ગાજર આદિ જમીનકંદનું ભક્ષણ, રાત્રિભોજન કરવું, અણગળ પાણી વાપરવું, આ બધા અભક્ષયની કોટીમાં ગણતરી થાય છે. આ પ્રકારે અન્યાય, અનીતિ અને અભક્ષયના બુદ્ધિપૂર્વક ત્યાગી પાત્ર જીવ ને સમ્યકૃત્વની પ્રાસિના અધિકારી સમજવા જોઈએ.

સખ્યસન અને તીવ્ર હિંસાદિપ પાપોનો ત્યાગતો નામદારી જૈન પણ કરે જ છે. સખ્યસનાદિના ત્યાગને માટે જૈન મનુષ્યને સમજાવવું જૈન મનુષ્યનું અપમાન કરવા સમાન છે.

આ વિષય સંબંધી મોક્ષમાર્ગપ્રકાશક પાના ૨૬૧ પર અત્યંત માર્ગિક કથન આવ્યું છે, તેને તે શાસ્ત્રના શાબ્દોમાં જ જોઈએ - “..કોઈને દેવાદિકની પ્રતીતિ અને સમ્યકૃત્વ ચુગપદ હોય છે તથા પ્રત - તપ, સમ્યકૃત્વની સાથે પણ હોય છે અને આગળ - પાછળ પણ હોય છે. દેવાદિકની પ્રતીતિનો તો નિયમ છે, તેના વિના સમ્યકૃત્વ નથી થતું, પ્રતાદિકનો નિયમ નથી. ઘણા જીવ તો પહેલા સમ્યકૃત્વ થયા પછી જ પ્રતાદિકને ઘારણ કરે છે. કોઈને ચુગપદ પણ થઈ જાય છે...”

**પ્રશ્ન જ્ઞ :** અણુપ્રતો કે મહાપ્રતોનો સ્વીકાર કરવો, સમ્યકૃત્વ માટે આવશ્યક છે કે નહીં ?

**ઉત્તર :** સમ્યકૃદર્શન પ્રાપ્ત કરવા માટે અણુપ્રતો અથવા મહાપ્રતોનું પાલન કરવું આવશ્યક નથી. હા, જો સમ્યકૃદર્શનની પહેલા કદાચ બાહ્ય

વ્યવહાર પ્રતિ લઈ લીધા હોય તો તેના પાલન કરતાં પણ તત્ત્વચિંતનની મુખ્યતા હોય તો સમ્યકુર્દશિન થઈ શકે છે, પરંતુ પ્રતો વિના પણ અવિરતસમ્યકૃત્વ ગુણસ્થાનની પ્રાપ્તિ થઈ શકે છે.

**વિશેષ અપેક્ષા વિચાર :**

(૧) અવિરત સમ્યકુર્દશિને વિશિષ્ટ પ્રશાસ્ત રાગને કારણ જ તીર્થીકર પ્રકૃતિ નામકર્મનો બંધ પ્રારંભ થાય છે. દર્શન વિશુદ્ધિ આદિ સોલહકારણ ભાવનાઓથી તીર્થીકર પ્રકૃતિનો બંધ થઈ શકે છે. આ સોળ ભાવનાઓમાં પણ મુખ્યઝુપથી તો એક દર્શનવિશુદ્ધિ ભાવના જ કારણ છે. આ એક ભાવના હોય અને અન્ય પંદર ભાવનાઓ હીનાદિક પણ હોય તો પણ તીર્થીકર પ્રકૃતિનો બંધ થઈ શકે છે.

આ એક ભાવના જ અન્ય બધી ભાવનાઓની ઉત્પાદક છે.

“બધાં જીવોનું પરમકલ્યાણ થાય. બધા જીવ મારી જેમ મોક્ષમાર્ગ થઈને સુધી થાય ” - એવી સમ્યકુર્દશિનપૂર્વક લોક-કલ્યાણની અખંડ ભાવનાનું નામ જ દર્શનવિશુદ્ધિ ભાવના છે.

ચોથા ગુણસ્થાનથી લઈને સાતમાં ગુણસ્થાન સુધી ક્યાંય પણ તીર્થીકર પ્રકૃતિ નામકર્મનું બંધાવું પ્રારંભ થઈ શકે છે અને આઠમાં ગુણસ્થાનના છઢા ભાગ સુધી તીર્થીકર પ્રકૃતિનો બંધ થાય છે. પરંતુ ઉદ્ય, તેરમાં - ચૌદમાં ગુણસ્થાનમાં જ રહે છે, જે કારણથી બાધ્યમાં સમવસરણની પ્રાપ્તિ થાય છે.

(૨) આ અવિરતસમ્યકૃત્વગુણસ્થાનથી જ જીવને પારમાર્થિક અતીજિન્દ્રિય સુખનો અંશ પ્રગટ થાય છે. વિપરીત શ્રદ્ધાવાળ અર્થાત્ પ્રથમ ગુણસ્થાનથી ત્રીજા સમ્યકુર્દશાત્ત્વ ગુણસ્થાન સુધીના સર્વ જીવ નિયમથી દુઃખી જ છે. પૂર્વ પુણ્યકર્મના ઉદ્યથી કેટલાક જીવને બાધ્ય અનુકૂળ વસ્તુઓના સંયોગથી સુખ જેવું લાગે છે, પરંતુ તે સાચું સુખ નથી.

વીતરાગતા/સમતાભાવ જ સાચું સુખ છે. આ સુખ ચથાર્થ શ્રદ્ધાની સાથે જ ઉત્પન્ન થાય છે. ચથાર્થ શ્રદ્ધા આત્માનુભવપૂર્વક જ થાય છે. આત્માનુભવ માટે અનંત સર્વજ્ઞ ભગવંતો દ્વારા કથિત દૈવ-શાસ્ત્ર-ગુરુ, જ દ્રવ્ય અને સાત તત્વોનું લેદજ્ઞાનપૂર્વક ચથાર્થ જ્ઞાન અને શ્રદ્ધાનની પણ અત્યંત આવશ્યકતા છે.

સાત તત્વોમાં પણ “હું ભગવાન આત્મા અનાદિ - અનંત, સહજ

શુદ્ધ સ્વપૂર્ણ જ છું,” એવી માન્યતા/શ્રદ્ધા/પ્રતીતિ જ સમ્યકૃત્વદર્શન છે.

(૩) સમ્યકૃત્વ પ્રાપ્તિને કારણ જ જીવ અંતરાત્મા સંજ્ઞાને પ્રાપ્ત થાય છે. ચોથા ગુણસ્થાનથી લઈને બારમાં ગુણસ્થાન સુધીના સર્વ જીવ અંતરાત્મા જ છે. આમાં પણ ચોથા ગુણસ્થાનવર્તી જીવ જધન્ય અંતરાત્મા છે. પાંચમા છઢા ગુણસ્થાનવર્તી જીવ મદ્યમ અંતરાત્મા છે અને સાતમા ગુણસ્થાનથી લઈને બારમાં ગુણસ્થાનવર્તી મહામુનિરાજ ઉત્તમ અંતરાત્મા છે.

(૪) “અવિરતસમ્યકૃત્વ” આ નામમાં જે “અવિરત” શબ્દ છે તે અંતદીપક છે અર્થાત્ પ્રથમ ગુણસ્થાનથી લઈને ચોથા અવિરત ગુણસ્થાન સુધીના સર્વ જીવ અવિરત જ છે. જેમ - અવિરત મિથ્યાત્વ, અવિરત સાસાદન સમ્યકૃત્વ અને અવિરત સમ્યકૃમિથ્યાત્વ, કારણ કે મિથ્યાત્વથી લઈને ચોથા ગુણસ્થાન સુધીના સર્વ જીવ સામાન્યપણે અવિરત જ છે. છતાંચ દરેક જીવની અવિરતિમાં ઘણું અંતર છે.

(૫) મિથ્યાત્વથી રહિત થવાને કારણ અવિરત સમ્યકૃક્રિયાને શ્રદ્ધાની અપેક્ષાએ “ક્રિયામુક્ત” કહે છે.

ક) જે જીવની શ્રદ્ધા ચથાર્થ થઈ ગઈ, તેને ક્રિયામુક્ત કહે છે.

ખ) બાર પ્રકારની અવિરતિથી અતીત થવાને કારણ છઢા ગુણસ્થાનવર્તી મુનિરાજ અવિરતિમુક્ત છે.

ગ) પંદર પ્રમાણોથી અતીત થવાને કારણ અપ્રમત્તસંયત આદિ આગળના ચાર ગુણસ્થાનવર્તી જીવને “પ્રમાણમુક્ત” કહે છે.

ધ) ઉપશાંતમોહ અને ક્ષીણમોહ ગુણસ્થાનવર્તી સર્વ જીવોને “મોહમુક્ત” કહેવું યોગ્ય છે.

ચ) સયોગ-અયોગ કેવળીઓને “જીવનમુક્ત” કહેવું સ્વાભાવિક છે. આને કથંચિત્ સિદ્ધ પણ કહે છે.

ઇ) ગુણસ્થાનાતીત જીવ ક્રવ્યકર્મ, ભાવકર્મ અને નોકર્મથી રહિત હોવાને કારણ સિદ્ધ જીવોને “દૈહમુક્ત”/ સાક્ષાત્મુક્ત કહે છે. હવે કોઈથી મુક્ત થવાનું તેઓને બાકી નથી. મોક્ષમાર્ગ અર્થાત્ મુક્ત થવાનો પ્રારંભ તો સમ્યકૃત્વદર્શન થવા પર ચોથા ગુણસ્થાનથી થાય છે.

(૯) ભવ્યત્વ શક્તિની અભિભ્યક્તિનો પ્રારંભ ચોથા અવિરત

સમ્યકૃત્પ ગુણસ્થાનથી જ થાય છે. જે જીવ મોક્ષમાર્ગ (રત્નત્રય) પ્રગટ કરવાની શક્તિવાળો હોય છે, તેને ભવ્યજીવ કહે છે.

ચોથા ગુણસ્થાનમાં મોક્ષમાર્ગ પ્રારંભ થાય છે અને સિદ્ધ અવસ્થામાં ભવ્યત્પ શક્તિનું ફળ પ્રાપ્ત થાય છે. આ અપેક્ષાથી સિદ્ધ અવસ્થામાં ભવ્યત્પ શક્તિનો અભાવ બતાવવામાં આવેલ છે.

જેમ - સિદ્ધ અવસ્થાની પ્રાપ્તિ જીવને નિયમથી નિજ શુદ્ધાત્માના દ્વારાનથી જ થાય છે, તેમજ સમ્યકૃતશર્ણની ઉત્પત્તિ પણ નિયમથી શુદ્ધાત્માના દ્વારાનથી જ થાય છે. આ જ દ્વારાને શુદ્ધોપયોગ કહે છે. આ વિષયમાં જ્યાસેનાચાર્યાદેવનું કથન અત્યંત સ્પષ્ટ છે.

સમયસાર ગાથા ૩૨૦ની તાત્પર્યવૃત્તિ ટીકા લખ્યા બાદ વિશેષ ખુલાસો કરતા થકા તેઓ લખે છે :-

“તે જ પરિણમને આગમની ભાષાથી ઔપશમિક, ક્ષાયોપશમિક અને ક્ષાચિક સમ્યકૃતલાવરૂપ કહેવામાં આવે છે અને તે જ પરિણમને અદ્યાત્મભાષાથી શુદ્ધાત્માલિમુખ પરિણામ, શુદ્ધોપયોગ આદિ નામોથી કહેવામાં આવે છે.”

આનાથી આ અર્થ સહજ જ ફલિત થઈ જાય છે કે પ્રથમોપશમ સમ્યકૃત્પ, ક્ષાયોપશમિક સમ્યકૃત્પ અથવા ક્ષાચિક સમ્યકૃત્પની પ્રાપ્તિ શુદ્ધોપયોગમાં જ થાય છે. આચાર્ય શ્રી જ્યાસેનદેવના સમયસારના ઉપર્યુક્ત એક જ ઉદાહરણથી આ અત્યંત સ્પષ્ટ થઈ જાય છે - ચોથા ગુણસ્થાનમાં શુદ્ધોપયોગ હોય જ છે.

પ્રશ્ન ર૪ : સમ્યકૃતશર્ણની પ્રાપ્તિ માટે શુદ્ધાત્માના દ્વારાને છોડી શું અન્ય કોઈ ઉપાય પણ હોઈ શકે છે ? કે એક માત્ર શુદ્ધાત્માનું દ્વારાન જ છે ?

ઉત્તર : જે પ્રકારે સમ્યકૃતારિત્રની ઉત્પત્તિ અને તેની પૂર્ણતાનો ઉપાય નિજ શુદ્ધાત્માનું દ્વારાન જ છે. તે જ પ્રકારે સમ્યકૃતશર્ણની ઉત્પત્તિનો ઉપાય પણ એક નિજ શુદ્ધાત્માનું દ્વારાન જ છે. અન્ય કોઈ ઉપાય નથી.

સમ્યકૃતશર્ણ અને સમ્યકૃતારિત આ બંને ભાવ આત્માશ્રિત વીતરાગસ્વરૂપ જ છે અને આ બંનેના નિમિત્તરૂપથી બાધક કર્મ પણ એક મોહનીય - દર્શનમોહનીય તથા ચારિત્રમોહનીય જ છે. માટે આની પ્રાપ્તિનો ઉપાય પણ એક આત્માશ્રિતપણું જ છે. આ કારણે

સમ્યહૃદર્શનની પ્રાણિનો ઉપાય પણ એક નિજ શુદ્ધાત્માનું દ્યાન જ છે; અન્ય નહીં.

ઘરલા પુસ્તક ૧ નો અંશ (પાના નં ૧૭૧ થી ૧૭૪)

સામાન્યથી અસંયતસમ્યહૃદ્રષ્ટિ જીવ છે ॥૧૬॥

જેની હ્રષ્ટિ અર્થાત શુદ્ધા સમીચીન(ચથાર્થ) હોય છે, તેને સમ્યહૃદ્રષ્ટિ કહે છે અને સંયમરહિત સમ્યહૃદ્રષ્ટિને અસંયતસમ્યહૃદ્રષ્ટિ કહે છે, તે સમ્યહૃદ્રષ્ટિ જીવ ત્રણ પ્રકારના છે. ક્ષાચિકસમ્યહૃદ્રષ્ટિ, વેદકસમ્યહૃદ્રષ્ટિ અને ઔપશમિક સમ્યહૃદ્રષ્ટિ.

સમ્યહૃદર્શન અને સમ્યહૃચારિત્ર ગુણોનો ધાત કરવાવાળી ચાર અનંતાનુંબંધી પ્રહૃતિઓ અને મિદ્યાત્પ, સમ્યહૃમિદ્યાત્પ તથા સમ્યહૃપ્રહૃતિ આ ત્રણ દર્શનમોહનીયની પ્રહૃતિઓ, આ રીતે આ સાત પ્રહૃતિઓના સર્વથા વિનાશથી જીવ ક્ષાચિક સમ્યહૃદ્રષ્ટિ કહેવામાં આવે છે. તથા આ જ સાત પ્રહૃતિઓના ઉપશમથી જીવ ઉપશમસમ્યહૃદ્રષ્ટિ થાય છે. તથા જેની સમ્યહૃત્પ સંજ્ઞા છે એવા દર્શનમોહનીય કર્મના લેદૃપ પ્રહૃતિના ઉદ્યથી આ જીવ વેદકસમ્યહૃદ્રષ્ટિ કહેવાય છે.

તેમાં ક્ષાચિકસમ્યહૃદ્રષ્ટિ જીવ કયારેપણ મિદ્યાત્પ ને પ્રાપ્ત નથી થતો, કોઈ પ્રકારના સંટેહને પણ નથી કરતો અને મિદ્યાત્પજન્ય અતિશયોને જોઈને વિસમયને પણ પ્રાપ્ત નથી થતો.

ઉપશમ સમ્યહૃદ્રષ્ટિ જીવ પણ આ પ્રકારના જ હોય છે. પરંતુ પરિણામોના નિમિત્તથી ઉપશમ સમ્યહૃત્પને છોડીને મિદ્યાત્પમાં જાય છે. સાસાદન ગુણસ્થાન ને પણ પ્રાપ્ત કરે છે. સમ્યહૃમિદ્યાત્પ ગુણસ્થાને પણ પહોંચી જાય છે અને વેદકસમ્યહૃત્પ ને પણ પ્રાપ્ત કરી લે છે.

(ઉપશમ સમ્યહૃદ્રષ્ટિના ઉપર્યુક્ત કથનથી પણ આ સ્પષ્ટ થઈ જાય છે કે ઉપશમ સમ્યહૃત્પની પ્રાપ્તિ કરવાવાળો જીવ નિયમથી મિદ્યાત્પ ને જ પ્રાપ્ત થાય છે, એવું નથી. તેને ચાર માર્ગ છે, જેને ઉપર મુજબ આચાર્યશ્રી વીરસેનજીએ સ્પષ્ટ કર્યા છે.)

તથા જે વેદક સમ્યહૃદ્રષ્ટિ જીવ છે તે શિથિલ શુદ્ધાત્માની હોય છે.

માટે વૃદ્ધ પુરુષ જે રીતે પોતાના હાથમાં લાકડીને શિથિલતાપૂર્વક

પકડે છે, તે રીતે તે પણ તત્ત્વાર્થના વિષયમાં શિથિલગ્રાહી હોય છે, તેથી કુહેતું અને કુદ્રદ્રાંતથી તેને સમ્યકૃત્વની વિરાધના કરવામાં વાર નથી લાગતી.

પાંચ પ્રકારના ભાવોમાંથી કચા - કચા ભાવોના આશ્રયથી અસંયત - સમ્યકૃત્વિ ગુણસ્થાનની ઉત્પત્તિ થાય છે ? આ રીતે પુછવાથી આચાર્ય શ્રી ઉત્તર આપે છે કે સાત પ્રકૃતિઓના ક્ષયથી જે સમ્યકૃત્વન ઉત્પત્ત થાય છે તે ક્ષાયિક છે, તેજ સાત પ્રકૃતિઓના ઉપશમથી ઉત્પત્ત થયેલ સમ્યકૃત્વ ઉપશમ સમ્યકૃત્વન હોય છે અને સમ્યકૃત્વનો એકદેશ ધાતૃપથી વેદન કરવાવાળી સમ્યકૃત્વપ્રકૃતિના ઉત્પત્ત થવાવાળું વેદક્ષસમ્યકૃત્વ ક્ષાયોપશમિક છે.

**શંકા ૭ :** ચોથા ગુણસ્થાનની આગળ અસંયમનો અભાવ શા માટે નથી કહ્યો ?

**સમાધાન :** આગળના ગુણસ્થાનોમાં અસંયમનો અભાવ એટલા માટે નથી કહ્યો, કારણ કે આગળના ગુણસ્થાનોમાં સર્વ સંયમાસંયમ અને સંયમ આ વિશેષણ જોવામાં આવે છે.

આ સૂત્રમાં જે સમ્યકૃત્વિ પદ છે, તે ગંગા નદીના પ્રવાહ સમાન આગળના સમસ્ત ગુણસ્થાનોમાં અનુવૃત્તિને પ્રાપ્ત થાય છે. અર્થાતું પાંચમાં આદિ સમસ્ત ગુણસ્થાનોમાં સમ્યકૃત્વન જોવામાં આવે છે.

**પ્રશ્ન:** - અમારી પાસે થોડી જ સંપત્તિ છે, તો દાન કયાંથી કરીએ ?  
**ઉત્તર:** - ભાઈ, વિશેષ સંપત્તિ હોય તો જ દાન થાય એવી કોઈ વાત નથી અને તું તેને સંસાર કાર્યોમાં ખર્ચ કરે છે કે નહીં ? તો ધર્મકાર્યમાં પણ ઉત્લાસપૂર્વક થોડી સંપત્તિમાં થી તારી શક્તિપ્રમાણે ખર્ચ કર. દાન વગર ગૃહસ્થપણું નિષ્ફળ છે. અરે ! મોક્ષનો ઉધમ કરવાનો આ અવસર છે. તેમાં બધો રાગ ન છુટે તો થોડો રાગ તો ઘટાવ. મોક્ષ માટે તો બધો રાગ છોડવો પડશે. જો દાનાદિ દ્વારા થોડો રાગ પણ ઘટાડવો તારાથી શક્ય નથી તો તું મોક્ષ નો ઉધમ કઈ રીતે કરીશ ?

ગુણસીલિ ગ્રંથીના માણસની જીવિત જીવિત જીવિત  
તીર્થયાત્રાની કોઈ વિશેષજ્ઞતા નથી હોતી નથી કાંઈ જીવિત  
નાના રીતનાની નોંધ કોઈ વિશેષજ્ઞતા નાહિયે જીવિત નિયત નિયત

## ૫

### દેશવિરત ગુણસ્થાન

પાંચમા ગુણસ્થાનનું નામ દેશવિરત છે. બહારમાં બુદ્ધિપૂર્વક અણુવ્રત  
ગ્રહણ કરવાથી અને અંતરંગમાં સમ્યક્ષર્ણન્પૂર્વક અનંતાનુંબંધી તથા  
અપ્રત્યાખ્યાનાવરણ કષાય ચોકડીનો અનુદય થવાથી દેશચારિત્રાપ  
આંશિક વીતરાગ પરિણામ પ્રગટ થવાથી પાંચમું ગુણસ્થાન થાય છે.

માત્ર વીતરાગભાવને પંચમગુણસ્થાન નથી કહેતા, વીતરાગતાના  
અવિનાભાવી બાધ અણુવ્રતાદિ પાલન કરવાનો રાગભાવ અર્થાત्  
પુણ્ય પરિણામ પણ આ ગુણસ્થાનના સ્વરૂપમાં અંતર્ગર્ભિત છે.

**પ્રશ્ન ૪૮:** કોઈ મળુષ્ય અણુવ્રતોને ગ્રહણ કરે અને તેને બે કષાય  
ચોકડીના અભાવપૂર્વક વીતરાગતા વ્યક્ત ન હોય તો તેને પાંચમું  
ગુણસ્થાન થશે કે નહીં ?

**ઉત્તર:** નહીં થાય, કારણ કે માત્ર આણુવ્રતોના ગ્રહણ કરવારૂપ રાગ  
અર્થાત્ પુણ્ય પરિણામને દેશવિરત ગુણસ્થાન નથી કહેતાં, કારણ કે  
આ માન્યતા વ્યવહારાભાસરૂપ છે. બે કષાય ચોકડીના અનુદયથી  
વીતરાગતારૂપ સાચોદર્મ વ્યક્ત થઈ ગયો હોય અને તે જ સમય  
અણુવ્રતાદિના પાલન કરવાના શુલ્પ પરિણામ પણ ચાલી રહ્યા હોય,  
તો જ દેશવિરત ગુણસ્થાન હોય છે, કારણ કે ત્યાં વ્યવહાર-નિશ્ચયનો  
સુભેન છે.

અણુવ્રતાદિ કે મહાવ્રત પાંચમા અથવા છઠા-સાતમાં ગુણસ્થાનના  
ઉત્પાદક કારણ નથી, માત્ર જ્ઞાપક કારણ છે. જ્ઞાપક કારણ એટલે  
નિભિત. નિભિતને ઉત્પાદક કારણ માનવું મહાન અજ્ઞાન છે.

આચાર્ય શ્રી નેમિયંબ્રેદેવે ગોમ્મટસાર જીવકાંડ ગાથા ૩૦માં દેશવિરત  
ગુણસ્થાનની પરિભાષા આ પ્રકારે આપેલ છે:-

**પચ્ચક્ખાણુદ્યાદો, સંજમભાવો ણ હોદિ ણવર્ણ તુ ।**

**થોવવદો હોદિ તદો, દેસવવદો હોદિ પંચમઽાં ॥**

પ્રત્યાખ્યાનાવરણ કષાય કર્મના ઉદ્યકાળમાં અર્થાત् નિમિત્તથી પૂર્ણ સંયમભાવ પ્રગટ ન થવા છતાં પણ સમ્યકુદર્શનપૂર્વક અણુપ્રતાદિં અહિત તથા બે કષાય ચોકડીના અભાવપૂર્વક વ્યક્ત થવાવાળી વીતરાગ દશાને દેશવિરત ગુણસ્થાન કહે છે.

ઉક્ત પરિભાષામાં “પ્રત્યાખ્યાનાવરણ કષાયના ઉદ્યકાળ”માં એવું વાક્ય છે તથા આગળ કહ્યું છે કે “પૂર્ણ સંયમભાવ પ્રગટ ન થવા છતાં પણ.” આ વાક્યોનો અર્થ એ થયો કે પ્રત્યાખ્યાનાવરણ કષાયના ઉદ્યકાળમાં આંશિક વીતરાગતારૂપ દેશસંયમ હોય છે. અણુપ્રતાદિં શ્રાવકના શુલ્ભોપયોગરૂપ ગ્રતોના પાલનનો ભાવ પ્રત્યાખ્યાનાવરણ કર્મના ઉદ્યનું કાર્ય છે.

આ વિચારણીય છે કે અણુપ્રતાદિના પાલનનો ભાવ ઔદચિકભાવ છે, જે કર્મના ઉદ્યના નિમિત્તથી થાય છે, તે વીતરાગભાવરૂપ નિશ્ચયધર્મ કેવી રીતે થઈ શકે ? જે કુરોદ્યના નિમિત્તથી થશે, તે તો શુલ્ભ કે અશુલ્ભભાવ રૂપ વિલાવ જ હશે. તે વીતરાગભાવરૂપ ધર્મ ન થઈ શકે.

બ્રત પાલનના શુલ્ભ પરિણામ તથા બાહ્યકિયા ને તો ઉપચારથી વ્યવહારધર્મ કહ્યો છે. આને વ્યવહારધર્મ પણ એટલા માટે કહ્યો છે, કારણ કે આની સાથે બે કષાય ચોકડીના અભાવપૂર્વક આંશિક વીતરાગરૂપ નિશ્ચય ધર્મ હોય છે.

ચોથા ગુણસ્થાનની જ આંશિક વીતરાગતારૂપ જ્ઞાનધારા/ધર્મધારા પ્રારંભ થઈ ગઈ છે, ચોથામાં રાગધારા અર્થાત્ કર્મધારા વિશેષ પ્રમાણમાં હતી. હવે દેશવિરત ગુણસ્થાનમાં વીતરાગધારા વદી ગઈ છે અને રાગધારા ચોથા ગુણસ્થાનની અપેક્ષાએ હીન થઈ ગઈ છે.

### નામ અપેક્ષા વિચાર:

વિરતાવિરત, સંયમાસંયમ, દેશસંયમ, દેશચારિત્ર ઇત્યાદિ અનેક નામ પાંચમા ગુણસ્થાન માટે છે. પંચમ ગુણસ્થાનવર્તી ત્રસ હિંસાથી વિરત છે અને સ્થાવર હિંસાથી અવિરત રહે છે, તેથી આનું વિરતાવિરત નામ પણ સાર્થક છે.

બાર પ્રકારની અવિરતિમાંથી આંશિકરૂપથી સંયમનું પાલન કરે છે અને શેષ અસંયમ છે, એવું જેનું જીવન હોય, તેને સંયમાસંયમી કહે છે. જે ચારિત્ર સકલ ચારિત્ર નથી, તેને દેશચારિત્ર કહે છે.

## ભેદ :

અગ્યાર પ્રતિમાઓની અપેક્ષાએ દેશવિરતગુણસ્થાનના અગ્યાર ઉપભેદ છે, જે આ પ્રકારે છે. - દર્શનપ્રતિમા, પ્રત, સામાચિક, પૌખદ, સચેતત્વાગ, દિવામૈથુનત્વાગ અથવા રાત્રિલોજન ત્વાગ, બ્રહ્મચર્ય, આરંભત્વાગ, પરિગ્રહત્વાગ, અનુમતિત્વાગ અને ઉદ્દિષ્ટ ત્વાગ પ્રતિમા.

ઉદ્દિષ્ટત્વાગ પ્રતિમાના પણ બે ભેદ છે. (૧) એક વસ્ત્રધારી શ્રાવક ઐલક અને (૨) બે વસ્ત્રધારી શ્રાવક ક્ષુલ્લક - આ પ્રતિમાઓનું સામાન્ય સ્પર્શપ નાટક સમયસારના ચૌદમાં અધિકારના પદમાં છંદમાં શાસ્ત્રકારના શબ્દોમાં આ રીતે છે.

**સંજમ અંશ જગ્યા જહાં, ભોગ અરુચિ પરિણામ ।**

**ઉદ્ય પ્રતિજ્ઞા કૌ ભયો, પ્રતિમા તાકૌ નામ ॥**

સંચયમનો અંશ પ્રગટ થયો, પરિણામોના ભોગોથી વિરક્ત થવું અને પ્રતિજ્ઞાનો ઉદ્ય થયો, તેને પ્રતિમા કહે છે.

ઉક્ત દોહામાં ત્રણ વિષય બતાવેલ છે.

(૧) સંજમ અર્થાત् ચારિત્રનો અંશ પ્રગટ થયો છે. બે કુષાય ચોકડીના અભાવપૂર્વક વ્યક્ત વીતરાગતા જ અહીં નિશ્ચય ચારિત્ર છે.

(૨) વિશિષ્ટ આંશિક વીતરાગતા વ્યક્ત થતાં જ તે જ સમયે સ્પર્શનાદિ પાંચ દિનિક્યોના સ્પર્શાદિ વિષય સંબંધી ભોગોથી વિરક્તિ/ અરુચિના ભાવ ઉત્પન્ન થયા.

(૩) પ્રતિજ્ઞાનો ઉદ્ય અર્થાત્ પંચેનિક્યોના ભોગોથી અરુચિરૂપ ભાવને કારણ ભોગોનો ત્વાગ કરવા માટે બુદ્ધિપૂર્વક પ્રત લેવાનો જે શુભભાવ થયો, તે જ વ્યવહાર પ્રતિમા છે.

જૈનધર્મ ભાવ પ્રધાન છે. આત્મા માત્ર ભાવ જ કરે છે, તેથી ભાવને અનુસાર કિયામાં પણ પરિવર્તન થયા વિના નથી રહેતું. (મોક્ષમાર્ગ પ્રકાશક પા. ૨૭૮) છતાં બાહ્ય કિયાને અનુસાર ભાવમાં પરિવર્તન થવાનો નિયમ નથી.

દોહામાં વ્યક્ત ત્રણ વિશેષતાઓમાં પ્રથમ બે અર્થાત્ સંચય અને ભોગોથી અરુચિરૂપ વિરક્તતાનો ભાવ તો વીતરાગ ભાવરૂપ અર્થાત્ નિશ્ચયધર્મરૂપ છે અને પ્રતિજ્ઞા બ્રહ્મણ કરવાનો ભાવ શુભભાવરૂપ ઔદ્ઘિકભાવ છે.

પહેલી પ્રતિમાનું નામ દર્શનપ્રતિમા છે અને અગ્યારમી પ્રતિમાનું નામ ઉદ્દિષ્ટત્વાગ પ્રતિમા છે. આ બંને પ્રતિમાઓના બાબ્ધ ત્યાગમાં અંતર તો ઘણું છે. છતાં બંનેનું ગુણસ્થાન પાંચમું જ છે, કારણ કે બંનેમાં બે કખાય ચોકડીનો જ અનુદય છે.

દર્શનપ્રતિમાધારી આત્માનુભવી સમ્યક્ષક્રિય શ્રાવક મૂળગુણોમાં તથા સખ વ્યસનના ત્યાગમાં અતિચાર નથી લગાવતો. દેવપૂજા આદિ છ કર્મોનું પાલન કરે છે. તે શ્રાવક માતા-પિતા, ભાઈ-ભહેન, પતની તથા બાળકોની સાથે ઘરમાં રહે છે. નીતિ-ન્યાયપૂર્વક વ્યાપારાદિ આરંભ કાર્ય કરીને ધન કમાવે છે. હેય બુદ્ધિપૂર્વક અરુચિથી અનેક વાર ભોજન કરે છે. પરિણામોમાં ઉત્સાહ ન હોવા છતાં પણ ભૂમિકા અનુસાર લૌકિક વ્યવહારમાં અનેક પ્રકારના સુંદર કપડાં પહેરે છે. પોતાના પરિણામોની કમજોરી તથા પુણ્યોદયાનુસાર અલ્પ કે અધિક પરિશ્રહ પણ રાખે છે.

અગ્યારમી પ્રતિમાધારી ઉદ્દૃષ્ટ શ્રાવક ક્ષુલ્લક અને ઐલક તો નિયમથી ધર છોડી દિગંબર મુનિરાજના સંઘ સાથે વન-વસતિકા આદિમાં નિવાસ કરે છે. વ્યાપારાદિ અશુભોપયોગરૂપ આરંભ - પરિશ્રહના સર્વથા ત્યાગી છે. ધન રાખવાનો ભાવ જ મનમાં નથી આવતો. ઉદ્દૃષ્ટ રહિત દિવસમાં એકવાર જ લિક્ષાવૃત્તિથી પ્રાસુક ભોજન કરે છે. દૂધ કે પાણી આદિ પેચ ભોજનના સમયે જ લે છે, અન્ય સમયમાં નહીં. ક્ષુલ્લક બે - ખંડવસ્ત્ર તથા લંગોટી અને ઐલક માત્ર એક લંગોટીનો જ ઉપયોગ કરે છે.

પૂર્વોક્ત પ્રકાર પહેલી અને અગ્યારમી પ્રતિમાધારી શ્રાવકના બાબ્ધ જીવનમાં ઘણો અંતર હોવા છતાં પણ બંનેને માત્ર બે જ કખાય ચોકડીના અભાવપૂર્વક વીતરાગતા છે, તેથી બંને પંચમ ગુણસ્થાનવર્તી જ છે.

**પ્રશ્ન ૪૮ :** પહેલી પ્રતિમાધારી અને ક્ષુલ્લક-ऐલક અગ્યારમી પ્રતિમાધારી - આ બંનેની વ્યક્ત વીતરાગતા/શુદ્ધિ/ધર્મ એક સમાન જ છે કે કાંઈ લેદ પણ છે ?

**ઉત્તર :** બે કખાય ચોકડીના અનુદયરૂપ નિમિત્તથી એમનું ગુણસ્થાન પાંચમું જ છે, કારણ કે બે કખાય ચોકડીના અભાવમાં થવાવાળી વ્યક્ત વીતરાગતારૂપ પરિણાતિ/શુદ્ધતામાં કોઈ અંતર નથી, છતાંચ બંનેની વ્યક્ત વીતરાગતારૂપ પરિણાતિમાં ઘણો જ અંતર છે, કારણ કે પંચમગુણસ્થાનવર્તી સાધકોના સૂક્ષ્મ પરિણામોની ફ્રાન્ઝિથી અસંખ્યાત

લેદ છે. તે અસંખ્યાત લેદોને અગ્યાર પ્રતિમાઓમાં વિલક્ત કરેલ છે. આ લેદોનું મૂળ કારણ ત્રિકાળી, સહજ, નિજશુદ્ધાત્માની સાધનાંથી પુરુષાર્થની હીનાધિકતા જ છે.

આ સાધનાના ફળસ્વરૂપ વિશુદ્ધિનું નિમિત્ત પામી પ્રત્યાખ્યાનાવરણ તથા સંજ્યલન કોધાઈ ચતુર્ષટ્ય કર્મોનો ઉદ્ય તીવ્ર, મંદ, મંદતર, મંદતમ હોય છે. આ ઉદ્યના નિમિત્તથી શુદ્ધિમાં અંતર હોય છે. તેથી બંનેની શુદ્ધિ, સુખ, સંપર, નિર્જરા આદિમાં પણ યથાયોગ્ય અંતર રહે છે.

**પ્રશ્ન ૫૦ :** કૃત્યલક અને ઐલકમાં માત્ર બાબ્દ કપડાં તથા કાંઈક બાબ્દ કિયાઓને કારણ જ લેદ છે કે વીતરાગતામાં પણ કાંઈ લેદ છે ?

**ઉત્તર :** કપડાંથી પરિગ્રહ અને આહાર કિયાની અપેક્ષાએ ચરણાનુયોગ સાપેક્ષ જે અંતર છે, તે તો સ્પષ્ટ છે જ. સાથે જ વ્યક્ત વીતરાગતામાં પણ અંતર છે. સંપર, નિર્જરા, સુખ, શાંતિ, શુદ્ધ્યોપયોગ, શુદ્ધ્યપરિણાત્મિક અદ્યિક માત્રામાં વ્યક્ત થવાને લિધે/નિમિત્તથી જ ઐલકના કપડાં આદિ બાબ્દ પરિગ્રહમાં ઓછાપ આવી છે.

કૃત્યલકના જીવનમાં ઐલકની અપેક્ષાએ વીતરાગતા ઓછી માત્રામાં પ્રગટ થઈ છે. તેથી તેમની પાસે કપડાં વધારે છે અને લોજનાર્દિની કિયા પણ ભિન્ન છે.

ऐલકની નિજ શુદ્ધતાની સાધના વિશેષ બળવાળી થઈ ગઈ છે. આ નિમિત્તથી પ્રત્યાખ્યાનાવરણ તથા સંજ્યલન કષાય ચતુર્ષટ્ય કર્મોનો ઉદ્ય મંદ, મંદતર, મંદતમ થઈ જાય છે. તેથી ઐલકની આત્મિક શુદ્ધિની વૃદ્ધિ થાય તે સ્વાભાવિક છે.

**પ્રશ્ન ૫૧ :** એક શ્રાવકે આજે સાતમી પ્રતિમા સ્વીકાર કરી છે અને અન્ય કોઈ શ્રાવકની અનેક વર્ષોથી સાતમી પ્રતિમાની સાધના ચાલુ છે, આ બંનેમાં કોઈ અંતર છે કે નહીં ?

**ઉત્તર :** બંને સાધકોમાં બે ક્રિષ્ટિથી અંતર હોઈ શકે છે. સામાન્ય અપેક્ષાથી વિચારીએ તો અનેક વર્ષોથી સાતમી પ્રતિમાની સાધના કરવાવાળાની વીતરાગતા વિશેષ અદ્યિક હોવી જોઈએ, કારણ કે તેને પ્રત્યાખ્યાનાવરણ કષાયનો ઉદ્ય મંદ થઈ ગયો છે અને સંજ્યલન કષાયનો પણ સાપેક્ષ મંદોદ્ય થાય છે.

જો આજનો સાતમી પ્રતિમાધારી વિશેષ પુરુષાર્થી હોય તો તે

પહેલાનાં સાતમી પ્રતિમાધારીથી પણ પોતાની પર્યાયની ચોગ્યતાથી વધારે વીતરાગતા પ્રગટ કરી શકે છે. વ્યક્ત વીતરાગતાની હીનાઘિકતા હોવી, તે તે સાધક જીવના નિજશુદ્ધાત્માના આશ્રયરૂપ પુરુષાર્થ પર નિર્લિપ છે.

### સમ્યકૃત્વ અપેક્ષા વિચાર:

દેશવિરત નામના પંચમ ગુણસ્થાનવર્તી શ્રાવકને ઔપશમિક, ક્ષાયોપશમિક અને ક્ષાયિક - આ ત્રણ સમ્યકૃત્વોમાંથી કોઈ પણ એક સમ્યકૃત્વ રહી શકે છે.

### ચારિત્ર અપેક્ષા વિચાર:

પંચમ ગુણસ્થાનવર્તી પ્રતી શ્રાવકને સંયમાસંયમ ચારિત્ર હોય છે. અહીં અપ્રત્યાખ્યાનાવરણ ક્ષાય કર્મોના વર્તમાનકાલીન સર્વધાતિ સ્પર્ધકોનો ઉદ્યાભાવી ક્ષય, ભવિષ્યમાં ઉદ્યમાં આવવા ચોગ્ય સર્વધાતિ સ્પર્ધકોનો સંદર્ભસ્થારૂપ ઉપશમ તથા પ્રત્યાખ્યાનાવરણ ક્ષાય કર્મનો ઉદ્ય રહે છે, તેથી પંચમ ગુણસ્થાનવર્તીને ચારિત્રમોહનીય કર્મનો ક્ષયોપશમ હોય છે. (ધ્વલા પુસ્તક ૧, પાનું ૧૭૫-૧૭)

ચોથા અવિરત સમ્યકૃત્વ ગુણસ્થાનમાં અનંતાનુબંધીના અનુદ્યથી ચારિત્રમાં સમ્યકૃપણું થઈ જાય છે, કારણ કે સમ્યકૃદર્શન સાથે જ્ઞાન અને ચારિત્ર - બંને સમ્યકૃ થઈ જ જાય છે. દેશવિરત ગુણસ્થાનમાં ઉપર ચારિત્રમોહનીય કર્મનો ક્ષયોપશમ ધાર્ટિત કરીને બતાવેલ છે, પરંતુ દેશસંયમ ચારિત્રને ક્ષયોપશમિક ચારિત્ર નથી કહેતા.

“ક્ષયોપશમિક ચારિત્ર” એવું નામ તો સકલ ચારિત્રને જ આપવામાં આવે છે. તત્ત્વાર્થસૂત્ર ગ્રંથનાં બીજા અદ્યાયના પાંચમાસૂત્રમાં ક્ષયોપશમિકભાવના અઢાર ભેદ બતાવેલ છે. તેમાં ક્ષયોપશમિક ચારિત્ર અને સંયમાસંયમરૂપ દેશચારિત્ર ભિન્ન - ભિન્ન ગણાવ્યા છે.

જ્યારે ભાવલિંગી મુનિરાજના ત્રણ ક્ષાય ચોકડીના અભાવને કારણ વીતરાગતારૂપ નિશ્ચય ચારિત્ર પ્રગટ થાય છે, ત્યારે દેશધાતિરૂપ સંજ્વલન ક્ષાય તથા નવ નોક્ષાયોનો ઉદ્ય રહે છે. તે સમયે જ ક્ષયોપશમિક ચારિત્ર ધાર્ટિત થાય છે.

જ્યારે જીવના પરિણામ/ભાવોમાં દેશધાતિ કર્મનો ઉદ્ય નિમિત્ત રહે છે, ત્યારે જ જીવના ક્ષયોપશમિક ભાવ પ્રગટ થાય છે, એવો નિયમ છે.

આ નિયમ ક્ષાયોપશમિક ભાવના અઠાર લેદોમાં પણ લાગુ પડે છે.

અનંતાનુંબંધી, અપ્રત્યાખ્યાનાવરણ અને પ્રત્યાખ્યાનાવરણ કષાય કર્મ - આ ત્રણે સર્વધાતિ હોવાથી આમાં ક્ષાયોપશમ ભાવની પરિભાષા પૂર્ણપણે ઘટિત થતી નથી. અનંતાનુંબંધી અને અપ્રત્યાખ્યાનાવરણ કષાયના અનુદ્ય તથા પ્રત્યાખ્યાનાવરણનો ઉદ્ય થવાથી ઔપचારિક ક્ષાયોપશમિક માનવામાં આવે છે. - આ કારણ છે કે દેશવિરત ગુણસ્થાનમાં ક્ષાયોપશમિક ચારિત્ર નથી કહ્યું.

### કાળ અપેક્ષાએ વિચાર :

**જધન્ય કાળ :** અંતર્મુહૂર્ત. મનુષ્ય કે તિર્યંચ જીવ વિરતાવિરત નામના ગુણસ્થાનવર્તી થઈ જાય છે અને તે આ પંચમ ગુણસ્થાનમાં રહે છે તો ઓછામાં ઓછા અંતર્મુહૂર્ત કાળ જ રહે છે. આનાથી ઓછા કાળમાં સાધક આ ગુણસ્થાનથી અન્ય ગુણસ્થાનોમાં ગમન નથી કરતો.

**જેમ કે - છઢા -** સાતમાં ગુણસ્થાનથી લઇને ઉપશમશ્રેણીના ચારેય ગુણસ્થાનોનો કાળ મરણની અપેક્ષા એક - બે સમયાદિનો હોઈ શકે છે. સાસાદનો કાળ એક-બે-સમયાદિ હોઈ શકે છે, પરંતુ પંચમ ગુણસ્થાનનો કાળ અંતર્મુહૂર્તથી ઓછા હોઈ જ ન શકે.

**ઉત્કૃષ્ટ કાળ :** મનુષ્યની અપેક્ષા ગર્ભકાળ સહિત આઠ વર્ષ અને એક અંતર્મુહૂર્ત ઓછું એક પૂર્વકોટી વર્ષ છે તથા સંમૂર્ચિષ્મ તિર્યંચની અપેક્ષાએ ત્રણ અંતર્મુહૂર્ત ઓછા એક પૂર્વકોટી વર્ષ છે. (ઘવલા પુ. ૪. પાના નં. ૩૬)

**મદ્યમ કાળ :** યથાયોગ્ય અંતર્મુહૂર્ત જધન્યકાળમાં એક-બે-ત્રણ આદિ સમયોને વધારતાં - વધારતાં એક અંતર્મુહૂર્ત ઓછું પૂર્વ કોટી વર્ષ સુધી જેટલાં-જેટલાં ભેદ હોય છે, તે સર્વ ભેદ દેશવિરત ગુણસ્થાનના મદ્યમકાળના ભેદ સમજવા જોઈએ.

**પ્રશ્ન પર :** સંમૂર્ચિષ્મ જીવ તો અસંજી હોય છે અને અસંજી જીવોને જ્યારે સમ્યક્ષર્ણન જ નથી થતું, તો તેમને પાંચમું ગુણસ્થાન કેમ થઈ શકે?

**ઉત્તર :** સંમૂર્ચિષ્મ જીવ સંઝી-અસંજી બંને હોય છે, આ કથન સ્વયંભૂરમણ સમુક્રમાં નિવાસ કરવાવાળા સંમૂર્ચિષ્મ તિર્યંચોની મુખ્યતાથી છે.

ઘવલા પુસ્તક-૪, પાના -૩૬ પર આનો ઉલ્લેખ આ પ્રકારે છે કે મોહનીય કર્મની ૨૮ પ્રકૃતિઓની સત્તાવાળા તિર્યંચ કે મનુષ્ય

મિથ્યાક્રષિ, સંજી, પંચેન્દ્રિય સંમૂહીએ, પર્યાપ્ત દેડકાં, માછલાં, મગરમચ્છ આદિ તિર્યાચોમાં ઉત્પન્ન થાય છે.

### ગમનાગમન અપેક્ષા વિચાર :

ગમન : ૧) કોઈ પંચમ ગુણસ્થાનવર્તી ક્રવ્યલિંગી મુનિરાજ પહેલા જેટલો શુદ્ધાત્માનો આશ્રય લઈ રહ્યા હતાં, તેથી પણ વિશેષ અધિક રીતિથી નિજ શુદ્ધાત્માનો આશ્રય લઈને અર્થાત્ શુદ્ધોપયોગ છારા જ અપ્રમત્તવિરત ગુણસ્થાનમાં ગમન કરવાથી ભાવલિંગી મુનિરાજ થઈ જાય છે.

ભાવલિંગી પંચમગુણસ્થાનવર્તી શ્રાવક હો કે પંચમગુણસ્થાનવર્તી ક્રવ્યલિંગી મુનિરાજ હો, તે પાંચમાંથી –

૨) ચોથા ગુણસ્થાનમાં અથવા

૩) ત્રીજા ગુણસ્થાનમાં અથવા ઔપશમિક સમ્યકૃત્વની સાથે હોય તો,

૪) બીજા ગુણસ્થાનમાં અથવા પરિણામોમાં વિશેષ અધઃપતન થવાથી સીધા,

૫) મિથ્યાત્વ ગુણસ્થાનમાં પણ ગમન કરી શકે છે.

આગમન : ૧) પ્રમત્તસંયત ગુણસ્થાનવર્તી ભાવલિંગી મુનિરાજ સીધા દેશવિરતમાં આવી શકે છે.

૨) ચોથા ગુણસ્થાનવર્તી ક્રવ્યલિંગી મુનિરાજ અથવા ક્રવ્યલિંગી શ્રાવક દેશવિરત ગુણસ્થાનમાં આવી શકે છે.

૩) પ્રથમ ગુણસ્થાનવર્તી ક્રવ્યલિંગી મુનિરાજ અથવા ક્રવ્યલિંગી શ્રાવક પણ સીધા આ દેશવિરત ગુણસ્થાનમાં આવી શકે છે.

### વિશેષ અપેક્ષા વિચાર :

(૧) સર્વર્थિક્ષિદ્ધિ આદિ એક ભવાપતારી દેવોના સમ્યકૃત્વ, બાલબ્રહ્મચર્યાત્પ, છાદશાંગજ્ઞાનત્વાદિની ઉપસ્થિતિમાં તથા તેમના જનસામાન્યવત્ત પાંચપાપ, સ્થૂળ વિષય-કષાય, અસિ-મસિ આદિ હિસાજન્ય ઘટકર્મ જોવામાં ન આવવા છતાં અંતરંગમાં એક કષાય ચોકડીના અભાવમાં ઉત્પન્ન વીતરાગતા થવાથી તેઓને દેશસંયમ નથી, પરંતુ અસંયમ જ છે અને મનુષ્ય તિર્યાચોની ઉપર્યુક્ત બાબુ પ્રવૃત્તિ જોવામાં આવવા છતાં પણ અંતરંગમાં સમ્યકૃદર્શન સહિત બે કષાય ચોકડીના અનુદ્યમાં ઉત્પન્ન વીતરાગતા વિધમાન થવાથી દેશસંયમ છે. આનો સ્પષ્ટ અર્થ એ થયો કે બાર અંગના જ્ઞાતા સૌધર્મ ઈંધ્ર,

લૌકાંતિક દેવ અથવા અહમિન્દ્ર દેવ, જે આત્માનંદનો અનુભવ કરી સુખી જીવન વ્યતીત કરે છે, તેનાથી પણ અતિ અલ્પજ્ઞાનના ધારક, ભૂમિકા યોગ્ય બાબુ હિસાડિ પાપથી આંશિક વિરત રહેવાવાળા દેશવતી મળુષ્ય - તિર્યચ પણ અધિક(વિશેષ) સુખી જીવન વ્યતીત કરે છે. (આ વિષયના સ્પષ્ટીકરણ માટે મોક્ષમાર્ગ પ્રકાશકનું પાના નં. ૨૩૨ જુઓ અને ડૉ. હુકમયંદજી ભારિલ્લે લખેલ ધર્મના દસલક્ષણના “ઉત્તમ સંચમ ધર્મ” નું અવલોકન કરો.) સુખનો સીધો સંબંધ વ્યક્ત વીતરાગતાથી છે, બાબુ પ્રવૃત્તિને અનુસાર ત્યાગ-ગ્રહણથી નથી.

(૨) સ્વયંભૂમણ સમુક્રમાં પ્રતિકૂળ વાતાવરણમાં પણ શુદ્ધાત્માનુભવરૂપ સમ્યક્ષર્ણન સહિત બે કષાય ચોકડીનાં અભાવપૂર્વક વ્યક્ત વીતરાગતારૂપ દેશચારિત્ર હોય છે. આ કારણે અસંખ્યાત તિર્યચ પણ અતીનિદ્રય આનંદનો અનુભવ કરતાં થકા પંચમ ગુણસ્થાનવત્તી છે.

ધર્મ (વીતરાગતા) વ્યક્ત કરવા માટે, ધર્મની વૃદ્ધિ કરવા માટે અથવા ધર્મની પરિપૂર્ણતા માટે બાબુ અનુકૂળતા કે પ્રતિકૂળતા અકિંચિત્કર છે, આ વિષય અહીં સ્પષ્ટ સમજમાં આવી જાય છે.

બાબુ પ્રતિકૂળ વાતાવરણ ધર્મ પ્રગટ કરવાના કાર્યમાં કાંઈ બાધક થતું હોત તો નરકમાં કોઈ પણ જીવને સમ્યક્ષત્વની પ્રાપ્તિ ન થવી જોઈએ, પરંતુ અસંખ્યાત નાર્કી સમ્યક્ષત્વની પ્રાપ્તિ કરે છે. નવ ગ્રૈવેયક સુધીના સ્વર્ગના બધાં દેવોને બાબુ અનુકૂળતાને કારણ સમ્યક્ષર્ણન થવું જ જોઈએ, એવો નિયમ ન થઈ શકે, કારણ કે અનેક દેવ મિથ્યાદ્રષ્ટિ જોવા મળે છે.

ઉપસર્ગ કે પરિષહમાં જકડાયેલાં સાધુની સાધુતા નાચ થઈ જવી જોઈએ અને તેઓને ઉપસર્ગ તથા પરિષહ વિજયી થઈને કેવળી થવાનો અવસર પણ ન મળવો જોઈએ, છતાં અનેક મુનિરાજ ઉપસર્ગ - પરિષહ વિજયી થઈ અંતર્મુખ પુરુષાર્થ કરતાં થકા કેવળી થાય છે અને પોતાની અતીનિદ્રય અનંતસુખરૂપ પર્યાયને પ્રતિસમય પ્રગટ કરી જ રહ્યા છે.

ધર્મની કિયા તો આત્માની પોતાની સ્વાધીન અને સ્વતંત્ર કિયા છે, તેને બાબુ અન્ય દ્રવ્યોની કિયાથી કાંઈ પણ સંબંધ નથી.

(૩) અહીં સંચમ શબ્દ આદી દીપક છે, કારણ કે આ સંચમાસંચમ ગુણસ્થાનથી લઈને ઉપરના સર્વે ગુણસ્થાનોમાં સંચમ નિયમથી જોવામાં

આવે છે. સંયમ + અસંયમ આ બંને શબ્દોની સંઘિથી સંયમાસંયમ આ એક શબ્દ બનેલ છે.

(૪) અસંયમ શબ્દને અંતરીપક સમજવો જોઈએ, કારણ કે પંચમ ગુણસ્થાનથી લઇને આગળના ગુણસ્થાનોમાં અસંયમ હોતો જ નથી. આને સમજવા માટે પ્રથમ ચાર ગુણસ્થાનોની સાથે અસંયમ શબ્દ જોડીને સમજવું ઉપયોગી થઈ પડે છે. જેમ કે - મિથ્યાત્પ અસંયમ, સાસાદન સમ્યકૃત્વ અસંયમ, મિશ્ર અસંયમ આદિ.

ઘવલા પુસ્તક ૧ નો અંશ (પાનાનં ૧૭૪ થી ૧૭૯)

સામાન્યથી સંયતાસંયત જીવ છે ॥૧૩॥

જે સંયત હોવા છતાં પણ અસંયત હોય છે, તેઓને સંયતાસંયત કહે છે. શંકા ૧૦ : જે સંયત હોય છે તે અસંયત નથી હોઈ શકતો અને જે અસંયત હોય છે તે સંયત નથી હોઈ શકતો, કારણ કે સંયમભાવ અને અસંયમભાવનો પરસ્પર વિરોધ છે, માટે આ ગુણસ્થાન નથી બનતું. સમાધાન : વિરોધ બે પ્રકારના છે, પરસ્પર પરિહારલક્ષણ વિરોધ અને સહાનવસ્થા લક્ષણ વિરોધ. આમાંથી એક ફ્રલ્યના અનંતગુણોમાં પરસ્પર પરિહાર લક્ષણ વિરોધ ઈષ્ટ જ છે, કારણ કે જો ગુણોનો એક - બીજાનો પરિહાર કરી અસ્તિત્વ ન માનવામાં આવે તો તેના સ્વરૂપની હાનીનો પ્રસંગ આવે છે. પરંતુ એટલા માત્રથી ગુણોમાં સહાનવસ્થા લક્ષણ વિરોધ સંભવ નથી.

જે વિવિધ ગુણોનું એકસાથે રહેવું જ વિરોધ સ્વરૂપ માની લેવામાં આવે તો વસ્તુનું અસ્તિત્વ નથી રહી શકતું, કારણ કે વસ્તુનો સદ્ભાવ અનેકાંત - નિમિત્તક જ હોય છે. જે અર્થિક્યા કરવામાં સમર્થ છે, તે વસ્તુ છે. પરંતુ અર્થિક્યા એકાંતપક્ષમાં નથી થઈ શકતી, કારણ કે અર્થિક્યાને જો એકરૂપ માનવામાં આવે તો ફરી ફરી તે જ અર્થિક્યાની પ્રાસિ થવાથી અને જો અનેકરૂપ માનવામાં આવે તો અનવસ્થાદોષ આવવાથી એકાંતપક્ષમાં અર્થિક્યાના હોવાપણામાં વિરોધ આવે છે.

પૂર્વના કથનથી ચૈતન્ય અને અચૈતન્યની સાથે પણ અનેકાંત દોષ નથી આવતો, કારણે ચૈતન્ય અને અચૈતન્ય આ બંને ગુણ નથી. જે સહભાવી હોય છે, તેને ગુણ કહે છે. પરંતુ આ બંને સહભાવી નથી,

કારણ કે બંધરૂપ અવસ્થા નહીં રહેવાથી ચૈતન્ય અને અચૈતન્ય આ બંને એકસાથે નથી જોવામાં આવતાં.

બીજું, વિરુદ્ધ બે ધર્મોની ઉત્પત્તિનું કારણ જે સમાન અર્થાત् એક માનવામાં આવે તો વિરોધ આવે છે, પરંતુ સંયમભાવ અને અસંયમભાવ આ બંને ને એક આત્મામાં સ્વીકાર કરી લેવા છતાં પણ કોઈ વિરોધ નથી આવતો, કારણકે તે બંનેની ઉત્પત્તિનું કારણ બિન્ન બિન્ન છે.

સંયમભાવની ઉત્પત્તિ કારણ ત્રસહિસાથી વિરતિભાવ છે અને અસંયમભાવની ઉત્પત્તિનું કારણ સ્થાપર હિંસાથી અવિરતિભાવ છે. માટે સંયતાસંયત નામનું પાંચમું ગુણસ્થાન થઈ જાય છે.

**શંકા 11 :** ઔદ્યિક આદિ પાંચ ભાવોમાંથી ક્યા ભાવના આશ્રયથી સંયમાસંયમ ભાવ ઉત્પત્ત થાય છે?

**સમાધાન :** સંયમાસંયમ ભાવ ક્ષાયોપ્તશમિક છે, કારણકે અપ્રત્યાખ્યાનવરણ કર્ષાયના વર્તમાનકાળના સર્વધાતિ સ્પર્ધકો ના ઉદ્યભાવી ક્ષય થવાથી અને આગામી કાળમાં ઉદ્યમાં આવવા યોગ્ય તેના જ સદ્ગુરૂપ ઉપશમ થવાથી તથા પ્રત્યાખ્યાનાવરણ કર્ષાય ના ઉદ્યથી સંયમાસંયમરૂપ અપ્રત્યાખ્યાન ચારિત્ર ઉત્પન્ન થાય છે.

**શંકા 12 :** સંયમાસંયમરૂપ દેશચારિત્રના આધારથી સંબંધ રાજવાવાળા કેટલા સમ્યકૃદર્શન હોય છે?

**સમાધાન:-** ક્ષાયિક, ક્ષાયોપ્તશમિક અને ઔપશમિક આ ત્રણોમાંથી કોઈએક સમ્યકૃદર્શન વિકલ્પથી થાય છે, કારણકે તેમાંથી કોઈ એકના વિના અપ્રત્યાખ્યાન ચારિત્રનો પ્રાદુર્ભાવ જ નથી થઈ શકતો.

**શંકા 13 :** સમ્યકૃદર્શન વગર પણ દેશસંયમી જોવામાં આવે છે?

**સમાધાન :** ના, કારણ કે જે જીવ મોક્ષની આકાંક્ષાથી રહીત છે અને જેની વિષય પિપાસા દૂર નથી થઈ, તેને અપ્રત્યાખ્યાન સંયમની ઉત્પત્તિ નથી થઈ શકતી. કહ્યું પણ છે -

“જે જીવ જિનેન્ફ્રેટેવમાં અદ્ધ્રતીય શ્રદ્ધાને રાખતો થકો એક જ સમયમાં ત્રસજીવોની હિંસાથી વિરત અને સ્થાપર જીવોની હિંસાથી અવિરત હોય છે, તેને વિરતાવિરત કહે છે.”

## प्रमत्तविरत गुणस्थान

ઇંગ્રિડ ગુણસ્થાનનું નામ પ્રમત્તવિરત ગુણસ્થાન છે. આ ગુણસ્થાન બાવલિંગી મુનિજારનું છે.

જેમ બીજું સાસાઈન ગુણસ્થાન છઢા, પાંચમાં કે ચોથા ગુણસ્થાનથી નીચે પડતા સમયે જ હોય છે, તેમ જ છદ્દું પ્રમત્તવિરત ગુણસ્થાન પણ સાતમાં અપ્રમત્તવિરત ગુણસ્થાનથી નીચે ઉત્તરતા સમયે જ થાય છે. આ સાર્વકાળિક તથા સાર્વદેશિક નિયમ છે.

જેવી રીતે કોઈ પણ જીવ મિથ્યાત્વ ગુણસ્થાનથી સાસાદન ગુણસ્થાનમાં નથી આવતો, તેવી જ રીતે મિથ્યાત્વ ગુણસ્થાનથી લઈ દેશવિરત સુધીના - આ પાંચે ગુણસ્થાનોથી કોઈપણ જીવ ચઢીને આ પ્રમત્તવિરત ગુણસ્થાનમાં ક્યારેય પણ નથી આવતો.

જેમ બીજા ગુણસ્થાનની પ્રાસિ મહાનતાની નિશાની નથી, તેમ પ્રમત્તવિરત ગુણસ્થાનની પ્રાસિ પણ મહાનતાની નિશાની નથી, છતાં છઢા ગુણસ્થાનમાં આવવું સખમ ગુણસ્થાનવર્તી ભાવલિંગી મુનિરાજનું અનિવાર્ય અંગ છે. છઢા ગુણસ્થાનમાં આવવાનું કોઈપણ મુનિરાજ ટાળી નથી શકતા.

બીજા ગુણસ્થાનની અપેક્ષાએ આ છઠા ગુણસ્થાનની એ વિશેષતા છે કે સાસાદન ગુણસ્થાનથી જીવ નિયમથી નીચેના મિથ્યાત્ત્વ ગુણસ્થાનમાં ગમન કરે છે, પરંતુ પ્રમત્સંચયતથી નીચેના કોઈ પણ ગુણસ્થાનમાં જવાનો ત્રિકાળ નિયમ નથી.

ઇଡા ગુણસ્થાનથી નીચે કોઈપણ ગુણસ્થાનમાં ગમન કર્યા વિના પણ આ ભાવલિંગી મુનિરાજ ઇડાથી સાતમાં અને સાતમાંથી ઇડામાં જવું -આવવું કે આવવું - જવું સતત કરતા થકા સાતિશાય અપ્રમત્ત થઈને

શ્રેષ્ઠી માંડી સિદ્ધ ભગવાન પણ થઈ શકે છે.

પ્રમત્તસંયત ગુણસ્થાનના પરિણામોની અર્થાત્ શુલોપયોગરૂપ બાહ્ય મહાપ્રતાદિની ઉપાદેયતા ભાવલિંગી મુનિરાજોને બિલ્કુલ પણ રહેતી નથી, કારણ કે એમનું મુખ્ય લક્ષ તો સતત પૂર્ણ શુદ્ધતાને પ્રાપ્ત કરવાનું જ હોય છે.

ઇછા ગુણસ્થાનમાં ભાવલિંગી મુનિરાજ અપ્રમત્તસંયતથી આવે તો છે પ્રત્યેક અંતર્મુહૂર્તમાં, પરંતુ જ્યારે - જ્યારે ઇછામાં આવે છે તો શીધ જ સાતમાં અપ્રમત્તસંયત દશામાં જ જવાનો બુદ્ધિપૂર્વક પુરુષાર્થ કરે છે, પ્રમત્તદશામાં જામી રહેવાનો નહીં.

અન્ય શબ્દોમાં એમ કહી શકાય કે જેને પ્રમત્તસંયત (શુલોપયોગ)ની મહિમા આવી જાય તો તે જીવ નિયમથી મિથ્યાત્વી થઈ જાય છે. શ્રાવક અથવા મુનિરાજ કોઈપણ સાધક જીવને પોતાના ત્રિકાળી નિજ શુદ્ધાત્માની ઉપાદેયતા છૂટીને કોઈપણ શુલોપશુલે પરિણામ અથવા બાહ્ય મન-વચન-કાચારૂપ કિયાની મહિમા/ઉપાદેયતા આવી જાય તો તેમનો મોક્ષમાર્ગ નિયમથી છૂટી જાય છે, આમ નિશ્ચિતરૂપથી સમજવું જોઈએ.

ત્રણ કષાય ચોકડીના અલાવમાં શુદ્ધ પરિણતિરૂપ વીતરાગતા સંદા હોવા છતાં રે મૂળગુણોના પાલનના શુલે પરિણામ જ ઇહું ગુણસ્થાન છે.

શ્રાવકના ચોથા અવિરતસમ્યહૃત્વ ગુણસ્થાનમાં અને પાંચમા દેશવિરત ગુણસ્થાનની અનેક પ્રતિમાઓમાં શુલે-અશુલે અને શુદ્ધ - આ ત્રણે ઉપયોગોમાંથી વધુ સમય તો પૂર્વ સંસ્કારવશ અશુલોપયોગમાં અથવા કદાચિત્ શુલોપયોગમાં જાય છે. પરંતુ શ્રાવકના જ્ઞાન - શ્રદ્ધામાં તો ત્રિકાળી નિજ શુદ્ધાત્માની જ ઉપાદેયતા રહે છે તથા તેનો જ આશ્રય(ધ્યાન) કરવાનો પુરુષાર્થ રહે છે.

શ્રાવક મુખ્યતાથી સામાચિકના કાળમાં સ્વભાવના આશ્રયથી શુદ્ધોપયોગનો જ પ્રચાસ કરતાં રહે છે, પરંતુ સામાચિકના કાળના અતિરિક્ત સમયમાં કદાચિત્ અશુલોપયોગ અથવા બુદ્ધિપૂર્વક શુલોપયોગના બાહ્ય કાર્ય પણ કરતાં જોવામાં આવે છે. તેવી જ રીતે ભાવલિંગી મુનિરાજના જીવનમાં શુદ્ધોપયોગની અપેક્ષા શુલોપયોગનો કાળ હંમેશા બેગાળો રહે છે. છતાં પણ તેમને બહુમાન/મહિમા/ઉપાદેયતા

શુલોપયોગની અણુમાત્ર (લેશમાત્ર)ની પણ રહેતી નથી.

પ્રશ્ન પડું : જીવ જે પરિણામમાં રહે છે, તેને તે પરિણામની મહિમા આવે છે ને ?

ઉત્તર : એવું બિલકુલ નથી. નારકી જીવ ૩૩ સાગરકાળ સુધી સાતમી નરકમાં રહે છે અને પ્રત્યેક સમયમાં નરકગતિના દુઃખોથી છૂટવા, ઈંછે છે. સમ્યકુદ્રષ્ટિ ચક્કવર્તી ૮૯ હજાર રાણીઓના રાગ અને છ ખંડના પરિચછ પરિણામો સાથે જીવનને હેય બુદ્ધિથી વિતાવે છે, છતાં પણ તે સંયોગો તથા સંયોગીભાવોથી છૂટવાની તડપન મનમાં સતત હોય જ છે.

સમ્યકુદ્રષ્ટિ સંયોગો અને સંયોગીભાવોમાં જળથી જુદા કમળવતુ રહે છે. મુક્તિગત સિદ્ધ જીવ પણ ભૂતકાળમાં અનાદિકાળથી મિથ્યાત્પને કારણે કુસંસ્કારોમાં રહેતા આવ્યા હતાં, પરંતુ તેઓને જ્યારે મિથ્યાત્પ આઈં વિકારો રહિત પોતાના સહજ શુદ્ધ આત્મસ્વભાવની ઉપાદેચતા ઉત્પન્ન થઈ ત્યારે જ તે સમ્યકુદ્રષ્ટિ થયા હતાં.

કોઈપણ મિથ્યાક્રષણે જે સમ્યકુદ્રષ્ટિ થવું હોય તો તેને પણ પોતાના વર્તમાનકાળમાં વિધમાન મિથ્યાત્પભાવને અને તેના વિષયને બુદ્ધિપૂર્વક હેય કરીને પોતાના વ્યક્ત જ્ઞાન-શ્રદ્ધાનમાં માત્ર ત્રિકાળી સહજ નિજ શુદ્ધાત્મ સ્વભાવની જ મહિમાની સ્વીકૃતિ અથવા પ્રતીતિ કરવી જ સમ્યકુદ્રષ્ટિ થવાનો એકમાત્ર ઉપાય છે. સમ્યકૃત્વની ઉત્પત્તિનો અન્ય કોઈ ઉપાય છે જ નહીં.

આ વિષયને સ્પષ્ટ સમજાવવા માટે ગ્રંથાધિરાજ સમયસાર શાસ્ત્ર ગાથા ૧૮૬ દ્વારા આચાર્ય શ્રી કુંદુંદેવે અત્યંત સુલોધ તથા મૌલિક શાન્દોમાં આસન્ન લખ્ય જીવને શુદ્ધ થવાની સલાહ આપી છે.

“શુદ્ધ આત્માને જાણતો થકો - અનુભવ કરતો થકો જીવ શુદ્ધ આત્માને જ પ્રાસ કરે છે અને અશુદ્ધ આત્માને જાણતો થકો - અનુભવ કરતો થકો જીવ અશુદ્ધ આત્માને જ પ્રાસ કરે છે.”

અસ્તુ ! પ્રકરણ તો પ્રમત્સંયત ગુણસ્થાનનું ચાલી રહ્યું છે.

આચાર્યશ્રી નેમિયંગ્રેને ગોમ્ભટસાર જીવકાંડ ગાથા ૩૨માં પ્રમત્સંયત ગુણસ્થાનની પરિભાષા આ પ્રમાણે આપેલ છે :-

સંજલણ-ણોક્સાયાણુદ્યાદો સંજમો હવે જમ્હા ।

મલજણણપમાદો વિ ય, તમ્હા હુ પમત્તવિરદ્દો સો॥

જો (ત્રણ કષાય ચોકડીના અભાવપૂર્વક) વીતરાગ પરિણામ, સમ્યકૃત્વ અને સકલ પ્રતોથી સહિત હોય, પરંતુ સંજ્વલન કષાય અને નવ નોકષાયના તીવ્ર ઉદ્ય નિમિત્ત, પ્રમાદ સહિત હોય, તેને પ્રમત્તવિરત ગુણસ્થાન કહે છે.

### નામ અપેક્ષા વિચાર:

પ્રમત્તસંયત, વિરત, સંયમ, સકલસંયમ, સકલચારિત્ર ઈત્યાદિ અનેક નામ છે. મોક્ષ સાધક મુનિજીવનમાં આ પ્રમત્તસંયત ગુણસ્થાન નિયમથી હોય જ છે.

અવિરતસમ્યકૃત્વ ગુણસ્થાનથી સૂક્ષ્મસંપરાય ગુણસ્થાન સુધી ચથાયોગ્ય વીતરાગ પરિણામ અને રાગ પરિણામ - બંને મિશ્રભાવ ભૂમિકાનુસાર થાય છે. જો કોઈ એવું માને કે છઢા ગુણસ્થાનમાં માત્ર વીતરાગ પરિણામ જ રહે છે, રાગ નહીં અથવા મહાપ્રતાદિ રૂપ મૂળગુણોનાં પાલનના રાગ પરિણામ જ રહે છે, વીતરાગ પરિણામ નહીં, તો તેની બંને માન્યતાઓ ઠીક નથી. અહીંચાના વીતરાગ પરિણામમાં ત્રણ કષાય ચોકડીનો અનુદ્ય નિમિત્ત છે અને ઔદ્યિક રાગ પરિણામને માટે સંજ્વલન કષાય ચોકડીનો તીવ્ર ઉદ્ય નિમિત્ત છે.

**પ્રશ્ન પણ :** પ્રમત્તવિરત ગુણસ્થાનમાં સંજ્વલન કષાય ચોકડી અને નવ નોકષાયોનો ઉદ્ય કહ્યો, એ તો ઠીક, પરંતુ તીવ્ર ઉદ્ય કહેવાનું કારણ શું છે ?

**ઉત્તર :** ગોમ્મટસાર જીવકાંડ ગાથા - જપમાં અપ્રમત્તગુણસ્થાનનું સ્વરૂપ સમજાવતાં આચાર્યશ્રી નેમિચંદ્રદેવે કષાય તથા નોકષાયનો મંદ ઉદ્ય કહ્યો છે. અપ્રમત્તસંયત સાતમા ગુણસ્થાનમાં (શુદ્ધોપયોગરૂપ દ્વારાનાપસ્થામાં) કષાય - નોકષાયોનો ઉદ્ય મંદ હોય છે, એ અપેક્ષાએ દ્વારાહિત શુભોપયોગરૂપ પ્રમત્તસંયત છઢા ગુણસ્થાનમાં તીવ્ર ઉદ્ય કહ્યો છે, કારણ કે મુનિરાજ સંજ્વલન કષાયના તીવ્ર ઉદ્યથી જ સહજ નીચે છઢા ગુણસ્થાનમાં આવે છે, છતાંચ અનંતાનુંબંધી આદિ ત્રણ કષાય ચોકડીના અભાવથી શુદ્ધ પરિણાત સતત રહે જ છે.

છઢા ગુણસ્થાનથી લઇને દસમાં સૂક્ષ્મસંપરાય ગુણસ્થાન સુધી કષાય અને નોકષાયોનો ઉદ્ય નિમનાનુસાર રહે છે.

(૧) પ્રમત્તસંયતમાં સંજ્વલન તથા નોકષાયનો તીવ્ર ઉદ્ય હોય છે.

(૨) અપ્રમત્તસંયત ગુણસ્થાન માં સંજવલન કખાય ચોકડી તથા નોકખાયોનો મંદઉદય રહે છે.

(૩) અપૂર્વકરણ ગુણસ્થાનમાં સંજવલન તથા નોકખાયનો મંદતર ઉદય હોય છે.

(૪) અનિવૃત્તિકરણ ગુણસ્થાન માં સંજવલન તથા નોકખાયોનો મંદતર ઉદય હોય છે.

(૫) સૂક્ષ્મ સાંપરાય ગુણસ્થાનમાં માત્ર સૂક્ષ્મ લોલનો જ ઉદય રહે છે, અન્ય કોઈ કખાય-નોકખાયનો ઉદય રહેતો નથી, કારણ કે શેષ બધા કખાયોની ઉદય-વ્યુચિત્તિ નવમામાં જ થઈ જાય છે.

વાસ્તવમાં તો સાધકરૂપ મુનિજીવનમાં માત્ર સંજવલન અને નોકખાયોના ઉદયનો જ ખેલ છે. અન્ય અનંતાનુંબંધી આઈ ત્રણે કખાયનો તો ભાવલિંગી મુનિ જીવનમાં ઉદય તથા તત્ત્વ જન્ય પરિણામોનો અભાવ જ વર્તે છે. મુનિજીવનમાં કખાય તો માત્ર કણિકારૂપમાં જ વિઘમાન રહે છે. (જુઓ, પ્રવચનસાર ગાથા -૫, રજક તથા રપજની તત્ત્વપ્રદીપિકા ટીકા)

પ્રથમ ગુણસ્થાનથી લઇને ચૌદ ગુણસ્થાનોમાં કખાયના સ્વરૂપનું સામાન્ય કથન આ પ્રકારે છે :-

(૧) ભિદ્યાત્વથી ભિશ્ર ગુણસ્થાન સુધીના ત્રણે ગુણસ્થાનોમાં કખાય સુમેરૂપર્વત સમાન છે, કારણ કે અનંતાનુંબંધી આઈ ચારે કખાયો પોતાના પૂર્ણ ધૈલેવ સાથે વિઘમાન છે. તે સંસારને વધારવાનું જ કામ કરી રહ્યા છે.

(૨) અવિરત સમ્યકૃત્વ ગુણસ્થાનમાં કખાય મહાપર્વતરૂપ રહી જાય છે, કારણ કે અનંતસંસારનું કારણ અનંતાનુંબંધીનો અભાવ થઈ ગયો છે, દેથી કખાયોની શક્તિ આંશિક ક્ષીણ થઈ ગઈ છે.

(૩) દેશવિરત ગુણસ્થાનમાં કખાયમાત્ર પર્વતરૂપ રહી જાય છે, કારણ કે ઉદયમાત્ર બે કખાય (પ્રત્યાખ્યાનાવરણ અને સંજવલન) ચોકડીનો જ છે અને તે પણ નાશોન્મુખ થઈ ગઈ છે, છતાંચ જીવના પુરુષાર્થની કમજોરીથી તેનું અસ્તિત્વ છે.

(૪) પ્રમત્તસંયત ગુણસ્થાનથી સૂક્ષ્મસાંપરાય ગુણસ્થાન સુધીના પાંચેય ગુણસ્થાનોમાં સકલચારિત્રના સદ્ભાવમાં ઉત્તરોત્તર નાચ થતો થકો સંજવલન કખાય તથા નોકખાયોનો ઉદય ચથાખ્યાતચારિત્રમાં

તારતમ્યદૂપથી બાધક છે.

(૫) ઉપશાંતમોહ ગુણસ્થાનથી લઈને અચોગકેવળી ગુણસ્થાન સુધીના ચારેય ગુણસ્થાનોમાં અને ગુણસ્થાનાતીત સિદ્ધાવસ્થામાં પણ માત્ર વીતરાગભાવ જ રહે છે, કષાયોનો સર્વથા અભાવ જ છે.

**પ્રમત્નસંયત શબ્દનું સ્પષ્ટીકરણ :** પ્રમત્ન + સંયત = પ્રમત્નસંયત.

પ્રમત્ન = પ્રકૃષ્ટ, મત્ત = મદ્દ્યુક્ત / અસાવધાન, સંયત = સંયમ.

એકલ સંયમરૂપ વીતરાગતા પ્રગટ થઈ જવાથી સંયત થઈ જવા છતાં પણ સંજીવલન કષાય અને નોકષાયોના ઉદ્યવશ વિકથા આદિ પંદર પ્રમાદોમાં હેચ બુદ્ધિથી પ્રવૃત્તિ થવાને કારણ સ્વરૂપમાં અસાવધાનવૃત્તિ થઈ જવાથી પ્રમત્નસંયત છે.

**“કુશલેષુ અનાદર: પ્રમાદ:”** (સવર્ધિક્ષિદ્ધિ પૃ. ૨૮૮)

કુશળકાર્યો - આત્મકલ્યાણકારી કાર્યોમાં અનાદર - અસાવધાની પ્રમાદ છે.

વિકથા - સ્ત્રીકથા, ભોજનકથા, રાજ્યકથા અને ચોર કથા. કષાય - કોઘ, માન, માચા, લોલ. વિષય - સ્પર્શેન્દ્રિયાદિકના સ્પર્શ, રસ, ગંધ આદિ પાંચ વિષય. નિંદ્રા અને સ્નેહ. આ પંદર પ્રકારના પ્રમાદ છે. તેના જ પ્રલેટ રૂપ, ૫૦૦ થાય છે.

**પ્રશ્ન પદ:** શું આ પંદર પ્રમાદ ભાવલિંગી મુનિરાજના જીવનમાં પણ હોય છે?

**ઉત્તર :** હા. પંદર પ્રમાદ ભાવલિંગી મુનિરાજને જ હોય છે. આ કારણે છઢા ગુણસ્થાનનું નામ પ્રમત્નવિરત છે. એનું વિવરણ :-

ચારે વિકથાઓમાં પ્રથમ કુમ સ્ત્રીકથાનો છે. જ્યારે મુનિરાજ પ્રથમાનુયોગના શાસ્ત્ર લખે છે અથવા પ્રસંગવશ ઉપદેશમાં શ્રોતાઓને ઐરાગ્ય પોષક કથામાં કોઈ ચક્કવતીની પટરાણીના સૌદર્યનું વર્ણન કરે છે તો તેઓને સ્ત્રીકથાજન્ય પ્રમાદ થઈ જાય છે.

ચરણાનુયોગના ઉપદેશમાં આ પદાર્થ ભક્ષ્ય છે, શ્રાવકને ખાવા ચોગ્ય છે, આ પદાર્થ અભક્ષ્ય છે, એવું ભોજન સંબંધી કથન કરવામાં, લખવામાં અથવા વિચારવામાં અથવા ગુરુની સમક્ષ આહારચર્ચાના સમયે લાગેલા દોષોની વાત કરી પ્રાયશ્ચિત આદિ લેવામાં ભોજનકથાજન્ય પ્રમાદ ઘટિત થઈ જાય છે.

શાસ્ત્રની રચનાનો પ્રારંભ કરતાં સમય અથવા શાસ્ત્રની સમાસિ સમયે કોઈ દેશ કે રાજાનો ઉત્તેખ કરવાનો ભાવ આવી જાય તો તે રાષ્ટ્રકથા કે રાજકથાજન્ય પ્રમાદ થઈ જાય છે.

પ્રથમાનુયોગ શાસ્ત્રની રચના કરતાં સમય અથવા ઉપરેશ દેતા સમય ચોરની કથા ઝારા તત્ત્વ સમજાવવામાં ચોરકથા નામનો પ્રમાદ થઈ જાય છે.

આચાર્ય મહારાજને પોતાના સંઘના વ્યવસ્થિત સંચાલનના સમયે કોઈ મુનિ શિષ્યોના પ્રતિ તેમની ભૂમિકા અનુસાર સંજવલન કષાયજન્ય કોદાઈ ઉત્પન્ન થતા જ રહે છે, તેને તેઓ કેવી રીતે ટાળી શકે ?

વિહાર કરતાં સમય કે દ્યાન માટે બેસતાં અથવા ઉભા રહેતાં સમય અનુકૂળ - પ્રતિકૂળ માટી-કાંકરાઈ વસ્તુઓના સ્પર્શનું જ્ઞાન થતું જ રહે છે. દ્રાહોન્ડ્રિયથી ગંધનું જ્ઞાન થવા પર, આહાર વ્યાપક કરતાં સમયે ખાટો-મીઠો આઈ રસનું પણ જ્ઞાન થવા પર નિજ શુદ્ધાત્માના સાક્ષાત અનુભવથી અયુત થઈ જવા પર જ પંચેન્ડ્રિયજન્ય પ્રમાદ થઈ જાય છે.

“પિછલી ર્યાની મેં કછુ શયન” નો નિંબારૂપ પ્રમાદ મુનિ જીવનમાં ઘટે જ છે. નિંબાને સમય તેટલા કાળ સુધી અર્થાત् ચથાયોગ્ય અંતર્મુહૂર્તકાળ સુધી શુદ્ધોપયોગરૂપ દર્શા નથી રહેતી. આ નિંબા પ્રમાદ છે. સ્નેહ અર્થાત् પ્રણાય, એક મુનિરાજને અન્ય મુનિરાજ પ્રત્યે પ્રેમ/અપનાપન (પોતાપણું) થાય છે, તેને સ્નેહ નામક પ્રમાદ કરે છે. આમ જ પ્રમાદના વિવિધ કાર્યો મુનિ જીવનમાં કદાચિત્ પરિસ્થિતિ વશ હેયબુદ્ધિથી થતાં રહે છે.

ગૃહસ્થ જીવનની જેમ આળસમાં સમય ગુમાવવો, સુઈ જવું, ગપ્પા મારવા આઈ અશુભોપયોગ જનિત પ્રમાદ તો મુનિના જીવનમાં સંભવ જ નથી, પણ ઉપર કદ્યા મુજબ પ્રમાદના બધા પ્રકાર મુનિજીવનમાં ચથાકાળ ઘટિત થઈ શકે છે.

### સમયકૃત્વ અપેક્ષા વિચાર:

આ પ્રમત્તસંયત ગુણસ્થાનમાં ભાવલિંગી મહામુનિરાજને ઔપશમિક, ક્ષાયોપશમિક અને ક્ષાયિક સમયકૃત્વમાંથી કોઈ એક સમયકૃત્વ હોય છે. ચારિત્ર અપેક્ષા વિચાર:

આ છઢી ગુણસ્થાનમાં ક્ષાયોપશમિક ચારિત્ર હોય છે. તે આ પ્રકારે છે - અહીં પ્રત્યાખ્યાનાવરણ કષાય કર્મના વર્તમાનકાળના સર્વધાતિ સ્પર્ધકોના ઉદ્યલાવી ક્ષય, તેમના જ ભવિષ્યમાં ઉદ્યમાં આવવા

યોગ્ય સર્વધાતિ સ્પર્ધકોનો સદવસ્થારૂપ ઉપશમ અને દેશધાતિ સંજ્યવલન કષાય કર્મ અને નવ નોકષાય કર્મનો તીવ્ર ઉદ્ય રહે છે. આ પ્રકારે ચારિત્રમોહનીય કર્મનો ક્ષયોપશમ ઘટિત થાય છે.(ધવલા પુ. ૧, પાનું ૧૭૭)

નિશ્ચયનયથી તો ચારિત્ર એક વીતરાગભાવસ્વરૂપ જ હોય છે. તેને ક્ષયોપશમિક આદિ નામ તો કર્મનું નિમિત્ત જાણી વ્યવહારનયથી જ આપેલા છે. મુનિરાજના જીવનમાં ત્રણ કષાય ચોકડીના અનુદ્યપૂર્વક વ્યક્ત વીતરાગતાતો નિશ્ચય ચારિત્ર છે અને તેજ સમયે સંજ્યવલન કષાયોદ્યથી ૨૮ મૂળગુણોના પાલનનો જે શુભરાગ હોય છે, તેને નિશ્ચય વીતરાગભાવનો સહચારી જાણીને વ્યવહારનયથી ચારિત્ર કરે છે. આનું જ કથન મોક્ષમાર્ગ પ્રકાશક પૃ. ૨૨૮ પર આ પ્રમાણે કરેલ છે:-

“.....સકલ કષાય રહિત જે ઉદાસીનભાવ, તેનું જ નામ ચારિત્ર છે.... જે ચારિત્રમોહના દેશધાતિ સ્પર્ધકોના ઉદ્યથી મહામંદ પ્રશાસ્ત રાગ થાય છે, તે ચારિત્રનો મળ છે.....કેટલાયે મંદકષાયરૂપ મહાપ્રતાઈનું પાલન કરે છે, પરંતુ તેને મોક્ષમાર્ગ નથી માનતા.”

કાળ અપેક્ષા વિચાર:

**જધન્યકાળ:** એક સમય છે. કોઈ મુનિરાજ દ્યાનમય અપ્રમત્ત ગુણસ્થાનથી છૂટીને શુભોપયોગરૂપ છઢા ગુણસ્થાનમાં પ્રવેશ કરે છે અને ત્યાં માત્ર એક સમય કાળ વ્યતીત થતાં જ તેમની મનુષ્ય આચુ પૂર્ણ થઈ જાય તો મરણાની અપેક્ષા પ્રમત્તસંયત ગુણસ્થાનનો જધન્યકાળ માત્ર એક સમય જ ઘટિત થાય છે.

**ઉત્કૃષ્ટકાળ:** પ્રમત્તસંયત ગુણસ્થાનવર્તી મુનિરાજ માત્ર યથાયોગ્ય એક (મદ્યમ) અંતર્મુહૂર્ત કાળ સુધી જ અહીં રહે છે. આ ગુણસ્થાન ત્રણ કષાય ચોકડીના અભાવપૂર્વક વ્યક્ત શુદ્ધ પરિણાતિ સહિત શુભોપયોગરૂપ છે.

મુનિરાજ શુદ્ધોપયોગરૂપ દ્યાનાવસ્થાની સતત ઇચ્છિ રાજે છે અને પુરુષાર્થ પણ તે તેવો જ કરે છે. તેથી તેઓ તુરંત અપ્રમત્તવિરત ગુણસ્થાનમાં જ ગમન કરે છે. જો છઢેથી સીધા મિથ્યાત્પ ગુણસ્થાનમાં ગમન કરે તો જ પ્રમત્તવિરત ગુણસ્થાનવર્તી મુનિરાજનો સર્વોકૃષ્ટ અંતર્મુહૂર્ત કાળ હોય છે.

**મદ્યમકાળ:** જેમ મરણાની અપેક્ષા જધન્યકાળ એક સમય સિદ્ધ થાય છે, એવી જ રીતે બે, ત્રણ, ચાર આદિ સમય, સંખ્યાત સમય, એક

આવલી આઈ રૂપ ભેદ, જે યથાયોગ્ય એક અંતર્મુહૂર્તની અંદર થશે, તે સર્વલેદ મરણાની અપેક્ષા પ્રમતસંયત ગુણસ્થાનનો મદ્યમકાળ ઘટીત થઈ શકે છે.

**પ્રમતસંયત ગુણસ્થાનના અંતર્મુહૂર્તકાળથી અપ્રમતસંયમ ગુણસ્થાનનો કાળ નિયમથી અડધો હોય છે.**

**પ્રશ્ન પ૫ :** છઢા ગુણસ્થાનનો જ્યારે ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્તકાળ પૂરો થઇ જાય છે અને મુનિરાજ અપ્રમતસંયત ગુણસ્થાનમાં ગમન કરવારૂપ પુરુષાર્થ ન કરી શકે, તો એવી સ્થિતિમાં તે મુનિરાજ છઢાગુણસ્થાનમાં ક્યાં સુધી રહી શકે છે ?

**ઉત્તર :** પ્રમતસંયતનો ઉત્કૃષ્ટકાળ માત્ર એક (મદ્યમ) જ અંતર્મુહૂર્ત છે. તેનાથી વધારેસમય કોઈપણ પરિસ્થિતિમાં કોઈ પણ મુનિરાજ પ્રમતસંયત ગુણસ્થાનમાં રહી શકતા જ નથી. જો છઢાનો અંતર્મુહૂર્તકાળ પૂર્ણ થતાં જ તત્કાળ સાતમાં અપ્રમતસંયત શુદ્ધોપયોગરૂપ દશામાં ગમન ન થાય તો નીચેના પાંચમા આઈ પાંચ ગુણસ્થાનોમાંથી કોઈને કોઈ એક ગુણસ્થાનમાં તે ગમન કરે જ છે. ક્ષાયિક સમ્યકૃત્વ સહિત પ્રમતવિરત ગુણસ્થાન હોય તો તેમનું પતન ચોથાથી નીચે થતું નથી. પ્રમતસંયત ગુણસ્થાનમાં માત્ર એક અંતર્મુહૂર્ત જ રહી શકે છે.

**પ્રશ્ન પણ :** શું અંતર્મુહૂર્તના પણ અનેક લેદ છે ?

**ઉત્તર :** હા, અંતર્મુહૂર્તના અસંખ્યાત લેદ છે. અસંખ્યાત સમયોની એક આવલી હોય છે. એક આવલી કાળમાં એક સમય વધારે જોડી દેવાથી જધન્ય અંતર્મુહૂર્ત થાય છે. તેમાં બે, ત્રણ, ચાર આઈ સમય જોડતાં જવાથી અંતર્મુહૂર્તના લેદ થતા જાય છે. આ રીતે લેદ કરતાં-કરતાં મુહૂર્ત અર્થાત് ૪૮ મિનિટમાંથી બે સમય ઓછો કાળ સુધી એમ લેદ કરતાં જતાં અંતર્મુહૂર્તના અસંખ્યાત લેદ થઈ જાય છે. આ બધાં અંતર્મુહૂર્તના જ લેદ છે.

**ગમનાગમન અપેક્ષા વિચાર :**

**ગમન :** ૧) પ્રમતસંયત ગુણસ્થાનવર્તી ભાવલિંગી મુનિરાજ પોતાને યથાયોગ્ય એક અંતર્મુહૂર્તકાળ વ્યતીત થયા પછી હંમેશા અત્યસ્ત થઈ જવાના કારણે ત્રિકાળી નિજ સહજાનંદમય શુદ્ધાત્માના દ્યાન છારા શુદ્ધોપયોગ પ્રગટ કરીને ઉપરના એકમાત્ર અપ્રમતસંયત ગુણસ્થાનમાં

જ ગમન કરે છે, અન્ય અપૂર્વકરણ આદિગુણસ્થાનોમાં સીધા ગમન નથી કરતાં.

૨) જો છઙાથી નીચેની તરફ ગમન કરે તો પોતાના પુરુષાર્થીની હીનતાથી/પોતાના અપરાધથી અને અન્ય ગુણસ્થાન માટે ચથાયોગ્ય કર્મના ઉદ્યાદિથી પ્રમતસંચયત ગુણસ્થાનવર્તી ભાવલિંગી મુનિરાજ સીધા દેશવિરત ગુણસ્થાનમાં ગમન કરી શકે છે. અહીં આવતાં જ તે ભાવલિંગી મુનિરાજ પ્રત્યાખ્યાનાવરણ કષાય કર્મના ઉદ્યથી પાંચમા ગુણસ્થાનવર્તી ફ્રલિંગી મુનિ થઈ જાય છે.

૩) અંતમુહૂર્ત પહેલા જે ત્રણ કષાય ચોકડીના અનુદ્યથી ભાવલિંગી મુનિરાજ હતાં, તે જ પૂર્વ કુસંસ્કારોની તીપ્તાવશ પોતાના પરિણામોમાં હીનતા આવવાથી આગળના અંતમુહૂર્ત માં છઙાથી સીધા અપ્રત્યાખ્યાનાદિ કષાય કર્મના ઉદ્યમાં અવિરત સમ્યકુફળિત થઈ જાય છે. અર્થાતું ચતુર્થ ગુણસ્થાનવર્તી ફ્રલિંગી થઈ જાય છે.

૪) કોઈ છઙા ગુણસ્થાનવર્તી સાચા મુનિરાજ પોતાની વ્યક્ત પરિણતિઃપ વીતરાગતાથી ચ્યુત થાય છે અને તે જ સમય શ્રદ્ધામાં સમ્યકુમિથ્યાત્પરઃપ પરિણમિત થઈને મિશ્ર દર્શનમોહનીય કર્મના ઉદ્યના નિમિત્તથી છઙાથી સીધા ત્રીજા મિશ્ર ગુણસ્થાનમાં ગમન કરે છે. તેઓને પણ ફ્રલિંગી કહી શકીએ છીએ.

૫) કોઈ દ્વિતીયોપશમ સમ્યકુટ્પ સહિત પ્રમતસંચયત મુનિરાજ ચારિત્ર અને સમ્યકુદર્શનથી ચ્યુત થઈને અનંતાનુંબંધી કષાય પરિણામના વ્યક્ત થવાથી તથા તે જ સમયે અનંતાનુંબંધી કષાય કર્મનો ઉદ્ય પણ આવી જવાથી બીજા સાસાદનસમ્યકુટ્પ ગુણસ્થાનમાં ગમન કરે છે અને ફ્રલિંગી મુનિરાજ બની જાય છે. ત્રીજા તથા બીજા ગુણસ્થાનનો કાળ અલ્પ હોવાથી તેની સાથે ફ્રલિંગીઃપ વ્યવહાર ગૌણ રહે છે.

૬) કોઈ પ્રમતસંચયત ગુણસ્થાનવર્તી ભાવલિંગી મુનિરાજ છઙાથી સીધા મિથ્યાત્પ અને અનંતાનુંબંધી કષાય કર્મનો ઉદ્ય થવાથી મિથ્યાત્પ ગુણસ્થાનમાં પણ ગમન કરે છે. અર્થાતું જે પહેલા સમયમાં ભાવલિંગી મુનિરાજ હતાં, તે જ પોતાના પુરુષાર્થીની વિપરીતતાને કારણ વિશિષ્ટ વીતરાગતાઃપ ધર્મથી ચ્યુત થઈ જવાથી પ્રથમ ગુણસ્થાનવર્તી ફ્રલિંગી મુનિરાજ થઈ જાય છે.

જુઓ, પરિણામોની વિચિત્રતા ! બાહ્યમાં ક્રબ્યલિંગરૂપ મુનિપણું તો યથર્થિતુપથી જેમનું તેમ જ છે, પરંતુ અંદરમાં ન મુનિયોગ્ય ધર્મ(શુદ્ધતા) રહ્યો, ન પ્રતી શ્રાવકને યોગ્ય, ન સમ્યક્ષ્રાણિને યોગ્ય પરિણામ.

**આગમન :** આ પ્રમત્તસંયત ગુણસ્થાનમાં આગમન માત્ર અપ્રમત્તસંયતથી જ થાય છે. અપૂર્વકરણ આઈ ઉપરના કોઈપણ ગુણસ્થાનોથી સીધા છિડ્યા ગુણસ્થાનમાં આગમન થતું નથી.

નીચલા પાંચેચ ગુણસ્થાનોમાંથી પણ પ્રમત્તસંયત ગુણસ્થાનમાં આગમન થતું નથી.

**સાતમા** શુદ્ધોપયોગરૂપ અપ્રમત્તસંયત ગુણસ્થાનથી જ શુલોપયોગરૂપ છિડ્યા ગુણસ્થાનમાં આગમનનો નિયમ છે.

**પ્રશ્ન પ૪ :** છિડ્યા ગુણસ્થાનને શુલોપયોગરૂપ જ કેમ કહ્યું ? અને નીચેની તરફ પતન થતા સમયે પ્રાપ્ત થવાવાળું ગુણસ્થાન પણ કેમ કહ્યું ?

**ઉત્તર :** છિડ્યા પ્રમત્તસંયત ગુણસ્થાનમાં ત્રણ કષાય ચોકડીનો અનુદ્ય થવાથી શુદ્ધ પરિણતિરૂપ વીતરાગતા તો છે, પરંતુ અહીં મુનિરાજના સંજપલન કષાયના તીવ્ર ઉદયથી બુદ્ધિપૂર્વક શુલોપયોગરૂપ ભાવ છે, તેથી તેને શુલોપયોગરૂપ કહ્યું છે. મુનિરાજને બે જ ઉપયોગ મુખ્યતાથી હોય છે. (૧) શુદ્ધોપયોગ અને (૨) શુલોપયોગ.

નિવિકલ્પ દ્વારાનરૂપ અવસ્થા, જે અપ્રમત્તદશા છે, તેને શુદ્ધોપયોગ કહે છે. દ્વારાનથી ચ્યુત થવાથી સવિકલ્પ અવસ્થા શુલોપયોગરૂપ છે, એ જ પ્રમત્તસંયત દશા છે. દ્વારાનથી ચ્યુત થવું કહો અથવા નીચેની તરફ પતન કહો, બંનેનો અર્થ એક જ છે. સાતમાની અપેક્ષાએ છિડું ગુણસ્થાન નિચલાસ્તરનું છે. તેથી તે નીચેની તરફ પતન થવા સમયે પ્રાપ્ત થાય છે.

નીચેની તરફ પતન એટલે પ્રમત્તસંયત અવસ્થા મુનિ અવસ્થા જ નથી અથવા તે બષ્ટ મુનિ અવસ્થા છે - એવું પણ નથી. મુનિજીવન જ એવું હોય છે કે જેમાં દ્વારા રહિત અવસ્થા થવી તેને વ્યવહારસ્વરૂપ કહેવાય છે, તેને શુલોપયોગ પણ કહે છે અને શુલોપયોગ - શુદ્ધોપયોગથી ભિન્ન અને ઉત્તરતીકોટીનું છે.

**પ્રશ્ન પ૫ :** શું છિડ્યા ગુણસ્થાનમાં આર્તદ્વારાન પણ થાય છે ?

**ઉત્તર :** હા, છિડ્યા ગુણસ્થાનમાં આર્તદ્વારાન થાય છે. પરંતુ તે મુખ્યરૂપથી શુલ્ભભાવરૂપ હોય છે અને કદાચિત્ અશુલોપયોગરૂપ પણ થઈ શકે છે

ઇતાં તે પણ હેયબુદ્ધિથી થાય છે.

**પ્રશ્ન ૫૦ :** ચોથા અવિરતસમ્યકૃત્વ અને પાંચમા દેશવિરત ગુણસ્થાનોમાં સ્વાનુભૂતિરૂપ શુદ્ધોપયોગ હોય છે: ચોથા, પાંચમા ગુણસ્થાનોથી પણ ઉપરના ઇંડા ગુણસ્થાનમાં માત્ર શુભોપયોગ જ હોય છે. શુદ્ધોપયોગ નહીં ..... આ કેવી વાત છે ?

**ઉત્તર :** ચોથા ગુણસ્થાનમાં સમ્યકૃદર્શનરૂપ ધર્મની ઉત્પત્તિ થાય છે, તે કરણલભ્ય વિના થતી નથી. તેથી ચોથા ગુણસ્થાનની ઉત્પત્તિ પૂર્વે મિથ્યાત્પ અવસ્થામાં જ જીવ આત્મદ્યાનનો બુદ્ધિપૂર્વક પ્રચાસ કરે છે અને લેદવિજ્ઞાનથી ચથાર્થ તત્પરાની ભાવભાસનાપૂર્વક શુદ્ધોપયોગના કાળમાં જ સમ્યકૃત્વની ઉત્પત્તિ થાય છે.

અવિરત સમ્યકૃત્વ ગુણસ્થાનમાં શુભ, અશુલ અને શુદ્ધ ત્રણે ઉપયોગ હોય છે તથા જે પ્રકારે ચતુર્થ ગુણસ્થાનથી શુદ્ધોપયોગની સાથે પંચમ ગુણસ્થાનમાં આગમન થાય છે. તેવી જ રીતે પંચમ ગુણસ્થાનવર્તી ક્રવ્યલિંગી મુનિરાજ શુદ્ધોપયોગથી જ સાતમાં ગમન કરે છે.

ચોથા કે પાંચમા ગુણસ્થાનવર્તી સાધક જીવ ઉપરના ગુણસ્થાનોમાં ગમન ન કરતાં થકા પણ ચથાસમય શુદ્ધોપયોગની પ્રાસિ કરતા રહે છે, કારણ કે આ બંને ગુણસ્થાનવર્તી જીવ મોક્ષમાર્ગી છે. શુદ્ધોપયોગના અભાવમાં પણ તેને શુદ્ધ પરિણતિ સતત બની રહે છે અને શુદ્ધપરિણતિને ટકાવવા માટે તથા તેની વૃદ્ધિ માટે તથા આનંદનો ભોગ કરવા માટે પણ શુદ્ધોપયોગનો પુરુષાર્થ કરતા રહે છે.

જો ચથાયોગ્ય કાળ પછી પણ શુદ્ધોપયોગ ન થાય તો તેમનું ચોથું કે પાંચમું ગુણસ્થાન પણ નથી રહેતું, તેમને મિથ્યાત્પ ગુણસ્થાનની પ્રાસિ થઈ જશે, આ વસ્તુસ્વરૂપ છે. માટે ચોથા-પાંચમા ગુણસ્થાનમાં જીવના પુરુષાર્થને અનુસાર કદાચિત् અશુલોપયોગ, શુભોપયોગ અથવા શુદ્ધોપયોગ હોય છે.

ઇંડા ગુણસ્થાનનું સ્વરૂપ જ અલગ છેનું છે. આ ગુણસ્થાનનું સ્વરૂપ જ બુદ્ધિપૂર્વક શુભોપયોગરૂપ છે. પ્રમત્તાસંયત ગુણસ્થાનવર્તી શુભોપયોગી ભાવલિંગી મુનિરાજ જો શુદ્ધોપયોગ કરે છે તો તેમનું ગુણસ્થાન સાતમું અપ્રમત્તાસંયત થઈ જાય છે. શુદ્ધોપયોગથી છુટે છે/પડે છે, તો તે જ અપ્રમત્ત મુનિરાજ પ્રમત્તાસંયત મુનિરાજ પ્રમત્તાસંયત અર્થાત્ શુભોપયોગી

થઈ જાય છે.

કોઈપણ જીવને મોક્ષમાર્ગ થઈ રહેવા માટે તેને વીતરાગતા હોવા આવશ્યક છે. તે વીતરાગતા બે કારણોથી જીવની પાસે કે સાથે રહે છે. એક તો શુદ્ધોપયોગથી અને બીજી શુદ્ધ પરિણાતિથી.

ઇછા ગુણસ્થાનમાં વીતરાગતારૂપ મોક્ષમાર્ગ અર્થાત્ શુદ્ધપરિણાતિ શુભોપયોગની સાથે -સાથે સતત રહે અવશ્ય છે, પરંતુ ઇછુ ગુણસ્થાન ભાવલિંગી મુનિરાજનું હોવા છતાં તેનું સ્વરૂપ જ વ્યક્ત શુભોપયોગરૂપ છે. માટે પ્રમત્તસંચયત ગુણસ્થાનમાં શુભોપયોગ જ હોય છે, શુદ્ધોપયોગ નહીં.

સાતમાં ગુણસ્થાનમાં અને તેની આગળનાં પણ બંધાં ગુણસ્થાનોમાં માત્ર શુદ્ધોપયોગ જ રહે છે. અન્ય કોઈ ઉપયોગ હોતો જ નથી. ઇછાથી મુનિજીવન છે, આનાથી આ સ્વયમેવ નિર્ણય થઈ જાય છે કે મુનિજીવનમાં માત્ર બે જ ઉપયોગ છે - એક શુદ્ધોપયોગ અને બીજો શુભોપયોગ.

આપણે ક્રવ્યાનુયોગની અપેક્ષાએ ગુણસ્થાનોનું વિલાજન આ પ્રકારે કરી શકીએ.

(૧) મિથ્યાત્પ ગુણસ્થાનથી ત્રિજા મિશ્ર ગુણસ્થાન સુધી નિયમથી શુભ અને અશુભ ઉપયોગ જ હોય છે. (૨) ચોથા તથા પાંચમા ગુણસ્થાનોમાં શુભ, અશુભ અને શુદ્ધોપયોગ ત્રણ ઉપયોગ રહી શકે છે. (૩) ઇછા ગુણસ્થાનમાં માત્ર શુભોપયોગ અને (૪) સાતમાં ગુણસ્થાનથી લઈને આગળના સર્વ ગુણસ્થાનમાં માત્ર શુદ્ધોપયોગ જ રહે છે.

**વિશેષ અપેક્ષા વિચાર:**

(૧) પ્રમત્તસંચયત આ ઇછું ગુણસ્થાન શુદ્ધપરિણાતિ સહિત શુભોપયોગરૂપ છે, છતાં આ દશા મુનિજીવનમાં અવશ્યભાવી છે છતાં પણ બંધકારક છે. નાટક સમયસાર (મોક્ષફ્રાર છંદ ૪૦)માં આને જગપંથ કહ્યો છે, જે નીચેપ્રમાણે છે :-

**તા કારણ જગપંથ ઇત, ઉત શિવમારગ જોર ।**

**પરમાદી જગ કૌં ધુકૈ, અપરમાદિ શિવ ઓર॥**

અર્થ: માટે પ્રમાદ સંસારનું કારણ છે અને અનુભવ મોક્ષનું કારણ છે. પ્રમાદી જીવ સંસારની તરફ જુયે છે અને અપ્રમાદી જીવ મોક્ષની તરફ જુયે છે.

મુક્તિ પ્રાપ્ત કરવા પૂર્વે અનિવાર્ય ગુણસ્થાનોના સંબંધમાં અહીં

થોડો વિચાર કરીએ :-

૧) અનેક જીવ બીજા સાસાદન ગુણસ્થાનને પ્રાપ્ત કર્યા વગર પણ મોક્ષ પ્રાપ્ત કરી શકે છે, કારણ કે જીવ ઔપશમિક સમ્યકૃત્વની સાથે ચોથા આદિ ઉપરના ગુણસ્થાનોથી પતિત થાય છે, તે જ બીજા ગુણસ્થાનમાં આવે છે. એવા ઉપરનાં ગુણસ્થાનોથી સાસાદનમાં પતિત ન થવાવાળા અનેક જીવ મોક્ષ જઈ શકે છે. તેથી બીજું ગુણસ્થાન અનિવાર્ય નથી.

૨) ત્રીજું ગુણસ્થાન પણ અનિવાર્ય નથી, આ ત્રીજા ગુણસ્થાનમાં પ્રવેશ કર્યા વગર પણ મુક્તિ સંભવ છે, કારણ કે જો જીવ પહેલા ગુણસ્થાનથી જ ચોથામાં આવે છે અથવા પાંચમા, સાતમામાં આવે છે તો છઢા-સાતમામાં આત્માનંદનું રસપાન કરતાં - કરતાં નીચે ગમન કર્યા વગર જ મુક્તિ પ્રાપ્ત કરી શકે છે. તેથી ત્રીજું ગુણસ્થાન પણ અનિવાર્ય નથી.

૩) ચોથા અવિરતસમ્યકૃત્વ ગુણસ્થાનની પ્રાપ્તિ વગર પણ જીવ મોક્ષની પ્રાપ્તિ કરી શકે છે, કારણ કે અનાદિ ભિદ્યાત્વ ગુણસ્થાનથી સીધા સાતમાં અપ્રમત્તમાં આવીને છઢા-સાતમામાં ઝૂલતાં થકા આગળ શ્રેણી માંડીને મુક્ત થઈ શકે છે. તેથી મુક્તિ પૂર્વે અવિરત સમ્યકૃત્વ ચોથું ગુણસ્થાન અનિવાર્ય નથી.

૪) જો ફ્રલ્યાલિંગી મુનિરાજ અનાદિ ભિદ્યાત્વથી જ સાતમાં અપ્રમત્તસંયતમાં જાય છે અને છઢા-સાતમામાં હજારો વખત ઝૂલતાં થકા શ્રેણી માંડી મુક્તિ પ્રાપ્ત કરે છે તો તેઓને પાંચમું દેશવિરત ગુણસ્થાન પણ અનિવાર્ય નથી.

૫) જો મુનિરાજ ઉપશમશ્રેણી પર આરોહણ કરે તો જ ઉપશાંતમોહ નામના અગ્યારમાં ગુણસ્થાનની પ્રાપ્તિ થાય છે. જે મુનિરાજ ઉપશમશ્રેણી પર આરોહણ ન કરતાં થકા માત્ર ક્ષપકશ્રેણી પર જ આરોહણ કરે છે તો તેમને ઉપશાંતમોહ ગુણસ્થાનની પ્રાપ્તિ થતી જ નથી, માટે અગ્યારમું ગુણસ્થાન પણ અનિવાર્ય નથી અને ઉપશમશ્રેણીના પ્રથમ ત્રણ ગુણસ્થાન પણ અનિવાર્ય નથી.

આ રીતે સંક્ષેપમાં બીજા, ત્રીજા, ચોથા, પાંચમાં, અગ્યારમાં - આ પાંચે ગુણસ્થાનો વગર તો કદાચિત્ જીવ મુક્તિ પ્રાપ્ત કરી શકે છે, પરંતુ છઢા પ્રમત્તસંયત ગુણસ્થાન વગર તો કોઈ જીવ મુક્તિ પ્રાપ્ત કરી શકતો

જ નથી અર્થાતું મિથ્યાત્વ, પ્રમત્તવિરત, અપ્રમત્તવિરત ક્ષપકશ્રેણીના ચારેય ગુણસ્થાન, સયોગકેવળી અને અયોગકેવળી આ નવ ગુણસ્થાનો વગર જીવ મુક્ત નથી થઈ શકતો.

**પ્રશ્ન ૫૧ :** આ પ્રમત્તસંયત ગુણસ્થાનને બંધનકારક, શુભોપયોગરૂપ, જગપંથ અને કથંચિતું આહુળતા ઉત્પાદક જાણવા છતાં પણ ભાવલિંગી મુનિરાજ આ ગુણસ્થાનમાં શા માટે આવે છે?

**ઉત્તર :** મોક્ષપ્રાપ્તિનો ક્રમ કોઈપણ જીવની ઈચ્છાનુસાર નથી થતો, જેવું વસ્તુસ્વરૂપ છે, તેના અનુસાર જ થાય છે. તે વસ્તુસ્વરૂપ તથા ક્રમ અનંત સર્વજ્ઞ ભગવંતોએ જાણ્યો છે અને તેને દિવ્યદ્વાનિમાં કહ્યો છે.

મુનિજીવનમાં સૌથી પહેલા શુદ્ધોપયોગરૂપ અપ્રમત્તવિરત ગુણસ્થાનની પ્રાપ્તિ થાય છે. ત્યારબાદ સાતમા ગુણસ્થાનની જ સીધા ક્ષપકશ્રેણી આરોહણ કરીને મુક્ત થવાની વ્યવસ્થા નથી. શુદ્ધોપયોગ રૂપ અપ્રમત્તવિરત દશામાં ચથાયોગ્ય એક અંતર્મુહૂર્ત કાળ વ્યતીત થતાં જ પર્યાયગત યોગ્યતાને કારણ તથા ચથાયોગ્ય કર્મોદયના નિમિત્તથી શુભોપયોગરૂપ પ્રમત્તવિરત ગુણસ્થાનમાં આવવું અનિવાર્ય થઈ રહે છે. મુનિઅવસ્થામાં માત્ર એક અંતર્મુહૂર્ત રહીને મુક્તિ પ્રાપ્ત કરવાવાળા ભરત આદિને પણ છઢા ગુણસ્થાનમાં આવવું અનિવાર્ય હતું. અંતર્મુહૂર્તમાં મુક્તિ પામવાવાળા મુનિરાજ પણ શ્રેણી-આરોહણની પહેલા તૈયારીની દશામાં તો એક અંતર્મુહૂર્ત દશામાં હજારો વખત છઢા-સાતમાં ગુણસ્થાનમાં ઝૂલે છે અર્થાતું તેઓને પણ છઢા ગુણસ્થાનમાં આવવું પડે છે, તેઓ આવવા નથી ઈચ્છિતાં. મોક્ષ પ્રાપ્તિની પહેલાનો વસ્તુગત ક્રમ એવો જ છે. આગમ પ્રમાણાથી વસ્તુનું સ્વરૂપ સમજવાથી જ્ઞાનમાં ચથાર્થિતા તેમજ નિર્મિતાની પ્રાપ્તિ જરૂર થાય છે.

જગપંથનો અર્થ સંસારનો માર્ગ છે અર્થાતું છઢા ગુણસ્થાનનો શુભોપયોગરૂપ ભાવ અર્થાતું શુલ્પરિણામ બંધરૂપ હોવાથી સંસારમાર્ગ છે. જેમ અનિનમાં શીતળતાની ખોજ વ્યર્થ છે, તેમ શુભમાં વીતરાગતરૂપ મોક્ષમાર્ગ શોધવો વ્યર્થ છે.

૨) આચાર્યહૃત બધા શાસ્ત્ર-લેખન, ઉપદેશ, દીક્ષા-શિક્ષા આદિ પ્રશસ્ત વ્યવહાર કાર્ય આ છઢા પ્રમત્તવિરત ગુણસ્થાનમાં જ થાય છે. મુનિજીવનના છઢા ગુણસ્થાનવર્તી મહામુનિરાજને સંજવલન કખાય તથા

હાસ્યાદિ નવ નોકખાયના તીવ્ર ઉદયમાં નિયમથી હેયબુદ્ધિપૂર્વક શુલ પરિણામ હોય જ છે, કારણ કે મુનિજીવનમાં (સ્થૂળજીપથી) અશુભોપયોગ માટે અવકાશ જ નથી. તેથી શુલ પરિણામમાં બુદ્ધિપૂર્વક થવાવાળા કાર્ય પણ મોક્ષમાર્ગને અનુકૂળ જ હોવા જોઈએ.

વાસ્તવમાં તો ગૃહસ્થ-જીવનમાં જે કાંઈ શુલ પરિણામ કે પુણ્યરૂપ કાર્ય થાય છે, તે બધાં અપ્રત્યાખ્યાનાવરણ, પ્રત્યાખ્યાનાવરણ કખાયોના મંદ ઉદયમાં થાય છે અને મુનિજીવનમાં શુલ પરિણામ અથવા પ્રશસ્તા/પુણ્ય કાર્ય નિયમથી સંજીવલન કખાય અને નવ નોકખાયોના ચથાયોગ્ય તીવ્ર ઉદયમાં જ થાય છે.

આ કારણે શ્રાવકજીવનથી પણ મુનિજીવન કેટલું જુદા પ્રકારનું છે, એનું સ્વયમેવ જ્ઞાન થઈ જાય છે. જે પરિણામ મુનિશ્વરો માટે હેય છે, એ પરિણામ ઝારા જ શ્રાવકો પર મહાન ઉપકાર થાય છે.

આપણો થોડો વિચાર કરવો જોઈએ કે જ્યારે મુનિરાજના હેયરૂપ(શુલ) પરિણામથી પણ શ્રાવકનું સહજ કલ્યાણ થાય છે તો વાસ્તવિક વીતરાગતારૂપ ધર્મથી શ્રાવકનું અવિનાશી કલ્યાણ કેમ ન થાય ? અવશ્ય જ થાય.

૩) આહારક આદિ ઋગ્ઘિદ્યાઓના વ્યવહાર ધર્મ-પ્રભાવના હેતુ કદાચિતું ઉપયોગ આ સવિકલ્પ અવસ્થારૂપ છઢા પ્રમતસંચયત ગુણસ્થાનમાં જ થાય છે, કારણ કે અપ્રમતાદિ ઉપરના ગુણસ્થાન નિર્વિકલ્પ શુદ્ધ્યોપયોગ રૂપ જ છે. ઋગ્ઘિ શબ્દનો અર્થ છે - પુણ્યોદયથી અર્થાત્ વિશુદ્ધિથી પ્રાણ કાંઈક વિશિષ્ટ વિકસીત શક્તિઓની ઉપલબ્ધિ.

જે મુનિરાજેને ઋગ્ઘિની પ્રાસિ થઈ ગઈ છે, તેઓને તે ઋગ્ઘિનો ઉપયોગ કરવો જ જોઈએ, એવો કોઈ નિયમ નથી, કારણ કે મુનિરાજ ઋગ્ઘિઓથી અત્યંત નિરપેક્ષ હોય છે.

૪) છઢા ગુણસ્થાનના નામમાં પ્રયુક્ત 'પ્રમત' શબ્દ અંતદીપક છે, કારણ કે મિથ્યાત્પથી લઇને પ્રમતસંચયત સુધી સર્વ જીવ નિયમથી પ્રમાણની બુદ્ધિવાળા જ હોય છે. આ બધાંની સાથે 'પ્રમત' શબ્દનો પ્રયોગ પણ કરી શકીએ છીએ. જેમ - પ્રમત મિથ્યાત્પ, પ્રમત સાસાંન સમ્યકૃત્પ, પ્રમત ભિશ, પ્રમતઅવિરત સમ્યકૃત્પ, પ્રમત દેશવિરત. પરંતુ ભાષાવિજ્ઞાનના નિયમાનુસાર સંક્ષિપ્તકરણ માટે માત્ર છઢા

ગુણસ્થાનમાં પ્રમત્ત શબ્દનો પ્રયોગ થયો છે.

**પ્રશ્ન કૃ:** છઢા - સાતમાં ગુણસ્થાનમાં ઝૂલતાં ઝૂલતાં પ્રચુર સ્વસંવેદનના આનંદની ગટાગટ ધૂંટ પીવાવાળા સર્વ ભાવલિંગી મુનિરાજની વ્યક્ત વીતરાગતા (નિશ્ચય ધર્મ) સમાન જ હોય છે કે તેમાં કાંઈ લેદ રહે છે ?

**ઉત્તર :** ૨૮ મૂળગુણોના પાલનરૂપ બાહ્ય વ્યવહારધર્મ તો સર્વ મુનિરાજે (આચાર્ય, ઉપાધ્યાય, સાધુ) ના સમાન જ હોય છે. અંતરંગમાં નિશ્ચયધર્મ રૂપ ત્રણ કષાય ચોકડીના અનુદ્યથી વ્યક્ત વીતરાગતા પણ સામાન્ય અપેક્ષાથી સમાન/સરખી જ હોય છે. (વિશેષ સ્પષ્ટીકરણ પંચાધ્યાચી અધ્યાય બીજે શ્લોક ૫૩૬ થી કરત જુઓ)

સૂક્ષ્મ પરિણામોની અપેક્ષાથી વિચાર કરવામાં આવે તો વીતરાગતા હીન -અધિક પણ થઈ શકે છે, કારણ કે તેનું નિમિત્ત કારણ સંજ્વલન કષાય ચોકડી તથા નોકષાય કર્મોનો તીવ્ર અથવા મંદ ઉદ્ય છે. આ કારણ અનેક વર્ષોથી દીક્ષિત મુનિરાજોની વીતરાગતા વિશેષ અધિક હોઈ શકે છે. આ વિવક્ષાની મુખ્યતાથી અનેક વર્ષોથી દીક્ષિત મુનિરાજોને ચરણાનુયોગ મોટા માને છે. આ કથન પણ સાપેક્ષ જ સમજું જોઈએ. કારણ કે અત્પકાળના દીક્ષિત મુનિરાજ પણ નિજશુદ્ધાત્માના દ્યાનરૂપ વિશેષ પુરુષાર્થી જુના(પહેલા દીક્ષિત) મુનિરાજથી પણ વધારે વીતરાગતાને પ્રગત કરી શકે છે.

આ બધાં કાર્ય પરિણામોની વિચિત્રતા અને પુરુષાર્થની વિશેષતાથી થાય છે. આ જ કારણ છે કે તીર્થીકર થવાવાળા આદિનાથ મુનિરાજ એક હજાર વર્ષ મુનિદશામાં સાધના કર્યો બાદ અરહંત ભગવાન થઈ શક્યા. બાહુબલી મુનિરાજને કેવળજ્ઞાનની પ્રાપ્તિ માટે એક જ વર્ષ પથ્યાથ થઈ ગયું. શ્રી મલ્લિનાથ મુનિરાજ માટે અરહંત અવસ્થાની પ્રાપ્તિ માત્ર છ દિવસની સાધનાથી જ થઈ ગઈ હતી અને ભરત મુનિરાજને તો કેવળ અંતર્મુહૂર્તની સાધનાથી જ કેવળજ્ઞાનને પ્રાપ્ત કરી લીધું હતું.

૧) આચાર્ય, ઉપાધ્યાય તથા સાધુ-સામાન્ય ક્રાણિથી આ ત્રણે પરમેષ્ઠીઓની વીતરાગતા સરખી હોવા છતાં પણ ગણધરાદિ પદ પર આર્થ સાધુ પરમેષ્ઠીની શુદ્ધિ વિશિષ્ટ હોય છે.

૨) જે મુનિરાજોને પરિહારવિશુદ્ધિ આદિ ઋદ્ધિઓ પ્રાપ્ત થઈ છે

તેઓની તથા અનંતાનુંબંધી કખાયની વિસંયોજના કરવાવાળા મુનિરાજોની શુદ્ધિ/વીતરાગતા વિશેષ હોય છે, છતાં પણ થાય છે તો લૂભિકાની અંદર જ.

**પ્રશ્ન ૫૩ :** ૨૮ મૂળગુણોમાંથી જો મુનિરાજો દ્વારા એક - બે મૂળગુણોનું પાલન ન થઈ શકે તો તેઓને મુનિ મનાય કે નહીં ?

**ઉત્તર :** અનંત તીર્થીકરોના પરમ સત્ય ઉપદેશને આચારોએ શાસ્ત્રોમાં લિપિબદ્ધ કર્યા છે, એવા પરમશ્રદ્ધેય તથા આરાદ્ય શાસ્ત્રોની આજ્ઞા માનવીએ આપણું કર્તવ્ય છે, જેનાથી આલોક અને પરલોકમાં જીવનું આત્મકલ્યાણ થાય છે. એ શાસ્ત્રોની તો આજ્ઞા છે કે ૨૮ મૂળગુણોનું સમગ્રીતે પાલન કરવું એ જ સાચા સાધુનું સ્વરૂપ છે. કદાચિત્ પૂર્વ સંસ્કારવશ મૂળગુણોનાં પાલનમાં કાંઈ અતિચાર પણ લાગી શકે છે.

જો એક - બે અથવા ત્રણ - ચાર મૂળગુણોનું પાલન ન હોય તો પણ સાચા ગુરુપણાની માન્યતા સ્વીકૃત થવા લાગે, તો પછી ૫-૬ કે ૭-૮ મૂળગુણોના અભાવમાં પણ ગુરુપણાની માન્યતા રૂઢ થઈ શકે છે કે માત્ર ૪-૫ મૂળગુણોના પાલનથી પણ ગુરુપણું માનવામાં આપત્તિ નહીં રહે, કોઈ નિશ્ચિત નિયમ જ નહીં રહી શકે.

એટલા માટે ૨૮મૂળગુણોનું પાલન અંડપણે કરવું જ સાચું મુનિપણું છે. ‘મૂળગુણ’ આ શબ્દ જ આપણાને બતાવે છે કે ગુરુપણાંના મૂળગુણ છે અર્થાત્ તેના વગર ગુરુપણું સંભવ જ નથી, જેમ મૂળની વગર વૃક્ષ હોતું નથી, એવી જ રીતે ૨૮મૂળગુણોની અનિવાર્યતા આગમ, તર્ક તથા ચુક્તિથી પણ યથાર્થ સિદ્ધ થાય છે.

૧) જો કોઈ ૨૮ મૂળગુણોનું આગમાનુસાર નિર્દોષ પાલન કરે છે, તે સાચા ગુરુ છે, એવી પરિભાષા ચરણાનુયોગના શાસ્ત્રોની મુખ્યતાથી કરવી ઉચ્ચિત (યોગ્ય) જ છે. સાચા મુનિપણાના વિષયને અન્ય અપેક્ષાઓથી પણ આપણે સમજવું આવશ્યક છે. તેથી થોડું સ્પષ્ટીકરણ કરીએ છીએ.

૨) અનંતાનુંબંધી આઈ ત્રણ કખાય ચોકડીના અનુદ્યકાળમાં દ્યાન રહિત તથા શુદ્ધ પરિણતિ સહિત અવસ્થાના સમયે મુનિરાજ જે પ્રકારના બાબુ આચરણમાં પ્રવૃત્ત હોય છે, તે આચરણને ૨૮ મૂળગુણ કહે છે.

૩) ત્રણ કખાય ચોકડીના અનુદ્યના કાળમાં શુદ્ધોપયોગથી છૂટવાથી

શુભોપયોગની ભૂમિકામાં મુનિરાજની જીવનચયને ૨૮ મૂળગુણ કહે છે.

૪) સંજીવલન કખાય ચોકડીના ચથાયોગ્ય તીવ્ર ઉદ્યના નિમિત્તથી મુનિરાજ જે પ્રકારે આચરણમાં પ્રવૃત્ત થાય છે, તેને ૨૮ મૂળગુણ કહે છે.

**પ્રશ્ન ૫ :** શું પુલાક આઈ મુનિ સાચા મુનિ નથી હોતા ? પુલાક મુનિનું સ્વરૂપ શું છે ?

**ઉત્તર :** “જે ઉત્તરગુણોની ભાવનાથી રહિત હોય અને કોઈ ક્ષેત્ર કે કાળમાં કોઈ મૂળગુણમાં અતિચાર લગાવે તથા જેને અલ્પ વિશુદ્ધાતા હોય, તેને પુલાક મુનિ કહે છે.” જેમ કે ગરમીની ઋતુમાં જાંઘ સુધી પગ ઘોઇ લેવા આઈ.

“પુલાક મુનિ આમ તો ભાવલિંગી સમ્યક્ષ્રષિ મુનિરાજ જ હોય છે, પરંતુ પ્રતોના પાલનમાં ક્ષણિક અલ્પદોષ થઈ જાય છે, જ્તાં પણ ચથાજાતરૂપ જ છે. (તેઓને ત્રણ કખાય ચોકડીના અનુદ્યપૂર્વક ભાવલિંગીપણું હોય છે.) તેઓને સામાચિક અને છેદોપસ્થાપના બે સંયમ હોય છે.” (વધારે સ્પષ્ટીકરણ માટે સર્વર્થસિદ્ધિ, તત્વાર્થવૃત્તિ, અર્થપ્રકાશિકા આઈ ગંધોનું અવલોકન કરો.)

ઘવલા પુસ્તક ૧ નો અંશ (પાના નં ૧૭૬ થી ૧૭૮)

સામાન્યથી પ્રમતસંયત જીવ છે. ॥૧૪॥

પ્રકર્ષથી મત જીવને પ્રમત કહે છે અને સારી રીતે વિરતકે સંયમને પ્રાપ્ત જીવને સંયત કહે છે. જે પ્રમત હોવા જ્તાં પણ સંયત હોય છે તેને પ્રમતસંયત કહે છે.

**શંકા 14 :**જો છઢા ગુણસ્થાનવર્તી જીવ પ્રમત છે તો સંયત ન હોઈ શકે કારણ કે પ્રમતજીવને પોતાના સ્વરૂપનું સંયેદન નથી થઈ શકતું. જો તેઓ સંયત છે તો પ્રમત ન હોઈ શકે કારણ કે સંયમભાવ પ્રમાણના પરિહાર સ્વરૂપ હોય છે.

**સમાધાન :** આ કોઈ દોષ નથી, કારણ કે હિંસા, અસત્ય, સ્તેય (ચોરી), અબ્રહ્મ અને પરિશ્રહ આ પાંચ પાપોથી વિરતિભાવને સંયમ કહે છે, જે ત્રણ ગુણ તથા પાંચ સમિતિઓથી અનુરક્ષિત છે. તે સંયમ વાસ્તવમાં પ્રમાદથી નાણ ન કરી શકાય, કારણ કે સંયમમાં પ્રમાદથી કેવળ મળની જ ઉત્પત્તિ થાય છે.

**શંકા 15 :** છઢા ગુણસ્થાનમાં સંયમમાં મળ ઉત્પણ કરવાવાળો જ

પ્રમાદ વિવક્ષિત છે, સંયમનો નાશ કરવાવાળો પ્રમાદ વિવક્ષિત નથી, આ વાત કેવી રીતે નક્કી કરી શકાય ?

**સમાધાન :** છઢા ગુણસ્થાનમાં પ્રમાદના રહેતા થકા સંયમનો સદ્ગ્રાવ અન્યથા થઈ નથી શકતો, માટે નિશ્ચય હોય છે કે અહીં મળને ઉત્પન્ન કરવાવાળો પ્રમાદ જ અભીજ છે. બીજું છઢા ગુણસ્થાનમાં થવાવાળા સ્વલ્પકાળવર્તી મંદતમ પ્રમાદ સંયમનો નાશ પણ નથી કરી શકતો, કારણ કે સકલસંયમના ઉત્કટૃપ થી પ્રતિબંધ કરવાવાળા પ્રત્યાખ્યાનાવરણના અભાવમાં સંયમનો નાશ જોવામાં નથી આવતો.

**શંકા 16 :** પાંચભાવોમાંથી ક્યા ભાવનો આશ્રય લઈને આ પ્રમત્તસંયત ગુણસ્થાન ઉત્પન્ન થાય છે ?

**સમાધાન :** સંયમની અપેક્ષાએ આ ગુણસ્થાન ક્ષાયોપશમિક છે.

**શંકા 17 :** પ્રમત્તસંયત ગુણસ્થાન ક્ષાયોપશમિક કેવી રીતે છે ?

**સમાધાન :** કારણ કે વર્તમાનમાં પ્રત્યાખ્યાનાવરણના સર્વધાતિ સ્પર્ધકોનો ઉદ્ય ક્ષય થવાથી અને આગામી કાળમાં ઉદ્યમાં આવવાવાળા સત્તામાં સ્થિત તેમના ઉદ્યમાં ન આવવા રૂપ ઉપશમથી તથા સંજવલન કષાયના ઉદ્યથી પ્રત્યાખ્યાન (સંયમ) ઉત્પન્ન થાય છે, માટે ક્ષાયોપશમિક છે.

**શંકા 18 :** સંજવલન કષાયના ઉદ્યથી સંયમ થાય છે, માટે તેને ઔદ્યિક નામથી કેમ કહેવામાં નથી આવતો ?

**સમાધાન :** ના, કારણ કે સંજવલન કષાયના ઉદ્યથી સંયમની ઉત્પત્તિ થતી નથી.

**શંકા 19 :** તો પછી સંજવલનનો વ્યાપાર ક્યાં થાય છે ?

**સમાધાન :** પ્રત્યાખ્યાનાવરણ કષાયના સર્વધાતિ સ્પર્ધકોના ઉદ્યલાવી ક્ષયથી (અને સદવસ્થારૂપ ઉપશમથી) ઉત્પન્ન થતા સંયમમાં મળના ઉત્પન્ન કરવામાં સંજવલનનો વ્યાપાર થાય છે.

સંયમના કારણભૂત સમ્યકુર્દશનની અપેક્ષા તો આ ગુણસ્થાન ક્ષાયિક, ક્ષાયોપશમિક અને ઔપશમિક ભાવનિમિત્તક છે.

**શંકા 20 :** અહીંથા સમ્યકુર્દશન પદની જે અનુવૃત્તિ બતાવી છે તેનાથી શું આ તાત્પર્ય નીકળે છે કે સમ્યકુર્દશન વગર પણ સંયમની ઉપલબ્ધ થાય છે ?

**સમાધાન :** એવું નથી, કારણ કે આખ, આગમ અને પદાર્થોમાં જે જીવને શ્રદ્ધા ઉત્પન્ન નથી થઈ તથા જેનું ચિત્ત ત્રણ મૂઢ્ઠતાથી વ્યાખ છે, તેને સંયમની પ્રાસિ નથી થઈ શકતી.

**શંકા 21 :** અહીં બ્રહ્વયસંયમને બ્રહ્મણ નથી કર્યું, એ કેવી રીતે જાણી શકાય ?

**સમાધાન :** ના, કારણ કે ભલાપ્રકારે જાણીને અને શ્રદ્ધાન કરીને જે ચમસહિત છે તેને સંયમ કરે છે. સંયત શબ્દની આ પ્રકારે વ્યુત્પત્તિ કરવાથી આ સમજાય છે કે અહીં બ્રહ્વયસંયમને બ્રહ્મણ નથી કર્યું.

-૦૦૦૦-

### દિગંબર મુનિરાજના ૨૮ મૂળગુણ

**૫ મહાંવ્રત :** અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિચિહ્ન મહાંવ્રત.

**૫ સમિતિ :** ઈર્થા, ભાષા, એષણા, આદાનનિક્ષેપણ અને પ્રતિષ્ઠાપના (ઉત્સર્ગ સમિતિ)

**૫ ઇન્દ્રિયવિજ્ય :** સ્પર્શનિક્ષય, રસનેનિક્ષય, ધ્રાણેનિક્ષય, ચક્ષુદ્દનિક્ષય અને કર્હેનિક્ષય વિજ્ય.

**૫ આપશ્યક :** સમતા, સ્તુતિ, વંદના, પ્રતિક્રિમણ, આલોચના (અથવા સ્વાધ્યાય), પ્રત્યાપ્યાન.

**૭ અન્ય ગુણ :** કેશલોચન, વસ્ત્રત્યાગ, અસ્નાન, ભૂમિશયન, અંદંતઘોવન, ઉભા ઉભા ભોજન, દિવસમાં એકવાર અલ્પ આહાર.

। નિર્દીષ્ટ રૂપ રૂપનું પ્રકાશાત્મક કર્તાનાં  
૧૧. નિર્દીષ્ટ ઉત્તેજને વિભાગી એ રૂપ સિદ્ધાત્મક  
જોડાનું નીચેનું નીચેનું તાં જોડાનું નીચેનું જોડાનું  
નીચેનું નીચેનું નીચેનું નીચેનું નીચેનું નીચેનું  
નીચેનું નીચેનું નીચેનું નીચેનું નીચેનું નીચેનું

(૭)

### અપ્રમત્તવિરત ગુણસ્થાન

સાતમાં ગુણસ્થાનનું નામ અપ્રમત્તસંયત ગુણસ્થાન છે. આ ગુણસ્થાન દ્યાનસ્થ મુનિરાજનું છે. વિચાર કરીએ તો વાસ્તવિક મુનિજીવનનું પ્રથમ ગુણસ્થાન તો અપ્રમત્તસંયત જ છે, કારણ કે પ્રમત્તસંયત ગુણસ્થાન તો અપ્રમત્તસંયતથી નીચે પડવાથી પ્રાપ્ત થાય છે.

જ્યારે કોઈ પણ સાધક ભાવલિંગી મુનિરાજ થઈ જાય છે, ત્યારે મિથ્યાત્પ, અવિરતસમ્યકૃત્ય અથવા દેશવિરત ગુણસ્થાનથી સીધા આ અપ્રમત્તસંયત ગુણસ્થાનમાં આવીને જ થાય છે. આ વિવક્ષાની મુખ્યતાથી અથવા પ્રવચનસાર ગ્રંથની ચરણાનુચોગ ચૂલિકાની બ્રહ્મિથી મોક્ષમાર્ગપ્રકાશકના પ્રથમ અદ્યાયમાં સાધુના સ્વરૂપનું વિશેચન કરતા સમેયે પાંના ત્રણ પર આવ્યું છે - જે વિરાગી થઈને, સમસ્ત પરિથિથનો ત્યાગ કરીને શુદ્ધદોપચોગરૂપ મુનિધર્મ અંગીકાર કરીને .....

અહીં શુદ્ધદોપચોગની પ્રમુખતાથી અપ્રમત્તસંયત ગુણસ્થાન ને જ સમજવું જોઈએ. શ્રેણી આરોહણની તૈયારી અર્થાત્ અપૂર્વ અને અલોકિક પુરુષાર્થ સાતમાંની સાતિશય અપ્રમત્તદશામાં જ થાય છે.

આચાર્યશ્રી અમૃતચંદ્ર અને આચાર્યશ્રી જ્યાસેન પ્રવચનસાર ગાથા ક્રમાંક ૭૮ની ટીકામાં આ શુદ્ધદોપચોગ ને જ અથવા અપ્રમત્તસંયત ગુણસ્થાનને પરમ-ઉપેક્ષા લક્ષણ પરમસામાચિક કહે છે. મુનિરાજની પ્રતિજ્ઞા અને આંતરિક ભાવના તો શુદ્ધદોપચોગરૂપ અપ્રમત્તસંયત ગુણસ્થાનમાં જ રહેવાની હોય છે, પરંતુ પુરુષાર્થની કમજોરીવશ તેઓને પ્રમત્તવિરત ગુણસ્થાનમાં આવવું પડે છે.

આચાર્યશ્રી નેમિચંદ્રદેવે ગોમ્મટસાર જીવકાંડ ગાથા જ્પમાં અપ્રમત્તસંયત ગુણસ્થાનની કર્મોદ્ય સાપેક્ષ પરિભાષા આ પ્રમાણે આપેલ છે:-

સંજલણણોક્લસાયાણુદાઓ, મંદો જદા તદા હોદિ ।

અપમત્તગુણો તેણ ય, અપમત્તો સંજદો હોદિ ॥

સંજ્વલન ક્ષાય તથા નવ નોક્ષાયના મંદ ઉદ્યના સમયમાં અર્થાત् નિમિત્તથી પ્રમાદ રહિત થવાવાળી વીતરાગદશાને અપ્રમત્તસંચયત ગુણસ્થાન કહે છે.

અહીં દ્યાનાવસ્થા છે, શુદ્ધોપયોગ છે, માટે વ્યવહાર સકલસંચયમ પાણવાનો શુભવિકલ્પ નથી થઈ શકતો. મુનિરાજ બુદ્ધિપૂર્વક તો જિજ શુદ્ધાત્મામાં મળન છે. આ કારણે દ્યાનજન્ય આત્માનંદનું રસપાન કરતા રહે છે.

અપ્રમત્તવિરત ગુણસ્થાનમાં સંજ્વલન દેશધાતિ ક્ષાય કર્મ અને હાસ્યાદિ નવ નોક્ષાય કર્મોનો મંદ ઉદ્ય છે, જે મુનિરાજને પ્રમાદલાવ ઉત્પન્ન કરવામાં સમર્થ નથી, પરંતુ આત્મામાં અબુદ્ધિપૂર્વક વિલાવ પરિણામનું અસ્તિત્વ બન્યું રહે છે. આ પરિણામોના નિમિત્તથી હીન સ્થિતિ-અનુભાગવાળા નવા કર્મબંધ પણ નિયમથી થાય જ છે.

સંજ્વલનજન્ય મંદ વિલાવ પરિણામ અને ત્રણ ક્ષાય ચોકડીના અનુદ્યપૂર્વક ઉત્પન્ન વીતરાગ પરિણામ - આ બંનેની મિશ્ર દશાને અપ્રમત્તસંચયત ગુણસ્થાન કહે છે.

વીતરાગતા તથા રાગ - દ્રેષ બંને ચારિત્રગુણાની પર્યાય છે. મોહ અને યોગના નિમિત્તથી આત્માના શ્રદ્ધા તથા ચારિત્ર ગુણોમાં થવાવાળી તારતમ્યરૂપ અવસ્થાઓને ગુણસ્થાન કહે છે. માત્ર વીતરાગ પરિણામોને અપ્રમત્તગુણસ્થાન નથી કહ્યું. સાતમાં ગુણસ્થાનમાં સ્થિત મુનિરાજ માત્ર વીતરાગ પરિણામોના ધારક નથી. તેઓને ક્ષાય-નોક્ષાય કર્મોના મંદ ઉદ્યના નિમિત્તથી અબુદ્ધિપૂર્વક મંદ રાગ-દ્રેષ પરિણામ પણ ધારાવાહીરૂપથી ચાલ્યા જ કરે છે.

મુનિરાજ રાગ-દ્રેષ પરિણામોનો બુદ્ધિપૂર્વક અનુભવ ભલે ન કરતા હોય, ત્રિકાળી નિજ શુદ્ધાત્માનો જ અનુભવ કરતા હોય, પરંતુ સાધક અવસ્થા હોવાને લીધે આત્મપરિણામોમાં વિલાવલાવોનો સદ્ભાવ છે અને તેના નિમિત્તભૂત કર્મોની સત્તા અને ઉદ્ય પણ છે. સંજ્વલન ક્ષાય-નોક્ષાયના મંદ પરિણામોના નિમિત્તથી ચથાયોગ્ય નવા કર્મબંધ

પણ થાય છે.

અપ્રમત્તસંયતથી લઈને સૂક્ષ્મસાંપરાય સુધીના ચારે ગુણસ્થાનોમાં થવાવાળા અબુદ્ધિપૂર્વક વિભાવ ભાવ સાધકની પોતાની બુદ્ધિ છારા પકડમાં આવતાં નથી અર્થાત् તેમના જ્ઞાનમાં સ્પષ્ટ ઝોય બનતા નથી, કારણ કે તે કેવળજ્ઞાનગમ્ય સૂક્ષ્મ ભાવ છે.

આચાર્યશ્રી નેમિયંબ્રેટે જ ગોમ્મટસાર જીવકાંડ ગાથા - જ્ડમાં સ્વસ્થાન અપ્રમત્તગુણસ્થાનની દ્યાનની મુખ્યતાથી લેદ સહિત પરિભાષા નીચે પ્રમાણે પણ આપેલ છે, જે વિશેષ મહત્વપૂર્ણ છે -

**ણદ્વાસેસપ્રમાદો વયગુણસીલોલિમંદિઓ ણાણી ।**

**અણુવસમતો અખવાઓ ઝાણણિલીણો હુ અપમત્તો ॥**

જેના વ્યક્ત અને અવ્યક્ત બધા પ્રકારના પ્રમાદ નષ્ટ થઈ ગયા છે, જે પ્રત, ગુણ અને શીલોથી મંડિત છે, જે નિરંતર આત્મા અને શરીરના લેદવિજ્ઞાનથી ચુક્ત છે, જે ઉપશમ અને ક્ષપકશ્રેણી પર આરૂઢ નથી થયા અને જે દ્યાનમાં લવલીન (તલ્લીન) છે, તેઓને અપ્રમત્તસંયત કહે છે.

આ ગાથાથી સ્પષ્ટ થાય છે કે સાતમાં ગુણસ્થાનમાં મુનિરાજને નિયમથી દ્યાન હોય જ છે, જેને શુદ્ધ્યોપયોગ નામથી પણ કહી શકીએ છીએ.

કદાચિત્ આ ને જ ધર્મદ્યાન આઈ નામથી અન્યત્ર કહેવાયું હોય તો આપણે ભિત્ત થવાની આવશ્યકતા નથી. નામ તો અન્ય હોઈ શકે છે, પરંતુ સાતમું ગુણસ્થાન દ્યાનાવસ્થાનું છે, આ નિર્ણયરૂપથી આપણે સમજું જોઈએ.

**લેદ અપેક્ષા વિચાર :**

સાતમાં ગુણસ્થાનના બે લેદ છે (૧) સ્વસ્થાન અપ્રમત્ત

(૨) સાતિશય અપ્રમત્ત.

**૧. સ્વસ્થાન અપ્રમત્ત (નિરતિશય અપ્રમત્ત) -**

૧) સર્વ પ્રમાદનાશક, પ્રત-ગુણ-શીલોથી સહિત અનુપશમક-અક્ષપક દ્યાનમાં લીન મુનિદશા સ્વસ્થાન અપ્રમત્ત છે.

૨) જે અપ્રમત્તસંયત ગુણસ્થાનથી મુનિરાજ નિયમથી છઢા પ્રમત્તસંયત ગુણસ્થાનમાં જાય છે, તે અપ્રમત્તસંયત ગુણસ્થાનને સ્વસ્થાન કે

નિરતિશય અપ્રમત્ત કહે છે.

૩) ભાવલિંગી મુનિરાજ સાતમાં-ઇંડા અને ઇંડા-સાતમાં ગુણસ્થાનમાં સતત ગમનાગમન કરતા જ રહે છે/જૂલતાં જ રહે છે. એ કાળમાં તેઓને પ્રાણ થવાવાળા અપ્રમત્તસંયત ગુણસ્થાનને સ્વસ્થાન કે નિરતિશય અપ્રમત્ત કહે છે.

## ૨. સાતિશય અપ્રમત્તસંયત :

૧) ચારિત્રમોહનીય કર્મની ૨૧ પ્રકૃતિઓ (અપ્રત્યાખ્યાનાવરણ-૪, પ્રત્યાખ્યાનાવરણ-૪, સંજીવલન - ૪ અને હાસ્યાદિક નવ નોકાશાય)ના ઉપશમ તથા ક્ષયમાં નિમિત્ત અધાકરણાદિ ત્રણ કરણોમાંથી પ્રથમ અધાઃપ્રવૃત્તકરણ દશા સાતિશય અપ્રમત્તસંયત છે.

૨) જે અપ્રમત્તસંયત ગુણસ્થાનથી વિશેષ પુરુષાર્થી મુનિરાજ નિયમથી ઇંડા પ્રમત્તસંયત ગુણસ્થાનમાં નીચે આવતા જ નથી, એ અપ્રમત્ત દશાને સાતિશય અપ્રમત્તસંયત કહે છે.

૩) જે અપ્રમત્તસંયત ગુણસ્થાનથી વિશેષ પુરુષાર્થી મુનિરાજ નિયમથી પ્રમત્તસંયતમાં ન જઈ ઉપર અપૂર્વકરણ ગુણસ્થાનમાં જ જાય છે અર્થાત् શ્રેણી પર આરુઢ થાય છે, તેને સાતિશય અપ્રમત્તસંયત કહે છે.

શ્રેણી તો આઠમા અપૂર્વકરણ ગુણસ્થાનથી જ પ્રારંભ થાય છે, ત્તાં પણ શ્રેણીની પૂર્વ તૈયારી સાતિશય અપ્રમત્તવિરત ગુણસ્થાનમાં જ થાય છે.

## અપ્રમત્તનું સ્પષ્ટીકરણ :

પૂર્વોક્ત વિકથાદિ પંદર પ્રમાણોની અભાવરૂપ દશા અર્થાત् શુદ્ધ્યોપયોગરૂપ અવસ્થાને જ અપ્રમત્તસંયત ગુણસ્થાન કહે છે. અપ્રમત્ત દશા કહો અથવા પ્રચુર આત્માનંદની દશા કહો - બંનેનો એક જ અર્થ છે. પ્રમત્તસંયત ગુણસ્થાનવર્તી મુનિજીવનની અપેક્ષા આ અપ્રમત્તસંયત/આત્મલીનતારૂપ અવસ્થાને સાવધાન અવસ્થા કહે છે. જિનાગમની રચના કરવી, ધર્મોપદેશ દેવો, સ્વયં દીક્ષાર્થી પાત્ર શ્રાવકોને મુનિદીક્ષા આપવી આદિ કાર્યો કરવા મુનિને માટે ઇંડા ગુણસ્થાનની પ્રમાદ દશા છે.

કેવળી પ્રાણિત વીતરાગધર્મ મહાન, અદ્ભુત અને આશ્ર્વિકારી છે. જે જે વિષયોને સર્વ જગત સર્વોત્તમ માને છે/ કહે છે, તે જ કાર્યોને કરવા પ્રમાદ કે આત્માની અસાવધાનતા અથવા મુનિજીવનના

અનુચામ કાર્ય છે, એવું કથન કેવળી ભગવાન કરે છે. મનુષું જ અલોકિક તથા અનુપમ દશા છે. આ જ દશા સાક્ષાત ભગવાન થવાનો સાચો એકમાત્ર ઉપાય છે. સાધુ થયો તે સિદ્ધ થયો, કરણી રહી ન કોઈ આ અલિપ્રાય સત્ય છે. સાધુ અર્થાત् દિગંબર મુનિ છે તો મનુષ્ય ગતિના જીવ, પરંતુ વાસ્તવમાં તે હૃતાં-હૃતાં સિદ્ધ ભગવાન જ છે, કારણ કે મુનિજીવન સિદ્ધદશારૂપી પર્વતની તળોટી જ છે. જેમ સિદ્ધ ભગવાન સાક્ષાત જ્ઞાતા-બ્રષ્ટા થઈ ગયા છે, તેમ જ દિગંબર લાવલિંગી સંત પણ પોતાની ભૂમિકા અનુસાર જ્ઞાતા-બ્રષ્ટાપણે જ રહે છે.

### સમ્યકૃત્વ અપેક્ષા વિચાર :

સ્વરસ્થાન અપ્રમત્ત મુનિરાજને તો ઔપશમિક, ક્ષાયોપશમિક અને ક્ષાયિક - આ ત્રણે સમ્યકૃત્વમાંથી કોઈપણ એક સમ્યકૃત્વ રહી શકે છે. પરંતુ સાતિશય અપ્રમત્ત મુનિરાજને દ્વિતીયોપશમ સમ્યકૃત્વ અને ક્ષાયિક સમ્યકૃત્વ - આ બંનેમાંથી કોઈ એક જ રહે છે.

સાતિશય અપ્રમત્ત ગુણસ્થાનવર્તી મુનિરાજને તો શ્રેણી પર આરૂપ થવાનું છે. ક્ષાયોપશમિક સમ્યકૃત્વની સાથે તે શ્રેણી આરોહણ ન કરી શકે, કારણ કે ક્ષાયોપશમિક સમ્યકૃત્વમાં જે કેવળજ્ઞાનગમ્ય ચલ-મલ-અગાઢ દોષ હોય છે, તે સૂક્ષ્મ દોષ પણ શ્રેણીના આરોહણ કાર્યમાં બાધક છે. છતાંય આ દોષ સમ્યકૃત્વરૂપી ધર્મમાં તો વિશેષ બાધા ઉત્પણ્ણ નથી કરી શકતા, પરંતુ શ્રેણી આરોહણના અલોકિક કાર્યમાં બાધક જરૂર થાય છે.

તેથી બાધકપણાંને દૂર કરવા માટે જ મુનિરાજના ક્ષાયોપશમિક સમ્યકૃત્વ જ ઔપશમિક સમ્યકૃત્વરૂપથી પરિણામિત થઈ જાય છે. આ કારણે ઔપશમિક સમ્યકૃત્વમાં ક્ષાયિક સમ્યકૃત્વ જેવી નિર્મળતા આવી જાય છે, આ સમ્યકૃત્વને દ્વિતીયોપશમ સમ્યકૃત્વ કહે છે.

શ્રેણી ચઢવાના સન્મુખ સાતિશય સખમ ગુણસ્થાનવર્તી ક્ષાયોપશમિક સમ્યકૃત્રણ જીવના ત્રિકરણપૂર્વક અનંતાનુંદી કધાય ચતુર્ષયના વિસંયોજન તથા દર્શનમોહનીયત્રિકના ઉપશમના સમયે થવાવાળા શ્રદ્ધાગુણાના સમ્યક પરિણામનને દ્વિતીયોપશમ સમ્યકૃત્વ કહે છે. (ઉપશમશ્રેણીવાળા માટે અનંતાનુંદીનું વિસંયોજન હોય અથવા ન

પણ હોય કોઈ નિયમ નથી.)

### ચારિત્ર અપેક્ષા વિચાર :

આ અપ્રમત્તસંયત સાતમાં ગુણસ્થાનમાં ક્ષાયોપશમિક ચારિત્ર હોય છે. તે ક્ષાયોપશમિકપણું નિમનપ્રકારે ઘટીત થાય છે - પ્રત્યાખ્યાનાવરણ કષાય કર્મના વર્તમાનકાળના સર્વધાતિ સ્પર્ધકોના ઉદ્યાભાવી ક્ષય, તેના જ ભવિષ્યમાં ઉદ્ય આવવા ચોગ્ય સ્પર્ધકોના સદ્બુધારણ ઉપશમ અને દેશધાતિ સંજ્ઞવલન કષાય તથા હાસ્યાદિ નવ નોકષાયોનો મંદ ઉદ્ય હોય છે.

મુનિજીવનમાં વ્યક્ત/પ્રગટ વીતરાગભાવ તો નિશ્ચય ચારિત્ર છે અને વીતરાગતાની સાથે તે જ સમયે અબુદ્ધિપૂર્વક રાગ પરિણામ, તે વ્યવહાર ચારિત્ર છે. નિશ્ચય ચારિત્ર તો મોક્ષમાર્ગસ્પર્ધાનું હોવાથી તેનાથી સંપર્નિજર્ઝા સતત થતાં જ રહે છે, તે જ સમયે જે અબુદ્ધિપૂર્વક કષાયનું પરિણામન છે, તે વ્યવહારચારિત્ર છે, તેનાથી આશ્વાસ-બંધ પણ થતાં રહે છે.

### કાળ અપેક્ષા વિચાર :

**જધન્યકાળ :** કોઈ પ્રમત્તસંયતનું ગુણસ્થાનવર્તી ભાવલિંગી સંત શુભોપયોગનો અભાવ કરીને શુદ્ધોપયોગનું અપ્રમત્તસંયત ગુણસ્થાનમાં માત્ર એક સમય જ રહે અને તત્કાલ જ મનુષ્યાચુનો ક્ષય થઈ જાય તો દ્યાનાવસ્થામાં જ મરણ થાય છે. આ પ્રકારે મરણાની અપેક્ષાથી જ માત્ર એક સમય ઘટિત થઈ જાય છે.

**જયારે ઉપશમક મુનિરાજ શ્રેણીથી ઉત્તરતાં સમયે અપૂર્વકરણ ગુણસ્થાનથી નીચે સાતમાં અપ્રમત્તસંયત ગુણસ્થાનમાં આવે છે, ત્યારે અપ્રમત્તસંયતમાં માત્ર એક સમય રહી શક્યા અને તત્કાળ મનુષ્યાચુનો ક્ષય થઈ જાય તો મરણાની અપેક્ષા માત્ર એક સમય ઘટિત થઈ જાય છે.**

**ઉત્કૃષ્ટકાળ :** જો અપ્રમત્તસંયત ગુણસ્થાનવર્તી મુનિરાજનું મરણ નથી થતું તો તે યથાચોગ્ય એક અંતર્મુહૂર્ત કાળ સુધી આ સાતમાં ગુણસ્થાનમાં રહે છે. સાતમાં ગુણસ્થાનનો ઉત્કૃષ્ટકાળ યથાચોગ્ય એક અંતર્મુહૂર્ત છે.

**મદ્યમ કાળ :** છઢા ગુણસ્થાનથી ઉપર અપ્રમત્તસંયતમાં જવાની અપેક્ષા તથા અપૂર્વકરણ ગુણસ્થાનથી નીચે અપ્રમત્તસંયતમાં આવવાની અપેક્ષા પણ વિચાર કરીએ છીએ અને મરણાની વિવક્ષાથી પણ વિચારીએ છીએ

તો બે, ત્રણ, ચાર આદિ સમયરૂપ કાળથી લઈને યથાયોગ્ય અંતર્મુહૂર્ત કાળ સુધી વચ્ચેના જેટલા પણ લેદ છે, તે સર્વે અપ્રમતસંયતના મધ્યમકાળના જ લેદ છે.

### ગમનાગમન અપેક્ષા વિચાર :

ગમન : ૧) સાતિશય અપ્રમતસંયત મુનિરાજનું ઉપરની તરફ ગમન માત્ર અપૂર્વકરણ ગુણસ્થાનમાં જ થાય છે.

૨) સ્વસ્થાન અપ્રમતસંયત મુનિરાજનું ગમન નીચે પ્રમતસંયત ગુણસ્થાનમાં જ થાય છે.

૩) જો ઉપશમશ્રેણીથી નીચે પતનકાળમાં કોઈ મુનિરાજ અપ્રમતસંયત ગુણસ્થાનમાં આવે તો તેમનું ગમન પણ પ્રમતસંયત ગુણસ્થાનમાં જ થાય છે.

૪) છઢા થી સાતમામાં આવ્યા હોચ અથવા આઠમાથી સાતમાં ગુણસ્થાનમાં આવ્યા હોચ તો પણ જો દ્વાનમગ્ન મુનિરાજનું શુદ્ધદ્વોપયોગના કાળમાં જ મરણ થઈ જાય છે તો તે મુનિરાજનું ગમન વિગ્રહગતિના સમયે ચોથા અવિરત સમ્યકૃત્વ ગુણસ્થાનમાં જ થાય છે. આગમન : ૧) સાદિ કે અનાદિ ભિદ્યાત્વ ગુણસ્થાનવર્તી દ્રવ્યલિંગી મુનિરાજનું ભિદ્યાત્વથી સીધું અપ્રમતસંયત ગુણસ્થાનમાં આગમન થઈ શકે છે.

૨) અવિરતસમ્યકૃત્વ ગુણસ્થાનવર્તી દ્રવ્યલિંગી મુનિરાજનું સીધું અપ્રમતસંયત ગુણસ્થાનમાં આગમન સંભવ છે.

૩) દેશવિરત ગુણસ્થાનવર્તી દ્રવ્યલિંગી મુનિરાજનું સીધું અપ્રમતસંયત ગુણસ્થાનમાં આગમન થઈ શકે છે.

૪) પ્રમતસંયત ગુણસ્થાનવર્તી ભાવલિંગી સંતોનું આગમન સાતમાં અપ્રમતસંયતમાં તો હંમેશા થાય જ છે.

૫) ઉપશમશ્રેણીથી નીચે તરફ પતન કરવાવાળા અપૂર્વકરણ ગુણસ્થાનથી અપ્રમતસંયતમાં આવવું થાય છે.

### વિશેષ અપેક્ષા વિચાર :

સાતિશય અપ્રમત ગુણસ્થાનમાં ચાર આવશ્યક કાર્ય થાય છે.

૧. સમય - સમયે પ્રતિ આત્મમાં અનંતગુણી વિશુદ્ધિ થતી રહે છે. પહેલા સમયમાં જેટલી માત્રામાં વિશુદ્ધિ છે, તેનાથી અનંતગુણી

નવી વિશિષ્ટ વિશુદ્ધિ બીજા સમયમાં થઈ જાય છે. બીજા સમયની વીતરાગતાથી ત્રીજા સમયની વીતરાગતા અનંતગણી વધારે છે, એવો કમ અંતર્મુહૂર્તકાળ સુધી નિરંતર ચાલુ જ રહે છે.

વિશુદ્ધિ કે વિશુદ્ધતામાં વૃદ્ધિગત વીતરાગ પરિણામ અને ઘટતો કષાયનો અંશ - બંને ગર્ભિત છે. આને મિશ્રધારા પણ કહે છે.

જેમ કે :- કોઈ માણસને આજે પહેલા દિવસે ૧૦ડા.નો લાભ થયો. તે દસ ડિપિયાનો લાભ પ્રત્યેક દિવસ દસગણો વધતો રહે તો તેને સાતમાં દિવસે કેટલો લાભ થાય છે, તેનો નિર્ણય કરીએ. તેનાથી વીતરાગતામાં અનંતગણી વૃદ્ધિનું અનુમાન થઈ જાય છે.

- (૧) પહેલા દિવસે લાભ માત્ર ૧૦ ઢા. નો છે.
- (૨) બીજા દિવસે લાભ દસ ગણો અર્થાત्  $10 \times 10 = 100$  ઢા.
- (૩) ત્રીજા દિવસે લાભ  $100 \times 10 = 1000$  ઢા.
- (૪) ચોથા દિવસે લાભ  $1000 \times 10 = 10000$  ઢા.
- (૫) પાંચમા દિવસે લાભ  $10000 \times 10 = 100000$  ઢા.
- (૬) છઠા દિવસે લાભ  $1 \text{ લાભ} \times 10 = 10 \text{ લાભ ઢા.}$
- (૭) સાતમા દિવસે લાભ  $10 \text{ લાભ} \times 10 = 1 \text{ કરોડ ઢા.}$

વ્યાપારમાં જો કોઈને રોજ દસગણો લાભ થાય છે, તો તે વ્યાપારીને સાતમા દિવસે જ એક કરોડ ઢા. નો લાભ થઈ જાય છે.

અહીં અપ્રમત્તસંચયત ગુણસ્થાનમાં તો પ્રતિસમય અનંતગણી વીતરાગતા વધતી જ જાય છે. જો સાતિશય અપ્રમત્તસંચયત મુનિરાજના થથાયોગ્ય માત્ર એક અંતર્મુહૂર્ત કાળના અસંખ્યાત સમયોમાં સમય-સમય પ્રતિ અનંતગણી વીતરાગતા વધતી જાય છે તો તે વીતરાગતા આગળ કેટલી વધી શકે છે, એનો સામાન્ય બોધ આપણાને આગમ પ્રમાણાથી થઈ જાય છે. અનંતનું પ્રત્યક્ષ જ્ઞાન તો માત્ર સર્વજ્ઞ ભગવાનને જ હોય છે.

વીતરાગતાની અનંતગણી વૃદ્ધિની તથા કષાયની ઉત્તરોત્તર હાની/હીન-હીન થવાનો આ કમ જીવ જ્યાંસુધી પૂર્ણ વીતરાગતારૂપ નથી પરિણામતો ત્યાંસુધી અર્થાત् ૧૧માં અથવા ૧૨માં ગુણસ્થાન સુધી નિરંતર ચાલ્યા જ કરે છે.

આના ફળસ્વરૂપે સ્વભાવમાં વિશેષ મળનતા અને પ્રચુર અતીજીવ્ય

આનંદનો ભોગ મુનિરાજ કરતા રહે છે.

**પ્રશ્ન ૬૪ :** બારમાં ગુણસ્થાનથી આગળ વીતરાગતામાં અનંતગુણી વૃદ્ધિ કેમ થતી નથી ?

**ઉત્તર :** બારમાં ગુણસ્થાનમાં પ્રથમ સમયમાં જ વીતરાગતા પરિપૂર્ણ પ્રગટ થઈ ગઈ છે તો હવે આગળ વધવા માટે કાંઈ અવકાશ રહ્યો જ નથી. તેથી પૂર્ણ વીતરાગ થવાથી અનંતગાણી વિશુદ્ધિરૂપ પૂર્ણ વીતરાગતા સતત અખંડ અને અવિચાળપદી અનંતકાળ સુધી બની જ રહે છે.

**પ્રશ્ન ૬૫ :** સ્થિતિબંધ કોણે કહે છે ?

**ઉત્તર :** જ્ઞાનાવરણાદિ કર્મરૂપ પરિણામિત પુદ્ગલ સ્કંધોનું આત્મપ્રદેશો સાથે એકલેત્રાવગાહ સ્થિતિરૂપ કાળાવધિના બંધન ને સ્થિતિબંધ કહે છે.

૨. સ્થિતિબંધાપસરણ થાય છે. પ્રત્યેક સંસારી જીવને પોતા-પોતાની ભૂમિકાઅનુસાર મોહ-રાગ-ઝ્રેષ્ઠ પરિણામોના નિમિત્તથી પ્રત્યેક સમયમાં નવા કર્મનો બંધ થતો જ રહે છે. આ સાતિશાય અપ્રમત્તા ગુણસ્થાનવતી મુનિરાજને વિપરીત માન્યતારૂપ મિથ્યાત્વ તો છે જ નહીં. તે તો ચોથા ગુણસ્થાનથી જ નથી રહેતું. તેથી દર્શનમોહનીયના નિમિત્તથી તો નવા કર્મબંધ થતાં જ નથી.

અપ્રમત્તાસંયત મુનિરાજના રાગ-ઝ્રેષ્ઠ પરિણામ પણ અત્યંત હીન થઈ ગયા છે. આગળના અંતર્મુહૂર્તથી તો તે મુનિરાજ શ્રેણી પર જ આર્થ થવાના છે તથા વર્તમાનકાળમાં વીતરાગતા સમય-સમય પ્રતિ વધતી જ રહી છે. તેથી નવા થવાવાળા કર્મબંધ ઉત્તરોત્તર ઓછી સ્થિતિ લઈને બંધાતા રહે છે, તેને જ સ્થિતિબંધાપસરણ કહે છે.

જેમ કોઈને પહેલા અંતર્મુહૂર્તમાં સો વર્ષના કર્મનો સ્થિતિબંધ થયો હતો, તેને જ બીજા અંતર્મુહૂર્તમાં ૮૦ વર્ષનો સ્થિતિબંધ થાય છે. ત્રીજા અંતર્મુહૂર્તમાં ૮૦ વર્ષનો સ્થિતિબંધ થાય છે. ચોથા અંતર્મુહૂર્તમાં ૭૦ વર્ષનો. આ રીતે નવા કર્મનો સ્થિતિબંધ ઓછા કાળાવધિનો જ થતો રહે છે. તેને સ્થિતિ-બંધાપસરણ કહે છે.

કર્મબંધમાં જીવના રાગ-ઝ્રેષ્ઠભાવ, નિમિત્ત માત્ર છે અને નવા કર્મબંધ સ્વયમેવ પોતાના કારણથી હીન સ્થિતિવાળા બંધાતા જાય છે. આમાં સાતિશાય અપ્રમત્તા ગુણસ્થાનવતી મુનિરાજનું બુદ્ધિપૂર્વક કાંઈ કર્તવ્ય નથી. માટે સર્વજ્ઞ કથિત સહજ નિમિત્ત-મૈમિત્તિક સંબંધ સમજવો બહુ જ

મહત્વપૂર્ણ છે.

આચાર્ય અમૃતચંક્રના પુરુષાર્થસિદ્ધઉપાય શ્લોક ૧૨માં આ વિષય અત્યંત સ્પષ્ટ રીતથી આવ્યો છે, જે આ પ્રકારે છે :-

જીવે કરેલા રાગાદિ પરિણામોનું માત્ર નિમિત્ત પામી કાર્માં વર્ગણાઓના પુરુષાર્થ સ્કંધ આત્મામાં પોતાની મેળે જ જ્ઞાનાવરણાદિ કર્મરૂપ પરિણામન કરી જાય છે.

પ્રશ્ન ૮૭ : નિમિત્ત - નૈમિત્તિક સંબંધ કોણે કહે છે ?

ઉત્તર : જ્યારે ઉપાદાન સ્વયં કાર્યરૂપ પરિણામે છે, ત્યારે ભાવરૂપ કે અભાવરૂપ જે કોઈ ચોગ્ય નિમિત્ત કારણનો તેની સાથે સંબંધ છે - તે બતાવવા માટે તે કાર્યને નૈમિત્તિક કહે છે. આ રીતે બિજ્ઞ પદાર્થોના આ સ્વતંત્ર સંબંધને નિમિત્ત - નૈમિત્તિક સંબંધ કહે છે.

નિમિત્ત - નૈમિત્તિક સંબંધ પરતંત્રતાનું સૂચક નથી, પરંતુ નૈમિત્તિકની સાથે કોણ નિમિત્તરૂપ પદાર્થ છે, તેનું જ્ઞાન કરાવે છે. જે કાર્યને નિમિત્તની અપેક્ષાએ નૈમિત્તિક કહ્યું છે, તેને જ ઉપાદાનની અપેક્ષા ઉપાદેય પણ કહે છે. (આ સંબંધ ને ફ્રાન્ઝ્યો - ઉપાદાન તથા નિમિત્તની એક સમયવતી વર્તમાનકાળની પથયોમાં જ બને છે.)

૩. પ્રશસ્ત પ્રકૃતિઓનો અનુભાગ સમયે-સમયે અનંતગણો વધે છે. પ્રશસ્ત પ્રકૃતિઓનો અર્થ છે સાતાવેદનીય આદિ પુણ્ય પ્રકૃતિ. આ વિષયને સમજવા માટે આપણે પહેલાં આ નિર્ણય કરીએ કે પુણ્યકર્મનો બંધ શ્રાવકને વધારે હોય છે કે મુનિરાજને. શ્રાવકના જીવનમાં બાધ્ય પુણ્યક્રિયા વધારે હોય છે, કારણ કે પૂજા, પ્રતિષ્ઠા, વિદ્યાન, દાન, પરોપકાર, ચાત્રાદિ સર્વ પુણ્યક્રિયાઓ શ્રાવક જ તો કરે છે.

મુનીજીવનમાં પુણ્યરૂપ બાધ્ય કિયાકાંડ માટે અવકાશ જ નથી કારણ કે પુણ્યક્રિયાઓ આરંભનું મૂળ હોય છે અને મુનિરાજ તો આરંભના ત્યાગી છે. છતાં પણ મુનીજીવનમાં પુણ્યભાવ વધારે હોય છે.

આનું મૂળ કારણ મુનિરાજની કખાયોની મંદ્તા અર્થાત્ વિશેષ વિશુદ્ધતા જ છે. જ્યાં કખાયોની વધારે મંદ્તા હોય છે, ત્યાં પુણ્યનો અનુભાગ બંધ વધારે હોય છે, એવો સ્વાભાવિક નિયમ છે.

સાતિશય અપ્રમત્તસંયત અવસ્થામાં બિરાજમાન મુનિરાજની વીતરાગતા તો વિશેષ છે જ અને પ્રતિસમય અનંતગણી વધી પણ રહી

છે. તેની સાથે જ વિધમાન સંજવલન કખાય ઉત્તરોત્તર ઘણો-ઘણો મંદ થતો જાય છે. આ કારણે નવાં પુણ્ય કર્મનો બંધ તો અલ્પ સ્થિતિ અને વધારે અનુભાગવાળો જ હોય છે, પરંતુ પૂર્વબદ્ધ પ્રશાસ્ત (પુણ્ય) પ્રકૃતિઓનો અનુભાગ પણ પ્રતિસમય અનંતગણો વધતો અર્થાત् ઉત્કર્ષિત જ થતો રહે છે.

૪. અપ્રશાસ્ત (પાપ) પ્રકૃતિઓનો અનુભાગ સમયે - સમયે પ્રતિ અનંતગણો ઘટે છે. મુનિરાજની વીતરાગતાનું વધવું, કખાયનું સતત મંદ થતા જવું - આ વિશુદ્ધિ પરિણામોના નિમિત્તથી સત્તામાં સ્થિત તથા નવા પાપ કર્મોનો અનુભાગ ઘટવો તે પણ સ્વયમેવ થતું જાય છે. જેમ-ગોળ મીઠો હોય છે, સાકર મીઠી હોય છે અને મીસરી પણ મીઠી હોય છે. છતાં આ ત્રણેના મીઠાપણામાં અંતર હોય છે. તેમજ કર્મોની ફળપ્રદાન શક્તિમાં પણ અલગ-અલગ વધતી - વધતી અથવા ઘટતી - ઘટતી વિશેષતાઓ હોય છે, તેને જ અનુભાગબંધ સમજવો જોઈએ.

જુઓ - પ્રકૃતિની વિચિત્રતા ! મિથ્યાક્રષ્ણ જીવ અંતર્ગની ઝયિથી પુણ્ય દીર્ઘે છે, પરંતુ તેને પુણ્ય નથી મળતું, ઉલ્લું પુણ્યની દીર્ઘાથી પાપની જ પ્રાપ્તિ થાય છે. સમ્યક્ક્રષ્ણ પુણ્ય દીર્ઘતો નથી અર્થાત् પુણ્યને હેય માને છે, તો પણ તેને સાતિશાય પુણ્યનો બંધ થતો રહે છે.

આગળ શ્રેણી સન્મુખ કે શ્રેણી પર આરુઢ સાધકનો ધર્મ તો વિશેષ વધતો જ જાય છે, સાથે જ પુણ્યનો અનુભાગ પણ પ્રતિસમય અનંતગણો વધતો જવો અને તે જ સમયે પાપનો અનુભાગ પણ પ્રતિસમય અનંતગણો ઘટતો રહેવો એ કાર્ય સ્વયમેવ તથા સતત થતા રહે છે.

ઉપર લખેલ (૧) પ્રતિ સમય અનંતગણી વિશુદ્ધિ (૨) સ્થિતિ બંધાપસરણ (૩) પ્રશાસ્ત પ્રકૃતિઓનો અનુભાગ અનંતગણો વધવો અને (૪) અપ્રશાસ્ત પ્રકૃતિઓનો અનુભાગ અનંતગણો ઘટવો - આ ચારે આવશ્યક કાર્ય સાતિશાય અપ્રમત્ત ગુણસ્થાનમાં પ્રારંભ થઈ જાય છે અને આગળ આઠમાં, નવમાં અને દસમાં ગુણસ્થાનોમાં પણ થતાં જ રહે છે.

**પ્રશ્ન ૫૮ :** ઉપશાંતમોહ આઈ આગળના ચારે ગુણસ્થાનોમાં આ ઉપર લખેલ ચારેય આવશ્યક કાર્ય કેમ નથી થતા ?

**ઉત્તર :** તેના ત્રણ કારણ આ પ્રમાણે છે :-

(૧) ઉપશાંતમોહ આઈ આગળના ચારે ગુણસ્થાનમાં નવા કર્મોનો

બંધ થવો જ અટકી ગયો છે, તેથી સ્થિતિ ઓછી થવાનું કોઈ કામ જ ન રહ્યું.

(૨) ઉપશાંતમોહ આદિ આગળના ચારે ગુણસ્થાનમાં મુનિરાજ પૂર્ણતઃ વીતરાગી થઈ ગયા છે. આ કારણે આ આવશ્યક કાર્યો માટે અવકાશ જ નથી.

(૩) કખાચ - નોકખાચનો અભાવ જ થઈ ગયો છે, આ કારણે અનુભાગ વધવા - ઘટવાનું કાંઈ કામ જ રહ્યું નથી. માટે ચારેય આવશ્યક કાર્ય અગ્યારમાં આદિ ગુણસ્થાનોમાં થતાં જ નથી.

૫. સાતમાં ગુણસ્થાનના નામમાં અપ્રમત્ત શબ્દ આવ્યો છે, તે આદિ દીપક છે, કારણ કે આ સાતમાં ગુણસ્થાનથી લઈને ઉપરના બધાં ગુણસ્થાન અપ્રમત્ત જ હોય છે.

અપ્રમત્તદશાં અર્થાત् દ્વાનાવસ્થા, શુદ્ધોપયોગ, આત્મલીનતા, શુદ્ધાત્માની અસ્તિની મસ્તીમાં મગનતા -એમ અનેક નામ છે.

અપ્રમત્તસંયત ગુણસ્થાનથી લઈને આગળના ગુણસ્થાનોમાં નિવાસ કરવાવાળા સર્વ મહામુનિરાજ અભૂતપૂર્વ અતીજિદ્રય આત્માનંદનો પ્રચુરતાથી રસપાન કરે છે.

૬. ઉપરિમ સમયવર્તી જીવોના પરિણામો થી ઓછા સમયવર્તી જીવોના પરિણામોની સદ્શા-સ્થિતિને અધઃપ્રવૃત્તકરણ કરે છે.

સમજી લો, સાતિશય અપ્રમત્ત ગુણસ્થાનવર્તી બે મુનિરાજ છે. એક મુનિરાજને સોળમાં સમયમાં આવવાવાળા શુદ્ધ પરિણામ પંદરમો સમય વીત્યા પછી સોળમાં થયા. અન્ય મુનિરાજને વિશેષ પુરુષાર્થ દ્વારા માત્ર ચાર સમય વ્યતીત થયા બાદ તરત જ સોળમાં સમયને ચોગ્ય / સદ્શા શુદ્ધ પરિણામ થઈ ગયા. આ પ્રકારે ઉપરિમ સમયવર્તી જીવના પરિણામોથી ઓછા સમયવર્તી જીવના પરિણામોની સદ્શતા ઘટિત થઈ, તેને જ અધઃપ્રવૃત્તકરણ કરે છે. ઉપરોક્ત બિત્ત સમયવર્તી પરિણામોની સદ્શતાને અનુકૃષ્ટ રચના પણ કરે છે.

૭. ચારિત્રમોહનીય કર્મના ઉપશામ તથા ક્ષયના પ્રસંગમાં અપૂર્વકરણના સંભુખ શુદ્ધોપયોગ પરિણામને અધઃપ્રવૃત્તકરણ કરે છે.

૮. સાતમાં અપ્રમત્તસંયત ગુણસ્થાનમાં મરીને વિગ્રહણતિના સમયે ચોથું ગુણસ્થાન થઈ જાય છે અથવા મરણની પહેલાં સાતમાં ગુણસ્થાનથી

પડીને છઢા, પાંચમા, ચોથા, બીજા તથા પહેલાં ગુણસ્થાનોમાંથી કોઈ પણ એક ગુણસ્થાનમાં આવ્યા બાદ મરણ થઈ શકે છે, પરંતુ આ નિયમ નથી કે સાતમાં ગુણસ્થાનવાળા ચોથા ગુણસ્થાનમાં જ આવીને મૃત્યુ પામે, કારણ કે સાતમાં ગુણસ્થાનમાં પણ મૃત્યુ થઈ શકે છે.

**ધવલા પુસ્તક - ૧નો અંશ (પાના નં. ૧૭૮-૧૮૦)**

**સામાન્યથી અપ્રમત્તાસંચયત જીવ છે ॥૧૫॥**

પ્રમત્તાસંચયતોનું સ્વરૂપ પહેલા કહેવામાં આવ્યું છે, જેનો સંચયમ પ્રમાદ સહિત નથી હોતો, તેને અપ્રમત્તાસંચયત કહે છે અર્થાત् સંચયત હોતા થકા જે જીવોના પંદર પ્રકારના પ્રમાદ જોવામાં ન આવે તેને અપ્રમત્તાસંચયત સમજવું જોઈએ.

**શંકા 22 :** બાકીના સંપૂર્ણ સંચયતોનો આ અપ્રમત્તાસંચયત ગુણસ્થાનોમાં અન્તર્ભવ થઈ જાય છે, માટે શેષ સંચયતગુણસ્થાનનો અભાવ થઈ જશે?

**સમાધાન :** એવું નથી, કારણ કે જે આગળ કહેવામાં આવવાવાળા અપૂર્વકરણાદિ વિશેષણોથી ચુક્ત નથી અને જેનો પ્રમાદ નષ્ટ થઈ ગયો છે એવા સંચયતોને જ અહીં ગ્રહણ કરેલ છે. માટે આગળના સમસ્ત સંચયત ગુણસ્થાનોનો આમાં અંતર્ભવ નથી થતો.

**શંકા 23 :** આ કેવી રીતે જાણવામાં આવે કે અહીંચા આગળ કહેવામાં આવનારા અપૂર્વકરણાદિ વિશેષણોથી ચુક્ત સંચયતોને ગ્રહણ નથી કરવામાં આવ્યા?

**સમાધાન :** ના, કારણ કે જો આ ન માનવામાં આવે, તો આગળના સંચયતોનું નિરૂપણ થઈ નથી શકતું. માટે એ જ્યાલ આવે છે કે અહીંચા અર્ઘૂલકરણાદિ વિશેષણોથી રહિત કેવળ અપ્રમત્ત સંચયતોને જ ગ્રહણ કરવામાં આવ્યા છે.

વર્તમાન સમયમાં પ્રત્યાખ્યાનાવરણીય કર્મના સર્વધાતિ સ્પર્ધિકોનો ઉદ્યક્ષય થવાથી અને આગામી કાળમાં ઉદ્યમાં આવવાવાળા તેના જ ઉદ્યાભાવલક્ષણ ઉપશમ થવાથી તથા સંજ્યલન કખાયનો મંદ ઉદ્ય થવાથી પ્રત્યાખ્યાનની ઉત્પત્તિ થાય છે, માટે આ ગુણસ્થાન પણ ક્ષાયોપશમિક છે.

તેવિ ડિઝિનિઓફિશાળ્ટ પ્રોક્રીપ એન્ડ રેન્ડિંગ, માર્કેટ, સ્ટોર્સ વિભાગ  
એ દુંગે, બીજી પ્રોડક્શન ટ્રાન્સ એક્સપોર્ટ કાર્યક્રમાનું કર્ણ એપ્પ  
લિન્ગાંજ જે માનગિશાળ્ટ એન્ડ માર્કેટાનું માર્કેટ કે વિભાગ માટે  
ઉક્કીંગ તેંડ કૃત્યું એપ્પ માર્કેટાનું માર્કેટ ક્રાંતિક, લિન્ગ કૃત્યું



(૧૯૭-૧૭૮) ગુણસ્થાન પરિચાલક - સ્ટોર્સ એપ્પ

## અપૂર્વકરણ ગુણસ્થાન

અપૂર્વકરણ નામનું આ આઠમું ગુણસ્થાન શ્રેણીના ગુણસ્થાનોમાં  
પ્રથમ ગુણસ્થાન છે.

પ્રશ્ન ૬૯ : શ્રેણી કોણે કહે છે ?

ઉત્તર : ચારિત્રમોહનીય કર્મની (અનંતાનુંબંધી ચતુર્ષય રહિત) ૨૧  
પ્રકૃતિઓના ઉપશમ કે ક્ષયના નિમિત્તથી વૃદ્ધિગત થવાવાળા જીવની  
વિશુદ્ધિને/વીતરાગ પરિણામોને શ્રેણી કહે છે. શ્રેણીના બે લેંડ છે.  
(૧) ઉપશમ શ્રેણી (૨) ક્ષપક શ્રેણી.

પ્રશ્ન ૭૦ : ઉપશમ શ્રેણી તથા ક્ષપક શ્રેણીની પરિલાખા શું છે ?

ઉત્તર : જેમાં ચારિત્રમોહનીય કર્મની ૨૧ પ્રકૃતિઓના ઉપશમની સાથે  
વિશુદ્ધતા/વીતરાગતા ઉત્તરોત્તર વધતી જાય છે, તેને ઉપશમશ્રેણી કહે  
છે. આઠમું, નવમું, દસમું અને અગ્યારમું આ ચાર ગુણસ્થાન  
ઉપશમશ્રેણીના છે.

જેમાં ચારિત્રમોહનીય કર્મની ૨૧ પ્રકૃતિઓના ક્ષયની સાથે વીતરાગતા/  
વિશુદ્ધતા ઉત્તરોત્તર વધતી જાય છે, તેને ક્ષપક શ્રેણી કહે છે. આઠમું,  
નવમું, દસમું અને બારમું આ ચાર ગુણસ્થાન ક્ષપકશ્રેણીના છે.

પ્રશ્ન ૭૧ : ચારિત્રમોહનીય કર્મની ૨૧ પ્રકૃતિઓની ક્ષપણા (ક્ષય)  
કરવાવાળા ક્ષપક મુનિરાજ સૂક્ષ્મસાંપરાય ગુણસ્થાનથી શું ઉપશાંતમોહ  
ગુણસ્થાનને ઓળંગી ક્ષીણમોહી થઈ જાય છે ?

ઉત્તર : ના, અહીં ઓળંગી જવાની વાત નથી. ક્ષપક મુનિરાજ  
ચારિત્રમોહનીય કર્મનો ક્ષય કરતાં થડા ઉત્તરોત્તર વીતરાગતા વધારતાં  
તેને પૂર્ણ કરે છે અર્થાત્ સૂક્ષ્મસાંપરાય ગુણસ્થાનમાં શોષ સૂક્ષ્મ લોલ  
કધાય કર્મનો પણ ક્ષય કરીને સીધા ક્ષીણમોહ નામના બારમાં ગુણસ્થાને  
પહોંચી જાય છે. માટે તેમના માર્ગમાં ઉપશાંતમોહ ગુણસ્થાનના આવવાનો

પ્રશ્ન જ નથી. કષય કરવાવાળાના માર્ગમાં કર્મોના ઉપશમનું સ્થાન કેવી રીતે આવી શકે છે ? બંગેનું સ્વરૂપ એક-બીજાથી લિન્ન છે.

આચાર્યશ્રી નેમિચંદ્રએવે ગોમ્બટસાર જીવકાંડ ગાથા - ૫૦માં અપૂર્વકરણ ગુણસ્થાનની પરિલાખા આ પ્રમાણે આપેલ છે : -

અંતોમુહુર્ત કાલં, ગમિંણ અધાપવત્તકરણં તં ।

પઢિસમયં સુજ્ઞંતો, અપુબ્વકરણં સમીલિલયઙ્ ॥

અધઃપવૃત્તકરણ સંબંધી અંતર્મુહૂર્તકાળ પૂર્ણ કરી પ્રતિ સમય અનંતગુણી શુદ્ધિને પ્રાપ્ત થયેલ પરિણામોને અપૂર્વકરણ ગુણસ્થાન કહે છે. આમાં અનુકૃષ્ટિ રચના થતી નથી.

આ ગુણસ્થાનનું પુરું નામ “અપૂર્વકરણ પ્રવિષ્ટ શુદ્ધિસંયત” છે.

ઉપરિમ સમયવર્તી જીવના પરિણામ અને નિમ્ન સમયવર્તી જીવના પરિણામોમાં સમાનતાનું હોવું, તેને અનુકૃષ્ટિ કહે છે. એવી સમાનતા અપૂર્વકરણ ગુણસ્થાનમાં નથી થઈ શકતી, કારણ કે અપૂર્વકરણ ગુણસ્થાનમાં જીવના પ્રત્યેક સમયના પરિણામ પૂર્વ સમયની અપેક્ષાએ અપૂર્વ - અપૂર્વ જ હોય છે. અર્થાત્ અહીં એક સમયના પરિણામોની સમાનતા બીજા સમયના પરિણામોની સાથે ક્યારેય હોઈ જ નથી શકતી.

ભેદ અપેક્ષા વિચાર : ઉપશમક અપૂર્વકરણ અને ક્ષપક અપૂર્વકરણ - એમ બે ભેદ છે.

**અપૂર્વકરણપ્રવિષ્ટ શુદ્ધિસંયત સંબંધી સ્પષ્ટીકરણ :-**

શબ્દાર્થ - અ = નહીં, પૂર્વ = પહેલા, અપૂર્વ = અત્યંત નવીન, કરણ = પરિણામ, અર્થાત્ પૂર્વમાં ક્યારેય પણ પ્રગટ ન થયા હોય તેવા અનુપમ શુદ્ધ પરિણામો. પ્રવિષ્ટ = પ્રવેશ મેળવવો, શુદ્ધિ = શુદ્ધોપયોગ સંયત = શુદ્ધાત્મ સ્વરૂપમાં સમ્યકૃતયા લીન.

આચિત્રમોહનીય કર્મની ૨૧ પ્રકૃતિઓના ઉપશમ કે ક્ષયમાં નિમિત્ત થવાવાળા, પૂર્વમાં અપ્રાપ્ત, વિશિષ્ટ વૃદ્ધિગત, શુદ્ધોપયોગ પરિણામ ચુક્ત જીવ અપૂર્વકરણ પ્રવિષ્ટ શુદ્ધિસંયત છે.

**સમ્યકૃત્વ અપેક્ષા વિચાર :**

અપૂર્વકરણ ગુણસ્થાનમાં દ્ર્ષ્ટિયોપશમ સમ્યકૃત્વ અને ક્ષાચિક સમ્યકૃત્વ આ બંને સમ્યકૃત્વોમાંથી મુનિરાજને કોઈ એક સમ્યકૃત્વ

હોય છે. દ્રીતીયોપશમ સમ્યકુદ્રષ્ટિ મુનિરાજ તો ઉપશમ શ્રેણી પર જ આડું થાય છે અને ક્ષાયિક સમ્યકુદ્રષ્ટિ મુનિરાજ ઉપશમ અથવા ક્ષપક આ બંને શ્રેણીઓમાંથી કોઈપણ એક શ્રેણી પર આરોહણ કરી શકે છે.

**પ્રશ્ન ૭૨ :** દ્રીતીયોપશમ સમ્યકુદ્રષ્ટિ મુનિરાજ ક્ષપક શ્રેણી નથી ચઢતા તેનું શું કારણ છે ?

**ઉત્તર :** પુરુષાર્થની કર્મજોરીને કારણ જે મુનિરાજેને યથાર્થ શ્રદ્ધામાં બાધક દર્શનમોહનીય કર્મોની સત્તામાંથી સર્વથા નાશ ન કર્યો હોય, તેઓને ચારિત્રમોહનીય કર્મનો નાશ કરવાનો ઉત્ત્ર પુરુષાર્થ કર્યાંથી અને કેવી રીતે થઈ શકે છે ? અર્થાત્ નથી થઈ શકતો.

વાસ્તવિક સ્થિતિ એ છે કે દ્રીતીયોપશમ સમ્યકુદ્રષ્ટિની પાસે હમણાં દર્શનમોહનીયની સત્તા છે, આ કારણે કાંઈક વિશિષ્ટ કાળ વીતી ગયા બાદ તે મુનિરાજ કદાચિત્ નીચેના ગુણસ્થાનોમાં પડીને મિથ્યાદ્રષ્ટિ પણ થઈ શકે છે. પોતાના પુરુષાર્થની ખામીને કારણા, પૂર્વ સંસ્કારવશ તથા સત્તામાં રહેલ કર્મનો ઉદ્ય આવવાથી કિંચિત્ ન્યૂન અર્ધપુરુદ્ગલ પરાવર્તનકાળ સુધી સંસારમાં પરિષ્ઠમણ પણ કરી શકે છે.

જે મુનિરાજની શ્રદ્ધા ભવિષ્યમાં કિંચિત્ માત્ર પણ મલિન થવાની સંલાઘના છે, તે મુનિરાજની વર્તમાનકાળની પર્યાયમાં ચારિત્રમોહનીય કર્મનો ક્ષય કરવાની યોગ્યતા હોતી નથી.

ઉપરના વિવેચનથી આપણાને આ નિર્ણય થઈ જાય છે કે શ્રદ્ધાની કોઈ પણ પ્રકારની અંશમાત્ર પણ ઓછપ અથવા તેને બાધક કર્મની સત્તા પણ ચારિત્રની નિર્મણતામાં અને પૂર્ણતામાં બાધક હોય છે. માટે પ્રથમ શ્રદ્ધાની નિર્મણતા માટે અપ્રતિહત પુરુષાર્થની આવશ્યકતા હોય છે.

શ્રદ્ધાની ક્ષાયિકરૂપ પરિપૂર્ણ નિર્મણ દશા પ્રગટ થયા પછી જ ચારિત્રની પૂર્ણતા કરવાનો પુરુષાર્થ જગૃત થાય છે.

ચારિત્ર અર્થાત્ સર્વોત્કૃષ્ટ ધર્મ, મુક્તિની પ્રાસિના સાક્ષાત કારણરૂપ ધર્મ પ્રગટ કરવા માટે અથવા વિશેષ વિકસીત કરવા માટે અથવા પૂર્ણ કરવા માટે સર્વ પ્રથમ, ધર્મનું મૂળ જે સમ્યકુદર્શન છે, તે ક્ષાયિકરૂપ હોવું જ જોઈએ, એવો સર્વથા નિયમ છે. માટે દ્રીતીયોપશમ સમ્યકુદ્રષ્ટિ મુનિરાજની ક્ષપકશ્રેણી ચઢવાની વર્તમાનકાળમાં યોગ્યતા નથી હોતી.

દર્શનમોહનીય કર્મનો પૂર્ણ નાશ થવા પર જ ચારિત્રમોહનીય કર્મનો નાશ થવાનો ક્રમ છે. સર્વજ્ઞ ભગવંતોએ કેવળજ્ઞાનથી જેને જાણ્યું છે. પરંપરાથી પ્રાપ્ત તે જ જ્ઞાનને દિગંબર મુનિરાજોએ શાસ્ત્રમાં લિપીબદ્ધ કરેલ છે.

**પ્રશ્ન ૭૩ :** મુનિરાજને દ્વિતીયોપશમ સમ્યક્ષૃષ્ટિ થવું જ ન જોઈએ, તેઓ આવું જધન્યકાર્ય શા માટે કરે છે ?

**ઉત્તર :** કર્મનો ઉપશમ કરવો અથવા ક્ષય કરવો એ કામ ન કોઈ મુનિરાજનું છે અને ન કોઈપણ શ્રાવકનું છે, કારણ કે કર્મ જડ છે અને તે આત્માથી અત્યંત ભિન્ન છે.

મુનિરાજ નિજ શુદ્ધાત્મામાં રમણ કરવારૂપ કાર્ય (ચારિત્ર) કરતા રહે છે. તેના નિમિત્તથી કર્મોમાં તેઓની પોતાની સ્વયંની યોગ્યતાનુસાર જે અવસ્થા થવી જોઈએ, તે થતી રહે છે.

મારે ક્ષાચિક સમ્યક્ષૃત્વ કરવું છે, એ દીર્ઘાથી કોઈને પણ ક્ષાચિક સમ્યક્ષૃત્વ પ્રાપ્ત નથી થતું, મુદ્દિત પણ નથી થતી. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું સારું - ખરાબ અથવા બીજા દ્રવ્યમાં કાંઈ હેર - ફેર જ નથી કરી શકતાં, એવો નિઃશંક નિર્ણય કરવો જોઈએ.

**પ્રશ્ન ૭૪ :** કરણાનુયોગના કથન સમયે વરચો-વરચો અદ્યાત્મનો વિષય શું ખીરમાં કાંકર જેવો નથી લાગતો ? તેને છોડીને વાત કરોને ?

**ઉત્તર :** એરે ભાઈ ! તમે આ શું વાત કરી ? કરણાનુયોગમાં અદ્યાત્મ કંકર જેવો નહીં સાકર જેવો છે. જેમ - સાકર વગર ખીર - ખીર જેવી નથી લાગતી, તેમ અદ્યાત્મ વગર કરણાનુયોગની અપેક્ષા સમજમાં નથી આવતી.

એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ પણ કરી શકતું નથી. સર્વ દ્રવ્ય સ્વાધીન તથા સ્વતંત્ર તથા સ્વયં પરિણામનશીલ છે. આ તો સર્વજ્ઞ કથિત વસ્તુ - વ્યવસ્થાનું મૂળ પ્રાપ્ત અર્થાત સર્વસ્વ છે. આ માત્ર અદ્યાત્મનો જ વિષય નથી, ચારે અનુયોગોનો મૂળ આધાર છે. આના વગર જીવનમાં ધર્મ થવાની વાત તો જવા દો, ધર્મ સમજવાની પાત્રતા પણ નથી આવી શકતી.

**પ્રશ્ન ૭૫ :** આપે ઉપર પ્રશ્ન નં ૭૩માં કહ્યું કે - “કર્મોની પોત-પોતાની યોગ્યતાનુસાર ઉપશમાદિક કાર્ય થાય છે.” આનો અર્થ શું છે ?

**ઉત્તર :** પુદ્ગલમય જ્ઞાનાવરણાદિ આઠેય કર્મમાં અચેતનપણું સમાન

હોવા છતાં પરિણમન સ્વલ્પાવને કારણ પ્રત્યેક કર્મની પરિણમન કરવાની પોત-પોતાની સ્વતંત્ર ચોગ્યતા હોય છે.

વિશેષ સ્પષ્ટીકરણ આ પ્રકારે છે :-

૧. ક્ષયોપશમ તો માત્ર જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય અને અંતરાય - આ ચાર ધાતિ કર્મોમાં જ થાય છે. અન્ય ચાર અધાતિ કર્મોમાં નહીં તથા જ્ઞાનાવરણ, દર્શનાવરણ તથા અંતરાય - આ ત્રણોય કર્મોનો ક્ષયોપશમ અનાદિથી નિગોદના જીવોમાં પણ નિયમથી જોવામાં આવે છે.

૨. અંતરકરણરૂપ/પ્રશસ્ત ઉપશમ અનંતાનુબંધીને છોડીને દર્શનમોહનીય તથા ચારિત્રમોહનીય કર્મોમાં જ થાય છે, અન્ય સાતે કર્મોમાં નહીં.

૩. સંદર્ભસ્થારૂપ કે અપ્રશસ્ત ઉપશમ માત્ર ચારે ધાતિકર્મોમાં જ થાય છે, અન્ય ચારે અધાતિ કર્મોમાં નહીં.

૪. વિસંયોજના માત્ર અનંતાનુબંધી કષાયોની થાય છે, અન્ય કોઈ પણ કર્મમાં કે અપ્રત્યાખ્યાનાવરણ આદિ કષાયોની પણ નથી થતી.

૫. સંક્રમણ પણ બધા કર્મોમાં નથી થતું. જેમ કે - આચુકર્મના ચારે ભેદનું પરસ્પરમાં સંક્રમણ નથી થતું. દર્શનમોહનીય અને ચારિત્ર મોહનીયમાં પણ પરસ્પર સંક્રમણ નથી થતું. મૂળ કર્મોમાં સંક્રમણ નથી થતું.

સજીતીય પ્રકૃતિનું ઉત્તર ભેદોમાં સંક્રમણ થાય છે. જેમ કે - સાતાનું અસાતાવેદનીયમાં, મિથ્યાત્પનું મિશ્રમાં અને મિશ્રનું સમ્યકૃત્પ પ્રકૃતિમાં, અનંતાનુબંધી ચારે કષાયોનું ૧૨ કષાય અને ૯ નોકષાયોમાં, અપ્રત્યાખ્યાનાવરણ તથા પ્રત્યાખ્યાનાવરણ કષાયોનું અન્ય કષાય - નોકષાયમાં આદિ.

૬. આચુકર્મને છોડી જ્ઞાનાવરણાદિ સાતે કર્મોનો નિરંતર બંધ થાય છે. કદાચિત્ કોઈને એક અંતર્મુહૂર્ત કાળ સુધી આઠેય કર્મોનો પણ બંધ થાય છે.

૭. દર્શનમોહનીય કર્મના ત્રણ ભેદોમાંથી માત્ર મિથ્યાત્પ કર્મનો જ બંધ થાય છે. મિશ્ર અને સમ્યકૃત્પપ્રકૃતિ - આ બંનેની સત્તા હોય છે અને તેનો ઉદ્ય પણ હોય છે, પરંતુ નિયમથી બંધ નથી થતો.

૮. મિથ્યાત્પ કર્મનો ક્ષય સ્વમુખથી નથી થતો. મિથ્યાત્પ કર્મ મિશ્રરૂપ પરિણમિત થાય છે. મિશ્રદર્શનમોહનીય કર્મ સમ્યકૃપ્રકૃતિરૂપથી પરિણમિત થાય છે. ત્યારબાદ સમ્યકૃપ્રકૃતિ કર્મ ઉદ્યમાં આવીને

સ્વમુખથી નષ્ટ થાય છે. આવી રીતે કમથી મિદ્યાત્પનો નાશ થાય છે.  
 ૬. અનંતાનુબંધી કષાય કર્મનો પણ સ્વમુખથી ક્ષય નથી થતો, તેનો વિસંયોજના ઝારા જ અલાવ થાય છે. વાસ્તવમાં વિચાર કરીએ તો વિસંયોજના નો અર્થ સર્વ સંકમણ જ છે. છતાંચ વિસંયોજિત અનંતાનુબંધી કષાય ચોકડી કદાચિત્ ફરીથી સંયોજિત પણ થઈ શકે છે, માટે તેને વિસંયોજન કહું છે. અન્ય ચારિત્રમોહનીય પ્રકૃતિઓમાં વિસંયોજના નથી થતી.

૧૦. આચુકર્મનો બંધ નિરંતર નથી થતો. ભુજયમાન આચુકર્મ (સ્થિતિબંધ)ના બે લાગ વ્યતીત થઈ ગયા બાદ ત્રીજા લાગના પ્રથમ અંતર્મુહૂર્તમાં (આચુકર્મ ૫૦ વર્ષની હોય તો ૪૦ વર્ષ વ્યતીત થવા પર) પ્રથમ અપકર્ષકાળ થાય છે. તેમાં નવી આચુકર્મનો બંધ ન થાય તો શેષ આચુકાળ બીજો અપકર્ષકાળ થાય છે, તેમાં આચુકર્મનો બંધ થઈ શકે છે. જો તેમાં પણ ન થાય તો આ પ્રકારે કમથી આઠ ત્રિભાગમાંથી કોઈ ને કોઈ એક અપકર્ષકાળમાં આચુકર્મનો બંધ થઈ શકે છે. જો આઠેચ અપકર્ષકાળમાં આચુકર્મનો બંધ ન થાય તો મરણના અંતર્મુહૂર્ત પૂર્વે આચુકર્મનો બંધ અવશ્ય થાય જ છે. આ વ્યવસ્થા કર્મભૂમિના મનુષ્ય અને તિર્યંચ જીવોની છે.

દેવ અને નારકીઓમાં આચુકાળ અંતિમ છ માસમાં આઠ અપકર્ષકાળનો નિયમ છે. અથવા જેને પ્રથમ અપકર્ષમાં કે દ્વિતીયાં અપકર્ષકાળમાં આચુકર્મનો બંધ થાય તો શેષ અપકર્ષકાળોમાં તે જ-તેનો બંધ થઈ શકશે, થાય જ છે, એવો નિયમ નથી.

ભોગભૂમિના જીવોનો આચુકાળ અંતિમ નવ માસ શેષ રહે, ત્યારે આઠ અપકર્ષોમાં આચુકાળ બંધનો નિયમ છે. (સમ્યક્ષજાનચંદ્રિકા ભા-૨, પૂલાર્ઘ પૃ. ૧૬)

૧૧. જીવના પ્રતિસમયમાં થવાવાળા પરિણામોને નિમિત્ત કરી કર્મોમાં પોત-પોતાની ચોગ્યતાથી -૧) પ્રકૃતિબંધ લિન્ન - લિન્ન જ થાય છે. ૨) પ્રદેશબંધ પ્રત્યેક કર્મનો અલગ - અલગ થાય છે. ૩) સ્થિતિબંધ પણ નિયમથી લિન્ન - લિન્ન જ થાય છે. ૪) અનુભાગબંધ પણ અલગ - અલગ જ થાય છે.

**ચારિત્ર અપેક્ષા વિચાર:**

અપૂર્વકરણ ગુણસ્થાનમાં ઉપશમકને ઔપશમિક ચારિત્ર અને ક્ષપકને

ક્ષાયિક ચારિત્ર હોય છે. તે આ પ્રકારે છે - જોકે અપૂર્વકરણ ગુણસ્થાનવતી મુનિરાજે કોઈ પણ ચારિત્રમોહનીય કર્મનો ઉપશમ કે ક્ષય નથી કર્યો, છતાં ઉપશમન શક્તિથી સમજિત અપૂર્વકરણ શ્રમણાના ઔપશમિક ચારિત્રભાવના અસ્તિત્વને માનવામાં કોઈ વિરોધ નથી (વિશેખ સ્પષ્ટીકરણ માટે જુઓ-ઘઘલા પુસ્તક પ, પાના નં. ૨૦૫, ગોમટસાર જીવકાંડ ગાથા ૧૪, ગોમટસાર કર્મકાંડ ગાથા -૨૦ની ટીકા તથા ભાવદીપિકા પાના નં. ૨૨૫-૨૩૪)

પ્રશ્ન ૭૫ : ઉપશમ તથા ક્ષપકશ્રેણીના આરોહક(ચઢવાવાળા)ને ઔપશમિક અને ક્ષાયિકચારિત્ર કેમ કહ્યો ? આમ જોઈએ તો આ કાર્ય તો ઉપશાંતમોહ અને ક્ષીણમોહ ગુણસ્થાનમાં થાય છે.

ઉત્તર : આપનું કહેવું સત્ય છે. ઉપશાંતમોહ ગુણસ્થાનમાં પૂર્ણ ઔપશમિક ચારિત્ર હોય છે અને ક્ષીણમોહ ગુણસ્થાનમાં પૂર્ણ ક્ષાયિક ચારિત્ર હોય છે, કારણ કે ત્યાં જ ચારિત્રમોહનીય કર્મનો પૂર્ણ ઉપશમ કે ક્ષય થાય છે. અહીં જે હમણા કહ્યું, એ કથન પરમ સત્ય હોવા છતાં પણ આઠમા ગુણસ્થાનનાં પ્રથમ સમયમાં ઔપશમિક ચારિત્ર અને ક્ષાયિક ચારિત્ર આગમમાં ઉપચારથી કહ્યું છે. આ ઉપચાર કથનનું કારણ પણ આ પ્રકારે છે -

જે મહામુનિશ્વર ઉપશમ અપૂર્વકરણ ગુણસ્થાનના પ્રથમ સમયમાં પ્રવેશી ચુક્યા છે, તે નિયમથી (જે આઠમાંથી અભ્યારમાં ગુણસ્થાન સુધી વચ્ચે મૃત્યુ ન થાય તો) ક્રમપૂર્વક ત્રણ જ અંતર્મૂહૂર્તરૂપ ગુણસ્થાનોમાં ઉત્તરોત્તર શુદ્ધિની વૃદ્ધિ કરતા થકા ઉપશાંતમોહી થઈ જાય છે. માટે અપૂર્વકરણના પ્રથમ સમયમાં જ ઔપશમિક ચારિત્ર છે, એવું આગમમાં કહ્યું છે.

ક્ષપક અપૂર્વકરણ ગુણસ્થાનવતી મહામુનિશ્વરની પાસે તો તે ઉપશમકથી પણ અધિક પુરુષાર્થ છે, કારણ કે ક્ષપકને તો મૃત્યુ થવાનો પણ અપવાદ નથી. ક્ષપક અપૂર્વકરણ ગુણસ્થાનવતી મહામુનિરાજ આઠમાંના પ્રથમ સમયથી તે માત્ર યથાચોગ્ય ત્રણ અંતર્મૂહૂર્ત પછી નિશ્ચિત જ ક્ષાયિક ચારિત્રવંત થઈ જાય છે.

આ કારણે અપૂર્વકરણ ગુણસ્થાનના પ્રથમ સમયથી જ ક્ષાયિક ચારિત્ર ઉપચારથી કહેવામાં કાંઈ પણ આપત્તિ નથી.

વાસ્તવિક રીતે વિચારીએ તો જેમ છઢા-સાતમા ગુણસ્થાનમાં ક્ષાયોપશમિક ચારિત્ર ઘટિત થાય છે, તેમ જ દસમા સૂક્ષ્મસાંપરાય ગુણસ્થાનના અંતિમ

સમય સુધી પણ ક્ષાયોપશમિક ચારિત્ર જ ઘટિત થાય છે.

**કાળ અપેક્ષા વિચાર :**

**જઘન્યકાળ :** જો કોઈ મુનિશ્વર ઉપશમક અપૂર્વકરણ ગુણસ્થાનમાં ઓછામાં ઓછો કાળ રહેશે તો માત્ર એક જ સમય રહી શકે છે.

**જેમ કે :-** કોઈ મહામુનિરાજ ઉપશાંતમોહ ગુણસ્થાનથી ઉત્તરતા સમયે નીચે અપૂર્વકરણ ગુણસ્થાનમાં માત્ર એક સમય જ રહી શકે અને તે મહામુનિરાજના મનુષ્યાચુનો ક્ષય થઈ જાય, તો મરણની અપેક્ષા અપૂર્વકરણ ગુણસ્થાનનો જઘન્યકાળ એક સમય ઘટિત થાય છે.

**પ્રશ્ન ૭૭ :** આપે આ કથન ક્ષપક અપૂર્વકરણ ગુણસ્થાનવર્તી મુનિરાજ ઉપર શા માટે ઘટિત ન કર્યું?

**ઉત્તર :** ભાઈ! ક્ષપક શ્રેણી પર આરૂપ મુનિરાજનું મૃત્યુ થતું જ નથી, આ એક અફર નિયમ છે, કારણ કે તેઓ અપ્રતિહિત પુરુષાર્થના બળથી કર્મોનો ઉત્તરોત્તર ક્ષય કરતા થકા ક્ષપકશ્રેણી પર આરોહણ કરી રહ્યા છે અને શીધ પૂર્ણ વીતરાગતાને પ્રાપ્ત કરશે. તેથી ક્ષપક મુનિરાજ માટે મરણની અપેક્ષા જઘન્ય એક સમય ઘટિત થતો નથી, માટે નથી ઘટાવ્યો.

**પ્રશ્ન ૭૮ :** આઠમા ઉપશમક અપૂર્વકરણમાં આવવાવાળા સાતિશય અપ્રમત્તસંચયત ગુણસ્થાનવર્તી મુનિરાજને શા માટે ન લીધા?

**ઉત્તર :** ઉપશમશ્રેણી ચઢવાવાળા મુનિરાજ આઠમા ગુણસ્થાનના પ્રથમ ભાગમાં મૃત્યુ પામતા નથી - એવું આગમમાં કથન છે. તેથી આઠમા ઉપશમક અપૂર્વકરણવાળા મુનિરાજને નથી લીધા.

**પ્રશ્ન ૭૯ :** આ આઠમા ઉપશમક અપૂર્વકરણમાં ન મરવારૂપ નિયમની શું આવશ્યકતા છે?

**ઉત્તર :** કરણાનુયોગ શાસ્ત્રના પ્રત્યેક કથનનું કારણ/હેતુ ન આપી શકાય, કારણ કે કરણાનુયોગ શાસ્ત્ર અહેતુવાદ આગમ છે, માટે જેમ છે તેમ સર્વજ્ઞ ભગવંતોએ કહ્યું છે, આપ પણ તેને આજાનુસાર માની લો.

શ્રેણી ચઢવાના તીવ્ર પુરુષાર્થરૂપ પરિણામમાં મરણ નથી થતું. આ કારણ પણ કહી શકીએ છીએ.

**ઉત્કૃષ્ટકાળ :** ચથાયોગ્ય એક જ અંતર્મુહૂર્ત છે. જો ઉપશમક અપૂર્વકરણ ગુણસ્થાનવર્તી મુનિરાજ વધારેમાં વધારે કાળ આ ગુણસ્થાનમાં રહેશે તો

માત્ર એક અંતર્મુહૂર્ત જ રહેશે.

ક્ષપક અપૂર્વકરણ ગુણસ્થાનનો કાળ પણ યથાયોગ્ય અંતર્મુહૂર્ત જ છે. તેનો જધન્ય - ઉત્કૃષ્ટ કાળ એવો લેદ જ નથી.

**મધ્યમકાળ :** ઉપશમક અપૂર્વકરણ ગુણસ્થાનનો મરણની અપેક્ષાથી બે, ત્રણ, ચાર આદિ સમયોથી લઇને યથાયોગ્ય અંતર્મુહૂર્ત કાળ સુધી વરચેના કાળના સર્વલેદ મધ્યમકાળના થઈ શકે છે.

**ગમનાગમન અપેક્ષા વિચાર :**

**ગમન :** ૧) ઉપશમક કે ક્ષપક અપૂર્વકરણ ગુણસ્થાનવર્તી મુનિરાજ ઉપરની તરફ નિયમથી અનિવૃત્તિકરણ ગુણસ્થાનમાં ગમન કરે છે.

૨) ઉપશમક અપૂર્વકરણ ગુણસ્થાનવર્તી મુનિરાજ શ્રેણીથી ઉત્તરતા સમયે નિયમથી અપ્રમત્તસંયત ગુણસ્થાનમાં ગમન કરે છે.

૩) જો આઠમા ગુણસ્થાનવર્તી મુનિરાજનું આઠમા ગુણસ્થાનમાં મૃત્યુ થઈ જાય તો તત્કાળ જ વિશ્વહગતિના પહેલા સમયમાં જ તે ચોથા અવિરતસમ્યકૃત્વ ગુણસ્થાનમાં જ ગમન કરે છે.

ચઢતા સમયે ઉપશમક અપૂર્વકરણના પ્રથમ ભાગમાં મરણ ન થવાનો નિયમ છે. અન્ય ભાગમાં ચડતાં સમયે પણ મરણ થઈ શકે છે. ઉત્તરતા સમયે ઉપશમક અનિવૃત્તિકરણથી નીચે અપૂર્વકરણ ગુણસ્થાનમાં કોઈ પણ સમય મરણ થઈ શકે છે.

**આગમન :** ૧) ઉપશમક અપૂર્વકરણ ગુણસ્થાનમાં આગમન નીચલા સાતમા અપ્રમત્તસંયત ગુણસ્થાનથી જ થાય છે.

૨) ઉપશમશ્રેણીથી ઉત્તરતા સમયે ઉપરના ઉપશમક અનિવૃત્તિકરણ ગુણસ્થાનથી પણ આઠમા ગુણસ્થાનમાં આગમન થાય છે.

૩) ક્ષપક અપૂર્વકરણ ગુણસ્થાનમાં આગમન માત્ર અપ્રમત્તસંયત ગુણસ્થાનથી થાય છે. ઉપરના કોઈ પણ ગુણસ્થાનથી નહીં, કારણ કે ક્ષપક નીચે ઉત્તરતા જ નથી, તે તો નિયમથી અરહંત બનીને સિદ્ધ થઈ જ જાય છે.

**વિશેષ અપેક્ષા વિચાર :**

૧) સાતિશય અપ્રમત્તવિરત ગુણસ્થાનમાં અધઃપ્રવૃત્તકરણના નિમિત્તથી જે ચાર આવશ્યક બતાવ્યા છે, તે સર્વ આવશ્યક આ અપૂર્વકરણ ગુણસ્થાનમાં પણ નિરંતર થતાં જ રહે છે. તેને આ


આઠમા ગુણસ્થાનના સંબંધમાં ફરીવાર જોવાનો કષ્ટ કરવો.

૨) પૂર્વબદ્ધકર્મોનો અસંખ્યાતગણો સ્થિતિકાંડક ઘાત થાય છે. સાતિશય અપ્રમત્ત ગુણસ્થાનમાં અધઃપ્રવૃત્તકરણના નિમિત્તથી નવા બંધાવાવાળા કર્મોનો ઉત્તરોત્તર અલ્પ સ્થિતિબંધ થાય છે. આ કાર્યને સ્થિતિબંધાપસરણ કહે છે. અપૂર્વકરણને કારણ પૂર્વબદ્ધ કર્મોનો સ્થિતિકાંડક ઘાત થાય છે.

અહીં રહસ્યની વાત એ છે કે કોઈપણ કર્મની સ્થિતિ (પુણ્ય હો કે પાપ) ઓછી થવી તે સાધકને માટે સારું જ છે, કારણ કે વધારે સ્થિતિબંધનો અર્થ સંસારમાં વધારે સમય સુધી રહીને જન્મ-મરણની ચક્કીમાં પીસાતા રહેવું એમ છે. અલ્પ સ્થિતિબંધમાં તો જીવનો મંદકષાયરૂપ ભાવ કારણ છે, પરંતુ સ્થિતિકાંડક ઘાતમાં તો વૃદ્ધિગત વીતરાગ પરિણામની સાથે રહેવાવાળા મંદકષાયરૂપ વિશુદ્ધભાવ નિમિત્ત કારણ છે. સાતમા ગુણસ્થાનથી આઠમા ગુણસ્થાનમાં વીતરાગતા વધી ગઈ છે.

સ્થિતિબંધાપસરણનો ભાવ એ છે કે જેમ સામે, લડવા માટે આવેલા શત્રુઓને પોતાની સામર્થ્યથી બળહીન કરતા રહેવા સમાન છે અને સ્થિતિકાંડક ઘાતનો ભાવ એ છે કે જેમ સુતેલા અથવા લડવાના લક્ષ્યથી વિસ્મૃત થયેલ બળવાન શત્રુઓને સાવધાન કરી અથવા શત્રુતાનું સ્મરણ કરાવી તેની સાથે પોતાના વિશેષ સામર્થ્યથી લડતા થકા તે શત્રુઓને શીધાતીશીધ તેમની શક્તિ ક્ષીણ કરતા થકા જીતી લેવા સમાન છે.

સ્થિતિકાંડક ઘાત સમજવા માટે નકશાની મદદ લઇએ. રેખા પૂર્વબદ્ધ કર્મના સ્થાન પર છે. તેના ઉપરના ભાગની બાજુમાં એક ચૌક બતાવ્યો છે, જે બહુ જ વર્ષો પછી ઉદ્યમમાં આવવાવાળા સત્તામાં પડેલ કર્મોનો પુંજ છે. તે કર્મપૂંજથી નીચેની તરફ જતું બાળ બનાવેલ છે. એનો અર્થ ઘણા વર્ષો પછી ઉદ્યમમાં આવવા યોગ્ય કર્મોને વિશુદ્ધ પરિણામોના નિમિત્ત થવાથી ઓછા વર્ષોમાં ઉદ્યમમાં આવવા યોગ્ય વિશિષ્ટ પ્રમાણથી અર્થાત્ ઉપરિતન વિભાગમાં સ્થિત



કર્મોની સ્થિતિ ઘટીને અધઃસ્તનના વિભાગમાં મળી ગયા, આને જ સ્થિતિ કાંડકઘાત કરે છે.

૩) પૂર્વબદ્ધ અશુલ કર્મોનો અસંખ્યાતગણી અનુભાગ કાંડકઘાત થાય છે. વૃદ્ધિગત વીતરાગતા અને મંદકષાયરૂપ પરિણામોને કારણે ઉપર સ્થિતિકાંડક ઘાત સમજાવેલ છે. નકશાથી પણ સમજાવવાનો પ્રયાસ કરેલ છે. જે પાપકર્મનો જેટલો સ્થિતિકાંડકઘાત થાય છે, તે સંખ્યામાં તે પાપકર્મનો અનુભાગ નિયમથી ઓછો થાય છે, એવો કર્મશાસ્ત્રનો નિયમ છે.

પહેલા સમયમાં ઉદ્યમાં આવવાવાળા પાપકર્મોમાં જેટલો અનુભાગ છે, તેના આગળ-આગળના સમયમાં ઉદ્યમાં આવવાવાળા તે કર્મોનો અસંખ્યાતગણા અનુભાગ ઘટીને ફલદાન શક્તિની હીનતા થવી, અસંખ્યાતગણો અનુભાગકાંડકઘાત છે.

અધિક અનુભાગવાળા કર્મ પરમાણુઓનું નીચે ઓછા અનુભાગવાળા કર્મપરમાણુરૂપ વિશિષ્ટ પ્રમાણથી શક્તિહીન થવું જ અનુભાગકાંડક ઘાત છે.


અનુભાગ વધારે અને કર્મ-પરમાણુ ઓછા તથા અનુભાગ ઓછા તથા કર્મ પરમાણુ વધારે, એવું જ અનુભાગબંધ અને પ્રદેશબંધનું સ્વરૂપ છે.

૪) અપૂર્વકરણ પરિણામોના નિમિત્તથી પૂર્વબદ્ધ કર્મોની ગુણ શ્રેણી નિર્જરાનો પ્રારંભ થયો છે.

પહેલા સમયમાં જેટલા કર્મોની નિર્જરા થાય છે, બીજા સમયમાં તેનાથી અસંખ્યાતગણી વધારે કર્મોની નિર્જરા થાય છે, તેને અસંખ્યાતગણી નિર્જરા કરે છે.

પહેલા તો પૂર્વબદ્ધ સત્તાના કર્મોમાં જીવના પરિણામોના નિમિત્તથી સ્વયમેવ કર્મોની ગુણશ્રેણીની રચના થાય છે. ત્યારબાદ ફરી ગુણશ્રેણી નિર્જરાનો પ્રારંભ થાય છે. નકશાથી આ વિષયને સ્પષ્ટ કરીએ છીએ. નકશામાં ૧ થી લઈને ૭ સુધીની સંખ્યાં ક્રમથી બતાવવામાં આવી છે.

એક ક્રમાંકની જે પહેલી આડી લીટી છે, તેનાથી બીજા નંબરવાળી



- ← 7 લીટી પહોળાઈમાં વધારે છે. અર્થાત्
- ← 6 પહેલા સમયમાં જેટલા કર્મોની નિર્જરા
- ← 5 થાય છે, તેનાથી અસંખ્યાતગણી વધારે
- ← 4 કર્મોની નિર્જરા દ્વિતીય સમયમાં થાય
- ← 3 છે. દ્વિતીય સમયમાં જેટલા કર્મ નિર્જરીત
- ← 2 થઈ ખરી જાય છે, તૃતીય સમયમાં
- ← 1 થઈ ખરી જાય છે, તૃતીય સમયમાં

તેનાથી અસંખ્યાતગણા વધારે કર્મ ખરતા રહે છે.

એવો જ કમ હવે ભવિષ્યમાં અંડકપથી બારમાં ગુણસ્થાનના અંતિમ સમય સુધી ચાલતો જ રહેશે. આને જ ગુણશ્રેણી નિર્જરા કરે છે.

ગુણશ્રેણીની રચના થવી અને ગુણશ્રેણીનું નિર્જરા થતી રહેવી આ કમ જીવના વૃદ્ધિગત શુદ્ધ પરિણામોથી સ્વયમેવ થતા જ રહે છે.

આમાં પોતાના સહજ સ્વભાવના આશ્રયથી નિરંતર શુદ્ધિની વૃદ્ધિ કરતા રહેલું, એ તો જીવનું કાર્ય છે અને કર્મોની નિર્જરા થવી તે પુદ્ગલમાં થવાવાળું કાર્ય છે. કર્મોની નિર્જરાનો ઉપાદાન કર્તા પુદ્ગલ ક્રિય છે, જીવ નહીં.

પ્રશ્ન ૮૦ : શ્રેણી પર આરૂપ મુનિરાજના વીતરાગ પરિણામોમાં પ્રતિસમય જ્યારે અનંતગણી વૃદ્ધિ થઈ રહી છે, ત્યારે કર્મોની નિર્જરા પણ અસંખ્યાતગણી ની જગ્યાએ અનંતગણી કેમ નથી થતી ?

ઉત્તર : શ્રેણી પર આરૂપ મુનિરાજના પરિણામોમાં વિશુદ્ધિ અનંતગણી જોવામાં આવે છે, તે અવિભાગી પ્રતિચ્છેદોની અપેક્ષાથી છે અને કર્મોની નિર્જરા સમયપ્રબદ્ધ પ્રમાણથી થાય છે.

એક સંસારી જીવના વધારેમાં વધારે અસંખ્યાતાસંખ્યાત સમયપ્રબદ્ધ પ્રમાણ જ કર્મનું સત્ત્વ જોવામાં આવે છે તો નિર્જરા અનંતગણી કેમ થાય ? એક સમયમાં ઉત્કૃષ્ટથી અસંખ્યાત સમયપ્રબદ્ધની જ નિર્જરા થાય છે, તેનાથી વધારે નહીં. તેથી નિર્જરાનું પ્રમાણ અસંખ્યાતગણું જ હોય છે માટે અનંતગણી નિર્જરા થતી નથી.

જો કર્મોની નિર્જરા અનંતગણી થશે તો અલ્પકાળમાં જ મુનિરાજના આઠેય કર્મોનો ક્ષય થઈ જશે અને મુક્તિ પણ થઈ જશે. તેનો અર્થ સાતિશય અપ્રમંતુગુણસ્થાનના કાંઈક સમયોમાં જ આઠ કર્મ ખરી જશે. જો અલ્પકાળમાં જ મુનિરાજ સિદ્ધ ભગવાન થઈ જશે તો ગુણસ્થાન માત્ર સાત જ રહેશે. તેમાં ગુણસ્થાનમાં અરહંત અવસ્થામાં થવાવાળા વિહાર, દિવ્યદ્વારનિથી થવાવાળા ઉપદેશ આદિને માટે અવકાશ જ નહીં રહે, સર્વજ્ઞ કથિત વ્યવસ્થા જ બગડી જશે.

આનાથી બે ક્રિયોના પરિણામની સ્વતંત્રતા સ્વયમેવ સ્પષ્ટ થઈ જ જાય છે. જીવક્રિયમાં પ્રતિસમય ઉત્તોતર અનંતગણી વિશુદ્ધતાની વૃદ્ધિ થઈ રહી છે. તે પોતાની સ્વતંત્ર યોગ્યતા (ઉપાદાન)થી અને તે જ સમયે વિશુદ્ધતાનું નિમિત પામી સત્તામાં પડેલા કર્મ પરિણાત

કાર્મણવર્ગણારૂપ પુદ્ગલસ્કર્ણધોની અસંખ્યાતગણી નિર્જરારૂપ કાર્ય સ્વયમેવ થઈ રહ્યું છે, તે પણ પુદ્ગલની પોતાની સ્વતંત્ર ચોગ્યતા થી.

કોઈનું પરિણમન કોઈના આધીન નથી. જીવાદિ સર્વ અનંતાનંત રૂપ્યોનું પરિણમન પોત-પોતાનામાં પૂર્ણ સ્વતંત્ર અને સ્વાધીન છે.

૫) ગુણસંક્રમણ અર્થાત્ અનેક અશુલ પ્રકૃતિઓ શુલ પ્રકૃતિઓમાં બદલાઈ જાય છે.

પ્રશ્ન ૮૧ : સંક્રમણ કોણે કહે છે ?

ઉત્તર : વિવક્ષિત કર્મ પ્રકૃતિઓના પરમાણુઓને સજીતીય અન્ય પ્રકૃતિરૂપ પરિણમન થવાને સંક્રમણ કહે છે.

જેમ કે - જીવના વિશુદ્ધ પરિણામોના નિમિત્તથી પૂર્વબદ્ધ અસાતાવેદનીય પ્રકૃતિના પરમાણુઓનું સાતાવેદનીયના રૂપમાં પરિણમયું.

આમાં પણ એટલી વિશેષતા છે કે ૧) મૂળ પ્રકૃતિઓમાં પરસ્પર સંક્રમણ નથી થતું ૨) ચારે આચુ કર્મોમાં આપસમાં સંક્રમણ નથી થતું ૩) મોહનીય કર્મના ઉત્તરભેદ, દર્શનમોહનીયનું ચારિત્રમોહનીય કર્મમાં સંક્રમણ થતું નથી. ૪) દર્શનમોહનીયના ભેદોમાં તથા ચારિત્રમોહનીય કર્મના ભેદોમાં પરસ્પર સંક્રમણ થાય છે.

આ પ્રક્રણમાં રહસ્યપૂર્ણ વાત એ છે કે જીવના મોહ-રાગ-ક્લેષ ભાવોના નિમિત્તથી પૂર્વબદ્ધ કર્મ બદલ્યા વગર જેમ છે તેમ જ સત્તામાં પડ્યા રહે અને તે જ રૂપથી ઉદ્યમાં આવી જીવને ફળ આપે, એવો નિયમ નથી.

જીવના પરિણામાનુસાર સત્તાના કર્મોમાં પરિવર્તન સ્વયમેવ થતું જ રહે છે, કારણ કે જીવના પરિણામ સતત બદલાતા રહે છે. તેથી પૂર્વબદ્ધ પાપકર્મની ચિંતાથી જિન્ન/આકુળ-વ્યાકુળ થવાની જરાય પણ આવશ્યકતા નથી.

જેમ - કોઈ ઘનવાન મનુષ્યને રૂપ વર્ષ પૂર્વે અત્યંત ઉત્સાહ અને ધર્મભાવનાથી લાખો રૂપિયા જિનિબિંબ પ્રતિષ્ઠા, ગ્રંથ પ્રકાશનાદિ વ્યવહાર ધર્મ કાર્યોમાં ખર્ચ કરેલા હતાં. તેના તે પુણ્ય પરિણામ અનુસાર વિશેષ પુણ્યકર્મનો બંધ પણ તે જ સમયે સ્વયમેવ થયો હતો.

વર્તમાનકાળમાં તે ઘનવાન મનુષ્યના પૂર્વકાળમાં બાંધેલા કોઈ પાપકર્મના ઉદ્યથી દરિદ્રતા આવી ગઈ છે. હવે તે વિચારે છે કે જોહું રૂપ વર્ષ પૂર્વે લાખો રૂ. ધર્મકાર્યોમાં ખર્ચ ન કરત તો સારું હતું, આજે હું ગરીબ ન હોત.

વર્તમાનકાળમાં આ વિપરીત ચિંતન અર્થાત્ અશુલભાવથી પૂર્વબદ્ધ

પુણ્યકર્મ પ્રથમ તો તત્કાળ ક્ષીણા/હીન થઈ જાય છે. પછી જે અશુલ વિચારોની પ્રબળતા રહેશે તો પુણ્યકર્મ સંકભિત થઈને પાપકર્મરૂપ થઈ જાય છે, આને સંક્રમણ કરે છે. આ પ્રકારે પાપનું સંક્રમણ પુણ્યમાં પણ થઈ જાય છે.

**૫) બિજન-બિજન સમયવર્તી જીવોના પરિણામ અસમાન જ હોય છે.**

**જેમ :-** અધઃપ્રવૃત્તકરણમાં બિજન-બિજન સમયવર્તી જીવોના પરિણામો સરખા પણ હોઈ શકે છે, પરંતુ આ અપૂર્વકરણ ગુણસ્થાનમાં પરિણામ સરખા નથી હોતા. અપૂર્વકરણ ગુણસ્થાનવર્તી જીવોના બિજન-બિજન સમયવર્તી પરિણામ ઉત્તરોત્તર બિજન-બિજન જ હોય છે અને સમાન સમયવર્તી જીવોના પરિણામ સમાન પણ હોય છે અને અસમાન પણ હોય છે.

**ઘવલા પુસ્તક - ૧નો અંશ (પાના નં. ૧૮૦ થી ૧૮૪)**

અપૂર્વકરણ પ્રવિષ્ટ શુદ્ધિ સંચતોમાં સામાન્યથી ઉપશમક અને ક્ષપક આ બંગે પ્રકારના જીવ છે ॥૧૫ ॥

કરણ શબ્દનો અર્થ પરિણામ છે અને જે પૂર્વ અર્થાત્ પહેલા નથી થયું તેને અપૂર્વ કરે છે. આનું તાત્પર્ય એ છે કે નાના પ્રકારના જીવોની અપેક્ષા આદિથી લઈને પ્રત્યેક સમયમાં ક્રમથી વધતા થકા અસંખ્યાત-લોક-પ્રમાણ પરિણામવાળા આ ગુણસ્થાનને અંતર્ગત વિવક્ષિત સમયવર્તી જીવોને છોડીને અન્ય સમયવર્તી જીવો દ્વારા અપ્રાપ્ય પરિણામ અપૂર્વ કરેવાચ છે.

અર્થાત્ વિવક્ષિત સમયવર્તી જીવોના પરિણામોથી બિજન સમયવર્તી જીવોના પરિણામ અસમાન અર્થાત્ વિલક્ષણ હોય છે. આવી રીતે પ્રત્યેક સમયમાં થંબવાળા અપૂર્વ પરિણામોને અપૂર્વકરણ કરે છે.

આમાં આપવામાં આવેલ અપૂર્વ વિશેષણાથી અધઃપ્રવૃત્ત પરિણામોનું નિરાકરણ કરવામાં આવ્યું છે, એવું સમજવું જોઈએ, કારણ કે જ્યાં ઉપરિતન સમયવર્તી જીવોના પરિણામ અધસ્તન સમયવર્તી જીવોના પરિણામની સાથે સદશ પણ થાય છે અને વિસદ્ધ પણ થાય છે, એવા અધઃપ્રવૃત્તમાં થંબવાળા પરિણામોમાં અપૂર્વતા નથી જોવામાં આવતી.

**શંકા 24 : ક્ષપણનિમિત્તક પરિણામ બિજન છે અને ઉપશમનનિમિત્તક પરિણામ બિજન છે. તેમાં એકત્વ કેવી રીતે થઈ શકે ?**

**સમાધાન :** ના, કારણ કે ક્ષપક અને ઉપશમક પરિણામોમાં અપૂર્વપણાની અપેક્ષાએ સરખાપણું / સામ્ય હોવાને લીધે એકત્વ થઈ જાય છે.

**શંકા 25 : પાંચ પ્રકારના ભાવોમાંથી આ ગુણસ્થાનમાં ક્યો ભાવ જોવામાં આવે છે?**

**સમાધાન :** ક્ષપકનો ક્ષાયિકભાવ અને ઉપશમકનો ઔપશમિકભાવ જોવામાં આવે છે.

યજું રૂ રીતે હું કરું ઉંચ અઠીએ ગારું નિ મહિ મેલાયું  
ઉંચ મદ્દેરામ નિંબાં રાવિંદ મેલાયું નિ શ્રીંડ રાગાય નિંદાયિ  
ઓપ મેલાયું અન્દાં હુંપામ કોણમ માં. હું કર છુંદાં નિંદ, હું કર

હું અઠી જ અન્દાં માલાયીપ નારીલ નોંધાય માલાયી-નોંધાય (૨)  
માલાયીપ નારીલ નોંધાય માલાયી-નોંધાય માલાયીનોંધાયાં -- : ૧૬  
મન્જસ માલાયીપ નારીલાય હું (૧) નિ હુંપ, હું કંઈ હુંપ મન્જસ  
નોંધાય માલાયી-નોંધાય નારીલ નોંધાય નોંધાય હુંપાય નિંદ નિંદ  
નારીલ નોંધાય અનિવૃત્તિકરણ ગુણસ્થાન

અનિવૃત્તિકરણ નામનું આ નવમું ગુણસ્થાન છે. શ્રેણીના ગુણસ્થાનોમાં  
આનો બીજો નંબર છે.

સિદ્ધ ભગવાન અનંત છે. ગુણોની અપેક્ષાએ એક સિદ્ધ ભગવાન  
બીજા કોઈપણ સિદ્ધ ભગવાનથી નાના કે મોટા નથી હોતા. બધાં  
સિદ્ધ ભગવાન સરખા જ હોય છે. તત્વાર્થસૂત્રના દસમાં અદ્યાયનું  
નવમું સૂત્ર લેદદર્શક છે.

**ક્ષેત્રકાલગતિલિંગતીર્થચારિત્રપ્રત્યેકબુદ્ધ્બોધિતજ્ઞાનાવગાહનાન્તર - ૧૮**  
**સંખ્યાલ્પબહુત્વતः સાધ્યાઃ ।**

ક્ષેત્ર, કાળ, ગતિ આદિ બાર અપેક્ષાઓથી સિદ્ધ જીવોમાં ભૂતકાળમાં  
થવાવાળી વિશેષતાઓની અપેક્ષાએ ભૂતનૈગમનયથી લેદ પણ બતાવેલ  
છે. વર્તમાનમાં ધર્મ પરિણામની/વીતરાગ પરિણામની અથવા અનંત  
ચતુર્ષયની દ્રષ્ટિથી અથવા સિદ્ધોના આઠ ગુણોની મુખ્યતાથી વિચાર  
કરીએ તો સિદ્ધોમાં પરસ્પર તલમાત્રનો પણ લેદ કે અંતર નથી.

આ અલેદ અર્થાત્ એકરૂપતાનો ખરી દ્રષ્ટિથી પ્રારંભ નવમાં  
અનિવૃત્તિકરણ ગુણસ્થાનના પ્રથમ સમયથી જ થાય છે. માટે આ  
અઢીક્ષીપના કોઈપણ ક્ષેત્રમાં કોઈપણ મુનિરાજ ભલે તે ઉપશમક હો કે  
ક્ષપક હો, તે જો આ અનિવૃત્તિકરણ ગુણસ્થાનના પ્રથમ સમયમાં પ્રવેશ  
કરે છે, તો તેમના ધર્મરૂપ પરિણામ સરખા જ હોય છે.

સંક્ષેપમાં એમ પણ કહી શકીએ કે અનિવૃત્તિકરણ ગુણસ્થાન  
સમાન ૧૧મા, ૧૨મા, ૧૩માં અને ૧૪માં ગુણસ્થાન સુધીના સર્વ  
ઉત્કૃષ્ટ સાધકોમાં ધાતિ-અધાતિ કર્મોદયથી ઔદધિક ભાવોમાં તો

પરસ્પર ભલે ગમે તેટલા પણ બેદ થઈ શકે છે, પરંતુ તેમાં પરસ્પર વીતરાગતા અર્થાત્ ધર્મ પરિણામ, સુખ, શાંતિમાં બધાની નિયમથી સમાનતા જ રહે છે.

આનો અર્થ - નવમાં ગુણસ્થાનના પ્રથમ સમયવર્તી એક મુનિરાજની વીતરાગતા અને અન્ય જેટલા પણ નવમા ગુણસ્થાનના પ્રથમ સમયવર્તી મુનિરાજ છે - તે બધાની વીતરાગતા સમાન જ હોય છે. આ રીતે ૧૦માં, ૧૧માં, ૧૨માં, ૧૩માં, ૧૪માં ગુણસ્થાનવર્તી સાધકોની પોત-પોતાનાં ગુણસ્થાનોમાં વીતરાગતા, સુખ આદિની પરસ્પરમાં સમાનતા જ રહે છે. આ વિષયનો ખુલાસો ધવલા પુસ્તક. ૧, પાના નં. ૧૮૭-૧૮૮ પર આ પ્રકારે આપેલ છે -

**શંકા ૨૬ :** ક્ષપકનું સ્વતંત્ર ગુણસ્થાન અને ઉપશમકનું સ્વતંત્ર ગુણસ્થાન એમ અલગ-અલગ બે ગુણસ્થાન શા માટે નથી કહેવામાં આવ્યા ?

**સમાધાન :** ના, કારણ કે આ ગુણસ્થાનના કારણભૂત અનિવૃત્તિરૂપ પરિણામોની સમાનતા બતાવવા માટે તે બંનેમાં એકતા કહી છે, અર્થાત્ ઉપશમક અને ક્ષપક આ બંનેમાં અનિવૃત્તિરૂપ પરિણામોની અપેક્ષા સમાનતા છે. કહું પણ છે :-

અંતર્મુહૂર્ત માત્ર અનિવૃત્તિકરણના કાળમાંથી કોઈ એક સમયમાં રહેવાવાળા અનેક જીવ જે પ્રકારે શરીરના આકાર, વર્ણ આદિ રૂપથી પરસ્પર લેદને પ્રાણ થાય છે, તે જ પ્રકારે જે પરિણામો ઝારા તેમાં બેદ નથી જોવામાં આવતો, તેને અનિવૃત્તિકરણ પરિણામવાળા કહે છે અને તેના પ્રત્યેક સમયમાં ઉત્તરોત્તર અનંતગુણી વિશુદ્ધિથી વધતા થકા એક જેવા જ (સમાન વિશુદ્ધિને લેતા થકા) પરિણામ જોવામાં આવે છે. તથા તે અત્યંત નિર્મિત દ્યાનરૂપ અનિની શિખાઓથી કર્મ-વનને ભર્મ કરવાવાળા હોય છે.

**પ્રશ્ન ૮૨ :** ધાતિ - અધાતિ કર્મોદયથી ઔદચિક તથા ક્ષાયોપશમિક ભાવોમાં લેદ હોઈ શકે છે, એ કેવી રીતે ?

**ઉત્તર :** અનિવૃત્તિકરણ ગુણસ્થાનવર્તી અનેક મુનિરાજોના શરીર નાના, મોટા, પાતળા કે જાડા હોઈ શકે છે. તે મુનિશ્વરોના શરીરનો વર્ણ કાળો, ગોરો હોઈ શકે છે, તે મુનિરાજ ઉમરની ફ્રાણિએ ચુવા અથવા વૃદ્ધ પણ

હોઈ શકે છે.

તે મુજિરાજોના ઔદ્યિક ભાવ જ્ઞાનાવરણા, દર્શનાવરણા અને અંતરાચ કર્મોના ક્ષયોપશમાનુસાર વર્તમાન જ્ઞાનના વિકાસમાં પરસ્પર અંતર પણ હોઈ શકે છે અર્થાત્ તેમાં કોઈ બે જ્ઞાનધારી, કોઈ ત્રણ જ્ઞાનધારી અથવા કોઈ ચાર જ્ઞાનધારી પણ હોઈ શકે છે. અગ્યાર અંગ અને ચૌદ પૂર્વના ધારક શ્રુતકેવળી-રૂપ મહાન જ્ઞાની અથવા માત્ર અષ્ટ પ્રવચનમાતૃકાને જાણવાવાળા અતિ અલ્પજ્ઞાનના ધારકપણાથી અનિવૃત્તિકરણાના ધર્મરૂપ પરિણામોની સમાનતામાં કાંઈ પણ બેદ કે અંતર નથી હોતો. આચાર્યશ્રી નેમિચંદ્રદેવે ગોમ્મટસાર જીવકાંડ ગાથા પછમાં અનિવૃત્તિકરણ ગુણસ્થાનની પરિભાષા આ પ્રમાણે આપેલ છે : -

**હોંતી અણિયદ્વિણો તે, પદિસમયં જેસ્સિમેક્કપરિણામા ।**

**વિમલયરઙ્ગાણહૃદ્યવહસિહાહિં ણિદ્રાઢકામ્મવણા ॥ ।**

અત્યંત નિર્મિણ દ્યાનાનરૂપી અન્નિ શિખાઓ છ્નારા, કર્મવનને બાળવામાં સમર્થ, પ્રત્યેક સમયના એક-એક સુનિશ્ચિત વૃદ્ધિગત વીતરાગ પરિણામોને અનિવૃત્તિકરણ ગુણસ્થાન કહે છે.

વૃદ્ધિગત શુદ્ધોપયોગરૂપ દ્યાનનો પ્રારંભ સાતમા અપ્રમત્તસંચયત ગુણસ્થાનથી થયો છે. તેથી નવમાં ગુણસ્થાનમાં દ્યાન અત્યંત નિર્મિણ થવું સ્વાભાવિક જ છે.

દ્યાનને અનિનની નહીં, અનિનશિખાઓની ઉપમા આપી છે. જે અત્યંત ઉપયુક્ત છે. અનિનમાં તો ઉધયાતા હોય છે, પરંતુ દાદ્ય વસ્તુને વિશેષ રીતથી બાળવાનું કાર્ય અનિનની શિખા જ કરે છે. આ શિખા જાણે કે અનિના હાથ છે, દાદ્ય વસ્તુને પોતાના કલ્જામાં લેવાનું કામ શિખાઓ છ્નારા જ થાય છે. ત્યારબાદ દાદ્ય વસ્તુને અનિન બાળે છે. આઠ કર્મોમાં મુખ્યતાથી ચારિત્રમોહનીય કર્મને વન કહ્યું છે, જેને નિર્મિણ દ્યાનાનરૂપી અનિનશિખા બાળે છે.

વાસ્તવમાં તો આ માત્ર નિમિત્ત - નૈમિત્તિક સંબંધની અપેક્ષાએ અસદ્ભૂત વ્યવહારનથી કથન કરવાની પદ્ધતિ છે. સત્ય વસ્તુસ્થિતિ તો એ છે કે જ્યારે મહામુનિરાજ અંતરોન્મુખી પુરુષાર્થના બળથી વીતરાગભાવને વિશેષ વધારે છે, વીતરાગતા ઉત્તરોત્તર પુરુષ થતી જાય છે, ત્યારે તેના નિમિત્તથી પૂર્વબદ્ધ ચારિત્રમોહનીય કર્મના

સ્પર્ધક પોતાની મેળે સ્થિતિકાંડકઘાત, અનુભાગકાંડકઘાત, સંકમણાદિ થઈને નિરંતર અકર્મરૂપથી પરિણમિત થતા જાય છે. આ કાર્યને “દ્યાનરૂપી અનિનશિખાઓએ કર્મવનને બાળી નાખ્યું” આ અલંકારિક શબ્દોમાં આચાર્યિયે કહ્યું છે.

કાર્મણવર્ગણાઓ જીવના મોહ-રાગ-ક્રેષના નિમિત્ત મેળવી સ્વયં કર્મરૂપથી પહેલા પરિણમિત થઈ હતી. હવે જીવના વીતરાગભાવના નિમિત્ત થવાથી કર્મરૂપ પરિણમિત કાર્મણવર્ગણાઓ સ્વયમેવ અકર્મરૂપ /કાર્મણવર્ગણારૂપ બદલી રહી છે.

અનિવૃત્તિકરણ ગુણસ્થાનને ચથાયોગ્ય અંતર્મુહૂર્ત કાળના જેટલા સમય છે, આ ગુણસ્થાનવર્તી મહામુનિરાજના પરિણામ પણ એટલાજ છે અને ઉત્તરોત્તર વિશિષ્ટ શુદ્ધતા સહિત છે. પ્રત્યેક સમયના એક-એક પરિણામ સુનિશ્ચિત છે. સમજી લો નવમા ગુણસ્થાનનો કાળ ચાર સમયનો છે તો આના પરિણામ પણ ચાર જ છે.

ભરતક્ષેત્રના એક તીર્થકર મુનિરાજ છે, એક ઐરાવત ક્ષેત્રના અભિધારી મુનિશ્વર છે અને એક મહાવિદેહ ક્ષેત્રના સામાન્ય દિગંબર સંત છે. આ ત્રણે અનિવૃત્તિકરણ ગુણસ્થાનના પ્રથમ સમયમાં પ્રવેશ કરે છે તો ત્રણોના પરિણામ એક સરખા જ હોય છે.

બીજા, ત્રીજા અથવા ચોથા સમયમાં પણ તે ત્રણોના પરિણામ પ્રત્યેક સમયમાં પરસ્પર સરખા - સરખા જ હોય છે. માનો આ બધા સાધક ભવ્યાત્માઓએ પોતાના સહજ જ્ઞાનાનંદ એક સામાન્ય સ્વભાવનો આશ્રય લઈને અનંત સિદ્ધોની સમાન થવાને માટે જ મંગલાચરણ કર્યું ન હોય?

નવમા ગુણસ્થાનનું પૂર્ણિનામ “અનિવૃત્તિકરણ બાદરસાંપરાય - પ્રવિષ્ટ-શુદ્ધિસંયત” છે.

લેદ અપેક્ષા વિચાર : શ્રેણીની અપેક્ષાએ આના તત્ત્વસંબંધી બે લેદ છે - (૧) ઉપશમક અનિવૃત્તિકરણ અને (૨) ક્ષપક અનિવૃત્તિકરણ.

(૧) મુનિરાજના જે વીતરાગ પરિણામના નિમિત્તથી ચારિત્રમોહનીય કર્મની ૨૧ પ્રહૃતિઓના ઉપશમના કાર્યની તૈયારી અપૂર્વકરણ ગુણસ્થાનના પ્રથમ સમયમાં પ્રારંભ થાય છે અને ત્યારબાદ નવમા ગુણસ્થાનના અંતિમ સમય સુધી માત્ર સૂક્ષ્મ લોલ કષાયને છોડીને ૨૦

કષાયો તથા સમગ્ર નોકખાયોનો પૂર્ણ ઉપશમ થઈ જાય છે, તે વીતરાગ પરિણામને ઉપશમક અનિવૃત્તિકરણ ગુણસ્થાન કહે છે.

૨) મુનિરાજના જે વીતરાગ પરિણામના નિમિત્તથી ચારિત્રમોહનીય કર્મની ૨૧ પ્રહૃતિઓના ક્ષયના કાર્યની તૈયારી આઠમા અપૂર્વકરણ ગુણસ્થાનના પ્રથમ સમયથી પ્રારંભ થાય છે અને ત્યારબાદ નવમાં ગુણસ્થાનના અંતિમ સમય સુધી માત્ર સૂક્ષ્મ લોલ કષાયને છોડી ૧૧ કષાયો તથા ૮ નોકખાયનો પૂર્ણ ક્ષય થઈ જાય છે, તે વીતરાગ પરિણામને ક્ષપક અનિવૃત્તિકરણ ગુણસ્થાન કહે છે.

અનિવૃત્તિકરણ બાદરસાંપરાય પ્રવિષ્ટ શુદ્ધિસંચયતનું સ્પષ્ટીકરણ :-

**શબ્દાર્થ:** અ + નિવૃત્તિ = અનિવૃત્તિ. અ = નહીં, નિવૃત્તિ = બેદ, કરણ = પરિણામ, અનિવૃત્તિકરણ = બેદરહિત, સુનિશ્ચિત સમાન પરિણામ. બાદર = સ્થૂળ, સાંપરાય = કષાય, પ્રવિષ્ટ = પ્રવેશ પ્રાપ્ત, શુદ્ધિ = શુદ્ધદોપયોગ, સંચયત = શુદ્ધાત્મ સ્વરૂપમાં સમ્યકૃપણે લીન.

ચારિત્રમોહનીય કર્મની ૨૧ પ્રહૃતિઓના ઉપશમ તથા ક્ષયમાં નિમિત્ત થવાવાળા સંજ્યલન કષાયના મંદિરમ ઉદયરૂપ સ્થૂળ કષાયના સદ્ભાવમાં સુનિશ્ચિત ઉત્તરોત્તર વિશિષ્ટ વૃદ્ધિગત, સ્વરૂપલીન શુદ્ધદોપયોગ પરિણામ ચુક્ત જીવ અનિવૃત્તિકરણબાદરસાંપરાય પ્રવિષ્ટ શુદ્ધિસંચયત છે.

**સમ્યકૃત્વ અપેક્ષા વિચાર :**

દ્વિતીયોપશમ અને ક્ષાયિક સમ્યકૃત્વ - આ બંને સમ્યકૃત્વોમાંથી અહીં એક સમ્યકૃત્વ રહે છે.

જો મુનિરાજ ઉપશમક અનિવૃત્તિકરણ ગુણસ્થાનવર્તી હોય તો તેઓને દ્વિતીયોપશમક સમ્યકૃત્વ અને ક્ષાયિક સમ્યકૃત્વ આ બેમાંથી કોઈ એક સમ્યકૃત્વ રહે છે. જો મુનિરાજ ક્ષપક અનિવૃત્તિકરણ ગુણસ્થાનવાળા હોય તો તેઓને ક્ષાયિક સમ્યકૃત્વ જ રહે છે.

**ચારિત્ર અપેક્ષા વિચાર :**

અનિવૃત્તિકરણ ગુણસ્થાનમાં ઉપશમક મુનિરાજને ઓપશમિક ચારિત્ર અને ક્ષપક મુનિરાજને ક્ષાયિક ચારિત્ર હોય છે, કારણ કે આ ગુણસ્થાનમાં ચારિત્રમોહનીય કર્મની ૨૦(સૂક્ષ્મ લોલને છોડી) પ્રહૃતિઓનો ઉપશમ કે ક્ષય થઈ જાય છે.(વિશેષ ખુલાસા માટે જુઓ - ઘવલા પુસ્તક-૫, પાના નં.

૨૦૫, ગોમટસાર જીવકાંડ ગાથા ૧૪, ગોમટસાર કર્મકાંડ ગાથા -૨૦ની ટીકા  
તથા ભાવદીપિકા- પાના નં. ૯૮૮ થી ૯૯૪)

ઉપશમ તથા ક્ષપક શ્રેણીના આરોહક થવાથી અહીં ક્રમશः ઔપશમિક  
અને ક્ષાયિક ચારિત્ર કહેવામાં આવે છે. (આઠમા ગુણસ્થાનની આગળના  
સર્વપ્રકરણ અહીં પૂર્ણ રીતે લાગુ પડે છે. તેને અહીં ફરી અવલોકન કરવા.)

આ અનિવૃત્તિકરણ ગુણસ્થાનના ચારિત્રમોહનીયના ઉપશમ કે ક્ષય  
કરવામાં વિશિષ્ટ યોગદાન આ પ્રકારે છે :-

સૂક્ષ્મતાથી જ્યારે આપણે વિચારીએ ત્યારે આ વિષય સ્પષ્ટ થઈ  
જાય છે કે પ્રત્યેક શ્રેણીના ગુણસ્થાન તો ચાર-ચાર જ છે. છતાંચિ  
પ્રત્યેક શ્રેણીના અંતના ગુણસ્થાન અર્થાત્ ઉપશાંતમોહ અને ક્ષીણમોહ  
પરિણામોએ ચારિત્રમોહનીય કર્મને ઉપશમ કે ક્ષય કરવાનું કામ તો કાંઈ  
કર્યું નહીં.

નીચેના ત્રણે ગુણસ્થાનોના પ્રત્યેક સમયના શુદ્ધ ભાવાનુસાર  
ચારિત્રમોહનીયના ઉપશમ કે ક્ષયનો પ્રારંભ થયો અને તેના ફળસ્વરૂપ  
પૂર્ણ પણ થયો. ત્યારબાદ અગ્યારમાં અને બારમાં ગુણસ્થાનમાં પૂર્ણ  
વીતરાગતા પોતાની મેળે સ્વયં પ્રગટ થઈ ગઈ છે.

અપૂર્વકરણ ગુણસ્થાને ચારિત્રમોહનીય કર્મના ઉપશમ કે ક્ષય કરવાનો  
પ્રારંભ તો કર્યો, પરંતુ કોઈ વિશેષ પ્રકૃતિઓનો ઉપશમ કે ક્ષય ન થઈ  
શક્યો. ક્ષીય પ્રારંભ કરવાનો શ્રેય કહો અથવા બહુમાન કહો, મબ્યો તો  
અપૂર્વકરણ ને જ, છતાંચિ ત્યાં પ્રત્યક્ષમાં કોઈ પણ ચારિત્રમોહનીયનો  
પૂર્ણ ઉપશમ કે ક્ષયરૂપ કાંઈ કાર્ય નથી થયું.

હવે વાત આવે છે અનિવૃત્તિકરણની. બાર કખાયોમાંથી માત્ર સૂક્ષ્મ  
લોભને છોડી અગ્યાર કખાયોનો અને નવ નોકખાયોનો પણ પૂર્ણ  
ઉપશમ કે પૂર્ણ ક્ષય કરવાનું વિશિષ્ટ મહત્વપૂર્ણ કાર્ય તો માત્ર એક  
અનિવૃત્તિકરણ પરિણામથી જ થયું છે.

તેથી નવમાં ગુણસ્થાનનવતી વીતરાગ પરિણામે શ્રેણીના અન્ય ત્રણે  
ગુણસ્થાનોની અપેક્ષાએ વિશેષ મહત્વપૂર્ણ કામ થયું છે, આ વાત સ્વયં  
સ્પષ્ટ થાય છે. આ ક્રષ્ણાએ અનિવૃત્તિકરણ ગુણસ્થાન અસાધારણ છે.

**કાળ અપેક્ષા વિચાર :**

**જધન્યકાળ :** ૧) કોઈ મહામુનિક્ષર ઉપશમક અનિવૃત્તિકરણ ગુણસ્થાનમાં

મરણાની અપેક્ષાએ માત્ર એક જ સમય રહે છે. જેમ કે કોઈ મહામુનિરાજ સૂક્ષ્મસાંપરાય ગુણસ્થાનથી નીચે ઉત્તરતા સમય નીચે અનિવૃત્તિકરણ ગુણસ્થાનમાં માત્ર એક સમય વ્યતીત કરતાં જ તેમના મનુષ્યાચુનો ક્ષય થઈ જાય તો મરણાની અપેક્ષાએ અનિવૃત્તિકરણ ગુણસ્થાનનો જધન્યકાળ એક સમય ઘટિત થાય છે.

૨) અથવા ઉપશમક અપૂર્વકરણ ગુણસ્થાનથી ઉપર ચડતા સમયે કોઈ મુનિરાજ અનિવૃત્તિકરણ ગુણસ્થાનમાં આરૂઢ થયા અને માત્ર એક સમય રહ્યા અને તત્કાળ મનુષ્યાચુનો ક્ષય થઈ જાય તો પણ નવમા ગુણસ્થાનનો જધન્યકાળ એક સમય થઈ શકે છે.

**ઉત્કૃષ્ટકાળ :** યથાયોગ્ય માત્ર એક અંતર્મુહૂર્ત. જો ઉપશમક અનિવૃત્તિકરણ ગુણસ્થાનવતી આ નવમા ગુણસ્થાનમાં વધારેમાં વધારે કાળ રહે તો યથાયોગ્ય એક અંતર્મુહૂર્ત કાળ સુધી જ રહેશે.

ક્ષપક અનિવૃત્તિકરણ મુનિરાજના જધન્ય કે ઉત્કૃષ્ટ કાળનો પ્રસંગ જ નથી આવતો, કારણ કે તેમનું તો ન પતન થાય છે અને ન મરણ. માટે જધન્ય કે ઉત્કૃષ્ટકાળ નથી. જેને જધન્યકાળ હોય છે, તેને જ ઉત્કૃષ્ટકાળનો વ્યવહાર હોય છે.

**મદ્યમકાળ :** ઉપશમ અનિવૃત્તિકરણ ગુણસ્થાનના બે, ત્રણ, ચાર, પાંચ આદિ સમયથી લઇને યથાયોગ્ય અંતર્મુહૂર્ત કાળની વર્ણણો કાળ નવમા ગુણસ્થાનનો મદ્યમકાળ છે; તે પણ મરણાની જ અપેક્ષાથી છે.

**ગમનાગમન અપેક્ષા વિચાર :**

**ગમન : ૧)** ઉપશમક અથવા ક્ષપક અનિવૃત્તિકરણ ગુણસ્થાનવતી મુનિરાજ ઉપરની તરફ સૂક્ષ્મસાંપરાય ગુણસ્થાનમાં જ ગમન કરે છે.

**૨)** ઉપશમ શ્રેણીથી ઉત્તરતા સમય અનિવૃત્તિકરણ ગુણસ્થાનવતી મુનિરાજ ઉપશમ અપૂર્વકરણ ગુણસ્થાનમાં જ ગમન કરે છે.

**૩)** જો ઉપશમક અનિવૃત્તિકરણ ગુણસ્થાનવતી મુનિરાજનું આચુ ક્ષય થવાથી મૃત્યુ થાય છે તો તે વિશ્વાસિતિના પ્રથમ સમયમાં નિયમથી ચોથા અવિરત-સમ્યકૃત્વ ગુણસ્થાનમાં જ ગમન કરે છે.

**આગમન : ૧)** ઉપશમક અનિવૃત્તિકરણમાં આગમન નીચેના ઉપશમક અપૂર્વકરણ ગુણસ્થાનથી જ થાય છે.

**૨)** ઉપશમ શ્રેણીથી નીચે ઉત્તરતાં સમયે દસમાં ઉપશમક સૂક્ષ્મસાંપરાય

ગુણસ્થાનથી જ આ નવમાં ગુણસ્થાનમાં આગમન થાય છે.

૩) ક્ષપક અનિવૃત્તિકરણ ગુણસ્થાનમાં આગમન માત્ર ક્ષપક અપૂર્વિકરણ ગુણસ્થાનથી થાય છે.

**વિશેષ અપેક્ષા વિચાર:**

૧) અનંતગણી વિશુદ્ધિ આદિ સર્વ આવશ્યક કાર્ય આ અનિવૃત્તિકરણ ગુણસ્થાનમાં આઠમા ગુણસ્થાનની જેમ જ થાય છે, તેને અહીં પણ સમજી લેવું.

૨) ચારિત્રમોહનીય કર્મ બાદરકૃષ્ણિથી સૂક્ષ્મમફુષ્ટિરૂપ થઈ જાય છે. આ કૃષ્ટિકરણથી સૂક્ષ્મલોભક્ષાય વગર શેષ સર્વ અગ્યાર ક્ષાય અને હાસ્યાદિ સર્વ નવ નોક્ષાયોનો સર્વથા ઉપશમ કે ક્ષય થઈ જાય છે.

**પ્રશ્ન ૮૩: કૃષ્ટિકરણ કોને કરે છે ?**

ઉત્તર : ક્રમથી ક્ષાયોનું કૃષ/હીન કરવાને કૃષ્ટિકરણ કરે છે. અર્થાત્ અનુભાગ/ફળ પ્રદાન કરવાની શક્તિનું ઉત્તરોત્તર ઓછા-ઓછા થતાં જવું તે જ કૃષ્ટિકરણ છે. આ અતિ વિશિષ્ટ મહત્વપૂર્ણ કાર્ય અનિવૃત્તિકરણ ગુણસ્થાનમાં જ થાય છે.

**પ્રશ્ન ૮૪: બાદરકૃષ્ણ કોને કરે છે ?**

ઉત્તર : (અનિવૃત્તિકરણ નામના નવમાં ગુણસ્થાનના પૂર્વે જોવામાં આવેલા સ્પર્ધકોને પૂર્વ સ્પર્ધકો કરે છે. અનિવૃત્તિકરણના નિમિત્તથી અનુભાગ ક્ષીણ સ્પર્ધકોને અપૂર્વસ્પર્ધક કરે છે.)

અપૂર્વસ્પર્ધકથી પણ અનંતમાં ભાગ અનુભાગ ક્ષીણ સ્પર્ધકોને બાદરકૃષ્ણ કરે છે. અર્થાત્ સંજ્વલન કોધ, માન, માચ અને લોભ ક્ષાયોના અનુભાગને ઘટાવવું/ક્ષીણ કરવું એ જ બાદરકૃષ્ણ છે. બાદર શાન્દનો અર્થ છે સ્થૂળ અર્થાત્ મોટા-મોટા ટુકડા કરવા.

**પ્રશ્ન ૮૫: સૂક્ષ્મમફુષ્ટ કોને કરે છે ?**

ઉત્તર : બાદર કૃષ્ણિથી પણ અનંતમાં ભાગ અનુભાગ ક્ષીણ સ્પર્ધકોને સૂક્ષ્મમફુષ્ટ કરે છે.

વસ્તુ-વ્યવસ્થાની અદલૂતતા તથા સૂક્ષ્મતા તો નીરખો ! ક્ષપક અનિવૃત્તિકરણાવાળા મહામુનિરાજ હવે માત્ર યથાયોગ્ય બે અંતર્મુહૂર્ત સમાસ થતાં જ (અર્થાત્ દસમા અને બારમા ગુણસ્થાનનો સમય પસાર કરતાં જ ) સર્વજ્ઞ ભગવાન/અરહંત બનવાવાળા છે. છતાંય તેમને હજુ

પણ આઠેય કર્મોની સત્તા હાજર છે. તેમાંથી એક પણ કર્મનો પૂર્ણ નાશ નથી થયો.

મોહનીયકર્મ નષ્ટોન્મુખ છે, છતાંચ સૂક્ષ્મલોલ પોતાના સામર્થ્યથી પોતાના અસ્તિત્વની જાણકારી મહામુનિરાજને પણ જાહે ગૌરવથી બતાવી રહ્યો છે. જેમ - બુઝાતો/ઓલવાતો દીવડો અંતમાં લલકીને બુઝાઈ જાય છે. અન્ય જ્ઞાનાવરણાદિ સાતે કર્મો પોત-પોતાની સ્થિતિ અનુસાર સત્તામાં છે. છતાં પણ તે સાતે કર્મોની નિર્જરા તો ઉત્તરોત્તર ચથાકમ તથા ચથાસ્થાન ચાલુ છે જ.

૩) ભિન્ન સમયવર્તી જીવોના પરિણામ સુનિશ્ચિત, વિસદ્ધ તથા એકસમયવર્તી જીવોના પરિણામ સુનિશ્ચિત, સંદર્શ હોય છે.

૪) અનિવૃત્તિકરણ બાદરસાંપરાય ગુણસ્થાનના નામમાં જે બાદર શબ્દ આવ્યો છે, તે અંતદીપક છે. પહેલા ગુણસ્થાનથી લઇજે આ ગુણસ્થાન સુધીના સર્વ જીવ બાદર કખાચ સહિત છે. જેમ કે મિથ્યાત્પ બાદર સાંપરાય, સાસાદન સમ્યકૃત્વ બાદરસાંપરાય, મિશ્ર બાદર સાંપરાય આદિ.

### ઘવલા પુસ્તક - ૧નો અંશ (પાના નં. ૧૮૪ થી ૧૮૭)

અનિવૃત્તિ બાદર સાંપરાયિક પ્રવિષ્ટ શુદ્ધિ સંચતોમાં ઉપશમક પણ હોય છે અને ક્ષપક પણ હોય છે. ॥૧૫॥

સાંપરાય શબ્દનો અર્થ કખાચ છે અને બાદર સ્થૂળને કહે છે. માટે સ્થૂળ કખાચોને બાદર-સાંપરાય કહે છે અને અનિવૃત્તિઝપ બાદર સાંપરાયને અનિવૃત્તિબાદરસાંપરાય કહે છે. આ અનિવૃત્તિબાદરસાંપરાયઝપ પરિણામોમાં જે સંચતોની વિશુદ્ધિ પ્રવિષ્ટ થઈ ગઈ છે, તેને અનિવૃત્તિ બાદર સાંપરાય-પ્રવિષ્ટ-શુદ્ધિસંચત કહે છે. એવા સંચતોમાં ઉપશમક અને ક્ષપક બંને પ્રકારના જીવ હોય છે. તે બધા સંચતોને મળીને એક અનિવૃત્તિકરણ ગુણસ્થાન થાય છે.

શંકા 27 : જેટલા પરિણામ થાય છે, તેટલા જ ગુણસ્થાન કેમ નથી હોતા ?

સમાધાન : ના, કારણ કે જેટલા પરિણામ થાય છે, તેટલા જ ગુણસ્થાન માનવામાં આવે તો વ્યવહાર જ ન ચાલી શકે. માટે

ફ્રલ્યાર્થિકનયની અપેક્ષાએ નિયત સંખ્યાવાળા જ ગુણસ્થાન કહેવામાં આવ્યા છે.

**શંકા 28 :** આ સૂત્રમાં સંચતપદનું ગ્રહણ કરવું વ્યર્થ છે ?

સમાધાન : આ કોઈ દોષ નથી, કારણ કે સંચતમ પાંચેચ ગુણસ્થાનોમાં સંભવ છે, આમાં કોઈ વ્યબિચાર દોષ નથી આવતો. આ પ્રકાર જાગ્રાવાનો કોઈ બીજો ઉપાય નહીં હોવાથી અહીં સંચતમ પદને ગ્રહણ કરેલ છે.

**શંકા 29 :** ‘પમત્તસંજદા’ આ સૂત્રમાં ગ્રહણ કરેલા સંચતપદની અહીં અનિવૃત્તિ થાય છે અને તેનાથી જ ઉક્ત અર્થનું જ્ઞાન પણ થઈ જાય છે માટે ફરી આ પદનું ગ્રહણ કરવું વ્યર્થ છે.

સમાધાન : જો એવું છે તો સંચત પદનું અહીં ફરી પ્રયોગ મંદબુદ્ધિ જનોના અનુગ્રહ માટે સમજવો જોઈએ.

**શંકા 30 :** જો એમ છે, તો ઉપશાંતકષાય આદિ ગુણસ્થાનોમાં પણ સંચતપદનું ગ્રહણ કરવું જોઈએ ?

સમાધાન : ના, કારણ કે દશમાં ગુણસ્થાન સુધી બધા જીવ કષાય સહિત હોવાને લીધે, કષાયની અપેક્ષાએ સંચતોની અસંચતોની સાથે સદશતા જોવામાં આવે છે, માટે નીચેના દસમાં ગુણસ્થાન સુધી મંદબુદ્ધિજનોને સંશય ઉત્પન્ન થવાની સંભાવના છે. તેથી સંશયના જ નિરાકરણ માટે સંચત વિશેષણ દેવું આવશ્યક છે, પરંતુ ઉપરના ઉપશાંત કષાય આદિ ગુણસ્થાનોમાં મંદબુદ્ધિજનોને પણ શંકા ઉત્પન્ન નથી થઈ શકતી, કારણ કે ત્યાં સંચત ક્ષીણકષાય અથવા ઉપશાંત કષાય જ હોય છે. માટે ભાવોની અપેક્ષાએ પણ સંચતોની અસંચતોથી સદશતા જોવામાં નથી આવતી. તેથી અહીં પર સંચત વિશેષણ દેવું આવશ્યક નથી.

-૦-૦-૦-૦-

૧૦

### સૂક્ષ્મસાંપરાય ગુણસ્થાન

સૂક્ષ્મસાંપરાય નામનું આ દસમું ગુણસ્થાન છે. ચારિત્ર મોહનીયકર્મનો સાક્ષાત ક્ષય અથવા ઉપશમ કરવાવાળું વિશિષ્ટ સામર્થ્યવાન ગુણસ્થાન છે.

**પ્રશ્ન ૮૬ :** આ સૂક્ષ્મસાંપરાય ગુણસ્થાન બળવાન કે વિશિષ્ટ સામર્થ્યવાન કઈ અપેક્ષાએ કહેવામાં આવેલ છે ?

**ઉત્તર :** દસમું ગુણસ્થાનને બળવાન કહેવાની વિવક્ષા એ છે કે સૂક્ષ્મલોભનો ઉપશમ કે ક્ષય કરવાની શક્તિ ન અપૂર્વકરણમાં છે અને ન અનિવૃત્તિકરણમાં છે. દસમાં સૂક્ષ્મસાંપરાયમાં જ સૂક્ષ્મલોભનો નાશ કરવાનું સામર્થ્ય છે, તેથી આને બળવાન કહ્યું છે.

ઉપરોક્ત કથન સંજવલન કષાયની અપેક્ષાથી છે અને સંજવલન લોભ કષાય નિયમથી સ્વોદયી પ્રફૃતિ હોવાથી છેલ્લે જ નષ્ટ થાય છે, એ પણ ચાદ રાખવું જરૂરી છે.

**પ્રશ્ન ૮૭ :** સંજવલન કોઇ, માન, માયા અને સ્થૂળલોભ શું સૂક્ષ્મલોભથી બળહીન છે ?

**ઉત્તર :** હા, છે જ. કારણ કે સૂક્ષ્મલોભથી પહેલા નવમા ગુણસ્થાનમાં જ સંજવલન કોઇદિનું ઉપશમ કે ક્ષય થઈ જાય છે.

**પ્રશ્ન ૮૮ :** શું સંજવલન કષાયોથી પણ અનંતાનુંબંધી આઈ કષાયો બળહીન છે ? કૃપયા આને સ્પષ્ટ કરો.

**ઉત્તર :** કંબડી રમતના ઉદાહરણથી આ પ્રશ્નનો ઉત્તર જલ્દી સમજમાં આવી શકે છે. રમતમાં જે પહેલા આઉટ થઈ જાય, તેને કમજોર જેલાડી માનવામાં આવે છે અને જે રમતમાં છેલ્લે સુધી સ્થાન જમાવી રાખે છે, તેને બળવાન અને ચતુર માનવામાં આવે છે.

સંજવલન કષાય અંત સુધી નષ્ટ નથી થતાં, દસમા ગુણસ્થાન સુધી જામેલા રહે છે. આ અપેક્ષાથી તેને બળવાન કહેવામાં આવે તો કોઈ દોષ

નથી. એમ તો અનંતાનુબંધીને જ બળવાન માનવાનાં આવે છે, કારણ કે તે અનંત સંસારનો અનુબંધ કરાવે છે અને મિથ્યાંત્વની સહ્યારિણી છે.

ચારિત્રમોહનીય કર્મની રૂપ પ્રફૃતિઓમાંથી જે કર્મનો નાશ(ઉપશમ કે ક્ષય) પહેલા થાય છે, તેને અન્ય કર્મોની અપેક્ષા બળહીન માનવામાં આવે છે. આ ચુક્તિના આધારે સંજ્વલન કખાયોની પહેલા અનંતાનુબંધી આઈ કખાયોનો ઉપશમ કે ક્ષય થઈ જાય છે. આ કારણથી તે અનંતાનુબંધી આઈ કખાયો સંજ્વલન કખાયોથી બળહીન સિદ્ધા થઈ જાય છે.

જ્યારે જીવ નિજશુદ્ધાત્મસન્મુખ થાય છે, ત્યારે અધઃકરણ આઈ પરિણામો ઝારા ઔપશમિક સમ્યક્ષર્ણન પ્રાપ્ત કરે છે. તે જ સમય દર્શનમોહ ઉપશમિત થાય છે અને અનંતાનુબંધી કખાય ચતુષ્ટયનો પણ સ્વયંમેવ અપ્રશસ્ત ઉપશમ થઈ જાય છે. દર્શનમોહને મરતો જોઈને જાણે અનંતાનુબંધી સ્વયં મરી જાય છે.

વિશેષ એટલું છે કે ક્ષાયિક સમ્યક્ષર્ણનની પ્રાપ્તિના સમયે અધઃકરણાઈ ત્રિકરણ પરિણામપૂર્વક જ અનંતાનુબંધી કખાય ચોકડી અન્ય ૨૧ કખાય, ૯ નોકખાયોમાં વિસંયોજિત થઈ જાય છે. અહીં અનંતાનુબંધીના વિસંયોજન માટે સ્વતંત્ર પુરુષાર્થ અપેક્ષિત છે.

અપ્રત્યાજ્યાનાવરણ અને પ્રત્યાજ્યાનાવરણ - આઠે કખાય કર્મો એકી સાથે સંજ્વલન કખાય ચતુષ્ટય તથા પુરુષવેદમાં પોતાને પરિવર્તિત કરીને સમાપ્ત થઈ જાય છે.

સંજ્વલન આઈ ચારેય કખાયો એક સાથે નાણ નથી થતાં. કોઇ કર્મ, માનમાં બદલાય છે, માન -માયા કર્મરૂપ થઈ જાય છે, માયા લોભમાં સંકમિત થાય છે, માત્ર લોભ કખાય કર્મ કોઈ અન્યરૂપ નથી થતો. તેથી સંજ્વલન લોભનો પણ અંશ જે સૂક્ષ્મલોભ તે વધારે બળવાન છે, જે બધાથી અંતમાં નાણ થાય છે.

પ્રશ્ન ૮૮ : આ ચુક્તિથી તો ચારિત્રમોહનીયકર્મથી પણ દર્શનમોહનીય કર્મ હીએ શક્તિવાળા સિદ્ધા થઈ જાય છે.

ઉત્તર : હા, આપનું કહેલું સત્ય છે. જો દર્શનમોહનીય કર્મ ચારિત્રમોહનીય કર્મથી શક્તિહીન ન હોત તો મુનિરાજ દર્શનમોહનીયનો ઉપશમ કે ક્ષય કરીને ચારિત્રમોહનીયના ઉપશમ કે ક્ષય માટે શ્રેણીના કાળમાં કટિબદ્ધ શા માટે અને કેવી રીતે થાત ?

માટે મોક્ષમાર્ગા, સાધક, આત્માર્થી જીવ જ્યારે કર્મોથી લડવાનો પ્રારંભ કરે છે, ત્યારે આહેય કર્મોમાંથી મોહનીય કર્મથી જ સૌ પ્રથમ લડવાની શરૂઆત કરે છે. મોહનીય કર્મોમાં પણ દર્શનમોહનીયથી ચુદ્ધ કરીને તેને જ સૌથી પહેલા પરાજ્યત કરે છે અને સ્વયં વિજ્યી અર્થાત् સમ્યકૃત્વી થાય છે. તેથી દર્શનમોહનીય કર્મ સ્વયં શક્તિહીન સિદ્ધ થઈ જાય છે.

પ્રશ્ન ૬૦ : કરણાનુયોગમાં તો તર્ક, હેતુ, ચુક્તિ માટે અવકાશ જ નથી, અહીં તો જિનેન્દ્ર ભગવાનની આજ્ઞા જ મુખ્ય રહે છે. આપ કરણાનુયોગના વિષયમાં તર્કનો ઉપયોગ શા માટે કરી રહ્યા છો ?

ઉત્તર : કરણાનુયોગ શાસ્ત્રમાં તર્ક નથી ચાલતાં, એ વાત સાચી છે, પરંતુ સમજવા-સમજાવવા માટે આચાર્યાઓ પણ આગમગર્ભિત ચુક્તિઓનો ઉપયોગ કર્યો છે. સ્વયં આચાર્યાઓ ચુક્તિથી અનેક વિષય સમજાવ્યા છે. આચાર્યશ્રી વીરસેનેણેં તો કરણાનુયોગના શાસ્ત્ર ઘવલાઈ ટીકામાં શંકા - સમાધાનની પદ્ધતિથી જ સમજાવ્યું છે. અહીંથા પણ જે સ્પષ્ટીકરણ ચાલી રહ્યું છે તે બધું આગમની મર્યાદામાં જ ચાલી રહ્યું છે.

પ્રશ્ન ૬૧ : આહેય કર્મમાં મોહનીયકર્મ અને મોહનીયમાં પણ દર્શનમોહનીય બળવાન છે, એવું કથન શાસ્ત્રોમાં આવ્યું છે. તેને આપ આજ્ઞાર્થી પ્રમાણ માનો.

ઉત્તર : અમને શાસ્ત્રના પ્રત્યેક વાક્ય પ્રમાણ છે. મોહ અને મોહમાં પણ દર્શનમોહ કર્મ બળવાન છે, આ સર્વ વિષય અમો સો ટકા સ્વીકારીએ છીએ. અહીં અમે એટલું માત્ર સ્પષ્ટ કરવા માંગીએ છીએ કે “દર્શનમોહનીય કર્મ બળવાન છે” એવું બતાવવામાં અનુકૂંપાવાન આચાર્ય મહારાજ કયા રહસ્યની વાત કહેવા માંગે છે, તેના પર આપણે ગંભીરતાથી વિચાર કરવો જોઈએ.

પ્રશ્ન ૬૨ : આમાં અતિ ગંભીર વિચારણાની શું જરૂરત છે ? વિચારવા માટે અવકાશ જ કર્યાં છે ? સ્પષ્ટ શબ્દોમાં આચાર્યાએ શાસ્ત્રમાં કહ્યું છે કે - “દર્શનમોહનીય કર્મ બળવાન છે.” તેને સો ટકા ખરું માનવું એ જ આપણું પરમ કર્તવ્ય છે. બસ ! વાત પૂરી થઈ જ ગઈ, પછી વાળની છાલ ઉતારવાથી શું લાભ ?

ઉત્તર : દર્શનમોહનીય કર્મને બળવાન બતાવવાનું કથન વ્યવહાર-

નયનું છે. એનો અર્થ દર્શનમોહનીય કર્મ બળવાન નથી, એવું સમજું લેવું જોઈએ. શાસ્ત્રના અર્થ કરવાની સારી પદ્ધતિ આ જ છે. આ જ વિશ્વયને મોક્ષમાર્ગ પ્રકાશક પાનાનં. ૨૫૦-૨૫૧ પર આ પ્રમાણે કહેલ છે-

વ્યવહારનથી જે નિરૂપણ કર્યું હોય, તેને અસત્યાર્થ માની તેનું શ્રદ્ધાન છોડવું .. વ્યવહારનય સ્વપ્રભ્રવ્ય - પરપ્રભ્રવ્યને અને તેના ભાવોને અને કારણ-કાર્યાદિકને કોઈને કોઈનામાં મેળવીને /લેળવીને નિરૂપણ કરે છે. તેથી એવા જ શ્રદ્ધાનથી મિથ્યાત્પ થાય છે. માટે તેનો ત્વાગ કરવો.

વ્યવહારનયની મુખ્યતાથી વ્યાખ્યાન છે, તેને તેમ છે નહીં, નિમિત્તાદિની અપેક્ષાએ ઉપચાર કરેલ છે - એમ જાણવું.

કર્મને બળવાન બતાવી જીવને વધારે બળવાન થવાની પ્રેરણા આપવાનો આચાર્યનો ભાવ છે, નહીં કે જીવને પુરુષાર્થીન બનાવવાનો.

**જેમ :-** લોકમાં પોતાની સેનાને યુદ્ધની તૈયારી કરવાનો ઉત્સાહ આપવા માટે સેનાપતિ કે રાજ શાત્રુના શીર્ઘની જાણકારી આપે છે, તે શાત્રુથી લયભીત થવા નહીં, પોતાની શક્તિ વધારવા માટે. તેમ જ અહીં કર્મોના સંબંધમાં સમજવું જોઈએ.

અનંત સંસારનું કારણ મિથ્યાદર્શન છે અને મિથ્યાત્પ કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ જી કોડાકોડીસાગરની છે, જે સર્વ કર્મોની અપેક્ષાએ પણ ઘણી વધારે છે. અનાદિકાળથી આજસુધી અને ભવિષ્યમાં પણ વિશ્વમાં અનંત જીવ અનંત દુઃખ લોગવતા આવ્યા છે અને ભોગવશે. આ બધો મિથ્યાત્પનો જ પ્રતાપ છે.

સંસારના સર્વ દુઃખોનું મૂળ પણ મિથ્યાત્પ જ છે. ૩૫૩ વિપરીત મતોના પ્રચાર-પ્રસારનો હેતુ મિથ્યાત્પ જ છે. આ અપેક્ષાથી દર્શનમોહ મહા બળવાન છે. મિથ્યાત્પનો નાશ થતા જ અનંત સંસાર સાંત/મર્યાદિત થાય છે અને અપુનર્ભવ/મુક્તિ માટે મંગલ પ્રસ્થાન પ્રારંભ થઈ જાય છે. જ્ઞાન તથા ચારિત્ર સમ્યક્કુર્શનના જ અનુગામી છે. આ અપેક્ષાને સુરક્ષિત રાખીને અહીંયા ચર્ચા ચાલી રહી છે.

**પ્રશ્ન ૮૩ :** દર્શનમોહ તથા ચારિત્રમોહ - આ બંગેમાંથી પહેલા ઉદ્ય-નાશ કોનો થાય છે ?

**ઉત્તર :** મિથ્યાત્પનો નાશ અનંત પુરુષાર્થીથી થાય છે અને બધાંથી પહેલા ઉદ્ય-નાશ પણ મિથ્યાત્પનો જ થાય છે. સમ્યક્કુર્શનની અપેક્ષા

ચારિત્ર અર્થાત્ આત્મસ્થિરતાનો પુરુષાર્થ અનંતગણો વધારે છે.

આમ તો ચારિત્રમોહનીયનો ઉદ્ય-નાશ મિથ્યાત્પના ઉદ્ય-નાશની સાથે જ પ્રારંભ થઈ જાય છે. પરંતુ પૂર્ણ ઉદ્ય-નાશ અને સત્પનાશ દસ્મા ગુણસ્થાનના અંતિમ સમયમાં જ થાય છે, અહીં આ વિવક્ષા છે.

વાસ્તવમાં ચોથા, પાંચમાં આઈ આગળના પ્રત્યેક ગુણસ્થાનને પ્રાપ્ત કરવાનો પુરુષાર્થ પણ ઉત્તરોત્તર અનંત-અનંતગણો છે. લેણે શ્રદ્ધા ચોથા ગુણસ્થાનમાં ક્ષાયિક થઈ જાય તો પણ ચારિત્રમાં તેનાથી પણ અનંતગણો પુરુષાર્થ આવશ્યક છે. સમ્યકૃત્પમાં પ્રતીતિનો પુરુષાર્થ અને ચારિત્રમાં સ્થિરતા/રમણતાનો પુરુષાર્થ થાય છે.

આચાર્યશ્રી નેમિયંડ્રેવે ગોમ્મટસાર જીવકંડ ગાથા ૫૦માં સૂક્ષ્મસાંપરાય ગુણસ્થાનની પરિભાષા આ પ્રમાણે આપેલ છે:-

**અણુલોહં વેદંતો, જીવો ઉવસામગો વ ખવગો વા।**

**સો સુહમસાંપરાઓ, જહખાદેણૂણાં કિંચિ ॥**

ઘોયેલા કૌસુંબી વસ્ત્રની આછી લાલીમા જેવા સૂક્ષ્મ લોભનું વેદન કરવાવાળા ઉપશમક અથવા ક્ષપક જીવોના ચથાખ્યાત ચારિત્રથી કિંચિત્ ન્યૂન વીતરાગ પરિણામોને સૂક્ષ્મસાંપરાય ગુણસ્થાન કહે છે.

કૌસુંબી વસ્ત્ર લાલ હોય છે. તેને પાણીમાં ઘોવાથી તેની લાલાસ ઓછી થઈ જાય છે. તે ઘોયેલા કૌસુંબી વસ્ત્રની લાલીમા સમાન સૂક્ષ્મલોભ પરિણામનું વેદન મુનિરાજ કરે છે અર્થાત્ સૂક્ષ્મલોભ કષાય કર્મના ઉદ્યથી મહામુનિરાજને અબુદ્ધિપૂર્વક ઉત્તરોત્તર ઘટતાં-ઘટતાં સૂક્ષ્મલોભ પરિણામ થતાં રહે છે.

આમ તો સાતમા અપ્રમત્ત ગુણસ્થાનથી જ મુનિરાજ નિજ સહજાનંદમય શુદ્ધાત્માનું વેદન/અનુભવ કરે છે, છતાંચ પૂર્ણ વીતરાગતારૂપ ચથાખ્યાત ચારિત્રની ઓછપને દર્શાવવાના ઉદ્દેશથી સૂક્ષ્મલોભનું વેદન કરવાવાળા એવું કથન અશુદ્ધનિશ્ચયનયથી આચાર્યશ્રી નેમિયંડ્રેવે ગાથામાં કર્યું છે. આને જ અદ્યાત્મની અપેક્ષાએ વ્યવહારનયનું કથન કહે છે.

અપ્રત્યાખ્યાનાવરણ કોધાઈ ચાર કષાય, પ્રત્યાખ્યાનાવરણ કોધાઈ ચાર કષાય અને સંજવલન કોધ, માન, માયા આ કુલ મળીને ૧૧ કષાય અને હાસ્યાઈ નવ નોકષાયોના અનુદ્યપૂર્વક વ્યક્ત થવાવાળા વીતરાગ પરિણામ દસ્મા ગુણસ્થાનનું ચથાર્થ સ્વરૂપ નથી. તે વીતરાગતા સૂક્ષ્મલોભ

ની સાથે હોય તો દસમું ગુણસ્થાન થાય છે, કારણ કે દસમા ગુણસ્થાનનું નામ જ સૂક્ષ્મસાંપરાય છે. સાંપરાય શબ્દનો અર્થ કષાય થાય છે.

**પ્રશ્ન ૮૪ :** જે સૂક્ષ્મ લોભને ગૌણ કરીએ તો શું કાંઈ દોષ છે ?

**ઉત્તર :** જે સૂક્ષ્મલોભને ગૌણ કરવામાં આવે તો દસમાં ગુણસ્થાનમાં જ પૂર્ણ વીતરાગતાનો સ્વીકાર કરવો અનિવાર્ય થઈ જશે અને પછી ચોદ ગુણસ્થાનની જગ્યાએ તેર જ ગુણસ્થાન રહેશે, જે આગમને માન્ય નથી. કરણાનુયોગમાં ડેવળી ભગવાનની આજાની પ્રધાનતા રહી છે, તેનું પણ દ્યાન રાખવું આવશ્યક છે.

દસમા ગુણસ્થાનનું પૂર્ણનામ “સૂક્ષ્મસાંપરાય પ્રવિષ્ટશુદ્ધિસંયત” છે. લેદ અપેક્ષા વિચાર :

શ્રેણીની અપેક્ષાએ આના બે લેદ છે. (૧) ઉપશમક સૂક્ષ્મસાંપરાય અને (૨) ક્ષપક સૂક્ષ્મસાંપરાય .

૧) જે વીતરાગ પરિણામમાં માત્ર સૂક્ષ્મસાંપરાય રૂપ કલંક અર્થાત् રાગ બાકી છે અને અન્ય સર્વ કષાય-નોકષાયોનો સર્વથા ઉપશમ થઈ ગયો છે, તેને ઉપશમક સૂક્ષ્મસાંપરાય ગુણસ્થાન કહે છે.

૨) જે વીતરાગ પરિણામમાં માત્ર સૂક્ષ્મસાંપરાય રૂપ કલંક અર્થાત् રાગ બાકી છે અને અન્ય સર્વ કષાય-નોકષાયોનો સર્વથા ક્ષય અર્થાત् નાશ થઈ ગયો છે, તેને ક્ષપક સૂક્ષ્મસાંપરાય ગુણસ્થાન કહે છે.

**સૂક્ષ્મસાંપરાય પ્રવિષ્ટ શુદ્ધિસંયત સંબંધી સ્પષ્ટીકરણ :-**  
સૂક્ષ્મ = અત્યંત હીન અનુભાગ.

સામ્પરાય = કષાય, પ્રવિષ્ટ = પ્રવેશ પ્રાપ્ત,  
શુદ્ધિ = શુદ્ધદ્યોપથોગ, સંયત = શુદ્ધાત્મસ્વરૂપમાં સમ્યકૃપણે લીન.

અત્યંત હીન અનુભાગ સહિત લોભકષાયના વેદન સહિત, વિશિષ્ટ વૃદ્ધિગત, શુદ્ધાત્મસ્વરૂપમાં લીન, શુદ્ધદ્યોપથોગ પરિણામ ચુક્ત જીવ, સૂક્ષ્મસાંપરાય પ્રવિષ્ટશુદ્ધિસંયત છે.

**સમ્યકૃત્વ અપેક્ષા વિચાર :**

દ્વિતીયોપશમ અને ક્ષાયિક સમ્યકૃત્વ, આ બંને સમ્યકૃત્વમાંથી કોઈપણ એક સમ્યકૃત્વ અહીં રહે છે. જો મુનિરાજ ઉપશમક સૂક્ષ્મસાંપરાય ગુણસ્થાનવર્તી છે તો તેઓને દ્વિતીયોપશમ સમ્યકૃત્વ અને ક્ષાયિક

સમ્યકૃત્વ - આ બંનેમાંથી કોઈ એક સમ્યકૃત્વ રહે છે. જો મુનિરાજ ક્ષપક સૂક્ષ્મસાંપરાય ગુણસ્થાનવર્તી છે તો તેઓને નિયમથી ક્ષાચિક સમ્યકૃત્વ જ હોય છે.

### ચારિત્ર અપેક્ષા વિચાર :

સૂક્ષ્મસાંપરાય ગુણસ્થાનમાં ઉપશમકને ઔપશમિક ચારિત્ર અને ક્ષપકને ક્ષાચિક ચારિત્ર હોય છે. આ જ ચારિત્રને સૂક્ષ્મસાંપરાય ચારિત્ર પણ કહે છે, કારણ કે અહીં માત્ર સૂક્ષ્મલોભ કખાયનો ઉદ્ય તથા તદ્દનુસાર સૂક્ષ્મલોભ પરિણામ થાય છે. (વિશેષ માટે જુઓ-ઘવલા પુસ્તક-૫, પાના નં.૨૦૫, ગોમટસાર જીવકાંડ જાથી ૧૪, ગોમટસાર કર્મકાંડ જાથી ૮૨૦ની ટીકા તથા ભાવદીપિકા પા.૨૨૫, ૨૩૪)

વૃદ્ધિગત સમ્યકૃત્યારિત્રમાં ઉત્પન્ન સૂક્ષ્માતિસૂક્ષ્મ દોષને બતાવવાવાળા ગુણસ્થાનનું નામ સૂક્ષ્મસાંપરાય ગુણસ્થાન છે.

આ દસમાથી આગળના ગુણસ્થાનોમાં ચારિત્રની અપેક્ષાથી દોષોની વાત જ નથી, કારણ કે ઉપશાંતમોહ આદિ સર્વ ગુણસ્થાન સર્વથા વિતરાગરૂપ જ છે.

સાતમાં ગુણસ્થાનથી લઇને આગળના ગુણસ્થાનોમાં ચારિત્ર સંબંધી વૃદ્ધિનું સ્વરૂપ કાંઈક વિશિષ્ટ જ છે, કારણ કે તેની બાબુ પ્રવૃત્તિમાં કાંઈ પરિવર્તન જોવામાં આવતું નથી. છતાંય અંતરંગમાં ઉત્તરોત્તર વિશેષરૂપથી ચારિત્ર વધતું જ જાય છે. વધતાં થકા ચારિત્રની તથા લોભકખાયની અંતિમ કડીનું નામ સૂક્ષ્મસાંપરાય છે. દસમા ગુણસ્થાનના સૂક્ષ્મસાંપરાયરૂપ દોષને માત્ર આગમપ્રમાણથી જાણી શકીએ છીએ. બીજુ કાંઈ બાહ્યક્રિયા આદિ ઉપાય નથી.

### કાળ અપેક્ષા વિચાર :

જધન્યકાળ : જો કોઈ મહામુનિરાજ ઉપશમક સૂક્ષ્મસાંપરાય ગુણસ્થાનમાં ઓછામાં ઓછા માત્ર એક સમય રહી શકે છે, તે પણ મૃત્યુની અપેક્ષાથી. જેમ :- ૧) કોઈ મહામુનિરાજ ઉપશાંતમોહ ગુણસ્થાનથી નીચે ઉત્તરતાં સમય સૂક્ષ્મસાંપરાય ગુણસ્થાનમાં એક સમય રહે અને તત્કાળ મનુષ્યાચુનો ક્ષય થઈ જાય તો મરણાની અપેક્ષાએ સૂક્ષ્મસાંપરાય ગુણસ્થાનનો જધન્યકાળ એકસમય હોઈ શકે છે.

૨) ઉપશમક અનિવૃત્તિકરણ ગુણસ્થાનથી ઉપર ચડતા સમયે કોઈ

મુનિરાજ સૂક્ષ્મસાંપરાય ગુણસ્થાનમાં માત્ર એકસમય આડુછ થયા અને તત્કાળ મનુષ્યાયુનો ક્ષય થઈ જાય તો પણ સૂક્ષ્મસાંપરાય ગુણસ્થાનનો જધન્યકાળ એક સમય ઘટિત થાય છે.

**ઉત્કૃષ્ટ કાળ :** સૂક્ષ્મસાંપરાય ગુણસ્થાનનો ઉત્કૃષ્ટકાળ ચથાયોગ્ય એક અંતર્મુહૂર્ત છે. જો ઉપશમક સૂક્ષ્મસાંપરાય ગુણસ્થાનવર્તી મુનિરાજ વધારેમાં વધારે આ દસમા ગુણસ્થાનમાં રહે તો ચથાયોગ્ય માત્ર એક અંતર્મુહૂર્ત રહી શકે છે.

ક્ષપક સૂક્ષ્મસાંપરાય ગુણસ્થાનનો ઉત્કૃષ્ટકાળ તો ચથાયોગ્ય એક જ અંતર્મુહૂર્ત છે. ક્ષપકનો જધન્યકાળ કે મદ્યમકાળ હોતો જ નથી.

**મદ્યમકાળ :** ઉપશમક સૂક્ષ્મ સૂક્ષ્મસાંપરાય ગુણસ્થાનના બે સમય, ત્રણ, ચાર, પાંચ આદિ સમયોથી લઇને ચથાયોગ્ય એક અંતર્મુહૂર્ત કાળની વચ્ચેનો સમય દસમા ગુણસ્થાનનો મદ્યમકાળ થઈ શકે છે, તે પણ મરણાની અપેક્ષા.

**ગમનાગમનનો અપેક્ષા વિચાર :**

**ગમન :** ૧) ઉપશમક સૂક્ષ્મસાંપરાય ગુણસ્થાનવર્તી મહામુનિરાજ ઉપરની તરફ ઉપશાંતમોહ ગુણસ્થાનમાં જ ગમન કરે છે.

૨) ઉપશમશ્રેણીથી ઉત્તરતા સમય સૂક્ષ્મસાંપરાય મુનિરાજ જ દસમા ગુણસ્થાનથી નીચે નવમા અનિવૃત્તિકરણ ગુણસ્થાનમાં ગમન કરે છે.

૩) જો ઉપશમક સૂક્ષ્મસાંપરાય ગુણસ્થાનવર્તી મુનિરાજનું મરણ થઈ જાય તો વિગ્રહગતિના સમયે તેમનું ચોથા ગુણસ્થાનમાં જ ગમન થાય છે.

૪) ક્ષપક સૂક્ષ્મસાંપરાય ગુણસ્થાનવર્તી મહામુનિરાજ ક્ષીણમોહ ગુણસ્થાનમાં જ ગમન કરે છે.

**પ્રશ્ન ૮૫ :** ક્ષપક સૂક્ષ્મસાંપરાય ગુણસ્થાનવર્તી મુનિરાજ ઉપશાંતમોહ ગુણસ્થાનમાં ગમન શા માટે નથી કરતા ?

**ઉત્તર :** ચારિત્રમોહનીય કર્મનો કર્મશાઃ ક્ષય અર્થાત् નાશ કરતા-કરતા પૂર્ણ વીતરાગતાને અભ્વકાળમાં પ્રાપ્ત કરશે. તેથી તે નિયમથી ક્ષીણ મોહ ગુણસ્થાનમાં જ ગમન કરે છે; અચ્યારમાં ઉપશાંતમોહ ગુણસ્થાનમાં નહીં.

ક્ષપકશ્રેણીના ગુણસ્થાનોમાં ઉપશમશ્રેણીનું ૧૧મું ગુણસ્થાન નથી આવતું કારણ કે ક્ષપક અને ઉપશમકનો માર્ગ પરસ્પર નિયમથી બિનન છે.

**આગમન :** ૧) ઉપશમક સૂક્ષ્મસાંપરાય ગુણસ્થાનમાં આગમન નીચેના

ઉપશમક અનિવૃત્તિકરણ ગુણસ્થાનથી જ થાય છે.

૨) શ્રેણીથી ઉત્તરતા સમયે ઉપરના ઉપશાંતમોહ ગુણસ્થાનથી પણ સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનમાં આગમન થાય છે.

૩) ક્ષપક સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનમાં આગમન માત્ર ક્ષપક અનિવૃત્તિકરણ ગુણસ્થાનથી થાય છે.

### વિશેષ અપેક્ષા વિચાર:

૧) અનંતગુણી વિશુદ્ધિ આદિ આવશ્યક કાર્ય આઠમા ગુણસ્થાનવત આ સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનમાં પણ સતત થતાં જ રહે છે.

૨) દસમા ગુણસ્થાનના નામને અનુસાર જ દસમામાં સૂક્ષ્મલોભ ક્ષાયનો ઉદ્ય રહે છે અને ઉદ્યના નિમિત્તથી અબુદ્ધિપૂર્વક સૂક્ષ્મલોભ પરિણામ પણ થતાં રહે છે. છતાંચ સૂક્ષ્મલોભરૂપ ચારિત્રમોહનીય વિભાવ પરિણામથી ચારિત્ર મોહનીય કોઇ, માન, માયા, લોભ અથવા હાસ્યાદિ નવ નોક્ષાયોમાંથી કોઈનો પણ નવો કર્મબંધ થતો નથી.

પ્રશ્ન ૮૫ : સૂક્ષ્મલોભ ક્ષાય નામના ક્રિયકર્મના ઉદ્યથી સૂક્ષ્મલોભરૂપ પરિણામ પણ મુનિરાજને થાય છે. એવી સ્થિતિમાં ઓછામાં ઓછા સૂક્ષ્મલોભનો બંધ થવો જ જોઈએ ને ? આપ નવા કર્મબંધ ન થવાની વાત કેમ અને કયા આધારે કરો છો ?

ઉત્તર : લોભરૂપ ક્ષાય પરિણામ અત્યંત સૂક્ષ્મ છે, જધન્ય છે. માટે ચારિત્રમોહનીય કર્મનો બંધ નથી થતો. સૂક્ષ્મલોભ કર્મના ઉદ્યાનુસાર અબુદ્ધિપૂર્વક સૂક્ષ્મલોભના જધન્ય પરિણામ થાય છે. જ્યારે મોહ પરિણામ જધન્ય હોય છે ત્યારે નવા મોહ કર્મનો બંધ નથી થતો. એવો કર્મ બંધનો એક અટલ નિયમ છે.

જો જધન્ય ભાવરૂપ સૂક્ષ્મલોભ થવા પર પણ નવા સૂક્ષ્મલોભ કર્મનો નવો બંધ પણ થતો રહેશે તો ક્યારેય જીવને મુક્તિ થશે જ નહીં. જો સૂક્ષ્મલોભથી પણ સૂક્ષ્મલોભનો બંધ માનશું તો સૂક્ષ્મલોભનો ઉદ્ય આવતો રહેશે અને સૂક્ષ્મલોભનો બંધ થતો રહેશે તો જીવને ક્યારેય મુક્તિ મળશે જ નહીં.

આ અતિ મહત્વપૂર્ણ વિષયને પંચાસ્તિકાય ગાથા ૧૦૩ની ટીકામાં સ્પષ્ટ કરેલ છે.

“જે કર્મબંધની પરંપરાનું પ્રવર્તન કરાવવાળી રાગ - છે પરિણાતિને

ઇહે છે, તે પુરુષ, વાસ્તવમાં જેનો સ્નેહ (રાગાદિરૂપ ચીકાશ) જીર્ણ થાય છે, એવો જધન્ય સ્નેહ(સ્પર્શગુણની પર્યાયરૂપ ચીકાશ). જે પ્રકારે જધન્ય ચીકાશની સન્મુખ વર્તતા થકા પરમાણુ ભાવીબંધથી પરાન્મુખ છે, તે જ પ્રકારે જેના રાગાદ જીર્ણ થઈ જાય છે એવો પુરુષ ભાવીબંધથી પરાન્મુખ છે. ગુણની સન્મુખ વર્તતા થકા પરમાણુની જેમ ભાવીબંધથી પરાન્મુખ વર્તતા થકા, પૂર્વ બંધથી છૂટતા થકા, અનિનતમ જળની દુઃસ્થિતિ સમાન જે દુઃખ તેનાથી પરિમુક્ત થાય છે.” (જુઓ તત્ત્વાર્થ સૂત્ર અધ્યાય પણું સૂત્ર ક્રમાંક ૩૪)

માટે દસમા ગુણસ્થાનમાં અત્યંત સૂક્ષ્મરૂપ લોભ પરિણામ થવાથી કોઈપણ પ્રકારના નવા કષાય અને નોકષાય મોહકર્મનો કર્મબંધ થતો નથી.

૩) સૂક્ષ્મલોભ પરિણામથી મોહકર્મનો બંધ તો નથી થતો, છતાંચ આ જ અબુદ્ધિપૂર્વક સૂક્ષ્મલોભ પરિણામથી જ્ઞાનાવરણ, દર્શનાવરણ, અંતરાય - આ ત્રણે ઘાતિકર્મો તથા સાતાવેદનીય આદિનું અંતર્મુહૂર્ત પ્રમાણ સ્થિતિનું અભ્ય અનુભાગ સહિત બંધ તો થાય જ છે.

જુઓ, પરિણામ અને કર્મબંધની વિચિત્રતા ! ક્ષપક - દસમા ગુણસ્થાનવર્તી આ જ મહામુનિરાજ માત્ર એક જ ચથાયોગ્ય અંતર્મુહૂર્તકાળ વ્યતીત થતાં જ બારમાં ક્ષીણમોહ ગુણસ્થાનને નિયમથી પ્રાસ કરે છે. બારમાં ગુણસ્થાનના અંતિમ સમયમાં જ આ ત્રણે ઘાતિકર્મનો ક્ષય પણ કરવાવાળા છે, કારણ કે તેઓ અંતર્મુહૂર્તમાં જ સર્વજ્ઞ ભગવાન થવાના છે. છતાંચ જ્યાંસુધી દસમા ગુણસ્થાનમાં છે ત્યાં સુધી ત્રણે ઘાતિકર્મનો બંધ થતો જ રહે છે.

બંધ થવાનું આ છેલ્લાં ગુણસ્થાન છે. ક્ષીણમોહ ગુણસ્થાન તથા તેનાથી આગળના ગુણસ્થાનોમાં બંધ થતો નથી, કારણ કે બંધનું કારણ મોહભાવનો પૂર્ણરીતે નાશ થઈ ગયો છે.

૪) અહીં સાંપરાય શબ્દ અંતદીપક છે. તેથી આ સૂક્ષ્મસાંપરાય નામના દસમા ગુણસ્થાનવાળા સાંપરાય અર્થાત સૂક્ષ્મ કષાય સહિત જ છે.

મિથ્યાત્પ ગુણસ્થાનથી લઈને સૂક્ષ્મસાંપરાય ગુણસ્થાનવર્તી સર્વ જીવ નિયમથી કષાય સહિત છે. આ સમજવા માટે પ્રથમ ગુણસ્થાનથી બધા દસે ગુણસ્થાનોને નિમનાનુસાર લખી શકીએ છીએ. જેમ કે - સાંપરાય મિથ્યાત્પ, સાંપરાય સાસાદન સમયકૃત્વ, સાંપરાય મિશ્ર, સાંપરાય અવિરતસમ્યકૃત્વ આદિ.

### ઘવલા પુસ્તક - ૧નો અંશ (પાના નં. ૧૮૮ થી ૧૮૯)

સૂક્ષ્મસાંપરાયપ્રવિષ્ટશુદ્ધિસંયતોમાં ઉપશમક અને ક્ષપક બંને છે. ॥૧૮॥

સૂક્ષ્મ કષાયને સૂક્ષ્મસાંપરાય કહે છે. તેમાં જે સંયતોની શુદ્ધિએ પ્રવેશ કર્યો છે, તેને સૂક્ષ્મસાંપરાયપ્રવિષ્ટશુદ્ધિસંયત કહે છે. તેમાં ઉપશમક અને ક્ષપક બંને હોય છે અને સૂક્ષ્મસાંપરાયની અપેક્ષા તેમાં ભેદ ન હોવાથી ઉપશમક અને ક્ષપક, આ બંનેનું એક જ ગુણસ્થાન હોય છે. આ ગુણસ્થાનમાં અપૂર્વ અને અનિવૃત્તિ આ બંને વિશેષણોની અનુવૃત્તિ થાય છે. માટે આ બંને વિશેષણ પણ સૂક્ષ્મસાંપરાય શુદ્ધિસંયતની સાથે જોડી લેવા જોઈએ, અન્યથા પૂર્વવતી ગુણસ્થાનોથી આ ગુણસ્થાનની કોઈપણ વિશેષતા નથી થઈ શકતી.

**વિશેષાર્થ :** જે દસમા ગુણસ્થાનમાં અપૂર્વ વિશેષણની અનુવૃત્તિ નહીં થાય તો તેમાં પ્રતિસમય અપૂર્વ અપૂર્વ પરિણામોની સિદ્ધિ નહીં થઈ શકે અને અનિવૃત્તિ વિશેષણની અનુવૃત્તિ નહીં માનવાથી એક સમયવતી જીવોના પરિણામોમાં સમાનતા અને કર્મોના ક્ષપણ અને ઉપશમનની યોગ્યતા સિદ્ધ થતી નથી. માટે પૂર્વ ગુણસ્થાનોથી આમાં સર્વથા બિજન જાતિના જ પરિણામ હોય છે, આ વાતને સિદ્ધ કરવા માટે અપૂર્વ અને અનિવૃત્તિ, આ બે વિશેષણોની અનુવૃત્તિ કરી લેવી જોઈએ. આ પ્રકારે આ ગુણસ્થાનમાં અપૂર્વતા, અનિવૃત્તિપણું અને સૂક્ષ્મસાંપરાયપણારૂપ વિશેષતા સિદ્ધ થઈ જાય છે.

આ ગુણસ્થાનમાં જીવ કેટલીયે પ્રવૃત્તિઓનો ક્ષય કરે છે, આગળ ક્ષય કરશે અને પૂર્વમાં ક્ષય કરી ચૂક્યો, માટે આમાં ક્ષાયિકભાવ છે. તથા કેટલીક પ્રકૃતિઓનો ઉપશમ કરે છે, આગળ ઉપશમ કરશે અને પહેલા ઉપશમ કરી ચૂક્યો, માટે આમાં ઔપશમિક ભાવ છે. સમ્યક્ષદર્શનની અપેક્ષાએ ક્ષપક શ્રેણીવાળા ક્ષાયિકભાવ સહિત છે અને ઉપશમ શ્રેણીવાળા ઔપશમિક તથા ક્ષાયિક આ બંને ભાવોથી ચુક્તા છે, કારણ કે બંનેય સમ્યક્ષત્વોથી ઉપશમશ્રેણીનું ચંડવું સંભવ છે. આ સૂત્રમાં ગ્રહણ કરેલ સંયતપદની પૂર્વવત અર્થાત् અનિવૃત્તિકરણ ગુણસ્થાનમાં બતાવવામાં આવેલ સંયતપદની સફળતાની સમાન સફળતા સમજી લેવી જોઈએ. કહ્યું પણ છે -

પૂર્વસ્પર્ધક અને અપૂર્વસ્પર્ધકના અનુભાગથી અનંતગણા હીન અનુભાગવાળા સૂક્ષ્મલોભમાં જે સ્થિત છે, તેને સૂક્ષ્મસાંપરાય ગુણસ્થાનવતી જીવ સમજવો જોઈએ.

۹۹

ઉપશાંતમોહ ગુણસ્થાન

અગ્યારમાં ગુણસ્થાનનું નામ ઉપશાંતમોહ છે. શ્રેણીના ચારે ગુણસ્થાનોમાં ઉપશાંતમોહ ઉપશમશ્રેણીનું અંતિમ ગુણસ્થાન છે. એક અપેક્ષાથી વિચારીએ તો ઉપશમશ્રેણીના ફળરૂપ આ ગુણસ્થાન છે.

ચારિત્રમોહનીય કર્મના ઉપશમનો પ્રારંભ ઉપશમક અપૂર્વકરણ ગુણસ્થાનના પહેલા સમયથી ચાલુ થયો હતો અને તે ઉપશમનું કાર્ય દસ મા ગુણસ્થાનના અંતિમ સમયમાં કહો અથવા અગ્યારમાં ગુણસ્થાનના પહેલા સમયમાં કહો, પરિપૂર્ણ થયું છે. આને જ આ પ્રકારે સમજુ શકીએ છીએ.....

સૂક્ષ્મલોભ કખાયનો વ્યય અને વીતરાગતાનો ઉત્પાદ એક સમયવતી છે, કારણ કે ઉત્પાદ અને વ્યય બંને એક જ સમયમાં ઉત્પન્ન થાય છે, આ વસ્તુ વ્યવસ્થાનું સ્વરૂપ છે.

અંતમાં ચારે ગુણસ્થાન પરિપૂર્ણ વીતરાગીઓના ગુણસ્થાન છે, તેમાં આ ઉપશાંતમોહ ગુણસ્થાન પ્રથમ ગુણસ્થાન છે. અગ્યારમાં ગુણસ્થાનવર્તી આ સુનીક્ષર પૂર્ણ સુખી થઈ ગયા છે.

**પ્રશ્ન ૮૭:** આઠેય કર્મોની સત્તા હોવા છતાં અને સાતે કર્મોનો ઉદ્ય હોવા છતાં ઉપશાંતમોહી મુનિરાજ પૂર્ણસુખી કેમ હોઈ શકે ?

ઉત્તર : દુઃખનું મૂળ કારણ એક મોહ પરિણામ જ છે. ઉપશાંતમોહ ગુણસ્થાનવતી મહામુનિરાજને મોહનો પૂર્ણ ઉપશમ થઈ ગયો છે. તેઓને રંચમાત્ર પણ મોહ પરિણામ નથી રહ્યો, તેથી તે પૂર્ણ સુખી છે. સત્તામાં સ્થિત કર્માનું વર્તમાન કાળના ભાવોથી કાંઈ સંબંધ નથી રહેતો.

શેષ ક્રયમોહ કર્મ દબાયેલા છે. અંતમુહૂર્ત કાળ (ઉપશાંતમોહ

ગુણસ્થાનનો કાળ) સમાસ થતા જ ચારિત્રમોહ કર્મનો ઉદ્ય પોતાની ચોગ્યતાથી થાય છે. છતાંચ જેટલા સમય સુધી ઉપશાંતમોહી અર્થાત્ વીતરાગી છે, તેટલા કાળ સુધી તે પૂર્ણ સુખી છે. જ્ઞાનાવરણાદિ ત્રણે ઘાતિકર્મનો ઉદ્ય થવાથી તે અલ્પજ્ઞાની કહેવાય છે, માટે અનંત સુખી નથી. મોહ પરિણામનો જેટલા કાળ સુધી સર્વથા ઉદ્યાભાવ છે, તેટલા કાળ સુધી તે પૂર્ણ સુખી જ છે.

આ વિષયનો ભાવ મોક્ષમાર્ગ પ્રકાશક પાના -૪૨ પર આ રીતે વ્યક્ત કર્યો છે : - “જેટલી-જેટલી ઈછા ઘટે તેટલું-તેટલું દુઃખ દૂર થાય છે અને જ્યારે મોહના સર્વથા અભાવથી સર્વ ઈછાનો અભાવ થાય ત્યારે બધું દુઃખ દૂર થાય છે, સાચું સુખ પ્રગટ થાય છે.” “સર્વ દુઃખ દૂર થાય છે” આનો જ અર્થ સુખ પૂર્ણ હોય છે, એ સ્પષ્ટ થયું.

પાપ કર્મની સત્તા હોવાથી કોઈ જીવનો કાંઈ બગાડ થતો નથી અને પુણ્ય કર્મની સત્તા હોવાથી કોઈ જીવનો કાંઈ સુધાર થતો નથી.

જો જીવ મોહ પરિણામ કરે છે તો જીવનો બગાડ છે, કારણ કે મોહ સ્વયં દુઃખમય ભાવ છે. જો જીવ મોહ પરિણામ નથી કરતો તો જીવનો સુધાર થાય છે, કારણ કે મોહના અભાવથી ઉત્પન્ન વીતરાગભાવ સુખમય છે.

જ્યારે જીવ પોતાના અનાદિકાળના અજ્ઞાનવશ કુસંસ્કારોના અપરાધથી મોહ પરિણામ કરે છે, તે જ સમય પૂર્વબદ્ધ મોહકર્મનો ઉદ્ય નિમિત્તરૂપથી રહે જ છે.

જેમ કે મુનિરાજ પાર્શ્વનાથ પર મુનિજીવનમાં જ્યારે કમઠ ઉપર્સર્ગ કરી રહ્યો હતો, ત્યારે તેમના ભવિષ્યમાં ઉદ્યમાં આવવાવાળી તીર્થીકર પ્રકૃતિની સત્તાએ કાંઈ મદદ નહોતી કરી. તેમ જ અહીં મોહનીય કર્મ સત્તામાં હોવા છતાં તે માટીના ઢેઝા સમાન જ છે. તેનો વર્તમાનકાળના ભાવોથી કોઈપણ નિમિત્ત-નૈમિત્તિક સંબંધ નથી. આચાર્યશ્રી નેમિયંડ્રેવે ગોમ્મટસાર જીવકાંડ ગાથા ૫૧માં ઉપશાંતમોહ ગુણસ્થાનની પરિભાષા આ પ્રકારે આપેલ છે :-

કદ્મકફલનજુદજલંવા, સરએસરવાળિયંવળિમ્મલયં ।

સયલોવસંતમોહો, ઉવસંત કસાયઓ હોદિ ॥

નિર્મલી ઇન સહિત સ્વચ્છ જગના સમાન અથવા શરદકાળના

સરોવર જળ સમાન સર્વ મોહોપશમનના સમયે વ્યક્ત થવાવાળી પૂર્ણ વીતરાગી દશાને ઉપશાંત ગુણસ્થાન કહે છે.

પરિલાખામાં ઉપશાંતમોહી જીવના વીતરાગી પરિણામને સ્વરચ્છ જળની ઉપમા આપી છે. કટકફળ (નિર્મળી નામની વનસ્પતિનું બીજ જે મલિન જળને નિર્મળ બનાવવા માટે ઉપયોગમાં લેવાય છે.)થી નિર્મળ કરેલ જળ અર્થાત્ જળ તો નિર્મળ થયું છે, છતાંચ મળ નીચે દબાયેલો સત્તામાં છે. આ પહેલા દ્રષ્ટાંતનો ભાવ છે.

બીજું દ્રષ્ટાંત શરદકાળના સરોવરનું છે. અહીં પણ જળનો નિર્મળ છે, પરંતુ નીચે કાદવ-કીચડનું અસ્તિત્વ છે, છતાંચ વર્તમાનમાં તે સ્વરચ્છ જળમાં મુખ અથવા ચંદ્રમાનું પ્રતિબિંબ જેમનું તેમ જ ઝલકે છે.

આનો ભાવ એ છે કે વર્તમાનકાળમાં તો વીતરાગભાવ પૂર્ણ નિર્મળ છે, છતાંચ એક અંતર્મુહૂર્ત પછી જ પૂર્વ સંસ્કારયશ પોતાના અપરાધથી, કાળજીય કે આચુક્ય થઈ જવાથી રાગાદૃષ્ટપ પરિણમિત થઈ જાય છે. અગ્યારમાં ગુણસ્થાનમાં ચારિત્રમોહનીય કર્મની ૨૧ પ્રકૃતિઓનું અંતરકરણારૂપ ઉપશમ થયેલ છે.

**પ્રશ્ન ૮૮ :** અંતરકરણારૂપ ઉપશમ કોણે કહે છે ?

**ઉત્તર :** અધકરણાદિ દ્વારા ઉપશમ વિદ્યાનથી અનંતાનુંબંધી ચતુર્ષટ્ય વગર મોહનીયકર્મની જે ઉપશમના હોય છે, તેને પ્રશસ્ત ઉપશમ કહે છે. તેને જ અંતરકરણારૂપ ઉપશમ પણ કહેવાય છે.

◆ આગામીકાળમાં (ભવિષ્યકાળમાં) ઉદ્યમાં આવવા ચોગ્ય કર્મ પરમાણુઓને જીવના પરિણામ વિશેષરૂપ નિમિત્ત થવાથી આગળ-પાછળ ઉદ્યમાં આવવા ચોગ્ય થવાને અંતરકરણારૂપ ઉપશમ કહે છે. (વિશેષમાટે જુઓ પરિશિષ્ટ કહ્માંક ૫)

અહીં ચારિત્રમોહનીયની ૨૧ પ્રકૃતિઓને ઉપરિતન તથા અધસ્તનસ્થિતિમાં વહેંચી વચ્ચેનો કાંઈક ભાગ ૨૧ ચારિત્રમોહનીય કર્મોથી રહિત કરવામાં આવેલ છે. જ્યારે જીવ અધસ્તન-સ્થિતિના કર્મોના ઉદ્યને પૂર્ણ લોગવીને ખાલી જગ્યામાં આવે છે, ત્યારે સ્વયં જ કર્મના રહિતપણાં કારણ જીવને ક્ષાયિક ચારિત્રના જેવું ઓપશમિક નિર્મળતારૂપ પૂર્ણ વીતરાગ ચારિત્ર થઈ જાય છે.

આ અગ્યારમાં ગુણસ્થાનનું પૂર્ણ નામ “ઉપશાંતકષાય-વીતરાગ

ઇઝસ્થ" છે.

**ઉપશાંતકષાય વીતરાગ ઇઝસ્થ સંબંધી સ્પષ્ટીકરણ :**

ઉપશાંતકષાય = દલાયેલો કષાય, વીતરાગ = વર્તમાનકાળમાં સર્વ પ્રકારના રાગાદિથી રહિત, ઇઝ = જ્ઞાનાવરણ - દર્શનાવરણના સદ્ભાવમાં વિદ્યમાન અલ્પજ્ઞાન-દર્શન, સ્થ = સ્થિત રહેવાવાળા અર્થાત્ જ્ઞાનાવરણ - દર્શનાવરણના સદ્ભાવમાં સ્થિત રહેવાવાળા.

સર્વ પ્રકારના કષાય ઉપશાંત થઈ જવાથી વર્તમાનમાં સર્વ રાગાદિના અભાવરૂપ વીતરાગતા પ્રગટ થવા છતાં પણ જ્ઞાનાવરણાદિકનો ક્ષ્યોપશમ થવાથી ઇઝસ્થ, અલ્પજ્ઞ જ છે.

**સમ્યકૃત્વ અપેક્ષા વિચાર :**

ઉપશાંત મોહી મુનિરાજ દ્વિતીયોપશમ સમ્યકૃત્વ અથવા ક્ષાયિક સમ્યકૃત્વ - આ બંને સમ્યકૃત્વોમાંથી કોઈપણ એક સમ્યકૃત્વના ધારક હોઈ શકે છે. કોઈપણ સમ્યકૃત્વને કારણ આ ઉપશાંતમોહ ગુણસ્થાનના સામાન્ય સ્વરૂપમાં અથવા સુખાદિમાં કાંઈ ફરક નથી પડતો.

**ચારિત્ર અપેક્ષા વિચાર :**

અહીં ઔપશામિક ચથાખ્યાત ચારિત્ર છે.

હવે આ અગ્યારામાં ઉપશાંતમોહ ગુણસ્થાનના પ્રથમ સમયમાં જ શેષ સૂક્ષ્મ લોભકષાયનો ઉદ્ય તથા સૂક્ષ્મલોભ પરિણામ - બંને ઉપશામિત થઈ ગયા છે.

**પ્રશ્ન ૮૮ :** અનંતાનુબંધી ચારે કષાયોનું શું થયું ? બતાવશો ?

**ઉત્તર :** જો ઉપશાંતમોહી મુનિરાજ ક્ષાયિક સમ્યકૃત્વિ છે તો તેમના અનંતાનુબંધી કષાયોનો અભાવ ક્ષાયિક સમ્યકૃત્વ થવા પહેલા જ વિસંયોજન દ્વારા થઈ ગયો છે.

જો ઉપશાંતમોહી મુનિરાજ દ્વિતીયોપશમ સમ્યકૃત્વના ધારક છે તો ઉપશામશૈણી પર આરૂઢ થવા પૂર્વે સાતિશાય અપ્રમત્ત અવસ્થામાં જ તેમનું ક્ષાયોપશામિક સમ્યકૃત્વ દ્વિતીયોપશમ સમ્યકૃત્વરૂપમાં પરિણામી જાય છે. તે સમયે અનંતાનુબંધી ચતુર્થ્યની વિસંયોજના કે સદ્ભાવસ્થારૂપ ઉપશામ થઈ જાય છે. માટે તેના અનંતાનુબંધીની સત્તા ભજનીય છે અર્થાત્ સત્તા હોય પણ અને ન પણ હોય.

**પ્રશ્ન ૧૦૦ :** વિસંયોજના કોને કહે છે ?

ઉત્તર : અનંતાનુંબંધી ચારે કષાયોના અપ્રત્યાખ્યાનાવરણાદિ બાર કષાય અને હાસ્યાદિ નવ નોકષાયરૂપથી પરિણામિત થવાને વિસંયોજના કહે છે. આ વિસંયોજનાનું કાર્ય ચોથા ગુણસ્થાનથી લઈને સાતમા ગુણસ્થાન સુધી ક્યાંચ પણ થઈ શકે છે.

ઉપશાંતમોહ ગુણસ્થાનના પ્રથમ સમયથી જ ઔપશમિક ચારિત્ર જેનું બીજું નામ ઔપશમિક યથાખ્યાતચારિત્ર છે, તે પ્રગટ થઈ જાય છે. આ ગુણસ્થાનના પ્રથમ સમયથી લઈને અંતિમ સમય સુધી એક જ પ્રકારની વીતરાગતા, નિર્મણતા, શુદ્ધિ રહે છે. તેથી ચારિત્ર એક જ પ્રકારનું ઔપશમિક યથાખ્યાતચારિત્ર રહે છે.

મોહ પરિણામનો અભાવ આટલી વિવક્ષા લઈને વિચારીએ તો બારમાં, તેરમાં, ચૌદમાં ગુણસ્થાનોમાં જે ક્ષાયિક યથાખ્યાતચારિત્ર છે તેમાં અને અગ્નિયારમાં ગુણસ્થાનના ઔપશમિક યથાખ્યાતચારિત્રમાં તલમાત્રનો પણ અંતર નથી. મોહકર્મની સત્તાનો સદ્ગ્રાવ અને ક્ષયરૂપ અભાવની અપેક્ષાથી જે અંતર છે, તે વિષય અહીં ગોણ છે.

૧૧માં ગુણસ્થાનના કાળ સંબંધી જઘન્ય, ઉતૃષ્ટ તથા મદ્યમ એમ ત્રણ બેદ હોય છે. ૧૨માં ગુણસ્થાનના કાળ સંબંધી કોઈ બેદ નથી.

ઇતાંચ આ અગ્નિયારમાં ગુણસ્થાનથી મહામુનિરાજ ક્રમઃ નીચે કાળક્ષય અથવા આચુક્ષયની અપેક્ષાએ ઉત્તરે જ છે. આ વિષયમાં મોક્ષમાર્ગ પ્રકારાકના પાણા રક્પણો અંતિમ પરિચ્છેદ જોવા જેવો છે.

“જુઓ, પરિણામોની વિચિત્રતા ! કોઈ જીવ તો ૧૧માં ગુણસ્થાનમાં યથાખ્યાતચારિત્ર પ્રાપ્ત કરીને ફરી મિથ્યાફ્રષ્ટ થઈ કિંચિત ન્યૂન અર્ધપુદ્ગલ પરાવર્તન કાળ સુધી સંસારમાં રખે છે અને કોઈ નિત્ય નિગોદથી નીકળી, મનુષ્ય થઈ, મિથ્યાત્વ છૂટ્યા પછી અંતમુહૂર્તકાળમાં કેવળજ્ઞાન પ્રાપ્ત કરે છે. એવું જાણી પોતાના પરિણામ બગડવાનો ભય રાખવો અને તેને સુધારવાનો ઉપાય કરવો.”  
કાળ અપેક્ષા વિચાર :

**જઘન્યકાળ :** કોઈ મુનિરાજે દસમાં ગુણસ્થાનથી પોતાની વીતરાગતાને ઉત્તરોત્તર વધારતા-વધારતા અગ્નિયારમાં ઉપશાંતમોહ ગુણસ્થાનમાં પ્રવેશ કર્યો અને માત્ર એક સમય ઉપશાંતમોહ ગુણસ્થાનમાં ઉપશમ યથાખ્યાત ચારિત્રની સાથે પૂર્ણ વીતરાગી તથા પૂર્ણ સુખી જીવન વ્યતીત કરતા

થકા જો મળુષ્ય આચુનો ક્ષય થઈ જાય તો મૃત્યુની અપેક્ષાએ ઉપશાંત મોહ ગુણસ્થાનનો જધન્યકાળ માત્ર એક સમય જ ઘટિત થાય છે. આવી રીતે એક જ પ્રકારે જધન્યકાળ ઘટિત થાય છે.

**ઉત્કૃષ્ટકાળ:** કોઈ પણ મહામુનિરાજ જો અગ્યારમા ગુણસ્થાનમાં મૃત્યુ વગર પૂર્ણકાળ સુધી રહે છે તો ચથાયોગ્ય એક અંતર્મુહૂર્ત સુધી જ રહે છે. બધાં ઉપશાંતમોહી મુનિરાજોનો અગ્યારમાં ગુણસ્થાનનો ઉત્કૃષ્ટ કાળ સરખો જ રહે છે.

**મદ્યમકાળ:** જેમ અગ્યારમાં ગુણસ્થાનનો જધન્યકાળ મરણની અપેક્ષાએ એક સમય જાણી લીધો, તેમ જ મરણની અપેક્ષાએ જ બે, ત્રણ, ચાર, પાંચ આદિ સમયોથી લઇને ચથાયોગ્ય અંતર્મુહૂર્તમાં એક સમય ઓછા કાળ સુધી જેટલા પણ લેણ થાય છે, તે સર્વ પ્રકાર અગ્યારમાં ગુણસ્થાનનો મદ્યમકાળ સમજુ લેવો જોઈએ.

**ગમનાગમન અપેક્ષા વિચાર:**

ગમન : ૧) અગ્યારમું ઉપશાંતમોહ ગુણસ્થાન ઉપશમશ્રેણીનું અંતિમ ગુણસ્થાન છે. તેથી ઓ અગ્યારમાં ગુણસ્થાનની આગળ ક્ષીણમોહ આદિ ગુણસ્થાનોમાં ઉપશાંતમોહી મુનિરાજનું ગમન થતું નથી. ઉપશમક મુનિરાજની ઉપશાંતમોહ ગુણસ્થાન સુધી જ વિકસીત થવાની પર્યાયગત યોગ્યતા રહે છે.

જેમ કે - ખેલાડી બોલને ઉપરથી થાપો (સ્ટ્રોક) લગાવી આકાશમાં ઉછાળે છે. બોલને ઉપરથી જ્યારે સ્ટ્રોક લાગે છે ત્યારે જ બોલ કેટલો ઉપર આકાશમાં ઉછળશે તે તેનું સામર્થ્ય નિશ્ચિત થાય છે.

તેમ જ બાવલિંગી સંતોનું આંતરિક બુદ્ધિપૂર્વક પુરુષાર્થ એ જ રહે છે કે ધારાવાહીનું શુદ્ધિની ઉત્તરોત્તર વૃદ્ધિ કરતા થકા પૂર્ણતાને પ્રાપ્ત કરે. પરંતુ અબુદ્ધિપૂર્વક શ્રેણી આરોહણના સમયે અપૂર્વકરણ ગુણસ્થાનના પહેલા સમયના પુરુષાર્થ અનુસાર જ આ સ્વભાવથી જ નિશ્ચિત થઈ જાય છે કે આ મુનિરાજ ઉપરના ક્યા ગુણસ્થાન સુધી જશે. નિર્ણય કરાવવાવાળું કોઈ કર્મ અથવા અન્ય કોઈ પણ નથી.

૨) ઉપશાંતમોહ ગુણસ્થાનવતી મુનિરાજ ચથાયોગ્ય એક અંતર્મુહૂર્ત કાળ સુધી ઉપશાંતમોહ ગુણસ્થાનમાં પૂર્ણ વીતરાગી તથા પૂર્ણ સુખી રહે છે. ત્યારબાદ નીચેના ઉપશમક સૂક્ષ્મસાંપરાય ગુણસ્થાનમાં ગમન કરે છે.

અહીં એક સુનિશ્ચિત નિયમ સમજવો જોઈએ કે કોઈપણ ઉપશમક ઉપશાંત મોહગુણસ્થાનથી નીચે ઉત્તરે છે તો તે કુમુદથી છઢા ગુણસ્થાન સુધી નીચે તો નિયમથી એક પછી એક ગુણસ્થાનમાં ગમન કરે છે. અગ્યારમાંથી સીધા છઢામાં કે ચોથામાં અથવા મિથ્યાત્ત્વ ગુણસ્થાનમાં ગમન ક્યારેય અને કોઈપણ નથી કરતા.

પંડિત ભાગચંદ્રજીના ભજનનો સાચો ભાવ ન સમજવાને કારણ કોઈક લોકો બમલુદ્ધિ રાખે છે, તે ખોટું છે.

ભજનમાં આવ્યું છે કે :-

**મુનિ એકાદશ ગુણસ્થાન ચદ્રિ, ગિરત તહીં તૈં ચિત્તભ્રમ ઠાની ।**

**ભ્રમત અર્ધપુદ્ગાલ પરિવર્તન, કિંચિત ઉન કાલ પરમાની ॥**

**જીવ કે પરિણામનિ કી યહ, અતિ વિચિત્રતા દેખનું જ્ઞાની ।**

“ગિરત તહીં તૈં ચિત્તભ્રમ ઠાની” થી જીવ ઉપશાંતમોહગુણસ્થાનથી સીધો મિથ્યાત્ત્વ ગુણસ્થાનમાં ગમન કરે છે, એવું સમજવું સત્ય નથી, કારણ કે પદમાં તો તેઓએ સામાન્ય કથન કર્યું છે. ઉપર જે કુમથી નીચે ઉત્તરવાની વિધિ કહી છે, તેમજ સમજવું જોઈએ.

વાસ્તવમાં જોવા જઈએ તો શ્રેણી ચઢતા સમયે મુનિરાજની જે કુમથી કર્મની ઉપશમતા થઈ છે, અગ્યારમાંથી પાછા ફરતાં સમય વિલોમ(વિપરીત)થી તે જ ઉપશમિત ચારિત્ર મોહનીયની ૨૧ પ્રકૃતિઓની ઉદીરણા થાય છે. તેથી છઢા ગુણસ્થાન સુધી તો કુમથી જ ઉત્તરીને આવે છે. ત્યારબાદ કોઈપણ ગુણસ્થાનમાં ગમન કરી શકે છે.

૩) ઉપશમશ્રેણી ચઢતાં (આઠમાગુણસ્થાનનો પ્રથમ ભાગ છોડીને) કે ઉત્તરતા સમય ઉપશમક મુનિરાજનું કોઈપણ ગુણસ્થાનમાં મૃત્યુ સંભવ છે. અર્થાત્ મૃત્યુના અંતિમ સમય સુધી મુનિરાજની શ્રેણીનું તે જ ગુણસ્થાન રહે છે, જેમાં મરણ થાય છે. પરંતુ મરણ પછી વિશ્વહંગતિમાં તે ઉપશમક મુનિરાજ ચોથા અવિરત સમ્યકૃત્વ ગુણસ્થાનમાં જ ગમન કરે છે અને દેવગતિમાં જ જન્મ લે છે.

**આગમન :** ઉપશાંતમોહગુણસ્થાનમાં નીચેના માત્ર ઉપશમક સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનથી જ આગમન થાય છે.

**જેમ :** આઠમા, નવમા અને દસમાં - ત્રણે ગુણસ્થાનોના ઉપશમક અને ક્ષપક એમ બે ભેદ હોય છે, તેમ ઉપશાંતમોહગુણસ્થાનના ઉપશમક

અને ક્ષપક એમ બે ભેદ નથી. તેથી ઉપશાંતમોહ એક જ પ્રકારનું છે.

### વિશેષ અપેક્ષા વિચાર :

૧) અગ્યારમાં ગુણસ્થાનમાં કેવળ સાતાવેદનીયનો ઈર્યાપિથાખ્રવ માત્ર એક સમયનો જ હોય છે, ત્યારબાદ તે સિથિતિ રહિત થવાને કારણ ખરી જાય છે. અહીં સાંપરાચિક આખ્રવ નથી હોતો, કારણ કે તે ઉપશાંતમોહી મુનિરાજ પૂર્ણિપથી કષાયરહિત અર્થાત્ વીતરાગી થઈ ગયા છે.

જે કે ઈર્યા શબ્દનો અર્થ ગમન પણ છે, પરંતુ અહીં તેનો અર્થ યોગ લેવામાં આવ્યો છે. માટે ઈર્યાપથ આખ્રવનો અર્થ માત્ર યોગ દ્વારા થવાવાળા આખ્રવ થાય છે. આશય એ છે કે જેમ સુકી ભીત પર ઘૂળાઓદિ ફેંકવાથી તે તેને ન ચોટી તત્કાળ જમીન પર સરકી જાય છે, તેમ જ યોગથી ગ્રહણ કરેલા જે કર્મ, કષાયના અભાવમાં આત્માથી ન ચીપકતાં તત્કાળ અલગ થઈ જાય છે, તે ઈર્યાપથાખ્રવ છે. સંસાર પરંપરા માટેનું કારણ જે સાંપરાચિક આખ્રવ છે, તે આ અગ્યારમાં ગુણસ્થાનમાં નથી હોતું. (વિશેષ સ્પષ્ટીકરણ ધવલા પુસ્તક ૧૩માં પાનાનં ૪૭-૪૮ જુઓ)

૨) ઔપશામિક ભાવોનો સદ્ગ્રાવ આ અગ્યારમાં ઉપશાંતમોહ ગુણસ્થાન સુધી જ રહે છે.

ઔપશામિક સમ્યકૃત્વ અને ઔપશામિક ચારિત્ર આ બંને શુદ્ધભાવ તો જીવના ત્રિકાળી, સહજ, શુદ્ધાત્મસ્વભાવના આશ્રયથી જ ઉત્પન્ન થાય છે અને તેમાં કર્મનું ઉપશામ નિમિત્ત માત્ર છે.

વસ્તુ સ્વાતંત્ર્યની મુખ્યતાથી કે અદ્યાત્મની અપેક્ષા અથવા ઉપાદાન - ઉપાદેયની અપેક્ષા અથવા ધર્મ વ્યક્ત કરવાના ભાવથી વિચારીએ તો કર્મના ઉપશમના સમયે કર્મની અપેક્ષા રાખ્યા વગર જ જીવના આ બંને - સમ્યકૃત્વ તથા ચારિત્ર પરિણામ થાય છે એમ સમજવું જોઈએ.

શુદ્ધાગુણની અપેક્ષા ઔપશામિક સમ્યકૃત્વ ચોથા ગુણસ્થાનમાં પ્રગટ થાય છે. ચોથા ગુણસ્થાનથી અગ્યારમાં ગુણસ્થાન સુધી ઔપશામિક સમ્યકૃત્વભાવ રહી શકે છે.

ઔપશામિક ચારિત્રભાવનો પ્રારંભ તો ઉપશમક અપૂર્વકરણ ગુણસ્થાનના પહેલા સમયથી જ થાય છે અને તેની પૂર્ણતા આ

ઉપશાંતમોહ ગુણસ્થાનમાં થાય છે. અગ્યારમાં ગુણસ્થાનથી આગળના ગુણસ્થાનોમાં ઔપશમિક ભાવ માટે અવકાશ જ નથી.

૩) અગ્યારમાં ગુણસ્થાનના નામમાં જે 'વીતરાગ' શબ્દ આવ્યો છે, તે શબ્દ આદિ દીપક છે.

વીતરાગ શબ્દના આદિ દીપકનો ભાવ સ્પષ્ટ સમજવા માટે આપણે આ પ્રકારે કથન કરી શકીએ. જેમ કે - વીતરાગ ઉપશાંત મોહ, વીતરાગ ક્ષીણ મોહ, વીતરાગ સયોગકેવળી, વીતરાગ અયોગકેવળી, વીતરાગી સિદ્ધ ભગવાન.

ચોથા અવિરતસમ્યકૃત્વ ગુણસ્થાનથી અંશિક વીતરાગતાનો પ્રારંભ થાય છે. ચોથા ગુણસ્થાનમાં મિથ્યાત્વ તથા અનંતાનુબંધી એક કષાય ચોકડીના અભાવપૂર્વક વીતરાગતા. પાંચમા ગુણસ્થાનમાં બે કષાય ચોકડીના અભાવપૂર્વક વીતરાગતા તથા છઢા ગુણસ્થાનમાં ત્રણ કષાય ચોકડીના અભાવપૂર્વક વીતરાગતા અને સંજ્યપલન કષાય તથા નવ નોકષાયજન્ય રાગ - દ્રેષ આ રીતે, વીતરાગતા + રાગ - દ્રેષ, બંને મિશ્રઝ્ઞપ ભાવ રહે છે. આ પરિણામોની મિશ્રતા ચોથા ગુણસ્થાનથી લઈને દસમા સૂક્ષ્મસાંપરાય ગુણસ્થાન સુધી ચથાયોગ્ય પ્રત્યેક ગુણસ્થાનમાં સમજી લેવું જોઈએ.

અગ્યારમા ગુણસ્થાનના સંબંધમાં વિશેષ વિચાર:

મુનિરાજના ઉપશમશ્રેણીથી પતિત થવાના વિષયને મુખ્ય કરીને "કર્મ બળવાન છે, કર્મ જીવને સંસારમાં રખડાવે છે, કર્મની સામે કોઈકું કાંઈ નથી ચાલતું" આદિ વ્યવહારનયના કથનને સત્યાર્થ માની અજ્ઞાની જીવ જિનવાણીનો જ આધાર લઈ મિથ્યાત્વને જ પુષ્ટ કરે છે.

માટે ઉપશાંતમોહી મુનિરાજનું પતન કેમ થાય છે, આ વિષયનો આપણે ખૂબ સાવધાનીપૂર્વક નિર્ણય કરવો જોઈએ.

અગ્યારમાં ગુણસ્થાનનું સ્વરૂપ ચથાર્થીરૂપથી સમજવવા આચાર્યશ્રી નેમિચંદ્ર હૃત લબ્ધિસાર ગાથા ૩૧૦ની સંસ્કૃત ટીકાનો પંડિતપ્રવરશ્રી ટોડરમલજીહૃત હીન્દી અનુવાદ આ પ્રમાણે છે : -

બહુરિ યા પ્રકાર સંક્લનેશ - વિશુદ્ધતા કે નિમિત્ત કરિ ઉપશાંત કષાયને પડના - ચઢના ન હો, જાતેં તહુાં પરિણામ અવસ્થિત વિશુદ્ધતા લિએ વર્તે હેં।

સ્પષ્ટ શબ્દોમાં અહીં આવ્યું છે કે સંકલેશ વિશુદ્ધતાથી પડવું-ચઢવું

થતું નથી.

એટલે કે અગ્યારમાં ગુણસ્થાનનો જેટલો થથાયોગ્ય અંતર્મુહૂર્ત કાળ છે, તેટલા કાળમાં સમય-સમય પ્રતિપૂર્ણ વીતરાગતા છે. વીતરાગતામાં કાંઈ ઓછું - વધારેપણું નથી.

અગ્યારમાં ગુણસ્થાનના પહેલા સમયથી લઈને અંતિમ સમય સુધી ચારિત્રમોહનીયકર્મના અંતરકરણાંત્રપ ઉપશામ થવાથી ત્યાંની વિશુદ્ધતામાં અંતર/ફરજ પડવામાં કાંઈ નિમિત્ત નથી, વિશુદ્ધતા અવસ્થિત છે.

છતાં પણ જીજાસુના મનમાં શાંકા ઉત્પન્ન થઈ જ જાય છે કે ઉપશાંત મોહ ગુણસ્થાનથી પતિત થવાનું કાંઈ ને કાંઈ કારણાં હોવું જ જોઈએ. તેનું સમાધાન લબ્ધિસારના જ શબ્દોમાં -

“બહુરિ તહીં તૈં જો પડ્ણા હો હૈ, સો તિસ ગુણસ્થાન કા કાલ પૂરા ભાએ  
પીછે નિયમ તૈં ઉપશામ કાલ કા ક્ષય હોઈ, તિસકે નિમિત્ત તૈં હો હૈ।”

સંક્ષેપમાં એટલું જ સમજાવ્યું છે કે ચારિત્રમોહનીય કર્મના ઉપશામના કાળનો ક્ષય થવાથી જ ઉપશાંતમોહી મુનિરાજ નીચે દસમાં સૂક્ષ્મસાંપરાય ગુણસ્થાનમાં આવે છે.

આ જ વિષય નો હજુ વિશેષ ખુલાસો આવ્યો છે - .વિશુદ્ધ પરિણામનિ કી હાનિ કે નિમિત્ત તૈં તહીં - (ઉપશાંત મોહ) તૈં નાહીં પડે વા અન્ય કોઈ નિમિત્ત તૈં નાહીં પડે હૈ; એસા જાનના । આ વાક્યમાં સંકલેશ- વિશુદ્ધ પરિણામ નિમિત્ત નથી અને કર્મની પણ નિમિત્તતાનો નિષેધ કર્યો છે, કારણ કે મુનિરાજ જ્યાંસુધી ઉપશાંતમોહ ગુણસ્થાનમાં છે, ત્યાં સુધી તો કોઈપણ ચારિત્રમોહનીય કર્મના ઉદ્યનું નિમિત્તપણું બનતું જ નથી.

જ્યારે સૂક્ષ્મલોભ કષાયના ઉદ્યનું નિમિત્ત બને છે, ત્યારે અગ્યારમું ગુણસ્થાન જ નથી રહેતું, દસમું સૂક્ષ્મસાંપરાય ગુણસ્થાન થઈ જાય છે. તેથી ઉપશાંતમોહી મુનિરાજ કર્મને કારણ નીચેના ગુણસ્થાનમાં આવ્યા, આ વ્યવહાર નથી થઈ શકતો. તેથી કાળક્ષય જ નીચેના ગુણસ્થાનમાં આવવાનું કારણ બને છે.

પ્રશ્ન ૧૦૧ : આ અગ્યારમાં ગુણસ્થાનમાં શું મુનિરાજનું મૃત્યુ નથી થઈ શકતું ?

ઉત્તર : ઉપશાંતમોહ ગુણસ્થાનવતી મુનિરાજનું અંતર્મુહૂર્તકાળમાંથી

કોઈપણ સમયમાં મરણ થઈ શકે છે. મરણ તો થાય છે શુદ્ધોપયોગરૂપ (દ્વારાનરૂપ) અવસ્થામાં અને ત્યારબાદ તત્કાળ જ વિગ્રહગતિના પ્રથમ સમયમાં ચોથું ગુણસ્થાન થઈ જાય છે અને તે મુનિરાજ દેવગતિમાં જ સૌધર્મ સ્વર્ગાર્થી સર્વર્थસિદ્ધિ સુધી ક્યાંચ પણ જન્મ લે છે.

**પ્રશ્ન ૧૦૨ :** તો ઉપશાંતમોહથી પડવાના કારણ બે થઈ ગયા. માત્ર એક કાળક્ષય જ ન રહ્યો ?

**ઉત્તર :** આપનું કહેવું સત્ય છે. જો મરણની અપેક્ષા લઈએ તો ઉપશાંતમોહથી પડવાના બે કારણ સિદ્ધ થઈ જાય છે. (૧) કાળ-ક્ષય અને (૨) ભવ-ક્ષય. છતાંપણા સામાન્ય કારણથી તો એક માત્ર કાળ-ક્ષય જ છે, કારણ કે ભવ-ક્ષયરૂપ કારણાંતો કદાચિત् કોઈ મુનિરાજને હોય છે તથા ઉપશમશ્રેણીના અન્ય ગુણસ્થાનોમાં પણ હોઈ શકે છે. ભવ-ક્ષય અને આયુષ્ય - આ બંગેનો એક જ અર્થ છે.

### ઘવલા પુસ્તક ૧ નો અંશ (પાનાનં. ૧૮૮ થી ૧૯૦)

**સામાન્યથી ઉપશાંતકષાયવીતરાગછબ્બસ્થ જીવ છે ॥ ૧૬॥**

જેણી કષાય ઉપશાંત થઈ ગઈ છે, તેને ઉપશાંતકષાય કહે છે. જેનો રાગ નષ્ટ થઈ ગયો છે, તેને વીતરાગ કહે છે. છબ્બ જ્ઞાનાવરણ અને દર્શનાવરણને કહે છે, તેમાં જે રહે છે તેને છબ્બસ્થ કહે છે. જે વીતરાગ હોવા છતાં પણ છબ્બસ્થ છે, તેને વીતરાગછબ્બસ્થ કહે છે. આમાં આવેલા વીતરાગ વિશેષણથી દસમા ગુણસ્થાન સુધીના સરાગ છબ્બસ્થોનું નિરાકરણ સમજજું જોઈએ. જે ઉપશાંતકષાય હોવા છતાં પણ વીતરાગ છબ્બસ્થ હોય છે, તેને ઉપશાંતકષાયવીતરાગછબ્બસ્થ કહે છે. આમાં (ઉપશાંતકષાય વિશેષણથી) આગળના ગુણસ્થાનોનું નિરાકરણ સમજુ લેવું જોઈએ..

આ ગુણસ્થાનમાં સંપૂર્ણ કષાયો ઉપશાંત થઈ જાય છે, માટે આમાં ઔપશમિકલાવ છે, તથા સમ્યકુદર્શનની અપેક્ષા ઔપશમિક અને ક્ષાચિક બંને ભાવ છે.

۹۲

## ક્ષીણમોહ ગુણસ્થાન

બારમાં ગુણસ્થાનનું નામ ક્ષીણ મોહ છે. શ્રેણીના ચાર ગુણસ્થાનોમાં ક્ષીણમોહ આ ક્ષપકશ્રેણીનું અંતિમ ગુણસ્થાન છે. એક અપેક્ષાથી વિચારીએ તો ક્ષપકશ્રેણીની પૂર્વી વીતરાગતાની પ્રાસિ સ્વરૂપ આ ગુણસ્થાન છે.

ચારિત્રમોહનીય કર્મના ક્ષયનો વિશેષ પ્રારંભ તો ક્ષપક અપૂર્વકરણ ગુણસ્થાનના પ્રથમ સમયથી ચાલુ થઈ ગયો હતો અને તે ક્ષયનું કાર્ય છ્સમા ગુણસ્થાનના અંતિમ સમયમાં કહો કે બારમાં ગુણસ્થાનના પહેલા સમયમાં કહો, બંનેનો એક જ અર્થ છે - પરિપૂર્ણ થયું છે. આ વિષયને આપણે આ પ્રમાણે પણ સમજુ શકીએ છીએ - સૂક્ષ્મલોભ કધાયનો વ્યય અને પૂર્ણ વીતરાગતાનો ઉત્પાદ બંને એક સમયવતી છે, કારણ કે ઉત્પાદ અને વ્યય બંને એક જ સમયમાં થાય છે, આ વસ્તુ વ્યવસ્થાનું સ્વરૂપ છે.

અનંતાનુબંધી કખાય ચોકડીની અપેક્ષાએ વિચારીએ તો ચોથા ગુણસ્થાનથી લઈને સાતમા ગુણસ્થાન સુધી જ્યાં ક્ષાચિક સમ્યકૃતવની પ્રાપ્તિ કરી છે, તે ગુણસ્થાનથી ચારિત્ર મોહનીયકર્મના ક્ષયનો પ્રારંભ થયો છે, પરંતુ અહીં ચારિત્ર મોહનીય કર્મની ૨૧ પ્રકૃતિઓની મુખ્યતાથી કથન કર્યું છે.

ચોઇ ગુણસ્થાનનોમાંથી અંતના ચારે ગુણસ્થાન પૂર્ણ વીતરાગમય છે. તેમાં ક્ષીણમોહ બીજા નંબરનું અને પૂર્ણ સુખ સ્વરૂપ ગુણસ્થાન છે.

**પ્રશ્ન ૧૦૩ :** મોહ કર્મ નાણ થઈ ગયો છે તો શું થયું ? હજ  
જ્ઞાનાવરણાદિ ત્રણે ઘાતિ કર્મનો ઉદ્દ્ય સતત ચાલુ જ છે. તેથી ક્ષીણમોહી  
મુનિરાજને પૂર્ણ સુખી કહેવું કેમ યોગ્ય થશે ?

**ઉત્તર :** અગ્યારમા ગુણસ્થાનના પ્રારંભમાં અમે આ વિષયનું સ્પષ્ટીકરણ કર્યું છે. તેને અહીં ફરી જુઓ.

જ્ઞાનાવરણાદિ ત્રણે ધાતિકમોના ઉદ્ય-નિમિત્તક ઔદ્યિક અજ્ઞાનનો પર્યાયમાં સદ્ગ્યાવ છે, જ્ઞાન કેવળજ્ઞાનરૂપથી પરિણામિત નથી થયું અને તેના ક્ષયોપશમ અનુસાર જ્ઞાનનો આંશિક વિકાસ થયો છે, આ વાત તો સાચી છે, છતાંચ જ્ઞાનની અલ્પજ્ઞતા દુઃખમાં કે સુખની પૂર્ણતામાં કાંઈ બાધક નથી. આ વિષયને હજુ વિશેષ સુગમતાથી આ પ્રકારે પણ આપણે સમજુ શકીએ છીએ : -

૧) પૂર્ણ સુખમાં જીવના મોહપરિણામ બાધક છે, જેમાં મોહનીય કર્મનો ઉદ્ય તથા ઉદીરણ નિમિત્ત છે. બારમા ગુણસ્થાનમાં મોહકર્મ તથા મોહ પરિણામનો સર્વથા અભાવ થવાને લીધે અહીં અનાકુળ લક્ષણ ક્ષાયિક અતીનિદ્રિય સુખ પ્રગત થયું છે.

૨) વ્યવહારનયથી અનંતસુખમાં બાધક અંતરંગકારણ - જ્ઞાનાવરણ, દર્શનાવરણ અને અંતરાય કર્મનો ઉદ્ય નિમિત્ત છે.

જેમ જ્ઞાનના સમ્યકૃપણામાં સમ્યકૃદર્શન નિમિત્ત છે, તેમ જ સુખની અનંતતામાં અનંતજ્ઞાન પણ નિમિત્ત છે. છતાંચ સુખની પૂર્ણતામાં જ્ઞાનાવરણાદિ કર્મનું કાંઈપણ સાક્ષાત બાધકપણું નથી.

**પ્રશ્ન ૧૦૪ :** તો અલ્પજ્ઞ અવસ્થામાં વિકસીત બાર અંગનું શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન અને મનઃપર્યાય જ્ઞાન વધારે સુખનું ઉત્પાદક કારણ છે કે નહીં ?

**ઉત્તર :** અલ્પજ્ઞ અવસ્થામાં વિકસીત જ્ઞાન ન સુખમાં કારણ છે ન દુઃખમાં, કારણ કે જ્ઞાન તો જ્ઞાનરૂપ છે. જ્ઞાનથી જ્ઞાન થાય છે, સુખ-દુઃખ નહીં. જ્ઞાન અને સુખ ગુણ બંને એકબીજાથી લિન્ન છે. તેમનું પરિણામન પણ લિન્ન - લિન્ન જ છે. એક ગુણ અન્યગુણથી રહિત છે - એવું તત્ત્વાર્થસૂત્રમાં પણ આચાર્ય ઉમાસ્વામીએ કહ્યું છે - દ્રવ્યાશ્રયા નિગુણા ગુણા : (અધ્યાય ૫, સૂત્ર ૪૧) ગુણ ક્રવ્યના આશ્રયથી રહે છે અને એકગુણ અન્ય અનંતગુણોથી રહિત છે. વસ્તુનું જેવું સ્વરૂપ છે, તેવું જ સમજવાથી જ્ઞાનમાં નિર્મણતા અને યથાર્થતા આવે છે.

**પ્રશ્ન ૧૦૫ :** આનો અર્થ શું સુખી થવા માટે જ્ઞાનનો કાંઈ ઉપયોગ જ નથી ?

ઉત્તર : જ્ઞાનનો ઉપયોગ કેમ નહીં ? મુખ્ય રીતે તે જ્ઞાનનો જ ઉપયોગ સુખી થવા માટે છે. અલ્પજ્ઞ અવસ્થામાં વિકસીત જ્ઞાનથી સર્વજ્ઞ કથિત યથાર્થ વસ્તુ-વ્યવસ્થાને જાણી જીવ જેટલો-જેટલો મોહ ઓછો કરતો જાય છે, તેટલું - તેટલું સુખ ઉત્પન્ન થતું જાય છે. મોહ પરિણામ જ દુઃખ છે અને નિર્માહીપણું જ સુખ છે.

આ વિષયનું સ્પષ્ટીકરણ મોક્ષમાર્ગ પ્રકાશન પાના - ૩૧૦ પર આ પ્રકારે સુબોધ શબ્દોમાં કર્યું છે...નિર્ણય કરવાનો પુરુષાર્થ કરો, તો બધાનું કારણ જે મોહકર્મ તેનું પણ ઉપશમાદિ થાય ત્યારે સ્વયમેવ બધ દૂર થઈ જાય, કારણ કે નિર્ણય કરતા પરિણામોની વિશુદ્ધતા થાય છે, તેનાથી મોહની સ્થિતિ-અનુભાગ ઘટે છે.

પ્રશ્ન ૧૦૬ : આ વિષય માટે કાંઈ શાસ્ત્રાધાર પણ છે ?

ઉત્તર : હા, શાસ્ત્રાધાર છે. જિનદર્મનો કોઈપણ વક્તા હોય તે શાસ્ત્રાધારથી જ વાત કરે છે અને કરવી પણ જોઈએ. શાસ્ત્રને પ્રમાણ માન્યા વગર પોતાની મતિ-કલ્પનાથી સમજવું કે સમજાવવાવાળો જિનદર્મનો યથાર્થ વક્તા ન હોઈ શકે. શાસ્ત્ર કથિત વિષયને ચુક્તિથી સમજાવવું અલગ વાત છે અને માત્ર કલ્પનાથી તર્ક કે ચુક્તિ જ બતાવતા રહેવું અલગ વાત છે.

મોક્ષમાર્ગપ્રકાશકના ત્રીજા અદ્યાયમાં પાના - ૫૦ પર કહ્યું છે - જો જાણવું ન થવું દુઃખનું કારણ હોય તો પુરુષને પણ દુઃખ થવું જોઈએ, પરંતુ દુઃખનું મૂળ કારણ ઈચ્છા છે.

.....મોહનો ઉદ્ય છે, તે દુઃખરૂપ જ છે. વધારે શાસ્ત્રાધાર માટે મોક્ષમાર્ગ પ્રકાશક ગ્રંથનું પાનું ક અને ઉરનું પણ અવલોકન કરો.

જો વધારે જ્ઞાન જ સુખનું ઉત્પાદક હોય તો અલ્પજ્ઞાનધારી ભાવલિંગી મુનિરાજથી બારાંગોના ધારક અસંયમી દેવો તથા, અગ્યારાંગ અને નવપૂર્વના ધારક ડ્રવ્યલિંગી મુનિરાજને પણ વધારે સુખી માનવાનો પ્રસંગ આવી જશે. મતિ-શુતજ્ઞાન -અવધિજ્ઞાન એમ ત્રણ તથા મતિશ્રુતાવધિ-મનઃપર્ય એમ ચાર જ્ઞાનના ધારી મુનિરાજોને અતિસુખી અને શિવભૂતિ જેવા અલ્પ ક્ષયોપશમવાળા મુનિરાજને ઓછા સુખી માનવા પડશે, જે શાસ્ત્ર તથા ચુક્તિથી પણ સંમત નથી થઈ શકતું. તેથી મોહથી રહિત વીતરાગ પરિણામ જ નિશ્ચયથી સુખ છે.

હવે ચથાયોગ્ય એક અંતર્મુહૂર્ત માત્ર કાળ વ્યતીત થઈ જવા પર આ ક્ષીણમોહી મુનિરાજ નિયમથી અરહંત પરમાત્મા થઈ જાય છે.

બારમા ગુણસ્થાનવર્તી મુનિરાજ, આ ગુણસ્થાનના પ્રથમ સમયથી જ ક્ષીણમોહી થઈ ગયા છે. અર્થાતું આઠેય કર્મોમાંથી મોહકર્મનો સર્વથા નાશ થઈ ગયો છે. તે આ ગુણસ્થાનના પ્રથમ સમયથી જ અરહંત પરમાત્મા થવા માટે ત્રણ ઘાતિકર્મોની ઉત્તરોત્તર અસંખ્યાતગણી નિર્જરા કરી રહ્યા છે (અસંખ્યાતગણી નિર્જરા તો આછમા ગુણસ્થાનથી જ ચાલુ થઈ જઈ શકતી) વીતરાગ થયા વિના સર્વજ્ઞ થાવું સંભવ નથી. આ વાત સત્ય હોવા છતાં પણ વીતરાગ થતાં જ તત્કાળ બારમાં ગુણસ્થાનના પહેલા સમયમાં જ સર્વજ્ઞ નથી થતાં.

**પ્રશ્ન ૧૦૭ :** બારમા ગુણસ્થાનમાં ક્ષીણમોહી થતાં જ સર્વજ્ઞ થઈ જવા જોઈએ, એમાં શું વિપત્તિ છે ?

**ઉત્તર :** જ્ઞાનાવરણાદિ ત્રણ ઘાતિકર્મોની સત્તા તથા ઉદ્દ્ય જ સર્વજ્ઞ થવામાં નિમિત્તરૂપમાં બાધક છે, કારણ કે દુસ્રમા ગુણસ્થાનમાં પણ રાગ પરિણામથી જ્ઞાનાવરણાદિનો બંધ થયો હતો. તથા પૂર્વે બાંધેલા કર્મોની પણ સત્તા છે, તેનો ક્ષય થતાં જ કેવળજ્ઞાન થાય છે.

ત્રણ ઘાતિકર્મોનો નાશ કરવા માટે અંતર્મુહૂર્ત સુધી એકત્વવિતર્ક શુક્લદયાન / શુદ્ધ્યોપયોગનું હોવું જરૂરી છે.

મુનિરાજ વીતરાગ થયા બાદ સર્વજ્ઞ થાય છે, આ સામાન્ય કથન છે અને પૂર્ણ વીતરાગ થયા બાદ પણ એક અંતર્મુહૂર્ત કાળસુધી એકત્વવિતર્ક શુક્લદયાન / શુદ્ધ્યોપયોગ કર્યા પણી જ ત્રણે ઘાતિકર્મોનો ક્ષય થવાથી મુનિરાજ સર્વજ્ઞ થાય છે, આ કથન વિશેષ તથા સૂક્ષ્મ છે. (વિશેષ સ્પષ્ટીકરણ માટે પંચાસ્તિકાય ગાથા-૧૫૦ -૧૫૧ની ટીકા જુઓ)

જો બારમા ગુણસ્થાનના પ્રથમ સમયમાં જ મુનિરાજ સર્વજ્ઞ થઈ જાય છે તો બારમા ક્ષીણમોહ ગુણસ્થાનનો અભાવ થઈ જશે અને ગુણસ્થાન ચૌદના બદલે તેર જ સિદ્ધ થશે.

આચાર્યશ્રી નેમિયંક્રદેવે ગોમટસાર ગાથા-૫૨માં ક્ષીણમોહ ગુણસ્થાનની પરિભાષા આ પ્રમાણે આપેલ છે :-

**ણિસ્સેસર્ખીણમોહો, ફલિહામલભાયણુદ્યસમચિત્તો ।**

**ખીણકસાયો ભણણદિ, ણિગંથો વીયરાયેહિ ॥**

સ્ક્રિટકમહિના પાત્રમાં રાજેલા નિર્મળ જળની સમાન સંપૂર્ણ કષાયોના ક્ષયના સમય થવાવાના જીવના અત્યંત નિર્મળ વીતરાગી પરિણોમોને ક્ષીણમોહ ગુણસ્થાન કહે છે.

પરિલાખામાં ક્ષીણમોહી જીવના વીતરાગ પરિણામને નિર્મળ જળની ઉપમા આપી છે. તે જળ પણ સ્ક્રિટકમહિના પાત્રમાં રાજેલું નિર્મળ જળ છે. આ પાત્રમાંથી કોઈપણ પ્રકારની ગંદકી ફરીથી પાણીમાં આવવાની સંભાવનાની શંકા પણ ન હો, માટે સ્ક્રિટકમહિનું પાત્ર લીધું છે.

જુઓ, આચાર્યોની સૂક્ષ્મબ્રહ્મિએ પાત્ર(વાસણ)ને કેટલી દીર્ઘબ્રહ્મિથી (વિચારપૂર્વક) પસંદ કરેલ છે. મહાપુરુષોની બ્રહ્મિમાં બ્રહ્માંત પણ અનુપમ તથા મૂળ વિષયના પોષક હોય છે. ક્ષીણમોહી મુનિરાજના ભાવી જીવનમાં કોઈપણ પ્રકારની અશુદ્ધતાની સંભાવના જ નથી. આ અલિપ્રાયને અત્યંત સ્પષ્ટ કરવા માટે જ સ્ક્રિટકમહિમથી પાત્રમાં રાજેલું નિર્મળ જળ લીધું છે.

ક્ષીણમોહ ગુણસ્થાનવર્તી મુનિરાજનો મોહ હવે તો અનંતકાળ માટે નાના થઈ ગયો છે. અંતિમ સૂક્ષ્મલોલ કષાયનો વ્યય અને પૂર્ણ વીતરાગતાનો ઉત્પાદ - આ બંનેની કાળ-પ્રત્યાસતિને અત્યંત સ્પષ્ટ કરવા માટે બારમાં ગુણસ્થાનની પરિલાખામાં “કષાયોના ક્ષયના સમયે” આ શબ્દોનો પ્રયોગ કર્યો છે. બારમા ગુણસ્થાનના નામમાં પ્રચુક્ત ક્ષીણ શબ્દનો અર્થ દુબળા, પાતળા, નિર્બજનકે અશક્ત એમ ન કરવો જોઈએ. અહીં ક્ષીણ શબ્દનો અર્થ અભાવ/નાશ છે.

વીતરાગ શબ્દનો શાબ્દિક અર્થ છે - “વિગત: રાગ: યસ્માત् સ: વીતરાગ:” જેમાંથી રાગ નીકળી ગયો છે, તેને વીતરાગ કહે છે. અહીં રાગ શબ્દ જીવના રાગ - છ્રેષ્ઠ - મોહ/મિથ્યાત્પ, કોઘાઉ ચારે કષાય, હાસ્યાદિ નવ નોકષાય, આ બધાનું જ પ્રતિનિધિત્વ કરે છે. રાગ ગયો તો જીવના સર્વ વિલાસ નીકળી ગયા છે અર્થાત્ પૂર્ણ વીતરાગતા પ્રગટ થઈ ગઈ છે.

આ વીતરાગરૂપ મોહ - ક્ષોલ રહિત સામ્યલાવને જ જિનદર્મમાં દર્મરૂપ કહેલ છે. આ વીતરાગતા જીવના ચારિત્રગુણની સ્વાલાવિક પર્યાય છે. આ વીતરાગતાનો પ્રારંભ ચોથા અવિરત સમ્યકૃત્વ ગુણસ્થાનમાં થાય છે. તેથી ચતુર્થ ગુણસ્થાનવર્તી જીવ કોઈપણ ગતિના હો, તે ધાર્મિક જ છે.

વીતરાગ પર્યાયનો ઉત્પાદક તો જીવ દ્રવ્ય અથવા જીવનો ચારિત્રગુણ

છે. છતાંચ નિમિત્તની મુખ્યતાથી કથન કરતા સમય નિમિત્તનું જ્ઞાન કરાવવા માટે સંપૂર્ણ કખાચોના ક્ષયના સમયે અથવા કર્મ ક્ષયથી વીતરાગતા ઉત્પન્ન થઈ, એવા વ્યવહારનય સાપેક્ષ કથન જિનવાણીમાં આવેલ છે.

કખાચ કર્મોનો નાશ પુછ્યાલ ક્રવ્યની પર્યાય છે અને વીતરાગતા જીવ ક્રવ્યની ચારિત્ર ગુણની પર્યાય છે. આ બંનેને એક-બીજાના કાર્ય-કારણ બતાવવાવાળું જ નિમિત્ત-નૈમિત્તિકનું કથન કહેવાચ છે. આમાં બંને ક્રવ્યોની પર્યાયોની ભિન્નતા તથા સ્વતંત્રતાનું જ્ઞાન રાખવું બહુ મહત્વપૂર્ણ તથ્ય છે.

જો કોઈ અજ્ઞાનવશ-નિમિત્ત-નૈમિત્તિક સંબંધમાં આ બંને પર્યાયોની લિન્નતા તથા સ્વતંત્રતાનું જ્ઞાન નથી રાખી શકતા અને તેમાં કર્તા-કર્મ સંબંધ માની લે છે તો મિથ્યાત્વનો પ્રસંગ આવી જાય છે, જે સાત વ્યસનોથી પણ મહાન પાપ છે.

કથન જિનવાણીનું હોવા છતાં પણ જો તેની અપેક્ષા સમજવાની સાચી ક્રદિત પ્રાપ્ત ન થઈ હો તો અપાત્ર જીવ જિનવાણીના લાભથી વંચિત જ રહે છે, જેના ફળસ્વરૂપ સંસારમાં અનંત દુઃખરૂપ જગ્નમ-મરણ જ કરતો રહે છે.

**અન્ય નામો:** ક્ષીણમોહ ગુણસ્થાનને જ ક્ષીણકખાચ પણ કહે છે. તથા આનું પૂર્ણ નામ ક્ષીણકખાચ વીતરાગ છબ્બસ્થ છે.

**નામ સંબંધી સ્પષ્ટીકરણ:** ક્ષીણ = નાશ, નાષ્ટ. કખાચ = રાગ-ક્લેષ-મોહ/ વિકારી પરિણામ, વીતરાગ = રાગ-ક્લેષ આદિ સર્વ વિકારોથી રહિત અત્યંત નિર્મિત દશા, છબ્બસ્થ = જ્ઞાનાવરણાદિના સદ્ભાવમાં વિઘમાન અલ્પ જ્ઞાન-દર્શનમાં સ્થિત.

સર્વ કખાચોના ક્ષયના સમયે અર્થાત્ નિમિત્તથી પૂર્ણ નિર્મિત વીતરાગદશા પ્રગટ થઈ જવા છતાં જ્ઞાનાવરણાદિ કર્મોનો ક્ષયોપશમ થવાથી ક્ષીણમોહી મહામુનિરાજ છબ્બસ્થ અર્થાત્ અલ્પજ્ઞ જ છે.

**સમ્યકૃત્વ અપેક્ષા વિચાર :**

બારમા ગુણસ્થાનવર્તી મહામુનિરાજને માત્ર ક્ષાયિક સમ્યકૃત્વ જ હોય છે, કારણ કે ઓપશામિક સમ્યકૃત્વ તથા ઓપશામિક ચારિત્રની સીમા અગ્યારમાં ગુણસ્થાન સુધી જ રહે છે.

### ચારિત્ર અપેક્ષા વિચાર :

ક્ષીણમોહ ગુણસ્થાનમાં ક્ષાયિક ચથાખ્યાતચારિત્ર જ હોય છે.  
ક્ષપક અપૂર્વકરણ આઠમા ગુણસ્થાનના પ્રથમ સમયથી જ ચારિત્ર મોહનીય કર્મની ૨૧ પ્રકૃતિઓના આંશિક ક્ષયનું કાર્ય પ્રારંભ થવાથી આઠમામાં પણ ઉપચારથી ક્ષાયિક ચારિત્ર કછું છે.

ચારિત્રમોહનીય કર્મની ૨૧ પ્રકૃતિઓમાંથી ૨૦ પ્રકૃતિઓનો ક્ષય તો નવમાં ક્ષપક અનિવૃત્તિકરણ ગુણસ્થાનના અંતિમ સમય સુધી થયો છે. દસમા ગુણસ્થાનમાં માત્ર સૂક્ષ્મલોભ કષાય બાકી રહ્યો છે. હવે આ બારમા ગુણસ્થાનના પ્રથમ સમયમાં જ બાકી સૂક્ષ્મલોભ કષાય કર્મનો ઉદ્ય તથા પરિણામ બંનેનો ક્ષય થઈ જાય છે. માટે અહીં ક્ષાયિક ચારિત્ર પૂર્ણ થઈ ગયું છે.

### કાળ અપેક્ષા વિચાર :

ક્ષીણમોહ ગુણસ્થાનનો કાળ અંતર્મુહૂર્ત છે.

ઇછા ગુણસ્થાનથી સાતમા અપ્રમત્ત ગુણસ્થાનનો કાળ(મૃત્યુની અપેક્ષા છીડીને) અદ્ય રહે છે. સાતમા થી આઠમા અપૂર્વકરણ ગુણસ્થાનનો કાળ થોડો ઓછો. અપૂર્વકરણની અપેક્ષા અનિવૃત્તિકરણનો કાળ થોડો વધારે ઓછો. નવમા થી દસમા ગુણસ્થાનનો કાળ તેનાથી પણ થોડો ઓછો અને ક્ષપક દસમાથી પણ આ ક્ષીણ મોહ ગુણસ્થાનનો કાળ થોડો ઓછો હોય છે. છતાંય ઇછા થી બારમા સુધી પ્રત્યેક ગુણસ્થાનનો કાળ પણ અંતર્મુહૂર્ત જ હોય છે.

આશ્ર્ય તો એ વાતનું છે કે ઇછા ગુણસ્થાનથી લઈને ક્ષીણમોહ ગુણસ્થાન સુધી શૈણીના ચારે ગુણસ્થાનોના કાળનો યોગ પણ માત્ર એક અંતર્મુહૂર્ત કાળ જ થાય છે, કારણ કે અંતર્મુહૂર્તના અસંખ્યાતા બેદ છે.

### ગમનાગમન અપેક્ષા વિચાર :

ગમન : ક્ષીણમોહ ગુણસ્થાનવર્તી મહામુનિરાજ ઉપરની તરફ એકલા તેરમા ગુણસ્થાન સયોગકેવળીમાં જ ગમન કરે છે.

આગમન : આ ક્ષીણમોહ ગુણસ્થાનમાં આગમન માત્ર ક્ષપક સૂક્ષ્મસાંપરાય ગુણસ્થાનથી જ થાય છે.

### વિશેષ અપેક્ષા વિચાર :

૧) અહીં માત્ર સાતાવેદનીયનો ઈધ્યપિથાખ્ય હોય છે, કારણ કે

બારમા ગુણસ્થાનવર્તી મહામુનિરાજને કોઈપણ પ્રકારના કોઈપણ કખાય-નોકખાયરૂપ અર્થાત् મોહકર્મનો ઉદ્ય તથા પરિણામ નથી રહ્યા, તે સર્વથા વીતરાગી થઈ ગયા છે. અહીં આશ્વચનું એક માત્ર કારણ ચોગનો જ સદ્ભાવ છે.

૨) ક્ષપક અપૂર્વકરણના પ્રથમ સમયથી જ ચારિત્રમોહનીય આહિ કર્મોની શ્રેણીગત અસંખ્યાતગણી નિર્જરા પ્રારંભ થઈ છે, તે નિર્જરા નિરંતર ઉત્તરોત્તર વધતી-વધતી વીતરાગ પરિણામોના નિમિત્તથી વૃદ્ધિયવંત પણ થતી જાય છે.

બારમા ગુણસ્થાનના પ્રથમ સમયથી જ જ્ઞાનાવરણાદિ ત્રણે ઘાતિકર્મોનો નવો બંધ થવો પણ સર્વથા અટકી ગયો છે. અહીં બારમા ગુણસ્થાનના અંતિમ સમયમાં ત્રણે ઘાતિકર્મોનો સર્વથા નાશ થતાં જ, તે જ સમય જ્ઞાન-દર્શન ગુણની અલ્પજ્ઞ અવસ્થાનો વ્યય અને કેવળજ્ઞાન તથા કેવળદર્શન પર્યાયનો ઉત્પાદ એક જ સમયે થાય છે. તે જ સમયે અલ્પવીર્યનો વ્યય થઈ અનંતવીર્યનો ઉત્પાદ થાય છે.

૩) ઔદારિક શરીરધારી છબ્બસ્થ જીવોના શરીરમાં નીરંતર અનંત નિગોદ જીવ વિધમાન હોય છે. ક્ષીણમોહી મુનિરાજનું શરીર પણ ઔદારિક શરીર જ છે, પરંતુ આ મુનિરાજના શરીરમાંથી પ્રથમ સમયથી જ અનંત બાદર નિગોદ જીવોનું પ્રતિસમય નીકળવું અર્થાત્ મરવું પ્રારંભ થઈ જાય છે. ક્ષીણમોહ ગુણસ્થાનના અંતિમ સમયમાં બદા બાદર નિગોદીયા જીવોના અભાવથી અનંતર સમયવર્તી તેરમા ગુણસ્થાનના પ્રથમ સમયમાં જ મુનિરાજ પરમ ઔદારિક શરીરધારી અરહંત પરમાત્મા થઈ જાય છે. (વિશેષ માટે ઘવલા પુસ્તક-૧૪, પાનું ર૙૮૮ થી ર૙૭૧ જુઓ)

**પ્રશ્ન ૧૦૮ :** અનંત નિગોદ જીવોની હિંસા કરવાવાળા મુનિરાજ અહિંસા મહાપ્રતી કેમ માની શકાય ?

**ઉત્તર :** પ્રમત્તયોગનો અભાવ થવાથી મુનિરાજ અહિંસા મહાપ્રતી જ છે. તે બાદર નિગોદ જીવોનું મૃત્યુ તેમના આચુકર્મના ક્ષયના નિમિત્તથી જ થયું છે, તેમાં ઔદારિક શરીરધારી મુનિરાજની કાંઈપણ નિમિત્તતા નથી.

૪) ચોથા ગુણસ્થાનથી બારમા ક્ષીણમોહ ગુણસ્થાન સુધીના સર્વ જીવોની અંતરાત્મા સંજ્ઞા છે.

૫) “ક્ષીણમોહ” આ શબ્દ આદિ દીપક છે. બારમાંથી લઇને ઉપરના

ગુણસ્થાનવર્તી સર્વ જીવ ક્ષીણમોહી જ છે. આ વિષયને સ્પષ્ટ સમજવા માટે આ પ્રકારનો સુલભ ઉપાય સારો છે - ક્ષીણમોહ સયોગકેવળી, ક્ષીણમોહ અયોગકેવળી, ક્ષીણમોહ સિદ્ધ ભગવાન .

૬) “ક્ષીણમોહ વીતરાગ છબ્બસ્થ” આ પૂર્વી નામમાં આવેલ છબ્બસ્થ શબ્દને અંતદીપક સમજવું જોઈએ. પ્રથમ ગુણસ્થાનથી લઈને આ બારમા ગુણસ્થાન સુધીના સર્વ જીવ છબ્બસ્થ જ છે. છબ્બસ્થ શબ્દનું અંતદીપકપણું આ પ્રમાણે સ્પષ્ટ થાય છે - મિદ્યાત્પ છબ્બસ્થ, સાસાદન સમયફૃત્પ છબ્બસ્થ, મિશ્ર છબ્બસ્થ, અવિરતસમયફૃત્પ છબ્બસ્થ, સંયમાસંયમ છબ્બસ્થ. આ રીતે બારમા ગુણસ્થાન સુધી લગાડતા જ બધું સમજમાં આવી જાય છે.

૭) અહીં બારમા ગુણસ્થાનના પ્રથમ સમયમાં મુનિરાજ ચારિત્ર મોહનીયથી પણ રહિત હોય છે. તેથી તેઓને મોહમુકત કહેવું ચુક્તિ તથા શાસ્ત્ર સંમત પણ છે.

**ધવલા પુરુષ - ૧નો અંશ (પાનાનં ૧૮૦ થી ૧૮૧)**

સામાન્યથી ક્ષીણકષાય વીતરાગ છબ્બસ્થ જીવ છે ॥૨૦॥

જેમની કષાય ક્ષીણ થઈ ગઈ છે, તેમને ક્ષીણકષાય કહે છે. જે ક્ષીણકષાય હોવા છતાં વીતરાગી છે, તેમને ક્ષીણકષાય વીતરાગ કહે છે. જે જ્ઞ અર્થાત् જ્ઞાનાવરણ અને છર્ણાવરણમાં રહે છે, તેમને છબ્બસ્થ કહે છે. જે ક્ષીણકષાય વીતરાગ હોવા છતાં છબ્બસ્થ હોય છે તેમને ક્ષીણકષાય વીતરાગ છબ્બસ્થ કહે છે. આ સૂત્રમાં આવેલું છબ્બસ્થ પદ અંતદીપક છે, માટે તેને પૂર્વવર્તી સમસ્ત ગુણસ્થાનોના સાવરણપણાનું સૂચક સમજવું જોઈએ.

**શંકા 31 :** ક્ષીણકષાય જીવ વીતરાગ જ હોય છે, એમાં કોઈ પ્રકારનો પણ વ્યબિચાર નથી આવતો, માટે સૂત્રમાં વીતરાગપદનું ગ્રહણ કરવું નિષ્ફળ છે.

**સમાધાન :** ના, કારણ કે નામ, સ્થાપના આઈર્પ ક્ષીણકષાયની નિવૃત્તિ કરવી એ જ આ સૂત્રમાં વીતરાગપદને ગ્રહણ કરવાનું ફળ છે. અર્થાત् આ ગુણસ્થાનમાં નામ, સ્થાપના અને ક્રવ્યરૂપ ક્ષીણકષાયનું ગ્રહણ નથી, પરંતુ ભાવરૂપ ક્ષીણ કષાયોનું જ ગ્રહણ છે, આ વાતને પ્રગત કરવા માટે સૂત્રમાં વીતરાગ પદ આપેલ છે.

**શંકા 32 :** પાંચપ્રકારના ભાવોમાંથી ક્યા ભાવથી આ ગુણસ્થાનની ઉત્પત્તિ થાય છે?

**સમાધાન :** મોહનીય કર્મના જે લેદ છે - ક્રવ્ય મોહનીય અને ભાવ મોહનીય. આ ગુણસ્થાનની પહેલા બંને પ્રકારના મોહનીય કર્મોનો સર્વથા નાશ થઈ જાય છે, માટે આ ગુણસ્થાનની ઉત્પત્તિ ક્ષાયિક ગુણ(ક્ષાયિકભાવ) થી છે. -૦-૦-

”એ શાન્તિની કાળજીની

સહેત-દર માટે ટોપલ શાંતિની વર્ણનાની નિરોધાની

એ મંદ્રાં હિંદુના માનવીની માનવકાળ મંત્રાનીની

॥ રાજાણગણનીનાનાના - નિરોધાની રાજાણગણ

॥ માનવકાળના - માનવકાળનાનાના

॥ રાજાણગણનીનાનાના - રાજાણગણનીનાનાના

૧૩

### સયોગકેવળી ગુણસ્થાન

તેરમા ગુણસ્થાનનું નામ સયોગકેવળી છે. આ ક્ષપકશ્રેણીના ચારે ગુણસ્થાનો બાદ પ્રાપ્ત થવાવાળું પ્રથમ ગુણસ્થાન છે. ક્ષીણમોહે ગુણસ્થાનમાં જે સુખ પૂર્ણરૂપથી પરિણામિત થયું હતું, હવે તે સુખ અહીં કેવળજ્ઞાનના સદ્બાવથી અનંત સુખરૂપથી કહેવામાં આવ્યું છે.

જીવની સર્વજ્ઞત્વ અને સર્વદર્શિત્વ શક્તિનો પૂર્ણ વિકાસ થઈ ગયો છે. શરીર સહિત હોવા જીતાં પણ શરીરથી નિર્લેંપતા તથા નિરપેક્ષતાનું સાક્ષાત જીવન અર્થાત્ સયોગકેવળી અવસ્થા છે. વીતરાગતાનું ફળ જ સર્વજ્ઞતા તથા સર્વદર્શિત્વ છે, હવે તે વ્યક્તિ/પ્રગટ થઈ ગયું છે.

અરહંત અવસ્થામાં આ પ્રકારના અઢારદોષ નાચ થઈ ગયા છે - ભૂખ, તરસ, બીમારી, જરા, જન્મ, મરણ, લય, રાગ, દ્રોષ, ગર્વ, મોહ, ચિંતા, મદ, આશ્ર્ય, નિંદ્રા, અરતિ, ખેદ અને પરસેવો.

મોક્ષમાર્ગ પ્રકાશક પાના નં. ૨ ઉપર પણ અરહંતોનું સ્વરૂપ અત્યંત માર્ભિક રૂપથી સ્પષ્ટ કર્યું છે. આંશિક કથન આ પ્રકારે છે.

“દેવાધિદેવપણાને પ્રાપ્ત થયા છે. તથા શસ્ત્રો, વાત્સાદિક તથા અંગવિકારાદિક જે કામ, કોધ આદિ નિંઘલાવોના ચિહ્ન, તેનાથી રહિત જેનું પરમ ઔદારિક શરીર થયું છે. જેના વચનોથી લોકમાં ધર્મતીર્થ પ્રવર્તે છે, જેના દ્વારા જીવોનું કલ્યાણ થાય છે.

જેમને લૌકિક જીવોના પ્રભુત્વ માનવાના કારણભૂત અનેક અતિશય અને નાના(વિવિધ) પ્રકારના યૈલબનું સંયુક્તપણું જોવામાં આવે છે.

જેમનું પોતાના હિત અર્થે ગણધર-ઇંડ્રાદિક ઉત્તમ જીવ સેવન કરે છે. - એવા સર્વપ્રકારથી પૂજવા યોગ્યશ્રી અરહંત દેવ છે, તેમને

અમારા નમસ્કાર હો.”

આચાર્યશ્રી નેમિચંદ્રદેવે ગોમ્મટસાર જીવકાંડ ગાથા ૬૩-૬૪માં સયોગકેવળી ગુણસ્થાનની પરિલાખા આ પ્રમાણે આપેલ છે:-

**કેવલણાણ દિવાયરકિરણકલ્નાવપ્પણાસિયણાણો ।**

**ણવકેવલલદ્ધુમામ સુજળિય-પરમપ્પવવએસો ॥**

**અસહાયણાણદંસણસહિતો, ઇદિ કેવલી હું જોગેણ ।**

**જુતોત્ત્ત્રિ સજોગજિણો, અણાઇણિહણારિસે ઉત્તો ॥**

ધાતિ ચતુષ્ઠયના ક્ષયના કાળમાં ઔદ્ઘિક અજ્ઞાનનાશક તથા અસહાય કેવળજ્ઞાનાદિ નવ લભિધસહિત થવાથી પરમાત્મ સંજ્ઞાને પ્રાપ્ત જીવની યોગસહિત વીતરાગ દશાને સયોગકેવળી ગુણસ્થાન કહે છે.

ધાતિ ચતુષ્ઠય એટલે જ્ઞાનાપરણા, દર્શનાપરણા, મોહનીય અને અંતરાય કર્મોનો ક્ષય થતાં જ તે જ સમયે કેવળજ્ઞાનાદિ નવ લભિધાઓ ઉત્પન્ન થાય છે. આ બંને કાર્ય એક જ સમયમાં થાય છે. આ જ એક સમયની ઘટના/કાર્યને “ચાર ધાતિકર્મોના ક્ષયના નિમિત્તથી કેવળજ્ઞાનાદિ થાય છે.” - એવું નિમિત્ત - નૈમિત્તિકનું કથન શાસ્ત્રમાં જોવા મળે છે.

આ વિષયને આચાર્યશ્રી ઉમાસ્વામીએ તત્વાર્થસૂત્રના ૧૦મા અદ્યાયમાં પ્રથમસૂત્ર દ્વારા સ્પષ્ટ કર્યું છે -

**મોહક્ષયાજ્ઞાનદર્શનાવરણાન્તરાય - ક્ષયાચ્ચ કેવલમ् ।**

કર્મોનો નાશ થવાથી કેવળજ્ઞાનાદિની ઉત્પત્તિ નથી થતી. કોઈ સ્વયં મરવાવાળો બીજાને કેવીરીતે જન્મ આપી શકે? કર્મોનો નાશ કેવળજ્ઞાનને ઉત્પન્ન નથી કરી શકતા. કેવળજ્ઞાનની પર્યાય તો જીવફ્રલ્યના જ્ઞાનગુણમાંથી પ્રગત થઈ છે. દસમા ગુણસ્થાનના અંતિમ સમયમાં જ મોહકર્મનો સંપૂર્ણ ક્ષય થઈ ગયો છે. બારમા ગુણસ્થાનના અંતિમ સમયમાં જ્ઞાનાપરણાદિ ત્રણે ધાતિકર્મોનો નાશ/ક્ષય પણ થઈ ગયો છે. આના અભાવદ્વાપ નિમિત્તને મુખ્ય કરી નિમિત્તનું જ્ઞાન કરાવવા માટે મોહ તથા જ્ઞાનાપરણાદિ ત્રણે ધાતિકર્મોના ક્ષયથી કેવળજ્ઞાન થયું, એવું નિમિત્ત - નૈમિત્તિક સંબંધ જોઈને વ્યવહારનથી, ઉપચારથી ધાતિકર્મોના નાશથી કેવળજ્ઞાન થાય છે, એમ આચાર્યશ્રી કથન કરે છે.

અજ્ઞાન બે પ્રકારનું હોય છે -

૧) મિથ્યા શ્રદ્ધાના નિમિત્તથી સંશયાદિ વિપરીતતા લઈને જે વ્યક્ત જ્ઞાન હોય છે, તેને અજ્ઞાન અથવા મિથ્યાજ્ઞાન કહે છે. આ અજ્ઞાન પ્રથમ ગુણસ્થાનની લઈને બીજા સાસાદન સમ્યકૃત્વ ગુણસ્થાન સુધી હોય છે. (ત્રીજા ગુણસ્થાનમાં શ્રદ્ધાને અનુસાર જ્ઞાન પણ મિશ્ર/સમ્યક્ષમિથ્યારૂપ રહે છે.)

૨) જ્ઞાનાપરણ કર્મજા ઉદ્દ્યથી જે જ્ઞાનની પર્યાયમાં અભાવ રહે છે તેને પણ અજ્ઞાન કહે છે. આ બીજા પ્રકારના અજ્ઞાનનું નામ ઔદ્ઘિક અજ્ઞાન છે. આ પહેલા ગુણસ્થાનની લઈને બાર્થમા ગુણસ્થાનના અંતિમ સમય સુધી રહે છે. ઔદ્ઘિક અજ્ઞાનનો નાશ કેવળજ્ઞાન થવાથી જ થાય છે. તેથી પરિભાષામાં ઔદ્ઘિક અજ્ઞાન નાશક વિશેષણ કેવળજ્ઞાન માટે આપેલ છે.

કેવળજ્ઞાનનું બીજું વિશેષણ “અસહાય” આપેલું છે. અસહાય શબ્દના બે અર્થ થાય છે.

**પ્રથમ અર્થ :** દીન, હીન, જેનું કોઈ મદદ કરવાવાળું કે સહાયક નથી, છતાંચ જે બીજાથી સહયોગ અર્થાત્ મદદની અતિશાય હાર્ડિક પરિણામોથી અપેક્ષા રાખે છે, તેને અસહાય કહે છે. આ દીનતાનું ધોતક(પ્રતિક) છે.

**બીજો અર્થ :** જેને કોઈથી પણ મદદ કે સહાયની આવશ્યકતા જ નથી, જે સ્વયં પોતાના સર્વ કાર્યને માટે સમર્થ, સ્વસહાય, સ્વાધીન તથા પરિપૂર્ણ છે, તેને પણ અસહાય કહે છે. આ સ્વયંપૂર્ણતાનું ધોતક છે.

પ્રસ્તુત પ્રકારણમાં કેવળજ્ઞાન માટે બીજો જ અર્થ લાગુ પડે છે, પહેલો નહીં.

કેવળજ્ઞાન માટે ન શરીરની આવશ્યકતા છે, ન ઇન્જિન્યોની અને ન બાધ્ય પ્રકાશ આદિ નિમિત્તોની. એટલું જ નહીં, કેવળજ્ઞાનને બાધ્ય જ્ઞેય (જ્ઞાન જે વસ્તુને જાણે છે, તેને જ્ઞેય કહે છે) વસ્તુઓની સાક્ષાત ઉપરિથિત પણ આવશ્યક નથી; કારણ કે કેવળજ્ઞાન તો જે જ્ઞેય પદાર્થ વર્તમાનમાં છબ્બસ્થને સાક્ષાત પ્રત્યક્ષ નથી, (જે જ્ઞેય સૂક્ષ્મ, અંતરિત અને દૂર છે) એવા અનાદિ ભૂતકાળના સર્વ પદાર્થોને અને ભવિષ્યકાળના અનંતાનંત સર્વ પદાર્થોને પણ અર્થાત્ સર્વ ક્રવ્ય-ગુણ-પર્યાયને યુગપદ એક જ સમયમાં પ્રત્યક્ષ તથા સ્પષ્ટ જાણે છે.

અનંત જ્ઞાન, દર્શન, ક્ષાયિક સમ્યકૃત્વ તથા ચારિત્રને અનંતચતુર્ષય કહે છે. દાન, લાભ, ભોગ, ઉપભોગ, વીર્યને પાંચલબ્ધિ કહે છે. આ રીતે ચતુર્ષય અને પંચલબ્ધિ મળીને ક્ષાયિક નવલબ્ધિ થઈ જાય છે. આ કેવળજ્ઞાનાદિ નવલબ્ધિ સહિત તેમાં ગુણસ્થાનવર્તી સયોગ કેવળી હોય છે. તેમને જ સકલ પરમાત્મા કહે છે. આ જ અરહંત તીર્થીકર પરમાત્માની પ્રતિમાઓ જિનમંદિરમાં બિરાજમાન કરવામાં આવે છે, જે બધાને પૂજ્ય હોય છે.

### નામ અપેક્ષા વિચાર :

સયોગકેવળી પરમાત્માના જ અરિહંત, અરહંત, અરુહંત, કેવળી, પરમાત્મા, સકલપરમાત્મા, સયોગીજિન, પરમજ્યોતિ, સર્વજ્ઞ, જિનેજ્ઞદેવ, જીવનમુક્તા, આખ આદિ એક હજાર આઠ નામ કહેવાયા છે.

૧) મિદ્યાત્પ અને કોદાદિ વિલાવ ભાવરૂપી શાત્રુઓને(અરિ=શાત્રુ, હંત = નષ્ટ કરવાવાળા) જે નષ્ટ કરે છે, તેને અરિહંત કહે છે.

૨) જે સર્વ જીવોથી પૂજનીય તથા આદર્શ છે, તેને અરહંત કહે છે. આચાર્ય કુંડલદેવે પોતાના ગ્રંથોમાં મુખ્યપણે અરહંત શબ્દનો પ્રયોગ કર્યો છે.

૩) જેમનું ફરી જન્મરૂપથી ઉત્પન્ન થવું નષ્ટ થઈ ગયું છે, તેને અરુહંત કહે છે.

૪) જે જિનેજ્ઞ ભગવાન યોગ સહિત છે, તેને સયોગીજિન કહે છે.

૫) જે પરમાત્મા હોવા છતાં પણ કલ અર્થાત્ શરીર સહિત છે, તેને સકલ પરમાત્મા કહે છે.

૬) જે જીવ કેવળજ્ઞાન સહિત છે, તેઓને કેવળી કહે છે.

૭) કેવળજ્ઞાનની મુખ્યતાથી જ અરહંતને પરમજ્યોતિ આદિ કહે છે.

### સમ્યકૃત્વ અપેક્ષા વિચાર :

તેરેમા ગુણસ્થાનમાં ક્ષાયિક સમ્યકૃત્વ જ રહે છે, છતાંચ સયોગકેવળી ગુણસ્થાનવર્તી પરમાત્માના કેવળજ્ઞાનને કારણ ક્ષાયિક સમ્યકૃત્વને જ પરમાવગાઢ સમ્યકૃત્વ કહે છે.

### ચારિત્ર અપેક્ષા વિચાર:

પરમ યથાજ્યાત ચારિત્ર. ક્ષીણમોહ ગુણસ્થાનમાં શ્રદ્ધા તથા ચારિત્રગુણનું પૂર્ણ નિર્મળ પરિણામન થવાને લીધે યથાજ્યાત ચારિત્ર થયું

હતું. હવે તેરમા ગુણસ્થાનમાં કેવળજ્ઞાનના નિમિત્તથી તે ચારિત્રને પરમ યથાખ્યાત ચારિત્ર કહે છે.

### કાળ અપેક્ષા વિચાર:

**જધન્યકાળ :** અંતર્મુહૂર્ત. તીર્થીકર સયોગકેવળીને છોડીને અન્ય પરમગુરુ ઓછામાં ઓછા પોતાનું જીવન અંતર્મુહૂર્ત સુધી અહીં સયોગકેવળી અવસ્થામાં વ્યતીત કરે છે. કોઈપણ સયોગકેવળી જિનેનું અંતર્મુહૂર્તથી ઓછા કાળાવધિમાં તેરમા ગુણસ્થાનને છોડીને ચૌદમાં ગુણસ્થાનમાં ગમન નથી કરી શકતા.

આ અરહંત સયોગી પરમાત્માનો દિવ્યદ્વયનિથી ઉપદેશ હો કે ન હો, વિહાર હો કે ન હો અથવા અંતઃકૃતકેવળી હો, બધા સયોગકેવળી પરમાત્માઓનો તેરમા ગુણસ્થાનનો જધન્યકાળ અંતર્મુહૂર્ત જ છે.

તીર્થીકર સયોગકેવળી પરમાત્માનો જધન્યકાળ વર્ષ પૃથકૃત્વ અર્થાતું વર્ષ થી લઈને ૮ વર્ષની અંદર જ હોય છે. આનો અર્થ એ થયો કે તીર્થીકર સયોગકેવળી પરમાત્માનો જધન્ય વિહાર કાળ પણ વર્ષ પૃથકૃત્વ જ હોય છે.

**ઉત્કૃષ્ટકાળ :** ગર્ભકાળ સહિત આઠવર્ષ તથા આઠ અંતર્મુહૂર્ત ઓછા એક પૂર્વ કોટી કાળ. આટલો દીર્ଘકાળ તેરમા ગુણસ્થાનનો કેમ/કેવીરીતે હોય છે. તેનું સ્પષ્ટીકરણ :-

જે એક પૂર્વ કોટીવર્ષની ઉત્કૃષ્ટ આયુના ધારક કર્મભૂમિજ કોઈ શ્રેષ્ઠ પુરુષ ગર્ભકાળ સહિત આઠ વર્ષના થતાં જ દીક્ષા લઈ કેવળ આઠ અંતર્મુહૂર્તકાળ સુધી મુનિજીવનમાં આત્મસાધના કરીને જે સયોગકેવળી ગુણસ્થાનને પ્રાપ્ત થયા છે, તે જિનેનું પરમાત્મા પોતાની મનુષ્યાયુના અંત સુધી દિવ્યદ્વયનિથી ઉપદેશ દેતા થકા વિહાર કરે છે.

આ કથન કર્મભૂમિના મનુષ્ય આયુની ઉત્કૃષ્ટ સ્થિતિની મુખ્યતાથી કર્યું છે.

**મદ્યમકાળ :** એક અંતર્મુહૂર્ત અને આઠ વર્ષ તથા આઠ અંતર્મુહૂર્ત ઓછા એક પૂર્વ કોટીકાળની વર્ચેના જેટલા પણ ભેદ થાય છે, તે સર્વ મદ્યમકાળના પ્રકાર જાણવા જોઈએ. જેમ કે બે, ત્રણ, ચાર, આદિ અંતર્મુહૂર્ત અથવા એક, બે, ત્રણ આદિ દિવસ કે મહીના કે વર્ષ યથાસંભવ લગાવી લેવા જોઈએ.

### ગમનાગમન અપેક્ષા વિચાર :

ગમન : સકલ પરમાત્મા જિનેન્ફ, તેરમા ગુણસ્થાનથી નિયમપૂર્વક ચૌદમાં અયોગ કેવળી ગુણસ્થાનમાં જ ગમન કરે છે.

આગમન : માત્ર ક્ષીણમોહ ગુણસ્થાનથી જ સયોગકેવળી ગુણસ્થાનમાં આગમન થાય છે.

### વિશેષ અપેક્ષા વિચાર :

૧) જો સયોગકેવળી પરમાત્માને તીર્થીકર નામકર્મનો ઉદ્ય હોય તો તેમના જન્મના દસ, તીર્થીકર પ્રફૃતિ નામકર્મના ઉદ્યના નિમિત્તથી સમવસરણની ર્ચના કાળમાં કેવળજ્ઞાનના દસ અતિશય, દેવકૃત ચૌદ અતિશય, આઠ પ્રતિહિર્યાદિ બધા જ્ઞ અલોકિક પૈલ્ભવ/ અતિશયોનો સહજ સંયોગ હોય છે.

૨) બધા સયોગકેવળી પરમાત્માઓને ક્ષાયિક જ્ઞાનાદિ અનંત ચતુર્ષ્ટયની પ્રાસિ નિયમથી થાય છે.

૩) સામાન્ય મનુષ્યોની જેમ સયોગકેવળીના કવળાહાર નથી હોતા, પરંતુ નોકમહાર હોય છે, જેનાથી પરમોદારિક શરીરની સ્થિતિ દીર્ઘકાળસુધી એક સરખી બની રહે છે. રોગ તથા જન્મમરણાદિ અફાર દીષ પણ નથી હોતા તથા અસાતાજન્ય બાધાઓ નથી હોતી.

૪) સયોગકેવળી પરમાત્મા ધણા પ્રકારના હોય છે. પંચ કલ્યાણકવાળા તીર્થીકર કેવળી, ત્રણ કલ્યાણકવાળા તીર્થીકર કેવળી, જે કલ્યાણકવાળા તીર્થીકર કેવળી, મૂક કેવળી, અંતઃકૃત કેવળી, ઉપસર્ગ કેવળી, સામાન્ય કેવળી, સમુદ્ધાત કેવળી, સાતિશય કેવળી, અનુભદ્ધ કેવળી, સતત કેવળી આદિ.

**મૂક કેવળી :** જે સયોગકેવળીને વાણીનો યોગ ન હોય અર્થાતું જેમની દિવ્યદ્યનિ ન હોય, તેમને મૂક કેવળી કરે છે.

**અંતઃકૃત કેવળી :** દ્યાનારૂઢ અવસ્થામાં બિરાજમાન જે મુનિરાજેને પૂર્વલખ કે આ ભવનો યેરી દેવ અથવા વિદ્યાધર આદિ ઉપાડી આકાશમાં લઈ જાય છે અને ઉપરથી સમુદ્ર કે અન્ધીમાં અથવા પહાડ પર ફેંકે છે. એવા અત્યંત પ્રતિકૂળ અવસરો વખતે આકાશથી નીચે સમુદ્રમાં કે અન્ધીમાં પડવાથી પહેલા અથવા પહાડ ઉપર પછડાવા પહેલા જ શુકલદ્યાનથી શ્રેણી માંડી આકાશમાં જ સયોગકેવળી થઈને અંતર્મુહૂર્તમાં

સિદ્ધ પદ પ્રાપ્ત કરી લે છે, તેમને અંતઃહૃતકેવળી કહે છે.

જેઓએ સંસારનો અંત કરી દીધો છે અને જે આઈ કર્મોનો અંત અર્થાત् વિનાશ કરે છે, તે અંતઃહૃતકેવળી કહેવાય છે. તેનો 'અર્થ' એ છે કે જે અંતઃહૃત થઈને સિદ્ધ થાય છે, નિષ્ઠિત થાય છે તે પોતાના સ્વરૂપથી નિષ્પત્તન થાય છે, તે અંતઃહૃત કેવળી છે.

**ઉપસર્ગ કેવળી :** મુનિ અવસ્થામાં ઉપસર્ગ હોય, તે ઉપસર્ગ અવસ્થાનો નાશ થતાં જ જેને કેવળજ્ઞાન પ્રાપ્ત થાય છે, તેમને ઉપસર્ગ કેવળી કહે છે. જેમ કે મુનિ પાર્શ્વનાથ પર કમઠે ઉપસર્ગ કર્યો હતો, ત્યારબાદ તેમને કેવળજ્ઞાન ધર્ય ગયું હતું.

**સમુદ્ધાતગત કેવળી :** જે સચોગી જિનેન્દ્ર પરમાત્માના આચુકર્મની સ્થિતિ ઓછી હોય અને વેદનીયાદિ ત્રણ અધાતિકર્મોની સ્થિતિ વધારે હોય તો તેમને આચુકર્મની સ્થિતિની બરાબર અન્ય ત્રણ કર્મોની સ્થિતિ કરવાને સમુદ્ધાત કહે છે. એવા સમુદ્ધાતને કરવાવાળા તેમાં ગુણસ્થાનવર્તી જિનેન્દ્રને સમુદ્ધાતગત કેવળી કહે છે.

**પાંચ કલ્યાણકવાળા તીર્થીકર :** ગર્ભમાં આવવાના જ મહિના પૂર્વે જ રત્નોની વર્ષા થવી આદિ અતિશય થાય છે. પછી ગર્ભ કલ્યાણક આદિ પાંચ કલ્યાણક થાય છે. પાંચ કલ્યાણકનું કથન ભરત-ઐરાવત ક્ષેત્રની મુખ્યતાથી છે અને ત્રણ તથા બે કલ્યાણકવાળા તીર્થીકર વિદેહક્ષેત્રમાં જ થાય છે. એટલું વિશેષ જાણાં.

**ત્રણ કલ્યાણકવાળા તીર્થીકર :** જે ચરમશરીરી ભવ્ય આત્માઓએ પોતાના વર્તમાન મનુષ્યભવના અવિરત સમ્યકૃત્વ કે દેશવિરત ગુણસ્થાનમાં તીર્થીકર પ્રકૃતિનો બંધ પ્રારંભ કર્યો છે, તેની દીક્ષા, કેવળજ્ઞાન અને નિર્વાણ કલ્યાણક - એમ ત્રણ જ કલ્યાણક હોય છે.

**ને કલ્યાણક વાળા તીર્થીકર :** જે ચરમશરીરી ભવ્ય આત્માઓએ વર્તમાન પ્રમત્તાપ્રમત્ત ગુણસ્થાનમાં તીર્થીકર પ્રકૃતિનો બંધ કર્યો છે, તેમને માત્ર કેવળજ્ઞાન અને નિર્વાણ / મોક્ષ કલ્યાણક એમ બે કલ્યાણક હોય છે.

૫) માત્ર સચોગ કેવળી ગુણસ્થાનવર્તી અરિહંતોનો જ ઈચ્છારહિત ઉપદેશ હોય છે. તેના માટે તીર્થીકર પરમાત્મા તીર્થીકર પ્રકૃતિ કર્મના ઉદ્ઘથી સમપસરણાની ર્થના થાય છે. સામાન્ય કેવળીને માટે પણ

ગંધકુટીની રચના પણ સૌધર્મ ઈંજ્રેની આજાથી કુલેર છારા થાય છે.

સાતમા ગુણસ્થાનથી લઇને બારમા ગુણસ્થાન સુધી તો મુનિરાજ દ્યાનારૂઢ રહે છે, તેથી તેમનો ઉપદેશ નથી હોતો. છઢા ગુણસ્થાનવર્તી મુનિરાજ, પંચમ ગુણસ્થાનવર્તી શ્રાવક તથા અપ્રતી શ્રાવકનો ઉપદેશ ઈચ્છાપૂર્વક જ થાય છે.

જીનેન્ઝ ભગવાનની સ્વભાવત: અસ્ખલિત(નિરંતર) અને અનુપમ દિવ્યદ્વારનિ સર્વાંગથી ત્રણે સંવિકાળમાં અને મદ્યરાત્રિમાં પણ છ-છ ઘડી સુધી (૮ કલાક ૩૫ મિનિટ સુધી) ખરે છે અને એક યોજન સુધી સંભળાય છે. તેના અતિરિક્ત વિશેષ પુણ્યાત્મા ગણાધરદેવ, ઈંજ્રે અથવા ચક્રવર્તીના પ્રશ્નાનુસાર અર્થનું નિરૂપણાર્થ તે દિવ્યદ્વારનિ શેષ સમયમાં પણ ખરે છે.

એક યોજનની અંદર દૂર કે નજીક બેઠેલા અઢાર-મહાભાષા અને સાતસો લધુભાષાઓથી ચુક્ત એવા તીર્થચ, મનુષ્ય તથા દેવની ભાષા રૂપમાં પરિણામિત થવાવાળી તથા જ્યૂનતા તથા અધિકતાથી રહિત, મધુર, મનોહર, ગંભીર, વિશાદ એવી ભાષાને પ્રાપ્ત (જીનેન્ઝ શબ્દકોષ ભાગ - ૨-પાના નં. ૪૩૧,૪૩૨) દિવ્યદ્વારનિ હોય છે.

તિલોચપણણાતી ભાગ-૨, ગાથા ૭૨૪, ૭૨૫ના ઉત્લેખાનુસાર અવસર્પિણીકાળમાં થવાવાળા ૪૪ તીર્થકરોના સમવસરણોનું પ્રમાણ ક્રમથી બાર યોજનથી પ્રારંભ થાય છે, ઘટતું થકું અંતિમ તીર્થકરણનું સમવસરણ એક યોજનનું રહી જાય છે.

ગાથા ૭૨૫માં ઉત્સર્પિણીકાળના તીર્થકરોના સમવસરણોનું પ્રમાણ ઉંઘા ક્રમથી ચાલે છે. અર્થાત્ પ્રથમ તીર્થકરણનું એક યોજનથી પ્રારંભ થાય છે અને વધતું થકું અંતિમ તીર્થકરણનું બાર યોજન પ્રમાણ થાય છે.

ક) અહીં ઈંજ્રેચાઈ પરનિમિત નિરપેક્ષ/નિઃસહાય (સ્વયં પરિપૂર્ણ સમર્થ) ત્રિકાળવર્તી લોકાલોકને ચુગપદ જાણવા-દેખવાવાળું કેવળજ્ઞાન તથા કેવળદર્શન ઉત્પન્ન થાય છે. તે બંનેનું પરિણામન ચુગપદ હોય છે. (જુઓ - નિયમસાર ગાથા ૧૬૦)

ઇંગ્લિસ્થ અવસ્થામાં જેમ જુવને પ્રથમ સામાન્ય અવલોકનરૂપ દર્શન થાય છે, પછી વિશેષ અવલોકનરૂપ જ્ઞાન થાય છે, તેમ જ કેવળદર્શન અને કેવળજ્ઞાનના સંબંધમાં પણ ક્રમિક દર્શન તથા ક્રમિક જ્ઞાનની પ્રવૃત્તિને

માનશું તો સયોગકેવળી જિનેજ્ર સર્વજ્ઞ તથા સર્વદર્શી સિદ્ધ નહીં થાય.

**પ્રશ્ન ૧૦૮:** સયોગકેવળી જિનેજ્ર સર્વજ્ઞ તથા સર્વદર્શી કેમ સિદ્ધ નહીં થાય ?

**ઉત્તર:** જે સમયે કેવળદર્શન હોય, તે સમયે કેવળજ્ઞાન ન હોય તો જિનેજ્ર સર્વજ્ઞ કેમ સિદ્ધ થાય ? અલ્પજ્ઞ જ સિદ્ધ થશે. તેથી સયોગ કેવળી અવસ્થામાં દર્શન અને જ્ઞાન - આ બંનેના ઉપયોગોની પ્રવૃત્તિ ચુંચપદ જ હોય છે. જ્ઞાનાવરણ તથા દર્શનાવરણ બંને કર્મોનો ક્ષય / અભાવ પણ એક સમયમાં જ થાય છે.

૭) આ સયોગકેવળી ગુણસ્થાનની આમને જ પરમગુરુ તથા પરમાત્મા સંજ્ઞા પ્રાપ્ત થાય છે.

૮) સમ્યકૃત્વના દસ લેદોમાંથી અહીં સયોગકેવળીનું સમ્યકૃત્વ પરમાવગાઢ કહેવામાં આવે છે. અત્યારસુધી સાધક મુનિરાજ અલ્પજ્ઞ હતા, અહીં સર્વજ્ઞ અને સર્વદર્શી થઈ ગયા છે. આ જ કારણ સમ્યકૃત્વના પરમાવગાઢપણામાં છે.

૯) અહીં ‘સયોગ’ શબ્દ અંતદીપક છે. તેથી પ્રથમ ગુણસ્થાનની લઈ ને તેરમા ગુણસ્થાન સુધીના સર્વ જીવ સયોગી/ચોગ સહિત જ છે. તેને આ રીતે સ્પષ્ટ સમજી શકીએ છીએ-સયોગ મિથ્યાત્વ, સયોગ સાસાદન સમ્યકૃત્વ, સયોગ મિશ્ર આદિ.

૧૦) ‘કેવળી’ શબ્દ આદ્દીપક છે. તેરમા ગુણસ્થાનમાં વ્યક્ત થયેલ કેવળજ્ઞાન અર્થત્ત કેવળીપણું તે આગળના ચૌદમા ગુણસ્થાનમાં અને સિદ્ધાલયમાં પણ અનંતકાળ સુધી સતત ઘૂંઘ અને અચલરૂપથી રહેવાવાળું છે. જેમ - અયોગકેવળી, સિદ્ધકેવળી.

૧૧) અહીં ચારે ધાતિ કર્મોનો અભાવ થઈ જવાથી સયોગકેવળી અરહંત પરમાત્માને જીવનમુક્ત પણ કહે છે. હજુ ચારે અધાતિ કર્મોની સત્તા અને ઉદ્ય હોવાથી તથા અસિદ્ધત્વ ભાવને લીધે મુક્તઅવસ્થા નથી થઈ.

૧૨) ભવ્યજીવોના ભગવાનશ જ ભગવાનનો વિહાર હોય છે. કેવળી ભગવાનના વિહારના વ્યવસ્થાપક કોઈ ઈન્જિનિયર નથી. જે જીવોની મોક્ષમાર્ગ પ્રાપ્ત કરવાની પાત્રતા પાકી ગઈ છે, તેમજે સહજ જ સર્વોત્તમ નિમિત્ત મળે જ છે. તેથી પાત્ર જીવોની તરફ ભગવાનનો વિહાર તથા

તેમના માટે ઉપદેશ સ્વયં થાય છે. પંક્તિત દૈલતરામજી એ કહ્યું પણ છે - ભવિ ભાગન વચ જોગે વશાય તુમ ઘનિ .....

૧૩) પાંચ ઈજ્જીયપ્રાણોનો તથા મનોબળનો વિનાશ તો ક્ષીણમોહ ગુણસ્થાનના અંતમાં થઈ જાય છે. વચ્ચનબળ અને શ્વાસોચછવાસ પ્રાણોનો વિનાશ સયોગ કેવળીના અંતિમ અંતર્મુહૂર્તમાં થાય છે. કાયબળનો વિનાશ સયોગકેવળીને અંતમાં થાય છે તરીકે આચુપ્રાણો વિનાશ અયોગકેવળી ગુણસ્થાનના અંતમાં થાય છે.

તેરમાના અંતમાં અર્થાતું ચૌદમા ગુણસ્થાનના પ્રથમ સમ્ભયમાં ૪ આત્માના સર્વ પ્રદેશ સ્થિર અર્થાતું અક્ષંપ થવાથી શરીરથી કિંચિતું ન્યૂન આકારવાળા થઈ જાય છે. સિદ્ધા અવસ્થાયોગ્ય આત્મ-પ્રદેશોનો આકાર નાળિયેરમાં સુકા ગોળા જેવો કિંચિતું ન્યૂન થઈ જાય છે.

પ્રશ્ન ૧૧૦ : સયોગકેવળી પરમાત્માના કેટલા અને ક્યા કર્માનો નાશ થઈ ગયો છે ?

**ઉત્તર :** તેરમા ગુણસ્થાનવર્તી અરહંત પરમાત્માની અવસ્થામાં નવા એકપણ કર્મ પ્રફૂલ્લિનો નાશ નથી થતો. આનું સ્પષ્ટીકરણ - જ્ઞાનાવરણાદિ ચારે ધાતિ કર્મોની કુલ મળીને સંખ્યા સુંદરાલીસ છે. (જ્ઞાનાવરણની -૫, દર્શનાવરણની - ૬, મોહનીયની - ૨૮ અને અંતરાયની - ૫) આનો નાશ તેરમા ગુણસ્થાનની પહેલા યથાસ્થાન થઈ ચૂક્યો છે.

અધાતિ કર્મોમાંથી નિમનાકિંત સોળ પ્રકૃતિઓ પણ અહી નથી -  
 (૧) નરકાયુ (૨) તિર્યચાયુ (૩) દેવાયુ આ ત્રણે આયુકર્મનું અહીં  
 અસ્તિત્વ જ જોવામાં નથી આવતું. નામકર્મની (૧) નરકગતિ (૨)  
 નરકગતયાનુપૂર્વી (૩) તિર્યચગતિ (૪) તિર્યચગતયાનુપૂર્વી (૫)  
 ક્રિદ્યનિન્દ્રય (૬) ત્રિદ્યનિન્દ્રય (૭) ચતુર્દ્યનિન્દ્રય (૮) ઉધોત (૯) આતપ  
 (૧૦) એકેનિન્દ્રય (૧૧) સાધારણ (૧૨) સૂક્ષ્મ અને (૧૩) સ્થાવર.  
 આયુકર્મની ત્રણ અને નામકર્મની તેર મળીને સોળ પ્રકૃતિઓ,  
 ઘાતિકર્મની ૪૭ + અધાતિ કર્મની ૧૬ = ૬૩.

## ધવલા પુસ્તક - ૧નો અંશ (પાના નં. ૧૮૧ થી ૧૮૨)

સામાન્યથી સ્યોગકેવળી જીવ છે ॥૨૧॥

કેવળપદથી અહીંયા કેવળજ્ઞાનનું ગ્રહણ કર્યું છે.

**શાંકા ૩૩ :** નામના એકદેશના કથન કરવાથી સંપૂર્ણ નામ છારા કહેવામાં આવેલ અર્થનો બોધ કેમ સંભવ છે ?

સમાધાન : ના, કારણ કે બળદેવ શબ્દના વાચ્યભૂત અર્થનો, તેના એકદેશરૂપ ‘દૈવ’ શબ્દથી પણ બોધ થતો જોવમાં આવે છે. આ રીતે પ્રતીતિ સિદ્ધ વાતમાં, “આ નહીં થઈ શકે” આ પ્રમાણે કહેવું નિષ્ફળ છે. અન્યથા બધી જગતાએ અવ્યવસ્થા થઈ જશે.

જેમાં ઈન્ડ્રિય, આલોક અને મનની અપેક્ષા નથી હોતી, તેને કેવળ અથવા અસહાય કહે છે. તે કેવળ અથવા અસહાય જ્ઞાન જેને હોય છે, તેને કેવળી કહે છે. મન, વચન અને કાચની પ્રવૃત્તિને યોગ કહે છે. જે યોગની સાથે રહે છે, તેને સ્યોગ કહે છે. આ રીતે જે સ્યોગ હોતાં થકા કેવળી છે તેમને સ્યોગકેવળી કહે છે.

આ સૂત્રમાં જે સ્યોગપદનું ગ્રહણ કર્યું છે તે અંતદીપક હોવાથી નીચેના સંપૂર્ણ ગુણસ્થાનોના સ્યોગપણાનું પ્રતિપાદક છે. ચારે ધાતિયા કર્મોનો ક્ષય કરી દેવાથી, વેદનીય કર્મને નિઃશક્ત કરી દેવાથી અથવા આઠેય કર્મોના અવયવરૂપ ૫૦ ઉત્તર-કર્મ-પ્રકૃતિઓને નષ્ટ કરી દેવાથી આ ગુણસ્થાનમાં ક્ષાચિકલાવ હોય છે.

**વિશેષાર્થ :** છતાંચ અરહંત પરમેષ્ઠીના ચારે ધાતિયાકર્મોની ૪૭, નામકર્મની ૧૩ અને આચુકર્મની ૩ આ રીતે ૫૩ પ્રકૃતિઓનો અભાવ થાય છે. છતાં પણ અહીં ૫૦ કર્મપ્રકૃતિઓનો અભાવ બતાવ્યો છે. એનો એવો અભિપ્રાય સમજવો જોઈએ કે આચુની ત્રણ પ્રકૃતિઓના નાશ માટે પ્રયત્ન નથી કરવો પડતો.

મુક્તિને પ્રાપ્ત થવાવાળા જીવના એક મનુષ્યાચુને છોડીને અન્ય આચુની સત્તા નથી જોવામાં આવતી. માટે અહીંયા આચુકર્મની ત્રણ પ્રકૃતિઓની અવિક્ષા કરીને ૫૦ પ્રકૃતિઓનો નાશ બતાવવામાં આવ્યો છે.

(૧૯૮૭ માટે લખાયું) પ્રાચીન નિર્ણય - ગુણસ્થાન

॥૧૩॥ એ પણ કોઈ વિશ્વાસ

એ કૃત હતું હોમાજાળું રહેતું હોમાજાળું

શાલ નિષ્ઠા નિષ્ઠા નિષ્ઠા : ૧૪ ૧૪

૧૪

અયોગકેવળી ગુણસ્થાન

અયોગકેવળી આ અંતિમ ગુણસ્થાન છે. કેવળજ્ઞાન સાથે રહેવાવાળું આ બીજું ગુણસ્થાન છે. ક્ષપકશ્રેણીના ચારે ગુણસ્થાનો બાદ પ્રાખ થવાવાળું આ બીજું ગુણસ્થાન છે. વીતરાગી ચારે ગુણસ્થાનોમાંથી આ છેલ્લું ગુણસ્થાન છે. કેવળજ્ઞાનાંદ અનંત ચતુર્ષય સહિત અરહંત પરમાત્માનું પણ આ બીજું ગુણસ્થાન છે. યોગરહિત અર્થાત् અયોગરૂપ આ એક જ ગુણસ્થાન છે. તેરમા ગુણસ્થાનની જેમ અહીં પણ જ્ઞાન, સુખાંદ અનંતરૂપ છે. અયોગકેવળી ગુણસ્થાન પણ સકલ પરમાત્માનું જ છે.

યોગોનો નાશ થતાં જ સયોગકેવળી પરમાત્મા જ અયોગકેવળી કહેવાય છે. શરીરમાં રહેવા છતાં પણ યોગોનો નિરોધ તથા શ્કાસોઅછવાસ બંધ થવાથી મન-વચન-કાયના નિમિત્તથી થવાવાળા આત્મપ્રદેશોનું કંપન અટકી ગયું છે. તેથી આત્મા અને શરીરનું એકદ્વારા પરિબાધ સંબંધ હોવા છતાં નિમિત્ત-નૈમિત્તિક સંબંધનો અભાવ થઈ ગયો છે.

આચાર્યશ્રી નેમિયંડ્રાદેવે ગોમ્મટસાર જીવકાંડ ગાથા કપમાં અયોગકેવળી ગુણસ્થાનની પરિલાખા આ પ્રમાણે આપેલ છે.

**સીલેસિં સંપત્તો, ણિસ્ક્રાણિસ્સેસ આસવો જીવો ।**

**કર્મરચ્યવિપ્પમુક્તો, ગયજોગો કેવલી હોદિ ॥**

સંપૂર્ણ શીલના ઐશ્વર્યથી સંપન્ન, સર્વ આશ્રવ નિરોધક, કર્મબંધ રહિત જીવની યોગરહિત વીતરાગ સર્જણદશાને અયોગકેવળી ગુણસ્થાન કહે છે.

**નામ અપેક્ષા વિચાર :**

સયોગી જિન આ એક નામ છોડી પૂર્વોક્ત તેરમાં ગુણસ્થાનમાં કહેલા

સર્વ નામોનો અહીં પણ વ્યવહાર હોય છે. જેમ - અરહંત, અરહંત, અરહંત, કેવળી, પરમાત્મા, સકલ પરમાત્મા, પરમજ્યોતિ, નિષ્કંપ પરમાત્મા આદિ,

૪ પ્રશ્ન ૧૧૧ : અયોગેવળીને સકલપરમાત્મા કહેવામાં દોષ આવે છે શું ?

ઉત્તર : કાંઈ દોષ નથી આવતો, કારણ કે અયોગેવળી ગુણસ્થાનવર્તી અરહંત પરમાત્મા પ્રત્યક્ષમાં શરીરસહિત છે. તેથી સકલ પરમાત્મા જ છે. 'કલ' શબ્દનો અર્થ શરીર છે. સ = સહિત, સ + કલ = સકલ, સકલ = શરીર સહિત.

આ ગુણસ્થાનમાં ચારે અધારિ કર્મોમાંથી ૮૫ કર્મોની સત્તા છે. સમ્યકૃત્પ અપેક્ષા વિચાર :

ક્ષાયિક સમ્યકૃત્પ જ અહીં પણ પરમાવગાઢ સમ્યકૃત્પરૂપ કહેવાચ છે. તેરમા ગુણસ્થાનવત્ત અહીં પણ સમજુ લેવું જોઈએ.

ચારિત્ર અપેક્ષા વિચાર :

ચથાખ્યાત ચારિત્ર, તેરમા ગુણસ્થાનની જેમ.

કાળ અપેક્ષા વિચાર :

પાંચ હસ્ત સ્વરો (અ, ઈ, ઉ, ઊ, લુ)ના ઉચ્ચારણ કાળ સુધી અર્થાત્ અંતર્મુહૂર્ત કાળ છે. અહીં કાળના જગ્ઘન્ય, મદ્યમ કે ઉત્કૃષ્ટ ભેદ નથી. ચૌદ ગુણસ્થાનમાંથી આ અયોગેવળી ગુણસ્થાન જ એકમેવ એવું ગુણસ્થાન છે, જે પોતાના અંતર્મુહૂર્ત કાળનું યથાર્થ જ્ઞાન કરાવવામાં પૂર્ણ સમર્થ છે. અન્ય ગુણસ્થાનોના અંતર્મુહૂર્ત કાળ માટે આપણે કેવલજ્ઞાનગમ્ય યથાયોગ્ય અંતર્મુહૂર્ત કાળ એમ કહેવું અનિવાર્ય થઈ ગયું છે, કારણ કે અંતર્મુહૂર્તના યથાર્થ નિર્ણય માટે ચૌદમા ગુણસ્થાન જેવું કોઈ માપદંડ આપણી પાસે નથી.

ગમનાગમન અપેક્ષા વિચાર :

ગમન : ચૌદમા અયોગેવળી ગુણસ્થાનથી સિદ્ધદંશામાં જ ઉદ્વર્ગમન થાય છે, કારણ કે હવે કોઈપણ પ્રકારની ઓછા રહી નથી કે જેની પૂર્તિ કરવામાં આવે.

આગમન : આ ચૌદમા ગુણસ્થાનમાં આગમન માત્ર સયોગેવળી ગુણસ્થાનથી જ થાય છે, અન્ય કોઈપણ ગુણસ્થાનથી નહીં.

### વિશેષ અપેક્ષા વિચાર:

૧) અયોગકેવળી ગુણસ્થાનના ઉપાન્ત્ય સમયમાં ૭૨ પ્રફૃતિઓની નિર્જરા અર્થાત ક્ષય થઈ જાય છે અને અંતિમ સમયમાં શેષ ૧૩ પ્રફૃતિઓનો પણ નાશ થઈ જાય છે. આ કર્મોના નાશ થવાના સમયે જ સંસાર અવસ્થાનો વ્યય અને સાંદ્ર અનંતકાળ માટે સિદ્ધદશાનો ઉત્પાદ પણ થઈ જાય છે.

૨) યોગના અભાવને લીધે અયોગકેવળીને ઈર્થપિથાખ્લવ પણ નથી હોતો, જે અગ્યારમાં-બારમાં તથા તેરમામાં પણ થતો હતો.

૩) મુનિરાજના ચોર્યશીલાખ ઉત્તરગુણોની તથા શીલ સંબંધી ૧૮ હજાર બેદોની પૂર્ણતા અહીં અયોગકેવળી અવસ્થામાં થાય છે.

**પ્રશ્ન ૧૧૨:** શ્રાવકના પણ ઉત્તરગુણ અને શીલ હોય છે શું?

**ઉત્તર :** હા, જરૂર હોય છે. અહિસાંડ પાંચ અણુપ્રત, દિગ્પતાંડ ત્રણ ગુણપ્રત અને સામાચિક આંડ ચાર શિક્ષાપ્રત - કુલ મળીને આ બાર પ્રત હોય છે. તેને જ શ્રાવકના ઉત્તરગુણ કહે છે. ગુણપ્રત તથા શિક્ષાપ્રતને સપ્તશીલ પણ કહે છે.

૪) પૂર્ણ સંવર તથા પૂર્ણ નિર્જરા પણ અયોગકેવળીને જ હોય છે.

૫) અહીં પ્રયુક્ત અયોગ શબ્દ આંડ દીપક છે. સ્વયં અયોગકેવળી ગુણસ્થાનવર્તી અરહંત પરમાત્મા તો અયોગી છે જ અને અહીંથી ઉપરની સિદ્ધદશા અયોગરૂપ અને અશરીરી જ છે.

### ધવલા પુસ્તક - ૧નો અંશ (પાના નં. ૧૮૩ થી ૨૦૦)

હવે આચાર્ય પુષ્પદંત ભણારક અંતિમ ગુણસ્થાનના સ્વરૂપનું નિરૂપણ કરવા માટે, અર્થરૂપથી અરહંત પરમેષ્ઠીના મુખથી નીકળેલા, ગણાધરદેવ દ્વારા ગુંથાયેલા શબ્દ રચનાવાળા, પ્રવાહરૂપથી ક્યારેય પણ નાશ ન થવાવાળા અને સંપૂર્ણ દોષોથી રહિત હોવાને કારણ નિર્દોષ એવા આગળના સૂત્રને કહે છે.

સામાન્યથી અયોગકેવળી જીવ છે ॥૨૦॥

જેણા યોગ વિધમાન નથી, તેને અયોગ કહે છે. જેમાં કેવળજ્ઞાન જોવામાં આવે છે, તેને કેવળી કહે છે. જે યોગ રહિત એવા કેવળી હોય છે, તેને અયોગકેવળી કહે છે.

**શંકા ૩૪ :** પૂર્વ સૂત્રથી કેવળીપદની અનિવૃત્તિ થવા પર આ સૂત્રમાં ફરીથી કેવળીપદનું ગ્રહણ ન કરવું જોઈએ ?

**સમાધાન :** આ કોઈ દોષ નથી, કારણકે સમનાસ્ક જીવોના સવિદિશ અને સર્વકાળમાં મનના નિમિત્તથી ઉત્પન્ન થયેલું જ્ઞાન સ્વીકાર કરેલું છે અને પ્રતીત પણ થાય છે, આ પ્રકારનો નિયમ હોવાથી અયોગીઓને કેવળજ્ઞાન નથી થતું, કારણ કે અહીંચા મન નથી હોતું. આ પ્રકારે વિવાદચરસ્ત શિષ્યોને અયોગીઓમાં કેવળજ્ઞાનના અસ્તિત્વના પ્રતિપાદન માટે આ સૂત્રમાં ફરીથી કેવળીપદનું ગ્રહણ કર્યું.

**શંકા ૩૫ :** આ સૂત્રમાં કેવળી આ વચનના ગ્રહણ કરવા માત્રથી અયોગી જીવનના કેવળજ્ઞાનનું અસ્તિત્વ કેવી રીતે જણાય છે ?

**સમાધાન :** જો આ પૂછો છો તો અમે પણ પૂછીએ છીએ કે ચક્ષુથી સ્તંભ આદિનું અસ્તિત્વનું જ્ઞાન કેવીરીતે થાય છે ? જો કહેવાય કે ચક્ષુજ્ઞાનમાં અન્યથા પ્રમાણાતા નથી આવી શકતી, માટે ચક્ષુ છારા ગૃહીત સ્તંબાદિકનું અસ્તિત્વ છે, એમ માની લઈએ છીએ. તો અમે પણ કહી શકીએ છીએ કે અન્યથા વચનમાં પ્રમાણાતા નથી આવી શકતી, માટે વચનના રહેવા પર તેનું વાચ્ય પણ વિઘ્નમાન છે, એવું પણ કેમ નથી માની લેતા, કારણ કે બંને વાત સરખી છે.

**શંકા ૩૬ :** વચનની પ્રમાણાતા અસિદ્ધ છે, કારણ કે ક્યાંક વચનમાં પણ વિસંવાદ જોવામાં આવે છે.

**સમાધાન :** ના, કારણ કે આના પર તો અમે પણ એવું કહી શકીએ છીએ કે ચક્ષુની પ્રમાણાતા અસિદ્ધ છે, કારણ કે વચનની જેમ ચક્ષુમાં પણ ક્યાંક વિસંવાદ પ્રતીત થાય છે.

**શંકા ૩૭ :** જો ચક્ષુ અવિસંવાદ હોય છે, તેને જ અમે પ્રમાણ માનીયે છીએ ?

**સમાધાન :** ના, કારણ કે બધા ચક્ષુઓનો સવિદિશ અને સર્વકાળમાં અવિસંવાદિપણું નથી જોવામાં આવતું.

**શંકા ૩૮ :** જે દેશ અને જે કાળમાં ચક્ષુના અવિસંવાદ ઉપલબ્ધ થાય છે, તે દેશ અને કાળમાં તે ચક્ષુમાં પ્રમાણાતા રહે છે ?

**સમાધાન :** જો કોઈ દેશ અને કોઈ કાળમાં અવિસંવાદી ચક્ષુને પ્રમાણાતા માનો છો તો પ્રત્યક્ષ અને પરોક્ષ વિષયમાં સવિદિશ અને

સર્વકાળમાં અવિસંવાદી એમ વિવક્ષિત વચનને પ્રમાણ કેમ નથી માનતા ?

**શંકા 39 :** પરોક્ષ-વિષયમાં ક્યાંક વિસંવાદ જોવામાં આવે છે, માટે સર્વદિશ અને સર્વકાળમાં વચનમાં પ્રમાણાતા નથી આવી શકતી ?

**સમાધાન :** આ કહેવું પણ ઠીક નથી, કારણ કે તેમાં વચનનો અપરાધ નથી, પરંતુ પરોક્ષ વિષયના સ્વરૂપને નહીં સમજવાવાળા પુરુષનો જ તેમાં અપરાધ જોવામાં આવે છે. કંઈ બીજાના દોષથી બીજાને તો પકડવામાં નથી આવતા, અન્યથા અવ્યવસ્થા પ્રાપ્ત થઈ જશે.

**શંકા 40 :** પરોક્ષ વિષયમાં જે વિસંવાદ ઉત્પન્ન થાય છે, તેમાં વક્તાનો જ દોષ છે, વચનનો નહીં, એ કેવીરીતે જાણ્યું ?

**સમાધાન :** ના, કારણ કે તે જ વચનથી ફરી અર્થના નિર્ણયમાં પ્રવૃત્તિ કરવાવાળા તે જ અથવા કોઈ બીજા પુરુષની બીજુવાર અર્થની પ્રાપ્તિ બરાબર જોવામાં આવે છે. તેથી જ્ઞાત થાય છે કે જ્યાં તત્ત્વ નિર્ણયમાં વિસંવાદ ઉત્પન્ન થાય છે, ત્યાં વક્તાનો જ દોષ છે, વચનનો નહીં.

**શંકા 41 :** જે વચનની વિસંવાદિતા કે અવિસંવાદિતાનો નિર્ણય નથી થયો, તેની પ્રમાણાતાનો નિશ્ચય કેવી રીતે કરાય ?

**સમાધાન :** આ કોઈ દોષ નથી, કારણ કે જેની અવિસંવાદિતાનો નિશ્ચય થઈ ગયો છે એવા આ આર્ધના અવયવરૂપ વચનના વિવક્ષિત આર્ધના અવયવરૂપ વચનના પણ અવયવીની અપેક્ષા એકપણું થઈ જાય છે, માટે વિવક્ષિત અવયવરૂપ વચનની સત્યતાનું જ્ઞાન થઈ જાય છે.

**વિશાળાર્થ :** જેટલા પણ આર્ધ - વચન છે તે બધા આર્ધના અવયવ છે, માટે આર્ધમાં પ્રમાણાતા હોવાથી તેના અવયવરૂપ બધા વચનોમાં પ્રમાણાતા આવી જાય છે.

**શંકા 42 :** આધુનિક આગમ અપ્રમાણ છે, કારણ કે અર્વાચીન પુરુષોએ તેના અર્થનું વ્યાખ્યાન કર્યું છે.

**સમાધાન :** આ કહેવું પણ ઠીક નથી, કારણ કે જ્ઞાન-વિજ્ઞાનથી સહિત હોવાને લીધે પ્રમાણાતાને પ્રાપ્ત આ ચુગના આચાર્યો ઝારા આના અર્થનું વ્યાખ્યાન કરેલું છે; માટે આધુનિક આગમ પણ પ્રમાણ છે.

**શંકા 43 :** છન્દોને સત્યવાદીપણું કેમ માનવામાં આવી શકે ?

**સમાધાન :** ના, કારણ કે શ્રુતના અનુસાર વ્યાખ્યાન કરવાવાળા આચાર્યોની પ્રમાણાતા માનવામાં કંઈ વિરોધ નથી.

**શંકા 44 :** આગમનો આ અર્થ પ્રામાણિક ગુરુ પરંપરાના ક્રમથી આવેલો છે, તે ડેવી રીતે નિશ્ચય કરી શકાય ?

**સમાધાન :** ના, કારણ કે પ્રત્યક્ષભૂત વિષયમાં તો બધી જગ્યાએ વિસંવાદ ઉત્પન્ન નહીં હોવાથી નિશ્ચય કરી શકાય છે અને પરોક્ષ વિષયમાં પણ, જેમાં પરોક્ષ-વિષયનું વર્ણન કરવામાં આવ્યું છે, તે ભાગ અવિસંવાદી આગમના બીજા ભાગોની સાથે આગમની અપેક્ષા એકતાને પ્રાપ્ત થવા પર, અનુમાનાદિ પ્રમાણો દ્વારા બાધક પ્રમાણોનો અભાવ સુનિશ્ચિત થવાથી તેનો નિશ્ચય કરી શકાય છે અથવા જ્ઞાન વિજ્ઞાનથી ચુક્ત આ ચુગના અનેક આંચાર્યોના ઉપદેશથી તેની પ્રમાણાતા જાળવી જોઈએ અને ઘણા સાધુ આ વિષયમાં વિસંવાદ નથી કરતા, કારણ કે આ રીતનો વિસંવાદ ક્યાંચ પણ જોવામાં નથી આવતો. તેથી આગમના અર્થના વ્યાખ્યાતા પ્રામાણિક પુરુષ છે, આ વાત નિશ્ચિત થઈ જવાથી આર્ધ - વચનની પ્રમાણાતા પણ સિદ્ધ થઈ જાય છે અને આર્ધ - વચનની પ્રમાણાતાના સિદ્ધ થઈ જવાથી મનના અભાવમાં પણ કેવળજ્ઞાન થાય છે, આ વાત પણ સિદ્ધ થઈ જાય છે.

**શંકા 45 :** સયોગડેવળીને તો કેવળજ્ઞાન મનથી ઉત્પન્ન થતું થશું ઉપલબ્ધ થાય છે.

**સમાધાન :** આ કહેવું પણ ઠીક નથી, કારણ કે જે જ્ઞાન આવરણ કર્મના ક્ષયથી ઉત્પન્ન છે અને જે અક્રમવર્તી છે, તેની ફરી ઉત્પત્તિ માનવી વિરુદ્ધ છે.

**શંકા 46 :** જે પ્રકારે મતિ આદિ જ્ઞાન સ્વયં જ્ઞાન થવાથી પોતાની ઉત્પત્તિમાં કારકની અપેક્ષા કરે છે, તે જ પ્રકારે કેવળજ્ઞાન પણ જ્ઞાન છે, તેથી તેને પણ પોતાની ઉત્પત્તિમાં કારકની અપેક્ષા કરવી જોઈએ ?

**સમાધાન :** ના, કારણ કે ક્ષાયિક અને ક્ષાયોપશમિક જ્ઞાનમાં સાધ્યર્થ નથી જોવામાં આવતું.

**શંકા 47 :** અપરિવર્તનશીલ કેવળજ્ઞાન પ્રત્યેક સમયમાં પરિવર્તનશીલ પદાર્થોને ડેવી રીતે જાણે છે ?

**સમાધાન :** એવી શંકા ઠીક નથી, કારણ કે જોય પદાર્થોની જેવું પરિવર્તન કરવાવાળા કેવળજ્ઞાનના તે પદાર્થોને જાળવામાં કોઈ

વિરોધ નથી આપતો.

**શંકા 48 :** જોયની પરતંત્રતાથી પરિવર્તન કરવાવાળા કેવળજ્ઞાનની ફરીથી ઉત્પત્તિ શા માટે ન મનાય ?

**સમાધાન :** ના, કારણ કે કેવળ ઉપયોગ-સામાન્યની અપેક્ષાએ કેવળજ્ઞાનની ફરી ઉત્પત્તિ નથી થતી. વિશેષની અપેક્ષા તેની ઉત્પત્તિ હોવા છતાં પણ તે (ઉપયોગ) ઈન્જિન્યુલાન્ડિક કર્મ નાચ થઈ ગયા છે એવા કેવળજ્ઞાનની ઈન્જિન્યુલાન્ડિકથી ઉત્પત્તિ થવામાં વિરોધ આવે છે.

નીજુવાત એ છે કે કેવળજ્ઞાન અસહાય છે, માટે તે ઈન્જિન્યુલાન્ડિની સહાયતાની અપેક્ષા નથી કરતું, અન્યથા સ્વરૂપની હાનિનો પ્રસંગ આવી જશે.

**શંકા 49 :** જો કેવળજ્ઞાન અસહાય છે તો તે પ્રમેયને પણ ન જાણો?

**સમાધાન :** એવું નથી, કારણ કે પદાર્થોને જાણવું તેનો સ્વભાવ છે અને વસ્તુનો સ્વભાવ બીજાના પ્રશ્નોને યોગ્ય નથી થયાં કરતાં, જો સ્વભાવમાં પણ પ્રશ્ન થવા લાગે તો પછી વસ્તુઓની વ્યવસ્થા જ નહીં થઈ શકે.

**શંકા 50 :** પાંચ પ્રકારના ભાવોમાંથી આ ગુણસ્થાનમાં ક્યો ભાવ છે?

**સમાધાન :** સંપૂર્ણ ધાતિયા કર્મોના ક્ષીણ થઈ જવાથી અને થોડા જ સમયમાં અધાતિયા કર્મોના નાશને પ્રાપ્ત થવાવાળા હોવાથી આ ગુણસ્થાનમાં ક્ષાયિક ભાવ છે.

### મોક્ષ

ભાઈ! ઉત્તમ સુખનો ભંડાર તો મોક્ષ છે. તેથી મોક્ષ પુરુષાર્થ જ સર્વ પુરુષાર્થમાં શ્રેષ્ઠ છે. પુરુષનો પુરુષાર્થ પણ આની અપેક્ષાએ હીન છે અને સંસારના વિષયોની પ્રાપ્તિ હેતુ જેટલા પ્રયત્ન છે, તે તો એકદમ પાપ છે, તેથી તે સર્વથા ત્વયજ્ય છે. સાધકને મોક્ષપુરુષાર્થની સાથે અણુપ્રતાદિં શુલ્કરાગરૂપ જે ધર્મપુરુષાર્થ છે, તે અસદ્ભૂતવ્યવહારનયથી મોક્ષનું સાધન છે.

તેથી શ્રાવકની ભૂમિકામાં તે પણ વ્યવહારનયના વિષયમાં ગ્રહણ કરવા યોગ્ય છે. મોક્ષનો પુરુષાર્થ તો સર્વશ્રેષ્ઠ છે, પરંતુ તેના અભાવમાં અર્થાતું નીચલી સાધક દશામાં અણુપ્રત-મહાપ્રતાદિરૂપ ધર્મપુરુષાર્થ જરૂર ગ્રહણ કરવો જોઈશે.

(શ્રાવક ધર્મ પ્રકાશ પાનું ૧૫૫)

શિલ્પ અપરે રાંધી

લાલદેવનગરના મહોદૃષ્ટિનાં કર્ણ કાં વચ્ચાયાં રાતાડામણાં ૧૩૧૦  
શિલ્પ અપરે રાંધી ૨૦૮ . ૬ ૧૪ લાલદેવનગરના મહોદૃષ્ટિનાં  
સીધા નિર્મણ જાઈ ગિય માટેનું નિર્મણના નેતૃત્વનાં એક જાંદ્રાં  
કંદળનિયુક્ત રીતનું હાનાં હેઠળ નિર્મણનિયુક્ત પણે અનુભૂતિના કંદળ  
નિર્મણનિયુક્ત નિર્મણનાં એક નિર્મણ નિર્મણ નિર્મણ નિર્મણ નિર્મણ નિર્મણ



### ગુણસ્થાનાતીત : સિદ્ધ ભગવાન

આ દુઃખમય સંસાર અવસ્થાથી કેટલાક જીવ તો સમ્યજ્ઞદર્શન પ્રાપ્ત કરવા છીતાં અનેક ભવોમાં કઠોર અને અપ્રતિહત સાધના કર્યા બાદ જ સિદ્ધાવસ્થાને પ્રાપ્ત કરે છે. અનેક જીવ માત્ર અનેક વર્ષોની સાધનાથી જ સિદ્ધ થઈ જાય છે. વિશિષ્ટ મહાપુરુષ માત્ર એક અંતર્મુહૂર્તમાં જ અનંત, ધ્યુપ, અવિચલ, પંચમગતિને પ્રાપ્ત કરી લે છે.

**પ્રશ્ન ૧૧૩ :-** અમે માત્ર અંતર્મુહૂર્તમાં જ સિદ્ધ થવા માંગીએ છીએ, અમને કઠોર સાધના ફાવતી નથી અને મુક્તિ માટે અમે હવે વધારે રાહ પણ જોવા નથી માંગતા, તેથી અતિશીધ મુક્ત થવાનું સુગમ સાધન બતાવોને !

ઉત્તર :- મોક્ષ પ્રાપ્તિનો વાસ્તવિક ઉપાય તો એક માત્ર નિજ શુદ્ધાત્મસ્વભાવનો નિર્વિકલ્પપણે સ્વીકાર અથવા અનુભવન તથા લીનતા કરવી તે જ છે, જેને અમોએ ગુણસ્થાનના પ્રકરણમાં અનેકવાર કર્યું છે. જીનવાણી માતા પણ આપણાને ચારે અનુયોગોમાં અત્ર-તત્ત્ર-સર્વત્ર આ વિષયને સમજાવી રહી છે.

ભાઈસાહેલ ! આત્મસાધનાના પરમપવિત્ર કાર્યની પહેલા, અંત અથવા મદ્યમાં કયાંચ પણ કષ્ટ, દુઃખ કે તકલીફ નથી. બધી અસહ્ય તકલીફોને સમાપ્ત કરવાનો એકમાત્ર સાચો ઉપાય પર તથા પરભાવોથી નિરપેક્ષ આત્મસાધન જ છે. આ જ એક સુગમ તથા સહજ સાધન છે.

જ્યાં સુધી નિજાતમસ્વભાવનું ચથાર્થ જ્ઞાન નથી થતું, ત્યાં સુધી આ પ્રકારના અનેક વિકલ્પ/પ્રશ્ન થતા જ રહેશે. આ બધાંનાં નિરાકરણ માટે સર્વજ્ઞ પ્રણિત આગમનું અદ્યયન-મનન-ચિંતનાદિ કર્યું અને આત્મજ્ઞ લોકોનો સત્ત્વમાગમ કરવો તે જ એક શરણ છે, આધાર છે અન્ય બીજો

કોઈ ઉપાય નથી.

બધા આત્મસાધક યથાયોગ્ય માત્ર એક અંતર્મુહૂર્તના આત્મ-દ્યાન/આત્મલીનતા કરીને જ મુક્તિની પ્રાપ્તિ કરે છે, તેમાં કાંઈ મતલેદ નથી.

છતાંય આ વિશિષ્ટ અંતર્મુહૂર્ત પુરુષાર્થની પૂર્ણતા અને તેના ફળની પ્રાપ્તિ માટે આદિનાથ જૈવા મુનિરાજને એક હજાર વર્ષ લાગ્યા, બાહુબલી મુનિવરને એક વર્ષ લાગ્યું અને ભરત ચક્રવર્તી માટે એક અંતર્મુહૂર્તની જ મુનિ અવસ્થાની સાધના પર્યાત થઈ ગઈ, છતાંય પુરુષાર્થ તો સરખો જ રહ્યો.

ખરેખર જોવા જઈએ તો ચક્રવર્તીની અબ્રત અવસ્થામાં પણ પોતપોતાની ભૂમિકા અનુસાર યથાયોગ્ય આત્મ - સાધનાનો પુરુષાર્થ સતત ચાલતો જ રહે છે, પરંતુ સ્થુળ / બાહ્ય બ્રહ્મિદ્યારી જગત તેને સ્વીકારતા નથી.

જ્યારે સૈાકિક જીવનમાં પણ કદાચિત્ પોતાની દરણાની પૂર્તિ થાય છે તો થોડીધણી આકુળતા મટે છે. અર્થાત્ આપણાને પણ તત્કાળ જ અલ્પ સુખનો નિરાકુળતાનો આભાસ થાય છે, ત્યારે જ્યાં સર્વ પ્રકારની સર્વર્થા દરણાજન્ય આકુળતા નષ્ટ થઈ જાય છે, ત્યાં અનંતસુખ નિયમથી થશે જ. આ રીતે અનુમાનથી પણ સર્વ આકુળતા રહિત સિદ્ધ જીવોના અનંતસુખી હોવાનું યથાર્થ અનુમાનજ્ઞાન આપણે કરી શકીએ છીએ.

અનંત સર્વજ્ઞ પ્રણીત આગમ પરંપરારી તો આપણાને આ માન્ય જ છે કે સિદ્ધ અનંત સુખી છે.

આચાર્યશ્રી નેમિચંદ્રદેવે ગોમ્મટસાર જીવકાંડ ગાથા-૮માં ગુણસ્થાનાતીત સિદ્ધ ભગવાનની પરિલાઘા આ પ્રમાણે આપેલ છે :-

અદૃવિહકમવિયલા, સીદીભૂદા ણિર્જણા ણિચ્ચા ।

અદૃગુણ કિદકિચ્ચા, લોયગપિવાસિણો સિદ્ધા ॥

જ્ઞાનાવરણાદિ અષ્ટકર્મ રહિત, અનંતસુખામૃતસ્વાદિ, પરમ શાંતિમય, મિથ્યાદર્શનાદિ સર્વવિકારરહિત, નિર્વિકાર, નિત્ય, સમ્યકૃત્વ આદિ આઠ પ્રધાનગુણયુક્ત, અનંત શુદ્ધ પર્યાયોથી સહિત, કૃતકૃત્ય, લોકાચરિથત, વીતરાગી, સર્વજ્ઞ નિકલ પરમાત્માને સિદ્ધ ભગવાન કહે છે.

### નામ અપેક્ષા વિચાર:

ગુણસ્થાનાતીત સિદ્ધ ભગવાનને જ વ્યવહારાતીત, પરમશુદ્ધ, કાર્યપરમાત્મા, લોકાંગવાસી, સંસારાતીત, નિરંજન, નિરાકાર, નિષ્કામ, નિષ્કર્મ, સાધ્યપરમાત્મા, પરમસુખી, જ્ઞાનાકારી, જ્ઞાનશરીરી, ચિરવાસી, અશરીરી ઈત્યાદિ અનેક નામ છે. તેમને દેહમુક્ત પણ કહે છે.

### સમ્યકૃત્વ અપેક્ષા વિચાર:

ક્ષાયિક સમ્યકૃત્વ જ પરમાવગાઢુપ નામને પ્રાપ્ત થાય છે. સામાન્ય ક્રષ્ણિથી ચોથા ગુણસ્થાનમાં પ્રગટ થવાવાળા સમ્યકૃત્વ અને સિદ્ધા-અવસ્થાનું સમ્યકૃત્વ - બંને સમાન છે, આ કથન સત્ય છે. આ વિષયને વિશેષ અપેક્ષાથી વિચારીએ તો અંતરનો પણ આપણે સ્વીકાર કરવો જોઈએ. જ્ઞાનગુણની અનંતતા વ્યક્ત થઈ ગઈ, ચારિત્ર પણ પરિપૂર્ણ શુદ્ધ થઈ ગયું, એવા અનેક સહચર ગુણોની વિશેષતા/ પર્યાયોથી સમ્યકૃત્વમાં પણ વિશેષતા કહેવામાં આવે છે. તેને પણ માનવું જ જોઈએ, કારણ કે એક ગુણની પર્યાય, લેદ અપેક્ષાએ અન્ય ગુણ ની પર્યાયથી કથંચિત્ ભિન્ન હોવા છતાં પણ સર્વથા ભિન્ન તો છે નહીં. એક આત્માના એક-એક પ્રદેશમાં અનંતગુણ અને તેની અનંત પર્યાયો અવિરોધરૂપથી રહે છે.

સાત તત્વોના યથાર્થ શ્રદ્ધાનની અપેક્ષાથી ચોથા ગુણસ્થાનનું સમ્યકૃત્વ અને સિદ્ધ ભગવાનનું સમ્યકૃત્વ સરખું છે. આ કથનને સુરક્ષિત રાખતા થકા આ બધું સમજવાની આવશ્યકતા છે.

સમ્યકૃત્વ તથા જ્ઞાનગુણની પર્યાયોમાં લક્ષણાની અપેક્ષા થી કાંઈ પરિવર્તન ન હોવા છતાં પણ બંને અથવા અનંત ગુણોના સહચારીપણાને કારણ જે પરસ્પરમાં આરોપીત વ્યવહાર હોય છે - તેને પણ યથાયોગ્ય - યથાસ્થાન રીતથી સ્વીકારવું ઉચિત છે.

જેમ આંખ બંધ કરી ને ચાલવું અને આંખોથી જોઈને ચાલવું - બંને અવસ્થાઓમાં ચાલવાનું કામતો પગથી જ થાય છે, છતાંચ આંખોથી જોઈને પગથી ચાલવામાં જે વિશેષતા હોય છે, તે વિશેષતા આંખો વગર નથી હોતી. તે જ પ્રકારે જ્ઞાનગુણના અનંતરૂપ પરિણામનની સાથે સમ્યકૃત્વ આદિ ગુણોમાં વિશેષતા કહેવામાં આવે છે, તેનો પણ સ્વીકાર કરવો જોઈએ.

### ચારિત્ર અપેક્ષા વિચાર :

અહીંયા પરમ યથાજ્યાત ચારિત્ર હોય છે.

બારમા ગુણસ્થાનમાં જ ચારિત્ર યથાજ્યાત થઈ ગયું છે, છતાંચ તેરમામાં અનંતજ્ઞાનને કારણ તેમાં વધારે વિશેષતા કહેવામાં આવી છે. એક ગુણનું રૂપ અન્ય ગુણના પરિણામમાં વિશિષ્ટ રીતે રહે જ છે. ચૌદમા ગુણસ્થાનમાં યોગજન્ય આત્મપ્રદેશોના કંપનપણાનો પણ અભાવ થઈ જવાથી ચારિત્રમાં વધારે વિશેષતા આવે તે સ્વાભાવિક જ છે. હવે અહીં સિદ્ધ અવસ્થામાં તો ચાર અધાતિ કર્મોનો પણ નાશ થઈ ગયો છે, માટે ચારિત્રની નિર્મિત પરિણામિં અતિવિશિષ્ટતા આવી છે.

વાસ્તવિક રીતે જોઈએ તો અધાતિકર્મ પણ ધાતિકર્મ જેવું જ કામ કરે છે.

**પ્રશ્ન ૧૧૪ :** અધાતિ કર્મોને આપ ધાતિકર્મ શા માટે કહો છો ?

**ઉત્તર :** ભાઈસાબ ! અનંત જ્ઞાનાદિ સ્વભાવ પર્યાયોના વ્યક્ત થવા પર પણ તે કર્મ સિદ્ધ અવસ્થાની પ્રાસ્તિમાં સાક્ષાત અદ્યાણ નાખવામાં નિમિત થઈ જાય છે, આ અપેક્ષાની મુખ્યતાથી અમે અધાતિ ને પણ ધાતિ કહ્યા છે.

**પ્રશ્ન ૧૧૫ :** જેમ - યથાજ્યાત ચારિત્રમાં તેરમા, ચૌદમા ગુણસ્થાનોમાં પરિવર્તન / બદલી થાય છે. અર્થાત પરમ યથાજ્યાત ચારિત્ર થઈ જાય છે, તેમ જ શું સુખમાં પણ કાંઈ ફરક થાય છે ?

**ઉત્તર :** હા , સુખમાં પણ અવશ્ય બદલી થાય છે. જે સુખ ક્ષીણકષાય ગુણસ્થાનમાં માત્ર પૂર્ણ થઈ ગયું છે, તે સુખ સચ્યોગ - અયોગ ગુણસ્થાનમાં કેવળજ્ઞાનની અપેક્ષા અનંતસુખ કહેવામાં આવે છે અને હવે આ સિદ્ધાવસ્થામાં વેદનીય કર્મના અભાવથી તે જ અનંતસુખ ને અવ્યાબાધ અનંતસુખ કહેવામાં આવે છે.

સુખ તથા જ્ઞાન વિષયનો ખુલાસો ચિદવિલાસ પાના નં . ૩૭ પર આ પ્રકારે આપેલ છે:

જ્ઞાનનું સુખ યુગપદ હોય છે અને પરિણામોનું સુખ સમય માત્રનું છે. અર્થાતું સમય - સમયના પરિણામ જચારે આવે છે, ત્યારે સુખ વ્યક્ત થાય છે. ભવિષ્યકાળના પરિણામ જ્ઞાનમાં આવ્યા, પરંતુ વ્યક્ત થયા નહીં. તેથી પરિણામનું સુખ કમપત્રી છે અને તે તો પ્રત્યેક સમયમાં નવું - નવું થાય છે. જ્ઞાનોપયોગ યુગપદ છે, તે

ઉપયોગ પોત - પોતાના લક્ષણ સહિત છે. તેથી પરિણામનું સુખ નવીન છે અને જ્ઞાનનું સુખ યુગપદ છે.

**પ્રશ્ન ૧૧૬ :** કેવળજ્ઞાન થવા છતાં પણ સુખના અવ્યાબાધ થવામાં શું બાધા છે?

**ઉત્તર :** વેદનીય કર્મની સત્તા અને તેનો ઉદય - આ જ સુખને અવ્યાબાધ થવામાં બાધક નિમિત્ત થાય છે.

#### કાળ અપેક્ષા વિચાર :

સાદિ અનંત કાળ. સિદ્ધ અવસ્થાનો પ્રારંભ થાય છે, તેથી તેનો કાળ સાદિ (સ+આદિ) છે અને આ અવસ્થાનો ક્યારેય નાશ થશે જ નહિ, તેથી સર્વે સિદ્ધ ભગવાન નિયમથી સાદિ અનંત જ છે.

જ ઢાળા શાસ્ત્રની છ્ડી ઢાલના તેરમા છંદમાં આ વિષયને ગ્રંથકારે આ શબ્દોમાં કહ્યું છે:-

રહિ હૈ અનંતાનંત કાલ, થથા તથા શિવ પરિણયે.

આ રીતે સિદ્ધોનો કાળ સાદિ અનંત હોવાથી કાળના જગ્ધન્ય અને ઉત્કૃષ્ટપણાથી સંબંધ જ નથી.

#### ગમનાગમન અપેક્ષા વિચાર :

**ગમન :** સિદ્ધ અવસ્થાથી કોઈ ઉપર અન્ય ઉત્કૃષ્ટ અવસ્થા છે જ નહિ. સિદ્ધ જીવનું અન્યત્ર ગમન થતું નથી. માટે તે ગમન રહિત અવસ્થિત/સ્થિર જ રહે છે.

**આગમન :** અયોગકેવળી ગુણસ્થાનથી અહીં આગમન થયું છે, અન્ય ગુણસ્થાનોથી અહીં આગમન પણ સંભવ નથી.

#### વિશેષ અપેક્ષા વિચાર :

૧) આમ તો અનંતાનંત સિદ્ધ ભગવાનોના જ્ઞાનાદિ અનંતાનંત ગુણોની પચ્ચાયોમાં કિંચિત પણ અંતર નથી તો પણ વ્યંજનપર્યથ અથવિત આકારમાં અંતર હોય છે. જીવ સ્વયં સ્વભાવથી અમૂર્તિક તો છે જ. હવે સિદ્ધ દશામાં શરીરનો અભાવ થવાથી સર્વથા તથા સદાને માટે નિરાકાર તથા અમૂર્તિક થઈ ગયા છે.

પ્રદેશાત્પ સામાન્ય ગુણની અપેક્ષાથી કોઈ ને કોઈ આકાર થવો તે વાત અલગ છે અને શરીરના અભાવથી નિરાકાર થયું અલગ છે. આ નિરાકારપણું પ્રદેશાત્પ ગુણનું જ કાર્ય છે, જીતાંચ તેને શરીરના અભાવની

મુખ્યતા કરીને કહ્યું છે. આ બંને કથનમાં વિરોધ નથી. આ નિરાકારપણા ને લીધે જ જે આકાશના ક્ષેત્રમાં એક સિદ્ધ ભગવાન બીરાજમાન છે, તે જ આકાશના ક્ષેત્રમાં અન્ય અનંત સિદ્ધ ભગવાન પણ પોતાની સ્વતંત્ર સત્તાથી બીરાજે છે. આ કાર્ય અવગાહનત્વ પ્રતિજીવી ગુણાનું કાર્ય છે.

૨) ભૂતપ્રજ્ઞાપન મૈગમનથી ક્ષેત્ર, કાળ આદિ છારા પણ આ સિદ્ધોમાં ભેદ કરવામાં આવે છે. જેમ કે - વિદેહક્ષેત્રથી મુક્ત, ભરતક્ષેત્રથી મુક્ત, ઉત્સર્પણી કાળના ચોથાકાળથી મુક્ત આદિ.

૩) સિદ્ધ દર્શાનો ઉત્પાદ મનુષ્ય ક્ષેત્ર નિવાસના અંતિમ સમયમાં અને મદ્યમ લોકમાં જ થાય છે. આ ક્રાંતિ થી વિચાર કરવામાં આવે તો સિદ્ધાલય તો મનુષ્યલોક જ છે, છતાંચ સિદ્ધદર્શા ઉત્પણ થતાં જ પરમપવિત્ર સિદ્ધ જીવનું અજ્ઞુગતિથી આઠમી ઈષ્ટપ્રાગભાર પૃથ્વી સુધી ગમન થાય છે અને ત્યાં જ અનંતકાળ સુધી આઠ ગુણોથી અલંકૃત રહે છે. સિદ્ધ પૂજનમાં પણ કહ્યું છે. -

સમક્ષિત દર્શન જ્ઞાન, અગુરુલઘુ અવગાહના,

સૂક્ષ્મ વીરજ્યાન, નિરાબાધ ગુણ સિદ્ધ કે.

દોહામાં આઠ ગુણ અર્થાત્ પર્યાયોનું કથન છે, જે આઠે કર્મોના અભાવથી વ્યક્ત થઈ ગયા છે, તે આ પ્રકારે છે - (જુઓ તત્વાર્થસાર અદ્યાય ૮, શ્લોક ૩૭ થી ૪૦)

- (૧) જ્ઞાનાવરણ કર્મના અભાવથી અનંત જ્ઞાન,
- (૨) દર્શનાવરણ કર્મના અભાવથી અનંતદર્શન,
- (૩) દર્શનમોહનીય કર્મના અભાવથી ક્ષાયિક સમ્યકૃત્વ, ] અનંત  
ચારિત્રમોહનીય કર્મના અભાવથી ક્ષાયિકચારિત્ર, ] સુખ
- (૪) અંતરાય કર્મના અભાવથી અનંતવીર્ય,
- (૫) વેદનીય કર્મના અભાવથી અવ્યાબાધત્વ,
- (૬) આચુ કર્મના અભાવથી અવગાહનત્વ,
- (૭) નામ કર્મના અભાવથી સૂક્ષ્મત્વ અને
- (૮) ગોત્ર કર્મના અભાવથી અગુરુલઘુત્વ.

સિદ્ધોનું સ્થાન : ઈષ્ટપ્રાગભાર પૃથ્વીના ઠીક મદ્યમાં ૨૪તમય,  
દિવ્ય, સુંદર, દેદીઘ્યમાન અને સીધા રાખેલા અર્દ્ય ગોળાની સદશ

મોક્ષશિલા છે. આ અત્યંત પ્રભાયુક્ત ઉત્તાન જીતાકાર અને મનુષ્યલોકને સદશ (૪૫ લાખ ચોજન) વિસ્તારવાળી છે. આ શિલાની મદ્યની મોટાઈ આઠ ચોજન છે, આગળ અંત સુધી કમશા: હીન થતી ગઈ છે.

સિદ્ધોની મોક્ષ - શિલા, આ સ્થાન વ્યવહારનયથી કહેવામાં આવ્યુંછે. નિશ્ચયથી પ્રત્યેક સિદ્ધ ભગવાન - પોત - પોતાના આત્મપ્રદેશોમાં અવસ્થિત છે.

**સિદ્ધોનું સુખ** - ત્રણે લોકમાં ચતુર્નિકાયના સર્વ દેવો, ઈંદ્રો, અહમિક્રો, પદવીધારી ચક્રવર્તી આદિ સર્વ રાજાઓ, ભોગભૂમિના યુગલો અને સર્વ વિદ્યાધરોના ભૂત - ભવિષ્ય - વર્તમાનના સર્વ સુખને એકત્રીત કરવા જીતાંચ ત્રિકાલજ વિષયોથી ઉત્પન્ન થવાવાળા આ ઈંદ્રીયજન્ય સમસ્ત સુખોથી (વિલિન્ન જાતિના) અનંતાનંતગણા શાશ્વત તથા અતિનિદ્રય સુખ સિદ્ધ પરમેષ્ઠી એક સમયમાં ભોગવે છે. લોકના અગ્રભાગમાં સ્થિત સિદ્ધપરમેષ્ઠી પોતાના આત્માના ઉપાદાનથી ઉત્પન્ન વૃદ્ધિ - હાનીથી રહિત, પરછ્રવ્યોથી નિરપેક્ષ, સર્વ સુખોમાં ઉત્કૃષ્ટ, બાધા રહિત, ઉપમા રહિત, દુઃખ રહિત, અતીનિદ્રય, અનુપમ સુખથી ઉત્પન્ન અને સમસ્ત સુખોમાં જે સારભૂત છે, એવા સુખનો ઉપભોગ નિરંતર કરે છે.

**સિદ્ધ ભગવાનનું સ્વરૂપ** :- તનુવાતવલયના અંતમાં છે મસ્તક જેમનું એવા ત્રિજગદવંદનીય, અનંત સુખમાં નિમચ અને નિત્ય જ આઠ ગુણોથી વિભૂષિત સિદ્ધ પરમેષ્ઠી તે સિદ્ધશિલાની ઉપર અવસ્થિત છે. જ્ઞાન જ છે શરીર જેમનું એવા તે અમૂર્તિક સિદ્ધ કોઈ કાર્યોત્સર્ગથી અને કોઈ પદમાસનથી નાનાપ્રકારના આકારોથી અવસ્થિત છે. પુરુષાકાર મીણ રહિત ઢાંચામાં જે પ્રકારે આકાશ પુરુષાકારને ઘારણ કરીને રહે છે, તે પ્રકારે પૂર્વ શરીરની લંબાઈ તથા પહોળાભીમાંથી ડિચિત જ્યૂન પુરુષાકાર પ્રદેશોથી ચુક્ત, લોકોત્તમસ્વરૂપ, શરણસ્વરૂપ અને સમસ્ત વિશ્વને મંગલસ્વરૂપ સિદ્ધ ભગવાન અંતરહિત, અનંતકાળ સુધી પોતાના આત્મામાં જ રહે છે. આ પ્રકારના સિદ્ધ ભગવાન વિશ્વના સમસ્ત અરહંતો અને મુનીશ્વરો દ્વારા વંદનીય તથા સ્તુત્ય છે (સ્તુતિ કરવા યોગ્ય), હું પણ તેમનું દચ્યાન કરું છું, તેઓ મને પોતાના ગુણોને સદશ પોતાની સિદ્ધગતિ સમાન અનંત સુખમય સિદ્ધદશા પ્રદાન કરે.

નિર્ણયાનું કેવી રીતે લાગતી રહેશે? એવું હોય, કે અમિતાબ  
ભાટીએ નીચે ઘવલા પુસ્તક ૧ નો અંશ (પાનું ૨૦૧) માટે ૧૯૩૬

સામાન્યથી સિદ્ધ જીવ છે. ||૨૦||

સિદ્ધ, નિર્ણિત, નિર્ણપત્ર, હૃતકૃત્ય અને સિદ્ધસાધ્ય - આ એકાર્થવાચી નામ છે. જેઓએ સમસ્ત કર્માનું નિરાકરણ કરી દીધું છે, જેઓએ બાહ્ય પદાર્થોની અપેક્ષા રહિત, અનંત, અનુપમ, સ્વાત્માવિક અને પ્રતિપક્ષરહિત સુખને પ્રાપ્ત કરી લીધું છે, જે નિર્ણેપ છે, અચલ સ્વરૂપને પ્રાપ્ત છે, સંપૂર્ણ અવગુણોથી રહિત છે, સર્વ ગુણોના નિધાન છે, જેમનો સ્વદેહ અર્થાત् આત્માનો આકાર ચરમશારીરથી કાંઈકન્યૂન છે, જે કમાનમાંથી નીકળેલા બાણની સમાન વિનિઃસંગ છે અને લોકના અગ્રત્વાગમાં નિવાસ કરે છે, તેમને સિદ્ધ કહે છે.

-o-o-o-o-

## પુરુષાર્થની અપૂર્વંતા

**પ્રશ્ન :** સાઈ મિથ્યાક્રષ્ણિ જીવ પ્રગતિ કરીને શીધાતિશીધ મુક્ત થાય તો કેટલા સમયમાં અને કેવી રીતે મુક્ત થાય છે?

**ઉત્તર :** ૧) મિથ્યાત્વપરયાચિથી કાંઈક ઓછો અર્ધપુરુદ્ગલ પરાવર્તન પ્રમાણ સંસારમાં પરિબહણ કરી અંતિમ લવ ત્રહણ કરવાથી મળુષ્ય ભવમાં ઉત્પન્ન થયો. ૨) ફરી અંતર્મુહૂર્ત કાળ સંસારનો બાકી રહી જવાથી ત્રણ કરણાને કરીને પ્રથમોપશમ સમ્યકૃત્વને પ્રાપ્ત થયો. ૩) ફરી વેદક સમ્યકૃત્વની થયો. ૪) ફરી અંતર્મુહૂર્ત કાળ છારા અનંતાનુંબંધી કખાચનું વિસંયોજન કરીને ૫) ત્યારબાદ દર્શનમોહનીયનો ક્ષય કરીને ૬) ફરી અપ્રમત્ત સંયત થયો ૭) પછી પ્રમત્ત અને અપ્રમત્ત ગુણસ્થાન આ બંને ગુણસ્થાનો સંબંધી સહસ્ત્રો પરિવર્તન કરીને ૮) ક્ષપકશ્રેણી પર ચઢતો થકો અપ્રમત્તસંયત ગુણસ્થાનમાં અધઃ પ્રવૃત્તકરણ વિશુદ્ધિથી શુદ્ધ થઈને ૯) અપૂર્વકરણ ક્ષપક થયો ૧૦) અનિવૃત્તિકરણ ક્ષપક થયો ૧૧) સૂક્ષ્મસાંપરાચિક ક્ષપક થયો ૧૨) ક્ષીણકખાચ વીતરાગ છબ્બસ્થ થયો. ૧૩) સથોગકેવળી થયા ૧૪) અયોગ કેવળી થયા થકા સિદ્ધ થઈ ગયા.

આ પ્રકારે મોક્ષમાર્ગની સાધનામાં શીધતા હોય તો ચૌદ અંતર્મુહૂર્ત માં મુક્તિકારી જાય છે અને આ બધા અંતર્મુહૂર્ત માં પણ એક જ મોટા અંતર્મુહૂર્ત માં આવી જાય છે. આનાથી સ્થૂળરૂપથી એ કહી શકીએ કે સાઈ મિથ્યાક્રષ્ણિ પણ મિથ્યાત્વ છોડીને અર્થાત્ સમ્યકૃત્વની થઈને એક જ અંતર્મુહૂર્તમાં મુક્ત થઈ શકે છે. (આ સાઈ મિથ્યાક્રષ્ણિની ચર્ચા) (જુઓ ધવલા પુસ્તક જ પાનું - ૩૩)

અનાઈ મિથ્યાક્રષ્ણિના સંબંધમાં પંડિતપ્રવર શ્રી ટોડરમલજીએ મોક્ષમાર્ગપ્રકાશક ગ્રંથમાં પા. નં. ૨૮૫ પર આ શબ્દોમાં કહ્યું છે - “જુઓ, પરિણામોની વિચિત્રતા.....! કોઈ નિત્ય નિગોદથી નિકળીને મળુષ્ય થઈ મિથ્યાત્વ છુટ્યા પછી અંતર્મુહૂર્તમાં કેવળજ્ઞાન પ્રાપ્ત કરે છે.”

## પરિશિષ્ટ - ૧.

જીવ જ બળવાન છે, કર્મ નહીં.

૧) જીવ જ સ્વયં અંતવ્યાપક થઈને સંસારચુકત અથવા નિઃસંસાર અવસ્થામાં આઉદ્-મદ્ય-અંતમાં વ્યાપ્ત થઈને સંસારચુકત અથવા સંસારહિત એવું પોતાને કરતો થકો પ્રતિભાસિત થાય છે.

- સમયસાર ગાથા ૮૩ ની ટીકા.

૨) વસ્તુની શક્તિ પરની અપેક્ષા નથી રાખતી. માટે જીવ પરિણામન સ્વભાવવાળો સ્વયં છે. - સમયસાર ગાથા ૧૨૧ - ૧૨૫ ની ટીકા.

૩) તત્ત્વબ્રહ્મિથી જોવા જઈએ તો રાગ - છ્રેષ્ઠને ઉત્પણ કરવાવાળા અન્ય દ્રવ્ય કિંચિત્ માત્ર પણ દેખાતા નથી, કારણકે સર્વ દ્રવ્યોની ઉત્પત્તિ પોતાના સ્વભાવથી જ થતી થકી અંતરંગમાં અત્યંત પ્રગટ પ્રકાશિત થાય છે. - સમયસાર કળશ ૨૧૯.

૪) આ આત્મામાં જે રાગ - છ્રેષ્ઠરૂપી દોષોની ઉત્પત્તિ થાય છે, તેમાં પરદ્રવ્યનો કાંઈપણ દોષ નથી. ત્યાં તો સ્વયં જીવ જ અપરાધી છે.

- સમયસાર કળશ ૨૨૦.

૫) જે રાગની ઉત્પત્તિ માં પરદ્રવ્યનું જ નિમિત્તપણું માને છે, પોતાનું કાંઈપણ કારણાત્મ નથી માનતા, તે - જેની બુદ્ધિ શુદ્ધ જ્ઞાનથી રહિત અંધ છે, એવા મોહનદીને પાર નથી કરી શકતા.

- સમયસાર કળશ ૨૨૭.

૬) આચાર્યશ્રી જ્યાસેન પુણ્ણફળા અરહંતા ગાથાની ટીકા કરતા લખે છે - દ્રવ્ય મોહનો ઉદ્ય થંધા છતાં પણ જે જીવ શુદ્ધાત્મ ભાવનાના બળથી ભાવ મોહરૂપ પરિણામન નથી કરતો તો બંધ નથી થતો. જો વળી (ફરીથી) કર્મોદ્ય માત્રથી બંધ થતો હોય તો સંસારીઓને સૌદૈવ કર્મના ઉદ્યાની વિઘ્નાનતા હોવાથી સર્વથા બંધ જ થશે, મોક્ષ કયારેય પણ નહીં થઇ શકે. - પ્રવચનસાર ગાથા - ૪૫.

૭) નિગોદ પથચિમાં ભાવકલંકની પ્રચુરતા કહેવાઈ છે, કર્મોનું બળવાનપણું તો ત્યાં પણ નથી કહ્યું.

- ગોમ્મટસાર જીવકાંડ, ગાથા - ૧૯૭.

૮) પ્રત્યેક ક્રિયે પ્રતિસમય ઉત્પાદ - વ્યય - ધોય્યાત્મક છે. તેથી કોઈને કોઈ નવી અવસ્થા થાય જ છે. તે અવસ્થાના કર્તા ક્રિયની ઉત્પાદરૂપ ભાવશક્તિ જ છે, કર્મ કે અન્ય ક્રિયે નહીં.

૯) જીવાદ છેયે ક્રિયોમાં ક્રિયાત્ત્વ નામનો એક સામાન્ય ગુણ છે. આ ક્રિયાત્ત્વ ગુણથી જ પ્રત્યેક ક્રિયની અવસ્થાઓ નિરંતર બદલાતી રહે છે. તેથી જીવમાં કાંઈક વિકારરૂપ તથા કાંઈક અવિકારરૂપ અવસ્થાઓ થાય છે, તેનો કર્તા જીવનો ક્રિયાત્ત્વ ગુણ જ છે, કર્મ નથી.

૧૦) જો કર્મ સ્વયં કર્તા થઈને ઉઘમથી જીવના સ્વભાવનો ધાત કરે, બાહ્યસામ્ઝગીને મેળવે, ત્યારે તો કર્મને ચેતનપણું પણ જોઈએ અને બળવાનપણું પણ જોઈએ, એમ તો છે નહીં, સહજ જ નિમિત્ત - નૈમિત્તિક સંબંધ છે. - મોક્ષમાર્ગ પ્રકાશક - પાના નં ૨૫.

૧૧) હવે, જે રાગાદિકલાવો નું નિમિત્ત કર્મને જ માની પોતાને રાગાદિકનો અકર્તા માને છે, તે કર્તા તો આપ છો, પરંતુ આપને નિરઉઘમી થઈને પ્રમાદી રહેવું છે, માટે અને જ દોષ આપો છે, તો તે દુઃખદાયક બને છે. - મોક્ષમાર્ગ પ્રકાશક - પાના નં ૧૮૫.

૧૨) તત્ત્વનિર્ણય કરવામાં કોઈ કર્મનો દોષ છે જ નહીં, તારો જ દોષ છે, પરંતુ તું સ્વયં મહંત રહેવા ઈછે છે અને પોતાનો દોષ કર્માદિકને લગાવે છે, તો જીન આજ્ઞા માને તો આવી અનીતિ સંભવ નથી. તને વિશ્વકર્માયરૂપ જ રહેવું છે, માટે ખોટું બોલે છે. મોક્ષની સાચી અભિલાષા હોય તો આવી ચુક્કિત શા માટે બનાવે ?

સાંસારિક કાર્યોમાં પોતાના પુરુષાર્થી સિદ્ધિ ન થતી માને, છતાંચ પુરુષાર્થી થી ઉઘમ કર્યા કરે છે, અહીં પુરુષાર્થ ખોઈ બેઠો, માટે જાહીએ છીએ કે મોક્ષને દેખા - દેખીથી ઉત્કૃષ્ટ કરે છે, તેનું સ્વરૂપ ઓળખીને તેને હિતરૂપ નથી જાણતો. હિત જાણો તો તેનો ઉઘમ કરે જ, ન કરે તે અસંલય છે. - મોક્ષમાર્ગ પ્રકાશક પાના. નં - ૩૧૧.

૧૩) કરણાનુયોગના શાસ્ત્રોમાં અનંત સર્વજ્ઞ ભગવંતોના જ્ઞાનાનુસાર આચાર્યોએ આ સાર્વકાળિક તથા સાર્વતૌમિક નિયમ બતાવ્યો છે કે “પ્રત્યેક છ માસ અને આઠ સમયમાં ૫૦૮ જીવ સિદ્ધય દર્શાને પ્રાપ્ત કરતા રહે છે.” તે પણ આપણને જીવના જ સ્વાધીન પુરુષાર્થ ને દર્શાવી રહ્યા છે.

૧૪) આ વિશ્વમાં અનેક જીવ સમ્યકુર્દર્શન પ્રાપ્ત કરી રહ્યા છે.

પાંચમા ગુણસ્થાનની પ્રપિત કરી રહ્યા છે. છઢા - સાતમામાં જૂલી રહ્યા છે તથા પરિષહઅને ઉપસર્જિપ વિપરીત/સંયોગમાં આત્માનંદનો અનુભવ કરી રહ્યા છે અને સિદ્ધ ભગવાન પણ થઈ રહ્યા છે. આ વાતોથી પણ જીવ જ પુરુષાર્થી એટલેકે બળવાન છે, આ વિષય આપણાને સ્પષ્ટ થઈ જાય છે.

૧૫) જડક્રવ્ય કર્મનો ઉદ્ય અને જીવના વિકારી પરિણામ એક સાથે તથા એક જ સમયમાં થાય છે, એવું કથન આચાર્યોએ કરણાનુયોગમાં કરેલ છે. માટે કર્મ જીવના વિકારી પરિણામોનો કર્તા નથી. તેથી કર્મ બળવાન નથી, આ વિષય અત્યંત સ્પષ્ટ રીતે સિદ્ધ થઈ જાય છે.

૧૬) કર્મને બળવાન માનશો તો જીવ પરાદીન અને કર્મોનો ગુલામ થવાથી કોઈ મુનિ, પ્રતી, શ્રાવક તથા સમ્યક્રષ્ટિ પણ નહીં થઈ શકે, કારણ કે પોત પોતાની ભૂમિકાને યોગ્ય વિશિષ્ટ કર્મોના ઉપશમાદિ થયા વિના કોઈ જીવ મુનિ આદિ થઈ જ નથી શકતા. નષ્ટ તો નબળા હોય છે, બળવાન નહીં. આજ સુધી અનંત જીવોએ સ્વયં પુરુષાર્થપૂર્વક મુક્તિ ની પ્રાપ્તિ કરી છે, તેના ફળસ્વરૂપે કર્મોનું અકર્મપણું સ્વયં થઈ ગયું છે.

૧૭) પૂર્વ જીવનમાં જીવને વિપરીત પુરુષાર્થી તીવ્ર મોણાદિ કર્મોનો બંધ કર્યો હતો અને તે કર્મના ઉદ્ય - કાળમાં પુરુષાર્થહીનતાથી જીવ ધર્મ પ્રકટ કરવામાં સમર્થ નથી થઈ શકતો. તેથી શાસ્ત્રમાં “કર્મ બળવાન છે.” એવું કથન પણ વ્યવહારનથી આવ્યું છે, વાસ્તવમાં કર્મ બળવાન નથી એવું સમજવું જોઈએ.

જેમ - રામના પરાક્રમ, શૌર્ય, દૈર્ય આદિની પ્રસિદ્ધિને સ્પષ્ટ કરવા માટે જ દુષ્ટ રાવણાના પણ શૌર્યનું વર્ણન જૈન શાસ્ત્રોમાં કર્યું છે. તેમ જ જીવના બળવાનપણાને વિશેષરૂપથી સિદ્ધ કરવા માટે વ્યવહારનથી કર્મને બળવાન કહેવાય છે, આનો અર્થ જીવ જ બળવાન છે. કર્મરૂપ નિમિત્તનું તો માત્ર જ્ઞાન કરાવવામાં આવ્યું છે.

૧૮) જે કર્મ ને બળવાન માનશું તો એક પણ જીવ સિદ્ધ ભગવાન નહીં બની શકે, કારણકે જીવના પુરુષાર્થપૂર્વક કર્મનો અભાવ થયા વગર કોઈ જીવ સિદ્ધ નથી થઈ શકતો. અનેક જીવ કર્મોના અભાવપૂર્વક સિદ્ધ ભગવાન થઈ ગયા છે. આનાથી સ્વયં સિદ્ધ થઈ ગયું કે જીવ જ બળવાન છે. જાહે સિદ્ધ ભગવાન સિદ્ધાલયમાં બેસીને આપણાને જોઈ

પોકારી - પોકારીને સમજાવી રહ્યા છે કે કર્મરહિત એવા આપણે અનંત સિદ્ધ્યોને જાહીને પણ જીવ જ બળવાન છે, કર્મ નહીં આ નાનકડી વાત તમારી સમજમાં કેમ નથી આવી રહી ?

૧૮) શ્રી ચંદ્રપ્રભ ભગવાનની પૂજનના છંદમાં કહ્યું છે,

કર્મ બિચારે કૌન, ભૂલ મેરી અધિકાઈ,

અનિન સહે ઘનઘાત, લોહકી સંગતિ પાઈ.

દેવ - શાસ્ત્ર - ગુરુ પૂજનનો આ છંદ પણ આપણને સ્પષ્ટ સમજાવી રહ્યો છે-

જડકર્મ ધુમાતા હૈ મુજકો, ચહ મિથ્યા ખાંતિ રહી મેરી,

મૈ રાગ-છ્રેષ્ઠ કિયા કરતા, જબ પરિણતિ હોતી જડ કેરી.

પ્રશ્ન : શાસ્ત્રોમાં સર્વત્ર સુખી અથવા મુક્ત થવાને માટે જીવને જ શા માટે સમજાવ્યું છે? કર્મોને શા માટે નથી સમજાવ્યું?

ઉત્તર : ૧) જીવ અનાદિ - અનંત છે, તેથી જીવ મોટો છે. કર્મ સાદિ - સાંત છે. માટે ઉમરની અપેક્ષાથી પણ કર્મ નાના જ છે. કર્મ વધારેમાં વધારે ૭૦ કોડાકોડી સાગરની સ્થિતિવાળા હોઈ શકે છે - જેમ લોકિક જીવનમાં મોટા અને નાના ભાઈઓમાં અથવા વિદ્યાર્થીઓમાં ઝઘડો થઇ જાય તો મોટાને સમજાવે છે. સંસારમાં જીવ મોટો છે. તેથી જીવ ને જ સમજાવ્યું છે.

૨) સમજદાર અર્થાત જ્ઞાનવાનને સમજાવી શકાય છે. તેથી શાસ્ત્રમાં કથન આવે છે - કર્મને નષ્ટ કરો એવું જીવને જ સમજાવ્યું છે, કારણે કે જીવ જ્ઞાનવાન છે. કર્મ પુદ્ગલની પર્યાય છે, પુદ્ગલ જડ અચેતન છે. તેથી “તેને તમે જીવને છોડો, તેને મુક્ત થવા દો, તેને શા માટે હેરાન કરી રહ્યા છો ?” એવું નથી સમજાવ્યું.

૨૦) છઙ્ગા ગુણસ્થાનમાં ભાવલિંગી મુનિરાજને અસાતાવેદનીય, અરતિ, શોક, ભય આદિ પાપકર્મો નો ઉદ્ય છે તથા પ્રતિકૂળ નિમિત્ત પણ છે, પરંતુ આ કર્મ મુનિરાજને દુઃખી કે ખેદભિજન નથી કરતાં, કારણે મુનિરાજ જ્ઞાતા - ફ્રષ્ટા રહે છે તો કર્મ બળવાન કેવી રીતે ? તેથી આપણી માન્યતા શાસ્ત્રાનુકૂળ બનાવવામાં જ આપણું હિત છે.

## પરિશિષ્ટ - ૨.

### ગુણસ્થાનોમાં વિશેષ

#### ૧. જીવોની સંખ્યાઃ-

- ૧) પ્રથમ ગુણસ્થાનમાં જીવોની સંખ્યા અનંતાનંત છે, આ તિર્યચગતિમાં સ્થાવર જીવોની અપેક્ષાથી છે.
- ૨) બીજા ગુણસ્થાનમાં જીવોની સંખ્યા પલ્યના અસંખ્યાતમાં ભાગ પ્રમાણે છે.
- ૩) ત્રીજા ગુણસ્થાનમાં જીવોની સંખ્યા પલ્યના અસંખ્યાતમાં ભાગ પ્રમાણે છે.
- ૪) ચોથા ગુણસ્થાનમાં જીવોની સંખ્યા પલ્યના અસંખ્યાતમાં ભાગ પ્રમાણે છે.
- ૫) પાંચમા ગુણસ્થાનમાં જીવોની સંખ્યા પલ્યના અસંખ્યાતમાં ભાગ પ્રમાણે છે, આ સંખ્યા સંજી તિર્યચ જીવોની અપેક્ષાથી કહેવામાં આવી છે.
- ૬) પ્રથમ ગુણસ્થાનમાં મનુષ્યોની અપેક્ષાએ સંખ્યા જગત્ શ્રેણીના અસંખ્યાતમાં ભાગ પ્રમાણે છે, આ સંખ્યા અપર્યાપ્ત મનુષ્યોની અપેક્ષાથી છે.
- ૭) ક્રિટીય ગુણસ્થાનમાં મનુષ્યોની અપેક્ષાથી સંખ્યા પદ કરોડની છે.
- ૮) તૃતીય ગુણસ્થાનમાં મનુષ્યોની અપેક્ષાથી સંખ્યા ૧૦૪ કરોડની છે.
- ૯) ચોથા ગુણસ્થાનમાં મનુષ્યોની અપેક્ષાથી સંખ્યા ૭૦૦ કરોડની છે.
- ૧૦) પાંચમા ગુણસ્થાનમાં મનુષ્યોની અપેક્ષાથી સંખ્યા ૧૩ કરોડની છે.
- ૧૧) છઢા ગુણસ્થાનમાં જીવોની સંખ્યા ૫,૬૩,૮૮,૨૦૯ (પાંચ કરોડ ત્રણાણું લાખ અઙ્ગાણું હજાર બસો છ) છે.
- ૧૨) સાતમા ગુણસ્થાનમાં જીવોની સંખ્યા ૨,૮૯,૮૮,૧૦૩ (બે કરોડ છન્નું લાખ, નવવાણું હજાર એકસો ત્રણા) છે.
- ૧૩) ઉપશમશ્રેણીના આઠમા, નવમા, દસમા, અચ્યારમાં ગુણસ્થાનોમાં ક્રમથી (૨૮૮,૨૮૮,૨૮૮,૨૮૮) જીવ છે. ટોટલ કુલ ઉપશમ શ્રેણીના ચારે ગુણસ્થાનોમાં જીવોની સંખ્યા ૧૧૮૯ છે.
- ૧૪) ક્ષપકશ્રેણીના આઠમા, નવમા, દસમા, બારમા ગુણસ્થાનોમાં

જીવોની સંખ્યા ૫૮૮, ૫૮૮, ૫૮૮, ૫૮૮ પ્રમાણે છે.

ક્ષપકશ્રેણીના ચારેથ ગુણસ્થાનમાં જીવોની સંખ્યા ૨૭૮૨ છે.

૧૫) તેરમાં ગુણસ્થાનમાં જીવોની સંખ્યા ૮,૮૮,૫૦૨ (આઠ લાખ , અષ્ટાણું હજાર , પાંચસો બે) છે.

૧૬) ચૌદમાં ગુણસ્થાનમાં જીવોની સંખ્યા ૫૮૮ છે.

૧૭) છઢા ગુણસ્થાનથી ચૌદમાં ગુણસ્થાન સુધી જીવોની સંખ્યાનું ટોટલ છે - ૫,૮૩,૮૮,૨૦૬ + ૨,૮૬,૮૮,૧૦૩ + ૧,૧૮૬ + ૨,૩૮૨  
 $8,88,502 + 588 = 8,88,88,287$  એટલે કે ત્રણ ઓછા નવ કરોડ મુનિરાજ ભાવલિંગી જ હોય છે.

૧૮) ફ્રાન્ટલિંગી મુનિરાજ પહેલા, બીજા, ત્રીજા, ચોથા, પાંચમા ગુણસ્થાનમાં પણ હોય છે.

૨. ગુણસ્થાનોમાં બંધ સંબંધી સામાન્ય નિયમઃ -

૧) મિથ્યાત્પની પ્રધાનતાથી મિથ્યાત્પ ગુણસ્થાનમાં ૧૬ પ્રકૃતિઓનો બંધ થાય છે.

૨) અનંતાનુંબંધી કષાયના ઉદ્યજનિત અવિરતિથી ૨૫ પ્રકૃતિઓનો બંધ થાય છે. સમ્યક્ષમિથ્યાત્પ પ્રકૃતિના ઉદ્યની અપેક્ષાએ મિશ્ર ગુણસ્થાનમાં બંધની વ્યુચિષ્ટિનો અભાવ થવાથી કોઈ નવી પ્રકૃતિનો બંધ નથી થતો અને કોઈપણ આચુકર્મનો પણ બંધ નથી થતો.

૩) અપ્રત્યાખ્યાનાવરણ કષાયોઉદ્યજનિત અવિરતિથી ૧૦ પ્રકૃતિઓનો બંધ થાય છે.

૪) પ્રત્યાખ્યાનાવરણ કષાય ઉદ્યજનિત વિરતાવિરતથી ૪ પ્રકૃતિઓનો બંધ થાય છે.

૫) સંજવલનના તીવ્ર ઉદ્ય જનિત પ્રમાદથી ૬ પ્રકૃતિઓનો બંધ થાય છે.

૬) સંજવલન અને નોકષાયના મંદ ઉદ્યથી પણ પ્રકૃતિઓનો બંધ થાય છે.

૭) ચોગથી એક સાતાવેદનીયનો બંધ થાય છે. (મોહનો સર્વથા ઉપશામ થવાથી અથવા ક્ષય થવાથી).

૮) તીર્થકર પ્રકૃતિનો બંધ સમ્યક્ષક્ષણિના ચતુર્થ ગુણસ્થાનથી આઠમા ગુણસ્થાનના છઢા ભાગ સુધી જ થાય છે.

૯) આહારકશરીર અને આહારક અંગોપાંગનો બંધ સાતમા થી આઠમા

ગુણસ્થાનના છઙ્ગા ભાગ સુધી જ થાય છે.

- ૧૦) ત્રીજા ગુણસ્થાનમાં કોઈપણ આચુનો બંધ નથી થતો.
- ૩) ગુણસ્થાનોમાં મૂળકર્મનો બંધ :-
- ૧) જ્ઞાનાવરણકર્મનો બંધ પહેલા ગુણસ્થાનની દસમા ગુણસ્થાન સુધી થાય છે.
- ૨) દર્શનાવરણકર્મનો બંધ પહેલા ગુણસ્થાનની દસમા ગુણસ્થાન સુધી થાય છે.
- ૩) વેદનીય કર્મનો બંધ પહેલા ગુણસ્થાનની તેરમા ગુણસ્થાન સુધી થાય છે.
- ૪) દર્શનમોહનીયનો બંધ માત્ર પ્રથમ ગુણસ્થાનમાં થાય છે.
  - ◆ ચારિત્રમોહનીયનો બંધ પહેલાથી નવમા ગુણસ્થાન સુધી થાય છે.
  - ◆ દસમા ગુણસ્થાનમાં સૂક્ષ્મલોભ કથાચના ઉદ્યથી સૂક્ષ્મલોભ પરિણામ તો થાય છે, છતાંચ ચારિત્રમોહનીય નો કોઈપણ પ્રકૃતિ નો બંધ થતો નથી.
- ૫) પહેલા ગુણસ્થાનની સાતમા સ્વસ્થાન અપ્રમત્ત ગુણસ્થાન સુધી આચુકર્મનો બંધ થાય છે. એટલું વિશેષ છે કે મિશ્ર ગુણસ્થાનમાં કોઈ પણ આચુકર્મનો બંધ થતો નથી.
- ૬) નામ કર્મનો બંધ પહેલા ગુણસ્થાનની દસમા ગુણસ્થાન સુધી થાય છે.
- ૭) ગોત્ર કર્મનો બંધ પહેલા ગુણસ્થાનની દસમા ગુણસ્થાન સુધી થાય છે.
- ૮) અંતરાયકર્મનો બંધ પહેલા ગુણસ્થાનની દસમા ગુણસ્થાન સુધી થાય છે.
- (૯) ગુણસ્થાનોમાં ઉદ્યઃ -
- ૧) તીર્થકર પ્રકૃતિનો ઉદ્ય તેરમા અને ચોદમા ગુણસ્થાનમાં જ થાય છે.
- ૨) આહારક શરીર અને આહારક અંગોપાંગનો ઉદ્ય છઙ્ગા ગુણસ્થાન માં જ થાય છે.
- ૩) સમ્યક્ષમિત્યાત્પ નો ઉદ્ય ત્રીજા ગુણસ્થાનમાં જ થાય છે.
- ૪) સમ્યક્ષપ્રકૃતિ નો ઉદ્ય ચોથાથી સાતમા ગુણસ્થાન સુધી જ થાય છે.
- ૫) ચોથા ગુણસ્થાનમાં ચારે અનુપૂર્વી નો ઉદ્ય થાય છે.

- ૬) પહેલું ગુણસ્થાન એક મિથ્યાત્વ અને ચાર અનંતાનુંબંધીના ઉદ્યથી થાય છે.
- ૭) બીજું ગુણસ્થાન અનંતાનુંબંધીના ઉદ્યથી થાય છે.
- ૮) ત્રીજું ગુણસ્થાન સમ્યકુભિમિથ્યાત્વ ના ઉદ્યથી થાય છે.
- ૯) ચોથું ગુણસ્થાન સાત કર્મોના અર્થાત્ દર્શનમોહનીય તૃ, ચારિત્ર મોહનીય- જ પ્રકૃતિના ઉપશમ, ક્ષય કે ક્ષયોપશમ (એક સમ્યકુ પ્રકૃતિના ઉદ્ય) થી થાય છે.
- ૧૦) પાંચમું ગુણસ્થાન ચારિત્રમોહનીયની ૧૭ પ્રકૃતિના ઉદ્યથી થાય છે. પ્રત્યાખ્યાનાવરણ - જ, સંજવલન - જ, અને નવ નોકખાય)
- ૧૧) છાંઢું ગુણસ્થાન સંજવલન તથા નવ નોકખાયના તીવ્ર ઉદ્યથી થાય છે.
- ૧૨) સાતમું ગુણસ્થાન સંજવલન તથા નવ નોકખાયના મંદ ઉદ્યથી થાય છે.
- ૧૩) આઠમું ગુણસ્થાન સંજવલન અને નવ નોકખાયના મંદતર ઉદ્યથી થાય છે.
- ૧૪) નવમું ગુણસ્થાન સંજવલન અને નવ નોકખાયના મંદતમ ઉદ્યથી થાય છે.
- ૧૫) દસમું ગુણસ્થાન સંજવલન સૂક્ષ્મલોભના ઉદ્યથી થાય છે.
- ૧૬) અગ્નારમું ગુણસ્થાન મોહનીય કર્મના સર્વેદ્યા ઉપશમથી થાય છે.
- ૧૭) બારમું ગુણસ્થાન મોહનીય કર્મના પૂર્ણ ક્ષયથી થાય છે.
- ૧૮) તેરમું ગુણસ્થાન ઘાતિ કર્મોના પૂર્ણ ક્ષયથી થાય છે.
- ૧૯) ચૌદમું ગુણસ્થાન ચોગના અલ્બાવની અપેક્ષાએ થાય છે.
- (૫) ગુણસ્થાનોમાં મૂળકર્મોનો ઉદ્ય:
- ૧) જ્ઞાનાવરણ કર્મનો ઉદ્ય પહેલાથી બારમા ગુણસ્થાન સુધી હોય છે.
  - ૨) દર્શનાવરણકર્મનો ઉદ્ય પહેલાથી બારમા ગુણસ્થાન સુધી હોય છે.
  - ૩) વેદનીયકર્મનો ઉદ્ય પહેલાથી ચૌદમા ગુણસ્થાન સુધી હોય છે.
  - ૪) મોહનીય કર્મનો ઉદ્ય પહેલાથી દસમાં ગુણસ્થાન સુધી હોય છે.
  - ૫) આચ્યુકર્મનો ઉદ્ય પહેલાથી ચૌદમા ગુણસ્થાન સુધી હોય છે.
  - ૬) નામકર્મનો ઉદ્ય પહેલાથી ચૌદમા ગુણસ્થાન સુધી હોય છે.
  - ૭) ગોત્રકર્મનો ઉદ્ય પહેલાથી ચૌદમા ગુણસ્થાન સુધી હોય છે.

- ૮) અંતરાયકર્મનો ઉદ્ય પહેલાથી બારમા ગુણસ્થાન સુધી હોય છે.
- (૯) ગુણસ્થાનોમાં મૂળકર્મોનું સત્ત્વ:-
- ૧) જ્ઞાનાવરણ કર્મનો પહેલાથી બારમા ગુણસ્થાન સુધી સત્ત્વ જોવામાં આવે છે.
  - ૨) દર્શનાવરણ કર્મનો પહેલાથી બારમા ગુણસ્થાન સુધી સત્ત્વ જોવામાં આવે છે.
  - ૩) વેદનીય કર્મનો પહેલાથી ચૌદમા ગુણસ્થાન સુધી સત્ત્વ જોવામાં આવે છે.
  - ૪) મોહનીય કર્મનો પહેલાથી અભ્યારમા ગુણસ્થાન સુધી સત્ત્વ જોવામાં આવે છે.
  - ૫) આચુ કર્મનો પહેલાથી ચૌદમા ગુણસ્થાન સુધી સત્ત્વ જોવામાં આવે છે.
  - ૬) નામકર્મનો પહેલાથી ચૌદમા ગુણસ્થાન સુધી સત્ત્વ જોવામાં આવે છે.
  - ૭) ગોત્રકર્મનો પહેલાથી ચૌદમા ગુણસ્થાન સુધી સત્ત્વ જોવામાં આવે છે.
  - ૮) અંતરાયકર્મનો પહેલાથી બારમા ગુણસ્થાન સુધી સત્ત્વ જોવામાં આવે છે.

## ગુણસ્થાનોમાં બંધવ્યુચિતીની સંજદા

ગુણસ્થાન	વ્યુચિત્ર પ્રકૃતિઓની સંખ્યા	વ્યુચિત્ર પ્રકૃતિઓના નામ
મિથ્યાત્પ	૧૬	મિથ્યાત્પ, હુંડકસંસ્થાન, નપુંસકવેદ, અસંપ્રાસાસૃપાટિકા-સંહનન, એક્સિયાતિ, સ્થાપર, આતપ, સૂક્ષ્મ, અપર્યાસ, સાધારણ, ક્રીક્રિય, ગ્રીક્રિય, ચતુર્ભિંદ્રિય, નરકગતિ, વરક-ગત્યાનુપૂર્વી અને નરકાયુ.
સાસાંદળ	૨૫	અનતાનુંધી કથાય ૪, સ્ટાનગૃદ્ધિ, નિંબા-નિંબા, પ્રચલા-પ્રચલા, દુર્બંગ, દુઃસ્પર, અનાદેચ, ન્યાયોધપરિમંડલ-સ્વાતિ-કુલજક અને વામનસંસ્થાન, વજનારાચ-અર્ધનારાચ-કીલિત-સંહનન, અપ્રશાસ્ત-વિહાયોગતિ, ટ્રીવેદ, નીચગોત્ર, તિર્યંચગતિ -તિર્યંચ-ગત્યાનુપૂર્વી, તિર્યંચાયુ અને ઉધોત.
મિશ્ર	૦૦	
અસંચંદ્રા	૧૦	અપ્રત્યાખ્યાનાવરણની ચાર કથાય, વજનારાચસંહનન, ઓદારિક શરીર, ઓદાચિકાંગોપાંગ, મનુષ્યગતિ-મનુષ્યગત્યાનુપૂર્વી અને મનજ્યાયુ.
દૈશસંચંદ્ર	૦૪	પ્રત્યાખ્યાનાવરણની ચાર કથાય.
પ્રમત્ત	૦૬	અસ્તિથર, અશુલ, અસાતાવેદનીય, અયશ-કીતિ, અરતિ અને શોક.
અપ્રમત્ત	૦૧	દૈવાયુ (અહીં સ્વપ્નસ્થાન અપ્રમત્ત દૈવાયુની બંધ નિષ્ઠાપના વ્યુચિત્રતિ જાણવી. સાતિશય અપ્રમત્તમાં દૈવાયુની વ્યુચિત્રતિ નથી થતી, કારણકે સાતિશય અપ્રમત્તમાં દૈવાયુનો બંધ જ નથી થતો.)
અપૂર્વકરણ (પ્રથમલાગ)	૦૨	નિંબા અને પ્રચલા, આભાગમાં ઉપસમન્દ્રીણી ચક્રતા સમયે મૃત્યુ નથી થતું.
ધ્યાનભાગ	૩૦	તીર્થીકર, નિર્માણ, પ્રશાસ્તવિહાયોગતિ, પંચિક્રિયાતિ, તૈજસ, કાર્મણ, આહારક શરીર-આહારક અંગોપાંગ, સમચતુરસત્રસંસ્થાન, દૈવગતિ, દૈવગત્યાનુપૂર્વી, યોક્કિયકશરીર, યોક્કિય અંગોપાંગ, વણીદિ-૪, અનુરૂપસુ, ઉપધાત, પરધાત, ઉરચાવાસ, ત્રસ, બાદર, પર્યાસ, પ્રત્યેક શરીર, સ્થિર, શુભ, સુખગ, સુસ્પર અને આદેય.
સંખમલાગ	૦૪	છાસ્ય, રતિ, ભય અને જુગુપ્સા.
અનિપૃત્તિકરણ		
પ્રથમલાગ	૦૧	પુરુષવેદ
ક્રીટીયભાગ	૦૧	સંજ્ઞવલન કોઘ
તૃતીયભાગ	૦૧	સંજ્ઞવલન માળ
ચતુર્થીયભાગ	૦૧	સંજ્ઞવલન માથા
પંચમલાગ	૦૧	સંજ્ઞવલન લોલ
સૂક્ષ્મસંપરાય	૧૬	જાગાવરણ પ, દર્શનાવરણ છ, અંતરાય પ, ચશકિતી, ઉરચગોત્ર.
ઉપશાંતિમોહ	૦૦	
ક્ષીણમોહ	૦૦	
સથોગી	૦૧	સાતાવેદનીય

આ રીતે સર્વ ૧૨૦ પ્રકૃતિઓ બંધયોગ્ય કહેવાય છે. તેનો બંધવ્યુચિત્રતિ ઉપર્યુક્ત કમથી જાણવો જોઈએ. (ઉપર્યુક્ત બદાં કથન વિવિધ જીવોની અપેક્ષાથી છે.)

### પરિશિષ્ટ - 3.

ગુણસ્થાનોમાં શુદ્ધ પરિણાતિ

શુદ્ધ પરિણાતિની પરિલાખા આ પ્રકારે છે:-

૧) આત્માના ચારિત્રગુણની શુદ્ધ પર્યાય અર્થાત વીતરાગ પરિણામને શુદ્ધ પરિણાતિ કહે છે.

૨) ક્ષાયના અનુદ્યથી વ્યક્ત વીતરાગ અવસ્થાને શુદ્ધ પરિણાતિ કહે છે.

૩) જ્યાંસુધી સાધક આત્માની વીતરાગતા પૂર્ણ નથી થતી, ત્યાં સુધી સાધક આત્મામાં શુલોપયોગ, અશુલોપયોગ અને શુદ્ધોપયોગ સાથે ક્ષાયના અનુદ્યપૂર્વક જે શુદ્ધતા અર્થાત વીતરાગતા હંમેશા બની રહે છે, તેને શુદ્ધ પરિણાતિ કહે છે. જેમ :-

૧) ચોથા અને પાંચમા ગુણસ્થાનમાં - જ્યારે સાધક, બુદ્ધિપૂર્વક શુલોપયોગ કે અશુલોપયોગમાં સંલઘ રહે છે, ત્યારે ક્ષાયના અભાવરૂપ આ શુદ્ધ પરિણાતિને લીધે જ તે જીવ ધાર્મિક થઈને રહે છે.

૨) છઢા ગુણસ્થાનવર્તી - શુલોપયોગી મુજિરાજને પણ શુદ્ધ પરિણાતિ નિયમથી રહે છે. આ શુદ્ધ પરિણાતિને કારણાજ યથાયોગ્ય કર્મોનો સંવર અને પૂર્વબદ્ધ કર્મોની નિર્જરા પણ નિરંતર થતી રહે છે.

શુદ્ધ પરિણાતિ અનેક સ્થાન પર આ પ્રકારે રહી શકે છે:-

(૧) ચોથા અવિરતસમૃદ્ધત્વ ગુણસ્થાનમાં - મિદ્યાત્વ અને અનંતાનુભંધી એક જ ક્ષાય ચોક્કડીના અનુદ્યરૂપ અભાવપૂર્વક વ્યક્ત વીતરાગતાથી જધન્ય શુદ્ધ પરિણાતિ સતત બની રહે છે. આ કારણે ચુદ્ધાદિ અશુલોપયોગમાં સંલઘ શ્રવકને પણ યથાયોગ્ય સંવર - નિર્જરા થાય છે.

(૨) પાંચમાં દેશવિરત ગુણસ્થાનમાં - અનંતાનુભંધી અને અપ્રત્યાખ્યાનાવરણ આ બે ક્ષાય ચોક્કડીના અનુદ્યરૂપ અભાવપૂર્વક વ્યક્ત વિશેષ વીતરાગતાના કારણે મધ્યમ શુદ્ધ પરિણાતિ સતત બની રહે છે. માટે દુકાન મકાનાદિ અથવા ધરના સદસ્યોની વ્યવસ્થારૂપ અશુલોપયોગમાં સમય વીતાવતા થકા પ્રતી શ્રવકને પણ યથાયોગ્ય સંવર - નિર્જરા થાય છે.

(૩) છઢે - પ્રમત્તવિરત ગુણસ્થાનમાં - અનંતાનુભંધી આદિ ત્રણ ક્ષાય ચોક્કડીના અનુદ્યરૂપ અભાવથી વ્યક્ત વીતરાગતાને કારણ ઉત્પન્ન શુદ્ધ પરિણાતિ શુલોપયોગની સાથે હંમેશા બની રહે છે, આ

કારણે સંપર - નિર્જરા પણ થતી રહે છે. આ કારણથી અપ્રમત્તવિરત મુનિરાજની જેમ જ પ્રમત્તવિરત મુનિરાજ પણ લાવલિંગી સંત જ છે.  
 (૪) સાતમા અપ્રમત્તવિરત ગુણસ્થાનથી લઇને નવમા અનિવૃત્તિકરણ ગુણસ્થાન સુધીના બધા લાવલિંગી મહામુનિરાજોને ત્રણ કષાય ચોકડી (યથાસંભવ સંજવલ કષાય તથા નવ નોકષાય) ના અનુદ્યરૂપ અભાવથી વ્યક્ત વીતરાગરૂપ શુદ્ધોપયોગ હંમેશા બની રહે છે.

ચોથાથી છઢી ગુણસ્થાન સુધી વિઘમાન સાધકને શુલ્ક કે અશુલ્કરૂપ (છઢી ગુણસ્થાનમાં કદાચિત् અશુલ્બોપયોગ હોય છે.) ઉપયોગ રહે છે, ત્યારે વ્યક્ત શુદ્ધતા સતત બની રહે છે, તેને જ શુદ્ધપરિણાતિ કરે છે. જ્યારે ઉપયોગ નિજશુદ્ધાત્મામાં લીન થઈ જાય છે, ત્યારે તે જ વ્યક્ત શુદ્ધતા અર્થાત્ વીતરાગતા વૃદ્ધિગત થઈ જાય છે, તેને શુદ્ધોપયોગ કરે છે. વ્યાપારરૂપ શુદ્ધતા શુદ્ધોપયોગ કહેવાય છે અને સહજ નિર્વિકલ્પ શુદ્ધતા શુદ્ધ પરિણાતિ કહેવાય છે.

(૫) દસમા સૂક્ષ્મસાંપરાય ગુણસ્થાનમાં ત્રણ કષાય ચોકડી અને સંજવલન કોદ, માન, માયા કષાયો તથા નવ નોકષાયોના ઉપશમ કે ક્ષયરૂપ અભાવથી ઉત્પન્ન વિશેષ વીતરાગતારૂપ (સંજવલન સૂક્ષ્મલોલ કષાય કર્મના સદ્ભાવમાં) શુદ્ધોપયોગ એક અંતર્મુહૂર્ત સુધી રહે છે.

ઉપયોગ (જ્ઞાન-દર્શન) ની સાથે ચારિત્ર ગુણની શુદ્ધતા અર્થાત્ વીતરાગતાને શુદ્ધોપયોગ કરે છે અને સામાન્ય શુદ્ધતા અર્થાત્ વીતરાગતાને શુદ્ધ પરિણાતિ કરે છે. સાતમા ગુણસ્થાન થી દસમા ગુણસ્થાનના અંતિમ સમય સુધી શુદ્ધ પરિણાતિ જ શુદ્ધોપયોગરૂપ પરિવર્તિત થઈ જાય છે.

(૬) અગ્યારમાં ઉપશાંતમોહ અને બારમા ક્ષીણમોહ ગુણસ્થાનમાં પણ વીતરાગતાની પૂર્ણતા થઈ ગઈ છે. તેથી આ બંને ગુણસ્થાનોમાં ઉપયોગ તથા પરિણાતિ એવો લેદ રહેતો નથી. પૂર્ણ વીતરાગતાને કારણ શુદ્ધોપયોગ પૂર્ણ થઈ ગયો છે. (મુનિ ભૂમિકાની શુદ્ધ પરિણાતિ વિષયનું સ્પષ્ટીકરણ પ્રવચનસાર શાસ્ત્રની ચરણાનુયોગ ચૂલિકાની આ ગાથાઓની ટીકામાં ફરી ફરી આવ્યું છે, તેને જિજાસુ જીવો જરૂર જુએ (ગાથા ૨૪૫, ૨૪૭ તથા ૨૪૮ થી ૨૫૧ વગેરે))

(૭) તેરમાં અને ચૌદમા ગુણસ્થાનોમાં અનંતદર્શન જ્ઞાનાદિ ચતુર્ભયરૂપ પરિણામનાનું કાર્ય શુદ્ધોપયોગનું ફળ છે.

## પરિશિષ્ટ - ૪.

### ધાતિકર્મના ક્ષયનું વિવરણ

કર્મના ક્ષયનો પ્રારંભ ક્ષાચિક સમ્યકૃત્વની પ્રાસિના સમયથી જ થઈ જાય છે. તીર્થકર્કેવળી, સામાન્યકેવળી અથવા શુતકેવળીના સાનિદ્યમાં જ કર્મભૂમિના મનુષ્ય ક્ષાચિકસમ્યકૃત્વની પ્રાસિનો પુરુષાર્થ પ્રારંભ કરે છે.

૧) સર્વપ્રથમ અધઃકરણ, અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ પરિણામોથી અનેંતાનુબંધી કષાય ચતુષ્ટયનો વિસંયોજન છારા અલાવ થઈ જાય છે.

૨) પછી આ જીવ એક અંતમુહૂર્ત કાળ સુધી વિશ્રામ લે છે. ત્યારબાદ ફરી અધઃકરણાદિ ત્રણકરણ પરિણામોથી મિથ્યાત્વ કર્મ, સમ્યક્મિથ્યાત્વ કર્મરૂપ પરિણામિત થઈ જાય છે. પછી સમ્યક્મિથ્યાત્વ કર્મ, સમ્યક્પ્રફૃતરૂપ પરિણામિત થઈ જાય છે. ત્યારબાદ કર્મથી સમ્યક્પ્રફૃત કર્મના ઉદ્યમાં આવી ક્ષય થઈ જાય છે. આ રીતે દર્શનમોહનીયની ત્રણ પ્રફૃતિઓનો ક્ષય થઈ જાય છે. આ પ્રકારે સમ્યકૃત્વ ધાતક સાત પ્રકૃતિઓનો ક્ષય થઈ જાય છે.

ક્ષાચિકસમ્યકૃત્વનું ઉપરનું અભૂતપૂર્વ કાર્ય ચોથા અવિરતસમ્યકૃત્વ ગુણસ્થાનથી લઇને સાતમા અપ્રમત્તસંયત ગુણસ્થાન સુધી કોઈપણ એક ગુણસ્થાનમાં ત્રિકાળ સહજશુદ્ધ નિજભગવાન આત્માના આશ્રયરૂપ પુરુષાર્થી જ થાય છે.

આ વિષયનો સ્પષ્ટ ખુલાસો મોક્ષમાર્ગપ્રકાશક ગ્રંથમાં પાના નં. ૩૩૪, ૩૩૫ પર આવેલ છે, તેને નીચે આપી રહ્યા છીએ:-

એટલું વિશેષ છે કે ક્ષાચિક સમ્યકૃત્વની સન્મુખ થવાથી અંતમુહૂર્ત કાળ માત્ર જ્યાં મિથ્યાત્વની પ્રફૃતિનો ક્ષય કરે છે, ત્યાં બે જ પ્રફૃતિઓની સત્તા રહે છે. પછી મિશ્રમોહનીયનો પણ ક્ષય કરે છે, ત્યાં સમ્યકૃત્વમોહનીય ની જ સત્તા રહે છે. પછી સમ્યકૃત્વમોહનીય ની કાંડકઘાતાદિ કિયા નથી કરતો, ત્યાં હૃતકૃત્યવેદક સમ્યક્રણિ નામ પામે છે - એવું જાણયું.

તથા આ ક્ષયોપશમસમ્યકૃત્વ નું જ નામ વેદકસમ્યકૃત્વ છે. જ્યાં મિથ્યાત્વ - મિશ્રમોહનીયની મુખ્યતાથી કહીએ, ત્યાં ક્ષયોપશમ નામ પામે છે. તેથી કથનમાત્ર બે નામ છે, સ્વરૂપમાં લેદ નથી. તથા તે

કથ્યોપશમ સમ્યકૃત્વ ચતુર્થાદિ સાતમા ગુણસ્થાન સુધી જોવામાં આવે છે.

આ રીતે કથ્યોપશમ સમ્યકૃત્વનું સ્વરૂપ કહ્યું.

તથા ત્રણે પ્રકૃતિઓના સર્વથા સર્વ નિષ્કરોના નાશ થવાથી અત્યંત નિર્મળ તત્ત્વાર્થશ્રદ્ધાન થાય, તેથી ક્ષાચિક સમ્યકૃત્વ છે. તેથી ચોથા થી સાતમાં ગુણસ્થાન સુધીમાં કચાંક કથ્યોપશમ સમ્યકૃત્વને આણી પ્રાપ્તિ થાય છે.

કેવી રીતે થાય છે? તે કહીએ છીએ - પ્રથમ ત્રણકરણ છારા ત્યાં મિદ્યાત્વના પરમાણુઓને મિશ્રમોહનીય તથા સમ્યકૃત્વમોહનીય રૂપ પરિણામિત કરે તથા નિર્જરા કરે - આ રીતે મિદ્યાત્વનો નાશ કરે તથા મિશ્રમોહનીયના પરમાણુને સમ્યકૃત્વમોહનીય રૂપ પરિણામિત કરી નિર્જરા કરે - આ પ્રકારે મિશ્રમોહનીયનો નાશ કરે. તથા સમ્યકૃત્વ મોહનીયના નિષેક ઉદ્યમાં આવીને ખરે, તેની વધારે સ્થિતિ આદિ હોય તો તેને સ્થિતિ-કાંડકાદિ છારા ઘટાવે. જ્યાં અંતર્મુહૂર્ત સ્થિતિ બાકી રહે ત્યારે હૃતકૃત્યવેદક સમ્યકૃત્વની થાય. તથા અનુક્રમથી આ નિષેકોનો નાશ કરીને ક્ષાચિક સમ્યકૃત્વની થાય છે.

તેથી આ, પ્રતિપક્ષી કર્મના અભાવથી નિર્મળ છે તથા મિદ્યાત્વરૂપ રંજનાના અભાવથી વીતરાગ છે, તેનો નાશ નથી થતો. જ્યારથી ઉત્પન્ન થાય ત્યારથી સિદ્ધ અવસ્થા સુધી આનો સદ્ભાવ છે. આ પ્રકારે ક્ષાચિકસમ્યકૃત્વનું સ્વરૂપ કહ્યું.

૩) નવમાં ક્ષપક અનિવૃત્તિકરણ ગુણસ્થાનમાં અપ્રત્યાખ્યાનાવરણ કોદા, માન, માચા, લોલ અને પ્રત્યાખ્યાનાવરણ કોદા, માન, માચા, લોલ આ આઠ કર્મપ્રકૃતિઓનું સ્તિબુક સંક્રમણ થઈને પરમુખથી અભાવ થઈ જાય છે. અર્થાત્ આ આઠ ધાતિરૂપ પ્રાપ પ્રકૃતિઓના ક્રાંત્યોની ક્ષપણા કાળમાં સમય-સમય પ્રતિ એક-એક ઝાલિકા સંજવલન કોદા, માન, માચા, લોલ તથા પુરુષવેદરૂપ કર્મમાં સંક્રમણ થઈ - થઈને બંને કષાય ચોકડીઓનો કથ થઈ જાય છે.

૪) ત્યારબાદ આ ક્ષપક અનિવૃત્તિકરણ ગુણસ્થાનમાં જ દર્શનાવરણ કર્મના નિંબાનિંબા, પ્રચલાપ્રચલા, સ્ત્ર્યાનગૃહિય આ ત્રણ કર્મોનો કથ થઈ જાય છે.

૫) પછી નવમા ગુણસ્થાનમાં જ સ્ત્રીવેદ અને નપુંસકવેદ કર્મનું ક્રિય પુરુષવેદ કર્મમાં સંક્રમિત થઈ જાય છે. ત્યારબાદ પુરુષવેદ તથા હાસ્યાઈ છ (હાસ્ય, રતિ, અરતિ, શોક, ભય, જુગુપ્સા) આ સાતે કર્મોનું સંક્રમણ સંજવલન કોઇ કષાય કર્મોમાં થાય છે. આ રીતે નવ નોકષાયોનો ક્ષય થઈ જાય છે.

હવે ચારિત્રમોહનીય કર્મોમાંથી માત્ર સંજવલન કોઇ, માન, માચા અને લોલ કષાયોની જ સત્તા બાકી રહી છે. તેમના ક્ષયનો ક્રમ આ પ્રમાણે છે :-

૬) નવમા ગુણસ્થાનમાં જ સંજવલન કોઇ કષાય કર્મનું સંક્રમણ સંજવલન માન કષાયમાં થાય છે. ત્યારબાદ સંજવલન માન કષાયનું સંક્રમણ સંજવલન માચા કષાયમાં થઈ જાય છે અને અંતમાં સંજવલન માચા કષાયનું સંક્રમણ લોલ કષાયમાં થઈ જવાથી સંજવલન કોઇ, માન અને માચા આ ત્રણ કષાયોનું સંક્રમણ થઈ-થઈને ક્ષય થઈ જાય છે. સંજવલન લોલ કષાય કર્મનું સંક્રમણ થતું નથી. સંક્રમિત થવા માટે ત્યાં (નવમા ગુણસ્થાનના ઉપાન્ત્ય સમયમાં) અન્ય ચારિત્રમોહનીય કર્મની સત્તા પણ શેખ રહી નથી. ચારિત્રમોહનીય કર્મનું સંક્રમણ અન્ય સાત કર્મોમાં પણ થતું નથી. તેથી સંજવલન લોલ કષાય કર્મનો ક્ષય સ્વમુખથી જ થાય છે.

પૂર્વોક્ત રીતે નવમા ક્ષપક અનિવૃત્તિકરણ ગુણસ્થાનમાં જ ચારિત્રમોહનીય કર્મની ૨૦ પ્રકૃતિઓનો ક્ષય થઈ જાય છે.

૭) દસમા ગુણસ્થાનના પ્રથમ સમયથી જ માત્ર સંજવલન લોલ કષાય કર્મ સૂક્ષ્મ લોલદ્રષ્ટિ ઉદ્યમાં આવી રહ્યો છે. બાદર લોલ કષાય કર્મનું સૂક્ષ્મકૃષ્ણિકરણનું કાર્ય નવમા ગુણસ્થાનમાં જ સંપર્ણ થઈ ગયું હતું. દસમા ગુણસ્થાનના અંતિમ સમયમાં સૂક્ષ્મ લોલ કષાયનો પણ ક્ષય થઈ જાય છે.

૮) હવે બારમા ગુણસ્થાનના પ્રથમ સમયથી જ મોહકર્મ તથા મોહ પરિણામોના સર્વથા અભાવથી મુનિરાજ પૂર્ણ વીતરાગી થઈ ગયા છે. હવે મોહનીય કર્મ વગર માત્ર ત્રણ ઘાતિ કર્મોની સત્તા બાકી છે. દર્શનાવરણના નવ કર્મોમાંથી છ કર્મ જ બાકી છે. તેમાંથી નિંદ્રા અને પ્રચલા આ બે કર્મનું બારમા ક્ષીણમોહ ગુણસ્થાનના ઉપાન્ત્ય સમયમાં


કથ્ય થઈ જાય છે.

૬) ક્ષીણકાંશ ગુણસ્થાનના અંતિમ સમયમાં જ્ઞાનાવરણ કર્મની મતિજ્ઞાનાવરણાદિ પ પ્રકૃતિઓ, દર્શનાવરણ કર્મની ચક્ષુદર્શનાવરણાદિ રૂપ્ય પ્રકૃતિઓ અને અંતરાયકર્મની પ પ્રકૃતિઓ - કુલ મળીને ૧૪ કર્મપ્રકૃતિઓનો ક્ષય થઈ જાય છે.

આ રીતે ઘાતિકર્માની ક્ષપણા/ક્ષયનું વિવરણ પુરુષ થયું.

## પરિશિષ્ટ - ૫.

### ઔપશામિક સમ્યકૃત્વ



આ મોટી રેખા મિથ્યાત્વ કર્મની છે. વચ્ચમાં પોલી અર્થાતું ખાલીજગ્યા મિથ્યાત્વ કર્મના ઉદ્દ્યથી રહિત દેખાડવામાં આવી છે. આ સ્થાનમાં પહેલા પણ મિથ્યાત્વ કર્મની સત્તા હતી. જ્યારથી સમ્યકૃત્વસન્મુખ મિથ્યાક્રષિ કરણાલબ્ધ્ય પ્રાપ્ત જીવ અધઃકરણ, અપૂર્વકરણ પરિણામોથી આવશ્યક કાર્ય કરે છે. પછી અનિવૃત્તિકરણ પરિણામનો થોડો સમય વીત્યા પછી મિથ્યાત્વકર્મના કાંઈક નિષેદ્ધ પ્રતિસમય દીર્ઘકાળ પછી ઉદ્ય આવવા યોગ્ય મિથ્યાત્વની ઉપરિતન સ્થિતિમાં જતા રહે છે અને કાંઈક નિષેદ્ધ અધસ્તન સ્થિતિમાં જઈને ભળી જાય છે. આ ક્રમ અનિવૃત્તિકરણના અંતિમ સમય સુધી ચાલતો રહે છે. આટલી અવધિમાં/ અંતર્મૂહૂર્તકાળમાં મિથ્યાત્વકર્મનો ઉદ્ય આવતો રહેવાથી અધસ્તન સ્થિતિના મિથ્યાત્વ કર્મ, ઉદ્યમાં આવી મળી/ભળી જાય છે અને જીવ મિથ્યાત્વ કર્મથી રહિત સ્થાનમાં પહોંચે છે. તથા ત્યાં મિથ્યાત્વ કર્મનો ઉદ્ય નહીં હોવાથી તથા શ્રદ્ધાગુણની સમ્યકૃત્વરૂપ પર્યાય પ્રગટ થવાને લીધે ક્ષાચિક સમ્યકૃત્વ જેવું યથાયોગ્ય એક અંતર્મૂહૂર્તકાળ સુધી ઔપશામિક સમ્યકૃત્વને પ્રાપ્ત કરે છે.

◆ સાચિ મિથ્યાફ્રાણિ હોય તો અનંતાનુંબંધીના જ તથા દર્શનમોહનીયના ૩ કર્મ કુલ મળીને ૭ કર્મોનો ઉપશમ કરે છે.

◆ અનાચિ મિથ્યાફ્રાણિ હોય તો અનંતાનુંબંધીના જ અને મિથ્યાત્વ નો ૧ - કુલ ૫ કર્મોનો ઉપશમ કરે છે. કદાચિત્ સાચિ મિથ્યાફ્રાણિ પણ ૫,૬ કે ૭નો ઉપશમ કરે છે. ◆ ઔપશમિક સમ્યકૃત્વના ઉત્પત્તિના પ્રથમ સમયમાં જ મિથ્યાત્વકર્મના ૧) મિથ્યાત્વ ૨) સમ્યક્મિથ્યાત્વ ૩) સમ્યક્ષ્રમાંસ - એવા ૩ ટુકડા થઈ જાય છે. ◆ ઔપશમિક સમ્યકૃત્વની પ્રથમ ઉત્પત્તિ ચોથા, પાંચમા અથવા સાતમા ગુણસ્થાનમાંથી કોઈપણ એક ગુણસ્થાનમાં થાય છે.


પ્રથમોપશમ સમ્યકૃત્વના સંબંધમાં મોક્ષમાર્ગપ્રકાશક શાસ્ત્ર પાના રક્ખણું આ કથન પણ અત્યંત મહત્વપૂર્ણ છે -

“આ રીતે અપૂર્વકરણ થયા બાદ અનિવૃત્તિકરણ થાય છે. તેનો કાળ અપૂર્વકરણનો પણ સંખ્યાતમો ભાગ છે. તેમાં પૂર્વોક્ત આવશ્યક સહિત કેટલોય કાળ વીત્યાબાદ અંતરકરણ કરે છે, જે અનિવૃત્તિકરણના કાળ પછી ઉદ્યમમાં આવવા યોગ્ય એવા મિથ્યાત્વકર્મના મુહૂર્તમાત્ર નિષેદ્ધ તેનો અભાવ કરે છે, તે પરમાણુઓને અન્ય સ્થિતિરૂપ પરિણામિત કરે છે. તથા અંતરકરણ કર્યા બાદ ઉપશમકરણ કરે છે. અંતરકરણ ક્ષારા અભાવરૂપ કરેલ નિષેકોના ઉપરવાળા જે મિથ્યાત્વના નિષેક છે તેને ઉદ્ય આવવા અયોગ્ય બનાવે છે. ઈત્યાદિક કિયા ક્ષારા અનિવૃત્તિકરણના અંતસમયના અનંતર જે નિષેકોનો અભાવ કર્યો હતો, તેનો કાળ આવે, ત્યારે નિષેકો વિના ઉદ્ય શેનો આવશે ? માટે મિથ્યાત્વનો ઉદ્ય ન થવાથી પ્રથમોપશમ સમ્યકૃત્વની પ્રાપ્તિ થાય છે. અનાચિ મિથ્યાફ્રાણિના સમ્યકૃત્વ મોહનીય અને મિશ્ર મોહનીયની સત્તા નથી, માટે તે એક મિથ્યાત્વકર્મનો જ ઉપશમ કરીને ઉપશમ સમ્યક્ષ્રમાંસ થાય છે તથા કોઈ જીવ સમ્યકૃત્વ પામી ફરી બષ્ટ થાય છે.”

“કોઈ જીવ સમ્યકૃત્વ પામી ફરી બષ્ટ થાય છે.” - આ ઉપરોક્ત વાક્યાંશથી પ્રથમ ઔપશમિક સમ્યકૃત્વને પ્રાપ્ત કરવાવાળો જીવ નિયમથી મિથ્યાત્વમાં જાય એવો નિયમ નથી, આ વિષય સ્પષ્ટ થાય છે.

## પરિશિષ્ટ - ૬

### ઔપશામિક ચારિત્ર



ઉપર બતાવવામાં આવેલ મોટી રેખા ચારિત્રમોહનીયના ર૧ કર્મો(પ્રફૃતિઓ)ની છે. વરચ્યમાંની ખાલી જગ્યા ચારિત્રમોહનીયની ર૧ કર્મોથી રહિત દેખાડી છે. આ સ્થાનમાં પણ પહેલા ચારિત્રમોહનીયની ર૧ કર્મપ્રફૃતિઓ હતી. જ્યારથી છ્ળીતીયોપશામી કે ક્ષાયિકસમ્યકૃત્વી મુનિરાજે ઉપશમક અનિવૃત્તિકરણ ગુણસ્થાનમાં પ્રવેશ કર્યો, ત્યારથી અર્થર્ત અનિવૃત્તિના પહેલા સમયથી ચારિત્રમોહનીય ર૧ કર્મોના કાંઈક નિષેક પ્રતિસમય દીર્ଘકાળ(લાંબા સમય) પછી ઉદ્યમાં આવવા યોગ્ય ઉપરિતન સ્થિતિમાં (સત્તામાં પડેલા કર્મોમાં) જતા રહે છે. કાંઈક નિષેક અધસ્તન સ્થિતિના કર્મોમાં જઈને ભળી જાય છે.

આ કમ નવમા ગુણસ્થાનના અંતિમ સમય સુધી ચાલતો રહે છે. આટલી અવધિમાં(અંતર્મૂહૂર્ત કાળમાં) ચારિત્રમોહનીયનો ઉદ્ય આવતા-આવતા અધસ્તન સ્થિતિના કર્મ ઉદ્યમાં આવી ખરી જાય છે અને મુનિરાજ ચારિત્રમોહનીય કર્મોથી રહિત સ્થાનમાં પહોંચે છે. અને મુનિરાજેને અગ્યારમું ઉપશામિક ગુણસ્થાન પ્રાપ્ત થાય છે.

ચારિત્રમોહનીય કર્મના ર૧ બેદ - અપ્રત્યાખ્યાનાવરણ કોધાઈ ૪, પ્રત્યાખ્યાનાવરણ કોધાઈ ૪, સંજ્યલન કોધાઈ ૪ અને હાસ્યાઈ નવ નોકધાય = ૪+૪+૪+૬ = ૨૧.

## ગુણસ્થાનોથી ગમન

મિથ્યા મારગ ચારિ, તીનિ ચાઉ પાંચ સાત લનિ,  
દુટીય એક મિથ્યાત્વ, તૃતીય ચૌથા પહેલા ગનિ ॥૧॥  
અપ્રત મારગ પાંચ, તીનિ દો એક સાત પન,  
પંચમ પંચ સુસાત, ચાર તિય દોય એક ભન ॥૨॥  
ઇકે ષટ ઈક પંચમ અધિક, સાત આઠ નવ દસ સુનો ,  
તિય અધ ઉરદ્ય ચૌથે મરન, જ્યારાહ બાર બિન દો મુનો ॥૩॥

- પંડિત ઘાનતરાયજી, ચર્ચા શતક, છંદ -૪૪

આ છંદનો ગુજરાતીમાં ભાવાર્થ આ પ્રકારે છે-

- ૧ પહેલા ગુણસ્થાનથી ઉપર ગમનના ચાર માર્ગ છે - ત્રીજા, ચૌથા, પાંચમાંને સાતમા ગુણસ્થાનમાં.
- ૨ સાસાદન ગુણસ્થાનથી નીચેની તરફ ગમનનો એક જ માર્ગ છે - પહેલા ગુણસ્થાનમાં.
- ૩ ત્રીજા મિશ્ર ગુણસ્થાનમાં ગમન માટે કુલ બે માર્ગ છે - ઉપરની તરફ ચોથામાં તથા નીચેની તરફ પહેલા ગુણસ્થાનમાં.
- ૪ ચોથા ગુણસ્થાનથી ગમનના પાંચ માર્ગ છે - ઉપરની તરફ પાંચમાં અને સાતમામાં અને નીચેની તરફ ત્રીજા, બીજા અને પહેલા ગુણસ્થાનમાં.
- ૫ પાંચમા ગુણસ્થાનથી પણ પાંચ માર્ગ છે - ઉપરની તરફ સાતમામાં તથા નીચેની તરફ ચોથા, ત્રીજા, બીજા અને પહેલા ગુણસ્થાનમાં.
- ૬ ઇક્ષા ગુણસ્થાનથી છ માર્ગ છે. - ઉપરની તરફ સાતમામાં તથા નીચેની તરફ પાંચમા, ચોથા, ત્રીજા, બીજા અને પહેલા ગુણસ્થાનમાં.
- ૭ ઉપશમ શ્રેણીની સનમુખ સાતમા ગુણસ્થાનથી ત્રણ માર્ગ છે - ઉપરની તરફ આઠમામાં, પડતા સમય નીચેની તરફ ઇક્ષામાં અને મૃત્યુ થાય તો વિશ્વ ગતિમાં ચોથા ગુણસ્થાનમાં.
- ૮ ઉપશમ શ્રેણીવાળા આઠમા ગુણસ્થાનથી ત્રણ માર્ગ છે - ઉપરની તરફ નવમામાં તથા નીચેની તરફ સાતમામાં અને મરણ અપેક્ષાએ ચોથા ગુણસ્થાનમાં.
- ૯ ઉપશમ શ્રેણીવાળા નવમા ગુણસ્થાન થી ત્રણ માર્ગ છે - ઉપરની તરફ દસમામાં તથા નીચેની તરફ આઠમામાં અને મરણ અપેક્ષાએ ચોથા ગુણસ્થાનમાં.
- ૧૦ ઉપશમ શ્રેણીવાળા દસમા ગુણસ્થાનથી ત્રણ માર્ગ છે - ઉપરની તરફ અગ્યારમાં તથા નીચેની તરફ નવમામાં અને મરણ અપેક્ષાએ ચોથા ગુણસ્થાનમાં.
- ૧૧ અગ્યારમાંથી બે માર્ગ જ છે - નીચેની તરફ દસમું અને મરણ અપેક્ષાએ ચોથા ગુણસ્થાનમાં.

### કરણાનુયોગના વ્યાખ્યાનનું વિદ્યાન

તથા ક્યાંચ જેની વ્યક્તતા કાંઈ ભાસિત નથી થતી, છતાંચ સૂક્ષ્મશક્તિના સદ્ભાવથી તેનું ત્યાં અસ્તિત્વ કહ્યું છે. જેમ - મુનિને અબ્રહા કાર્ય કાંઈ નથી, છતાંચ નવમાં ગુણસ્થાન સુધી મૈથુનસંજ્ઞા કહી છે. અહમિન્દ્રોના દુઃખનું કારણ વ્યક્ત નથી, છતાંચ કદાચિત્ અસાતા નો ઉદ્ય કહ્યો છે. આ પ્રકારે અન્યત્ર જાણવું.

તથા કરણાનુયોગ સમ્યક્ષર્ણન - જ્ઞાન-ચારિત્રાદિક ધર્મનું નિરૂપણ કર્મ પ્રકૃતિઓના ઉપશમાદિકની અપેક્ષા સહિત સૂક્ષ્મશક્તિ જેવીરીતે જોવા મળે છે, તેમ ગુણસ્થાનાદિમાં નિરૂપણ કરે છે તથા સમ્યક્ષર્ણનાદિના વિષયલૂટ જીવાદિઓનું પણ નિરૂપણ સૂક્ષ્મભેદાદિ સહિત કરે છે.

અહીં કોઈ કરણાનુયોગ અનુસાર તમે ઉધમ કરો તો થઈ નથી શકતો, કરણાનુયોગમાં તો યથાર્થ પદાર્થ બતાવવાનું મુખ્ય પ્રયોજન છે, આચરણ કરાવવાની મુખ્યતા નથી.

માટે આ તો ચરણાનુયોગાદિક અનુસાર પ્રવર્તન કરો, તેથી જે કાર્ય થવાનું છે તે સ્વયંમેવ જ થાય છે. જેમ - તમે કર્મોના ઉપશમાદિ કરવા ઈચ્છો તો કેમ થાય ? આપ તો તત્ત્વાદિકનો નિશ્ચય કરવાનો ઉધમ કરો, તેનાથી જ ઉપશમાદિ સમ્યક્ષર્ત્વ થાય છે. આ પ્રકારે અન્યત્ર જાણવું.

એક અંતર્મુહૂર્તમાં અગ્યારમાં ગુણસ્થાનથી પડીને ક્રમશः મિથ્યાફ્રાષ્ટિ થાય છે અને ચઢીને ડેવળજ્ઞાન ઉત્પન્ન કરે છે, તો એવા સમ્યક્ષત્વાદિના સૂક્ષ્મભાવ બુદ્ધિગોચર નથી થતાં. માટે કરણાનુયોગ અનુસાર જેમ છે તેમ જાણી તો લે, પરંતુ પ્રવૃત્તિ બુદ્ધિગોચર જેનાથી ભલું થાય તેવી કરે.

તથા કરણાનુયોગમાં પણ ક્યાંક ઉપદેશની મુખ્યતા સહિત વ્યાખ્યાન હોય છે, તેને સર્વથા તે પ્રકારે નહીં માનવું. જેમ - હિંસાદિકના ઉપાયને કુમતિજ્ઞાન કહ્યું છે, અન્ય મતાદિકના શાસ્ત્રાભ્યાસને કુશ્રુતજ્ઞાન કહ્યું છે, ખરાબ જુએ, સારું ન જુએ, તેને વિભંગજ્ઞાન કહ્યું છે, તે તો તેને છોડવા અર્થે ઉપદેશ છ્ણારા એમ કહ્યું છે. તારતમયથી મિથ્યાફ્રાષ્ટિનું બધું જ્ઞાન કુજ્ઞાન છે, સમ્યક્ષફ્રાષ્ટિનું બધું જ્ઞાન સુજ્ઞાન છે. આ પ્રકારે અન્યત્ર જાણવું.